

**● અનુક્રમણિકા ●**

ક્રમ	વર્ષ	અંક	વિષય	પે.નં.
૧.	૩	૪	દર્શનની ખડુવિધ કલા - સત્ત્વિક દર્શન	૧
૨.	૩	૫	દર્શનની ખડુવિધ કલા - અનુકૂળતા દર્શન	૧૪
૩.	૩	૬	દર્શનની ખડુવિધ કલા - સ્વદોષ દર્શન	૨૭
<b>● શ્રી અરિહંત પરમાત્માની ઓળખાણ ●</b>				
૪.	૪	૫	શ્રી અરિહંત પરમાત્માની ઓળખાણ	૪૨
૫.	૪	૭	શ્રી અરિહંત પરમાત્માની પરમાત્માનું સ્વરૂપ	૪૮
૬.	૪	૧૧	શ્રી અરિહંત પરમાત્માની લોકોત્તમાદિ	૫૬
૭.	૪	૧૮	શ્રી અરિહંત પરમાત્માની નિષેધ મુખે સ્વરૂપ	૫૭
૮.	૪	૧૯	શ્રી અરિહંત પરમાત્માની ગીતાનો પ્રસંગ	૬૩
૯.	૪	૨૦	શ્રી અરિહંત પરમાત્માની તીર્થકર પરમાત્માનું જીવન	૬૫
૧૦.	૪	૨૧	શ્રી અરિહંત પરમાત્માની શ્રમણ અવસ્થા	૭૨
૧૧.	૪	૨૩	શ્રી અરિહંત પરમાત્માની પરમાત્માના ગુણો	૭૮
૧૨.	૪	૨૪	શ્રી અરિહંત પરમાત્માની સાચી મોટાઈ કઈ ?	૮૧
૧૩.	૪	૨૫	શ્રી અરિહંત પરમાત્માની પરમાત્માનો ઉપકાર	૮૮
૧૪.	૪	૨૭	શ્રી અરિહંત પરમાત્માની પ્રભુએ શું શું આપ્યું ?	૧૦૨
૧૫.	૪	૨૮	શ્રી અરિહંત પરમાત્માની પંચકારણવાદ	૧૦૭
૧૬.	૪	૨૯	શ્રી અરિહંત પરમાત્માની આત્મઉક્ખંતિકમ	૧૧૩
૧૭.	૪	૩૦	શ્રી અરિહંત પરમાત્માની વિરતિવાદ	૧૧૪
૧૮.	૪	૩૧	શ્રી અરિહંત પરમાત્માની સપ્તનય	૧૧૮
૧૯.	૪	૩૨	શ્રી અરિહંત પરમાત્માની પંચપરમેષ્ઠી અરિહંત સિદ્ધ	૧૨૩
૨૦.	૪	૩૪	શ્રી અરિહંત પરમાત્માની પંચપરમેષ્ઠી આચાર્યાર્થિ	૧૨૫
૨૧.	૪	૩૫	શ્રી અરિહંત પરમાત્માની વિશિષ્ટ સમ્યગ્દર્શન યોગ	૧૨૭
૨૨.	૪	૩૬	શ્રી અરિહંત પરમાત્માની શુદ્ધિયોગ	૧૩૩
૨૩.	૪	૩૭	શ્રી અરિહંત પરમાત્માની સ્ફળ ધ્યાનમાર્ગ	૧૩૭
૨૪.	૪	૩૮	શ્રી અરિહંત પરમાત્માની ભક્તિયોગ	૧૩૮
<b>● જૈન શાસનમાં ભાગવતી દીક્ષાનું સ્થાન ●</b>				
૨૫.	૪	૮	જૈન શાસનમાં ભાગવતી દીક્ષાનું સ્થાન	૧૪૨
૨૬.	૪	૧૦	બાળ સંન્યાસ દીક્ષા પ્રતિબંધ વિ.વિરોધ સમિતિ	૧૫૬
૨૭.	૪	૧૧	વિધાનસભામાં ‘બાલ-સંન્યાસ પ્રતિબંધક બીલ’ રજૂ કરતાં શ્રી પટવારીએ કરેલા આકેપોનો પ્રતિકાર	૧૬૩

(G)

ક્રમ	વર્ષ	અંક	વિષય	પે.ન.
૨૮.	૪	૧૧	સ્થાનકવાસી કોન્ફરન્સના મંત્રી શ્રી ખીમયંદ મગનલાલ વોરાનું નિવેદન	૧૭૪
૨૯.	૪	૧૨	સંન્યાસ દીક્ષા જેવી પવિત્ર ધાર્મિક બાબતમાં હસ્તક્ષેપ કરતો શ્રી પટવારીનો કાયદા ખરડો	૧૭૬
૩૦.	૪	૧૩	દીક્ષાનો પ્રેશન સામાજિક નહિ કિન્તુ શુદ્ધ ધાર્મિક જ છે.	૧૮૮
૩૧.	૪	૧૨	અમદાવાદમાં ભરાયેલી જૈનોની જાહેર સભાએ પસાર કરેલ ઠરાવ	૧૯૨
૩૨.	૪	૧૪	બાળ સં.દીક્ષા પ્ર. બીલના ટેકેદારોનો પોકળ પ્રચાર	૨૦૦
૩૩.	૪	૧૫	પ્રધાનમંત્રી શ્રી મોરારજીભાઈ દેસાઈએ કરેલું ઐતિહાસિક ભાષ્ણા	૨૦૩
૩૪.	૪	૧૬	બાળ સંન્યાસ દીક્ષા પ્રતિબંધક બીલ એટલે ત્યાગના આદર્શ અને ધર્મનો મૃત્યુંંટ !	૨૨૦
૩૫.	૪	૧૭	છૃંગાસ સ્ત્રીસંસ્થાઓના આશ્ર્યે મળેલી બહેનોની જાહેર સભા	૨૨૭
<b>● સંસ્કૃતિના સંરક્ષણ ●</b>				
૩૬.	૫	૧૬	સંસ્કૃતિના સંરક્ષણ ભાગ-૧	૨૩૦
૩૭.	૫	૨૦	સંસ્કૃતિના સંરક્ષણ	૨૪૩
૩૮.	૫	૨૧	સંસ્કૃતિના સંરક્ષણ ભાગ-૨	૨૪૪
૩૯.	૫	૨૨	સંસ્કૃતિના સંરક્ષણ ભાગ-૨ - અંગારક દેષાંત	૨૪૭
<b>● ગૃહસ્થધર્મ કેમ દીપે ? ●</b>				
૪૦.	૭	૩૦	ગૃહસ્થધર્મ કેમ દીપે ?	૨૬૧
૪૧.	૭	૩૧	ગૃહસ્થધર્મ કેમ દીપે ? - ૮૮ પુત્રોને ભવ્ય ઉપદેશ	૨૭૧
૪૨.	૭	૩૨	ગૃહસ્થધર્મ કેમ દીપે ? - ૮૮ પુત્રોને ભવ્ય ઉપદેશ	૨૮૨
<b>● ચંડકોશિયાનું દેષાંત ●</b>				
૪૩.	૭	૩૩	ચંડકોશિયાનું દેષાંત	૨૮૫
૪૪.	૭	૩૪	ચંડકોશિયાનું દેષાંત	૩૦૧
<b>● અંગાર્ષ અને રૂદ્રકનું કથાનક ●</b>				
૪૫.	૩	૭	અંગાર્ષ અને રૂદ્રકનું કથાનક	૩૦૮
૪૬.	૩	૧૧	અંગાર્ષ અને રૂદ્રકનું કથાનક	૩૧૧

(H)

## દર્શનની પડવિધ કલા

દર્શન એટલે શું ? દર્શનની કિયા કરી જાણો :- જગતના મહાન તત્ત્વજ્ઞાનીઓ ગ્રાણી માત્રમાં માનવ અવતારને વિશેષ કિંમતવાળો કેમ ગણે છે ? કહો, એટલા માટે કે માનવ જીવનમાં દર્શન કરવાની સુંદર કલા આત્મામાં કેળવી શકાય છે; અને દર્શનની કલા જો આવરી તો પછી અનંત સુખમય મુક્તિની મહાન સિદ્ધિની વાત જીવને માટે કાંઈ કઠીન નથી; તેમજ વર્તમાન જીવનમાં પણ દર્શનની કલાનો દિવ્ય પ્રભાવ અનુભવી શકાય છે. આજે દર્શનની કલાનો વિચાર કરવાનો છે. ત્યારે પહેલાં જાણવું જોઈએ કે દર્શન એટલે શું ? દર્શનનો સામાન્ય અર્થ “જોવું” એવો થાય, પણ અહીં વસ્તુને કેવા રૂપે જોઈએ છીએ તે વિચારવાનું છે. એમાંય કળાયુક્ત દર્શન એનું નામ કે જે જોવાનું બીજા જીવોના કરતાં વિશેષતાવાળું હોય. એમ તો જગતમાં ધ્યાય જીવો જોવાની કિયા કરે છે. એકેન્દ્રિયથી માંદીને ત્રીન્દ્રિય સુધીના જીવોને જોવાની શક્તિ યક્ષુ દ્વારા નથી, પણ બીજી ઈન્દ્રિયો દ્વારા પારખવાની શક્તિ છે. તો તેનું પણ પારખવાનું કાર્ય ચાલુ છે. એથી આગળ ચતુરિન્દ્રિય અને પંચન્દ્રિય જીવોને ચક્ષુ પણ મળે છે. તો ચક્ષુ દ્વારા જોવાનું કાર્ય ચાલુ છે. આવી ઈન્દ્રિયથી સામાન્ય દર્શન કરવાની શક્તિ ધરાવનારા જીવો અસંખ્ય છે. પણ એવી રીતે વસ્તુને કે પ્રસંગને જોવો, એમાં કોઈ આત્મિક જ્યોતિ, સ્ફૂર્તિ કે સદ્ગુરીયોની લાભ નથી. આપણે જોવાની એવી કિયા કરવી છે કે જેમાંથી આત્મિક લાભનો રોકડો નફો મળે. આવું જોયું તે જોઈ જાણું ગણાય ! માણસને ખાવા બેસાડ્યો, પણ એણે એવું ખાંદું કે ઉઠવા બરાબર ઊલટી કરી, તો એ કદાચ ખાંદું કહેવાય, પણ ખાઈ જાણું ન કહેવાય. મોટા સારા શુકન જોયા ને પછી બજારમાં ગયો. પણ વેપારમાં સોઢા એવા કર્યા કે ત્યાં કમાવવાની વાત તો દૂર, પરંતુ ઉપરથી ગાડોના ગુમાયા. તો એણે સોઢો કર્યો તો કહેવાય, પણ કરી જાણ્યો નહિ કહેવાય. આવી અનેકાનેક કિયાઓ છે કે જે કરી માત્રથી કરી ન કહેવાય, પણ એનું શુભ સુંદર ફલ આવે તો કહેવાય કે કરી જાણી.

અણાધ વસ્તુદર્શન અને માનસિક કલ્પનાના યોગેજ દુઃખનો વધારો :- જાવું

છે દિલ્હી, ને ચાલ્યો પદર માઈલ દક્ષિણ તરફ ! તો દિલ્હી ઊલટું દૂર પડી ગયું. ત્યારે જુઓ કે જીવ અનંતકાળથી દર્શન કરતો કરતો આવ્યો; પણ પૂછો કે દર્શનના ફળ રૂપે આત્મજ્ઞાન વધ્યું ? આત્મબળ વધ્યું ? આત્મ-સમૃદ્ધિ નિકટ થઈ ? વધુ પ્રગટ થઈ ? દર્શન કરતાં જ દિવ્ય સુખાનુભવ થાય છે ? દર્શન અવું કરવું છે, તો જ એ કરી જાણ્યું કહેવાય. જગતના જીવો કરતાં વિવેકી મનુષ્યની બલિહારી હોય તો આ છે કે જગતના જીવો દર્શન તો કરે છે. પણ એ ઊલટા દર્શનમાંથી આત્મ-સમૃદ્ધિની નિકટતા કરવાની, પ્રગટતા સાધવાની કે દિવ્ય સુખાનુભવ ચાખવાની વાત તો દૂર, પણ કહો કે વિવિધ ઊંધા દર્શનથી જ દુઃખ ચિંતાની હોળી સર્જે છે. આત્માને વધુ પરાધીન અને અપવિત્ર બનાવે છે. દર્શનની શક્તિ અને તારક બની કે મારક ? શ્રી સર્વજ્ઞ ભગવાને સમ્બ્રદ્ધદર્શન શિખવાડીને કલાયુક્ત દર્શનની જે શક્તિ આપી, તે નહિ પામેલા અભાગીયા જીવો આમ તો જડ કરતાં સામાન્ય દર્શન કરવાનો એક મહાન શક્તિ પામેલા છઠાં, ખોટા દર્શનના યોગે જ દુષ્ટ કર્મની ભારે પરતંત્રતા વહોરીને નિર્બણ બની હુન્યવી પદાર્થો, ઈન્દ્રિયો, મન, કાયા, વગેરે વગેરે અનેકાના ગુલામ બને છે. કહો ને, તેમજ આજે અનેક દુઃખો અણાધ-બિનઆવડતવાળા વસ્તુ-દર્શન અને માનસિક કલ્પનાના યોગે જ વધારી રહ્યા છો, એવું નથી લાગતું ? કોઈ પણ પદાર્થ કે પ્રસંગને સંકુચિત, વિપરીત કે મૂળ દસ્તિએ લેવાથી મહાકલેશ-મહાદુઃખ ખડાં થાય છે. પણ ધ્યાનમાં રાખણે કે વસ્તુ-દર્શન કરાવનાર જે ઈન્દ્રિયો અને મન મલ્યા છે, એ દ્વારા વસ્તુનું દર્શન કલાભર્યું યોગ્ય રીતે કરતાં ન આવડયું તો તે દર્શન મોંયું બની જવાનું ! અહીંય કલેશ અને ચિંતા, તથા દેષ અને દીનતા આપનારું બનવાનું ! પછી ત્યાં એ વખતે એમ મહાભયંકરતા સર્જનારું બનવાનું ! પછી ત્યાં એ વખતે એમ લાગે કે ‘અદર્શની બન્યા હોત તો સારું કે આટલી નુકશાનીમાં તો ન ઉત્તરત !’ આંખો સમજુ હોય તો એને થાય કે ‘અરે ! આંખો નથી, શું કરું ? આંખ હોત તો દેવગુરુના દર્શન અને જીવજ્ઞાન કરત !’ પણ આ તો દેખતો બનીને જ આંખથી એવા દુરાચાર બેલ્યા, એવા રાગ-દ્રેષ્ટ-મોહ પોથ્યા, કે એથી નરકાદ્દિના દુઃખ સજ્યા !

દેખતો છતો ઊંધો ! તેથી ઊંધા દર્શને જ પાયમાલ :- સપાટ ભૂમિ હોય, પણ જુએ કે ખાડા છે, માટે ચાલ્યો બીજા માર્ગ; અને ખાડાવાળી ભૂમિને દેખે કે ‘આ સારી સપાટ ભૂમિ, ચાલો અહીં એમ કરી એ માર્ગ ચાલે. શું એ ? દેખતો છે છતાં ઊંધો ! પાછો જાતને દેખતો માને છે તેથી બીજાની સહાય લે નહિ; તેથી ખાડામાં પડે કે બીજું કાંઈ થાય ? દર્શન દ્વારા વસ્તુને જોઈ ખરી પણ જોઈ જાણી નહિ, વસ્તુનું દર્શન કર્યું ખરું પણ એવું મૂખાઈભર્યું ઊંધું દર્શન કર્યું કે જીવ એના

પરિણામે જ ઉન્માદથી રંગાઈ એવા અ-કાર્યોના ઉધમાતમાં ચઢ્યો, કે એના પરિણામે મનુષ્યપણાથી દેશવટો પામી નરક નિગોદની કેદમાં પૂરાયો. તંહુલીયો મચ્છ દુષ્ટ દર્શન ન કરત તો એના પર નરકમાં પરમાધામી વગેરેની કૂરતા વરસત ખરી ? પણ જોવાની આવડત મળી ને ? છે તો પાણીના પોરા જેવડો, પણ જોતાં આવડે છે. શું ? જેની આંખની પાંપણ પર પોતે રહ્યો છે, તે વિશાળ અખંડ જીવતા બહાર નીકળતા અનેક માછલાંને જોતાં આવડે છે ! “અરે ! આટલા બધા પેઠા, પણ આ મૂર્ખ એદી છે ! એણે ખાધાં નહિ ! એના સ્થાને હું હોઉં તો એક ન છોટું. બધાં ખાઈ જાઉં.” આ દર્શન કરતાં આવડે છે, એટલે ક્ષણે ક્ષણે નરકની કારભી પીડાઓ પોતાના આત્મા માટે રજુસ્ટર્ડ કરાવે છે ! એ દર્શન સઘણું મિથ્યાદર્શન છે. સ્વાત્મધાતક દર્શન છે.”

**સુદર્શન-કુદર્શનનું માપ શાના પર ? :-** જે દર્શનની પાછળ મહાન આબાદી મળે, આંતરશક્તિઓ ભરપૂર ખીલે, આત્મા પરની અનંતાનંત કર્મ બેડીઓ ફડોફડ તૂટવા માંડે તે દર્શનનું નામ સમ્યગુદર્શન. તેજ સુદર્શન, તારક દર્શન ! અનંતકાળથી જીવ રખડતો રખડતો પૃથ્વીકાય, અપકાય વગેરે કે નરક નિગોદના મહા નીચા સ્થાનેથી માનવભવ જેવા મહા ઊંચા સ્થાને આવેલાને પણ પાછી જૂની પુરાણી દુઃખમય સ્થિતિને ભેટાવનારું દર્શન મિથ્યાદર્શન છે. તે દર્શન શ્રાપદ્રુપ છે. જોવાની લાભ્ય છે, વિચારવાની શક્તિ છે, ઈન્દ્રિયોને વિષયો સાથે જોડવાની તાકાત છે. તો તે દ્વારા જે દર્શન થાય છે, તે દર્શન સુદર્શન કે કુદર્શન, તે માપ શાના પર નીકળે ? આત્માના ઓજસ, તેજ અને સત્ત્વ ખીલે છે કે નહિ ? આત્મિક શક્તિ, પુરુષાર્થ અને સ્વાધીનતા વધે છે કે નહિ ? દુર્ગુણનાં શોષણ અને પાપના ઘટાડા થાય છે કે નહિ તેના પર; ભવિષ્યના અનંતાનંત કાળનાં આશાસન વધે છે કે નહિ, તેના પર. સાચો આસ્તિક આત્મા એ બહુ જોશે. જુઓ વાલી રાજાના જીવનમાં આ સુદર્શન દેખાય છે; કેમકે એનામાં ઓજસ-તેજ-સત્ત્વ છે, દુર્ગુણના શોષણ અને પાપના કાપ છે.

**વાલી રાજાનું સુદર્શન :-** વાલી રાજાની સામે રાવણ લડાઈ કરવા ચઢી આવે છે. શું બગાડ્યું છે ભાઈ ! વાલીએ ? કાંઈ નહિ; પણ રાવણ આજ્ઞા મનાવવા માગે છે, અને એ ના કહે છે, એટલે લડાઈ ! કેવી રાવણની જારશાહી ? પણ બિચારાને આના પુષ્યની ક્યાં ખબર છે ? દોડતાં પહેલાં સ્વપરના પુષ્ય તપાસો. વાલીને લડવું તો નહોટું પણ રાવણને નમતુંય નથી જોખવું. તેથી રાવણ ગમે તેવા હજારો વિદ્યાર્થો રાજાઓનો સમ્રાટ રાજા છતાં, જ્યારે એ વાલીની સામે યુદ્ધભૂમિ પર ઉતરી આવે છે ત્યારે જરાય ગભરાયા વિના વાલી યુદ્ધ માટે સામે આવે છે.

બળવાન છે એ. આમ છતાં સુદર્શનવાળા એ દર્શન શું કરે છે તે જુઓ. યુદ્ધભૂમિ પર વિશાળ લશ્કર જોતાં એમ વિચારે છે કે “અહો ! આ લડાઈ આમાંના કેટલાય સેંકડો હજારો નિર્દોષ હાથી, ઘોડા અને મનુષ્યોનો સંહાર કરશે ! ત્યારે શું ફોગટ એના ઘોર પાપથી રંગવાનું આ જીવન ?” આમાં શું દર્શન કર્યું ? સામાનું લશ્કર ભયકારક છે એવું દર્શન નહિ, કે ‘ઓય ! આટલું મોટું લશ્કર ? એ શું કરશે મને ?’ આવું નહિ. તેમજ પોતાના લશ્કરમાં એ દર્શન નહિ કે ‘વાહ ! કેવું સામાનો કચ્ચરઘાણ કાઢે એવું આ મારું લશ્કર છે !’ અથવા ‘અરેરે કેવું મુદુદાલ મારું લશ્કર ! બીજાનો ખોડો કાઢી નાખવાને બદલે જાતે કપાઈ મરે એવું કેવું માલ વિનાનું મારું લશ્કર !’ ત્યારે એમ પણ નહિ કે ‘એમાં શું ? સંસારમાં બધું જ કરવું જોઈએ ને ?’ આ કુદર્શનો છે. આ તામસી દર્શનો છે. આવા દર્શન નહિ કરતાં બંને લશ્કરમાં એ જોયું કે ‘અહો ! આ બિચારા નિર્દોષ જીવો અમારા સ્વાર્થની અંધતામાં કપાઈ જશે ! એનો સંહાર ઘોર પાપ લાવનાર થશે ! માટે લાવ એને અટકાવું.’ શું જોયું આમાં ? ‘લશ્કર દ્યાપાત્ર છે. એનો સંહાર પાપજનક છે,’ એ જોયું.

તેથી રાવણને કહી દીધું કે ‘જો ઝગડો આપણે વ્યક્તિગત છે.’ અહીં ખૂબી એ કે પોતાને ઝગડો હતો નહિ. રાવણને સત્તાધીશતા આજ્ઞાકારિતા જોઈતી હતી. તેથી ઝગડવા આવ્યો હતો છતાં આ ઉદારતાથી કહે છે કે “ઝગડો આપણા બે વચ્ચે છે. તો ઝગડવાણા આપણે અસલ તો શ્રાવક છીએ. તો વિચાર કે આપણું આ લશ્કરે શું બગાડ્યું છે, તે આપણી સ્વાર્થધિતામાં એનો મરો થવો જોઈએ ? માટે એને બાજુએ રાખી માત્ર આપણે બંને જ સામસામા લડી લઈએ.” રાવણથી આમાં ના કેમ કહેવાય ? જો કે મનમાં તો કદાચ પહેલાં એમ આવ્યું હશે કે ‘મારી આજ્ઞામાં આ બધા વિદ્યાર્થ રાજાઓ છે, એની સામે વાલીનું શું ચાલવાનું હતું ?’ પોતાના સામંતોના લશ્કર સહિત પોતાના લશ્કરમાં મહાન વિજયકારિતા એ જોઈ રહ્યો છે. વિજયકારિતા એટલે ? શત્રુસંહાર-કારિતા જુએ છે એ. કેવું દર્શન આ ? તામસી કુદર્શન. લશ્કર એનું એ; પણ જોવાલોવામાં ફરક. વાલી એજ લશ્કરમાં દ્યાપાત્રના જુએ છે. સંહારથી પાપદાયિતા દેખે છે. હવે અહીં રાવણ એકલો લડવા કબૂલ થાય છે. અહીં પણ ખૂબી. રાવણ પોતાનામાં અખૂટ બળવતા દેખે છે. એટલે ગર્વિષ્ટતા દાખવે છે. વાલી પોતાનામાં શ્રાવકપણું જુએ છે; તેથી બંને ત્યાંસુધી પાપની ઓછાશ કરવાનું વિચારે છે ! સામાને પણ એ સલાહ આપે છે. બંનેની સામસામે લડાઈ થઈ પણ તેમાંય શરૂઆત વાલીની નહિ ! કેમ વારું ? હજુ રાવણને નિરપરાધી દેખે છે, તેથી નિરપરાધી ત્રસ જીવને શ્રાવકથી મરાય શી

રીતે ? કેવું સુદર્શન ! માટે પહેલો શસ્ત્રપ્રયોગ રાવણને કરવા હે છે. પોતે રાવણના આજ્ઞાધીન નહિ બનવાનો અને તેથી જ લડાઈ લડવાનો સ્વાર્થ ખરો, પણ અધિક પાપમાં ડૂબવાની વાત નહિ. સંસારી જીવનનું દર્શન આવું કરવાનું કે એમાં પાપની અલ્પતા કરવાની, પણ અધિકતા કરવાની નહિ. રાવણના શસ્ત્રપાત વાલી નિષ્ફળ કરે છે. તેથી રાવણને મોટા સામંત રાજાઓ અને લશ્કરની નજરમાં પોતાનું હલકું દેખાય છે, ને કોધ વધે છે. પોતાનું ચાલતું નથી એવા યુદ્ધમાંય સુદર્શન કરવાનું એને મોંધું છે. તેથી પાછો વળી જવાને બદલે એને વાલી પર વધુ નફરત છૂટે છે, તેથી જ ગુસ્સે ભરાઈ મહાશ્રી ચંદ્રહાસખ્રગ લઈ મારવા દોડે છે. વાલી નીડર અને બળવાન છે. તેથી જરાય ચસકયા-કંચ્ચા વિના પોતાના એક હાથે ખડુગવાળો હાથ અને બીજા હાથે આખું રાવણનું શરીર પકડી લઈ એને અધર ઉંચકી પોતાની બગલમાં પકડી લે છે. ત્યાં હવે રાવણથી ચસકય એવું નથી ! પછી એને એમજ ઉંચકી જંબુદ્ધીપને રેન મારી આવી પાછો યુદ્ધભૂમિ પર ખડો કરી દે છે ! કહે છે એને, “જો રાવણ જે તારા બળ અને ચંદ્રહાસાદિ શર્સ્ત્રની પુણ્યાઈ ઉપર વિશ્વાસ રાખી તેં ઘમંડ અને યુદ્ધ કર્યું. એણે જ તારી કેવી ઠગાઈ કરી ?” શું કર્યું આ ? રાવણને એના બળ-શર્સ્ત્રાદિમાં ઘમંડ અને યુદ્ધ, એણે જ તારી કેવી ઠગાઈ કરી ? શું કર્યું આ ? રાવણને એના બળ-શર્સ્ત્રાદિમાં ઘમંડકારિતા, અને યુદ્ધ-યોગ્યતાનું મિથ્યાદર્શન સમજાવી, વિશ્વાસની પોકળતા બતાવી, તેમજ સાચા દર્શન તરીકે એ સામગ્રી ઠગાઈકારિણી છે એવું દર્શન કરાવાયું.

**જીતેલા વાલીનું સુદર્શન :-** હવે અહીં મહાન સમ્યગ્દર્શન જુઓ, રાવણ તો શરમાઈ જ ગયો. સમજે છે કે બગલમાં દબાવીને વાલી પોતાને મારી શક્ત; પણ જીવતદાન આપું, એ વાલીની મહાન ઉદારતા છે, સજજનતા છે. તેથી હાથ જોડી રાવણ ક્ષમા માગે છે, અને ગુણગાન કરે છે. પરંતુ વાલી વિચારે છે કે “જગતના જે બળ અને સંપત્તિ, બંનેએ રાવણને ભૂલાવામાં નાખી દીધો. એ મને શું ન કરે ? તેમજ એવી ભાન ભૂલાવનારી સંપત્તિને વળગીને શું બેસી રહેવું, તું ? અને શું જીવન બરબાદ કરવું’તું ? ભગવાન જિનેશ્વર દેવની આજ્ઞા આરાધવામાં કાં ન લાગી જાઉં ?” એમ કરી રાવણની હારના પ્રસંગમાં પોતે સંસારની અસારતાના દર્શન કરી વિરાગમાં વધ્યા ! રાજ્યાટ નાના ભાઈને સૌંપી ચારિત્ર લેવા નીકળ્યા. કેવા મહાન સાત્ત્વિક નરવીર ! કેવા મહાન સુદર્શનકારી દ્રષ્ટા ! ધન્ય અવતાર એમનો ! દર્શનનો વિવેક એમનો ગજબ ! નાના ભાઈ સુગ્રીવને તો કહી દીધું કે તારે રાવણની આજ્ઞામાં રહેવાનું. કેમકે એ જોયું કે એ કાંઈ પોતાના જેવો સર્મથ નથી. તેથી એકલો રહી કોક હિ’ ફંદાઈ જાય અને જીવન કલેશમાં પડે, એના

કરતાં રાવણની આજ્ઞા નીચે રહે એમાં અનર્થ નહિ. બળ-સંપત્તિના માપ કાઢી એની બળાબળતાનું દર્શન કરતાં આવડવું જોઈએ; એય સુદર્શન. રાવણ એ ભૂલ્યો હતો. વાલીની અખૂટ બળ સામે પોતાનું ચંદ્રહાસખ્રગ બળ વિનાનું છે તેવું જોઈ ન શક્યો. જે પુણ્યાઈ વિશ્વાસ કરવા યોગ નથી, તેમાં રાવણે વિશ્વસનીયતા જોઈ, તો પસ્તાવાનો અવસર આવ્યો. ત્યારે વાલીએ પુણ્યાઈના એ ઉપયોગ તરફોડયા. માનવ જીવનમાં જિનાજ્ઞા-પાલન અને આત્મ-સંશોધનની કર્તૃતાના મહાન દર્શન કર્યા.

આપણી વાત શી ચાલતી હતી ? આત્માના ઓજસ, સત્ત્વ, તેજ, સ્વાધીનતા, દુર્ગુણશોષણ-પાપત્યાગના ભવ્ય પુરુષાર્થ વગરે ઉપરથી મપાય કે આપણાં દર્શન સુદર્શન છે. આના ઉપર ધર્માત્માએ ભવિષ્યના અનંત કાળનાં આશ્વાસન મેળવેલા હોય છે. તેથી હવે નિઃસત્ત્વ રોદણાં એને કરવાની જરૂર નથી. આ સુદર્શનમાં એને પરમાત્માની મહાન ઓથ મલી ગઈ છે.

પરમાત્મા એટલે તો અનંત આનંદ અને અનંત પ્રકાશના પુંજ. એનાં ચરણે દુઃખ અને અંધકાર શાનો ? પરમાત્મા એટલે આત્માના શુદ્ધ સ્વરૂપમાંજ રમણ કરનારા. એમની નિશ્ચામાં એ રમણતાના કોડ હોય ને ? પરમાત્મા એટલે એ કે જેમને જીવવા માટે બહારના માણણી-પોષણની જરૂર નથી. જેમને જન્મ નથી, દેહ નથી, રોગ નથી, ભૂખ નથી, જરા નથી; એનું નામ પરમાત્મા ! આવા પરમાત્માના ચરણનું શરણ એટલે પરમાત્માના એક અંશનું પણ શરણ લેનારનું દર્શન કેવું સુદર્શન હોય ? શરણું એવી રીતે લઈએ કે પરમાત્મા જ્યારે સ્વ સ્વરૂપમાં સંપૂર્ણ પણે રમણ કરનાર છે, તો હું આત્માના એ સ્વસ્વરૂપના અંશમાં તો રહ્યું. શું સ્વરૂપ છે ? સર્વથા વીતરાગતાનું ! અનંતજ્ઞાનનું ! શુદ્ધ દ્રષ્ટાપણાનું ! અક્ષય-સ્થિતિનું ! અવ્યાબાધ અસંયોગિક સુખનું ! આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવું ? આવું, અનાદિની સંજ્ઞાઓથી સર્વથા રહિત ! અનેક વિકારો, આતુરતાઓ અને કર્મની પરાતંત્રાઓથી વિનિરૂપકત !

એવા સ્વરૂપના અંશમાં રમણતા એટલે ?

કદાચ વીતરાગતા નહિ, પણ વૈરાગ્યમાં રમણતા. આહારાદિ સંજ્ઞાઓ સર્વાશે ત્યાગ યદિ નહિ, તો પણ તેના પર થોડો ઘણો કાપ કહો, છે ને અંશમાં રમણતા ? વિરાગ-ત્યાગમાં મગનતા ખરી ? ભલે અનંતજ્ઞાન નહિ પણ એના અનંતમાં ભાગના શુદ્ધજ્ઞાનનો ખજાનો ખરો ? દ્રષ્ટાપણું સર્વાશે શુદ્ધ અને કાયમી નહિ સહિ, તોય અલ્પાંશે અને વારે વારે શુદ્ધ દ્રષ્ટાપણું ખરું ? આવી જે અંશેય રમણતાની સ્થિતિ તેને પણ જે આત્મા પોતાના આત્મામાં કેળવે છે, તે શું

કરે છે ? ભવિષ્યના અનંત કાળનાં આશાસન લે છે, કે હવે મને પરમાત્માનું મહાન આલંબન મલ્યું છે, મને એમનું મહા સમર્થ ધ્યાન રહે છે, પરમાત્મામાં હું મલી જવાના રસ્તે છું, તો હવે ચિંતા કે મૂંજવણ શ્રી રાખવાની ? સત્પુરુષાર્થી બની એક વસ્તુનો કેડો પકડ્યો, કે એની પ્રાપ્તિ થયા વિના રહે નહિ. એટલે માનવિજ્ય મહારાજે પરમાત્મા શ્રી શાંતિનાથ ભગવાનની સ્તુતિ કરતાં કહ્યું.

“તું વીતરાગપણું દાખવી, ભોળા જનને ભૂલાવે;  
મેં જાહીને ક્રીધી પ્રતિજ્ઞા, તેહથી કહો કોણ ડોલાવે.”

પ્રભુ, શા સારું ‘હું વીતરાગ છું.’ એમ કહી ભોળા માણસને ભૂલ ભૂલમણીમાં નાખો છો ? તમારી પાસેથી જ બધી આત્મસમૃદ્ધિ મારે લેવાની છે. ‘વીતરાગ કશું આપવાનું ચાહે નહિ, ભક્ત ઉપર રાગ કરે નહિ, માટે તું ફોગટ પાછળ લાગ્યો છે,’ એમ બતાવી ભૂલાવામાં નાખો છો. વીતરાગ એવા અમારે તો ભક્ત કે શત્રુ બન્ને સરખા. શત્રુનું બગાડીએ જ નહિ, ભક્તને કશું આપીએ નહિ,’ એમ કરી ભોળવો છો. આ બધી મને ખબર હતી, એટલે જ મેં આ પ્રતિજ્ઞા કરી છે કે તમારી પાસેથી લીધા વિના હું તમને છોડીશ નહિ. અહીં નહિ તો ભવાંતરમાં પણ તમને હું મૂકનાર નથી. હું તો કહું છું કે,

“કોઈ કોઈની કેડો મત પડો, કેડો પડ્યા હો આણવા જ.”

કાં તો કોઈએ કોઈની કેડો પડવું નહિ; અને પડ્યા તો એને જરૂર પાસે લાવવા જ. પાસે આણવા વિના રહેવું નહિ. એટલે જ

“નિરાગી પ્રભુ પણ ખોચીયા, ભક્તે કરી હો મેં સાત રાજ”-

“વીતરાગ પરમાત્મા શ્રી શાન્તિનાથ ભગવાનના હાલ તો ચૌદ રાજલોકના મથાળે છે, છીતાં મારા ભક્તિ બળથી મેં એમને સાત રાજ નીચે અહીં બેંચીને મારા હૃદયમાં લાવી રાખ્યા છે.” આમાં પ્રતિજ્ઞાની વાત આવી. તેથી પ્રશ્ન થાય કે,

પ્ર.- આવી તે વળી બાધા હોતી હશે ?

૬.- અહીં સમજો કે સમ્યકૃત્વનો સ્વીકાર એ બાધા જ છે. એમાં પ્રભુ બનવા સુધી પ્રભુને ન છોડવાનો નિર્ધાર આવી જ જાય છે. માત્ર દેવગુરુને ધર્મની તેજસ્વી શ્રદ્ધાની જરૂર છે.

પ્ર.- દેવગુરુ ધર્મની શ્રદ્ધા શા સારુ કરવાની ? ઉધાડા હઈશું તો કાઈ આ શ્રદ્ધાર્થી કપડાં નહિ મલે, કે ઠંડીમાં ગોદં નહિ મળે, ખાવાપીવા કે પૈસાટકા નહિ મલે; તો પછી શ્રદ્ધા કરવી જ શા સારુ ? અરિહંત એજ દેવ સાચા ! એમ કરવા કરતાં કોઈ શેઠને કેમ પકડી ન લેવા ? કોઈ ઉદાર સુખીને કેમ ન વળગતું ? એથી

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ” (ભાગ-૧૮)

કંઈક મળે, ને દળદર તો ફીટે.

૩.- અરિહંત પર શ્રદ્ધા દર્શનની કળા મેળવી રાગ, દ્વેષ, કામ, કષાયરૂપ અરિને હણવા માટે. સાધુ પર શ્રદ્ધા કલાયુકત દર્શન કરી, સંસાર ત્યજી સાધુ થવા માટે ! અને ધર્મશ્રદ્ધા સમ્યગ્દર્શન કરી જીવને ધર્મમય બનાવવા માટે ! ત્યારે હવે તમારે શું બાદબાકી કરવાની છે કે ‘ના ભાઈ, અરિહંતની શ્રદ્ધા કરવાની ખરી, પણ અરિને કાઢવાનો મોખ નથી, આંતર દુશ્મનને દુશ્મન નથી માનવા ? અમારે તો રાગ, દ્વેષ, કામ, કષાય વિના જરાય ન ચાલે. એમ સાધુને માનશું ખરા, પણ અમારે સાધુ બનવું જ નથી. ધર્મ પર શ્રદ્ધા રાખશું ખરા, પરંતુ અમારે ધર્મમય થવું નથી.’ આવી બાદબાકી કરી રાખી છે ? જો કરશો કે કરી રાખી હશે તો કળાવાળું દર્શન નહિ, સમકિતમાં તો બેય વસ્તુ જોઈએ. અરિહંતાદિને માનવા સાથે જાતે એવા બનવાની હૃદયમાં ઈતેજારી જોઈએ. તો જ સાચી શ્રદ્ધા ગણાય. એમાં હવે ઉગમગ ન થવાય, એ સારુ સમકિતરૂપી પ્રતિજ્ઞા છે. એમાં દેવનો કેડો પકડવાનો છે, એટલા માટે કે દેવ વીતરાગપણું દાખવીને આપણાને જાણે સિજનલ ધરી કહે છે, તમેય વીતરાગ બનો. એટલે કહો કે ખરી રીતે વીતરાગતાનો કેડો પકડવાનો છે. જગતના પદાર્થો પાછળનું કેડે પડવાનું સસ્તું છે, પણ વીતરાગતાને, મુક્તિને અને મુક્તિના પતિ પરમાત્માને પૂછે પડવું ઘણું ઘણું મોંબું છે ! કેમકે એમની પાછળ પડ્યા પછી દાણિ ઝણહળતા વિરાગની સાખુત રાખવી પડે. હવે જગતમાં ઊંધા દર્શન ન કરાય; જગતને સારા રૂપે કે સુખાકારી રૂપે ન જોવાય. પ્રત્યેક પ્રવૃત્તિમાં સાવધાની રાખવી પડે કે મારી દાણિ શુદ્ધ રહે છે ને ? આંખ સામે દુન્યાવી પ્રલોભનો માયા-મમતા કરનારા, રાગ પ્રેમ વરસાવનારા ઘણા મળે. પણ ત્યાં બધે સાવધાની જોઈએ કે આમાં મારે લપટાવાનું નથી, સારું માનવાનું નથી. તો મુક્તિની ધગશ ટકે; તો પ્રભુપ્રેમ ટકે. માટે જ.

રાજુલની ચેતવણી :- માનવી સ્ત્રીને પરણવામાંથી પાછા ફરી મુક્તિ સ્ત્રીને પરણવા જનાર નેમનાથને રાજુલ કહે છે- “પ્રીત કરતા સોહિલી રે હાં, નિર્વહિતાં જંજાળ મેરે વાલમા.” કેવી હિતાંકણી ! ચેતાવી દે છે કે અમને છોડી મુક્તિ સુંદરીના મોહમાં ધસ્યા જાઓ છો. પણ ધ્યાન રાખજો કે એની સાથે પ્રીત માંડવી શરૂ કરવી સહેલી છે, પણ એનો નિર્વહિ કરવો ભારે કઠીન છે. અમે તો તમારા તરફની બધી અગવડ તો શું, પણ અરુચિ-રીસ-ઊંધી દાણિ વગેરે સહન કરી લેનારા છીએ. પણ આ મુક્તિ એમાંનું કશું સહન નહિ કરે. કાયા કે ખાનપાનાદિની સુખશીલતાના પ્રલોભનમાં જરા પણ તત્ત્વ, ને વિરાગ પ્રત્યે જો અરુચિ કે રીસ કરનારા બન્યા કે ઊંધી દાણિ, કુદર્શન, કરનારા બન્યા તો મુક્તિ નહિ ચ્યાલાવી લે;

૮ ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા- દર્શનની પ્રશ્નવિધ કલા (ભાગ-૧૮)

એ તો દૂરથી જ તમને ધુતકારી કાઢશે.” રાજુલની કેવી સરસ ચેતવણી ! અહીં ‘પ્રીત કર્ણતા સોહિલી, નિર્વહતાં જંજાળ’નો ઉપર ટપકે અર્થ એવો થાય કે ‘તમે મારી સાથે પ્રીત માંડીને ટકાવી શક્યા નહિ; કેમકે પ્રીતિ કરવી તો સહેલી છે, પણ ટકાવવામાં ભારે જંજાળ છે.’- પરંતુ આ કથન સામાન્ય છે; ત્યારે પ્રીત તરીકે મુક્તિ સાથેની પ્રીતિ લઈ, ‘મુક્તિ પામવા સુધીમાં એ અખંડપણે ટકાવવામાં બહુ મોટી મુશ્કેલી છે,’- એ અર્થ વિશેષતાવાળો છે. ઉપરાંત સંગત પણ છે. કેમકે આ ચેતવણીથી પણ નેમનાથ પ્રભુ પાછા નથી વળતા; ત્યારે રાજુલ પણ નક્કી કરે છે કે જો તમારે પણ મુક્તિની પ્રીતિજ ખપે છે, તો મારે પણ એજ ખપે છે. શું કર્યું આ ? દર્શન સમ્યક્ કર્યું. વાત એ ચાલે છે કે પરમાત્માનો કેડો પકડવાનો તે પરમાત્મા બનવા સુધી મક્કમપણે પકડવાનો.

‘પ્રભુ અભેદપણે મને મળો. પછી આપ છૂટા.’- એવું વિરોધવાળું કહિવિચન :- અહીં જે દર્શનની કળાનો વિચાર કરવાનો છે, તેને સાધવામાં ઉપયોગી થાય એવી આ વાત છે કે આપણે પરમાત્માનો ઠેઠ સુધી કેડો પકડી રાખવો જોઈએ. એ માટે હૃદયમાં વીતરાગ પરમાત્માને ભક્તિ સહિત વસાવી રાખવા જોઈએ. અર્થાત્ પરમાત્માનું વીતરાગ, અનંતગુણનિષિ, અને તારક તરીકેનું સ્મરણ જીવતું જાગતું રહેવું જોઈએ. હવે કવિ એક બીજી તેવી જ ઉપયોગી સરસ વાત કરે છે,-

“મનમાંદી આણી વાસીયા હવે કેમ નીસરવા દેવાય;  
જો ભેદરહિત મુજશું મિલો, તો પલકમાંદે છૂટાય...”

અર્થાત્ હે પ્રભુ ! આપને મેં હૃદયમાં વસાવ્યા પછી હવે કેવી રીતે જવા દેવાય ? હા, આપને છૂટવાનો એક રસ્તો છે કે જો આપ મને ભેદરહિત અર્થાત્ અભેદભાવે મળો તો પછી આપ પલકમાં છૂટી શકો છો. કહિના આ કથનમાં વિરોધ આવે છે. પ્રશ્ન એ થાય છે કે,

પ્ર.- ભગવાન જો અભેદભાવે મળી ગયા તો એનો અર્થ એ થયો કે ભગવાન અને આપણો આત્મા એકરૂપ થઈ ગયા. તો પછીથી ભગવાનને છૂટવાનું રહ્યું જ ક્યાં ?

હજુ એકલો હાથ પકડેલો હોય તોય છૂટાતું નથી, તો એકરૂપ થઈ ગયા પછી છૂટવાનો અવસર જ ક્યાં છે ? એટલે આમાં તો ‘માતા મારી વંધ્યા’ જેવો વિરોધ છે.

૩.- પરંતુ અર્થ આમ સમજવામાં વિરોધ છે. કિન્તુ જો બીજી રીતે અર્થ સમજવામાં આવે તો વિરોધ નહિ દેખાય. તે અર્થ આ રીતે સમજવાનો છે. એમાં ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ” (ભાગ-૧૮)

માત્ર ‘મિલો’ શર્ધણી ખૂબી છે. ‘મિલો’ એટલે ‘સંબંધિત થઈ જાઓ’ એવો અર્થ નહિ કરતાં ‘મળો’ અર્થાત્ ‘દર્શન આપો’ એવો અર્થ કરવાનો છે. વ્યવહારમાં જેમ કહેવાય છે કે ફ્લાણા ભાઈ મને રસ્તે મળ્યા હતા. અર્થાત્ મને એમના દર્શન થયા હતા. એવી રીતે અહીં કવિ કહે છે,” પ્રભુ ! આપ જો મને ભેદ રહિત દર્શન આપો. અર્થાત્ આપનું જે શુદ્ધ સ્વરૂપ પ્રગટ થયેલું છે એ જો મને અભેદભાવે દેખાઈ જાય, એટલે કે મારા આત્માની સાથે એકમેકરૂપે એ સ્વરૂપ દેખાઈ જાય. ‘હું જ જાણે એવા સ્વરૂપવાળો જ છું’ એવું મને સચોટ ભાસ્યા કરે, તો પછી મારે આપને પકડી રાખવાની જરૂર નહિ રહે; તેથી આપ છૂટા. માત્ર મને મારો આત્મા સંસારી સદેહી, સકર્મા, સવિકારી નહિ દેખાવો જોઈએ.” આમ દસ્તિ કરી, સ્વાત્માને સંસારથી ઊંચે લઈ પરમાત્મસ્વરૂપની ભાવનામાં લીધો, એ સમ્યગ્દર્શન કર્યું, દર્શનની કળા સાધી.

### ● અધમાત્માને પરમાત્મા બનાવવાની સુંદર વિચારણા ●

“મારો આત્મા એટલે પરમાત્મા, પરમાત્મા એટલે તો શ્રેષ્ઠ શુદ્ધ આત્મા. અદેહી, અકર્મા, અવિકારી-એવો હું આજે શું કરી રહ્યો છું ?” એની હરેક પળે જાગૃતિ રાખવાની છે. પોતાના શુદ્ધ સ્વરૂપનું મનન અને મંથન, ગીત અને ગુંજન ચાલુ રાખવાની જરૂર છે. હવે તો જાણો એક જ ધૂન કે “મારો આત્મા એટલે પરમાત્મા. છાતાં આજે અધમાત્મા છે, તો હવે બીજા ગીજા વિકલ્પ-વિચારો અને લાલસા-લાગણીઓ કાઢી નાખી એની દરેકે દરેક અધમતા અને મલિનતા દૂર કરું. આત્માને પરમાત્મ-સ્વરૂપની નિકટ લઈ જાઉં.” આ ઘ્યાલ કરવાનો તે ઘડીએ જગત પ્રત્યે અરિસા જેવા શુદ્ધ દ્રષ્ટા, નિર્લેપ ઉદાસીન દ્રષ્ટા બનવાનું લક્ષ કેળવવું પડશે. અરિસા સામે કોઈ તલવાર જેંચીને અરિસો ફોડવા આવે, ને બીજો કોઈ વરમાળા લઈને અરિસાને પહેરાવવા આવે, તો અરિસો તલવાર સામે લાલ નહિ થાય. કે વરમાળા સામે હર્ષિત નહિ થાય. અરિસામાં બન્ને ક્રિયાના પ્રતિબિંબ પડે ખરા, પણ એને એ માટે ન રોષ, ન તોષ. બસ, આપણો આત્મા અરિસા જેવો અરુષ, અતુષ બની જાય, તો પરમાત્મા જેવો બની જાય. મન કહે “જગતમાં મારી સામે વિરુદ્ધ કે વહાલી ગમે તે પ્રવૃત્તિ થાઓ, પણ મારે ન દેખીલા બનવાનું કે ન પ્રેમાણ બનવાનું. જગતના પ્રસંગો ને સંયોગો તો વિચિત્ર આવે, પણ તેમાં મારા આત્માને વિકારી બનાવવાની જરૂર નહિ. જગતની ઉજળામણમાં ઉજળા થવાની કે મલિનતામાં મલિન થવાની શી જરૂર છે ? મારો આત્મા એટલે પરમાત્મા છે ! ને પરમાત્માનો આત્મા એટલે જગતથી નિરાલો ! જગતથી નિરાલો એટલે

તद્દન શુદ્ધ ! તદ્દન શુદ્ધ એટલે જગતની કોઈ પણ અસર એના પર નહિ ! એ વખતે પરમાત્મા સાથે જાણે એક રૂપ બન્યાની ઉલ્લસિત સ્થિતિ કેવી કે હવે ગડમથલ કરવાની જરૂર નહિ કે ‘અહો ! પ્રભુને ભૂલી ગયો ? લાવ, પરમાત્માને ભૂલી જાઉં દું તે યાદ કરું.’ હવે તો જગત ભૂલાઈ ગયું. જગતનું જે જે દેખાય એમાં એમાં પરમાત્માનો સંબંધ દેખું. એવી રમણતા પ્રભુ સાથે કરી દઉં.” સમકિત ઉચ્ચર્યું એટલે ટેક ધરી કે “હવે પ્રભુને મારામાં એકેમેક કર્યા વિના નહિ રહું !” જે કે અભેદભાવ નીપજવાની વાર છે. પણ પ્રાથમિક ભૂમિકામાં શું કરવાનું ? અભેદભાવની ભાવના ભાવવાની. એ આવક્યું કે પછી તો જગતના ભાવોમાં આકુળઘ્યાકુળ થવાનું બંધ. જગતની પીડા કોઈ પીડા નથી ! જગતની શાબાશી કોઈ શાબાશી નથી ! મન એટલું બધું સદ્ગ્રહ બની જશે ! રાગ-દ્વેષ હજુ ઊભા હશે, છતાં એની અંધતા નીકળી ગઈ. એ માટે દર્શનની કલા શીખવાની છે ! એના માટે છ કણા જેવાની છે.

(૧) સાત્ત્વિક દર્શન, (૨) અનુકૂલતા-દર્શન, (૩) આત્મીયતા-દર્શન, (૪) સ્વદોષ-દર્શન, (૫) વિકાસમાં વિનાશ-દર્શન, (૬) દુઃખહેતુ-દર્શન.

## • ૧. સાત્ત્વિક દર્શન •

સંસાર જેને કહીએ છીએ ને જગત તરીકે જેને ઓળખીએ છીએ એવી લક્ષ્મી અને વિષયો, કુટુંબ અને કબીલા, મિત્ર કે શત્રુ; ઘર કે દુકાન, શહેર કે જંગલ,-આ બધાનાં સાત્ત્વિક દર્શન કરતાં આવડવું જોઈએ. એ પહેલી કણા. પ્રશ્ન થશે કે,

પ્ર.- સાત્ત્વિક દર્શન કોણું નામ ? દર્શનમાં વળી સાત્ત્વિકતા શી ? સાત્ત્વિક તો આત્માનો ગુણ કહેવાય. આત્મા કોઈ સાત્ત્વિક હોઈ શકે, કોઈ રાજ્ય હોય, કોઈ તામસ હોય પણ તે આત્મા જ હોય. તમે તો દર્શનને સાત્ત્વિક કહો છો !

૬.- હા, ખુબીવાળા દર્શન પર આત્મા સાત્ત્વિક થાય છે. માટે દર્શનને પણ સાત્ત્વિક કહીએ છીએ. આત્માને સાત્ત્વિક બનાવે એવું દર્શન કરવું; તે કણાવણું સાત્ત્વિક દર્શન છે. ત્યારે તમે પૂછો કે, વસ્તુને દેખવા માત્રથી સાત્ત્વિકતા આવે ? એનો ઉત્તર એ છે કે હા, આવે. દેખવાની કિયાને સામાન્ય ન સમજતા. કોઈપણ પદાર્થને, કોઈપણ પ્રસંગને, કે કોઈપણ વ્યક્તિને તમે કેવી રીતે દેખો છો, એના પર તો તમારા સાત્ત્વિકભાવ કે તામસભાવને ખીલવાનો, સુખદુઃખના સરવાળા-બાદભાડી થવાનો અને વીરતા-કાયરતા-પોષાવાનો મોટો આધાર છે. દા.ત. સામેથી

બ્રાન્ડ ન્યુ મોટર ચાલી આવે છે. એમાંથી કોઈ મહા શ્રીમંત ઉતરી તમારી સાથે વાત કરવા ચાહે છે. હવે જો તમે ‘ઓહો, કેવો સારો શેઠીયો ! હું વળી એ મને બોલાવે છે ?’ આમ જો દર્શન કર્યું, તો સમજી લ્યો કે દીનતા આવી. પછી અનું ચાટુ કરવાનું મન થશે. ત્યાં સાત્ત્વિકતા ગઈ. પણ જો શ્રીમંતાઈમાં ન અંજાતા, જવલંત વૈરાગ્યથી હદ્યને બેપરવા રાખ્યું તો સત્ત્વ ટક્યું. પછી ત્યાં જે વાત થશે તે ઓજસ્વી થશે, ગરીબો નહિ. કેમ આ ? દર્શનની કળાને યોગે. ‘પૈસા માત્રથી એને મારે મોટો માનવાની અને લેવાઈ જવાની શી જરૂર છે ? હું પણ મારી જાતનો માલિક છું.’-એમ જે જીવો પોતાના આત્માનું મૂલ્ય સમજતા નથી, જેને ભાગ્યનું ભાન નથી, જે દીર્ઘ દ્રષ્ટા નથી, જે આત્માઓ અજ્ઞાનતામાં સબડે છે, બ્રમજામાં ભટકે છે, એ જગતની વસ્તુઓમાં અને વ્યક્તિઓમાં એવા ઉપલકીયા ધર્મોના દર્શન કરે છે, તેમજ ઉંડાણમાં પડેલા ધર્મો, જે અવશ્ય વિચારવા યોગ્ય છે, તેની સામે અંખમિચામણાં કરે છે, ઉપર ઉપરથી જગતને જોઈ રાચે છે, માચે છે, અને નાચનાચ કરે છે. પણ અવસરે એ જ જગત તરફથી લપડાક એવી ખાય છે કે શોક અને પોકનો પાર નથી રહેતો, ચાલીસ વર્ષ દિક્રો જન્મ્યો. એટલે બેન્ડવાજાં વગડાવો છો ને ? પેંડા વહેંચોને ? જન્મોત્સવની ધામધુમને ? શું કર્યું આ ? ‘પુત્ર મને મળ્યો, હવે હું બાપ બન્યો. જે કમાઈશ તે લેખે લાગશે.’ એમ મનને થાય છે. મળોલી લક્ષ્મી લેખે ક્યારે લાગે ? એને કોઈ આવો ભોગવનાર મલે તારે ને ? ધર્મમાં ખર્ચાય ત્યારે નહિ ને ! ત્યાં ઉપલક્ષ્યાં દર્શન કર્યા કે ‘લક્ષ્મી હવે લેખે લાગશે. પુત્ર સો વર્ષના આયુષ્યવાળો છે ! મોટો થશે એટલે સેવા-ચાકરી થશે. છેલ અને દંગો નહિ દે. મોટો થશે કે હોશિયાર થશે. બધું રૂદું રૂપાળું બનવાનું છે ! ને મારું નામ અમર થઈ જવાનું !’ આવાં આવાં ઉપલકીયા ધર્મના ઘેલાં દર્શનમાં આખા નગરમાં ઠાઠ ને માઈ ! જેમ જેમ પુત્રના દિવસો વધતા જશે, તેમ તેમ બાપના મનોરથો પણ વધતા જશે ! પણ ધારો કે ભોગ જોગે આ છોકરો વીસ વર્ષ પૂરા થતાં મરીને રવાના થયો, કે ઝગડી-લૂંટીને જુદ્દો થયો, તો માખાપને અફસોસી કેટલી ? પારાવાર ! જગતની વસ્તુના સાત્ત્વિક દર્શન કરતાં ન આવડવું તેના પરિણામે તે કેવા ભયંકર શોકમાં ડૂબે ? એના સ્થાને વસ્તુમાં સાત્ત્વિક દર્શન કરનાર વિરાગીને કોઈ શોક નહિ. અરે વાંઝીયાને પૂછો ‘તમારે કેમ મોંકાણ નહિ ?’ તો એ તો જેને ત્યાં જન્મનાં વાજાં; એને ત્યાં મોતની કાણ’. સાત્ત્વિક દર્શન કરવાની કણા હોત તો જોઈ લેત કે, “દિક્રો મળ્યો એટલે એક જગતની વસ્તુનો સંયોગ થયો. સંયોગ માત્ર વિનશ્યર છે. તેનો અંત આવવાનો છે. ચાચ આપણે પુત્રને છોડીએ કે ચાચ આપણને તે મૂકી જાય, બેમાંથી એક વાત

નક્કી છે. એથી એમાં આપણો લહેવાઈ જવાનું નહિ. એ તો કર્મ મદારી જીવ વાનરને નચવે છે. વળી આગળ વધીને દિકરો એટલે ? આજસુધી એ નહોતો મલ્યો, તો મોહ નહોતો થતો; પણ હવે મળ્યો એટલે એનાથી જ હવે મોહ થવાનો. વધુ ખર્ચ ધર્મને બદલે એના પર કરાવાનો. તેમ બીજું એ કે એ તો પૂર્વભવની ધર્મકમાડી લઈને આવ્યો હશે, તો પણ એને મોહથી હું એવા કુસંસ્કારો, ઈન્દ્રિય વિષયના સંસ્કારો આપવાનો કે એમાં એના બિચારાના પૂર્વના ધર્મસંસ્કાર બધા ધોવાઈ જશે ! આવી પાપ લીલામાં શું ખુશી થવું ? ઢીક છે, જગતના કાનું પ્રમાણે વાળું વગડાવી લઈએ પણ એમાં ઘેલા બનવાનું નહિ ! અ-સ્વસ્થ થવાનું નહિ ! ખોટી કલ્પનામાં તણાવાનું નહિ.” આવડે આ ? જો આ આવડે તો પછી પુત્રના મૃત્યુ કે જગડા પર શોક નહિ થાય, કેમકે દર્શન એવું સાત્ત્વિક હતું કે વસ્તુસ્થિતિના બરાબર ઝાલ સાથે હદ્ય પોતાના કાબુમાં છે. તેથી માને છે કે આપણે તો જગતના જેલ ફક્ત જોવાના. સ્નોહીનું મૃત્યુ થયું તો વિચારવાનું કે ‘આવ્યો હતો પરુણલો, શાનો શાશ્વત રહે અમ પાસ ?’ એ તો ચેતાવતો ગયો કે હું જાઉં છું તેમ તમારે પણ જવાનું છે. માટે આ અલ્યકાળના જીવનમાં જ ધર્મસાધના કરવાની શક્યતા છે તેને મૂકી જગતની ખોટી આળપંપાળ સંભાળવામાં તણાશો મા. નહિતર જીવન હારી જશો ! જ્યાં જગત પહેલાં મોહ કરી અંતે શોકને આધીન બને છે, ત્યાં આ સાત્ત્વિક દર્શનવાળો પહેલેથી જ મોહને અટકાવે છે. તેથી જ શોકથી બચાવવાની એ પ્રવીષ્ટતા મેળવે છે. આંખ સામે સોનું આવ્યું કે જીવેરત આવ્યું; આ દર્શન કરે છે, “શું મલ્યું આ ? રાગના કીચડમાં રખડાવનારું મલ્યું. જગતના મોતી-માણેક કે કોરી કરંસી નોટો હાથમાં આવી તો શું આવ્યું ? દેવગુરુધર્મને ભૂલી આ એકન્દ્રિયના ખોખાને વધુ કિમતી વધુ વહાલા કરવાનું આવ્યું. આગળ વધીને અવસર આવ્યે દેવગુરુધર્મ પર શેઠાઈ બજાવવાનું આવ્યું.”

પ્ર.- દેવગુરુ પર શેઠાઈ ?

ઉ.- હા, મધ્યમ માણસ હોય તે પ્રભુની પૂજાનું બધું કાર્ય સેવક થઈને જાતે કરશે. પણ શ્રીમંત હશે તે પૂજારીને ભગવાન તૈયાર રાખવાની તાકીદ આપશે. પછી ભલે પૂજારી આશાતના કરી વાળે. માત્ર તિલક કરવા શેઠ સાહેબ પધારશે. જેમ મીલનો સેકેટરી બધું તૈયાર રાખે, ને શેઠ આવીને એના પર સહી કરી દે, તેમ આ શેઠ શ્રાવક દુનિયાનો દાસ છતાં ભગવાનનો શેઠ થઈ પ્રભુને ચાંલ્યા કરવાનું મતું મારી દેશો ! મધ્યમ હોય તે ગુરુને ‘બાપજી, બાપજી !’ કહી ને વેલા થઈ જશે; ને શ્રીમંત હોય તે કહેશે ‘જુઓ, મહારાજ !’ આ આમ કરવાનું છે. મહારાજ, કાળ વિલક્ષણ છે. બધું જોઈ વિચારીને કરતા જાઓ આ નાની પ્રજાને ભુવનભાનું એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ” (ભાગ-૧૮)

વૈરાગ્યનો ઉપદેશ આપતા નહિ.” આવા ઓર્ડર અને ઓડીનન્સો શ્રીમંત કાઢશે. આ બધું શાના પર ? લક્ષ્મી આવી એના પર. તો લક્ષ્મીમાં એ દેખાવું જોઈએ કે લક્ષ્મી આવું આવું કરાવનારી છે. એથી ઘોર પાપ અને ભવભ્રમણની વિટંબજા છે. માટે એને ઓળખીને ચાલવું. આમ સાત્ત્વિકતા ખીલવાનો અવસર મલશે. એથી પછી પ્રસંગે ઉદારતા, નમ્રતા, અને સાવધાની ખૂબ જળકશે. નહિતર લક્ષ્મીના કુર્દશનના જોરે જ દેવગુરુધર્મની અવગણના અનાદર ચાલશે, સ્વાર્થની કુરી રમતો રમાશે. જિનાજ્ઞાને જીવનમાંથી વોસિરાવી જડની આજ્ઞાને શિરોધાર્ય કરવાનું થશે ! માટે એનાથી બચવા વસ્તુને ઓળખો. વસ્તુના ઊંડાણના સમ્યંદર્શન કરો. લક્ષ્મીના થોક તે સુખના થોક નથી, એ તો જેરી સાપના ભારા છે, - એવું સાત્ત્વિક દર્શન કરો. સાપના ભારા ઓછા થઈ ગયા તો રડો નહિ આત્મસત્ત્વની સુવાસ ત્યાં વધુ મહેકાવો. ઉપકાર માનવો જોઈએ શાસનનો કે અજબ જિનશાસન મલ્યું છે, તો તેથી વસ્તુનું નિર્મણ સાત્ત્વિક દર્શન કરી શકીએ છીએ. જગતના વેભવમાં શું પડેલું છે ? અનાદિની ગલીય કુટેવોની પુષ્ટિ પડેલી છે; દુર્ધાનની સુલભતા પડેલી છે; આત્માને નિઃસત્ત્વ બનાવવાના કામણ પડેલા છે.

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદધિ”

વર્ષ-૩, અંક-૫, તા. ૨-૧૦-૧૯૫૪

## ૨ દર્શનની પડવિધ કલા.

**બાવાજીનું દસ્થાન્ત :-** જુઓ એક બાવાજી ભીક્ષાએ નીકલ્યા છે. કોઈ દાતારે એમની જોળીમાં અજાણે લોટ ભેગો સોનાનો ટૂકડો નાખી દીધો. ના કેમ પાડવી ? એ તો લાખા ઝુંપીએ તરંગ કરતા, “આવી ગયું છે તો ઢીક થઈ ગયું. આમ રોજ માગવા જતા તો હવે રોજ જવાની ભાંજગડ ગઈ. પ...ણ, ના, એમ બેઠા ખાઉ થઈને ખાઈ ન જવાય અગિયારમે દિવસે માંદા પરીયે તો ? ભીક્ષાએ તો જવાનું. માટે આને રાખી મૂકો. અવસરે કામ લાગશે.” જુઓ કેવા ઘેલા તરંગ ? છે કંઈ માલ ? છે કોઈ આત્મચિંતા ? જડ ચેતનને રમાડે છે ! સોનાના ટૂકડાએ શું કર્યું ? અનાદિની દુષ્ટભાવના, ગલીય મમતાવૃત્તિને અંદર પેસી જવા માટે આત્મમંદિરના દરવાજા ખુલ્લા કરી આપ્યા ! બાવાજીએ બહારથી આવીને ઝુંપીએ જોળી ટિંગાડી. ચેલો બાજુમાં બેઠો છે. ચેલાને કહે છે, “મેં સ્નાન કરનેકો જતા હું. ઈસ જોલીકા ધ્યાન બરાબર રખના.” જીવનમાં જગતનું એક પાપ ધાલીએ કે એની પાછળ થોકબંધ પાપને આવવાની જગ્યા કરી આપવી જ પડે છે.

માટે થોકબંધ પાપનો ખપ ન હોય તો એક પણ પાપને જગા ન આપો. આજસુધી ઝોળી પર ધ્યાન રાખવાની જરૂર નહોતી પડતી. આજે આ શું ? બરાબર ધ્યાનની જરૂર પડે છે ? ચેલાને લાગે છે કે “કેમ જાણો.” ગુરુ કહે છે, “દેખ ! ઝોલીમાં દેખના નહિ.” અને પોતે જાણો પૂછે છે, “ક્યાં ગુરુદેવ ?” તો ગુરુ જાણો કહે છે, “ગુરુ કે સામને પ્રશ્ન કરતા હે ? મેં કહેતા હું સો કરને કા હૈ.” ચાલોને વહેમ પણ્ણો કે એવું તે છે શું ?

બાવાજી ગયા. પણ ચિત્તમાં ઝોળી લેતા ગયા. તેથી એ એનો વિચાર કરતા કરતા ચાલે છે. તમેય ચિત્તમાં ધર-દુકાન, પૈસા-પરિવાર અહીં લઈને આવો છો, તેથીજ એના વિચાર કરો છો ને ? તે ય લાખ રૂપિયાનું પ્રભુર્દશન, જિનવાણી-શ્રવણ, સામાયિક વગેરે બગાડીને ને ? ધર્મ કરવા જાઓ ત્યાં ચિત્તમાં સંસાર લેતા ન જાઓ. સંસારને તે વખતે ભાગ્ય-ભવિતવ્યતાને સોંપો. બાવો વિચારે છે, “ધું તો ધંટા દો ધંટા પૂજા-સ્નાનમે હો જાતા હૈ. લેકિન આજ તો મેં ફોરન વાપિસ લોટતા હું.” આજ સુધી ઝોળીમાં સોનું નહોતું આવ્યું ત્યાંસુધી એ ભાવના રહેતી કે “આજ તો બાજી અસ્થી તરહસે દો-તીન ધંટા પરમાત્માકા ધ્યાન લગાયેંગે.” પણ આજ સોનાએ શુભ ચિત્તમાં ઉથલપાથલ કરી નાખી. સાચ્ચિક દર્શનની કળા ન આવડે તો મહાયોગી માણસ આટલા સોનાના ટૂકડામાં અટકી પડે. ચેલાથી રહેવાયું નહિ, “ક્યા ગુરુજી ઝોલી મેં એસી કૌનસી ચીજ લાયે હૈ, ક્રિ બરાબર ધ્યાન રખનેકા કહ ગયે હૈ ? ક્યાં હૈ મેં દેખું.” એમ વિચારને ચેલાએ ઉઠીને ઝોળી ખોલીને જોયું ! તો અંદર ચક્યક ચળકે છે ! સોનાનો ટૂકડો !! દેખતાં જ “અધધ ! માર ડાલા. એ કયા ?” એમ વિચારી રહસ્ય સમજ ગયો ચેલો ! સોનાના ટૂકડાને ફણીધર સાપ સમાન દેખતા એષે હાથમાં લઈ દૂર ગીય જાડીમાં ઉછાળી ફગાવી દીધો. કહો, સોનું એનું એ, પણ દર્શન-દર્શનમાં જ ફરક છે ને ?

બાવાજીના ચિત્તમાં હતું એટલે હવે આંખને અને પીળાને મેળ કરાવવા આવ્યા જરૂર સુંપીએ ! ઝોળી ખાલી જોઈ તહુક્યા !

“અંબે ગોરખ ! કયા ઝોળી તું ને ખોલી થી ?”

“જી.”

“તો કહાં ગયા વહ સોનાકા ટૂકડા ?”

“વો તો ગુરુદેવ મૈં ને ઉસ જાડીમેં દૂર ફેંક દીયા.”

“અરે પાગલ ! એ ક્યા કીયા તુંને ?... તુંજે મૈ ક્યાં બોલા થા ?... અબ કહાંસે મીલેગા એસા ટૂકડા ? રોજ રોજ નહિ મિલતી હૈ એસી ચીજ !”

“અહો ગુરુદેવ ! ઈસમેં કયા હૈ, આપકે નામ પર તો સારા પહાડ ભી

સોનેકા બનાયે જા સકતા હૈ !”

“એસા હો તો બના દે મૈં દેખું.”

એવો એ લાયક ચેલો હતો કે એ ચેલાની સેવામાં દેવ ગુપ્ત રીતે સહાયક હતો. તેથી ચેલો તે બે હાથ ઝોડીને ગુરુનું નામ દઈ કહે છે, “મેરા ગુરુકા નામ પર પહાડ સોનેકા હો જાઓ.” કહેતાં જ સામેનો પહાડ સોનાનો દેખાવા લાગ્યો. જે ગુરુના નામ પર પહાડ સોનાનો થઈ જાય છે. ત્યાં ચેલો સાવધાન કરે છે, ‘સ્વામી ! ઈસમેં કોઈ બડી બાત નહીં હૈ. જરૂર ચિત્તસે હટ કર શુભધ્યાનમં આજા વો બડી બાત હૈ.’ અર્થાતું “અનંતકાળની પુરુગલ માયામાંથી ખસી પ્રભુચિત્તામાં આવ્યા તે, અને હમણાં પરમાત્માને ભૂલી જરૂર પુરુગલની લગનીમાં ગયા હતા તે પાછા વળી પ્રભુચિત્તનમાં આવી ગયા તે આશ્ર્ય હૈ.” ગુરુના પગમાં પડી કહે છે, ‘ગુરુજી ! ક્ષમા કીજીએ, મૈં તો આપકા અજ્ઞાન શિષ્ય હું. આપકે સામને બોલને કે લીધે લાયક નહિ હું.’ દર્શન-દર્શનમાં કેવો ફરક ? ચેલા પાસે સોનાનો પહાડ છે, છતાં નિરપેક્ષી છે ! ગુરુ સોનાના માત્ર ટૂકડામાં લુબ્ધ થઈ અપેક્ષાવાળા બન્યાં ! અને ચિત્તને કલેશ વહોર્યો. સમ્યગ્દર્શન કરતાં આવડે તો દુનિયાના તમામ પદાર્થોમાં કલેશના મંડાણ જોઈને એનાથી દૂર રહેવાય. આંખ સામે ચક્યકતું દેખાય તેથી શું લહેવાઈ જવાનું ? ત્યાં સત્યથી એમ જોવાનું કે હું આનો ગુલામ નથી. આ નહિ હોય તો સાચી શાંતિ દેખાશે. ત્યાગી મુનિઓને પરમ શાંતિ છે. મધ્યમ માણસને ત્યાં કેટલીકવાર જે જગડા નહિ દેખાય તે પૈસે ટકે સારી રીતે સુખી દેખાતા માણસને ત્યાં દેખાશે, કેમકે એને એના પૈસામાં દર્શન જ જુદું થાય છે.

પ્ર.- પૈસામાં પરમાર્થ કરવાની શક્યતા છે, સ્નેહીઓને સંતોષવાની તાકાત છે, નવાં ધ્યાદારીના કે હાયવોયના પાપથી બચાવવાની તાકાત છે, સારી રીતે ધર્મ સાધના કરવા નિરાંત દેવાની શક્તિ છે, એવું નહિ ?

ઉ.- ના, એ દેખાય. એ તો જોશે કે આ પૈસામાં મને શેઠ બનાવવાની તાકાત છે. બધા પર મારો પાવર ચલાવવાની તાકાત છે. આવું તામસી દર્શન એ કરે છે. પણ બધી જાતની પુણ્યાઈ પોતા પાસે છે નહિ તેથી કરે છે જગડા. એમ ઠેઠ રાજા પણ થાય તોય શું ઓર વધુ જગડા. નાખૂશ કરેલો પીતરાઈ બાકી ન રાખે ! બાહારવરીયો જ થાય ! “પદ ભાટ કરાવુ. શું સમજે છે એ એના મનમાં ?” અને હા, રાજાને ઉથલાવી પાડેય ખરો ! લક્ષ્મી અને વિષયોમાં, કુંદુંબ અને સ્નેહીમાં, મિત્ર અને શરૂમાં, જો આપણી પાસે દર્શન કરવાની કળા હોય તો, એનાજ આધારે શું કરે ? પ્રમાણનો પરાજ્ય, ને આત્માનો વિજ્ય ! કુંસંપનો

વિનાશ ને સંપનો વિકાસ ! કોથાદિ મહિન લાગણીઓના ઝાસ અને ક્ષમાદિ ઉજ્જવલ ભાવોની ખૂબ ખૂબ વૃદ્ધિ ! આ દર્શનને કરતાં આવડે તો પોતે સાવધાન એવો બને કે એ સરંજામ પાછળ મૂઢ જીવો જે અનર્થો ઊભા કરે છે, તે અનર્થોને જન્મવાજ દે નહિ.

બાહુબળજી પાસે ભરતને મારવાનું બળ હતું, પણ એમણે જગ્રતિ આવતાં કેવું સરસ દર્શન કર્યું ! પહેલાં તો અન્યાયી રીતે ચક મૂકનાર ભરતને મારવા માટે બાહુબળજી મુઢી ઉપાડી દોડ્યા. પણ મારતાં પહેલાં અટક્યા વિચારે છે, “અહો ! આ મુઢી કોના પર ? આ યુદ્ધ કોના કુળમાં ? આ મુઢી ભાઈને મારું તો ઈતિહાસમાં શું લખાય ?- ‘આજે લંપટાના પાપે નાના ભાઈને મોટાએ હણ્યો,’ એવું લખાય ! મહાન તીર્થકર પ્રભુ ઋષભદેવના બે દીકરા લડ્યા ! પિતાની ગેરહાજરીમાં પિતા તુલ્ય મોટાભાઈ ભરતને પૂજવાને બદલે મારવા જાઉં ?” જુઓ એજ ભરત અને એજ બાહુબળજી છે. પણ દષ્ટિ ફરતાં દર્શનમાં કેવો ફરક ! “હવે તો આ ઉપાડેલી મુઢી લોચ કરી ચારિત્ર લેવા કામ લાગેશે.” કેવાં રમણીય દર્શન ! નિર્ભલ દર્શન ! સાત્ત્વિક દર્શન ! એ મુઢીથી લોચ કરી ત્યાંને ત્યાંજ સાધુ બની ગયા. ત્યારે ભરત પણ પશ્ચાત્તાપ કરે છે, ‘અહો ! રાજ્ય લક્ષ્મીને ભવતરુનું બીજ ન સમજનારા અધમ છે; અને સમજવા છતાં અને વળગી રહેનારો હું અધમાધમ હું.’ આ એમનુંય સુ-દર્શન. સાત્ત્વિક દર્શન કરનારો વસ્તુના ઉપલકીયા દેખાવમાં અંજાતો કે લહેવાઈ જતો નથી. વસ્તુ માત્રમાં ભૂત-ભવિષ્યના અનંત પર્યાયોનું એ દર્શન કરે છે. એટલે આંખ આગળ ઘેબરનો થાળ આવ્યો કે માત્ર ઉપરની રોચકતા અને મીઠાશને એ જોવાનો નહિ; પણ એના ભૂતકાળે પર્યાયો કેવા હતા તથા હવે શરીરના મળરૂપે કેવા નિપજવાના છે તે જોવાના ! ‘અંદરથી કંફ-પિતથી લેપાએલું ! આંતરડામાં વિષા રૂપ ! ને બધાર પે કે મારીરૂપ ! ઘેબરપણાનું નામ નિશાન ન દેખાય ! આવા પ્રક્રવાન્ન પર રાગની ગુલામી ?’

આમ વિચિત્ર પર્યાયોનું દર્શન કરે એથી એના ભોગવટામાં આત્માને ઘેલછા નહિ હોય; ખાતાં મોહું વધારે પહોંણું નહિ થાય; મન વિકારોથી બદબદશે નહિ. એવું જ જગતના સ્નેહીઓમા પણ ભૂતકાળના ને ભવિષ્યના પર્યાયોનું દર્શન કરે. “આજે વહાલા છે, તે પૂર્વે દુશ્મન હતા. આજના દુશ્મન પૂર્વે નિકટના સગા હતા તો હવે અહીં રાગદ્રોષના નાટક શા કરવા’તા ? આજના વહાલા એ સદાના વહાલા નથી; દેખી તે દેખી નથી. ઢીક છે નભાવી લેવાનું. પણ તેમાં આત્માનું ધન હોમી દેવાનું નહિ. એમાં પરલોકનું ભવિષ્યનું હિત વિસરી નહિ જવાનું. એટલે

પોતાની પાસેના પુષ્યથી કુટુંબનું પોષણ થતું જાય, પણ તેટલો જ ભોગ ધર્મ માટે આપવાનો ! કાયરતાને લીધે સંસારમાં રહ્યો અઠાર પાપસ્થાનકની કાર્યવાહી થતી જાય; છતાં પરલોકનો સચોટ ખ્યાલ જાગ્રત રાખવાનો, એટલે ધર્મની સેવા જોરદાર કરવાની.” કોણ કરાવે આ ? સાત્ત્વિક દર્શન કરવાની કળા.

## ● ૨. અનુકૂળતાદર્શન ●

બીજી કળામાં આવે છે ઉચ્ચ માનવ જીવનમાં જે પ્રાપ્ત થયેલો સમય અને ક્ષેત્ર, મળેલાં જે સાધનો, પ્રાપ્ત થયેલાં જે સંયોગો અને મળી આવેલી જે મન-વચન-કાયાદિની પરિસ્થિતિ, એમાં ધર્મસાધના અને પાપનિવારણાની અનુકૂળતાનું દર્શન કરવાનું. અર્થાત્ આપણા અજ્ઞાન મનને ચાલુ સમય-સંયોગો વગેરે પ્રતિકૂલ લાગતા હોય છતાં હવે આપણે એ બધાને અનુકૂળ તરીકે જોવાના; -આ બીજી, કળા છે. ‘હું જો સમજદાર હોઉં તો, કષ્ટમય દ્યાતો પણ વર્તમાન સમય ખરું જોતાં ઘણો અનુકૂળ મલ્યો છે !’- એવી દઢ માન્યતા જોઈએ. જગત જે એને ખરાર ગણે છે. તે ઊંચા ઉદેશ અને ખોટા ખ્યાલને લીધે. પણ જેને ઊંચા ઉદેશ અને સાચા ખ્યાલથી કસાવાની તક ગમે છે, પાપ અહીં ભોગવી લઈને પાપક્ષય કરવો ગમે છે, ધમંડ ઉન્માદિથી બચવું ગમે છે, એને તો એ ઘણો ઘણો સારો લાગે. ત્યારે તમે પૂછો કે,

પ્ર.- સાહેબ ! શું આ ક્ષેત્ર અને આ સમય સારો છે ? આના કરતાં મહાવિદેહમાં હોત અથવા અહીં જ માત્ર પચીસ સો વર્ષ પૂર્વના કાળમાં હોત તો વધુ સારું કે નહિ ?

૩.- જે સારું આપણા હાથની વાત નહિ, તેનાં વલખાં શા સારુ ? અને વલખા મારો તેથી સુખી કે દુઃખી ? મન નિશ્ચિત ? કે સચિન્ત ? તો જ વિચાર ફોગટ દુઃખી કરે, ચિંતામગન કરે, તે વિચાર, તે દર્શન શા કામનું ? એના કરતાં અનુકૂળતાનું દર્શન કરો ‘અહો ! વર્તમાનમાં જૈન શાસન સાથેનો જે માનવભવનો કાળ મલ્યો છે, તે જગતના બીજા ભવોના કાળ કરતાં કેટલો બધો મહાન છે ! નરકના જીવને અબજોના અબજો વર્ષો સુધી એક ક્ષણની પણ શાતાત્તા નહિ કે શાંતિ નહિ ! ભૂખનું દુઃખ અસંખ્ય કાળનું ! છતાં કષાયની શાંતિ કે પાપનો તિરસ્કાર નહિ ! રાતી પાઈની વસ્તુ નહિ છતાં ક્ષણનો ત્યાગધર્મ નહિ ! એની અપેક્ષાએ અહીં માત્ર અનંતમા ભાગનું દુઃખ ! ભૂખનું દુઃખ અસંખ્ય કાળનું ! છતાં મિનિટના તપની વાત નહિ ! અનંતગુણી વેદના ! છતાં કષાયની શાંતિ કે પાપનો તિરસ્કાર નહિ ! રાતી પાઈની વસ્તુ નહિ છતાં ક્ષણનો ત્યાગધર્મ નહિ ! એની અપેક્ષાએ

અહીં માત્ર અનંતમાં ભાગનું દુઃખ ! માત્ર અનંતમાં ભાગની ભૂખ ! કેવળ અનંતમાં ભાગની અશાંતિ ! ઉપરથી તપ-ત્યાગનો કેટલો મોટો અવકાશ ! વિચારો કે માત્ર કલાક બે કલાકનું દુઃખ સહન કરાય તો નવકારશી તપથી કેટલો મહાન લાભ મળે છે કે નરકના ૧૦૦ વર્ષના કારમા દુઃખ સહી સહીને ખપતાં પાપો એક નાની નવકારશીમાં ખપે છે ! પછી તો તપમાં આગળ વધતાં દસગુણ-દસગુણ થઈને એક અછમાં દસ લાખ કરોડ વર્ષ જેટલું. આવા તપ-ત્યાગનો અવસર મળ્યો એ કેટલો સુંદર સમય મળ્યો ! ત્યાં પછી શું એવી બૂમો હોય કે ‘દુધ મોંધું, ધી મોંધું, ખાવાની અનુકૂળતા નહિ ? શું જોઈએ ? કહો ‘અહો ! ચાલો ફાયા ! ઓછું મળવામાં, ઓછી ભૂખ લાગવામાં, ત્યાગ-તપની અનુકૂળતા થઈ !’

**પ્રતિકૂલના દાખલા :** અનુકૂળ કેમ જોવાય ? :- માણસ જો ડહાપણથી વિચાર કરે તો ન ગમતી કે પીડાડુપ લાગતી વસ્તુઓ પણ અનુકૂળ બનાવી શકે છે. દા.ત. (૧) પૈસા ઓછા મળ્યા, તો એ અપેક્ષાએ ઠીક થયું કે ગર્વ ઓછો ચઢશે; રંગરાગના વધુ પાપ અટકશે, બીજાને દબાવતા ચાલવાનું નહિ થાય; દેવ-ગુરુને વળજ્યા રહી એમનો વધુ સમાગમ સધાશે. કહો આમાં ક્યાં નુકશાન છે ? ઉલટો લાભ છે. (૨) શરીર માંદું પડ્યું તો પાપની પ્રવૃત્તિમાં ઓછું દોડશે; સાથે જૂનાં અશાતા કર્મના દેવાં ચૂકવાઈ જશે. પરમાત્મા વધારે યાદ આવશે. શું ખોટું છે ભાઈ ! આમાં ? (૩) સ્નેહીઓ પ્રતિકૂલ થયા; કલેશ કરનાર થયા; તોય ઠીક. આપણે એમના તરફ આકષ્યર્થ મોહનું પાપ બહુ કરતા હતા તે ઓછું થશે. સંસારની સ્વાર્થમયતા અને અસારતાનું સચોટ ભાન જગૃત રહેશે. બીજાને પણ દેખાડી શકશે કે ‘જુઓ સંસાર આવો માલ વિનાનો છે.’ એવા સ્નેહી પાછળ, બહુ પૈસા ખરચવાનું દિલ રહેતું હતું, તે હવે નહિ રહે. તો તે બચેલા પૈસા ગુરુદેવ અને ધર્મની સેવામાં ખર્ચ શકાશે. વિરોધી સ્નેહી આપણા ચુનગાન નહિ કરે તેથી આપણને અભિમાનનો આઝરો નહિ ચઢે. કેવા સુંદર લાભ છે ! (૪) દુન્યવી કોઈ આપત્તિ આવી તો આત્મસત્તા અને ગુણરક્ષાના વિકાસના ઈનામ લેવાની પરીક્ષા આવી, એમ માની આનંદિત રહેવાશે. ધૈર્યનો અભ્યાસ સારો તેળવી શકાશે. સમતાની પ્રવૃત્તિ કરવાનો અવસર આમાં મળશે. પૂર્વના મહાદુઃખ અનુભેવલા મહાપુરુષો સારી રીતે યાદ આવી, અનુમોદના ખૂબ કરાશે. દુઃખ ભોગવવાથી પાપકર્મનાં દળીયાં છૂટા થશે.

**પ્ર.-** કોઈને બહુ ઉપકાર કર્યો, પણ તે પછીથી આપણો દુશ્મન થઈ આપણા પર અપકાર કરનારો બન્યો. તો એમાં શું અનુકૂળ ?

**૬.-** ત્યાં અનુકૂળ એ કે “(૧) સારું થયું કે આપણે તો વહેલાં ઉપકાર

કરવાનો લાભ લઈ લીધો. નહિતર એણે જો પૂર્વે અપકાર કર્યો હોત તો આપણને ઉપકાર કરવાની બુદ્ધિ ન થાત.” બીજું. (૨) ઉપકારનો બદલો ઉપકાર મળવાથી તો મન ખુશ થાત કે ‘ઠીક આપણા ઉપકારની કદર થઈ.’ એમ ઉપકારને વટાવી લેત. એથી આપણે કરેલા ઉપકારના મહાન લાભને ઉળટાવીને સોદામાં ફેરવી નાખત; મહા લાભ ગુમાવત. વળી (૩) અનુકૂળતા એ કે જગતની વિચિત્રતા જોવા મલી કે સાવધાની ન હોય તો માનવના અવતારેય સારું કરવાનું તો દૂર રહ્યું પણ બીજાનું બગાડવાનું બને છે. એવા અવસરમાં મારે સારું થયું કે હું સાવધાન થયો, મને ઉપકાર કરવાનું આવદ્યનું. એથી આગળ વધીને (૪) મારે શા માટે એમ માનવું કે મારું એ બગાડ છે. મારું બગાડનાર તો મારા જ પૂર્વના કર્મ છે. એ તો બિચારો દ્યાપાત્ર છે. અથવા (૫) મને પ્રતિકૂળતા આવી એ કર્મક્ષયનો માર્ગ આવ્યો, માટે તો બગાડદ્યનું ન કહેવાય; પણ લાભ કરી આખ્યો ગણાય. આમ વિવેક વાપરીએ તો પ્રતિકૂળતામાં અનુકૂળતા છે. એ બુદ્ધિ રાખવા સારી ચિંતવનાઓ કરી અનુકૂળતાદર્શનના માર્ગો મનમાં નિશ્ચિત કરી રાખવા જોઈએ.

**વ્યવહારમાં અનુકૂળ દસ્તિ :-** આ તો બધી આધ્યાત્મિક દસ્તિ વિચારણા થઈ. પરંતુ જગતમાંય અનુકૂળતાના દર્શનથી કેવા લાભ થાય છે, એ જુઓ. કેટલાક માણસને વાત વાતમાં રીસાવાની ટેવ હોય છે. એવાને આપણે બહુ સાચવવા છતાં, માનો કે, એ રીસાઈ પડ્યા. હવે આપણે એમાં અનુકૂળતા એ જોઈએ કે ‘જે થયું તે ઠીક છે, એમને અતડા રહેવું છે, તો ભલે રહે; આપણે સમય-શક્તિનો અપવ્યય બન્યો. હવે એમને મનાવવામાં સમય ગુમાવવાને બદલે કોઈ સારું પરમાર્થનું કામ કરવામાં સમય ગાળો.’ એવી રીતે ધારો કે મોજશોખની વસ્તુના ભાવ વધી ગયા; તો અનુકૂળતા એ થઈ કે એના ખરચ બચી જશે. જીવન જરૂરીયાતની મોંઘવારી થઈ, તો કરક્કસર, ત્યાગ, સંયમ વગેરેનાં અભ્યાસની અનુકૂળતા થઈ.

**ભલાભાઈ શેઠનું દસ્તાન્ત :-** અરે ! વ્યવહારમાં ડાદ્યા માણસો નરસા પ્રસંગને પણ અનુકૂળ માની લઈ એમાંથી સારું તત્ત્વ શોધી લે છે. અક્કલ એનું નામ કે અસાર દેખાતામાંથી પણ સાર ઉપર જ નજર રાખી સાર બેંચી લે. અક્કલનું દેવાળું એ કે સારમાંથી કચરો શોધે. સાર જોવા પર પેલા ભલાભાઈ શેઠનું દસ્તાન્ત તો જાણો છો ને ? ધરની તેલીનું બારણું ભાંગ્યું તો પત્નીની ફરીયાદ ઉપર કહે છે કે ‘તું મુંઝ મા. જે થાય તે સારા માટે.’

‘પણ આ અંદર ઢોર -બોર પેસી જશે તો ?’

તોય જવાબ એયનો એ ‘જે થાય તે સારા માટે !’ પણ ખરેખર બન્યું એવું

કે એક માંદલું ગધેઠું ઉધાડી તેલીમાં પેસી ગયું અને ઘરના ઓટલા આગળ પડ્યું.  
હવે પત્ની જરા જોસમાં બોલી,

‘લ્યો જુઓ આ તેલીનું બારણું ન કરાયું તો ગધેઠું પેસી ગયું. નહોતી  
કહેતી હું ?’

‘પણ તું ગભરા મા. જે થાય તે સારા માટે.’ કેમ વારું ? શેઠ શું જુએ  
છે ? બહારથી નુકશાન રૂપ લાગતી ઘટનાઓ પણ સારા માટે છે, અનુકૂળ છે,  
એ જોયું. પત્ની આમ ડાહી હતી. શંકા જણાવતી ખરી પણ પતિના બોલ ઉપર  
‘પતિ જે કહેતા હશે તે સારા માટે’ એમ પતિવચનમાં અનુકૂળતા જોઈ લેતી હતી  
તેથી પતિનું કહેવું માની લઈ શાંતિ પકડી. આર્ય મર્યાદાઓની બલિહારી ઓર છે.  
અહીં જો વિરોધ કરે તો જગડો થઈને અશાંતિ થાય બંને ને ! ત્યારે આમાં ? બંનેય  
સુખ શાંતિમાં ! હવે બન્યું એવું કે એજ રાતના બીજેથી ચોરી કરીને માણસો  
નીકળતા હતા. ત્યાં પાછળ કોઈ પકડવા દોડે છે એવો એમને વહેમ પડ્યો. તેથી  
આ તેલી ઉધાડી દેખી, એમાં પેઠા, પણ અંધારામાં વચ્ચેમાં પેલી ગધેરી નડી.  
પટકાયા એના ઉપર. એમાં એવા ગભરાણા કે માલ તો હાથમાંથી ત્યાં પડી ગયો,  
એટલું જ નહિ પણ પોતેય એ અને બીજી ગભરામણે ત્યાં ઊભા ન રહેતા ત્યાંથી  
ભાગી ગયા. અહીં તો વહેલી પરોઢે બાઈ દીવો લઈ ઘર સાફ કરતી બહાર  
આવી. જુએ છે તો સોનાનો માલ પડેલો જોયો. અટ પતિને જગાડી લાવી દેખાડ્યો.  
‘શું બન્યું હશે ?’ એમ પૂછે છે. પતિ ચકોર હતો. કહે છે “રાતના કોઈ ચોર  
આવેલા હશે તેનું આ પરિણામ. ગધેરી સાથે ભટકાવાથી ગભરાવાને લિધે બન્યું  
લાગે છે. કહે તેલીનું બારણું બંધ હોત, ને ગધેઠું અહીં પડ્યું ન હોત, તો આ  
બનત ? માટે જ કહું શું કે જે થાય તે સારા માટે.”

અહીં ખૂબી એ છે કે માનો કે કદાચ આવું કાંઈ ન પણ બન્યું હોત તોય  
મનમાં વિકલ્પ કરવાથી શું વળત ? ઊલદું એની ચિંતામાં ખાવા-પીવાની કિયાઓના  
સુખ ઉડી જાત.

**અનુકૂળ દર્શન બીજી રીતે :-** આપણા મનને અણગમતા, અનિષ્ટ લાગતા  
પ્રસંગમાં અનુકૂળતા જોવાની એક વસ્તુ થઈ. હવે બીજી વસ્તુ એ છે કે મનુષ્ય  
જન્મથી માંગીને આયદિશ-આર્થકુલ-પાંચેય ઈન્દ્રિયની પદૃતા વગેરે વગેરે ઠેઠ સુદેવ-  
ગુરુ-ધર્મના સંયોગ સુધીની સામગ્રી આપણને જે મળી છે, તેમાં ઉચ્ચ કોટિની  
આત્મોન્તતિ સાધવાની કેવી સુંદર અનુકૂળ તક છે, તેનું દર્શન કરવાનું છે. એ  
કરવા માટે એની સામે તિર્યંચપણું, અનાર્થદિશ-કુલ, આંધળા-બહેરાપણું...ઈસ્લામાદિ  
ધર્મ વગેરેને દાખિ સામે લાવીને ત્યારે મનુષ્યપણું વગેરે ઉત્તમ સામગ્રીમાં કેવી કેવી

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ” (ભાગ-૧૮)

૨૧

મહાન અનુકૂળતા છે તે સમજાય; શી શી નાનેથી મોટ મોટી સાધનાઓની શક્યતા  
છે, તે સચોટ જ્યાલમાં આવે. એ પછી તો સાધનામાં પુરુષાર્થ જોરદાર જાગે.

વાત એ છે કે અનુકૂળતાનું દર્શન કરવાની કળા કેળવો. પહેલી કળામાં શું  
કર્યું ? વસ્તુ માત્રમાં એની જે ઠેઠ ઊંડાણ સુધીમાં અને દીર્ઘ પરંપરાએ યથાસ્થિતિ  
સ્થિતિ છે, ગુણદોષ છે, એનું દર્શન કર્યું. બીજી કલામાં ક્ષેત્ર, સમય, સાધન,  
સંયોગો. ને સ્થિતિ જે મલ્યાં એમાં કેટલી કેટલી આત્મગુણ-વિકાસ, દોષદ્વાસ  
કર્મક્ષય, દાખિશોધન, આત્મ-કલ્યાણ વગેરે સાધવાની અનુકૂળતા છે, તે જોવાની  
ચતુરાઈ કેળવવાની છે. ‘સમય હલકો નહિ પણ ઉચ્ચ મલ્યો છે,’ - આ જોતાં  
આવડે કે એના એજ કળને માણસ પાપકાળમાંથી ધર્મકાળ બનાવે ! દુર્ધાન, ખોટા  
ચિંતન, સંકલ્પ-વિકલ્પો અને દુર્ધાનના સમયમાંથી શુભ ભાવનાઓ અને શુભધ્યાનના  
સોનેરી સમયમાં આવી જવાય. એની એજ ક્ષણને દીનતા, ઓશિયાળાપણું, શોક  
અને પોકમાંથી હટાવીને મહાન ઓજસમાં, મહાન ભાગ્યશાળીપણાના ગૌરવમાં,  
અને ઉચ્ચ કોટિની સાન્નિક વિચારણામાં ફેરવી નખાય. કળા આટલી કે  
કપરાસંયોગમાં પણ અનુકૂળતા શી છે તે જોતાં આવડાં જોઈએ. તો આત્મામાં  
અજબ ફેરફાર કરી શકીએ. નહિતર પછી કેટલાકને ફૂટેવ હોય છે, સારામાં સારી  
સ્થિતિમાં પણ રોદણાં જ રોયા કરે. એને તો ખરેખર અનુકૂળ કાળ પણ પ્રતિકૂળ  
જેવો. કેમકે એ અનુકૂળતા નહિ ઊઠાવે. મદનરેખાએ પોતાનું જીવન દર્શનની  
વિશિષ્ટ કળાથી ભરેલું છે. એથી એનું અને એના સંયોગોમાં આવનાર આત્માઓનું  
દા.ત. પતિને બે પુત્રોનું મહાન કલ્યાણ સધારેલું છે. એને જ્યાલ છે કે સમયની  
અનુકૂળતા માત્ર નરકના જીવ કરતાં જ નહિ, કિન્તુ એકેન્દ્રિયાદિ કરતાંય ધર્ષી  
ઉંચી, ઉચ્ચ, કલ્યાણકારિણી મળી છે. એટલું જ નહિ પણ દુનિયા પર અનેકાનેક  
માનવો કરતાં જે આ જેણ કુળમાં મળેલો અવતાર, તે અજબ કોટિનો છે. માંદ્વધવારી  
હાડમારી છે તેથી શું ? સાવધાની વધારે આવશે; પુણ્ય-પાપનો જ્યાલ જાગૃત  
રહેશે. પૌદ્ગલિક અનુકૂળતા એટલે તો વધુ પ્રમાણી અને બિનસાવધાન બનવાનો  
ભય. પ્રતિકૂળતા મનને એમ સાવધાન કરે છે કે (૧) આ બધાં તોફાન શાથી ?  
સમજ કે ‘આપણા પૂર્વના પાપ વિના કોઈ દુઃખ દેનાર નથી.’ માટે જગતને દોષ  
દેવાનો છોડી, તારા પાપને દોષ દે. (૨) સાથે એ પણ જો કે બહુ સારો સમય  
તું ક્યાં પચાવી શકે એમ છે ? એમાં તો કોઈ કામ, કોષ, માન, લોભના વિકારોને  
વશ થાત. દેવાંગના મળી હોત તો એની લુભ્યતામાં આખો દૂબી જાત. લક્ષ્મીના  
ઇક્ક ઇક્કામાં ઘમંડનો પાર ન હોત. ઈન્દ્રિયો અને મનના દ્વારા અજ્ઞાન અને મૂર્ખ  
રીતે વસ્તુને દેખવામાં દૂબી ગયો હોત. એવા બધા દોષમાંથી બચાવી લેનાર

૨૨

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા- દર્શનની પ્રદ્વિષ કલા (ભાગ-૧૮)

વર्तमान समय सारो के खोटो ? नरकादिमां पटकनार दोषप्रापक समयने बदले गुणप्रेरक समय ए अनुकूળ के प्रतिकूल ? छतां

प्र.- ‘वधु पड़ती प्रतिकूलता होवाथी चित विहृण रहे छे; तेथी धर्ममां के कोई सारी वातमां चित लागतुं ज नथी. पछी शी रीते समय अनुकूल भासे ?’

६.- अहीं ए विचारवानुं छे के प्रतिकूलता खमाती नथी. तो पछी अगवड नभावी लेवानो अभ्यास क्यां पाडवाना ? मनने अने आत्माने क्षवानो समय क्यो ? सहन-शक्ति केणववानी तक कर्द ? ध्यान राखो, सोनुं अजिनमां शुद्ध थाय छे; चंदन वहेरावा उपर महेक भारे छे; तो आपत्तिमां गभरावानुं शुं ? त्यारे आपणा बांधेला पाप सिवाय आपणने कोई हुःख आपनार छे ? तेम, ए पाप भोगव्या विना धूटको छे ? खरी रीते तो ए विचारवुं जोईअे के आट आटली आपत्तिनी वयमां पण केवी सरस शरीरादिनी अनुकूलता भली छे ! केवा सरस साधनो मल्यां छे ! शरीर, इन्द्रियो, हाथ-पग अने हृदय केवुं ? भगञ्ज केवुं ? निकटनुं ने बहारनुं कुटुंब केवुं मल्युं छे ! भित्रमंडणनुं सर्कल केवुं ? देवगुरुने धर्मनां साधनो केवां ? बधुय झेवरमां छे, अनुकूल छे ! केवी रीते ? इन्द्रियो यकोर छे; आंभो क्लाकोना क्लाको जिनेन्द्र देवना मुखडां नीरभ्या ज करे ! मन प्रभु-स्मरण चितन पेट भरीने पीअे ! कान जिनवाणीना प्रवाहमां क्लाकोना क्लाको जीत्या ज करे ! अने ज्ञाती तो सत्यवयन जिनवाणी, परमार्थवाणी, कोईना गुण गावानी वाणी पूर बहारमां वहावी शकाय ! त्यारे शरीर केवुं छे ? सरस ! देवगुरु संघनी सेवा, धर्मकरणी, तपस्यादि धाणी धाणी साधना धर्मनी करी शके अेम छे. शरीरने समजावी दीधुं के “चौदस छे आजे, तेथी खावा नहि मणे.” तो कर्द नहि, शरीर बणवो नहि करे. भूख लागशे ते तो पेली भूतकाणनी कूटेवथी; पण अने बणशे नहि तेथी कपाती धसाती जशे. त्यारे केवा सरस हाथपग ? सारी रीते दया, परोपकार अने प्रभुभक्ति आदि परमार्थना काम करी शके. ज्यां नवरा परीअे के विचार थयो. “कूरसद छे तो चाल देवगुरुना दर्शने. तो पग तेयार. नवकारवाणी गणवी छे. तो हाथ तेयार छे.” जो समज्ञअे, जो रोदणां न रोईअे, तो साधन केवां सरस अनुकूल देखाय ? उच्य कोटिनी साधना करवा भाटे भारे अनुकूल ! तिर्थयनी दशा साथे सरभावो तो ठीक समजाशे. पंखी अनाजना कणामां, शिकार पक्षीना शिकारनी शोधमां घुम्या ज करशे. गाय, भेंस, बकरा वगेरेना, माछला, मरघाना त्रास देखाय छे ने ? पाछो अने धर्म शो ? अहीं आपणे तिर्थयपाणु नथी, अेकेन्द्रियादि के अनार्य भनुष्यपाणु नथी. पाकीस्तानी नथी. उमदा संयोगो छे. कुटुंब गमे तेवुं तो पण आर्य कुटुंब ! ढेड-भंगी ने वसवायानुं नथी. आ

अनुकूलतानुं दर्शन करतां आवडे तो अल्प आयुष्य होय, ने एक बे भिनिट ज आई बाकी होय छतां आत्मा उच्य भावनामां यढी महान सद्गति साधी ले ! अेवुं दर्शन मदनरेखाअे कर्युं हतुं, ने पतिने कराव्युं ! पतिने तो भोटाभाईअे खडगनो धा कर्याथी मोत अने क्षायमां नरक तरफनुं प्रयाश शरु थर्द गया जेवी स्थिति हती. पण मदनरेखाअे छेल्ली धडीमां सुजाई दीधुं, ‘जुओ, आ भाई दुश्मन नथी, दुश्मन तो आपणा पूर्वना करेला कर्म छे. अने भोगवी नाश करवामां भाई निमित भन्या तेथी उपकारी गणाय. बाकी केवा सरस आरिहंत प्रभु अने अेमनुं शासन मध्या छे ! भरवानुं तो भवे भव मणे ज छे. नवकार मंत्र अने चार शरणा मणवा दुर्लभ, ते मध्या छे. वणी दीर्घकाण कठोर चारित्रनी आराधना तो मुश्केल छे; पण आ तो आवा ज्ञवलेण धानी कारभी पीडा वजते भिनिट बे पांच भिनिट मन साखुत राखी समता समाधिमां जीलो तो सद्गति साधवानी महान अनुकूलता छे. तो आवी सुंदर अनुकूलतावाणी अंतधीनो लाभ कां न लेवो ?’... आवी आवी रीते पतिने अनुकूलताना दर्शन करावी साधनामां एवो यढावी दीधो के ए भरीने पांचमा देवलोकमां याल्यो गयो.

अनुकूलता सामे खोटां बहानां :- मदनरेखाअे के युगबाहुअे अेम विचार्यु डोत के ‘आमां शुं समाधि रहे ?’ तो उंधु मारत ने ? धर्मनी सामे प्रतिकूलतानुं बहानुं उंधु करी ज्ये केई विकल्पो अने केई मनोरथो धडी राख्या हशे, पण खबर नथी के अेनी पूँठे जे काणनी सत्ता काम करी रही छे, ए एकी वजते बधुं साफ करी ज्येत ज्येतामां एकला अटुला रांक ज्वने क्यांय उपारी जशे ! भाटे एवा क्रीडा जेवा घेला मनोरथो धोडी महापुरुषो ये साधेला मनोरथ करवा. ए भाटे वर्तमान संयोगोने साधनामां अनुकूल मानी लेवा. दर्शननी क्ला ए तो मानव आत्मानी शाबाशी छे. एथी संसारमां गमे तेवा संयोगोमां पण मोक्षमार्गनी कोईने कोई साधना शक्य बनावाय छे. तेथी अहीं भोक्तना सुखनी वानगी याखी शकाय. सामग्रीमां अनुकूलता ज्येतां आवडवी जोईअे. पछी प्रतिकूलताज ज्येया करवी होय तो साधना नहि थाय. ‘शील सारुं छे, पण माता ना कहे छे ! कहे छे हज तमे बंने नाना छो.’ ‘तप करवो छे पण भूख बहु लागे छे, तप केम थाय ?’ हुःभी सामे आवे त्यां दया करवा जेवी स्थिति छे, पण आपणी पासे छे शुं, ते दया दान करीये ? सामग्री परिस्थिति अनुकूल नथी.’ ‘कुटुंब स्नेही साथे धाणुं य उदारताथी वर्तवुं छे. पण ज्यां स्नेह, प्रेम, भाव नहि त्यां शुं थाय ?’ धंधा भजारनी स्थिति तो महा धांधलवाणी छे, अेमां क्यां परमार्थ के धर्म थाय ? ‘मंदिरमां तो भीड बहु थाय छे.’ तो उपाश्रयमां साधु महाराज तो ठीक

હે ને ? ‘ના, એય બરાબર નથી. એકલી ત્યાગ ને તપની, વ્રત ને સામાયિકની વાત કરે છે. આપણાને કંઈ રસ આવે નહિ. એ જોઈએ તે આપી શકે તેમ નથી.’ ત્યારે શું અનુકૂળ છે ? કશું નહિ. બધું જ પ્રતિકૂલ છે. હવે કહો આમાં ક્યારે ઊંચો આવવાનો ? ખૂબી પાછી એ કે બધું આત્મસાધના માટે જ પ્રતિકૂળ હોય ? તેથી જ આત્મસાધના નથી કરવી. સંસાર સાધવા માટે તો બધું અનુકૂળ છે, તેથી સંસાર ચલાવવામાં અટકાતું નથી.

**નરકાદિની દિષ્ટિએ અનુકૂળતા :-** દર્શનની કળા આત્મહિતની સાધના માટે અનુકૂળતા જોવાનું એવું શીખવે છે કે એ સાધના ચારે બાજુની વિવિધ સાધના બને, અને તે અખંડ ચાલે. ધર્મ ન કરવા દેવા માટે મોહરાજાએ પૂર્વના અનંત ભવોમાં શું શીખવ્યું ? એક જ, રોદણાં રોવાનું ! રોદણાં રોવા સિવાય જવને આજસુધીમાં બીજું આવક્યું છે શું ? પૂર્વે પ્રસંગો તો કેઈ સોનેરી હતા, પણ એને ધર્મસાધનામાં પ્રતિકૂળ છે, અનુકૂળ નથી એમ કથીરના કરી કરીને જીવને માયકંગલો કરી નાખ્યો. ટૂકડા રોટલા પાછળ કૂતરો કેવો ચાટુ કરનારો ? હવે આજે ફરી પાછું શું ? એવી જ રોટલા-પોટલા પૂરવાની ધાંખલ ! એકેન્દ્રિય કે ક્રીડા-પણ વગેરે ભવોમાં ભયંકર મારનો પાર નહિ; નરકમાં ખાવા-પીવા કણ કે ચાંગળું પણ નહિ, અપમાન અવગણનાનો હિસાબ નહિ, ઉપરાંત ઘોસ ગ્રાસ ! ત્યાં કોઈ હાથ પકડી કહે, ‘ભાગ્યવાન ! બોલ, ભવમાં ભટકવું છે ? અહીંથાં ભડીની અંદર મકાઈના ડોડાની જેમ શેકાવું છે ? બોલ, અહીંથી છોડાવી સંયમ-જગતમાં લઈ જઈએ તો આવવું છે ? પણ ત્યાં ધીખતી શીલા પર કાઉસ્સણ કરવા પડશે. ઇ છમાસીના તપ કરવા પડશે. સાધુની લાતો; ગુરુના ઠપકા-શિક્ષા સહવા પડશે; આહાર કુસ્કાનો, ને પાણી ઉકાણેલું ઉનું મળશે. બોલ તૈયાર છે ?’ તો હા પાડે ને ? કહે, ‘પહેલો તૈયાર ?’ સહી કરી આપે ! શા માટે ? જે આ બધું તમારી દિષ્ટિએ મહાપ્રતિકૂળ, તે એને મહાઅનુકૂળ લાગે છે. પાપ ધોવા માટે, આજે ઉપવાસ તો કાલે કુસ્કીનું નહીં પણ માલ-પાણીનું પારણું મળે એમ છે, છતાં ઉપવાસ માટે કાયા ઠીક નથી ! પ્રતિકમણ પછી કોંચની મખમલી શય્યામાં સુવાનું મળે છે, તોય પ્રતિકમણ માટે સમય નથી ! કદાચ થોડું ધન દુઃખીને આપો તોય પછી બચત કેટલી બધી રહે છે; છતાં દાનની અનુકૂળતા નથી લાગતી ! જીતમાં કેટલું ઠાંસવાનું ? પેટ પર હાથ પંપાળી શકાય એટલું ને ? તે પછી પણ સાધમણી યાદ કરવાની અનુકૂળતા નથી, કેમ ? ધર્મની વાતમાં નનો ભણવાનો ? મારી પાસે શું છે ? આ સામે આવતી લક્ષ્મીને લાત મારવા જેવું નથી ? જરા વિચાર નહીં કે, કોને લાત મારી રહ્યો છું ! દાનને લાત એટલે ભવિષ્યમાં શ્રીમંતાઈને લાત અને દરિક્તાને નોતરું

કે બીજું કાઈ ? ખાતો, પીતો, ઓઢતો; ઘરે બે-ચાર છોકરા, ધર્મથી તો આ બધું છે ! એજ ધર્મની સામે વિદ્ધાઈ ? મનને તમાચ મારવાનું થાય ? મન ! તું મને આવું શીખવે છે ? સંસારનું લોખંડી ગાડું ખેંચવા બધી કાયા તૈયાર; જ્યારે જિનાજ્ઞાની નાની રેકડી તાણવા બળ નથી; સમય નથી, સામગ્રી નથી ! વાહ ડહાપણ ! ધર્મરાધનાનો ભાવોલ્વાસ જગાડો, ઉત્સાહ વધારો, વિચારો કે અનંત કાળમાં આવો પ્રસંગ કારો ? ભગવાનને મેરુ પર લઈ આવવા ઈન્દ્ર પાસે કરોડો સેવક દેવો હતા; પણ ઈન્દ્રને કેમ સ્વયં લાભ લેવાની વાત ? કેમ નોકરો પાસે ઉપદાવવાની વાત નહિ ? “પ્રભુ મારા નાથ ! હું ઈન્દ્ર બન્યો તો એમની ભક્તિ કરવાની મહાન અનુકૂળતા મળી. એનો અણમોલ લાભ લઉં.” આવી સીધી અનુકૂળતાનું દર્શન જગત છે માટે. ઊંધી અનુકૂળતા જોઈ હોત તો નોકરની સગવડ દેખત. પાછું પ્રભુને ત્રણ લોકના નાથ માન્યા પછી એક છોકરો તેજો હોય તેમ તેડી લઈ જવાનું નહીં પણ પાંચ રૂપ કરી પ્રભુને ચામર, છત્ર, વજના ઠઠારા સાથે લઈ જવાના. અનુકૂળતા જોતાં આવડવું જોઈએ.

### ● ૩. આત્મીયતા - દર્શન ●

**સાત્ત્વિક દર્શન** અને અનુકૂળતા દર્શન પછી ત્રીજુ મહાન દર્શન છે આત્મીયતાદર્શન. એ માત્ર ચેતન જગતને લાગુ પાડે છે. અર્થાત્ ગ્રાણી માત્રને આપણા પોતાના સ્નેહી સમજવા જોઈએ. કોઈનાયે પ્રત્યે હૃદયમાં દ્વેષ-દુષ્મનાવટ કે ઈષ્ટ-અસૂયા ન રાખવી જોઈએ; કારણ એ છે કે એ વૃત્તિઓ ખોટી રીતે આપણા શુભ હૃદયનો એવો કબજો લઈ લે છે કે એવા દ્વેષમાં તણાયે આપણાથી કાંઈ બની શકવાનું હો કે ન હો, પણ હલકી તામસી વિચારણાઓ હૈયામાં રમ્યા જ કરે છે. ત્યાં પછી આપણી બીજી પુણ્યાર્થિનું સુખ અનુભવવાનું દૂર જાય છે અને સામાનું ગમે તે થવાનું હોય, પણ પહેલાં તો આપણે જ દુઃખમાં પડીએ છીએ. ત્યારે આત્મીયતા અર્થાત્ મિત્રતા અથી બચાવે છે.

**જેમ સાત્ત્વિક દર્શન** કરવાથી વિકલ્પોના દુઃખ ટળે છે, દીનતા જાય છે, હાયવોય-દુર્ધ્વાન અટકે છે, અને કર્મબંધથી બચાવે છે; તેમજ અનુકૂળતાના દર્શનથી ખરાબ ગણાતી સામગ્રીને સારામાં સારી આત્મહિતને અનુકૂળ બનાવી શકાય છે, અને એમાંથી એ પ્રમાણે લાભ ઉઠાવાય છે; તેવી રીતે આત્મીયતાના દર્શનથી જીવમાત્રમાં મિત્રતાની બુદ્ધિ કરાય છે. તેથી આપણા ઘોર અપરાધીને પણ જ્યારે આપણે એમ માન્યો કે “આ મારો છે સંયોગવશાતું એણે આ ભૂલ કરી નાખી છું. તો જેમ વહાલામાં વહાલો આપણો દીકરો મોટી ભૂલ કરે તોય એની

પ્રત્યે આપણે દુશ્મનાવટ નથી કરતાં. તેમ આની પ્રત્યે પણ શા માટે કરવી ? ગમે તેમ તોય એ મારો મિત્ર છે.” સામાના પર ગુસ્સો થતો કોણ અટકાવે છે ? ‘મારો એ અંગત સ્નેહી છે’-એવી આત્મીયતાની બુદ્ધિ.

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદધિ”

વર્ષ-૩, અંક-૬, તા. ૮-૧૦-૧૯૫૪

### ૩ દર્શનની ખડવિધ કલા.

હવે આજે એ મુસીબત છે કે એક કુઠુંબમાં પણ તેવી સ્નેહાળ આત્મીયતા બુદ્ધિ કમી થઈ ગઈ છે. તેથી પ્રેમ, મિત્રતા, શાંતિ વગેરે વધવાને બદલે પરસ્પર દ્વેષ, કલેશ અને વિરોધ વધ્યા છે. પતિ પત્ની પ્રત્યે અને પત્ની પતિ પ્રત્યે અરુચિ ધરાવે છે. વિરોધ ધરાવે છે, જગડા કરે છે. એવું જ પિતા પુત્ર વધ્યે, માતા પુત્ર વધ્યે, સાસુ વહુ વધ્યે, કલેશની ભર્તી સણગતી છે. એથી આગળ, શેઠ-નોકર, દ્રસ્તી અને બીજા, પ્રમુખ-સેકેટરી વગેરેમાં આપસઆપસ કલેશ, દ્વેષ, અને વૈરવિરોધ વર્તે છે. એમાં મોટા ભાગે કારણ આત્મીયતાને બદલે પરતાનું દર્શન છે. ‘સામો મારો સાચો સ્નેહી નથી, મારા દુશ્મન જેવો પારકો છે, મારું બગાડનારો છે, મારી સામે થનારો છે, આપણે કાંઈ વિશ્વાસું નહિ; મિત્ર નહિ; એકહંદ્યો નહિ;’ વગેરે વગેરે બુદ્ધિ થાય છે. તેથી મહાન જગડા-રગડા જામે છે. દ્વેષ પોસાય છે. ઈર્ધા થાય છે, નિંદા થાય છે. પ્રમોદભાવને વિસરાય છે. પ્રભુ મહાવીરદેવે ચંડકોશિયા જેવાને પોતાનો ગણ્યો તો એનું કરડવાનું વેઠીને પણ એનો ઉદ્ધાર કર્યો. નહિતર તો એમ થાય, ‘જવા દો નાલાયકને. એ ઘાતકી છે.’ આમ સામાન્યાં છૂંધી ઉત્તમતા હોવા છતાં અધમપણાની બુદ્ધિ થાય ! સામો દયપાત્ર હોવા છતાં દ્વેષ કે ઉપેક્ષણીય છે, એવું દેખાય ! પોતાની વિશિષ્ટ શક્તિઓનો સુંદર ઉપયોગ પરના ઉદ્ધારમાં થઈ શકે એમ હોય, તેના બદલે એ દિવ્ય શક્તિઓ એમ જ વેડફાઈ જાય, કે ઊલટી ઊંધા કાર્યોમાં રાક્ષસી શક્તિનું કામ કરનારી બની જાય. એનું કારણ એ છે કે જ્યારે આત્મીયતા ભૂલીને આવા આવા હુઃખી કે દુર્ગુણીના ઉદ્ધારમાં શક્તિ ન ખરચવી હોય ત્યારે એ શક્તિ બીજે કયા ઉપકારમાં જવાની હતી ? દુર્ગુણીના ઉદ્ધાર કરવા માટે તમારી પાસે પૈસા હોય તો તો એ પૈસાની તમારી પાસે વિશિષ્ટ ધન-શક્તિ ગણાય. દુર્ગુણીને સૌભ્યતાથી હિતની સલાહ આપવાની બુદ્ધિ તમારી પાસે હોય, તો એ વિશિષ્ટ બુદ્ધિ-શક્તિ ગણાય. એમ સામો તથ્યો હોય, પણ તમે ખામોશ રાખી કાંઈ ન બોલો-ચાલો, અને તેથી સામો ઠંડો પડે, વહુ કખાયથી બયે, ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ” (ભાગ-૧૮)

૨૭

તો એ તમારી સહિષ્ણુતાની શક્તિ વિશિષ્ટ મન-શક્તિ ગણાય. આ શક્તિઓ વપરાય ક્યાં ? કહો જેના પર આત્મીયભાવ હોય, આ મારો સ્નેહી છે, વિરોધી નહિ,-આવી ભાવના હોય ત્યાં.

શ્રીપાલકુમારે યુદ્ધભૂમિ પર મિજાજ અને વિશ્વાસધાતી અજિતસેન કાકાને હરાવ્યા પછી આત્મીયતા એવી દાખવી કે રાજ્ય પાછું સોંપવા માંડયું. તેમ આજે કોઈમાં સામાને હરાવીને એની લૂંટ અને પાછી સોંપી દો ખરા ? કે ઉપરથી દંડ ઓકાવો ? અહીં ખૂબી એ થઈ કે અજિતસેને ત્યાં જ સંસાર ત્યજ સાધુપણું લીધું ! એવું જ વાલી રાજાએ રાવણને હરાવ્યા પછી એનું પડાવી લેવાને બદલે પોતાનું બહુ છોડ્યું. ભાઈ સુશ્રીવને રાવણની આજ્ઞા નીચે સ્થાપ્યો, રાવણને બેન પરણાવી, અને પોતે ચારિત્ર લીધું. કેવી આત્મીયતા !

આત્મીયતાથી જેમ પીડિત પર દ્યા વરસાવાય છે, તેમ ઉન્નતિવાળા ઉપર પ્રેમ વરસાવાય છે. તેથી ઈર્ધા નથી થતી; પણ પ્રમોદ થાય છે. નિંદા અરુચિ નથી કરતા, ગુણાનુરાગ અને વાત્સલ્ય કેળવાય છે. જો આપણી જત માટે આપણને પુરેપુરો મહત્વભાવ છે, તો તેથી કોઈ વાર પણ આપણે આપણા તરફ દ્વેષ કે આપણી નિંદા નથી કરતાં, તેમ બીજા પર પૂર્ણ મમતા હોય તો એના પ્રત્યે દ્વેષ કે એની નિંદા નહીં કરીએ. પરંતુ જ્યારે નિકટમાં નિકટના પણ સ્નેહી ઉપરેય સહેજ પણ મમત્વ ઓછું થાય છે, ‘આ આપણે એટલા અનુકૂળ નહિ, એટલા વિશ્વાસુ કે સમર્પિત નહીં’- એવું જરા પણ મમત્વ ઓછું થાય છે, ત્યારે એના પ્રત્યે અરુચિ, ને એની નિંદા કરીએ છીએ. આ નિંદા, દ્વેષ, ઈર્ધા વગેરે દોષો પોતાના જ આત્માના કેવા મહાન દુશ્મન છે એ ક્યાં નથી સમજાય એવું ? ઉત્તમ જીવનમાં મળેલી તત્ત્વ ચિંતન, ગુણાનુરાગ, મહાપુરુષના જીવનની વિચારણા અને અભ્યાસ વગેરે સાધવાની અમૂલ્ય તક શુમાવાય છે. કેમકે પેલામાંથી પરવારાય, તો આ થાય ને ? આ તત્ત્વચિંતનાંદિ જો ન થાય તો આનાથી નીપજતા મહાલાભો ગુમાવાય છે; અને નિંદા ઈર્ધાથી આ ભવમાં અને ભવાંતરમાં મહાદુઃખો વહેરાય છે. બસ, એથી ભચવાનો અદ્ભુત ઉપાય આત્મીયતાનું દર્શન કરવાનો છે. જગતમાં સૌ કોઈને આપણી જત જેવા પોતાના ગણો; એટલે દ્વેષ, નિંદા વગેરે દોષો રવાના થઈ જવાના.

પ્ર.- પણ એ આપણનું બગાડે ત્યારે તો દ્વેષ થાય ને ?

૩.- પાણ ભૂત્યા. બગાડવા માત્રથી કોઈ દ્વેષપાત્ર નથી બનતો. એને પારકો ગણીએ છીએ પછી એ દ્વેષપાત્ર બને છે. એમ તો આપણી જતે વગર વિચારે કેટલાંક કામ કરીને આપણનું પોતાનું ક્યાં નથી બગાડતા ? છતાં ક્યાં દ્વેષ

૨૮ ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા- દર્શનની ખડવિધ કલા (ભાગ-૧૮)

થાય છે ? ત્યારે ત્યાં તો જત માટે જેમ સમાધાન કરી લઈએ છીએ કે ‘શું થાય ? સંયોગો જ એવા હતા કે આપણને આવું કરવાનું સૂજયું. બાકી આપણે જાળી જોઈને થોડું જ કર્યું છે ?’ તો તેવી રીતે બીજા માટે આ સમાધાન ન કરી શકાય ? ‘શું કરે એ ? એના સંયોગજ એવા હતા કે એને આવું કરવાનું બને. એની જગાએ હું હોઉં તો હુંય આવું કરી બેસું એવો છું. માટે એને દોષ ન દેવો, એના પર દેખ ન કરવો. અવસરે જેમ બીજા તરફથી આપણી જત માટે દ્યા ચાહીએ છીએ તેમ આપણા તરફથી એના પર દ્યા વરસવા દો,’ આમ મન મનાવી સામા પર દ્યા ન ચિંતવી શકાય ? શું દેખ જ ચિંતવવો પડે ? એકવાર આત્મીયતાના દર્શનનો અનુભવ કરવા માંડો, અને દુશ્મનને પણ પ્રેમ બક્ષિતા જાઓ, પછી જોજો એના પર કેવી સરસ અસર થાય છે ! અને તે કદાચ ન પણ થાય તોય તમારા કલેજે કેટલી બધી ઠંડક અને ચિત્તમાં કેટલી બધી પ્રસન્નતા રહે છે. તે જોજો !

**આત્મીયતાના દર્શનથી ભાવદ્યા :-** આત્મીયતાનો વિચાર વધુ વિકાસવાળો બને ત્યારે તો એટલો બધો ભાતૃભાવ પ્રગટ થાય કે બીજા પર ભાવદ્યાનો ધોખ આપણા ડેયામાં વહેવા માંડે. તેથી પહેલાં નંબરમાં તો આપણી કોઈ એવી પ્રવૃત્તિ ન થાય કે જેથી સામામાં મોહની, પાપવાસનાની જગૃતિ થાય. આજનો ઉદ્ભબ વેશ અને ચેષ્ટાઓ પણ આ ભયંકરતા સર્જે છે. પાપની સલાહો પણ આ ભયંકરતા સર્જે છે. પાપની સલાહો પણ આ ભયંકર કામ કરે છે ત્યાં આત્મીયતા શી ? જેના પરિણામે સામો જીવ દુર્ગીતિમાં પટકાય. ત્યાં ભાતૃભાવ કેળવ્યો ગણાય કે શત્રુભાવ ? ‘મારા નિમિત્ત કોઈ પણ જીવબંધુ બિચારો પાપબુદ્ધિમાં ન ફરી પડો. એથી એ નરકાદિમાં ન પડો.’ એ વિચારમાં આત્મીયતાનું દર્શન છે. મદનરેખાના મનમાં આધાત છે. ‘મારું પાપી રૂપ બિચારા ઉત્તમ ગુણસંપન્ન નિર્દોષ પતિના મરણમાં નિમિત્ત થયું. એવા રૂપમાં અજીન કાં ન મૂકાયો ? એ કરતાં હું ગર્ભમાં સરી કેમ ન ગઈ ? બિચારો એ રાજ પણ રૂપના પાપમાં લુબ્ધ થઈ સદાચારને ભૂલ્યો !’ જો દર્શનની કલાની આવડત હોય તો સાત્ત્વિકતા તેળવાય, સાચી અનુકૂળતા જોવાય, અને આત્મીયતાની ભાવના વિકસાવાય. શું આજે રૂપનાં અને અંગો-પાંગોનાં પ્રદર્શન તથા બોલચાલના ટાયલાં કરતાં, કે સફાઈ બતાવતાં ભાનબાન રહેતું હશે કે કોઈ નિર્દોષ જીવો, જે ખોટા સંયોગ નથી મળ્યા માટે બચેવા છે, એને ખોટા સંયોગ આપી વાસનાના દાવાનળમાં ન જીકું ? એવી ભાવદ્યાની બુદ્ધિ રહેતી હશે ને ? તો તો પહેલેવેશ અને બોલચાલ એવા સુશીલતાના રક્ષણાર્થ થાય કે જ્યાં નિર્દોષ જીવ વિકારવશ ન બને; જ્યાં પોતાની પવિત્રતા જળવાઈ રહે,

આર્થ સંસ્કૃતિના સંબંધની વફાદારી રહે, અને પાપી વિચારણા ન જાગી આવે. સુશીલતાના સંરક્ષણની મર્યાદા કેટલી બધી કંડક છે તેનો એક દાખલો જુઓ.

પરમાત્માના દર્શને જતાં પાંચ અભિગમ સાચવાના કચ્ચા છે. એમાંનો એક પ્રભુને દૂરથી જ દેખતાં મસ્તકે અંજલી જોડી ‘નમો જિણાણં’ કહેવાનો છે; પણ સ્ત્રીઓને આ અભિગમનો નિષેધ કર્યો. સ્ત્રીઓથી હાથ જોડી ઊંચા ન કરાય. એને એટલું બધું મર્યાદાશિલ રહેવાનું; જેથી બીજાને અનુચિત જોવાનું ન બને. શું આ ? ભાવદ્યા; આત્મીયતા.

#### ● ૪. સ્વદોષદર્શન ●

આત્મીયતાના દર્શન પછી સ્વદોષદર્શન વર્ણવવાનું છે. સ્વદોષ-દર્શનનું ઘણી વાર વર્ણન થયું છે, તેથી એને ટુંકમાં જોઈશું. જેમ પૂર્વે કહેવા ત્રણ દર્શનથી દુઃખ-નાશ, લાભ-પ્રાપ્તિ અને દ્યા-પ્રેમ થાય છે, તેમ ચોથા સ્વદોષ-દર્શનથી આત્મ-જાગૃતિ રહે છે. એમાં કરવાનું એટલું જ છે કે જ્યાં આપણે બીજાના દોષ જોવા પ્રેરાઈએ છીએ, ત્યાં એમ ન કરતાં આપણા પોતાના દોષ જોવાના; એટલું જ નહિ પરંતુ આપણા દોષ હાલતાં અને ચાલતાં જોયા કરવાના. એથી આપણી ભામીઓનો સચોટ જ્યાલ રહેવાથી નવી ભૂલો ઓછી થાય. તેમજ બીજાના દોષને બદલે આપણા દોષ જોવાથી એ લાભ થાય કે બીજા પર ગુસ્સો કરી જેમ-તેમ બોલવા વર્તવાનું અટકી જાય. તેથી આપણી સજજનતા વધે !

**P.- આપણને એ નમાલા ન સમજે ?**

**૩.- આજ ભૂલ છે.** જ્યારે દોષ સામાનો છતાં આપણા હૃદયમાં સાચેસાચ આપણા દોષ જોવાની વૃત્તિ ઊભી થાય છે, ત્યારે એની અસર સામા ઉપર સરસ પડે છે; તેમ આપણા મન ઉપર પણ સુંદર અસર થવાથી પછી આપણા બોલ કે વર્તાવ એવા કુદરતી આકર્ષણ બને છે; અને કદાચ માનો કે આમ છતાંય આપણને સામો કે બીજા નમાલા ગણે, તો તેથી કરીને શું આપણે આપણી ગુણસંપત્તિ ગુમાવવી ? પરદોષ-દર્શન અને સ્વદોષનું અ-દર્શન એ ગુણ સંપત્તિ ગુમાવવાનો રસ્તો છે, આવું કરી પત્તી અચુંકારી ભણ્ણાએ માત્ર પોતાના પતિમંત્રીના દોષો જોવા માંચા તો ક્ષમાદિ ગુણ ન આવ્યો; અને તેથી જ અંતે પાપીઓના હાથમાં પકડાઈ શરીરના લોહી નિયોવાવાની ઘોર પીડા વેઠાવી પડી ! એની એજ અચુંકારી પછીથી સામાની ભૂલમાંય સ્વદોષદર્શન કરવાવાળી થઈ, તો ઈન્દ્રથી પ્રશંસિત બની અને અહીં મહાદેવી તરીકે પૂજાઈ.

આપણો બીજો કોઈ દોષ જ ન જડે તો શું કરવું :- એમ કેટલાક અહંમાનીને થાય છે. પરંતુ એને ખબર નથી કે જરા ઉડી ઉત્તરી તપાસાય તો પોતાનો કોઈનો કોઈ દોષ મળી આવશે. છેવટે બીજું કાંઈ ન જડે તો પોતાનો પાપોદયરૂપી દોષ તો ખરો જ ? સંસારસવાસરૂપી દોષ તો છે જ ? અસહિષ્ણુ મન, વસ્તુ પર રાગ-મમત્વ વગેરે દોષ ક્યાં નથી ? એટલે એકવાર આ થશે કે ‘સામાના દોષ જોવા તરફ અંધ બની આપણા જ દોષ જોવા,’ પછી એની કળા આવડી જશે.

સ્વદોષ-દર્શનમાં બીજી વસ્તુ એ છે કે આપણી કાર્યવાહીમાં આપણી શી શી ખામી છે એ જોવાની સતત જગૃતિ આપણે રાખવી જોઈએ. આ પણ વસ્તુ બહુ લાભકારી છે. કેમકે એથી આપણી પ્રવૃત્તિ ચણાય છે. જેમ અનાજ ચાળવાથી માટી વગેરે નીચે બહાર પડી જાય છે, તેમ આપણી વાણી, વિચારણા અને વર્તણૂકને સ્વદોષ-દર્શનની ચાળણીથી ખામીઓ બહાર તરી આવે છે; જેને પછી ઊંચકી ઊંચકીને દૂર કરવાનું. અને ફરી નહિ ધૂટાવા દેવાનું સુલભ બને છે. ત્યારે માણસ જો આ કરતો જાય, તો તો જીવન એનું આત્મ-સંશોધનમય બની જાય; પગલે પગલે ઉન્નતિ થાય છે કે નહિ એ સાધનામાં જોતા રહેવાય; પર ચિંતાની અધમાધમતામાંથી બચી જવાય; કેમકે એની કુરસદજ ન મળે.

સ્વદોષદર્શનમાં એક પણ મોટો લાભ છે કે એનાથી ઊંચ ગોત્રનું પુષ્ય બંધાય છે; યશ-આદેય વગેરે અનેક બીજા પુષ્યની કમાઈ થાય છે; તેમજ પરદોષ જોવાનું બંધ કરવાથી નીચ ગોત્ર-અપશય વગેરે અનેક પાપો બંધાવાનું અટકી જાય છે. વળી અનાદિની પરદોષ જોવાની કુ-આદતનો અંત આવે છે; સ્વદોષદર્શન શુણના સુસંસ્કાર જામે છે; જે ગુણ વિકાસ પામતાં પામતાં મૃગાવતીજી, શીતલાચાર્ય વગેરેની જેમ ઠેઠ કેવળજ્ઞાન સુધી પહોંચાડી દે છે.

બાકી ખેંચો, પણ શાની ? :- ઘણી વાર આપણે બીજાના દોષોની ફરીયાદ કરીએ છીએ કે “ફલાણા અમારાથી અતડા રહે છે, રોઝથી ચાલે છે.” અલબત એ અતડા રહેતા હશે, ને રોઝ કરતા હશે, પણ તે છાતાં દોષ આપણો છે, અન્નિ સ્વભાવે જ ગરમ છે, માટે બળે. એટલે જ તેની પાસે જે જાય, તેને બાળે જ છે. તેમ સામો શું રોઝ કરવાના સ્વભાવવાળો છે ? તો તો એની પાસે જે જાય તે બધાની સામે એ અતડો અને અક્કડ રહેવો જોઈએ. પણ ના, તમારા સિવાય બીજાઓ સાથે તો એ હળે-મળે છે ! તો એનું જે અતડાપણું માત્ર આપણી સામે છે, તેમાં આપણો કોઈ દોષ છે. એ શોધી કાઢવા વિચારવું ઘટે કે “તો શું મારા હૈયામાં કૂણાશ નથી ? હૈયું વિશાળ નથી ? મારું મુખ સૌભ્યભાવને બદલે અસુચિભાવને ભજનારું છે ? વાણી મીઠાશને બદલે કટુતાવાળી છે ?” આ બધું છે

કે નહિ તે પહેલું જોવું જોઈએ. દેખાય છે કે “એ સામો આવતો હતો, હું જતો હતો, મેં તેને બોલાવ્યો નહિ. પછી તે અતડો રહે તેમાં તેનો શું વાંક ? એ મળ્યો, મેં શિષ્ટાચાર કર્યો નહિ, પછી દોષ કોનો ?” જેનામાં કોમળતા-વિશાળતાએ લક્ષણ હોય તે મોટા ભાગે જગતમાં પ્રિયદર્શન બને. એ સારા જગતનો પ્રેમ જીતી શકે. તો કુટુંબનો પ્રેમ જીતવો તેમાં શું મોટી વાત હતી ? પણ આ લક્ષણો વિના બનવું અશક્ય છે. તેમજ વાંધા વચ્છામાં પોતાના દોષના દર્શન વિના પણ એ નહિ બને. જો તે બનાવીએ તો ભડ્રમૂર્તિ બનીએ. આપણા પર સૌ સ્નેહ રાખનારા અને આપણી હાજરી સૌને પસંદ પડે તેવું બને. આજની દશા જોતાં એનો એકડ એકથી અભ્યાસ કરવાનો છે. “કાલની નવકારવાળી બાકી છે, દાન બાકી છે.” આવી બાકી ખેંચતા હતા, તેમ આ બાકી ખેંચવાની છે કે “કોઈ કઠોરતા, કોઈ કટુતા, કોઈ દિલમાં કુદ્રતા કે અનુચિતતા દિલમાંથી દૂર કરવાનું બાકી રહી ગયું નથી ને ? હા, અમુક જગ્યાએ હું કઠોર બની ગયો હતો, આહા ! એ બહુ ખરાબ ! હવે આ દોષો મારે ટાળવા છે, માટે આમ આમ કરું.” કોઈ મિથ્યાદર્શનમાં પડ્યો હોય, પણ એનામાં કોમળતા, વિશાળતા, મધુરતા વગેરે શુભ લક્ષણો આવી ગયા હોય તો તેણે એ વિચારવાનું કે “મારે પ્રભુના દર્શન રહી ગયાં. મારે સામાયિક રહી ગયું !” એને એ; અને આપણે આ બાકીમાં જોવું પડે કે “હદ્યમાં જ્યારે મૃદુતા, નમ્રતા કેળવવાનો અવસર મળ્યો હતો ત્યારે મેં હદ્યમાં કઠોરતા પૂરી. ધન્ય અવસર પ્રાપ્ત થયો હતો ત્યારે ઘમંડમાં આવી કટુવાણી કાઢી હતી.” હદ્યની કૂણાશ દિલની મોકણાશ, વર્તાવની યોગ્યતા, એ બધું કમાવવા માટેના અવસર અહીં મળે છે, પછી ક્યાં મળશે ? એ ખૂબી માનવ ભવની છે કે અહીં આપણી સામે કોઈ ધમધમતો આવ્યો, તો સમજ અને વિવેક હોવાથી કુણું હદ્ય રાખી શકાય છે, ને દિલ વિશાળ બનાવી શકાય છે. પણ-બશુના ભવમાં ગયો ત્યાં અનિષ્ટ પ્રસંગ તો આવશે; પણ સમજ વિવેકના અભાવે ગુણોની કમાઈ નહિ થાય. કોઈ લાકી લઈને આવ્યું દોર પાસે, ત્યાં તે પશુના દિલમાં કૂણાશ, વિશાળતા કે વિવેક રહે ? કઠોરતા ભારે આવી જાય ને ? “મારું ચાલે તો શિંગંડુ મારી દઉં !” છૂટું હોય તો લગાવેય અરું; ને બાંધેલું હોય તો મનથી ઘણું કરે. કસાઈ જેવાના હાથે કપાઈ મરવા છતાં કેટલાય પણ મરીને નરકમાં જાય છે. મનથી એટલું રોક્રથાન કરે છે કે નરકનાં ભાતાં ઉપાઈ છે. એનો ભવ એવો કે અહીં મહાપીડાના પ્રસંગ આવે; અને એમાં ગુણોપાર્જન દુર્લભ છે. જ્યારે આપણી પાસે ભવ એવો છે કે અલ્ય કષણા પ્રસંગો મળે, છતાં મહાન ગુણો સંપાદન કરવાની સોનેરી તક છે. તે તકનો સોનેરી સહૃપ્યોગ ક્યારે થાય ? આ ભવમાંથી ચૂક્યા

પછી નહિ થાય. આ ભવમાં સ્વદોષોની બાકી બેંચી, એને દૂર કરવાની જહેમત ઉઠાવાય ત્યારે.

**સ્વદોષનું નિરીક્ષણ એટલે ગુણવૃદ્ધિ !! :-** એક ખૂબી જુઓ કે જેણે સ્વદોષ-દર્શન આદર્ઘુ તેણે ખરી રીતે ગુણ-સ્થાનકની પાયરીએ ચઢવાનું પ્રારંભ્યું. આ એવું છે કે આપણે આપણી જાતને દોષિત જોતા હોઈએ છીએ, પણ ગુણ આપણને ઊંચે બેંચે છે ! મૃગાવતીએ પોતાના દોષ જોવા માંડવા કે બેંચાયા ઊંચે છદ્વા ગુણસ્થાનક્ષી સાતમે, આઠમે, નવમે, ઠેઠ તેરમા ગુણઠાણા સુધી વધ્યા ઊંચે ! એ શું કરતા હતા ? દોષ જોતા હતા. “કેવી હું અક્કરમી ! બીન શરમી ! હું રાજકુમારી, એટલે ? હું ઘણી જ ઉપયોગવંતી હોવી જોઈએ, ત્યાં મેં આ શું કરી નાખ્યું !...” આમ માત્ર પોતાના દોષનું નિરીક્ષણ ! આત્મા દોષનું નિરીક્ષણ કરે અને ગુણસ્થાનક ઉપર બેંચે ? જ્યારે આપણે ગુણમાં વધવાનો યત્ન કરીએ ત્યારે, પણ જોવામાં પોતાના દોષ દેખાય છે; ને વસ્તુગત્યા ગુણસ્થાનક ઉપર બેંચે છે ! હાલતાં ને ચાલતાં સ્વદોષનું નિરીક્ષણ કર્યા કરવું જોઈએ.

એમાં આગળ વધું એટલે ? દિલ જ્પે નહિ જ્યાં સુધી બાકી ભરપાઈ કરાય નહિ. સ્વદોષનું નિરીક્ષણ બનાવતી ક્યારે ? કે એની બાકી બેંચ્યા પછી એની ભરપાઈ કરવામાં અખાડા હોય. જેમ એક દેવાદાર હોય અને કહે ખરો કે ‘શેઠ, તમારા પૈસા શાહશેગ;’ પણ આપવામાં ખામી હોય, તો પછી એ અખાડા કે બીજું કાંઈ ? તેમ તમે ગુરુને ઠગવાનો સફાઈબંધ રસ્તો રાખી ત્યો, એટલે કહો ખરો કે ‘સાહેબ અમે તો ઘણા દોષવાળા છીએ;’ પણ પાછું દોષ સુધારવાની બાધા હોય, ત્યાં શું થાય ? દોષના નિરીક્ષણ પછી દોષથી પાછા હઠવાની. દોષના પક્ષને મૂકવાની, અને દોષના પાપને ગુરુ પાસે આલોચવાની પૂરી તૈયારી જોઈએ. પછી કદાચ એવા પણ દોષો હોય કે જે એકદમ છટે નહિ. છતાં એની બાકી બેંચવી જોઈએ. સ્વદોષદર્શન સાચું ત્યારે કે એ બાકી બેંચ્યા પછી એનો આત્માને જંપ ન હોય. આ તો બહુ સહેલી વાત છે. દેણાદાર વર્ષો સુધી દેવું ભરપાઈ ન કરી શકે એ બને, પણ શાહુકાર સમજે કે “આ દેવાદાર છે, પણ એને જંપ નથી, નિરાંત નથી !” તો એને લુચ્યો નહિ માને. તેમ અહીં નિરીક્ષણ સાચું ત્યારે કે દોષોનું દર્શન કર્યા પછી એ દોષો બદલ જંપ ન હોય.

**સંસારનો વફાદાર સેવક :-** “કેમ ભાગ્યશાળી, ચારિત્ર લીધું નથી ? કેમ વ્યાખ્યાનમાં ટાઈમસર નહોતા આવ્યા ?” “સાહેબ, પ્રમાદ છે.” આ આજનો જાણે ગોખી રાખેલો રજીસ્ટર્ડ જવાબ છે ! પછી એ પ્રમાદ દોષના દેવામાંથી ભરપાઈ કરવાનો આનીભાર પણ પુરુષાર્થ ખરો ? કહોને ‘પુરુષાર્થ ? એ જમાના ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ” (ભાગ-૧૮)

ગયા મહારાજ ! આજે તો અમે અમારી દુનિયામાં એવા તૈયાર છીએ કે જ્યાં ઉષાપ દેખાય કે તરત જ એને પૂરી કરીએ ! બાકી આમાં શું છે ? ગઈ સાંજે દૂધ પીવાનું રહી ગયું; તો આજે ડબલ ઠોકો ! પૈસા કાલે કમાવવાના બાકી હતા, તો આજે ચોવીસ કલાક ખડા રહીને પૂરા કરો ! આવી સંસારની બાકીઓ ભરપાઈ કરાય છે. કેમ કરો છો ને ? હા, એનું નામ સંસારનો વફાદાર સેવક ! ધર્મનો વફાદાર સેવક તો તે કે જે આત્મસંબંધી તૃટિ રહી ગઈ હોય, જે સુધારવામાં બાકી રહી ગઈ હોય. તેને ભરપાઈ કરવા ચોવીસ કલાક તૈયાર હોય. એનો ધર્મ ફક્ત પૂજા કે પ્રતિકમણ નહિ પણ એની સાથે સાથે “આ ક્ષમાદિ ગુણો કેળવવા બાકી રહી ગયા. આ આ દોષો દૂર કરવા રહી ગયા.” એમ બાકી બેંચે; અને એની નુકસાનીને ભરપાઈ કરવામાં મથે. એ તો ભવાભિનંદી જીવો સંસારરસિક જીવો, કે જે જડની બાકી બેંચવામાં અને એની અધુરાશ પૂરી કરવામાં શૂરા પૂરા હોય, પણ જૈન એટલે તો મોક્ષેચ્છુ; એ તો રાત દિ’ આત્માની બાકીની ચિંતામાં હોય. દોષોની બાકી બેંચ્યા પછી નુકસાની ભરપાઈ કરવાનું શાના બળ પર થાય ? બે જાતના દર્શન પર. તેની વાત હવે કરવાની છે. (૧) ‘જડના વિકાસમાં જીવના વિનાશનું દર્શન.’ અર્થાત् (૨) ‘જડની જરૂરીયાતમાં જીવને દુઃખ આવે છે-એનું દર્શન.’ અર્થાત् (૧) જડ જેટલું ખીલે, એટલો આત્મા કરમાય છે. (૨) જડ વિના જેટલું નથી ચાલતું, તેટલો આત્મા સ્વસુખ ગુમાવી દુઃખી થાય છે. આ બે દર્શનિકળા આવડે તો સ્વદોષનો ઉદ્ધાર સહેલાઈથી થાય.

#### ● ૫. જડના વિકાસમાં જીવના વિનાશનું દર્શન ●

પાંચમા દર્શનની કળા છે-જડના વિકાસમાં આત્માના વિનાશનું દર્શન કરવાની. હેયે દ્રસાવવાની જરૂર છે કે જડ પદાર્થોના વિકાસ સાધવામાં પોતાના જ ચેતન જીવની વિનાશ સાધવાની પરિસ્થિતિ ઊભી થાય છે. તો જડની આ ઓળખાશ થવી જોઈએ કે આ બધા બંગલા-બગીચા-દુકાન-તિજોરી વગેરે ફાલીકૂલીને મને શું સારું કરી દેનારા છે ? જેમ સૂર્યસ્ત પછી અંધકાર ફાલીકૂલીને દિવસના રવા સથ્યા આધા પ્રકાશને શોખાવી નાખું કરી નાખે છે; તેમ આ જડના વિકાસનું પરાકમ પણ એવું છે કે પૂર્વની માંડમાંડ સાધેલી આત્મપુણ્યાઈને સુકવી નાખે, ઉચ્ચ ગતિનો અંત લાવી દે.

અનંતકાળનો ઈતિહાસ તપાસો તો આ સ્પષ્ટ જગાશે કે જેમ જેમ ભૌતિક ઉદ્ય થતો ગયો, તેમ તેમ આધ્યાત્મિક વિનાશ નીપજતો ગયો, દાખલા તરીકે જંગલમાં હરણીયાને બદલે બળવાન સત્તાધીશ એવા વાધ-સિંહના અવતાર મળ્યા;

તો તે તેના આત્મા માટે સદ્ગતિમાંથી અસ્ત પામી નરક જેવી ધોર હુગતિમાં ફેંકાઈ જવા માટે. એવી રીતે મનુષ્યપણે સામાન્ય માનવને બદલે રાજાનો અવતાર થયો; તો તે પણ લડાઈ, શિકાર, માંસાહાર, વિષયકખાયાદિમાં ચક્કૂર બની આત્માને હુગતિમાં ભટકવવા માટે. આનું નામ જડનો જો વિકાસ તો આત્માનો વિનાશ. આ તો પરલોકની દસ્તિએ વાત થઈ. આ જીવનની દસ્તિએ પણ વિચારતાં આજ સત્ય દેખાઈ આવશે. સામાન્ય નિયમ મુજબ વધુ લક્ષ્મીવાન બનતાં માણસો વધુ દોષવાળા અને હુગુણી બને છે; લક્ષ્મીની ગરમી ઉપર ગર્વ, અક્કડતા, અતડાઈ, ગુસ્સો, માયા, લોભ વગેરે હુગુણો વધારે છે.

શાસ્ત્ર કહે છે કે-ચક્કવર્તીની સમૃદ્ધિ એવા પાપમાં ચઢાવે છે કે ઠેઠ સાતમી નરકે લઈ જાય. આ શું છે ? જડના વિકાસથી આત્માનો વિનાશ; એથી આત્માના અહીંના સુખશાન્તિ લોપાતા જવાના. ધર્મ-વ્યાપાર અને તત્ત્વ-પરિચય કરવાનું ઓછું થતું જવાનું; અગર દૂર પડતું જવાનું; અને એના બદલે પાપ-વ્યાપાર અને અજ્ઞાન-પરિચય વધતો જવાનો. જો ધર્મ-વ્યાપાર અને તત્ત્વ-પરિચયનું અનંત મૂલ્ય સમજો, તો લાગશે કે મહાન આત્મોનાનિકારક આવી વસ્તુની સગવડ આપનારા આવા મોઘેરા જીવનમાં બીજો વેપલોજ શા સારું કરવો ? પાપ-વ્યાપાર અને અજ્ઞાન-પરિચય કરવાના ભવ તો જગતમાં ઘણાય છે, અને મળે છે. હિંસા, જુઠ, અનીતિ, અબ્રાહિમ(વિષયસેવા), પરિગ્રહ એ પાપની પ્રવૃત્તિ ક્યાં નથી મળતી ? તેમ કોધાદિકખાયો વગેરેના પાપ આચરવાનું ક્યાં સુલભ નથી ? એમ અતત્વમાં એટલે કે પ્રમાદમાં નિદ્રા અને વિકથા ગણાય, તેમ અજ્ઞાનમાં જે વિપરીત વિકલ્પો અને ઊંધા ધોરણ ગણાય, તેનો પરિચય પણ ક્યાં નથી ? માટે જ જડ લક્ષ્મી, જડ કાયા, જડ મિલકત, સ્નેહી કુટુંબીના જડ દેહ, ઈત્યાદિના વિકાસમાં મોહવાનું નહિ; સાવધાન બનવાનું. રાગાદિમાં નહિ તણાવાનું. અહીં એક પ્રશ્ન થવો સંભવિત છે.

પ્ર.- જડના વિકાસમાં બધે વિનાશ-વિનાશ દેખવામાં નિરાશાવાઈપણું કે રોતડપણું નથી ?

ઉ.- ના, જેમ માણસ બજારમાં પૈસા કમાવવા ગયો ત્યાં સો વેપારીને વેપાર-વકરો ચાલે છે, માત્ર પોતાની દુકાને નથી ચાલતો; તો એના મનમાં આવે છે, કે ‘અરેરે ! આ કમાય છે.., તે કમાય છે, પેલા કમાય છે... માત્ર હું જ અક્કરમી ? મારે ત્યાં કોઈ દેખાય નહિ ? કોઈ ધરાક નહિ ?’ આવી જે લાગણી થઈ આવે છે, એમાં શું અંધકારદર્શન છે ? રોતડપણું છે ? ના, એ તો જગત્તિ છે, ઉમળકો છે, તેથી જ એ ઉઠાને વધુ પુરુષાર્થ કરે છે. વેપારનો બીજો રસ્તો

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ” (ભાગ-૧૮)

૩૫

લે છે. ગમે તેમ કરીને પણ આજીવિકા ઉભી કરે છે. એમ અહીં પણ જડના વિકાસમાં સાચેસાચ આત્મવિનાશનું દર્શન થયા પછી માણસ આત્મવિકાસના સાચા પુરુષાર્થ બેઠે છે. આ તો જડવિકાસના અંજામણમાં જીવ અંજાઈ જાય છે, તેથી પોતાની જતનું જ ભાન ભૂલીને અવળા ઉદ્યમમાં લાગી જાય છે. ખરી રીતે ઉદ્યમ માત્રથી શાબાશી નથી. સારા હિતકારી ઉદ્યમથી જશ મલે છે. જીવન જીતી જવાય છે. જડને વિસ્તારવાની ધૂન લઈ બેઠેલાને પૂછો કે ‘હુન્યવી પ્રવૃત્તિમાં બહુ લાંબા-પહોળા થયા ખરા, પણ છેવટે પરિશામ શું ? તે કહો.’ એ કહે કે ‘કેમ ? ખૂબ સારા પૈસા કમાયા.’ તો એમ કહેનારને પૂછું પેડ કે ‘પણ પછી શું ?’ તો એ કહેશે ‘જીવનમાં મહાન સગવડો અને સન્માન.’ તોય ત્યાં પ્રશ્ન છે, કે ‘પછી શું ?’ ઉત્તર નથી. આ જડ વિકાસીની દશા છે. ત્યારે આત્મવિકાસીને પૂછો, “પૈસા તો કમાયા પણ પછી શું ?” તો કહેશે ‘સાત ક્ષેત્રમાં એનું વાવેતર.’ વળી પૂછો ‘પણ પછી શું ?’ ‘પછી ઉત્તમ સદ્ગતિ.’ ‘પછી શું ?’ ‘પછી ઉત્તમ ધર્મ-સાધના.’ ‘પછી ?’ ‘મોક્ષ.’ ‘તે પછી ?’ ‘સંસારમાં ભટકવાનું જ નહિ. તો હુંખારિદ, પીડા-પરાધીનતા, અરૂચિ-અપમાન, વગેરે કાંઈ જ નહિ.

આ દર્શનવાળો ડિમિયાગર વૈદ બને છે :- એટલે જડલક્ષ્મી વધી, જડ શરીર વધવું, જડ સ્નેહીઓ વધ્યા ત્યાં આ દર્શનની કળાવાળો રોવા નથી બેસતો કે ‘હાય ! આમાં હું મરી ગયો !’ પણ એટલું જરૂર થાય છે, કે ‘જીવ ! થાન રાખજે આ એવો વિકાસ થયો છે, કે જેના મોહમાં તું આખોને આખો કચાઈ જાય. આ બધો સરંજામ દોષ-હુગુણો, મોહ, ભોગવિલાસ વગેરેને પોષનારો છે. તેથી તો તારોજ વિનાશ થાય; માટે ડિમિયાગર વૈદ જેમ જેરી અઝીણમાંથી જીવાડનાંનું ઔષધ બનાવે છે, તેમ તું પણ એ વિકસેલા જડમાંથી એવા આત્મહિતના પરમાર્થના કાર્ય સાધી લે જે, કે જેથી તને સારામાં સારી સદ્ગર સ્થિતિ મળે.’ આવી સાવધાનીથી જીવ સુકૃતના માર્ગ લાગી જાય છે, અને ભાવી અનંતકાળને ઉજજવલ કરે એવી અવસ્થા ઉભી કરે છે. જે જડના વિકાસમાં જ ચક્કવર્તી મરે તો નરકે જ જાય, એવા જડના વિકાસને ભરત ચક્કવર્તીએ આરિસાભવનમાં એવો સંકોચી લીધો કે એમાં આત્માની અનેરી ખીલવટ થઈ ! કેવળજ્ઞાનનો અપૂર્વ વિકાસ પામ્યા !!

કહો જોઉ. જડનો વિકાસ જીવનો ધાતક અને જડનો સંકોચ્ય જીવનો ઉદ્ધારક લાગે છે ખરો ? ‘છે’ નથી પૂછતો ‘લાગે છે’ પૂછું દું. ઘાણીમાં પીલાઈ જનારા મહાત્માઓએ જડ કાયાના વિકાસને બદલે ફૂરચા ઉડવાનું દેખ્યું એમાં જીવનો મહાઉદ્ધાર માની ખુશી થયા તો અનંતકલ્યાણ સાધી શક્યા, જડનો વિકાસ ધાતક

૩૬

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા- દર્શનની ખૂબિધ કલા (ભાગ-૧૮)

છે, માટે તો સાધુઓ એને છોડીને ભાગી નીકળ્યા છે, અને તમે ભાગવાની તૈયારીમાં પડ્યા છો, કેમ ખરું ને ? જો ના કહેજો તો ધ્યાન રાખજો કે શ્રાવકપણાની સ્થિતિમાંથી નહિ રહી શકો. શ્રાવક એટલેય જડ વિકાસથી ગમ્ભરાનારો, પણ ખુશી થનારો નહિ; અને ગમ્ભરાનારો એટલે એનાથી દૂર ભાગવાની ગડમથલમાં પડેલો.

ઘરમાં આગ લાગી; ત્યાં એહી માણસ બૂમ મારે ખરો કે ‘અરે ! આગ લાગી આગ ! બળી જવાશે,’ પણ ઉઠીને ભાગે નહિ તો એની બૂમ કેવી સમજવી ? ‘અલ્યા, તો પછી ભાગતો કેમ નથી ?’ એમ પૂછતાં એ કહે છે ‘શું કરું ભાઈસાબ ! આ બધું સંભાળવા-સમેટવાનું છે,’ તો એ બળી જવાની ભીતિ વિનાનો પાગલજ ગણાય ને ? એમ તમને સાચેસાચ લાગે કે આ જડના સરંજામની ફોજ મારા આત્માને સંગળાવી નાખનાર ફોજ છે, પણ એમાંથી નીકળવાને બદલે એને સંભાળવામાં પડ્યા રહો, તો નિર્ભાક અજ્ઞાની ને ? માટે શું કરવાનું ? પહેલું તો એ કે જડને જેટલું ઓછું વિસ્તાર્યું, ઓછું ચદાયું-ફટાયું, તેટલું સારું એવો નિર્ધાર કરી એ માર્ગ ઉઘમી બનવાનું; અર્થાત ધન બહુ ભેગું કરવાનું બંધ, વેપાર મોટા વિકસાવવાના બંધ, કુટુંબ-પરિવાર-બંગલા-બગીચા વગેરે વધારવાનું બંધ; આવું આવું વધતું ઓછું પણ આચરવું જોઈએ; અને એ માટે એ જોતાં રહેવું જોઈએ કે “બહુ ધનના વિકસમાં લોભ અભિમાન વધે છે, બહુ વેપારના વિકસમાં આરંભ-સમારંભ અને અસત્ય, અનીતિ, મૂલ્યાં વગેરે વધે છે, ને ધર્મમાં લક્ષ ઘટી જાય છે, કુટુંબ-પરિવારના વિકસમાં મોહ, રાગ, મોટાઈની લાગણી વગેરે વધે છે, શેઠાઈ આવીને દેવગુરુ ને ધર્મ પ્રત્યે સાચું સેવકપણું ગુમાવવાનું થાય છે; બંગલા-બગીચાના વિકસમાં હિંસા વધે છે, અજ્ઞાન-મૂઢઠા-મમતાદિ વધે છે. આ લોભ, ગર્વ, હિંસા, જૂઠ, અનીતિ, મોહ, રાગ, શેઠાઈ વગેરે વધવાથી જીવનો ચારે બાજુથી વિનાશ સર્જય છે. કેમકે અહીં પણ અવસરે અણધારી આફના, ઈર્ધિના, અને અશાંતિ-અપયશના ભોગ બનવું પડે છે; અને પરલોકમાં તો પૂછવાનું જ શું ? લોભ, મોહ, રાગ, જૂઠ, અનીતિ વગેરે એકેક દોષના એવા કારમા કંદુ ફળ ભોગવવાના હોય છે, તે પણ નરક-તિર્યંચના અનેકવાર ભયંકર ભવો કરીને ! માટે જ આવો જીવ વિનાશ સર્જનારા જડના વિકસના શા વધામણાં કરી હરખાવુંતું ?

## ● ૬. જડની જરૂરીયાતમાં દુઃખનું દર્શન ●

પરની આશામાં ને આશામાં માણસ તણાયો જાય છે, પણ તેથી એને અંતે નિરાશ થવું પડે છે. આમ છતાં આ આશાના ફાંસલામાં જગત એવું ફસાય છે ભુવનભાનું એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ” (ભાગ-૧૮)

કે એવા એક ફાંસલામાંથી નીકળી જવાને બદલે પોતાની જ જાતે એવા બીજી નવા નવા પાશ ઊભા કરે છે. એક આશાની પાછળ અનેક આશાઓ ઉઠે છે, જે જંખના, ચિંતા, હાયવોય વગેરેના દુઃખ દે છે. ત્યારે એવી આશાઓ ઉઠવાનું શું કરશા ? કહો, જડની જરૂરીયાત લાગી તે. ‘અમુક અમુક વસ્તુની જરૂર છે, એના વિના નહિ ચાલે,’ એમ વિચાર થયો કે એ વસ્તુની આશા ઊભી થાય છે. જો મનને એમ થાય કે ‘ના, મારે એની જરૂર નથી, એના વિના હું ચલાવી લઈશ; તો પછી એની આશા સેવવાની પીડા નથી હોતી. આ તો ‘મારે અમુક જોઈએ છીએ, અમુકની જરૂર છે,’ એમ જરૂરીયાત લાગે છે ત્યાં, પછી એની આશામાં ફસાનું-તણાનું પડે છે; અને આશાની ફસામણ દુઃખદાયી બને છે. દાખલા તરીકે સમજો કે એક માણસ દૂધ પી રહ્યો છે. એવામાં જો એને કંક મગજમાં તરંગ આવ્યો કે ‘આ દૂધ તો હંકુ છે, તે ગરમ જોઈએ; આ તો સાછુ છે, ‘એમાં બદામ જોઈએ;’ તો પછી ઠંડા કે સાદા દૂધની મજા ઉડી જશે; મનને દુઃખ લાગશે. એટલે અહીં ઠંડુ દૂધ દુઃખ નથી આપતું. જો જે મય્યું તે બરાબર છે, અગર ધાર્યા કરતાં અધિક છે, તો મનને દુઃખ નથી લાગતું. પણ ‘ગરમ જોઈએ, બદામવાનું જોઈએ,’- એવી ઊભી કરેલી જરૂરીયાત દુઃખને જન્મ આપે છે. પાછી આ જરૂરીયાતમની ખૂલ્લી એવી છે કે એક સાપણમાંથી સો સાપોલીઆની જેમ એક જરૂરીયાતમાં અનેક જરૂરીયાતો ઊભી થાય છે; અને જેમ જેમ જરૂરીયાત વધે તેમ તેમ દુઃખની લાગણી વધે છે. દા.ત. ‘દૂધ ગરમ જોઈએ’ એવું મનમાં આવ્યું. ત્યાં વળી એમ થશે કે “પ્રાયમસ તૈયાર જોઈએ. અમારા આવવા પહેલાં સમજ રાખીને તૈયાર કરી રાખવું જોઈએ; એવું ગરમ પણ સાંકડા ટાંક્યા વાસણમાં કે કીટલીમાં રાખવું જોઈએ; તે પણ પવન વિનાની જગાએ મૂકવું જોઈએ.” આમ કેઈ જરૂરીયાતોના તરંગો ઉઠશે. એમાં જીવને શું મળ્યું ? માત્ર ચિંતા અને દુઃખની લાગણીઓ. સાદા દૂધથી પતાવ્યું હોત તો પીધા પછી કંઈ નહિ. પણ મન માન્યું ગરમ અને બદામવાનું દૂધ જો મય્યું તો મોંકાણ મંડાણી. રાગ વધે, પ્રશંસા વધે, સ્મરણ લાંબુ- ‘કેવું સરસ ! વગેરે, પરભવ માટે પાપ વધે ! અહીં દુઃખ વધે ! અહીં તો થોડી પણ જરૂરીયાત ઊભી છે ત્યાં સુધી શાસ્ત્ર દુઃખ કહે છે, તો પછી ઘણું મળવા છાતાંય જેને તૃષ્ણાઓ શમતી નથી, આવશ્યકતાઓ રહે છે. તેને કેટલું બધું દુઃખ ? જાણો છો ને, પેલી ભીલિને રાણી બનાવ્યા પછીનો કિસ્સો ?

એક ભીલિને રાજાએ રાણી બનાવી. એને સારી રીતે રખાવ્યા પછી પૂછ્યું ‘કેમ, ખાવા-પીવાનું બરાબર છે ને ?’ ત્યારે એ કહે છે ‘શું રાખ બરાબર ? આ ઘેબરપાક તો આપ્યો પણ પેલાં ખાટાં બોર કાં આપ્યા ?’ રાજા કહે છે,

‘એમ, ? તો કપડા તો સરસને ?’ ‘શું ધૂળ સરસ ? જરીયાન સાડી આપી, પણ પેલાં ચણોઠીઓ ટાંકેલા બદનીયાં ક્યાં મખ્યાં ?’ ‘ત્યારે ઘરેણામાં શું માલ ? સાવ હલકાં પતલાં મોતીના દોરા કે હીરાના હારથી શું ? પતલી હલકી હીરાની બંગડીઓથી શું ? પેલા રીતસર વજનદાર પીતળના કંઢા કે પીતળના ઝાંઝર બલૈયા ક્યાં આખ્યા શું ?’ એમ જેને વલોપાત કરવાની કુટેવ છે, ગમે તેવું મળે છતાંય ‘હજી ફ્લાણું ક્યાં મખ્યું ? અમુક નથી આવ્યું ત્યાં સુધી શું ?’ વગેરે જરૂરીયાતો ઊભી જ છે, એને બિચારાને ચિંતા અને રોદણાંના દુઃખમાં દટાયા રહેવું પડે છે. પછી જેમ આ રાજ ગુસ્સે થઈને ભીલડીને વનમાં તગેડી મૂકે તેમ અવસરે તેવા કોઈ કલેશ-દુર્દશમાંય મૂકાણું પડે છે.

જડની વધુ જરૂરીયાતમાં વધુ દુઃખનું દર્શન કરી શું કરવું જોઈએ ? (૧) જડની માયા થોડે થોડે પણ ઓછી કરવી જોઈએ; (૨) જડની પરાધીનતા પર કાપ મૂકવો જોઈએ. જીવને ઉચિત વર્તાવ કોણ નથી કરવા દેતું ? જડની વધુ પડતી માયા અને પરાધીનતા. માયા એટલે ‘આ મારું’ એવી મૂછ્છા, ‘આ સારું એવી લાલસા. પરાધીનતા એટલે ‘એ બહુ સગવડાયી, એના વિના જરાય ન ચાલે,’ આ ધોરણ. પતી ગયું ! જડને પનારે પડ્યો, પછી શા માટે ઉચિત વર્તે ? એ તો આને જ સંભાળ્યા કરવાનો, ‘કુટુંબમાં વડેરા છીએ તે માન વિના ન ચાલે.’ આજ મીઠું લાગ્યું પછી કાલે નાનો ઊઠીને સામું બોલે તો કેમ સહે ? સામે ઢોક ! ‘ના, પણ અમે કંઈ ખોટું કહેતા નથી. એના હિતને માટે અમે તો કરીએ છીએ !’ ખરી રીતે કેટલીકવાર સામાનું હિત ઘવાય છે, એવી વિચારણા નથી હોતી; ‘એ તો મારું વચન ન માન્યું’ આ બેઠેલું છે. તેથી જ બધી વાતો છે ઔચિત્યનો ભંગ કરીને કેવળ પોકળ હિતેખીપણું દેખાડવાની. જડની જે જંજાળ વળગી છે,-લક્ષ્મી, વિષયો, માન-પાન, આબરુ, સત્તા, શાશ્વતપણ, હું પદ વગેરેની-એના પરની માયા કપાય, એની પરાધીનતા કપાય.

પાંચમી-છદ્વી દર્શનની કલા માટે આટલું જીવન રાખો કે સામાન્ય રીતે (૧) જેમ જડ વધુ સારું બનતું જાય છે, તેમ આન્મા બગડતો જાય છે; (૨) જીવને જેટલી જેટલી જડની અપેક્ષા રહે છે, તેટલો તેટલો એ દુઃખી થાય છે. ઉધાડા પગે ફરતો હતો તો મંદિર ઉપાશ્રયમાં ગયે ચિંતા નહોતી. બૂટ રાખ્યા એટલે ચોરાવાની ચિંતા વધી. વળી બજારના જુદા, ફરવા જવાના બૂટ જુદા, એમ જડની અપેક્ષા વધારી એટલે ઓર રાગ વધ્યો, ચિંતા વધી, પાપખર્ય વધ્યો. એથી ધર્મખર્ય પર કાતર પડવાની. જડની જેમ વધુ અપેક્ષા, કાળજી, તેમ ધર્મની ઓછી રહેવાની. જડની જરૂરીયાતમાં સુખના દર્શને, ઈશ્વરને અર્પિત કરવા જેવો આત્મા જડને

અર્પિત કરી દીધો ! કેવી મહાન ગફ્ફલત ! આંખ સામે રોટલી અને પેંડા બેય આવ્યાં. પેંડાની અપેક્ષા થઈ, એટલે કે જરૂર લાગી, ‘પેંડા બહુ સારા’ એમ કર્યું તો પછીની પંચાતીનો પાર નહિ. એ તો જે સમજે કે “જો ‘પેંડા બહુ સારા’ કર્યું, તો આપણે ખરાબ થવું પડશે,” એજ રોટલીને સહજ વધાવી લઈ ખરાબીમાં પડતો બચી શકે. જાણો છો, ‘રત્નો બહુ સારા, વાવડી બહુ સરસ, નંદનવન ઘણું સુંદર...’ આમ જે દેવો જરૂર સારું ને જરૂરી કરવા જાય છે, એના બાર વાગી જાય છે ! મરીને એ પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાયમાં ચાલ્યા જાય છે ! કેવી કારમી સજા ! વીતરાગના શાસનની હદદે સ્પર્શના કરવી હોય તો શક્યતા મુજબ જડની જરૂરીયાત ઓછી કરતા ચાલો; અને ઊભી રહેલી જરૂરીયાતથી ભડકો, અમાંય કાપકુપ કરો.

જ્યાં જ્યાં જોશો ત્યાં ત્યાં જડના તોફાનથી જ દુઃખની પોકો દેખાશે. જ્યાં સુધી માણસ કાળી ચા પીને ચલાવતો હતો, ત્યાંસુધી સુખી હતો. હવે ગાંઠીયા વધા કે દુઃખ આવ્યું ! પછી તો ગાંઠીયા વિના જાણે મરવા પડ્યો ! આત્માને કોઈ મુડાલ બનાવનાર હોય તો જડની વધુ જરૂરીયાતો છે. પુણિયો હિંમત-હોશિયારીથી મગધના રાજા સામે વાતો કરતો હતો. “સાધમ્ની છો, આવો બેસો ! ફરમાવો આશા.” જરાયે શ્રીમંતાઈ કે સંપત્તિ એને આંજી જાય ? એ તો તેવાને આંજી જાય કે જે જડની અપેક્ષાઓથી મુડાલ બનેલા હોય. અમારે તો દૂધ ન મલે તો કાંઈ નહિ. જે મલે તે સહી. પેટનો ખાડો પુરાવો જોઈએ. ખાડો પૂરવા કાંઈ રત્નો ન પુરાય; ધૂળ ફેફાં જ પૂરવાનાં.

રૂપિયા તો મારા આહેસર દાદાના હતા ! :- આજની ભયંકર પરિસ્થિતિ જુઓ, કે સામગ્રી પૂરી છે છતાં પરમાર્થનાં દર્શન દુર્લભ થઈ ગયાં ! કેમ વારુ ? કારણ એ છે કે જાતના જ જ્યાં મોટા ખર્ચ હોય ત્યાં શું રાખ ખર્ચ્યે પરમાર્થમાં ? એ તો એ પંચિયું અને પછેડી ઓઢનારા, અને દાળ-રોટી ખાનારા ને પૈસા ખૂબ જ વધે, એ થોકબંધ પરમાર્થ કરી શકતા. મોજમજાહ, વટ-વહેવાર, ફેશન-સગવડના ખર્ચની આજે તો એટલી ભયંકરતા વધી ગઈ કે હિસાબ જ નથી. જાણે મોઢું દિવાનાપણું આવી ગયું છે ! એટલે હાથમાં પેટી ઉપાડી લેવાવાળાને કંજુસ કહે છે ! સિદ્ધિગિરિએ ગયેલા મારવાઈનો દાખલો આખ્યો હતો ને. એક મારવાઈ હતો. ધરરી તોસીને વર્ષીતપણું પારણું, એટલે સિદ્ધિગિરિ પર લઈ ગયો તોશીને છેલ્લી અણ્ણાઈ હતી. તળોટીમાં આવ્યાં. તોળીવાળો તો દસ રૂપિયા માગીને ઊભો રહ્યો. આ કહે છે ‘પાંચ રૂપિયા મલશે.’

એટલે ડોળીવાળો કહે છે, “આજે પાંચમાં ડોળી ન મળે, વૈશાખ સુદ  
ત્રીજના દહાડે ?”

તો મારવાડી કહે છે, “અલ્યા પણ અશક્ત ડેશી ઉપર શી રીતે પહોંચશે ?”

આ તો ડોસીને કહે “બેસી જી મા, ખભા પર ! ખભો સલામત છે !”  
ડોસીનો ભાર કંઈ બહુ નહોતો. પોતે ખખડધખ જુવાન હતો. શરમ નહોતી  
માતા-પિતાની સેવા કરવામાં. એ તો આજે ફેશનની લત છે કે સવારમાં ઉઠી  
માબાપને પ્રણામ કરતાં શરમ આવે ભાઈને ! ડોસી થોડું ચાલી, થોડું ખભા પર,  
એમ ડોસીને ઉપર પહોંચાડી ! હૈયું તો દાદાના દર્શન કરતાં નાચી ઉઠ્યું ! ડોસીને  
પૂછે છે ‘બોલ શું જોઈએ ?’ ‘પહેલી પૂજા.’ મોટા ખર્ચ લીધી એની ઉછરામણી.  
નીચે ઉત્તરતાં બિખારીઓને દાન, અને પોતાના તરફથી સાધર્મી વાતસલ્ય. પૂછનારા  
પૂછે છે “આ શું ? ડોળીવાળાને આપવા વધુ પાંચ રૂપિયા નહોતા મળતા તે તું  
હજારો ખર્ચે છે !!”

આ કહે છે “તમને ખબર નથી લાગતી, રૂપિયા તો મારા આદેસર દાદાના  
હતા, એટલે એમની પલાંઠીમાં મૂકાય ? કે આ ડોળીવાળાને અપાય ?” આ તો  
એ અલ્ય જરૂરવાળાની વાત. પણ આપણે તો પહેલા પોતાની ફાંદ મોટી હોય,  
પછી શું ધૂળ પરમાર્થ કરીએ ? જડની જરૂરિયાતો વધે કે દુઃખ, ગુલામી અને માયા  
પણ વધે છે, સાથે દીનતાને હીનતા પણ વધે છે.

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદધિ”

વર્ષ-૪, અંક-૫, તા. ૧૩-૮-૧૯૫૫



## શ્રી અરિહંત પરમાત્માની ઓળખાણ

ઉંચી અને નીચી શક્તિઓમાં વિવેક :-

માનવભવ જેવા સુવર્ણભવમાં શું વિશેષ મળ્યું છે ? બળવાન કાયાની  
શક્તિ નહિ, ચકોર ઈન્દ્રિયોની શક્તિ નહિ, પાવરધા હથ-પગ વગેરે વિશેષ  
અવયવોની, કે યુક્તિપૂર્વક છટાદાર બોલવાનું બળ નહિ; કિન્તુ હાર્દિક  
સદ્ભાવનાબળ, માનસિક સુબુદ્ધિબળ અને આત્મિક સુનિર્ણયશક્તિ સાથે  
સત્પુરુષાર્થશક્તિ. વિશેષ તરીકે એ મળેલ છે. માનવની કાયા ઈન્દ્રિયો વગેરેની  
શક્તિઓ અલબત ક્રીડા-પશુ આદિની શક્તિઓ કરતાં વિશેષ શક્તિઓ છે; પરંતુ  
એ માનવહદ્ય-મન-આત્માની શક્તિઓ કરતાં નીચી કોટિની છે. માનવના ઉપર  
કહેલી બળવાન હાર્દિક માનસિક અને આત્મિક શક્તિઓ અતિ ઉચ્ચ અને કિમતી  
છે. ત્યારે વિચારો કે નીચી કોટિની કાયા ઈન્દ્રિયો વગેરેની શક્તિઓનો ખૂબ  
ઉપયોગ કરી લેવાય અને ઉચ્ચ કોટિની એ હદ્ય, મન અને આત્માની શક્તિઓનો  
ઉપયોગ ન કરાય કે ઓછા કરાય એ શું મૂર્ખતા નથી ? જેની પાસે ગાડી, મોટર  
બંનેય છે એ બળદગાડીમાં રોજ બહુ ફરે અને મોટરમાં વર્ષમાં કોકવાર ફરે, તો  
એને લોકમૂર્ખ કહે કે બીજું કાંઈ ? ત્યારે તમે કહેશો કે અમે હદ્ય, મન અને  
આત્માની ભાવના-બુદ્ધિ-પુરુષાર્થ શક્તિઓનો પણ ખૂબ ઉપયોગ કરીએ જ છીએ,  
તો એ પ્રશ્ન છે કે એ ઉપયોગ કેવો કરો છો ? સદ્બુધ્યોગ કે દુરુધ્યોગ ? પશુ કરે  
એવો ઉપયોગ કે દેવ પણ ન કરી શકે એવો ઉપયોગ ? મળેલી આ વિશેષ  
કોટિની દુર્લભ શક્તિઓનો દુરુધ્યોગ ખૂબ પ્રમાણમાં કરાય અને સદ્બુધ્યોગનું દેવાળું  
હોય, એ કેટકેટલું દુઃખદ, દયાપાત્ર અને અણાનતાભર્યું કહેવાય ! ભૂલવા જેવું  
નથી કે આ શક્તિઓનો દુરુધ્યોગ કાયિકાદિના દુરુધ્યોગ કરતાં ઘણો જ નુકશાનકારક  
નીવડે છે, અને ભયંકર દુર્ગતિઓમાં ભવબ્રમણ કરાવનારો બને છે. માટે જ એવા  
નુકશાનથી બચવા અને અતિ ઉચ્ચ કોટિના લાભો મેળવવા માટે દુર્લભ શક્તિઓના  
સર્વ દુરુધ્યોગ ટાળી સુંદર સદ્બુધ્યોગ કરવાનો સતત પુરુષાર્થ આદરાવો જોઈએ.

**ઉચ્ચ શક્તિના ઉપયોગ :-** એ સહૃપ્યોગમાં (૧) ભાવના બળથી હદ્યમાં સદ્ભાવનાઓ અને પવિત્રતાને ભરયક ભરી દેવાની; (૨) બુદ્ધિબળથી મનને ઉચ્ચ કોટિની સદ્ભુદ્ધિઓમાં રમતું રાખવાનું; મનને સૂક્ષ્મ અને સુંદર કોટિની તાત્ત્વિક વિચારણા-યોજના-મનોરથો કરતું બનાવવાનું, તથા (૩) નિર્ણય-પુરુષાર્થ બળથી આત્માની પાસે મહાન તત્ત્વશ્રદ્ધાના નિર્ણય, મોક્ષમાર્ગના અને સિદ્ધાન્તોના નિર્ણયો તેમજ મોક્ષ-સાધનાના પુરુષાર્થ આદરવવાના. તાત્પર્ય એ છે કે ત્રિવિધ બળથી અંતરથી ઉચ્ચ આદર્શ-મનોરથોવાળા, સુમતિયુક્ત, સદ્ધવિચારક, વિવેકી, સત્કર્તવ્યના નિર્ધરિવાળા, પવિત્ર અને સત્પુરુષાર્થી બનવાનું છે.

### સહૃપ્યોગનું પહેલું સાધન :-

આ માટે પહેલું તો આપણી નજર સામે (૧) ઉચ્ચ આદર્શ પુરુષો, (૨) ઉચ્ચ આદર્શ જીવનસરણી, અને (૩) ઉચ્ચ આદર્શ સિદ્ધાન્તો જોઈએ. તો જ આપણા આત્મામાંથી અનાદિની ઠાંસીને ભરેલી મહિનતા દૂર જાય; અને આત્મામાં એ ઉચ્ચ આદર્શો, પવિત્રતા, પુરુષાર્થ વગેરે જગમગતા તથા જીવનવ્યાપી બની જાય.

**આત્મિક મહિનતા બે પ્રકારની છે.** એક તો ગમે તેવી વ્યક્તિ, વસ્તુ કે માન્યતા પર શ્રદ્ધા અને રુચિ એ મહિનતા છે. ત્યારે બીજી મહિનતા અસ્થુ આચયરણની મહિનતા છે. એ બંનેને ટાળવા માટે સમ્યક્તવ અને ચારિત્ર (વિરતિ) જ સમર્થ છે. જ્યારે બંનેય મહિનતા દૂર કરાશે ત્યારે જ આત્મા ઉન્નતિની ટોચે પહોંચશે. એમાંય જો પહેલી મહિનતા દૂર થશે તો જ બીજી મહિનતાને નીકળી જવાનો અવકાશ મળશે.

શ્રદ્ધાની મહિનતાથી તો માણસની કાંઈ કિંમત જ નથી રહેતી. તેમ વર્તનની મહિનતાથી પણ માણસ ઊંચો નથી આવી શકતો. દુનિયામાંય જુઓ કે જેને યોગ્ય વ્યક્તિ પર શ્રદ્ધા નહિ, યોગ્ય પ્રવૃત્તિની રુચિ નહિ અને સુયોગ્ય સિદ્ધાન્ત તથા મર્યાદા પર આસ્થા નહિ, તો એવા માણસની કાંઈ જ કિંમત નથી હોતી. સારો અમલ હજ્ય મુશ્કેલ હોય, પણ સારી આસ્થામાંથી ય જ્યારે માણસ જાય ત્યારે જીવનમાં શું રહ્યું? રોગી માણસ અનેક વૈદ ડોક્ટરો બદલ્યા તો કરે, પણ પાછો જે વખતે જેની દવા ખાતો હોય એ વખતે પણ જો એના પર શ્રદ્ધા ન રાખે, તો વહેમાં અને હેયા વિનાનો જ ગણાય ને? અથવા જેની સાથે સંબંધ લાગ્યો છે એવા માતા, પિતા, પત્ની, પુત્ર, શેઠ, વડીલ વગેરે ઉપર શ્રદ્ધા ન રાખે, તેમ શુદ્ધવ્યવહારના સિદ્ધાન્તો અને સારી પ્રવૃત્તિની રુચિ ન હોય તો એવાને માનવભવ મળ્યા પછી જીવન તો ગમે તેમ પુરુ થાય છે, પણ તે હંગધા વિનાનું અને કુશ્રદ્ધા-ભુવનભાનું એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ” (ભાગ-૧૮)

કુવિકલ્પો-કુપ્રવૃત્તિમાં અથડાઈ-કુટાઈને પૂર્ણ થાય છે. તો આ લૌકિક દૃષ્ટિની જેમ લોકોત્તર દૃષ્ટિએ માણસે યોગ્ય વ્યક્તિ, યોગ્ય તત્ત્વો અને યોગ્ય વર્તન ઉપર શ્રદ્ધા કેળવવી જોઈએ છે. સાથે, પ્રવૃત્તિ પણ પાપસ્થાનકોના ત્યાગપૂર્વક એકાંતે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં આદર્શવી ઘટે છે. એ માટે જ આદર્શ ઉચ્ચ પુરુષો, આદર્શ ઉચ્ચ સિદ્ધાન્તો અને આદર્શ જીવનસરણીને સતત નજર સામે રાખવાના છે. એ ઉચ્ચ આદર્શોની આસ્થામાં અને એને યોગ્ય અમલમાં હદ્ય, મન અને આત્માના ભાવનાબળ, બુદ્ધિબળ, વિવેકબળ અને પુરુષાર્થબળ ખરચવાના છે. આસ્થામાં આત્માનો સમ્યક્તવ ગુણ પ્રગટે છે; અમલમાં ચારિત્ર ગુણ પ્રગટે છે. ચારિત્ર સર્વથા અને અંશે એમ બે પ્રકારે હોય છે. અંશે ચારિત્રમાં ગૃહસ્થને યોગ્ય બાર પ્રતો આવે છે. મોક્ષ સર્વાશ-ચારિત્રથી જ મળે છે. પણ એ પામવા અંશેય ચારિત્ર અહીં આદર્શ પુરુષ તથા એમના વચન ઉપર શ્રદ્ધા કેળવવા અને એમનેજ નજર સામે સ્થિર રાખી લેવા, આદર્શ પુરુષ તરીકે શ્રી અરિહંત પરમાત્માને વ્યવસ્થિતપણે ઓળખી લેવા જોઈએ. મોક્ષના અનન્ય ઉપાયભૂત સમ્યક્તવમાં શ્રી અરિહંત પરમાત્મા પ્રત્યે અટલ વિશ્વાસ અને પ્રીતિ આવશ્યક છે. તો પ્રસંગતઃ સમ્યક્તવનો આછો ઘ્યાલ કરી લઈ, પછી એના એક વિષય તરીકે સુદેવની શ્રદ્ધાના પ્રસંગમાં પરમાત્મ તત્ત્વનો વિચાર કરીશું.

### ● સમ્યક્તવ-સમ્યગદર્શન ●

મનુષ્યના મનરૂપી મંદિરમાં શ્રી અરિહંત પરમાત્મા પવિત્ર પ્રતિષ્ઠા કરાવવા યોગ્ય છે. એવા માનવમનોમંદિરે પહેલાં તો જે ઉચ્ચ આદર્શો, નિર્મળ શ્રદ્ધાબળ અને પવિત્ર વિચારસરણીના અજવાળાં પાથરવાના છે, એના માટે સમ્યક્તવરૂપી દીપક પ્રગટાવવો જોઈએ. સમ્યક્તવ એટલે સમ્યગદર્શન. પૂ. વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિજી મહારાજ શ્રી તત્ત્વાર્થ મહાશાસ્ત્રમાં કહે છે કે,

**‘તત્ત્વાર્થશ્રદ્ધાનં સમ્યગદર્શનમ् ।’**

કલિકાલ સર્વજ્ઞ પૂ. આચાર્ય પુંગવ શ્રી હેમયંત્રસૂરીશ્વરજી મહારાજ શ્રી યોગશાસ્ત્રમાં ફરમાવે છે કે,

**‘રુચિર્જિનોકતતત્ત્વેષુ સમ્યક્શરદ્ધાનમુચ્યતે ।’**

સાર એ છે કે સર્વજ્ઞ વીતરાગ શ્રી જિનેશ્વરટેવોએ ફરમાવેલા તત્ત્વો પરની હાર્દિક શ્રદ્ધાનું નામ સમ્યગદર્શન છે. અર્થાત્ ‘જે જિનોએ કહ્યું તેજ સાચું અને શંકા વિનાનું છે. તમેવ સંચ્ચ નિસ્સંક, જં જિણોહિ પવેઇઅં’ એવી હાર્દિક શ્રદ્ધાનું નામ સમ્યગદર્શન છે.

(उ) तत्त्व :- ए तत्त्वो त्रष्णा प्रकारे हे : शेय तत्त्वो, हेय तत्त्वो अने उपादेय तत्त्वो. ए तत्त्वो पर रुचि एटले के त्रष्णेय प्रकारना तत्त्वोमांथी जे जे तत्त्व जेवा स्वरूपवाणु हे ते ते तत्त्व प्रत्ये अने अनुरूप हार्दिक वलश राख्वुं तेनुं नाम सम्यक्श्रद्धा हे. ‘अनुरूप’ एटले के (१) तत्त्व जे हेय स्वरूपवाणु हे तो अना प्रत्ये आत्मानुं असारता-निर्गुणतानुं भान, अशागमो, भय, तिरस्कार, अने त्यज्यतानुं वलश. एम (२) उपादेय तत्त्वो तरफ सारभूततानी अने सुखकारितानी भुद्धि, गमवापृष्ठ, निर्भयता-निश्चिन्तता, अने कर्तव्यतानुं वलश; अने (३) शेय तत्त्व तरफ शुद्धशान दृष्टि अर्थात् रागद्वेषरहित उदासीनतानुं वलश; आ त्रिविध वलश ए सम्यक्त्वनी अवस्था हे.

**बीज रीते उ तत्त्व :** अथवा तत्त्व एटले उपास्य तत्त्वो. ए त्रष्णा प्रकारे; (१) सुदेव (२) सुगुरु, अने (३) सुधर्म अना पर रुचि एटले के हार्दिक अभंड श्रद्धा; ए सम्यग्दर्शन.

अहीं पहेलां आ सुदेवादि त्रष्णा उपास्य तत्त्वोनो विचार करीए. केमके (१) श्री जैन संघमां आबालवृद्ध प्रसिद्ध हे के ‘भाई ! देवगुरुधर्म पर श्रद्धा राखो.’ बीजुं वधारे कांઈ न बनी शके तोय आटली श्रद्धा अवश्य राखो. वणी (२) उपर जे कही आव्या के उच्च आदर्श पुरुषो, आदर्श ज्ञवनसरणी अने आदर्श सिद्धान्तोने बराबर नजरमां राख्या करो, तेनो घ्याल आ सुदेव-गुरु-धर्मांथी मणे हे; अने आ मुख्य वस्तु हे. ज्ञवन ज्ञवतां एक वार हृष्टय सामे निरंतर आदर्श बराबर रम्या करे, पछी तो आत्मामांथी मखिनवृत्तिओ दूर थઈ पवित्रता आववामां तथा मखिन प्रवृत्तिओ अटकी पवित्र प्रवृत्तिओना भगीरथ पुरुषार्थ जागवामां वार नहि लागे. दुनियामां पश जुओ के ऊचा विद्यार्थी पर नजर राखनारो नीचा नंबरनो विद्यार्थी प्रेरणा पद्धति मेणवी ऊचे आवे हे. मोटा वेपारी पर दृष्टि राखीने नानो वेपारी आगण वधे हे. ऐवी रीते आपणे पश आदर्श पुरुष-परमात्माना आलंबने आत्मविकास साधवानो हे. जगतमां अनादिकाण्ठी सुदेव-सुगुरु-सुधर्मानुं तत्त्व एक सरखुं एक ज ज्ञातानुं चाल्यु आवे हे. अर्थात् अनंतकाण पूर्वेनुं पूछो, के अनंत काण पछीनुं पूछो, के सुदेव कोण ? सुगुरु कोण ? सुधर्म कयो ? तो एक ज जवाब हे के,

**सुदेव-सुगुरु-सुधर्मानी व्याख्या :-**

**सुदेव :-** अठारेय हुपण रहित अने योगीस अतिशयोथी युक्त, तथा सद्धर्मना आद्य उपदेशक श्री सर्वज्ञ वीतराग परमात्मा ए ज सुदेव हे.

**सुगुरु :-** आ ज्ञवन प्रतिज्ञापूर्वक पंचमहाप्रतधारी, सर्व सावध योगना

अने अना कारणभूत कंचन कामिनीना त्यागी, तथा जिनोक्तशास्त्रमर्यादाथी रहेनारा अने श्री जिनवयनानुसारी ज प्रुपणा करनार श्री साधु भगवंतो ए ज सुगुरु हे.

**सुधर्म :-** रागादि दोष रहित अवा अनंतज्ञानी सर्वज्ञ भगवंतोमे (श्री केवली भगवंतोमे) भाषेलो त्रिकालाबाध्य तत्त्वसिद्धान्तोथी संपन्न जे धर्म, तेज सुधर्म हे.

आमां, जोशो तो ज्ञानो के कोई वैयक्तिक देव-गुरु-धर्मनी वात नथी. अहीं तो देवत्वना गुणथी संपन्न होय ते देव, पछी भले नाम गमे ते हो. ते पश संसारी ज्ञव बनी शके हे. गुरुत्वना गुणथी युक्त होय ते गुरु, व्यक्ति गमे ते हो; अने साची धर्मताना स्वरूपवाणो होय ते धर्म. विराट विश्वमां एक मात्र जैन दर्शन निष्पक्षपातपणे आ वस्तु फरमावे हे, तेथी ज जैनदर्शन ऐज विश्वदर्शन हे, सौ कोई मान्य करी शके अेवुं शासन हे, सर्वश्रेष्ठ दर्शन हे. माटे ज संसारसाधना पडती मूळी ऐज एक आदरणीय हे; यावत् मोक्ष सुधी उपासनीय हे, अवश्य आराधवा योग्य हे. आनी श्रेष्ठता माटे युक्ति अने डेतु अहीं बताववामां आवशे.

### • सुदेव •

**जुदा जुदा धर्मोना ईश्वर :-** सुदेव एटले मोक्ष, धर्म अने तत्त्वोना मूणभूत आद्यप्रृपक अवा एकज साचा देवाधिदेव. जगतमां अनादि अनंत काणथी अवा सुदेव तरीके ज्ञवन्मुक्त पश पछी विदेहमुक्त बननारा अवा अनंतगुणसंपन्न वीतराग सर्वज्ञ श्री अरिहंत परमात्मा ज होय हे. नैयायिकादि केटलाको सुदेव एटले देवाधिदेव परमात्मा तरीके अनादिसिद्ध जगतकर्ता ईश्वरने माने हे; त्यारे वेदान्तीओ सूषिकाले उत्पन्न सूषिकर्ता ईश्वरने माने हे. भिमांसको वणी उपदेशक के सर्जनहार नहि पश मात्र मंत्रदेवताने उपासनीय परमात्मरूपे कहे हे. त्यारे वणी योगदर्शनवाणा परमात्मा तरीके अनादि शुद्ध सहज शक्तिमान आत्माने स्वीकारे हे. तो केटलाक महेश्वरवादी जेवा महेरबानी अने कोप करनार सर्व शक्तिमान ईश्वरने परमात्मा तरीके भजे हे. त्यारे सांख्य अने बौद्धो वणी तत्त्वोना आद्यप्रृपक अवा परिमितज्ञानी कपिल अने बुद्ध जेवाने परम पुरुष कहे हे. तो अवतारवादीओ वणी युगे युगे साधुज्ञोनो रक्षण माटे अने हुङ्क्यत्यकारीओना विनाश माटे अवतार लेनारने परमात्मा तरीके स्वीकारे हे. तेम, केई सर्जनहार ब्रह्माने, केई रक्षणकार विष्णुने, केई संहारक महादेवने, केई पवित्र पुरुष रामने, अने केई देवी शक्ति चंडी, भवानीने ईश्वरे सुदेव तरीके पूजे हे. आधुनिक काणे किंश्चित्यनो वणी आदम-ईव द्वारा ज्ञवो सर्जनहार अने काईस्ट द्वारा धर्मनो संठेशो

મોકલનારા ગોડ (God)ને પરમાત્મા તરીકે માને છે. તો મુખ્યિમો મહિમદ પેગંબર દ્વારા જગતને ધર્મસંદેશ આપનારા અલ્લાહને ખુદા-ઈશ્વર કહે છે.

સુદેવના જ આધારે આત્મામાં વલણ-વૃત્તિ-પ્રવૃત્તિ-ઘડતરને અવકાશ :- સુદેવના સ્વરૂપમાં આટલા બધા ભેદની વચ્ચે પરમાત્માનું સાચું સ્વરૂપ ઉપર કહું તેમ સંદેહમુક્ત એવા વીતરાગ સર્વજ્ઞ શ્રી અરિહંતનું જ શાથી, એ એક બુદ્ધિમાનો માટે ખાસ વિચારસરણી વસ્તુ છે. સુદેવ પરમાત્મા એ તો જીવનમાં અતિ જરૂરી આદર્શ અને આદેશકારી પરમપુરુષ છે. તેથી એમને સાચા રૂપમાં ઓળખી રાખવા જ જોઈએ. એમના આધારે જ પછી જીવનમાં આત્માનું વલણ, વૃત્તિ, પ્રવૃત્તિ અને ઘડતર થશે. બીજું એ પણ જોવું જરૂરી છે કે, કોઈએ અલ્લાહ અજ્ઞાન મનથી અમુક નીચા આદર્શની કદાચ જરૂર પણ માની, છતાં શું પરમાત્મામાં ખરેખર ! એવા આદર્શ ને ગુણ હોય છે ? દા.ત. કોઈને એમ થયું કે જીવવા માટે જરૂરી હવા, પાણી, વનસ્પતિ વગેરે કોઈ બનાવનાર વિના કેમ બને ? અને ન બને, તો આપણું શું થાય ? એમ વિચારી પરમાત્મામાં કર્તાપણાનો આદર્શ કલ્પો. પણ વિચારવાનું એ છે કે જેને પરમ આત્મા કહીએ, એનામાં એ સાચે જ ઘટી શકે ? આ માટે પહેલું એ જુઓ કે

પ્ર.- સુદેવની શી વિશેષતા છે ? અને આ દુનિયામાં ચિરકાળથી ફસેલા આપણા આત્માને સુદેવની જ જરૂર શા માટે છે ? તેમજ શું જીવના સદા આવા ને આવા ભટકતા રામના હાલ અને દુઃખમય પરાધીન દશા જ રહે છે કે એમાંથી કદાપિ છૂટકારો થાય છે ?

ઉ.- અહીં ઉત્તર એ છે કે જીવના ભવભ્રમણ અને કર્મને પરાધીન દશાનો અંત આવી શકે છે. કારણ કે જે હિંસા મિથ્યાત્વાદિ કારણોએ કરીને એ ભવભ્રમણ અને પરાધીનતા નીપણે છે, એ કારણો જો બંધ થાય તો સ્વાભાવિક છે કે ભવભ્રમણ અને પરાધીનતાનો અંત આવે. હવે જો આ સ્થિતિ ઊભી કરવી હોય તો એ કારણો કેવી રીતે બંધ કરવા, એનો માર્ગ અને એનું વિજ્ઞાન અર્થાત્ મોકષમાર્ગ ને સંસારમોક્ષનું સ્વરૂપ જાણવું જોઈએ. તેમજ બીજું એ કે આપણને એ માર્ગની જીવનમાં ઉત્તારનારનો આદર્શ પણ મળવો જોઈએ. આ જણાવનાર અને આદર્શ આપનાર પ્રથમ અને શ્રેષ્ઠ કોટિના કોઈ હોય તો તે સુદેવ છે. કેમકે સુદેવે પ્રથમતઃ પોતાના જીવનમાં આદર્શ કોટિનો મોકષમાર્ગ ઉત્તાર્યો હોય છે, અને પહેલાં સ્વયં ઉગ્ર સાધનાથી સર્વજ્ઞ વીતરાગ બની પછી જગતને મોકષમાર્ગનો તથા સંસાર-મોકષના સ્વરૂપનો બોધ આપે છે. શ્રેષ્ઠ આદર્શતા અને પ્રથમ (ઉપદેશકતા), આ બે વિશેષતા સુદેવની છે. આપણે જો ચતુર્ગતિમય સંસારની રંગભૂમિ પર આપણા જીવની થતી દુર્દ્શા,

કેવી ? કે એક વાર દેવનું ખોળીયું, તથા તે પછી તરત કૂતરાનું ખોળીયું; એક જીવનમાં રાજાપણાનો દમામ, તો પછીના જ જીવનમાં ઢેડ-ભંગનો અવતાર, એક વાર મહાશ્રીમંતનું જીવન, તો પછી તરતજ ઘોર દુઃખમય નારકનો જન્મ; આવી દુર્દ્શાનો અંત લાવી પરમ સુખ અને સ્વાધીનતાભર્યો મોકષ નીપણજવા માગતા હોઈએ તો સ્વાભાવિક છે કે આપણે આંખ સામે ઊંચો આદર્શ રાખી સત્ય તત્ત્વ સમજવા સાથે સાચા મોકષમાર્ગની આરાધના કરવી જોઈએ. આ બેય વસ્તુ સુદેવ થકી જ મળે એમ છે.

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદધિ”

વર્ષ-૪, અંક-૭, તા. ૨૨-૧૦-૧૮૫૫



## ૫ શ્રી અરિહંત પરમાત્માની ઓળખાણ

બીજાઓએ કલ્પેલું ઈશ્વરનું સ્વરૂપ ઈશ્વરમાં દોષયુક્તતા બતાવે છે :- કેટલાકો પરમાત્માના અવતારને એવી વૃત્તિ-પ્રવૃત્તિ અને અવસ્થાવાળા માને છે કે જેથી એમનામાં રાગદ્રેષાદિ દોપો હોવાનું સ્પષ્ટ જણાય. તો શું એવા દોપવાળા ઈશ્વર હોય ? દા.ત. એમણે ખોળામાં કે બાજુમાં પોતાની તરીકે સ્ત્રી રાખી હોય, તો એ રાગનું ચિહ્નન છે. વળી એમને પોતાને જો સંતાન હોય તો એ કામવાસનાની અને કામભોગની કિયાની નિશાની છે. હાથમાં શસ્ત્ર હોય તો એ દ્રેષનું સૂચ્યક છે. તેમ જો આંતરવૃત્તિ ભક્તને યુદ્ધમાં સહાય કરવાની થતી હોય, અને ખરેખરી સહાય કરવાનું ઈશ્વરે કર્યું પણ હોય તો તે રાગની નિશાની છે. ત્યારે દુષ્ટ માણસનો અંત કરવાની વૃત્તિ હોય, જેમ કે કહે છે ને કે... ‘વિનાશાય ચ દુષ્કૃતામ्, સંભવામિ યુગે યુગે ।’ અર્થાત્ ‘દુષ્ટ કાર્યો કરનારના વિનાશ માટે અર્થાત્ વિનાશ કરવાની વૃત્તિથી દરેક યુગમાં હું અવતરું છું,’ તો આવી વૃત્તિ એ અને એના ઉપર પાછી દુષ્ટના નાશની પ્રવૃત્તિ હોય, એ દ્રેષને સાબિત કરે છે. એમ જગતના સર્જનની પ્રવૃત્તિ હોય તો એમાં તો દિવ્ય સુખકારી સ્વર્ગ અને દારુણ દુઃખકારી નરકનાંય નિર્માણ આવે; એય રચવામાં રાગદ્રેષ તો જોઈએ જ; વધારામાં કૂરતા-કઠોરતાય જોઈએ. કેમકે ઈશ્વરે જેને માટે નરક બનાવી, એ પાપી જીવોને બિચારાને પાપ કરતી વખતે એમણે અટકાવ્યા નહિ અને હવે ભયંકર સજા કરવા એ તૈયાર થાય છે. એ તો એવું થયું કે માતાએ જાણવા છતાં પોતાના અજ્ઞાની પુત્રને જૂઠ બોલવા દીધું, પછી એની જીબ પર ડામ ટેવા ગઈ; પહેલાં ચોરી કરવા દીધી પછી હાથે

આમ દીધા. અથવા કોઈ માતાએ પહેલા જોવા કર્યું કે ‘પોતાનો એક હુણ દીકરો બીજા સજજન દીકરાને ખોટી રીતે મારે છે,’ આ જોવા છતાં માતાએ એમ મારતાને અટકાવ્યો નહિ, પણ મારી રવા પછી હુણ દીકરાને ફૂરપણે પીટવા લાગી. ત્યારે જો એમ કહેવામાં આવે કે ઈશ્વર ગુનો થવાનું જાણતા નથી કે અટકાવી શકતા નથી; તેથી અટકાવતા નથી; તો તો એમનામાં અજ્ઞાનતા કે અશક્તિ સાબિત થશે. ત્યારે શું અજ્ઞાની ઈશ્વર સ્વયં સાચું તત્ત્વસ્વરૂપ અને મોક્ષમાર્ગ જાણી શકે કે જગતને બતાવી શકે ? ઈશ્વર એટલે તો સર્વદોષ મુક્ત અનંતજ્ઞાની પૂર્ણ પુરુષ. એને બદલે દોષયુક્તતા, અત્યજ્ઞતા, અને અપૂર્ણતા એ ઈશ્વરત્વના વિરોધી છે.

### સદોષ ઈશ્વર શું આપે ? :

આમ ઈશ્વરમાં જો રાગ, દેખ, ફૂરતા, કઠોરતાદિ દોષોની વૃત્તિ-પ્રવૃત્તિ હોય તો સાધક એવા ઈશ્વરને આદર્શ તરીકે સામે રાખવાથી શું મેળવશે ? ભલે ઈશ્વરનો ઉપદેશ નિર્દોષ બનવા માટેનો હોય, પણ ખુદ ઈશ્વર જ પોતાના જીવન દોષોનું પ્રદર્શન કરે તો એ અનાદિના દોષમાં સબડતા જીવને કેવો આદર્શ આપે ? શાળાનો શિક્ષક ગમે તેવો સારો ઉપદેશ આપે કે ‘બીડી ન પીવાય,’ પણ પોતે જ વિદ્યાર્થી સામે ઊભો ઊભો ટેસથી જો બીડી પીતો હોય તો શું એ સારો આદર્શ આપી શકે ? એ વિદ્યાર્થી બીડીથી શું આધો રહેશે કે ઊલટું બીડી પીનારો બનશે ? ભલે એને ઈશ્વરની લીલા માનવામાં આવે, પરંતુ એવી લીલામાં કોઈ દોષરૂપતા નથી એવું તો ભક્તને જરૂર લાગશે; તેથી પોતાનીય તેવી રાગદ્વેષ કામની વૃત્તિ-પ્રવૃત્તિમાં કાંઈ વાંધો નહિ લાગે. આથી સંસારનો ડાસ કે પુણિ ?

### સદોષ ઈશ્વરથી ધર્મના નામે પાપપોષણ :-

બીજું એ છે કે ઈશ્વરનો ઉપદેશ તો મોક્ષમાર્ગનો જ હોય, એમાં જો એ કહે કે અપુત્રીયાની સદ્ગતિ ન થાય, તો ભક્ત શું સમજે ? એ જ કે “ઈશ્વરના આદેશથી પુત્ર અવશ્ય જોઈએ અને એ માટે પુત્રનો પરિગ્રહ તથા વિષયસેવન જરૂર જોઈએ તો એ પાપ નહિ, પણ કર્તવ્ય.” આવી સમજ-શ્રદ્ધા ધરવામાં પરિગ્રહ અને વિષયસેવન ઉપર સુગ-ધૂષા થવાની કયાં રહી ? પાપપણું માનવાનું કયાં રહ્યું ? જીવને અનાદિકાળથી એ બે સારી રીતે પ્રિય તો છે જ; એમાં હવે આથી મસ્તી વધે કે ઘટે ? અને તેય મસ્તી પાછી ઈશ્વરીય આદેશના નામે, ધર્મના નામે !! કેવું કારમું અજ્ઞાન ! એથી જ આવો ધર્મના નામે કહેવાતો ઈશ્વરીય ઉપદેશ મૂઢ જીવોને અનાદિના રાગ, કામ, મૂળધ્યાદિ ભયંકર દોષોની પોષક પ્રવૃત્તિ સેવતા રખવશે. એટલું જ નહિ, પણ એને કર્તવ્ય માનવાની મિથ્યામાતિ પોષવા સાથે પાપોમાં ડંખ, કંપ, ભય બુદ્ધિ વગેરે થવાનું પણ ઉતાવી દેશે ! એમ જે ઘર

સંસાર ઉપર જીવને અનાદિકાળથી ગ્રીતિ તો છે જ અને સંસારના અનેક નિમિત્તના યોગે જ પુનઃસંસારવર્ધક રાગદ્વેષાદિ દોષો પોષાયા છે; એનો સર્વથા ત્યાગ નહિ, પણ ઊલટું કર્તવ્ય પાલન, માનવર્ધમ, સાચું પરીક્ષા સ્થાન, વગેરે કલ્પિત ધર્મના નામે એ ઘર સંસારને એ ગૃહસ્થપણાને જીવનભર ચલાવવાનું ઈશ્વર ઉપદેશો તો જીવો એ સંસારપાલન નિઃસંકોચપણે અને પાપ માન્ય વિના કરવાના ! તેથી એ સાંસારિક જીવન ભૂતકાળની જેમ અહીં પણ એ જીવમાંય રાગદ્વેષાદિ દોષોનું સિંચન કર્યે જશે; તો જીવ ઊંચો ક્યારે આવશે ? તેમ એ પણ છે કે ઈશ્વર જો સર્વજ્ઞ નહિ તો આખા જગત સાથે અનંતાનંત કાળથી સંકળાયેલા તત્ત્વો કેવી રીતે ઉપદેશી શકશે ? એટલે, કહેવાનો સાર એ છે કે,

**સુદેવ કેવા ન હોય :-**

(૧) જે ઈશ્વર કહેવાવા છતાં સ્વ જીવનમાં રાગ-દ્વેષાદિની પ્રવૃત્તિવાળા હોઈ ભક્તને આદર્શ તેવો પૂરો પાડે છે.

(૨) જેમના ઉપદેશમાં મિથ્યાત્વ, હિંસાદિ, તથા રાગ-દ્વેષાદિ પાપોના સર્વત્યાગનો અને એને અનુરૂપ ત્યાગમય જીવનમાર્ગનો મુખ્ય સુર નથી, કે એ જ કર્તવ્યનો નિર્દેશ માત્ર પણ નથી.

(૩) જે પોતે અ-સર્વજ્ઞ હોવાથી અનંતાનંત કાળના સમસ્ત જગતના ભાવો જાણતા નથી, તેથી તેની સાથે સંકળાયેલા તત્ત્વોને જાણતા ન હોવાથી એવા સનાતન સત્ય તત્ત્વોને જગતને ઉપદેશી શકતા નથી.

એવી વ્યક્તિ સાચા પરમાત્મા કે સુદેવ હોઈ શકે નહિ. સુદેવ તરીકે એવાને માની શકાય નહિ.

**સુદેવ કેવા હોય ? :-** સુદેવ એવા જોઈએ કે

(૧) જેમના ઉચ્ચ આદર્શની દીવાદાંડીને નજરમાં રાખવાથી આપણું જીવન જહાજ હજ્ય ફરીથી રાગદ્વેષ-કામકષાયાદિ દોષોની ખડક સાથે અથડાઈ પડે નહિ; પાછું,

(૨) જેમના સંપૂર્ણ ત્યાગ-વિરાગ અને સમ્યગ્દર્શનના ઉચ્ચ ઉપદેશથી પણ રાગાદિપોષક જીવને છોડવાનું બને. તેમજ

(૩) જેમના અનંતજ્ઞાનની દૃષ્ટિમાં દેખાયેલ સાચા ટંકશાળી તત્ત્વોના ઉપદેશથી આપણે અતાવની શ્રદ્ધા-સમજના ઘેરા અંધકારમાં અથડાતા ટીચાતા ન રહીએ, પણ હવે ઉચ્ચ તત્ત્વ શ્રદ્ધા-તત્ત્વજ્ઞાનના પ્રકાશ પામી ખરેખરી મોક્ષમાર્ગની સાધના સાધી લઈ સંસારથી છૂટી મુક્તિના પરમપદે પહોંચી જઈએ. સુદેવ આવા જોઈએ. એટલું જ નહિ પણ

(૪) જે એવા સાચા દેવાધિદેવરૂપ સુદેવ સ્વર્ય જીવનમાં મહાવૈરાગ્યથી સંસારિક રીતમાત અને રાગદ્રેષાદિ પોષક બીજી પ્રવૃત્તિનો સર્વાશે ત્યાર કરવા પૂર્વક વીતરાગ બનેલા હોય, મહાન તપસ્યાદિ દ્વારા જ્ઞાનાવરણીયાદિ કર્મનો સર્વથા ક્ષય કરીને અનંતજ્ઞાની સર્વજ્ઞ બનેલા હોય, તથા જગતને ઉપદેશ મહાત્યાગ વૈરાગ્ય-અહિસાદિનો આપતા હોય, તથા યથાર્થ તત્ત્વબોધ કરાવતા હોય.

એટલે એ નક્કી થયું કે જે કોઈ વીતરાગ સર્વજ્ઞ અરિહંત અને સાચા મોક્ષમાર્ગના તથા જગતના તત્ત્વના યથાર્થ ઉપદેશક તીર્થકર છે, એ જ સુદેવ છે. મોક્ષાભિલાષી જીવે સુદેવ તરીકે એમને જ માનવા જોઈએ. જગતમાં એવા સુદેવ હોઈ શકે છે; તેથી એ કાલ્યનિક નથી. જગતમાં એવા પરમાત્મા એ એક વાસ્તવિક શ્રેષ્ઠ પદાર્થ છે.

### સુદેવમાં પાંચ બાબત વિચારવાની :-

એવા વીતરાગ, સર્વજ્ઞ, અરિહંત તીર્થકર ભગવાનનું ૧. સ્વરૂપ શું, ૨. એમનું જીવન કેવું, ૩. એમનામાં ગુણો કયા કયા, ૪. ભગવાન તરીકેની એમની વિશિષ્ટ શક્તિઓ કેવી કેવી તથા ૫. જગત ઉપર એમના ઉપકાર શા શા.

આ પાંચ રૂપે એમની ઓળખાણ કરી લેવી જોઈએ.

### ● ૧. પરમાત્માનું સ્વરૂપ ●

સાચા સુદેવ એ સંસારી આત્મામાંથી જ પરમાત્મા બની અરિહંત તીર્થકર બનેલ હોય છે. માત્ર, જેમ અનેક રલોમાં જાત્યરલ ઠેડ ખાણમાં પડ્યું છે, ત્યારનું બીજા રલો કરતાં જુદી જાતનું એટલે કે વિશિષ્ટ કોટિનું હોય છે, તો જ તે બહાર નીકલ્યા પછી સંશોધન પામીને બીજા કરતાં મહાયદીયાતા તેજવાળું અને પાણીદાર હોય છે; એવી રીતે સુદેવ પરમાત્મા બનનાર આત્માઓ પણ અનાદિ કાળથી બીજા આત્મા કરતાં મૌલિક વિશિષ્ટતા ધરનારા હોય છે. કાલકમે એ માનવભવ સુધી ઊંચે આવીને વિશિષ્ટ સાધના દ્વારા તીર્થકરપણાનું પુણ્ય ઉપાર્જિ છે. એ પછી બીજા ભવે મનુષ્યપણે એ ઉત્કૃષ્ટ પુણ્યના ઉદ્યક્તાને ધારીકર્મનો ક્ષય કરવા પૂર્વક દેવાધિદેવ તીર્થકર પરમાત્મા બને છે. આ ભરતક્ષેત્ર જેવામાં અમુક અમુક કાળે કાળે જ માત્ર ચોવીસ-ચોવીસ તીર્થકર દેવો થયા કરે છે; અને મહાવિદેહ ક્ષેત્રમાં સદા તીર્થકર દેવો થયા કરે છે.

તીર્થકર પરમાત્મામાં ચોગ્રીસ પ્રકારની વિશેષતાઓ (અતિશયો) હોય છે, જેનું વર્ણન આગળ કરાશે. એમાંથી મુખ્ય ચાર અતિશયો બરાબર તીર્થકરપણાની અવસ્થાનો આછો પણ ચોક્કસ પ્રકારે ખ્યાલ આપે છે. તે આ : ૧.

અપાયાપગમાતિશય, ૨. જ્ઞાનાતિશય, ૩. પૂજાતિશય અને ૪. વચ્ચનાતિશય. પરમાત્મામાં આ ચાર અતિશયો પ્રગટ્યા પછી જ એ ઉપદેશ કરે છે.

૧. અપાયાપગમાતિશય બે પ્રકારે હોય છે. એક સામાન્ય અને બીજો વિશેષ. સામાન્યમાં, અપાય=અઠાર પ્રકારના દૂષણો; તેનો અપગમ=નાશ. અર્થાતું સામાન્ય અર્થમાં અપાયાપગમ એટલે ૧૮ દૂષણોનો નાશ. વિશેષ અર્થમાં પોતે વિચરતા હોય તેનો સવાસો યોજના પ્રદેશમાં અપાય=મારી, મરકી, વગેરે ઉપદ્રવોમાં સાત પ્રકારની ‘ઈતિ’ દૂર થાય છે. ૧. અતિવૃષ્ટિ, ૨. અનાવૃષ્ટિ, (લીલોસુકો દુકાળ), ૩, ઉદ્દર વગેરે બહુ જીવોત્પત્તિ, ૪, પતંગીયા તીડ વગેરેનો ઉપદ્રવ, ૫. પ્લેગ, મરકી વગેરે મારક રોગો, ૬. સ્વચ્છકભય (પોતાના દેશનો જ બળવો), અને ૭ પરચકભય. (દુશ્મન રાજાનું આકમણ) તેનો અપગમ=શાંતિ, નિવારણ. અર્થાતું તીર્થકર પ્રભુ વિચરતા હોય ત્યાંથી ચારે બાજુના સવાસો જોજનમાંથી મારી, મરકી વગેરે ઉપદ્રવો શાંત થઈ જાય છે, ટળી જાય છે.

અઠાર દૂષણો પણ બે રીતે ગણાવવામાં આવે છે. એક તો, ચાર ઘાતી કર્મો જે નાશ પામે છે, એમાં જ્ઞાનાવરણકર્મના ઘરનો દોષ ૧. અજ્ઞાન, દર્શનાવરણકર્મથી નીપજતો દોષ ૨. નિત્રા, અંતરાય કર્મથી થતા દોષ દાનાદિ પાંચ લાભ્ય (શક્તિ)માં પાંચ વિઘ્ન, એમ ગ્રાસ કર્મના સાત દોષ; અને મોહનીય કર્મના ઘરના ૧૧ દોષ: ૮ મિથ્યાત્વ, ૮ અવિરતિ, ૧૦ રાગ, ૧૧ દ્વેષ, અને ૧૨ કામ, એ પાંચ અને ૧થી ૧૮ હાસ્યાદિ છ (હાસ્ય, શોક, રતિ, અરતિ, ભય, જુગુપ્સા), એમ કુલ ૧૮.

### બીજી રીતે ૧૮ દૂષણો :-

૧ અજ્ઞાન, ૨ નિત્રા, ૩ અંતરાય એ ગ્રાસ કર્મના ગ્રાસ. મોહનીય કર્મના પંદર; તે આ, કોધાદિ ૪ કખાય, એમ, હાસ્યાદિ ૬ એમ ૧૩, ૧૪મું નિંદા, ૧૫ કામ, ૧૬ મોહ, ૧૭ મિથ્યાત્વ, અને ૧૮ અવિરતિ. શ્રી તીર્થકર પરમાત્મામાં આમાનું કોઈ પણ દૂષણ સૂક્ષ્મ કોટિનું પણ હોતું નથી; તો જ તે પરમ એટલે સર્વોચ્ચ અને સર્વશુદ્ધ આત્મા છે. ઉપર ગણાવેલા દૂષણો તો તે કર્મના ઉદ્યથી આત્મામાં ઊભી થતી સ્બલનાઓ અને વિકારો છે. પરમ આત્મામાં એટલે કે શુદ્ધ આત્મામાં એવી કોઈ પણ સ્બલના હોઈ શકે જ નહિ. તેથી જ સાધક આત્મા માટે એજ સર્વશ્રેષ્ઠ આદર્શ નજર સામે રાખવાનો હોય છે.

૨. જ્ઞાનાતિશય : અઠારેય દૂષણો નાશ પાભ્યાથી તીર્થકર પરમાત્મામાં કેવલજ્ઞાન કેવલદર્શન પ્રગટે છે. તેનાથી લોક, અલોક સમસ્ત જગતના સર્વ જીવો અને સર્વ પુદ્ગલાદિ અજીવ દ્રવ્યોની સર્વ ભૂત-ભાવી વર્તમાનકાળની દરેક પર ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-શ્રી અરિહંત પરમાત્માની ઓળખાણ (ભાગ-૧૮)

અવસ્થા સ્વરૂપ વગેરે પ્રત્યક્ષ જાણો છે અને જુએ છે. એ અનંતજ્ઞાન-દર્શનમાં જોવા જાણવામાંથી ક્યાંય કશું જ બાકી રહેતું નથી. તે પણ મનનો ઉપયોગ મૂક્યા વિના સદા જોતા જાણતા બિરાજે છે. દા.ત. જેમ દર્શનમાં સહજભાવે એની સામેની બધી ખુલ્લી ચીજોનું એકી સાથે પ્રતિબિંબ પડે છે; એવી રીતે આ અનંતજ્ઞાન-દર્શનમાં સમસ્ત દ્રવ્યોના ત્રિકાળવર્તી ભાવો જાણો પ્રતિબિંબિત થાય છે, દરેક ભાવ પર જ્ઞાનનો પ્રકાશ પડે છે. આવા જ્ઞાનથી એ પ્રભુ સર્વજ્ઞ બન્યા. તેથી એમનામાં હવે લેશ માત્ર અજ્ઞાનતા નથી. એટલે કે જગતમાં ક્યારેય, ક્યાંય પણ કોઈ પણ બનેલ પ્રસંગ પદાર્થ કે પ્રવૃત્તિને ન જાણવા-જોવાપણું નથી. એ બધું જોવા મુજબ જ જે તત્ત્વો જેવા રૂપે છે, તે રૂપે જ એ ઉપદેશે છે. મોક્ષ-સંસારનું સ્વરૂપ અને મોક્ષમાર્ગ બરાબર હોવા મુજબ જ વર્ણવે છે. તેથી અસત્યનો લેશ પણ નથી. વળી પૂર્વોક્ત રાગ દ્વેષાદિ અદ્ભાર દૂષષ્ઠો નીકળી જવાથી સાચું જાણવા છતાંય, એ દોષોના નિમિત્તે બોલાતું જૂદું બોલવાનો પણ, અહીં અવકાશ નથી, માટે જ આવા સર્વજ્ઞ વીતરાગ પરમાત્માનો જ ઉપદેશ યથાર્થ, સત્ય, વિશ્વસનીય અને આદરણીય છે. એ જ હોઈ શકે.

**૩. પૂજાતિશય :** તીર્થકર પરમાત્મા જ્યારે કઠોર આત્મસાધનાથી વીતરાગ સર્વજ્ઞ બને છે, ત્યારે તીર્થકરપણાનું પુષ્ય પ્રગટ થાય છે. એમાં, સ્વર્ગમાંથી ઇંડ્રો અને કરોડો અભાસો દેવ-દેવીઓ અહીં આવી એમની ભારે પૂજાભક્તિ કરે છે. સમવસરણ રચે છે, દુન્હુભિ બજાવે છે, ઇન્દ્ર જેવા ચામર વીજે છે, દેવતાઓ નૃત્ય કરે છે, પ્રભુના ગુણગાન કરે છે, સુગંધિતજ્જલ અને પુષ્પની વૃષ્ટિ કરે છે, પ્રભુના સુરમાં મીઠી બંસરીના મધુરા જીણા સુર પૂરે છે. પ્રભુને જુકી જુકીને પ્રણામ કરી અપૂર્વ હર્ષ અને આતુરતાથી પ્રભુની મીઠી દેશના સાંભળે છે. શ્રી તીર્થકર પરમાત્માની પૂજા થવામાં સર્વજ્ઞ બન્યા ત્યારથી સદા જગ્ઘન્યથી એક કોડ દેવતા પ્રભુની સેવામાં સાથે જ રહે છે. પ્રભુને પગ મૂકવા નવ સુવર્ણ કમલો રચાઈ જાય છે. તે, પ્રભુ ચાલે છે ત્યારે; જાણો સાથે ચાલે છે. પાછળ પાછળના બજ્જે સુવર્ણ કમળ આગળ આગળ આવતા જાય છે. તે કમળ પાછળ સ્પર્શમાં માખજાના પિડા જેવા અતિ સુકોમળ હોય છે. વળી પ્રભુની પૂજામાં આઠ પ્રતિહાર્યની શોભા થાય છે,

તે આઠ પ્રાતિહાર્ય આ :- નીચેથી ઉપર ગણાતાં, ૧. સિંહાસન, ૨. ચામર, ૩. ભામંડળ, ૪. છત્ર, ૫. પુષ્પવૃષ્ટિ, ૬. અશોકવૃક્ષ, ૭. દિવ્ય ધ્વનિ અને ૮. દેવ-દુન્હુભિ. પ્રભુ ચાલે ત્યારે સિંહાસન અને છત્ર આકાશમાં ચાલે છે. પ્રભુને બેસાં હોય ત્યારે સિંહાસન નીચે ગોઠવાઈ જાય છે. ઉપદેશ દેવા સમવસરણમાં ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ” (ભાગ-૧૮)

બિરાજે ત્યારે અશોકવૃક્ષ પ્રભુની પાછળ રહી સમસ્ત પર્ષદાને છાયા આપે છે. ભામંડળ પ્રભુના મુખની પાછળ ચમકનારો તેજનો ગોળાકાર પૂંજ છે તે થાળી જેવો ગોળ અને કિરણો પ્રસારતો હોય છે, તથા પ્રભુની અનુપમ કાન્તિને વળી કોઈ અધિક વધારી દે છે. પ્રભુને જોનારની આંખો પ્રભુ ઉપરથી ખસી શકતી નથી; એટલી બધી લોકોત્તર મુખમુદ્રાની રમ્યતા, મનોહરતા હોય છે. દુન્હુભિ બજ્જને ચારેબાજુના પ્રદેશમાં લોકોને આ મુક્તિપુરીમાં લઈ જનારા સાર્થવાહ આવ્યાની ખબર આપે છે, અને એમનું શરણ લઈ લેવાની હાકલ કરે છે. દિવ્યધ્વનિ પ્રભુની દેશનાના અવાજમાં સંગીતનો આલાપ પૂરે છે. પુષ્પવૃષ્ટિ એવી થાય છે કે આખું વાતાવરણ જાણો મધ્યમધતો બગીચો; અને પાછી ખૂબી એ કે લોકો ચાલે કરે છતાં પ્રભુના અતિશયથી પુષ્પને કિલામજા ન થાય એવી રીતે, અને ડીટીયા નીચે અને પાંખડીઓ ઊંચી એવી રીતે પુષ્પવૃષ્ટિ થયેલી હોય છે.

સમવસરણની શોભા તો અલૌડિક હોય છે; તે પણ એક માત્ર તીર્થકરદેવો માટે જ રચાય છે. એમાં ઉપરાપર ત્રણ ગઢની રચના દેવતાઓ કરે છે. નીચેનો ગઢ ચાંદીનો, એમાં મથાળે સુવર્ણની કંગરી અને અંદરના ભાગ પર શ્રોતાના વાહનો મૂકવાની જગ્યા રાખીને અંદરના વચ્ચા ભાગમાં બીજો સુવર્ણનો ઊંચો ગઢ રત્નની કંગરીવાળો હોય છે. ત્યાં વળી પશુઓ, પંખીઓ વગેરે તિર્યથ પ્રાણીઓને બેસવાની જગ્યા છોડી વચ્ચમાં ઊભો ગીજો ગઢ રત્નનો અને ચંદ્રકાંતમણિની કંગરીવાળો કરેલો હોય છે. એના પર પ્રભુ અને દેવ-માનવની ભાર પર્ષદા બેસે છે. એ અને તિર્યથો ત્યાં પ્રભુની દેશના ચાલે છે તેને અતિશય ઉલ્લાસ-આતુરતાથી સાંભળે છે, દરેક ગઢની ચારે બાજુ ગઢ ઉપર ચઢવાના પગબીઆ અને ચઢીને અંદર પેસવાના તોરણવાળા સુશોભિત દરવાજા હોય છે. સમવસરણની નીચે ઊંચા ધર્મચક અને ઈન્દ્રધ્વજ ઊભેલા શોભે છે. ઉપરના ત્રીજી ગઢની ઉપર વચ્ચમાં ઊંચું અશોકવૃક્ષ હોય છે. એની આગળ પૂર્વ દિશામાં રત્નમય સિંહાસન ઉપર જગતગુરુ તીર્થકરદેવને ઈન્દ્ર વિનંતિ કરીને બેસાડે છે. બાકીની ત્રણ દિશામાં દેવતા પ્રભુના બરાબર સમાન દેખાય એવા ત્રણ પ્રતિબિંબ ગોઠે છે, અને એ પ્રભુના અતિશયથી સમાન કાંતિવાળા ભાસે છે; જેથી ચારે દિશામાં બેઠેલા લોકોને એમજ લાગે કે પ્રભુ અમારી સામે જ છે. પ્રભુની આસપાસ ભાર પર્ષદા બેસે છે, તેમાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચાર; અને વંતર-ભવનપતિ-જ્યોતિષી-વેમાનિકના દેવો તથા દેવીઓ એ આઠ; એમ ભાર પર્ષદા હોય છે. પ્રભુની સામે જમજા હાથે સૌથી આગળ ગણધર ભગવાન પણી કેવળજ્ઞાની મહર્ષિઓ, પણી મન:પર્યાયજ્ઞાની વગેરે મહર્દ્ધિક સાધુઓ તથા પણી પાછળ બીજા સાધુ મહારાજો હોય છે. પણી પાછળ

વैमानिक દેવીઓ અને સાધ્વીઓ ઉભી હોય છે. પ્રભુ ત્યાં ધર્મની અને તત્ત્વની દેશના આપે છે; અને જીવોને બોધ પમારી એમના મિથ્યાત્વાદિ દોષો હઠાવીને એમને સાધુપણું શ્રાવકપણું અને સમ્યક્ત્વ, આપે છે. ત્યાં કુમતોની અને મિથ્યાત્વાદિની ભેખડો તુટી જાય છે.

(૪) વચનાતિશય : પ્રભુ કે દેશના આપે છે, તે વાણી પાંત્રીસ ગુણવાળી હોય છે. એનું વર્ણન આગળ અપાશે. એમાં એક મિઠાશ એવી હોય છે કે દા.ત. દૂરથી જેઠ માસના ધીખતા તાપમાં શેઠની ધમકીથી બીજી વાર ભારે લાકડાનો ભારો માથે ઊંચકી કોઈ દુર્બળ ડેશી અત્યંત થાકેલી અને બહુ ભૂખ-તરસથી ખાનપાનની ઉત્તાવળમાં ઝટપટ ઝટપટ ચાલી આવતી હોય, અને ત્યાં એમાંથી એકાદ લાકું નીચે પડી ગયું તેને લેવા એક હાથે માથે ભાર પકડી રાખી. કેદેથી નમી બીજો હાથ નીચો નમાવે, બરાબર એટલામાં જ ધારો નજીકમાં રચાયેલા સમવસરણ પરથી નીકળેલી પ્રભુની મધુરી વાણીનો સુર ડેશીના કાન પર પડે, તો એ સાંભળવાના રસમાં એમજ વાંકી ને વાંકી વળેલી ઉભી રહી જાય અને ભૂખ, તરસ, થાક, અશક્તિ, બધું ભૂલીને મહા આનંદમાં મગન થઈને એમજ સાંભળ્યા કરે; એટલી બધી મીઠાશ પ્રભુની વાણીમાં હોય છે. વળી તે વાણી સર્વ પ્રકારના પણ, પંખી, માનવ અને દેવો પોતપોતાની ભાષામાં સારી રીતે સમજ શકે છે. તેમજ એક પ્રકારે બોલાયેલું પણ પ્રભુવચન અનેક જીવોના હદ્યમાં ઉઠતા જુદા જુદા સંદેહોને એકી સાથે દૂર કરી દે છે. પ્રભુની વાણીના પ્રભાવ આગળ ભલભલા ભેજાંબાજવાદી પાખંડીઓ પણ ત્યાં વિવાદ કુર્તક ચલાવી શકતા નથી; કિન્તુ સાંભળતા જ બેસી રહે છે. અનંત જ્ઞાનને ધરનારા પ્રભુ પર્ષદાના સર્વ પ્રશ્નોના ઉત્તર કહી શકે છે. કેમકે એમનાથી શું અજાણ્યું છે? જીવોના અનંત ભવો અને એકેક પરમાણુના અનંતકાળના પયદ્યો (અવસ્થાઓ) હાથમાં રહેલા સ્પષ્ટ મોટા આમળાની જેમ પ્રત્યક્ષ જુએ છે.



## શ્રી અરિહંત પરમાત્માની ઓળખાણ

આદિકર સ્વયંબુદ્ધ-પુરુષોત્તમ-પુરુષસિંહ વગેરે વિધિમુખે પ્રભુ સ્વરૂપ :-

શ્રી તીર્થકર પ્રભુ ધર્મના આદિકર પહેલા ઉપદેશક હોય છે. તે પણ વ્યવસ્થિત ધર્મતીર્થના-ચતુર્વિધ સંઘ અને સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગને વ્યવસ્થિતપણે સ્થાપનારા છે. તે પણ જન્મથી સ્વયંબુદ્ધ અને પુરુષાર્થથી સ્વયં સર્વજ્ઞ બનેલા છે.

પ્રભુ ચાર મહાઅતિશયોથી સાચા પુરુષોત્તમ છે, પુરુષસિંહ છે, પુરુષોમાં શ્રેષ્ઠ પુંડરિક અને શ્રેષ્ઠ ગંધહસ્તિ સમાન છે. જેમ ગંધહસ્તિ બીજા ઉન્મત હાથીઓના મદને ગાળી નાખે છે, તેમ પ્રભુ પણ પૂર્વે કહ્યું તેમ, જે બે પ્રકારના અપાય પોતાના રાગદ્રોષ અને લોકમાં મારી મરકી વગેરે, તેને શાંત કરી દે છે. શ્રેષ્ઠ પુંડરિક જેવા પ્રભુ કેવળજ્ઞાનરૂપી લક્ષ્મીનું નિવાસસ્થાન બને છે. પછી પ્રભુની સતત્વસન્માર્ગ પ્રકારાક અને કુમત-કુમાર્ગ વિધ્યંસક એવી જે દેશના ગાજે છે એ સિંહનાદની જેમ ક્ષુદ્ર મૃગલારૂપી મિથ્યાત્વ, ને મિથ્યાદષ્ટિ જીવોને ત્રાસ પમાદનાર બને છે. તેમ, પ્રભુ રાગદ્રોષાદિ આંતર દુશ્મનો પ્રત્યે સિંહ જેવા કૂર-કઠોર બની એનો કંચ્ચરધાણ કરવામાં સિંહ જેવા શૂરવીર હોય છે, તેથી પ્રભુ ખરેખરા પુરુષસિંહ છે, તેમજ પ્રભુ એવા પુરુષોત્તમ છે કે જેમને અસંખ્ય દેવદેવેન્દ્રો જેવા પણ પૂજે છે, ભજે છે, જેમનું શરાણું માને છે; અને જેમનામાં શ્રેષ્ઠ સહજ શક્તિઓ, ગુણો, સાધના અને ઉપકારકતા હોય છે, એનું વર્ણન આગળ કરાશે.

**લોકોત્તમાદિ :-** એવા એ સુદેવ લોકમાં પણ ઉત્તમ હોય છે. પ્રભુ પંચાસ્તિકાય (જીવપુદ્ગલાદિ દ્રવ્યો)ના સાચા પ્રરૂપક હોવાથી લોકાદિત છે. અનાદિ કાળથી મૌહ લૂંટારાથી લૂંટાતા પીડાતા ભવ્ય લોકોનું વિમોચન-સંરક્ષણ (યોગ-ક્ષેમ) કરે છે, માટે સાચા નાથ છે; તેથી લોકનાથ કહેવાય છે. વળી એ ભવ્ય લોકોને પ્રભુ મોક્ષમાર્ગ પ્રકારશતા હોવાથી સાચા લોકપ્રદીપ છે. અને વિશેષ કરીને ઉત્તમ લોક જેમકે ગણધર ભગવાન, એમનામાં દ્વાદશાંગી (સમસ્ત શુતજ્ઞાન)નો ઉદ્ઘોત કરતા હોવાથી પ્રભુ લોકપ્રદોત્કર છે.

**અભ્યદાતા વગેરે, ધર્મદાતા વગેરે :-** ત્રણ લોકના નાથ અને અનંત જન્મ-મરણની જંજાળમાંથી સદાને માટે ઉદ્ધરનાર પરમપુરુષ શ્રી પરમાત્મા મૌલિક વિશેષ સ્વરૂપને ધરનારા હોય છે. પંથ ભૂલેલા અને ભવાટવીના ભયમાં ફસેલા જીવોને

પ્રભુ અભ્ય-ચક્ષુ-માર્ગ-શરાણ તથા બોધિનું દાન કરનારા હોય છે. જીવોને સાચું સુખ પમાદવું છે, તેથી દેવાધિદેવ શુદ્ધ ધર્મનું દાન કરવા સાથે સાચી ધર્મપ્રક્રિયાના ઉપદેશક હોય છે. તે પણ પરોપદેશો પાંડિત્યનું નહિ, પણ સ્વયં જીવનમાં અતિ કઠોર ધર્મચર્ચાઓ આચરીને સાચા ધર્મનાયક બન્યા પછી ઉપદેશે છે. વળી ધર્મ સાધતાં સાધતાં ચૂકનારા જીવોને સારથિની જેમ ધર્મમાર્ગ લાવનારા હોય છે, એવા પ્રભુ ધર્મશાસનના ચક્કવર્તી છે.

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદધિ”

વર્ષ-૪, અંક-૧૮, તા. ૧૪-૧-૧૯૫૬

## ૭ શ્રી અરિહંત પરમાત્માની ઓળખાણ

**જિન-તીર્ણ-બુદ્ધ-મુક્ત :** - શ્રી અરિહંત પરમાત્મા રાગદ્રોષને જીતીને જિન બનેલા હોય છે. તેથી અજ્ઞાન સાગર તરીને તીર્ણ બનેલા હોય છે. એટલે જ બુદ્ધ=સર્વજ્ઞ બની જીવનમુક્ત થઈ જગતને ધર્મ દેખાડી અંતે જીવન પુરુષ થતાં દેહ ત્યજ સર્વથા નિરંજન નિરાકાર અરૂપી એવા વિદેહ મુક્ત બનનારા હોય છે.

શ્રી તર્થીકર પરમાત્માનું વિશેષ વિસ્તૃત સ્વરૂપ આગળ પર કહેવાશે તે એમના જીવન તથા સાધના, એમના ગુણો, એમની શક્તિ, અને એમના ઉપકારો ઉપરથી સમજાશે. હાલ તો પ્રભુનું અહીં જેમ થોડુંક વિષિમુખે સ્વરૂપ જોયું તેમ હવે નિષેધ મુખે જોઈએ; જેથી બરાબર જ્યાલ આવે કે જગતમાં સાચા દેવાધિદેવ પરમાત્મા કેવા હોય તો સુદેવ ગણી શકાય.

### નિષેધમુખે સ્વરૂપ :-

(૧) સુદેવ અનાદિ શુદ્ધ નથી, તો પહેલી વાત એ કે પરમાત્મા આત્મામાંથી બને છે પણ અનાદિ શુદ્ધ પરમાત્મા જેવી કોઈ વસ્તુ નથી. કેમકે (૧) અનાદિ શુદ્ધને ભાગ્ય વગેરે કારણો ન હોવાથી શરીર ન હોય. તેથી એ શરીરધારી તરીકે જગત પર મોજુદ જ નહિ તો જગતને ધર્મ શી રીતે બતાવી શકવાના હતા? વળી (૨) એ જો શુદ્ધ છે તે અશુદ્ધમાંથી શુદ્ધ બનીને નહિ કિંતુ અનાદિના; તો પ્રશ્ન એ થશે કે જીવો જે અનાદિના અશુદ્ધ છે તે કદીય શુદ્ધ કેમ થઈ શકે? તેમજ (૩) એવા અનાદિ શુદ્ધ પરમાત્મા હોવામાં તર્ક પ્રમાણ પણ શું? ત્યારે

(૨) સુદેવ અશરીરી નથી:- પરમાત્માને ઉપદેશ કરવા માટે કાંઈ બીજાના કર્મથી શરીર ન મળે, કેમકે નિયમ તો એ છે કે પોતાના જ કર્મનો ફળભોગ પોતે કરે. કર્મ કોઈના, અને ફળ કોઈ ભોગવે એવું ન બને. નહિતર તો કાર્ય-ભૂવનભાનું એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ” (ભાગ-૧૮)

૫૭

કારણભાવની અવ્યવસ્થા થઈ જાય; તેમજ મોક્ષ પામેલા જીવને પણ કોઈવાર બીજાના કર્મ શરીર ધારણ કરવાનું કેમ ન બની આવે? વળી,

(૩) સુદેવ અવકતા નથી :- શરીર નહિ તો મુખ પણ નહિ, તો તે વિના ધર્મ અને તત્ત્વોના વક્તા પણ કેમ બની શકે? કેટલાકો શાસ્ત્રને ઈશ્વરથી ઉપદેશાયેલ નહિ પણ નિત્ય માને છે. એ પણ ખોટું છે. કેમકે નિત્ય હોય તો પણ એનો કોઈ પ્રથમ પ્રગત કરનાર, સમજાવનાર જોઈશે. એ પ્રગત કરનાર સમજાવનાર રાગી દેખી કે અજ્ઞાની નહિ ચાલે. એટલે પાછું, વીતરાગ સર્વજ્ઞ પ્રભુની જરૂર પડ્યે જ. એથી એ આવ્યું કે પ્રભુ અશુદ્ધમાંથી શુદ્ધ બનેલા છે, શરીરધારી છે, અને ઉપદેશક છે.

(૪) પરમાત્મા સરાગ સદેષ નથી :- પરમાત્મા શુદ્ધ હોવાથી સરાગ, સદેષ નથી. એમને ભક્તો ઉપર પ્રેમ કે દુર્જન ઉપર દેષ કરવાનો હોતો નથી. એક દુન્યવી સારો બાપ પણ બધા પુત્રો પર સમદાદિવાળો હોઈને વધુ કમાતા ઉપર પ્રેમ અને ઓદૃં કમાતા ઉપર દેષ નથી કરતો, તો આ તો જગત-પિતા! એ તો મહાન આર્દ્ધ પુરુષ હોવા જોઈએ જ. એથી જ.

(૫) વીતરાગ-વીતદેષ પરમાત્મા અનુગ્રહ-તિરસ્કાર કરનાર પણ નથી હોતા. અર્થાત્ પ્રભુ અમુક ઉપર કૃપાદાચિ વરસાવે અને અમુક ઉપર તિરસ્કારથી અનું નિર્કંદન કાઢી નાખે; એવું બની શકતું નથી; ચાલ્ય સામો ગમે તેવો ભક્ત હો કે દેખી હો. પ્રભુ ધર્મશાસન સ્થાપી જગતને સાચું આલંબન આપે. પણ પછી તો દરેક પોતાની યોગ્યતા ખીલવીને જાતે જ એ આલંબને ધર્મપુરુષાર્થ કરવો પડે, તો જ મોક્ષ પામે. જો એમ ન કરે અને પાપમય જીવન જીવે તો પાપકર્મના બંધથી બંધાઈ સંસારમાં ભટકવાનો. કોઈ, આત્મા ગમે તેવો દુષ્ટ હોય અને મહેશનો અનુગ્રહ એને મોક્ષ અપાવી દે એવું બની શકે જ નહિ. જો એમ બને, તો તો પછી મહેશ સર્વજીવો પર કેમ અનુગ્રહ ન કરે? ત્યાં જો જીવની યોગ્યતા અને સત્પુરુષાર્થ પર આધાર રહેતો હોય તો તો પાછી યોગ્યતા અને પુરુષાર્થ જ જરૂરી બન્યા! ત્યારે

(૬) સુદેવ સજી કરનાર કે ઈનામ દેનાર નથી :- પરમાત્મા સુકૃતનાં ઈનામ આપનાર કે દુષ્કૃત બદલ સજી કરનાર પણ નથી. કેમકે તો તો એક બાજુ પોતે રાગદ્રોષની જરૂર પડે જ છે. નિર્દ્દિષ પર રાગ થવાની છોડી દે છે. વધુ દોષિત પર નફરત દેષ થવાથી ભારે સજી કરે છે. વળી સર્વ શક્તિમાન પ્રભુ એવી સજી કરવાને બદલે પહેલેથી દુષ્કૃતને જ કેમ ન અટકાવે? એ એક મોટો

૫૮ ભૂવનભાનું એન્સાઈક્લોપીડિયા-શ્રી અરિહંત પરમાત્માની ઓળખાણ (ભાગ-૧૮)

પ્રશ્ન છે. પોલીસ પણ, પોતાની નજર સામે કોઈને ખૂન કરવા હે અને પછી ખૂનીને પકડે, તો ગુનામાં આવશે.

(૭) ઈશ્વર જગત્કર્તાનથી :- ત્યારે, અનંત ગુણસંપન્ન પરમાત્મા જગત્કર્તા પણ નથી. કેમકે (૧) આખા જગતને બનાવવા માટે શરીર કેટલું મોટું જોઈએ અને તે પોતાના ભાગ્ય વિના ક્યાંથી લાવે ? તેમજ (૨) કુંભારના ચાકની જેમ જગતને બનાવવા માટે વેદિકા કઈ ? (૩) એ વેદિકા અને પોતાનું શરીર ઈશ્વરે શી રીતે બનાવ્યું ? અર્થાત્ કયા શરીરથી અને કઈ વેદિકા પર એ જગત્સર્જક શરીર-વેદિકા બનાવ્યા ? બીજું એ છે કે, (૪) જગત બનાવવાનું ઈશ્વરને પ્રયોજન શું ? ઈશ્વર તો કૃતકૃત્ય છે; એમના સર્વ પ્રયોજન સિદ્ધ થઈ ગયા છે. હવે સૂચિ રચવામાં શો હેતુ છે ? જો કહો કે (૫) જગતના જીવ પર કૃપા કરવાનું પ્રયોજન છે, તો તો એ આખા જગતમાં સુખનાં જ સ્થાન કેમ ન રચે ? શા માટે નરક વગેરે દુઃખના સ્થાન, દુઃખનાં શરીર ઈત્યાદિ બનાવે ? શા માટે લોકો લડે-જઘડે એવાં સાધન રચે ? ત્યારે જો કહો કે (૬) જીવોના સારા-નરસા ભાગ્યને અનુસાર રચવાનું હોય, તો એનો અર્થ એ થયો કે એ ભાગ્ય આગળ ઈશ્વરનું પણ ચાલતું નથી. તો પછી એ સર્વ શક્તિમાન શા ? અને કર્મ બધું કરે ત્યાં એમની જરૂર પણ શી ? ત્યારે (૭) “પ્રયોજન વગેરે તો કાંઈ નહિ, પણ કીડા માત્રથી, લીલા માત્રથી ઈશ્વર જગતને બનાવે છે,” એમ જો કહો તો એવા ઈશ્વર રાગવાળા ઠરશે. કેમકે કીડામાં રાગ અવશ્ય હોય. વળી (૮) ભાગ્યને (કર્મને) અનુસારે ફળ ઈશ્વર આપી શકે, આપે છે, એમ કહેવા પર, પ્રશ્ન એ થશે કે તો પછી કર્મનું તરત ફળ કેમ ન દેખાડે કે જેથી શુભ કર્મનું તત્કાળ ફળ સુખ, અને પાપકર્મનું તત્કાલિક ફળ દુઃખ જોઈ અજ્ઞાન લોક વધુ પાપ કરતું તો અટકી જાય ? જીવે એક વાર ચોરી કરી કે તરત પીઠ પર સાટકા પડ્યા, અથવા એકજ જૂઠ બોલ્યો કે તરત જ જ્ઞબ પર લ્યાય ઉઠી, કે સામાએ એ જૂઠ તુર્ત પકડી પાડી આને સજી કરી, આવું ઈશ્વર કેમ ન બનાવી શકે ? અને જો કહો કે (૯૦) એ તો કર્મ પાકે ત્યારે પરમાત્મા ફળ આપે; તો તો પછી કર્મ પાકીને ફળ આવવાનું જ છે, એમાં ઈશ્વરની ક્યાં જરૂર રહી ? કેમકે કાચાં ફળ જાડ પર એની મેળે પાકે છે; તેથી ત્યાં કોઈ પકવનાર નથી ગણાતો.

(૮) પરમાત્મા અવતારી પુરુષ નથી :- અર્થાત્ પરમાત્માએ એક વાર જગતને તત્વજ્ઞાન આપ્યું, પછી મોક્ષમાં ગયા; અને વળી પાછી જરૂર પડી ત્યારે એમણે જ મોક્ષમાંથી પાછો અવતાર આ જગતમાં લીધો અને જગત પર ઉપકાર કર્યો. એમ મોક્ષમાંથી આવી આવી યુગે યુગે અવતાર લીધો, એવું નથી બનતું.

પૂર્વે કહ્યું તેમ મોક્ષ પામીને સર્વશુદ્ધ નિરંજન-નિરાકાર અને કર્મરહિત બન્યા પછી અવતાર લેવાનું નથી કોઈ પોતાને પ્રયોજન, કે નથી પોતાની પાસે અવતારની કોઈ સામગ્રી. અવતાર એટલે તો જન્મ, દેહધારણ વગેરે. એ કર્મ વગેરે સામગ્રી વિના ક્યાંથી બની શકે ? વળી અવતારી જીવનમાં જે કાંઈ પ્રપંચ, કામકીડા, આરંભ-સમારંભ કરે એ બધું જે ખરી રીતે પાપરૂપ છે, અને પરમાત્માનું હોવાથી અને નિષ્પાપ, ગુણરૂપ અને એમની લીલા તરીકે ઓળખાવવું પડે ! કેવી વિટંબણા ! બીજાને સ્ત્રી સંગ એ પાપ, વિષ્ણુને લક્ષ્મીનો સંગ એ પાપ નહિ

(૯-૧૧) ૯ પ્રભુ વિભુ નથી, ૧૦ શક્તિપૂર્જ્ય નથી, ૧૧ લૌકિક ઉપકાર નથી :- ત્યારે (૯) એ પણ વસ્તુ નથી કે પરમાત્મા વિભુ અર્થાત્ જગતવ્યાપી હોય. બને જ નહિ આ. કેમકે પ્રભુ જો શરીરથી વ્યાપક હોય તો જગતમાં બીજું કાંઈ રહી શકે નહિ. સૂક્ષ્મ શરીરથી કહો તો ત્રણ પ્રશ્ન અનું સ્વરૂપ શું એ કરી શું શકે, અને એમાં પ્રમાણ શું ? આત્માથી વ્યાપક કહો તો ય ખોટું; કેમકે આત્મા અનંત પ્રદેશી છે જ નહિ, હોય તો પછી આખા વિશ્વમાં વ્યાપી રહેલા એ આત્માનું એક સ્થાનેથી બીજે ગમનાગમન સંભવી શકે જ નહિ. સંસારમાં પર્યટન શું ? તેમજ લોકો જ્યાં ત્યાં મળમૂત્ર નાખી વ્યાપક ઈશ્વરની આશાતના કરનારા બને !

(૧૦) પરમાત્મા શક્તિથી પૂર્જ્ય નથી કે મહાદાતાપણાથી પૂર્જ્ય નથી :- કેટલાકો કહે છે કે “અહો ! ઈશ્વર કેવો સર્વ શક્તિમાન ! આપું બ્રહ્માણ્ડ એણે રચ્યું. કેવી મહાન શક્તિ ! આપણા ઉપયોગ માટે ભૂમિ, પાણી, હવા, નદીઓ, વનસ્પતિ, વગેરે બનાવી કેવું આપણને મફત આપ્યું ! કેવો એ કરુણાસાગર ! નાના અણુથી માંડી મોટમોટા પર્વતો, સૂર્ય, ચંદ્ર વગેરે બધું એણે બનાવ્યું ! અહો ધન્ય એ વિરાટ શક્તિ ! એની ઈશ્વરા વિના એક પાંદુંય હાલી ન શકે; ને એક તણખબુંય ભાંગી ન શકે !” આમ માની ઈશ્વરને એવી અનંત શક્તિ બદલ અને હવા-પાણી વગેરેના દાતાપણા બદલ માને-પૂર્જે-નમે છે પણ આ ખોટું છે. કેમકે પહેલી તો વાત એ, તે આવી શક્તિ અને આવા ઈશ્વર પ્રમાણ વિરુદ્ધ છે; પ્રમાણ સિદ્ધ નથી. ઉપર ‘ઈશ્વર જગત્કર્તાનથી’ એ વિષયમાં દ્લીલો આપી છે. બીજું એ કે એવી જડશક્તિ માનવાથી અને એ શક્તિના પૂજારી બનવાથી પોતાના આત્માને આધ્યાત્મિક દર્શિએ શો લાભ ? કહે છે.

પ્ર.- એવી શક્તિ માનવાથી પોતાનો કર્તૃત્વનો અહંકાર ટળે ને ? તેમજ એવી અનંત શક્તિ ધરનારને ચરણો આત્મા સુકેલો રહે ને ?

૩.- તો શું એવું માનનારા બધા નિરભિમાની બની ગયા છે ? બધાએ

પોતાનું મન માત્ર એવા પરમાત્માને ચરણે લગાવી દીધું છે ? કદાચ કહો કે બધા લોક સારા થોડા જ બને છે ? તો ય એ કહો કે જે જે નિરભિમાની બન્યા અને જેમણે જેમણે પ્રભુને જ એક શરણ્ય માન્યા, એમને શું એથી વિષયોથી વિરક્ત અને રાગદ્વયાદિ કથાયોથી મુક્ત બનવાનો અવકાશ મળ્યો ? આ બહુ વિચારણીય છે. કેમકે ઈશ્વરે બનાવ્યું છે એમ માનતાં તો ઉલ્લંઘ મનને એમ થાય કે તો પછી એ સારા માટે જ બનાવ્યું છે, તેથી એને ભોગવવામાં શો વાંધો ? પરમાત્મા થોડું જ નાશક બનાવે ? એણે જેર બનાવ્યું છે તે પણ તેવા દિલભગ્ન અને અતિ દુઃખીને આત્મધાતથી રાહત મેળવવા માટે; કારીગર વૈદને દવા બનવવા માટે. સારાંશ કે પ્રભુની મહેરબાની છે બધું બનાવવામાં. માટે એ જગત્પિતાના બાળકો એવા આપણો એને ભોગવો, આવી આવી અજ્ઞાન દશા સેવી વિષયરાગ અને કથાયસેવન ટકવાના-વધવાના. તેથી સંસારકેદ ઊભી રહેવાની. શું તરણ-તારણ પરમાત્મા સંસારકેદમાં નિમિત્ત ? માટે કહો કે પરમાત્મા એવી સર્જન શક્તિવાળા નથી. વળી અભિમાન ટળે કહો છો તે તો કર્તૃત્વનું, પણ બીજો મદ અભિમાન ટળવાનો અવસર ક્યાં ? ‘પ્રભુએ અમને કેવું સરસ ઊંચું કુળ આયું, બળ આયું, ધન આયું ! અમારા જેવો કોણ કુળવાન, બળવાન કે ધનવાન છે ?’ આવો મદ ક્યાંથી ખસવાનો હતો ? ત્યારે ‘પ્રભુએ બધું આયું-બનાવ્યું છે, તો રાખવામાં શો વાંધો ? પ્રભુએ જ કુટુંબ આયું છે. તો એ ધન કુટુંબનો ત્યાગ કેમ કરાય ?’ એમ કરી વિષયો ઉપર રાગ, મમતા ચાલુ રહેશે. ખરી રીતે કર્તૃત્વનું અભિમાન તો કર્મસત્તાની પ્રબળતા માનવાથી ટળે શકે છે. તેમ ઈશ્વરને એવા મહાદાતા માનવાને બદલે, જગતમાં અન્યત્ર ન મળે એવા મોક્ષમાર્ગના દાતા અને અનંત વીતરાગતા વગેરે ગુણસંપન્ન માનવાથી એમના પર ખૂબ જ ફૂલજાતા બુદ્ધિ તથા ગુણાનુરાગ રહે છે અને એમના ચરણે આત્માને જુકેલો રખાય છે. ઉપરાંત પરમાત્માને શ્રેષ્ઠ સાધક, વીતરાગ, સર્વજ્ઞ, સત્ત-તત્ત્વના ઉપદેશા તરીકે જોવાથી કેટલીય પ્રબળ પ્રેરણાઓ આધ્યાત્મિક ઉન્નતિની મળે છે; તેમ એવા પરમાત્માના સત્ય ઉપદેશથી સાચું માર્ગદર્શન, તત્ત્વદર્શન અને સાધનાનો બોધ મળે છે. એવા જ પરમાત્મા પોતે સૃષ્ટિસર્જનની ધાંધલ વિનાના હોઈ જડના સર્જનમાં મોહ-મમતા અને સૂક્ષ્મ સ્થૂલ જીવિતસાહિનું પાપ લાગે છે એમ બતાવી શકે. પોતે જ સર્જક હોય તો કેમ બતાવી શકે ? વળી પૂર્વ કર્યું તેમ એવી શક્તિવાળા ઈશ્વર હોવાનું પ્રમાણથી સિદ્ધ નથી. ઈશ્વરમાની એવી શક્તિથી ઈશ્વરને પૂજ્ય માનવા, એ અજ્ઞાન ચેટા છે. ગામડાના અભિષ્ણ મૂઢ લોકો નજરબંધી મેસ-મેરીજમ વગેરે કોઈ જાદુ ચ્યમતકારની વસ્તુ બતાવવનારની શક્તિ ઉપર મુશ્ખ થાય છે. એમ હઠયોગ વગેરેની શક્તિ ઉપર

શહેરી લોકો પણ આકષ્ય છે. પરંતુ એવી શક્તિમાં શી આત્મિક વિશેષતા ? આત્માને શી ઉપકારકતા ? શી ગુણકારિતા ? ખરી રીતે પરમાત્માની માનવીયતા પૂજ્યતા અનંત ગુણો અને આધ્યાત્મિક ઉપકારને કરનારી યથાર્થ તત્ત્વદેશના ઉપર છે. માટે જ,

(૧૧) પરમાત્મા માત્ર લૌકિક ઉપકાર કરનારા નથી, પણ શ્રેષ્ઠ એવા લોકોત્તર ઉપકારને કરનારા છે. પરમાત્માનો લૌકિક ઉપકાર પણ, કશું બનાવીને કે આપીને નહિ, પરંતુ સદ્ગુણ પોષણ અને સુખશાન્તિ આપે એવું ધર્મપ્રધાન પવિત્ર જીવન જીવવાની પદ્ધતિ બતાવીને છે. ત્યારે, શુદ્ધ ધર્મમાર્ગ અને યથાસ્થિત તત્ત્વસ્વરૂપ ઉપદેશવાનો જે લોકોત્તર ઉપકાર શ્રી વીતરાગ સર્વજ્ઞ તીર્થકર પરમાત્મા કરે છે, તે બીજું કોઈ કરી શકતું નથી. અરે ! એટલું જ નહિ, પણ જે રાગીદેખીજાનો જગતમાં ધર્મ અને તત્ત્વના નામે ખોટા ધર્મ અને ખોટાં તત્ત્વો પ્રચારનારા બને છે, તેથી પહેલાં વીતરાગ પ્રભુથી આ શુદ્ધ સત્ય ધર્મમાર્ગ અને તત્ત્વપ્રકાશ નીકળ્યા પછી એમાંથી આડા જઈને બની શકે છે; પણ એનાથી એ સ્વપરનો ભયંકર અપકાર કરનારા બને છે. કેમકે એ કર્તવ્યને અકર્તવ્ય મનાવે છે અને અકર્તવ્યને કર્તવ્ય મનાવે છે. ત્યારે સાચા વીતરાગ પરમાત્માના લોકોત્તર ઉપકારથી તો જીવોના આ ભવ, પરભવ, અને ભાવી અનંતકાળ સુખી અને ઉજ્જવળ બની જાય છે; પણ આ માટે પરમાત્માને દુનિયાના લૌકિક માર્ગથી જુદું ચાલવું પડે છે.

આના એક વ્યક્તિગત દાખલા તરીકે તીર્થકર ભગવાન ઋષભદેવ સ્વામીની પાસે પોતાના જ અહીંણું પુત્રો મોટા પુત્ર ભરતની સામે ફરિયાદ લઈને આવ્યા કે “અમને દરેકને રાજ્ય આપે (પિતાજીએ) આપી સ્વતંત્ર બનાવ્યા, ઇતાં ભરત ખોટી રીતે અમારા પર સત્તા જમાવી અમને એની આજ્ઞાને પરતંત્ર બનાવવા માગે છે.” અહીં એ ધ્યાનમાં રહે કે ઋષભદેવ પ્રભુએ પરમાત્મા તીર્થકર બનવા પૂર્વે સંસારી સરાગ ગૃહસ્થની અવસ્થામાં ઔચિત્ય તરીકે એ પુત્રોને રાજ્ય વહેંચી આયા હતા. બાકી વીતરાગ પરમાત્મા તરીકે બન્યા પછી તો એમને પોતાને જ કોઈ જ કુટુંબ મિલકત વગેરે સંસાર હોતો નથી તો બીજાને એ આપવા કરવાનુંય શાનું હોય ? એ તો એક માત્ર ધર્મ આપે. પછી જીવને એમના ઉપદેશથી એ ધર્મ સાધવાના પરિણામે મોક્ષ સુખ મળવા પૂર્વે, પુણ્યબંધની રૂએ સંસારની અનુકૂળતા મળી જાય એ વાત જુદી. અસ્તુ. આ તો પરમાત્મતત્વનું જરા સ્વરૂપ બતાવ્યું. હવે અહીં જુઓ કે ઋષભદેવ ભગવાને ફરિયાદી અહીંણું પુત્રોને એમ ન કર્યું કે “શું તમે મારા પુત્ર થઈને આવા મુદ્દાલ ? આવા કાયર ? તમે ન્યાયી છો, ભરત અન્યાયી છો. અન્યાયી માણસ શિક્ષાને જ પાત્ર છો. તેથી તમે એવે શિક્ષા કરી શકો

છો.” અમજ, એવું પડ્યા ન કહ્યું કે ‘ભરત અને તમે ભાઈઓ છો. અંદર અંદર સમજ લો. અને નિરાંતે સલાહ-સંપથી રાજ્યપાટ ભોગવો.’ પરમાત્માને પૂછવા આવ્યા છે ને ? તો પછી પરમાત્માએ તો લોકોતર ઉપકાર જ કરવામાં શું કામ બાકી રાખવાની હોય ? તેથી ઋષભદેવ પ્રભુએ તો આ ચેતવવાના યોગ્ય અવસરના તથા પોતાની વીતરાગતાના હિસાબે કહ્યું કે “અરે મહાનુભાવો ! આ તમે કેવા અણાની ? સાચો શત્રુ નહિ એવા આ ભરતને તમે શત્રુ માનવા નીકળ્યા, પરંતુ આ તમારા આત્માની અંદર બેઠેલા ખરા શત્રુઓને કેમ તમે જોતા નથી ? એ અંતરના કોધ, મમતા તૃષ્ણાદિ દુશ્મનો જ તમને આ ધમધમાટ કરાવી રહ્યા છે. પણ એ આંતર દુશ્મનો, સમજ રાખો કે, તમારું નિર્કંદન કાઢશો. તેમ જે રાજ્યના મોહે કલહનું પાપ સેવવા ઊભા થયા છો, એ બાધ્ય રાજ્ય લક્ષ્મી વગેરે પણ જરાય વિશ્વસનીય નથી; સ્થાયી નથી. ક્ષાણભંગુર એવી એ જઉ-જઉની સ્થિતિમાં રહી જીવો પાસે તૃષ્ણા મમતાના ઘોર પાપ કરાવી જીવોને દીર્ઘ દુર્ગીતિમય સંસારના પંથે ચઢાવી દેનારી છે.” ઈત્યાદિ ઉપદેશ અજબ સચોટ દાણાંતો સહિત આપી ત્યાંને ત્યાં અહ્વાણને સંસારના ત્યાગી મુનિમહર્ષિ બનાવ્યા. ભરતને આ વાતની ખબર પડી કે પશ્ચાતાપ સાથે દોડતો આવી ક્ષમા માગો છે; અને અહ્વાણું ભાઈના સાચા પુરુષાર્થની અનુમોદના તથા પોતાની રાજ્ય મમતાની ભારે નિંદા કરે છે. આ થયો નવાણું પર ગ્રામુનો લોકોતર ઉપકાર.

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદ્વિ”

વર્ષ-૪, અંક-૧૮, તા. ૨૧-૧-૧૯૮૫

## ૮ શ્રી અરિહંત પરમાત્માની ઓળખાણ

હવે આની સામે ગીતાનો પ્રસંગ જુઓ કે શ્રી કૃષ્ણને અર્જુન કુરુક્ષેત્ર પર કહે છે “પૂર્ય એવા ભીખ પિતામહ તથા દ્રોષાચાર્ય વગેરે કુટુંબી ભાઈ ભાંડુ સાથે યુદ્ધ કરી એમનો કચ્ચયરધાણ કાઢીને રાજ્યસંપત્તિ મારે નથી જોઈતી. એવી પૂર્યો અને સ્નેહીઓના લોહીથી ખરડી રાજ્યસંપત્તિ લેવા કરતાં હું ખુશીથી ભીખ માગીને પેટ ભરીશ.” આમ કહી અર્જુને શસ્ત્રો નીચે મૂકી દીધા ! આ વખતે જુઓ કે જેઓ આ કૃષ્ણમાં પરમાત્મપણું માને છે એમના પરમાત્મા તરીકે માનેલા શ્રીકૃષ્ણ ગીતામાં શું કહે છે અને અર્જુન પાસે શું કરાવે છે; એ કહે છે “અર્જુન તું કાયર થઈ ગયો છે. ‘હાય ! આમને કેમ મરાય,’ એવા દુર્બલ વિચારમાં ચઢી ગયો છે. પણ એમાં તને મારવાના કર્તૃત્વનું અભિમાન થયું છે. કિન્તુ તું સમજ કે આત્મા ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદ્વિ” (ભાગ-૧૮)

૬૩

તો અચ્છેદ છે, અભેદ છે, અમર છે, મરતો નથી. તો એને તું શું મારી શકવાનો હતો ?”...ઇત્યાદિ ઇત્યાદિ ઉપદેશ આપી અર્જુનને યુદ્ધ માટે ટટાર કર્યો અને પોતે સહાયમાં રહી એને ખૂનખાર યુદ્ધ કરાવીને જિત અપાવી ! વિચારો કે આ ઉપકાર કેવો કે જેમાં વિરક્ત અને ઉપશાન્ત બનેલો અર્જુન રાગીદેખી અને પૂજ્યો, વિદ્યાગુરુ વગેરેનો ધાતક બન્યો ? એ ઉપકાર કેવો કે જેમાં કોઈ ઉત્તમ જીવોના નાશ થયા !

વીતરાગ સર્વજ્ઞ પરમાત્માનો તો વિશિષ્ટ લોકોતર ઉપકાર હોય છે. એમાં એ જગતને જે યથાર્થ તત્ત્વબોધ અને વાસ્તવિક મોક્ષમાર્ગરૂપ ધર્મનો ઉપદેશ આપે છે, એ અજબ કોટિનો હોય છે, અનું આણું વર્ણન અહીં આગળ આવશે.

તીર્થકર ભગવંતોની જેમ સિદ્ધ ભગવંતો પણ પરમાત્મા છે :-

પરમાત્મા સ્વરૂપની આ બહુ આણી વિચારણા કરી છે. અહીં એક ધ્યાન રાખવાનું છે કે પરમાત્મા એટલે ધર્મતીર્થના સ્થાપક, તત્ત્વોના આદ્ય પ્રદૃપ્દ અને વિશિષ્ટ કોટિના અતિશયશાલી પ્રભુ, તથા વિશિષ્ટ ઉપકારક પરમાત્મા. આ અર્થ લઈએ છીએ પરંતુ પરમાત્મા એટલે સામાન્ય રીતે ‘સર્વથા શુદ્ધ આત્મા, કર્મથી મુક્ત આત્મા,’ એવો અર્થ લઈએ ત્યારે એવા પરમાત્મા સિદ્ધ ભગવંતો છે. એ પણ તીર્થકર પરમાત્માએ બતાવેલા મોક્ષમાર્ગની આરાધના કરીને મૂળ આત્માપણાની સ્થિતિમાંથી ઉંચે આવી મોહનો અને ઘાતી કર્મબંધનોનો સર્વથા નાશ કરી અહીં કેવલ્ય અવસ્થા (તીર્થકર નહિ પણ સર્વજ્ઞ વીતરાગ દશા) પામી અંતે અઘાતી કર્મ બંધનોનો પણ નાશ કરી નિરંજન નિરાકાર એવા પરમ અર્થાત્ શુદ્ધિમા શ્રેષ્ઠ આત્મા બની આ જગતની ઠેઠ ઉંચે લોકાન્તે સિદ્ધ ભગવંત તરીકે કાયમ માટે સ્થિર થયેલા છે. પ્રસ્તુતમાં સુદેવ કોને માનવા, અર્થાત્ સાચા આદ્ય ધર્મ પ્રદૃપ્દ અને ગ્રાદ્ય વચન તરીકે કોને સ્વીકારવા, કોના વચનને કહેનારા ચુનું સાંભળવું અંગીકાર કરવું, એ વિચારણા હોવાથી શ્રી સિદ્ધ પરમાત્માને બદલે શ્રી તીર્થકર પરમાત્માનું સ્વરૂપ વિચાર્યુ. હવે તારક તીર્થકરદેવનું લોકોતર જીવન જોઈએ.



## ૬ શ્રી અરિહંત પરમાત્માની ઓળખાણ

### (૨) તીર્થકર પરમાત્માનું જીવન.

**માર્ગાનુસારીના ગુણ પર સમ્યક્ત્વ : પ્રથમ ભવ :-**

અનાદિ અનંતકાળથી ચોરાશી લાખ યોનિમય આ સંસાર-ચક્રમાં અનંતાનંત જીવો પરિભ્રમણ કર્યા જ કરે છે. એમાં ભવિષ્યમાં તીર્થકર બનનારના પણ આત્મા પહેલાં તો એમજ સંસારની કેદમાં ભમતા હોય છે, અને વિવિધ યોનિમાં દુઃખ સહે છે. માત્ર એમનામાં બીજા જીવો કરતાં જીત્યરત્નની જેમ છૂંધી વિશિષ્ટતા હોય છે. એ ગ્રગટ થવા માટે અવસર આવ્યે માર્ગાનુસારિતા=શિષ્ટ માનવ-ગુણોના બળો સદ્ગુરુનો યોગ પામી સુદેવ-સુગુરુ-સુધર્મની ઓળખાણ મેળવીને એ આત્મા સમ્યગ્દર્શન પામે છે, અર્થાત્ ત્રણ તત્ત્વ ઉપર દઢ શ્રદ્ધાવાળા બને છે. દા.ત. શ્રી ઋષભદેવ પ્રભુના જીવ ધના સાર્વવાહે જેને સાર્વમાં આવવું હોય તેને સાથે લેવાની ઉદારતા દાખવી તો સાધુ મળ્યા; ને શિષ્ટાચાર પ્રશંસા કરી ધીનું દાન દઈ શ્રદ્ધા પામ્યા. નયસારે અટવીમાં અતિથિ સત્કાર યાદ કર્યો ત્યાં મુનિ મળ્યા, દાન દીધું અને સમકિત લીધું. પાર્શ્વપ્રભુના જીવ મરુભૂતિએ બુદ્ધિના આઠ ગુણની માનવતા ઉપર સાધુયોગે સમ્યક્ત્વ સાધું. આમ માર્ગાનુસારીના એટલે કે માનવતાના કોઈને કોઈ ગુણની ખીલવત ઉપર ધર્મશ્રદ્ધા પામ્યા. આ શ્રદ્ધા એવી ઊંચી હોય છે કે એમાં કેટલાય તીર્થકરના આત્માઓ ત્યાં સાથે સાથે જ પેલી મૌલિક વિશિષ્ટતાને ખીલવતા વીસ સ્થાનક અગર ઓછાની આરાધના કરે છે; અને તીર્થકરપણાનું સર્વોત્કૃષ્ટ પુષ્ય ઉપાર્જ છે. ત્યાંથી એક બીજો ભવ કરી પછી ત્રીજે જ ભવે તીર્થકર થાય છે. જ્યારે, બીજા કેટલાક તીર્થકર જીવો સમકિત પામ્યા પછી પણ તીર્થકર બનવા પૂર્વે વધુ ભવ કરે છે. ભવની ગણાત્મી સમ્યક્ત્વ પામ્યા પછી ગણાય છે પરંતુ તીર્થકરપણાનો સંબંધ તીર્થકર પરમાત્મા બનવાના પૂર્વના ત્રીજા ભવથી મનાય છે.

**સાચી વિશ્વદ્યા અને વીસ-સ્થાનક પર તીર્થકરપણું : પૂર્વનો ત્રીજો ભવ :-**

આત્મામાં પરમાત્મપણું એટલે કે વીતરાગ સર્વજપણું આવે છે તે મોહ અને બીજા ઘાતી-કર્મના નાશના પ્રભાવે આત્મામાંથી અશુદ્ધિ તથા આવરણ ચાલી જવાથી આવે છે. મોહના નાશે રાગાદિ અશુદ્ધિ ટળીને વીતરાગતા આવે છે; તથા જ્ઞાનવરણ કર્મના નાશે અજ્ઞાનતા ટળવાથી સર્વજતા આવે છે. પરંતુ તીર્થકરપણું જે આવે છે;

તે તો વિશિષ્ટ કોટિની પુષ્યપ્રકૃતિ-શુભકર્મ પ્રકૃતિના ઉદ્યથી આવે છે. કેમકે તીર્થકરપણા માટે શ્રેષ્ઠ કોટિનો યશ, વચનની શ્રેષ્ઠ આદેયતા, રૂપ, સ્વર, સૌભાગ્ય વગેરેની અનુકૂળતા જરૂરી છે; જેથી દેવો અને ઈન્દ્રો જેવા પણ બેંચાઈ આવે, મહાન અદ્રભુત ભક્તિ કરે, સમવસરણાદિ માનવલોકો અને શહેરી-જંગલી તર્યચ પશુ-પંખી સુદ્ધાં બેંચાઈ આવે; ત્યાં પાછી પ્રભુની વાણીની શક્તિ એવી કે સૌ સૌની ભાષામાં સમજ જ્યા; સૌના સંદેહ એક સાથે ટળે; સૌ મહામિઠાશ એવી અનુભવે કે જેમાં થાક, ભૂખ, તરસ-પીડા વગેરેનું નામ નહિ. આ બધું જે બને તે કાંઈ સર્વજતા-વીતરાગતાદિ આત્મવિકાસથી નથી બનતું. એનું એ કાર્ય નથી; એ બધું તો પુષ્ય-કર્મના ઉદ્યથી જ બની શકે છે. તેથી કહો કે ભલે વીતરાગ-સર્વજતાદિનો સાથે સહકાર હોય જ છે, પરંતુ ઉપરોક્ત યશ-આકર્ષણ-વચનશક્તિ વગેરે જે આવે છે તે તો પુષ્યકર્મનું જ કાર્ય છે, પુષ્યના ઉદ્યથી જ આવે છે. એમાં પ્રબળ યશ વગેરે પુષ્ય-કર્મ તો માતાના ગર્ભમાં પ્રભુ આવે ત્યારથી ઉદ્યમાં હોય છે; પરંતુ સમવસરણ મંડળા વગેરેનું ઐશ્વર્ય પ્રગટવું તથા વિશિષ્ટ ધર્મવાણી વરસાવવી, એ વીતરાગ સર્વજ બન્યા પછી ઉદ્યમાં આવતા તીર્થકર નામ કર્મ નામના પુષ્યથી બને છે. આ વિશિષ્ટ યશસૌભાગ્યાદિ પુષ્યકર્મ સહિત તીર્થકર નામકર્મનું પુષ્ય-કર્મ પૂર્વના ત્રીજ ભવમાં ઉપાર્જ છે. તીર્થકર નામકર્મ ઉપાર્જવનારી મુખ્ય સાધનામાં (૧) અવિહડ નિર્મણ સમ્યક્ત્વ, (૨) વીસસ્થાનકો પૈકી એક અથવા અનેક સ્થાનકની ઉપાસના-આરાધના, અને (૩) વિશિષ્ટ વિશ્વદ્યા હોય છે. ત્રણનું આદ્ધું સ્વરૂપ આ રીતે છે.

(૧) અવિહડ સમ્યક્ત્વમાં સુદેવાદિ ત્રણ ઉપર એવી જવલંત શ્રદ્ધા હોય છે કે એનો રંગ અસ્થિમજજા લાગી ગયો હોય છે. જગતમાં એજ સાર, અને સુખ માટે એજ સમર્થ લાગે છે; એજ ઈષ અને પરમઈષ લાગે છે. યથાર્થ તત્ત્વની શ્રદ્ધા હદ્યને સદા સંસારની વાતોમાં કકળાં અને ધર્મની, કર્મક્ષયની, ને મોક્ષની વાતોમાં ઉલસતું રાખે છે. શ્રી અરિહંત પરમાત્મા પર તો એવી ઉત્કર રૂચિ હોય છે કે જાણે રોમેરોમાંથી ‘અહીં’ના ગુંજારવનો ધનિ નીકળે છે ! હાલતાં ને ચાલતાં, બેસતાં ને ઉઠતાં, કામમાં કે નવરાશમાં, અરિહંતની પ્રબળ લગની લાગી હોય છે. એમ સુગુરુ-સુધર્મનોય અખંડ રાગ, અનુપમ પક્ષપાત, ને અત્યંત બહુમાન હોય છે.

(૨) વીસ સ્થાનક અને એની આરાધના :- વીસ સ્થાનકની આરાધનામાં વીસ પદ આ રીતે છે. જૈન શાસનમાં પ્રસિદ્ધ નવપદમાંના પહેલાં પાંચ પરમેષ્ઠિમાં ‘પ્રવચન’ અને ‘સ્થવિર’ ઉમેરતાં સાત થાય. નવપદના છેલ્લા ચાર પદમાં વિનય, દાન, શીલ, ક્રિયા, ઉમેરતાં આઠ થાય; એમ કુલ પંદર પદ થાય. એમાં સમાધિ

વગેરે બીજા પાંચનો ઉમેરો થતાં વીસ સ્થાનક બને છે. તેમાં ક્યાંક એકને બદલે બીજું નામ પણ આવે છે. વીસ નામ આ મુજબ છે; ૧. અરિહંત, ૨ સિદ્ધ, ૩ પ્રવચન, ૪ આચાર્ય, ૫ સ્થવિર, ૬ ઉપાધ્યાય, ૭ સાધુ (એમના ઉપર અત્યંત રાગ, પક્ષપાત અને બહુમાન; એમની અનુપમ ભક્તિ વૈયાવચ્ચ, ગુણગાન, દર્શનવંદન, વિનય, આશાતના-ત્યાગ, તથા ધ્યાન જાપ વગેરે ઉપાસના) ૮ શાન, ૯ દર્શન, ૧૦ વિનય, ૧૧ ચારિત્ર, (આવશ્યક), ૧૨ શીલ (બ્રહ્મચર્ય), ૧૩ ક્રિયા, ૧૪ તપ, ૧૫ દાન (ગૌતમ), ૧૬ સમાધિ, ૧૭ વૈયાવચ્ચ ૧૯ સમાધિ, ૨૦ વૈયાવચ્ચ (૧૬ જિન, ૧૭ સંયમ), ૨૮ અભિનવ શાન, ૨૮ શુત, અને ૨૦ તીર્થ. આઠમાથી વીસમાં સ્થાન સુધીનાની આરાધના સ્વયં કરવાનું, ને બીજાને આરાધના કરવાનું તથા આરાધનાની અનુકૂળતા-પ્રેરણ કરવાનું આવે; તેમજ આરાધના કરનારની આરાધનાની અનુમોદના કરવાનું આવે. આરાધનામાં બે સ્થાનોની શ્રદ્ધા-ગુણગાન કરાય. એની તથા એના સાધનાની સાધના, રક્ષા અને પ્રભાવના કરાય. એ સ્થાનોનું શુભ ચિંતન, ધ્યાન અને તન્મયતા કરાય.

(૩) વિશિષ્ટ વિશ્વદ્યા :- સમ્યક્તવના પ્રભાવે, તીર્થકરપણાનું પુણ્ય ઉપાર્જનાર મહાત્માના હૃદયમાં સંસારના દુઃખમય, દુઃખફલક અને દુઃખાનુંધી સ્વભાવનો જ્યાલ એટલો બધો જાગતો અને ધીખતો બની જાય છે કે એવા દુઃખરૂપ સંસારમાં ફસેલા ગ્રાણી-માત્ર ઉપર એમના દિલમાં ઉત્કટ ભાવદ્યા ઊભરાય છે. મહામાયાવી અને પ્રલોભક એવા મોહ અને અજ્ઞાનના મૃગપાશમાં જીવોને ફસાવીને કર્મસત્તારૂપી પારધી એના ચતુર્ગતિમય સંસારમાં કેવા કેવા બેહાલ કરે છે, અને નરક-નિગોદ સુધીના પ્રયંક દુઃખ દેતા જીવોને કેવા કેવા ભમાયે રાખે છે, એ જાણો સાક્ષાત્ નજર સામે એ મહાત્મા નિહાળે છે. એમનું દિલ દ્યાથી ઉકળી ઉઠે છે; દિલમાં ‘ક્યારે હું સમર્થ બની આ બિચારા દુઃખી જીવોને કુટિલ મોહજાળમાંથી અને કર્મની કારમી વેદનામાંથી બચાવી લઉં,’ એવી ઉત્કટ કરુણાનો ધોખ વહેવા મારે છે. “ક્યારે હું સર્વ જીવોને જિનશાસનના રસિયા, શાસનના શ્રદ્ધાનું કરી એક માત્ર મોક્ષમાર્ગના જ મુસાફર બનાવી દઉં ! એવું બજ મારામાં ક્યારે આવે !” આવી ઉત્કટ ભાવદ્યા-ભરી સદ્ગ્રાવનામાં, એ મહાત્મા પૂર્વોક્ત બે સાધના સાથે, રમણ કરતા થક તીર્થકર નામ-કર્મનું પુણ્ય ઉપાર્જન છે.

કઈ અવસ્થામાં આ પુણ્યનું ઉપાર્જન ? :-

એ પુણ્ય ઉપાર્જની વખતે એ સમ્યક્તવ, શ્રાવકપણું કે સાધુપણું, એ ગ્રાણમાંથી ગમે તે સ્થિતિમાં રહેલા હોય છે. ભગવાન શ્રી ઋપુષ્ટદેવ અને શ્રી પાર્વતીના સ્વામીએ પૂર્વના ગ્રીજા ભવમાં ચક્કવતીપણાની સમૃદ્ધિ-સુખશીલતા છોડી ભુવનભાનું એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ” (ભાગ-૧૮)

સર્વત્યાગવાળું ચારિત્ર અને પવિત્ર સાધુપણું સ્વીકારી ઉક્ત પ્રભળ સાધના કરી હતી, ને તીર્થકરપણાનું પુણ્ય ઉપાર્જનું હતું. ત્યારે શ્રી મહાત્મા પ્રભુએ પણ રાજવીપણું છોડી ચારિત્ર લઈને એક લાખ વરસ સુધી માસખમણના પારણે માસખમણના સંણગ તપ સાથે વીસ સ્થાનકની આરાધના કરી તીર્થકર નામગોત્ર ઉપાર્જનું હતું. પણ રાજા શ્રેષ્ઠિકે માત્ર સમ્યક્તવ સ્પર્શને અને સુલસાદિએ શ્રાવકધર્મ પાળતાં તીર્થકર નામ કર્મ નિકાચું હતું.

**નરક ગતિના અતુલ ત્રાસમાં પણ અજબ સમાધિ :-**

આ રીતે પુણ્ય ઉપાર્જ પૂર્વનો ત્રીજો ભવ પૂરો થતાં સામાન્ય રીતે એ આત્માઓ વૈમાનિક દેવલોકમાં દેવ થાય છે; પણ જેમને સમ્યક્તવ પામવા પૂર્વે ભવાંતર માટે નરક ગતિનું આયુષ્ય બંધાઈ ચૂક્યું હોય છે, અને એમણે પછી સમ્યક્તવ પામી તીર્થકરપણાનું પુણ્ય ઉપાર્જનું હોય છે, એ આત્મા એ ભવ પૂરો થતાં નરક ગતિમાં જાય છે. ત્યાં એમનો આત્મા એવી તત્ત્વદાસ્તિ અને ઉપશમસહિત વિરક્તદશામાં કાળ વ્યતીત કરે છે કે એક બાજુ એમની ઉપર ધોર કર્લેઆમ વરસવાનું, આગમાં બળવાનું, ઘણથી ટીપાવાનું વગેરે અસહ્ય ચાલી રહ્યું હોય છે; છતાં બીજી બાજુ એવા ત્રાસ વરસાવનારા પરમાધામી ઉપર કે બીજા નરક જીવો ઉપર એમને અમૈતી-ભાવ અર્થાત് ‘આનું નિકંદન નીકળો’ એવી દુર્ભર્વના થતી નથી. પરંતુ એમને પોતાના જ કર્મનો વાંક જણાય છે. એમાં પણ પોતે જ કરેલી પાપકરણી બદલ પોતાની જાત પ્રત્યે જ તિરસ્કાર છૂટે છે; કહો, નરકના ધોર ત્રાસમાંય કેવી આત્મ-જાગૃતિ ! કેવી સમાધિ ! ત્યારે, દેવલોકમાં જનારા તીર્થકર દેવના જીવોને, ત્યાં મહાભોગ-વિલાસનાં સાધન સરંજામ અને વાતાવરણ છતાં, આંતરિક કાંઈ આનંદ આવતો નથી. એને તો જડ-પુદ્ગળના જેલ અને પુણ્યની લીલા સમજી પોતાના ચૈતન્યવંતા આત્માને અનાસકત-ભાવમાં, ઉદાસીન-ભાવમાં એ રમતો રાખે છે. હજુ તો પરમાત્મપણું મેળવ્યું નથી, પરમાત્માપણાનો જન્મ પણ હજુ મેળવ્યો નથી, ત્યાં પણ જો આટલી બધી મહાયોગી જેવી આત્મોન્તિવાળી દર્શામાં છે. તો એ પરમાત્મા બનવાના ભવમાં આવશે ત્યારે કેટલી ઊંચી દશા ! પરમાત્મા બનવાની સંયમ-સાધનામાં કેટલી ઊંચી અને પરમાત્મપણું પામશે ત્યારે કેવી અતિ ઉચ્ચ અવસ્થા ! એમ સાચા પરમાત્મા બનનાર સુદેવનું જ આલંબન આપણા જીવન માટે મહાહિતકારી બને ! અવશ્ય બને ! એના બદલે જ્યાં કહેવાતા પરમાત્મામાં રાગ-દ્રેષ્ણની પ્રવૃત્તિઓ, કામ-પ્રેમની ચેષ્ટાઓ અને યુદ્ધાદિ સુધીની ધમાધમ સેવાતી હોય, અને ઉપદેશ પણ અતત્ત્વ-અમાર્ગનો અપાતો હોય, એમના આલંબનથી આત્મા ઊલટો કેવા મહાઅનર્થમાં ફસાય ? અરે ! એથી મોક્ષ-સુખ તો

દૂર દૂર જ રહે, પણ સંસારમાંય સદ્ગતિનાં સુખ પડા મોંઘા બની જાય. રાગદ્વિપ લિસાદિની ગ્રવૃત્તિઓ તથા અતત્ત્વ-અમાર્ગને તત્ત્વ અને ધર્મમાર્ગ માનવાની ભિથ્યાત્વદશા ભવમાં ચિરકાળ ભમાવનારી બને. માટે જ સુદેવની પરીક્ષા કરીને શ્રી વીતરાગ સર્વજ્ઞ તીર્થકર પરમાત્માને જ સુદેવ તરીકે સ્વીકારી એમના શરણે નિજના આત્માને લઈ જઈ સમર્પિત કરી દેવો જોઈએ. એજ ધન્ય જીવન છે. કુદેવ-કુગુરે, સાંસારિક મોહંધ માતાપિતા, પત્ની, શેઠ વગેરેને શરણે રહેવાથી કે સમર્પિત થવાથી શું વળવાનું હતું ? જન્મ-મરણ ફીટવાના હતા ? જો એ ન ફીટે તો દુઃખ અને દુર્દ્દા અકબંધ ઉભા જ રહે ને ?

**અંતિમ ભવ :-** પરમાત્માનો જીવ નરક કે દેવલોકમાંથી અવીને છેલ્લા ભવે મનુષ્ય લોકમાં રાજીવી જેવા ઉચ્ચ કુળમાં અવતરે છે. અહીં પેલા ઉત્કૃષ્ટ કોટિના ઊંચ ગોત્ર, યશ-નામકર્મ, સૌભાગ્ય નામકર્માદિ પુણ્યકર્મના ઉદ્ય થાય છે. તેથી જુઓ કે કેવી અદ્ભુત સ્થિતિ ઉભી થાય છે !

### ● ચ્યવન કલ્યાણક ●

(૧) પ્રભુ માતાના ગર્ભમાં આવતાં જ ગ્રાણ લોકના સમસ્ત જીવોને શાતા સુખનો અનુભવ થાય છે. પરમાત્માના ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન, અને નિવાણ એ પાંચ પ્રસંગને કલ્યાણક કહેવાય છે. બીજા કોઈ પણ આત્માના પ્રસંગને માટે એ શબ્દ નથી વાપરતો. કેમકે પ્રભુના જ એ પાંચ પ્રસંગ જગતભરના જીવોને કલ્ય એટલે કે સુખ આણનારા બને છે. નરકના જીવોને પ્રતિક્ષણ ધોર ગ્રાસની વચ્ચમાં મીઠો અપૂર્વ શાતા સુખનો અનુભવ કરાવનાર એક માત્ર પ્રભુનું કલ્યાણક છે. વાહ ! કેવી સરસ પ્રભુની બલિહારી ! વળી પ્રભુના કલ્યાણક વખતે જ ગ્રાણ જગતમાં ઉદ્ઘોત (પ્રકાશ) થાય છે.

(૨) પ્રભુના ચ્યવન વખતે બીજું એ બને છે કે માતા ઊંઘમાં ચૌદ તેજસ્વી મહાસ્વભ જુએ છે. ચૌદ સ્વભનો આ છે : ૧ ગજ, ૨ વૃષભ, ૩ કેસરીસિંહ, ૪ અભિષેક કરાતી લક્ષ્મી દેવી, ૫ બે ફૂલમાળા, ૬ ચંદ્ર, ૭ સૂર્ય, ૮ મોટો ધવજ, ૯ પૂર્ણ મહાકલશ, ૧૦ પદ્મસરોવર, ૧૧ ક્ષીરસાગર, ૧૨ વિમાન (નરકમાંથી આવેલ પ્રભુની માતાને ૧૨મું ભવન), ૧૩ રનરાશિ, અને ૧૪ નિર્ધૂમ અનિ જીવાળાનો ગંજ.

(૩) ચ્યવન વખતે ત્રીજું એ બને છે કે ઈંદ્રનું મહાસ્થિર સિંહાસન પણ ડેલાયમાન થાય છે, અને અવધિજ્ઞાનથી ઈંદ્ર પરમાત્માના જીવનો અવતાર જાણી અત્યંત આલહાદ અને રોમાંચ અનુભવે છે. ત્યાં તત્કાલ સિંહાસન પરથી ઉઠી,

મોજડી ઉતારી, સાત આંડ ડગલાં પ્રભુની દિશા સન્મુખ જઈને ઉત્તરાસંગ (બેસ) કરી ઢીંચણ પર રહી અંજલી જોડવા સાથે પ્રભુની સુતિરૂપે શક્સતવ (નમુંથુણું) સોત્ર ભણે છે. એ સોત્રમાં પરમાત્માના અપૂર્વ આત્મપરાકમ, અદ્ભુત શ્રેષ્ઠતા અને સર્વોચ્ચ આત્મોપકારની ભવ્ય વાતો હોય છે; પણ સંસાર-લીલાની કોઈ જ મેલી-ધેલી વાતો નહિ.

(૪) ચ્યવન વખતે ચોથી વસ્તુ એ કે પ્રભુને ત્યારથી જ નિર્મળ અવધિજ્ઞાન હોય છે; તેથી જગતમાં દૂર દૂર વર્તી પદાર્થોને ય પ્રત્યક્ષ જોઈ શકે છે.

### ● (૧) ગર્ભ અવસ્થા ●

ગર્ભમાં રહ્યા રહ્યા પ્રભુનું શરીર માતાના આધારથી પોષાવા છતાં લોકોત્તર પુદ્ગલનું બને છે. એવું કે એનું રૂપ ઈન્જ્રો કરતાં પણ અનંતગણું સુંદર હોય છે. તેમજ શરીરમાં લોહી ગાયના દૂધ જેવું સર્કેદ વર્ષાવાણું હોય છે. કેમ ન હોય ? જન્મ પામતા એક પુત્ર ઉપર પણ અતીવ પ્રેમ-વાત્સલ્ય ધરનારી માતાના સ્તનમાં દૂધ તૈયાર થાય છે, તો ત્રૈયે લોકના જીવો પર વાત્સલ્ય ધરનારા પ્રભુના આખા શરીરમાં લોહી દૂધ જેવું બને એમાં શી નવાઈ ? એટલું જ નહિ પણ એમની માંસાદિ ધાતુઓ જરાય બિભિસ નહિ, પણ ખૂબ જ મનોહર ને દર્શનીય હોય છે. ગર્ભ વધવા છતાં માતાનું ઉદર વિકૃત એટલે કે ફૂલેલું, ઊંચું આવેલું દેખાતું નથી. એવો પ્રભુનો પ્રભાવ હોય છે. તેમજ માતાને કોઈ તકલીફ નહિ. બલકે માતાપિતાના ધરમાં દેવતાઓ કોઈ પર્વતો વગેરેમાંથી નધાણીયાતા ધનના લાવીને ઠગલા કરે છે. માતા પણ પિતા અને જ્યોતિષીઓ દ્વારા સ્વખન-ફળ જાણી મહાન આનંદ ઉત્સવ કરે છે.

### ● પ્રભુનો જન્મ અને ઉત્સવો ●

ગર્ભકાળ પૂરો થયા પછી ગ્રહોની ઊંચી અને બળવાન સ્થિતિમાં કુદરતના મહાસુંદર વાતાવરણ વચ્ચે નિરોગી માતા મહા આરોગ્ય ધરતા એવા આ પુત્રરતને જન્મ આપે છે. એથી ગ્રાણ લોકમાં સુખ અને પ્રકાશ પથરાય છે. ત્યાં દિક્કુમારીઓ, દેવતાઓ અને પિતાના ઉત્સવ થાય છે.

(૧) છાયન દિક્કુમારી દેવીઓ સિંહાસન ચળવાથી પ્રભુ-જન્મ જાણી પોતાના હજારો સેવક દેવતાના પરિવાર સાથે પ્રભુના ધેર આવે છે. માતા અને પુત્રને પ્રશામી એક યોજન ભૂમિ ચોક્ક્ખી અને સુગંધી જલથી સિંચિત કરી ગ્રાણ કેળનાં ધર બનાવે છે. એમાં ગીતગાન નૃત્ય સાથે માતાને અને પ્રભુને અંગે વિલેપન, સ્નાન,

અલંકાર સજાવટ, ધૂપન, રક્ષાબંધનાદિ કૃત્ય અલોકિક સામગ્રી અને દિવ્ય ભભકાથી કરે છે. પછી,

(૨) ઈન્દ્રઉત્સવ :- એમના જતાં જ ઉપર દેવલોકમાં સૌધર્મ ઈન્દ્ર સિંહસન ડેલવાથી પ્રભુનો જન્મ જાણીને સેનાપતિ હરિણોગમેખી દેવ પાસે મોટો સુધોપા ઘંટ વગડાવી મેરુ પર જન્માભિપેક ઉત્સવ કરવાની જાહેરાત કરાવે છે. કરોડો દેવતાઓના પરિવાર સાથે એ નીચે ઉત્તરી આવે છે. પ્રભુની માતાને પ્રણામ સાથે જન્મોત્સવ કરવાનું જણાવી, અવસ્વાપિની નિદ્રા આપે છે; અને પાંચ રૂપ વિક્રવી સ્વયં એકરૂપે પ્રભુને બે હાથમાં બેસાડી, બે રૂપે આજુબાજુ ચામર વીજતો, એકરૂપે આગળ વજ અને પાછળ છત્ર ધરતો ઈન્દ્ર પ્રભુને મેરુ શિખર ઉપર પાંદુકવનમાં લાવે છે. ત્યાં બીજા ઈન્દ્રો પણ આવી પહોંચે છે અને એ મહાન વિવિધ વાજીઓના સરોદો વચ્ચે ક્ષીરસાગર, પચસરોવર માગધતીર્થ વગેરેના નિર્મળ પાણી, ઔષધિઓ વગેરેથી સૌધર્મ ઈન્દ્રના ખોળામાં રહેલ પ્રભુના મહાન અભિપેક કરે છે. એ પછી સૌધર્મેન્દ્ર પ્રભુને ઈશાનેન્દ્રના ખોળામાં આપી પ્રભુની આગળ પોતાની પશુ જેવી અવસ્થા છે એ સૂચવતું બળદનું રૂપ કરી શિંગડામાંથી પ્રભુને દિવ્ય ક્ષીરપાણીની મોટી ધારાથી અભિપેક કરતો નાચે છે. એ પછી પ્રભુને દિવ્યવસ્ત્ર અલંકારાદિ પહેરાવીને મહાગુણગાન-સ્તુતિ-પ્રાથમના કરી પ્રભુને માતાની પાસે મૂકી દે છે. ત્યાં ઘરમાં બતીસ કોડ રન્ન, સુવર્ણ વગેરેની વૃદ્ધિ કરે છે; પ્રભુના અંગુઠે અમૃત સંચારે છે, જેને પ્રભુ ચૂસીને જ ભૂખ શાંત કરે છે. પ્રભુને સ્તનપાન કરવાનું હોતું નથી. દેવના ઉત્સવ પછી રાજી મહાન જન્મોત્સવ ઉજવી લોકોને અપૂર્વ દાન, કરમાઝ, મહિત ખરીદી વગેરે કરાવે છે. જોહી સ્વજનને ભોજન સત્કારપૂર્વક પ્રભુનું નામ પાડવામાં આવે છે. ગર્ભમાં દિવ્યજ્ઞાન અને જન્મ વખતે આવાં દિવ્ય સન્માન છતાં પ્રભુને મન કોઈ અભિમાન કે આનંદ નથી. પ્રભુ તો નિર્લેંપ છે.

આટિ સુધી પ્રભુની જન્માવસ્થા વિચારી. હવે પ્રભુની રાજ્યાવસ્થા જુઓ.

## ● (૨) રાજ્યાવસ્થા ●

જન્મ્યા પછી પ્રભુ મહાવૈભવી લાલન-પાલનમાં ઉછરે છે, કેમકે રાજવી સમૃદ્ધિમાં જમે છે, તેમજ દેવોએ ભંડાર ભરી દીધા છે ! વળી દેવતાઓ પ્રભુના દર્શને અને પ્રભુ સાથે ખેલવા માટે આવે છે ! પ્રભુથી પોતે હારવામાં એ ગૌરવ લે છે ! આ બધી મહાસગવડ-સન્માનની સ્થિતિમાં અંતરથી પ્રભુ મહાવિરાગી અને ઉદાસીન અવસ્થામાં રમે છે ! ત્યારે આપણે મામૂલી તુચ્છ સગવડ સન્માનમાં રાગમૂઢ બની લહેવાઈ જઈએ છીએ. વિચારજો આવા સાચા પરમાત્માના આલંબને

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ” (ભાગ-૧૮)

૭૧

આપણી કેવી અધમાધમ દશા સમજાય છે. એમને આતુરતા. કૌતુક કે રમવા-ખેલવાની લાલસા તૃણા હોતી નથી. છતાં બાલકીડા કે બીજો વ્યવહાર કરે છે તે બીજાના અનુરોધથી; બીજાઓનું મન રાખવા. પોતાને કોઈ રસ કે ઉત્કંઠા નથી. એટલે જ માતાપિતા પણ એમના મહાવૈરાગ્યને દેખે-સમજે છે; તેથી જ એમને પાણિગ્રહણ (વિવાહ) કરવાનું સમજાવવામાં મુશીબતી અનુભવવી પડે છે. અને અંતે એ સુંદર રૂપવતી અને સુશીલ રાજકુમારી સાથે પ્રભુનું લગ્ન કરાવે છે.

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદધિ”

વર્ષ-૪, અંક-૨૧, તા. ૪-૨-૧૯૫૬



## શ્રી અરિહંત પરમાત્માની ઓળખાણ

પ્ર.- આવા મહાવિરાગી પ્રભુ પરણે જ શું કામ ?

ઉ.- પૂર્વના ત્રીજા ભવમાં ઉચ્ચ ધર્મ-સાધના સાથે શુભ ભાવનામાં એવા રમ્યા છે કે એના યોગે ઉપાર્થેલા વિપુલ પ્રમાણમાં પ્રકૃષ્ટ લોગપુણ્ય દેવભવ વીત્યા પછી પણ ભોગવવાના બાકી રહે છે. એ ભોગવ્યા વિના નાશ પામે એમ નથી એવા નિકાયિતકર્મ છે. તેથી જ પ્રભુને લગ્ન કરી કર્મ-દુશ્મનને નીચ ઉપાયથી કાઢવો પડે છે. બાકી કેટલાક તીર્થકર દેવો જેમને દેવભવ પછી ભોગકર્મ નથી તે લગ્ન પણ નથી કરતા અને રાજ્ય પણ નથી ભોગવતા; એ તો બ્રહ્મચારી-કુમારપણે ચારિત્ર લે છે. ત્યારે રાજ્ય પામનારામાં પણ ઉત્કૃષ્ટ ભોગપુણ્યવાળા કેટલાક ચક્કવર્તી પણ બને છે. એવા ચક્કવર્તી પ્રભુના પુણ્ય અપૂર્વ વિશેષતાવાળા હોય છે. એવા વિશેષ કોટિના એ પુણ્ય હોય છે કે બીજી ચક્કવર્તીની જેમ એમને સામાન્ય રીતે દિવિજ્યમાં યુદ્ધ નથી કરવા પડતા. રાજ્યાં એમ જ આકર્ષાઈ શરણો આવે છે. એમ છ ખંડ પર વર્ચસ્વ સાથે ચૌદરન્ન, નવ નિધાન, એક લાખ બાણું હજાર સ્ત્રીઓનું અંતઃપુર, ચૌરાશી લાખનું ગજદળ, હયદળ અને રથદળ તથા કરોડોનું પાયદળ વગેરેનો વૈભવ નિર્દેખપણે ભોગવે છે. ત્યાં પ્રભુ કમળપત્રની જેમ અંતરથી ન્યારા અને મહાવૈરાગ્યવાસિત હોય છે.

ધર્મશાસન સ્થાપવા દેવોની વિનંતિ : વર્ષદાન :-

રાજ્યશાસન કાળ પૂરો થતાં પ્રભુના દીક્ષા સમયની એક વર્ષ પૂર્વે પાંચંગમાં દેવલોકના લોકાન્તિક દેવતા આવીને પ્રભુને ધર્મતીર્થ પ્રવર્તાવવા વિનંતિ કરે છે. ત્યારથી પ્રભુ એક વર્ષ સુધી રોજ પ્રભાતે બે ઘડી સુધી લોકોને ઈચ્છિત દાન આપે છે. આ થઈ રાજ્યાવસ્થાની વિચારણા. હવે

૭૨ ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-શ્રી અરિહંત પરમાત્માની ઓળખાણ (ભાગ-૧૮)

### • (3) શ્રમણાવસ્થા •

પ્રભુ હવે સંસાર ત્યજ ચારિત્રમાર્ગ વિચરવા તૈયાર થાય છે. ધરવાસ મૂકીને દીક્ષા લઈ અનગાર-સાધુ બનવા તૈયાર થાય છે. જુઓ કે પરમાત્માનું કેવું સુંદર આદર્શજીવન કે હજ્ય એમના ભક્તોમાંના કોકને પૂર્વે જીવનની તેવી સાધનાના હિસાબે છેલ્લા ભવમાં ધરમાં બેઠા જ વીતરાગતા અને કેવળજ્ઞાન (સર્વજ્ઞતા) પ્રગત થઈ શકે છે; પણ પ્રભુ પોતે તો ધર ત્યજ ચારિત્ર લઈને જ તપ, સંયમથી કર્મ ખપાવી વીતરાગ સર્વજ્ઞ બને છે; એ પરથી બાળજીવોને બહુ ઊંચું આવંબન મળે છે કે 'પ્રભુ જેવા પ્રભુ તે ભવમાં નક્કી કેવળજ્ઞાન અને મુક્તિ પામવાનું જ્ઞાણવા છતાં જો કર્મ ખપાવવા માટે સંસારવાસની અનુકૂળતા છોડી મહાકઠોર ચારિત્ર જીવન પણે છે, તો આપણે કોણ માત્ર ? આપણે જો ચારિત્ર પાળીએ તો જ આપણાં કર્મ નાશ પામે ને મુક્તિ થાય.' પ્રભુનો ચારિત્ર-ઉત્સવ કરવા હન્દો અને દેવતા પણ આવે છે. મહાન અભિપેકવિષિ વસ્ત્રભૂષણ પરિધાનાદિ પછી શિબિકામાં પ્રભુને આરૂઢ કરી મોટા વરધોડા સાથે પ્રભુને ઉદ્ઘાનમાં લાવવામાં આવે છે. પ્રભુ ત્યાં નીચે ઉત્તરી સ્વયં વસ્ત્રાલંકાર ઉતારી, દાઢી-મૂદ્ધ અને માથાના વાળનો પંચમુદ્રિક લોચ કરે છે; અને જીવજ્ઞજીવની માનસિક-વાચિક-કાચિક સર્વ પાપ વ્યાપારના ત્યાગની ભીષ્મ પ્રતિજ્ઞા ઉચ્ચરે છે. સંસારત્યજ્ઞ સાધુજીવન સ્વીકારે છે. ત્યાં ધન, કુટુંબ, પરિવાર, ધર વગેરે સર્વ વસ્તુનો ત્યાગ કરે છે.

ત્યાંથી પછી પણ સાધુપણે પૃથ્વીતલ ઉપર વિચરે છે. સાથે કોઈ નોકર-ચાકર કે સ્વજ્ઞન-મિત્ર નહિ ! પ્રભુને દુષ્પ પણ ને માણસો અનેક ઉપદ્રવ પણ કરી જાય. છતાં પ્રભુની સાથે કોઈ જ સામાન સરંજામ કરું જ નહિ; એક માત્ર દેવહુદ્ધ વસ્ત્ર સાથે પ્રભુ વિચરે છે. ધોર તપસ્યા આદરે છે, એમાં પાણા શું દિવસે કે શું રાતે જમીન પર પલાંડી માંડીને પ્રભુ બેસતા પણ નથી; તો સુવાની વાત જ કર્યાં ? એમાંય વળી ભૂખ-તરસ, ટાઢ-તડકો, ડાંસ-મચ્છર વગેરે પ્રભળ પરીસહો આનંદથી સહે છે. ઉપરાંત દેવતાઈ, માનવીય કે પશુના ભયંકર ઉપસર્ગ પણ બહુ જ સમતાભાવે વધાવી લે છે. કોઈ જ ખેદ, દ્વેષ, અધીરતાદિ કરવાની વાત નહિ ! ગમાર માણસોના અપમાન-પ્રહાર તથા કૂતરા જેવાના બટકાથી માંડી ઠેઠ સિંહ-વાધના કે સર્પ-શસ્ત્ર સુધીના ગમે તેવા ભયાનક ઉપદ્રવો આવો, ફાંસી, અજ્ઞિ વગેરેના ઉપદ્રવ સામે આવો, કીડીઓ વગેરેથી વિંધાઈ આખું શરીર ચાલણી જેવું થવાનું બનો એ બધીય સ્થિતિમાં પ્રભુને ક્ષમા, દયા, સંયમોપ્યોગ અને આત્મધ્યાન સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ જ નહિ. એમ કરતાં કરતાં એઓશ્રી ઉત્કૃષ્ટ

મંગળભૂત અહિંસા, સંયમ અને તપથી કર્મના થોકના થોક ખપાવે રાખે છે. આ થઈ પ્રભુની શ્રમજા-અવસ્થાની વાત. આ બધી અવસ્થામાં પ્રભુના જે ગુણો છે તેનું વર્ણન આગળ જોઈશું. પણ એટલું ખરું કે મહાપુણ્યે મળેલી મહાન સમૃદ્ધિ હકુરાઈ સુકોમળતાદિને અવગણી પ્રભુ અજબ સહિષ્ણુતા સમતા સમાધિમાં જીવે છે. હવે પદ્સ્થ અવસ્થા જુઓ.

### • (4) પદ્સ્થ અવસ્થા •

તપસ્યા સંયમ અને ધ્યાનના બળે તથા ઉપસર્ગ પરીસહોને ખૂબ જ સમતાભાવથી સહન કરવાના પ્રતાપે પોતાના ધાતી કર્મ-જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચારનો મૂળથી નાશ કરી પ્રભુ વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા બને છે. ત્યાં તીર્થકર નામ-કર્મનું ઉત્કૃષ્ટ પુણ્ય હવે ઉદ્યમાં આવે છે. એનાથી તીર્થકર પદ પ્રાપ્ત થાય છે. એ પદવાળી અવસ્થા તે પદ્સ્થ અવસ્થા. કેવળજ્ઞાન પ્રગટાં તરત જ દેવતાઓ ત્રણ ગઢવાણું સમવસરણ રચે છે. એના ઉપર જગતગુરુ બિરાજમાન થઈ ધર્મદિશના આપે છે. તેને એ અવસરે દેવ, મનુષ્ય તિર્યંચની પર્ષણ ખૂબ જ રસથી સાંભળે છે, અને સમજે છે. ત્યાં વિશિષ્ટ પુણ્યાઈ અને શક્તિવાળા અમુક માણસો બોધ પામી દુન્યવી ઊંચી સ્થિતિનોય ત્યાગ કરી પ્રભુ પાસે સાધુપણું લે છે; અને પ્રભુને ત્રણ વાર, 'હે ભગવંત ! તત્ત્વ શું ?' એમ પ્રશ્ન કરે છે, એના ત્રણ ઉત્તરમાં પ્રભુ ફરમાવે છે, "ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, સ્થિર રહે છે. અર્થાત્ જગતની વસ્તુ માત્રમાં સત્ત્રમાત્રમાં ઉત્પત્તિ, નાશ અને સ્થિરતાના એક સાથે ત્રણેય ગુણધર્મ હોય છે. ન હોય તે વસ્તુ નહિ, સત્ત્ર નહિ." ઉત્તરો સાંભળી એ મહાનુભાવોના શ્રુત જ્ઞાનાવરણના પડદા એવા તૂટી જાય છે કે એમના આત્મામાં લોકાલોકના પદાર્થો, તત્ત્વો તથા મોક્ષમાર્ગની સમસ્ત પ્રક્રિયા વગેરેનો સૂક્ષ્મ અને વિશાળ બોધરૂપી શ્રુતજ્ઞાન પ્રગટે છે. એના ઉપર એ ત્યાંને ત્યાં સંયમ જીવના આચાર, દર્શનો, તત્ત્વો, વગેરેના મહાશાસ્ત્રો રચે છે. એને દ્વાદશાંગી કહે છે. આગમ પુરુષના એ મૂળભૂત શાસ્ત્રો હોવાથી અંગ કહેવાય છે. અંગ બાર હોય છે. એમાં છેલ્લું બારમું અંગ દિશ્યિવાદ નામનું શાસ્ત્ર છે. એના પેટાના પાંચ પ્રકારમાં એક પ્રકાર ચૌદ પૂર્વ નામના મહાશાસ્ત્રનો હોય છે; જેમાં આત્મવાદ, કર્મવાદ, જ્યોતિષ, નિભિત, વનસ્પતિ વિજ્ઞાન, વિદ્યા, મંત્રો, તંત્રો વગેરેનો દરિયો વર્ણવેલો હોય છે. દ્વાદશાંગીની આ સમગ્ર રચના કરનારને ગણધર કહેવાય છે. એમની એ રચનાને પ્રભુ કેવળજ્ઞાનથી તદ્દન સાચી જુએ છે, અને

એના ઉપર સત્યતાનું સમર્થન કરવા તથા બીજા યોગ્ય સાધુઓને એ શાસ્ત્રોનું દાન કરવાની અનુષ્ણા આપવા ત્રિભુવન પતિ સિંહાસન પરથી ઉઠે છે. ગણધર ભગવંતો એક હારમાં માથું નમાવી, હાથ જોડી ઊભા હોય છે. ઈન્દ્ર ત્યાં થાળમાં સુંગઘિત વાસક્ષેપ ચૂર્ણ લઈ બાજુમાં ઊભો રહે છે. પરમાત્મા એમાંથી ચૂર્ણની મુહિ ભરી “દ્રવ્ય-ગુણ-પર્યાયથી હું તીર્થની અનુષ્ણા આપું છું” એમ કહેતાં એ નતમસ્તક ગણધર ભગવંતોના માથે ચૂર્ણ પ્રક્ષેપ કરે છે. શું કર્યું આમાં વિશ્વનાથે? દ્રવ્યો, ગુણો અને પર્યાયો જે યથાર્થ રીતે ગણધર ભગવાને જાણ્યા, અને સૂત્રરૂપે એને અક્ષરદેહ આખ્યો, હવે એ બીજાને ભણવવાની રજા આપી. અર્થત્ એમ કહેવાય કે એ બધાં શાસ્ત્રો ખુદ તીર્થકર દેવના ફરમાવેલા છે. એ શાસ્ત્રો એ જિનવચન જ છે. આ રીતે ગણધર મુનિઓ જે બન્યા તે તીર્થ કહેવાય, એના કરનારા પ્રભુ તીર્થકર કહેવાય છે. પ્રભુ ત્યાં બીજાઓને પણ દીક્ષા, શ્રાવકપણું, સમ્યક્ત્વ વગેરેય આપે છે. એથી સાધુ, સાધી, શ્રાવક-શ્રાવિકા એમ ચતુર્વિધ સંધની રચના થાય છે. એમને પાળવાના વ્યવસ્થિત આચારો, અનુષ્ણાનો વ્રતો વગેરે હોય છે. એમાં સ્બલનના થાય તો દંડ હોય છે. ઈત્યાદિ વ્યવસ્થાથી આ એક ધર્મ-શાસન બન્યું ગણાય છે. શાસનના અધિપતિ રજા ધર્મ ચક્રવર્તી શ્રી તીર્થકર ભગવાન છે. આચાર્યો એમના પ્રતિનિધિ છે; એ પ્રભુના ધર્મશાસનનો પ્રચાર કરે છે. સાધુ, સાધી, શ્રાવક, શ્રાવિકા એ પ્રજાજનો છે. એમના ધર્મજીવનનું પાલન-પોષણ કરવામાં આવે છે.

આવા તીર્થકર ભગવાન ત્રણેય લોકની પૂજાને પામે છે. ખાસ કરીને દેવોની આઠ મહા પ્રાતિહાર્યની સિંહાસન ચામર વગેરે (પૂર્વે ગણાવેલા આઠની) પૂજાને અહૃ (યોગ્ય) બનેલા છે, તેથી અહૃત્-અરહંત અરિહંત કહેવાય છે. હવે એ ચાલે ત્યાં પગલાં માંડવાની જગા પર માખણના પિંડ જેવા સુકોમળ નવ સુવર્ણ કમળ રચાય છે. પ્રભુ ચાલે ત્યાં ઉપર ગગનમાં પંખીઓ પ્રદક્ષિણા દે છે, રસ્તાના ઝડ પ્રભુને નમે છે, અતુ અનુકૂળ થાય છે, પવન શીતળ મંદ વહે છે; કાંટા ઊંધા થઈ જાય છે; સવાસો જોજનમાંથી મારી મરકી વગેરેના ઉપદ્રવો ટળી જાય છે. એવા વીતરાગ સર્વજ્ઞ તીર્થકર શ્રી અરિહંત પરમાત્મા ત્યાર પછી આયુષ્ય પહોંચે ત્યાં સુધી દેશેદેશ ગામે-ગામ વિચરે છે. દિવસના પહેલા અને પાછલા પહોરે ધર્મ-દેશના દે છે; લાખો કરોડો જીવો પ્રભુના અને શિષ્યોના હાથે સાધુપણું, વ્રતધારી શ્રાવકપણું, કે સમકિતિ શ્રાવકપણું પામે છે.

## • (૫) રૂપાતીત અવસ્થા •

અંતે આયુષ્ય સમાપ્ત થવાના અવસરે પ્રભુને જ્ઞાનમાં યોગ્ય લાગે તે મુજબ છેલ્લા દિવસોમાં આધાર-પાણી ત્યજ અનશનમાં રહી પર્દકાસન વગેરે આસને શુદ્ધ ધ્યાનના છેલ્લા બે પાયાથી તદ્દન અયોગી બની ચાર અધાતી કર્મ (વેદનીય, આયુષ્ય, નામકર્મ-ગોત્રકર્મ)નો સર્વથા નાશ કરે છે; અને મોક્ષ પામે છે. મોક્ષમાં હવે શાશ્વત કાળ માટે કર્મ, શરીર, મન, વચન, ગતિ, ભવ, ઇન્દ્રિયો, લેશયા ભૂખ, તરસ, રોગ, શાતા-અશાતા, યશ-અપયશ, માનાપમાન વગેરેથી રહિત બની તદ્દન શુદ્ધ સ્ફટિકવત નિર્મળ, નિરંજન નિરાકાર અરૂપી આત્મા બની ચૌદ રાજલોકના મથાળે સિદ્ધ-શિલાના ઉપર પહોંચી જાય છે; અને લોકના અંતે સ્પર્શને રહે છે. ત્યાંથી કદી એમને પાછું ઉત્તરવાનું નથી હોતું. અલબત્ત હજી બીજા આ પૃથ્વી ઉપરના વિશિષ્ટ કોટિના જીવો પૂર્વે કંધું તેમ વિશિષ્ટ કોટિનું ઊંચું સમ્યક્તવ વીસ સ્થાનક અને વિશદ્યાનાં આરાધન કરી તીર્થકર થતા જાય છે. બાકી મોક્ષે ગયેલા, શું તીર્થકરના કે શું બીજા, ગમે તે આત્માને અવતાર લેવાના હોતા નથી. હવે તો અક્ષય અવ્યાબાધ અનંતા સુખમાં એ જીલે છે. એ સુખ સર્વ જીવોના સુખ કરતાં અનંતગુણું હોય છે; સંયોગની અપેક્ષા વિનાનું નિરપેક્ષ આત્મસુખ હોય છે. સંયોગ-જન્ય સુખના અભ્યાસીને એના અનુભવનો જ્યાલ નથી આવી શકતો. પણ તે વાસ્તવિક સુખ છે અને અનંત પ્રમાણવાળું છે; કેમકે જીવને જો એક શરૂના નાશથીય મહાઆનંદ થાય છે; એક ઈચ્છાની પૂર્તિ અને નિવૃત્તિ થવાથી અપૂર્વ આનંદ લાગે છે; એક રોગ એક પીડા એક ઉપદ્રવના નાશથી અદ્ભુત સુખનો અનુભવ થાય છે; એક સારા પદાર્થની પ્રાપ્તિથી અપૂર્વ મજા આવે છે; તો પછી સર્વ શરૂના અભાવથી, સર્વ ઈચ્છાની નિવૃત્તિથી, સર્વ પદાર્થની પ્રાપ્તિથી અને સર્વ રોગ-પીડા-ઉપદ્રવના નાશથી અનંત સુખ પ્રાપ્ત થાય, અનુભવાયા કરે એમાં શી નવાઈ ? મોક્ષાવસ્થામાં કોઈ શરૂ, કોઈ ઈચ્છા, કોઈ રોગાદિ રહેતા નથી. તેથી અને ખરું તો આત્મા ઉપરના સર્વ આવરણ-ક્યરા દૂર થઈ ગયા હોય છે; તેથી સ્વભાવગત અનંત આનંદનો દિવાકર નિર્મલ આત્મગગનમાં વૈશાખના મધ્યાહ્નની જેમ જળહળી ઉઠે છે !

હવે આત્માને જન્મ નથી, એટલે શરીર નથી ને મન નથી; એટલે રોગ, શાક, દુઃખ, દારિદ્ર્ય દૌર્ભાગ્ય, જરા, મૃત્યુ વગેરે કોઈ જ વેદન નથી; તેમ કામ, કોષ, મંદ, માયા, મત્સર વગેરે કાંઈ જ લાગણી કે વિકાર નથી. એ તો હવે અરૂપી, અમોહી, અકોધી, અમાની, અમાયી, અલોભી, અરામી, અદ્વૈતી, અલેશ્યી,

નિરિચ્છ, નિર્વેદી, નિર્વિકલ્પ, નિરપેક્ષ, શુદ્ર સ્વરૂપસ્થ બનેલા છે. હવે તો લોકાલોક પ્રકાશક કેવળજ્ઞાન-કેવળદર્શન વડે સમસ્ત જગતને ઉદ્ઘાસીનભાવે જોવાના અને અનંત સહજ આનંદમાં જીવાના નિર્મલ આત્મસ્વરૂપમાં રમણ કરે છે. આ થયું રૂપાતીત અવસ્થાનું સ્વરૂપ. એમ પરમાત્માના જીવન અંગેની વિચારણા થઈ.

પરમાત્માની પ્રથમ સમ્યક્તવ પામવા વખતની ઉત્તમતા પૂર્વના ત્રીજા ભવની અદ્ભુત સાધના અને સાચું વિશ્વાત્સલ્ય સહિત તાત્ત્વિક જગત દ્યાળુપણું, દેવભવની દુર્લભ વિરક્ત દશા, અવન પદ્ધીની અદ્ભુત ઉત્તમતા, જન્મ વખતનો આત્મકલ્યાણ અર્થે દિક્કુમારીઓ, ઈન્દ્રો, દેવો વગેરેનો ઉત્સવ આ બધું મળીને પ્રભુની જન્મ અવસ્થા, એ પદ્ધી પ્રભુની લગ્ન અને રાજ્ય અવસ્થામાં નિર્લેપ નિરાસંગ દશા, એ પદ્ધી રોમાંચક અને હૃદયવેધી શ્રમણઅવસ્થા, એમાંની ધોર તપ-સંયમ વગેરેની સાધનાની ચર્ચા અને ઉચ્ચ તપ, પવિત્ર જીવન, પદ્ધી પદસ્થ અવસ્થામાં સાચેસાચ પરમાત્મપણાની અવસ્થા અને ચર્ચા, પરમાત્મપણાનું કર્તવ્ય-પાલન, સાચી લોકનાથપણાની સ્થિતિ આ બધું એ પદસ્થ અવસ્થા પદ્ધી શુદ્ધ સુંદર આત્મસ્વરૂપ અને અનંત વૈભવ સમૃદ્ધિવાળી રૂપાતીત અવસ્થા...આમ પરમાત્માના જીવનનો પણ વિચાર આપણને આપણા અધમ સ્વરૂપમાંથી બહાર કાઢી પરમાત્મસ્વરૂપે પહોંચાડનારું બને છે. પરંતુ તે પરમાત્માનું આવું જીવન આલંબન તરીકે મળે તો જ. એના બદ્લે પરમાત્માનું લીલાદિ યેષાનું જીવન હોય, યુદ્ધાદિ ધમધમાટ જીવન હોય, મોટી પ્રવૃત્તિનું જીવન હોય, આરંભ-સમારંભનું જીવન હોય, અને તે પણ પાછું પરમાત્મસ્વરૂપના ખાતે ખતવાયું હોય, તો એ શો આદર્શ કે શું આલંબન આપી શકે ? ત્યારે એ પણ વસ્તુ છે કે આપણા જીવન સામે ઉપર વણવિલી જન્માદિ અવસ્થાઓવાળા તેમજ પૂર્વ કહેલા સ્વરૂપ અને હવે કહેવાના ગુણો, શક્તિ અને આને ઉપકાર કરનારા આદર્શ ન ધરી રાખીએ, અને એમાં યથારોગ્ય ન આચરીએ તો માનવ જીવનની સફલતા શી સધાવાની ?



“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદધિ”

વર્ષ-૪, અંક-૨૩, તા. ૧૮-૨-૧૯૫૯



## શ્રી અરિહંત પરમાત્માની ઓળખાણ

### ● પરમાત્માના ગુણો ●

ગુણો અનંતા છે. સર્વજ્ઞ શ્રી અરિહંત પરમાત્મામાં ધાતીકર્મોનો અમલ નાશ થવાથી અનંતગુણો પ્રગટ થયેલા હોય છે, ખુદ સર્વજ્ઞ ભગવાન પણ એ ગુણોને પૂરેપૂરા જાણવા છતાં વર્ણવી શકતા નથી. કેમકે આયુષ્ય પરિમિત છે, અંતવાળું છે, એમાં અનંતગુણો ક્યાંથી વર્ણવી શકાય. કહું છે કે,

યદિ ત્રિલોકી ગણના પરા સ્યાત્ પારે પરાર્થ્ય ગણિતં યદિ સ્યાત્ ।

ન વા સમાપ્તિઃ પુનરાયુષઃ સ્યાત્ તદૈવ સ સ્યાદ્ગણેયગુણઃ ॥

એટલે કે જો, પ્રભુના ગુણોની ગણની કરવામાં ત્રણેય લોકના જીવો લાગી જાય, પાછું ગણિત પણ પરાર્થ્યની પેલે પાર હોય, અને ગણનારના આયુષ્યની વળી સમાપ્તિ ન હોય, તો જ એમના ગુણોની ગણની પૂરી થાય ! એટલા બધા ગુણવાળા એ છે ! આનો અર્થ જ એ કે અનંતા જીવોથી અનંતાકાલ સુધી સતત કરાતી ગણની પ્રમાણ ગુણો ! એટેલે ગુણો બે-પાંચ પચાસ નહિ પણ અનંતા !!

પ્ર.- દોષ તો માત્ર અદાર દૂર થાય છે, તો ગુણ અદાર જ કેમ નહિ ? હિસા જવાથી અહિસા ગુણ. રાગ જવાથી વીતરાગતા ગુણ. એમ અદાર જ થાય ને ? અનંતા કેવી રીતે ?

ઉ.- એ વાત સાચી છે કે અદાર દોષના નાશથી એના પ્રતિપક્ષી અદાર ગુણો જન્મે. પરંતુ દોષ અદાર એ સ્થૂલ ગણની છે, દરેક દોષના અવાન્તર બેદ એટલા બધા છે કે કુલ દોષો અનંતા થાય.

પ્ર.- અનંત દોષોની સમજ કેમ કરવી ?

ઉ.- આ કઠિન છે; પણ સમજો કે દા.ત. અજ્ઞાન નામનો દોષ છે, તે અજ્ઞાન દોષમાં ત્રણેય કાળના તે તે પદાર્થોનું અને એના તે તે પર્યાયોનું અજ્ઞાન જુદું જુદું ગણતાં, અનંત જાતના અજ્ઞાન દોષ થાય કે નહિ ? એવી રીતે કામચેષ્ટાની કેટલીય જાતો છે ! એ દરેક જાતની પાછી અવાન્તર જાતો છે ! એમાંચ કામ સંબંધી કેટકેટલી જાતના વચ્ચો, કેવી કેવી વિચારણાઓ, અને કેટલીય જાતના આંખના કટાક્ષોથી માંનીને જુદા જુદા અંગની જુદી જુદી ચેષ્ટાઓ, આ બધું તો પાછું એક સ્ત્રીના એક ભવના અવતાર સંબંધી, પણ જગતભરની સ્ત્રીઓના જુદા

જુદા ભવ સંબંધી એ દોષો ગણવા જતાં કેટલા દોષો થાય ? એવું રાગ દોષના પણ અનંત ભેદ પડે. દા.ત. એક વસ્તુ પર રાગ છે. તેથી એના સુતર કે રેશમના પુમે પુમે જુદો જુદો રાગ છે. કેમકે, ધારો કે એના પર કોઈની કલમની ટાંકની સહેજ અણી જો લાગી ગઈ, તો માત્ર એક ઝીણી પુમ પર ડાઘ લાગ્યો પણ તેથી મનને ખૂંચે છે. જો કે બાકીની હજારો પુમ હજ તો નિષ્કલંક ઉજ્જવળ છે, જતાં આ એક પુમ પરના જુદા રાગના લીધે અતિ ઝીણો ડાઘ પણ ખમાતો નથી. એમ એક જ ઘરમાંની અનેકાંનેક ઘર-વખરાની અને એજ રીતે જગતભરની વસ્તુઓના રાગેરાગના થોક છે ! તેમ વસ્તુ દરેકના ખૂણો ખૂણાના રાગ, રૂપના રાગ, રસના રાગ, ગંધના રાગ, સ્પર્શના, આકૃતિના... ઈત્યાદિ અનંત અંશના રાગ જુદા જુદા છે. માટે જ એક કેરીમાંય, રંગ, સ્વાદ વગેરેના રાગ અલગ હોવાથી તેથી રંગે લાલ-પીળી જ ગમે છે, સ્વાદે મીઠી જ ગમે છે, ગંધે સુગંધીત જ ગમે છે, સ્વાદે મીઠી જ ગમે છે, ગંધે સુગંધિત જ ગમે છે, પાછી સ્પર્શે તે સુવાળી જ વહુ ગમે છે. એમાંય આકૃતિએ ગોળમટોળ જ સારી ગમે છે. આ બધામાંય પાછું જુદી જુદી જાતની લાલાશે રાગ જુદો જુદો ! જુદી જુદી મીઠાશે રાગ જુદો જુદો ! આમ રાગનાય હિસાબ નથી. એટલે જ બીજું બધું બરાબર જતાં એકદ રંગ કે રસ બરાબર ન હોય તો ખૂંચે છે. રાગ-દ્વેષ અજ્ઞાનાદિના દોષો અનંતા છે. આ તો બાળજીવોને સમજવાની ગણાની છે. પણ અનંત દોષોની સૂક્ષ્મ સમજ તત્ત્વજ્ઞ પુરુષ આમ કરી શકે. એ જાણે છે કે આત્મામાં જ્ઞાનાવરણીયાદિ કર્મના અનંત દલિકો છે, તેમજ રાગદ્વેષાદિના સંકલેશના અસંખ્ય સ્થાનકના પ્રત્યેકમાં વૃદ્ધિ પામતો અનંત અનંત રસ છે. તેથી આ અનંત દલિક અને અનંત રસના કાર્યરૂપે અનંતા દોષો થાય, તેમજ તેના નાશથી અનંત ગુણ-પ્રગટ થાય, એમાં નવાઈ નથી.

આ વસ્તુ ધ્યાન પર લઈએ ત્યારે જે કહેવાય છે કે ‘પરમાત્મા અગમ અગોચર છે. પરમાત્માનું સ્વરૂપ અતિ ગંભીર છે, અતિ ગહન છે,’ તે અગમ, અગોચરતા, અને ગંભીરતા-ગહનતા શી, તેનો ધ્યાલ આવે. હવે વિચારો એ જગદીશરે એવા અનંતા દોષોને ધક્કે ચઢાવી અનંતા ગુણો પ્રગટ કરવાનું જે પરાકમ કર્યું, તેથી કેવું અચિત્ય, અતુલ, અનંત પરાકમ !! ત્યારે એમના તે અનંતા ગુણોય કેવા ? પ્રભુની વિચારણીય ગહનતા આ છે; પણ નહિ કે બીજાઓએ માનેલી સર્જન શક્તિની ગહનતા. એ અનંતગુણોની જ ગહન વિચારણા આપણા દિલમાં આત્મવિશુદ્ધિનો નવો પ્રકાશ અને નવો ઉલ્લાસ આપી શકે.

બ્રહ્માણ સર્જવાની શક્તિ કે હવા-પાણી-અન્ન-પ્રકાશ વગેરે આપવાનો લૌકિક ઉપકાર વિચારવામાં આપણા પોતાના અનાદિકાળથી ખંધા થયેલા કામ-કોધ-ભુવનભાનું એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ” (ભાગ-૧૮)

મોહાદિદોષોને ધક્કો શી રીતે લાગે ? તેમ એવા શક્તિ-ઉપકારવાળા ઈશ્વર પણ આપણા દોષો કેમ ટાળી શકે ? પોતે વીતરાગતા બતાવે તો ભક્તને વૈરાગ્ય તરફ ઉલ્લસિત કરી શકે.

### પરમાત્મા બનવાની ભૂમિકાના ગુણો :-

આમ તો પ્રભુના ગુણો ગણાય તેમ નથી, તેથી માત્ર મોટા થોડાક જ ગુણોનો વિચાર થાય. તે પણ અતિ અલ્ય વિચાર થઈ શક્શે. આમાં પણ પહેલું એ જોવા જેવું છે કે હજ જ્યારે પ્રભુની પરમાત્મા તરીકે નથી મનાતા, પણ એક આદર્શ માનવ, આદર્શ બાળક, આદર્શ પુત્ર, આદર્શ ગૃહસ્થ, આદર્શ રાજ, આદર્શ સાધુ,... ઈત્યાદિ રૂપે ગણાય છે, ત્યારે પણ એમનામાં પરમાત્મા બનવાની ભૂમિકાને યોગ્ય કેવા કેવા મહાન અચિત્ય પ્રભાવશાલી ગુણો છે.

**પરમાત્મા બનવા પૂર્વના ગુણો :-** પૂર્વે જોયું તેમ, પરમાત્માના જીવમાં અનાદિકાલથી જાત્યરત્નની જેમ સહજ ઉત્તમતા છે. એના યોગે એ સંસારના વિવિધ ભવોમાં પણ ઊંચા વિશિષ્ટ સ્થાનો પામે છે. પછી પ્રથમ સમકિત પામવાના અવસરે એમનામાં ઉદારતા, સ્વદોષ-દર્શન, વગેરે અનેક ગુણોથી મધ્યમધતી અદ્ભુત માનવતા ખીલી ઉઠી હોય છે. અહીં માનવતાના કેટલાક ગુણો દણાત સાથે જુઓ.

**ઉદારતા પરપીડાપીડિતતા, સ્વદોષદર્શન, લધુતા, પરાર્થવ્યસન, પરમમૈત્રી, ઔચિત્ય, ગુણાનુરાગ, ધર્મશ્રદ્ધા, મહાસંવેગ વૈરાગ્ય :-**

દા.ત. ઋષભદેવ પ્રભુના જીવ ધના સાર્થવાહે નગરમાં એવો ઢંદેરો પીટાયો કે જે કોઈને મારા સુરક્ષિત સાર્થમાં આવવું હોય તે ખુશીથી આવે. અટવી વગેરેમાં રક્ષક પહેરીગીરો તરફથી બરાબર રક્ષા રહેશે; તેમજ જેની પાસે બીજી પણ સાધન સામગ્રી નહિ હોય તેને મારા તરફથી પૂરી પાડવામાં આવશે. કેવી મહાન ઉદારતા ! સહેજે લોકો સ્વયં પરેશ કમાવવા જવા ઈછે, પણ એમાં આ તો આખા નગરના લોકોને આમંત્રણ દે છે ! ત્યાં મુનિઓને પણ સાર્થમાં ખુશીથી લીધા ! એ પછી પ્રવાસની વચ્ચે મુનિઓની સંભાળ લેવાનું જરા ભૂલ્યા, તો તે બદલ એમણે ભારે પશ્ચાત્તાપ કરવાનું, અને ક્ષમા માગવાનું કર્યું, એ કેવી ઉત્તમ પરપીડાપીડિતતા, સ્વદોષદર્શન, લધુતા, વગેરે ગુણો ! એ ભવ પછીના ભવોમાં પણ સ્વાર્થ ગૌણ કરીને રાખેલી પરાર્થ-વ્યસનિતા, પરદુઃખભંજકતા, પરમમૈત્રી, ઉચ્ચ ઔચિત્ય, વિવેક, ગુણાનુરાગ અને પ્રમોદભાવ. વળી ઉચ્ચ ધર્મશ્રદ્ધા, મહાસંવેગ, મહાવૈરાગ્ય વગેરે ગુણોની એમનામાં અજબ ગજબ કોટિના હતા ! જેનો ધ્યાલ તો તે તે જીવનના તે તે પ્રસંગો વિચારવાથી ઠીક આવી શકે. યદ્યપિ સમ્યક્ત્વ પામતા અને પામ્યા પછી તીર્થકર પરમાત્માના આત્મામાં બહુ ગુણો અંદરખાને તો પ્રગટ

થઈ જ ગયા હોય છે, પરંતુ એમાંના કેટલાક ગુણો તો જીવનમાં તેવા તેવા પ્રસંગો ઉપસ્થિત થતાં જ બહાર જણાય છે. તેથી એ જીણવા માટે જુદા જુદા તીર્થકર ભગવાનના નિરનિરાળા પૂર્વ જીવન પ્રસંગો વિચારવા ઉપયોગી બને છે.

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદધિ”

વર્ષ-૪, અંક-૨૪, તા. ૨૫-૨-૧૯૫૬



## ૧૨ શ્રી અરિહંત પરમાત્માની ઓળખાણ

પરોપકારવૃત્તિ, અતિથિસત્કારની ભૂખ, બાળનમ્રતા, વિચારકતા, નિરહંકારતા, કૃતજ્ઞતા, ધર્માનંદ, વૈભવી સંસાર-ત્યાગ, ઘોરતપ, સમતા :-

દા.ત. શ્રી મહાવીર પ્રભુનો પહેલો નયસારનો ભવ વિચારતાં એમાં મહાન પરોપકારવૃત્તિ. જેંગલમાં પણ અતિથિ સત્કારની ભૂખ, સત્પુરુષો આગળ બાળ જેવી નમ્રતા, વિચારકતા તેમજ આમ તો પોતે ગુણસંપન્ન માનવ હોવા છતાં પોતાની જીતમાં પોતે નિરહંકારથી નિર્ણયાતા-અધ્યમતા અને પશુતાનું દર્શન કરી રહ્યા છે તે; ધર્મ પાખ્યાનો અપૂર્વ આનંદ; ધર્મ પમાડનાર પ્રત્યે ઊંચી કૃતજ્ઞતાની બુદ્ધિ...વગેરે ગુણો છે. મરીચિનો અને વિશ્વભૂતિનો ભવ જોતાં એમાં સહજમાં વૈરાગ્ય પામવાનો અને ઝાંદ્રિભર્યો સંસાર ત્યજવાનો પુરુષાર્થ બહુ અદ્ભુત કોટિનો ગુણ છે ! એ તેવા પ્રસંગ પરથી સમજાય છે. વિશ્વભૂતિના ભવમાં તપનો ગુણ કેટલો મહાન, કે મોટી લખ્યિ ઉત્પન્ન થઈ ગઈ હતી. પ્રિયમિત્ર નામના ચક્કવતીના ભવમાં ષટ્ટંંદના વૈભવવિલાસ ત્યજ કોડ વર્ષ કઠોર ચારિત્ર પાળવાનો ગુણ, નંદનંત્રષિના ભવમાં રાજીવીપણું ત્યજ લાખ વર્ષ ચારિત્ર જીવન ! માસખમજાના પારણે માસખમજા કરીને લગભગ બાર લાખ માસખમજાની અતિ ઘોર તપસ્યા ! એમાંય વીસ સ્થાનકની જોરદાર આરાધનાઓ ! સાથે મહાસમતા, સમાધિ, અંતિમ સંલેખના, અનશન વગેરે ગુણો અનુપમ કોટિના જોવા મળે છે !! છેલ્લા ભવના પૂર્વભવમાંય પરમાત્માના જીવમાં ચાચ નરકમાં કે સ્વર્ગમાં અપૂર્વ ઉપશમ આત્મજાગ્રતિ, અપૂર્વ વૈરાગ્ય, વગેરે ગુણો પ્રકાશતા હોય છે !!

નિરભિમાનિતા, તત્ત્વદર્શિતા, માતૃભક્તિ, કષ્ટસહિતા :-

અંતિમ ભવમાં તો પ્રભુમાં ગુણોનો થોક ઉભરાય છે ! ગર્ભમાં આવે ત્યાં નિર્મણ અવધિજ્ઞાન, સમ્યક્તવ અને જીવલંત વૈરાગ્ય પ્રગટ હોય છે ! શ્રી મહાવીર પ્રભુને ગર્ભમાં રહ્યે રહ્યે માતા ઉપર મહાભક્તિનો આવેગ અને વિવેક જગ્યા હતા, એમાં એમને ત્યારની અતિ સુકોમળ કામે પણ હાલ્યા-ચાલ્યા વિના અંગોપાંગ ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ” (ભાગ-૧૮)

૮૧

સંગોપવીને બેસવાનું મહા કપદું કાયકષ ઉપાયું. શ્રી અરિહંત પરમાત્માનો જીવ જન્મ પામે ત્યાં દિક્કુમારીઓ અને દેવન્દ્રો જેવાથી પણ મહા સન્માન કરાવા છતાં મહાન આત્મસંયમી. પ્રભુ એથી જરાય ઉત્કર્ષ નથી માનતા ! જરાય અભિમાન નથી કરતા ! કેવી મહાન નિરભિમાનિતા ! ઉપરથી એ બધું પુણ્યની લીલા, એટલે કે ક્ષણિક, પરાવીન અને આત્મ સ્વરૂપની બાધ હોવાનું સમજે છે.

એવી મહાન તત્ત્વદર્શિતાનો ગુણ પ્રભુમાં જીનથી હોય છે. ત્યારે મહાગંભીરતા, નિરભિમાન અને મહાસાત્ત્વિકતા કેવીક હોય છે તે જુઓ.

પ્રભુ અવસર આવે પણ બાલપણથી એવી ગંભીરતા અને આત્મલઘુતા દાખવે છે કે જેમાંનું આપણાથી શું બને ! ‘શ્રી મહાવીર પ્રભુ તીર્થકર થશે’ એમ દન્નો કહી ગયા છે. છતાં માતાપિતા એમનું મહાજ્ઞાની પ્રભુપણું ભૂલી એમને બાળ સમજી નિશાળે ભણવા મૂકવા માટે લઈ જાય છે; તે ઠેઠ પંડિતના ઘરમાં લઈ ગયા ત્યાં સુધી ! પણ મહાગંભીર પ્રભુ તો કાંઈ બોલતા જ નથી કે ‘આ કેમ મને અહીં લાવો છો ? કોણ મને ભણાવનાર છે ? લાવો તો ખરા, જરા પહેલાં એનું જ્ઞાન હું તપાસું કે અને કેટલું આવડે છે ? અને મને તમારે ભણાવવો છે ! એમને ? જેઓ હું, તમે કેટલું ભણ્યા છો ?...’ આવું કાંઈ પણ મનમાંય વિચારવાનું નહિ. તો સહેજ પણ બોલવાની વાત જ ક્યાં ? કેવીક સાગરથી અધિકી ગંભીરતા ! મૌનપણે ઠેઠ પંડિતના ઘર સુધી ગયા. એમાં મનની અંદર ભાવી ભાવ જે બનાવે તે તત્ત્વસ્થપણે વિચારતા જોયા કરે છે.

સાચી મોટાઈ એજ છે કે શુભાશુભ બનાવોમાં ભથ્થથ્થભાવ રાખી ગંભીર રહેવાનું, પણ અજ્ઞાની મૂઢ માણસોની જેમ એ શુભ અશુભ બનાવોની અસર નીચે લહેવાઈ જવાનું નહિ. શુભા-શુભની અસરમાં તણાવું એ તો હીન સત્ત્વના છે. પ્રભુ તો મહાસાત્ત્વિક અને સાગરથી પણ અધિક ગંભીર છે. નહિતર ક્યાં પેલો પંતુજી પંડિત ! અને ક્યાં આ મહાજ્ઞાની અવધિજ્ઞાની અને શાસ્ત્ર પારગામી પ્રભુ ? પ્રભુ આગળ પંડિત તો કુછ વિસાતમાં નહિ. છતાં માતાપિતાના દોર્યા પ્રભુ એવાને ઘેર ભણવા જાય છે ! કોઈ અપૂર્વ સત્ત્વ, ગંભીર્ય, અને નિરભિમાન વગર આ બનવું મુશ્કેલ છે. અલ્ય સત્ત્વતામાં તો આત્મા ચલિત થઈ ઉછળી ઉડે. કમમાં કમ છેવટે વિચારવાય મંડી પડે કે આ તો અનુચિત થાય છે ! માતાપિતાની આટલી બધી બિનસાવધાની ?...વગેરે વગેરે એહીં તો કશું જ એવું નહિ. બાલવયે આવા અસાધારણ ગુણો છતાં મહાપ્રોદી, ઉદાસીન અને તત્ત્વદર્શિમાં રમતા છે. કેમકે સમજે છે કે ‘ભાવીભાવ જે સર્જે તે સર્જવા દો. એમાં કાંઈ આપણો આંતરિક ગુણ ખોવાતો નથી. પંડિત પોતે સામે ગાઈ પર ચઢી બેસે,

૮૨ ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-શ્રી અરિહંત પરમાત્માની ઓળખાણ (ભાગ-૧૮)

આપણે સામે ઉભા રહેવું પડે એમાં આપણા અંદરના મહાજ્ઞાનાદિ ગુણ જરાય ઘવાતા નથી.’

### નિરુત્સુક તથા અત્યંત ધીર અને નિર્ભય :-

બાલ્યવયમાં પ્રભુ રમવા કરવાની ઉત્સુકતા આતુરતા રહિત હોય છે. તેથી માત્ર મિત્રોના અનુરોધથી એમને ભેગા ભળવું પડે છે, ઘરમાં પણ એમને બીજા રમાડે, ખીલાવે એવી ઈચ્છા કે આતુરતા એમને હોતી નથી. એ તો પોતે ઉદાસીનતા અને તત્ત્વદિષ્ટમાં રમતા હોય છે. પરંતુ એમના પ્રભળ પુણ્ય એવા છે કે સ્વજન પરિજન જરાય થાક્યા-કંટાખ્યા કે ધરાયા વિના પ્રભુને ખૂબ મહલાવે છે. અવસરે દેવતાય રમાડવા મહલાવવા આવે છે. મહાસુખ સત્કારની સુંવાણી સ્થિતિ છતાંય એમાં પ્રભુની કેવી અલૌકિક પ્રૌઢતા અને નિરુત્સુકતા ? ત્યારે સમજી રાખો કે આપણાથી પણ આવા આવા વિશેષ ગુણોએ જ પરમાત્મભાવની નિકટ પહોંચી શકાય છે. બાલ્યવયે નિર્ભયતા પણ પ્રભુમાં અદ્ભુત હોય છે એના એક દસ્તાંત તરીકે શ્રી મહાવીર પ્રભુનું આમલકી ક્રીડાનું દસ્તાંત પ્રસિદ્ધ છે. સ્વર્ગમાં ઈન્દ્ર પ્રભુના ધૈર્યના ગુણ ગાયા. મિથ્યાદિ દેવતાએ સહી ન શકવાથી પ્રભુની પરીક્ષા કરવા નીચે આવ્યો. એ મિત્રોના અનુરોધથી બેલતા પ્રભુને મોટા કાળા ફૂલીધર સર્પનું અને સાત તાડ કેટલા ઊંચા પિશાચનું રૂપ દેખાડે છે. ત્યાં બીજા છોકરાઓ તો ગભરાઈ જાય છે, પણ પ્રભુ લેશમાત્ર ધૈર્ય છોડતા નથી. કિન્તુ નિર્ભયપણે સાપને હાથેથી પકડી દૂર ફેંકે છે પછી પાછા એટલા ઊંચા પિશાચના ખબે બેસીને એને મુઠી લગાવી સંકોચાવી દે છે. દેવને અંતે ક્ષમા માગવી પડે છે. પ્રભુનો આ ધૈર્ય ગુણ છે.

### મહાશાંતતા, ઉચ્ચ વિવેક, મહાવિનય, મર્યાદાપાલન :-

પ્રભુ કુમાર અને યુવાન અવસ્થામાં આવે છે ત્યાં પણ એમનામાં મહાશાંતતા અને ઉચ્ચ વિવેક જળહળતો હોય છે. એક દાખલો જુઓ કે શ્રી નેમિનાથ પ્રભુ પ્રત્યે શંકા ખાઈને ફૂલ વાસુદેવે એમને કહ્યું કે ‘આવો નેમિકુમાર, આપણે બળની પરીક્ષા કરીએ.’ પ્રભુ અતુલ બળી છે છતાં અહીં મહાશાંત છે. તેથી બીજું કશું બોલતા નથી. પરીક્ષામાં ફૂલનો હરાદો અખાડામાં મહલ કુસ્તી કરવાનો કે એવો કોક હશે. પરંતુ અહીં તો નેમિકુમાર કહે છે કે ‘જો ભાઈ, આપણે ભૂલુઠન (ભૂમિ પર આળોટવાનું) કરવું અનુચ્છિત છે. માટે માત્ર હાથ વાળવામાં બળની પરીક્ષા કરીએ.’ કેવો સુંદર વિવેક ! આટલું કરવામાં પણ પ્રભુને કાંઈ જશ લેવાની કંદ્ધા નહોતી. કિન્તુ શ્રી ફૂલના અનુરોધને અનુસરતા હતા. એમાં અરિહંત થનાર પરમ

પુરુષ માટે અનુચ્છિત ચિંતા કરી તીર્થકરની એક પ્રકારે આશાતના કરતા હતા તે અટકાવવાની જરૂર પણ ગણી શકાય. કેવી સરસ ભાવદ્યા ! કેવો નિર્દોષ વિવેકી ઉપાય ! અહીં નેમિકુમાર હજી પરમાત્મ સ્વરૂપમાં નથી આવ્યા પણ પરમાત્મભાવની નિકટ લઈ જાય એવા ઉત્તમ ગુણોને ધરે છે. એમાં એમણે શ્રી ફૂલનો હાથ તો કમલના નાલની જેમ વાળી દીધો, પણ પોતાના હાથ ઉપર ફૂલા આખાને આખા લટકી પડ્યા તોય વાળી શક્યા નહિ. આટલું બળ હોવા છતાં શ્રી ફૂલની મજાક ઉડાવવાની નહિ એવી પ્રભુની ઠરેલતા.

પ્રભુના કેટલા ગુણો ગણી શકશો ? ગુણો તો ગાયા ગણાય નહિ એટલા બધા છે. બીજો પ્રસંગ જુઓ.

જરાવિદ્યાથી મૂર્ખીંત એવી શ્રી ફૂલની આખી સેનાની મૂર્ખી ઉતારવા શ્રી નેમિકુમારે ફૂલને ધરણેન્દ્ર પાસેથી શ્રી પાર્વતનાથ પ્રભુની મૂર્તિ મેળવી એનું સ્નાત જલ સેના પર છાંટવા કહ્યું. આ પણ કેવો મહાવિવેક ! પોતે ક્યાં પ્રભાવશાલી નહોતા ? છતાં પોતાની જ ચરણરંજ કે ચરણજલ લઈ છાંટવા ન કહ્યું અને મૂર્તિ મેળવવા કહ્યું. દરમિયાન પોતે શાનુ દળને માર્યા વિના ફૂલની સેનાનું રક્ષણ કર્યું.

ત્યારે જુઓ કે પાર્વતું કુમારે એક વાર પિતાને મિત્ર રાજા પરના મ્લેચ્છ રાજાના હલ્લાને ટાળવા યુદ્ધમાં જતાં રોકી પોતે ગયા પણ વિના લડાઈએ મ્લેચ્છ રાજાને વશ કરી આવ્યા. કેવો સરસ હદ્યનો મહા કોમળભાવ અને વિશ્વ મૈત્રી ? શક્ય સમારંભ અટકાવવાનો પ્રભુનો કેટલો સુંદર વિવેક ? ત્યારે ત્યાં એ મિત્ર રાજાએ પાર્વતું કુમારને પોતાની પુત્રી પ્રભાવતી કન્યાને પરણવા માટે ખૂબ આગ્રહ કર્યો પણ પિતાએ જે કાર્ય માટે મોકલ્યા છે તે સિવાય બીજી વાત નહિ એમ કરી ના પાડી એમ જ પાછા આવ્યા. કેવો મહાન પિતૃવિનય ? કેવું મહાન મર્યાદાપાલન ? ભોગવૃત્તિ પર કેવો મહાન કાબુ ?

રાજ્યાવસ્થામાં પણ અનુપમ સમૃદ્ધિ હોવા છતાં પ્રભુ ઉદાસીન, અંતરથી ન્યારા અને કમલપત્ર જેવા નિર્વેપ હોય છે. ભોગવિલિ કર્મ બાકીનું તથા તદ્ભબ મોકશનું જાણવા છતાં લગ્નનો આગ્રહ કરતા મિત્રોને દાખીને અને માતાજીની વિનય પૂર્વક કહે છે કે,

“સંસારની વૃદ્ધિ કરનારા પાણીગ્રહણમાં આપનો આટલો બધો આગ્રહ શા માટે ?” કેવો સુંદર આત્મજાગ્રત્તિ ? કેવો સરસ અવસરોચ્છિત સત્યતત્ત્વપ્રકાશ ? પોતાના પણ લગ્નને નિષ્પાપ કે કર્તવ્ય મનાવવાની બેલદ્ધા નહિ ?

## ● સાધુપણા ગુણો ●

પરમાત્મા બનવા પૂર્વે જ્યારે ગૃહસ્થપણામાંય આવા આવા તો અપરંપાર ગુણો એમનામાં હોય છે, ત્યારે સાધુપણામાં તો ગુણોનું પૂછવું જ શું ? અનુપમ કોટિનો સર્વ ત્યાગ, વિના સહાયે કઠોર સંયમ સાધના, ધોર અભિગ્રહ-પ્રતિજ્ઞાઓ, અતિ ઉત્ત્ર તપસ્યા, સહર્ષ ઉપસર્ગ સહન, ઉપસર્ગ પરિસહોની ફોજ આવ્યે પણ અંગેલ સમતા-સમારવિમાં સ્થિરતા, પોતાની સુકોમલ કાયા પર કારમો કેર ? દેવતાઈ ધોર ઉપદ્રવોમાં પણ ધરણી ધ્રૂજતી હોય છતાં પ્રભુનું હૃદય મેરુવત્ત નિષ્પક્તપ ? ધરતી ધ્રૂજે એ દેવતાનો જીલમ કેટલો ? કલ્યાનમાં તો લાવો. એમાં અપૂર્વ ધૈર્યથી સહર્ષ સહવાનું એ અતિ સુકોમળ કાયામાં પણ કેવી જબરજસ્ત કોટિની સહન જ કર્યે જવાની વૃત્તિ ? શ્રી મહાવીર પ્રભુના કાનમાં ગોવાળીઓએ ખીલા ઠોક્યા ! શા માટે ભાઈ પ્રભુએ ઠોકાવવા દીધા ? પ્રભુ તો બાલપણાથી અરે જન્મતાં વેંત એવા બળવાન હતા કે એમને માત્ર પોતાના પગના અંગુઠાથી મેરુને ચલાયમાન કર્યો હતો તે અહીં ખીલા ઠોકવા આવતા ગોવાળીયાની કાનપદ્ધી જાલે તો શું ગોવાળીઓ રાડેરાડ પાડીને ભાગી ન જાય ? પણ કેમ પોતાનો બચાવ નહિ ? કહો કે આત્માની મહાઆંતરદાસિ જગત હતી ? કઠીન કર્મના નાશ, નિજની કાયા પર કારમા કેર સહીને કરવા હતા, તત્વનો જ્ઞાનનો કેવો સુંદર અમલ ? આમાં ક્યાંય કોથનું નામ-નિશાન નહિ ‘હું તીર્થકર, હું મહાબળીયો,’ એવું લેશમાત્ર પણ અભિમાન મનમાં ય નહિ ! કેવી અનુપમ ક્ષમા ? અનુપમ નમ્રતા ? એવી જ પ્રભુમાં હતી અજોડ સરલતા, અજોડ નિસ્પૂહતા, ચારિત્રમાં કષ્ટ અને ઉપસર્ગો સામે સહાય માટે સેવક થઈ રહેવા ઈન્દ્ર માગણી કરે, છતાં પ્રભુજી ઘસીને ના પાડી અને એકાંતે સહવાનું ! એ કેટલો ઊંચો સહન વહોરવાનો અને સહિષ્ણુતાનો આદર્શ. પરમાત્માની પૂર્વ ભૂમિકામાંય જો આટલા ઉચ્ચ ગુણો હોય તો આપણાને પ્રેરણા એવી જ મળે ને ? મારા પ્રભુએ કેટકેટલું સંશુદ્ધ હતું, ત્યારે ભગવાન થયા હતા ! તો પછી મારે શું નહિ સહવાનું ? પ્રભુ તો સશક્ત હતા અને ઈન્દ્રાદિ સેવકોવાળા હતા છતાં બળ બહાર ન વાપર્યું. પણ સ્વર્કર્મ કચરવામાં વાપર્યું તો પછી મારે પણ એજ કર્તવ્ય હોય આવી પ્રેરણા ક્યાં મળે ? પરમાત્માને આવા ગુણ-સંપન્ન વિચારવામાં મળે. પણ પ્રભુને સર્જનહાર કલ્યવાથી ન મળે.

પ્રભુના સંયમગુણો તો વળી અતિશય ઊંચા હતા. ઈર્યાસભિતિ વગેરે પાંચ સભિતિ અને મન-વચન-કાયાની સૂક્ષ્મમાં સૂક્ષ્મ કોટિની ગુપ્તિ, એમાં તથા નવ બ્રહ્મચર્યની વાડ અને દશવિધ યત્નિર્ધર્મ પાલનમાં પ્રભુ પૂરે પૂરા સાવધાન હતા.

વર્ષોના સંયમમાં પણ એક સેકંડ વાર હુદ્ધિન કે હુર્વિચાર નહિ ! કે શૂન્ય મગજ અથવા સાવધ વિકલ્પ સરખો નહિ ! તો વાણી અને કાયાના સંયમનું તો પૂછવું જ શું ? કોઈ જ રસ-ત્રદ્વિ-સાતાના ગારવ કે માયા-નિદાન-મિથ્યાવના શલ્યનું નામ નિશાન નહિ ! આહાર-વિષય-પરિગ્રહ-નિદ્રાદિ સંજ્ઞાઓની કોઈ પરવશતા નહિ. એવા એ પ્રભુ પૃથ્વી પર અપ્રતિબદ્ધપણે વિહાર કરતા હતા. એમને કોઈ દ્વય-ક્ષેત્ર-કાળ-ભાવનો ભય નહિ, કે રોકાણ નહિ ! માટે જ,

પ્રભુ વાયુ જેવા અપ્રતિબદ્ધવિહારી હતા. તેમજ ગગનની માફક નિરાલંબ, આધાર વિના રહેનારા હતા, અર્થાત્ ધોર ઉપદ્રવમાં પણ એમને કોઈની સહાય, કોઈના આધારની અપેક્ષા નહોતી, કેમકે કાયાનો બચાવ-રક્ષણ જોઈતું જ નહોતું. પ્રભુ સાધનમાં ભારંડપક્ષીની માફક અપ્રમત હતા; સંયમ અને આત્માની જગૃતિમાં સદા સાવધાન હતા. પ્રભુનું હૃદય પવિત્રતાથી શંખ જેવું ઉજજવલ, વિશ્વમૈત્રીથી પરમ પ્રેમાળ અને શાંતરસથી છલોછલ ભરેલું હતું. પ્રભુ પૃથ્વી કે વૃક્ષની જેમ સર્વસહ હતા; કમળપત્રની જેમ કર્મ કીચડમાંથી જન્મવા છતાં અને ભોગજળથી ઉછરવા છતાં હવે એ બંનેથી તહન અલગ અને નિર્લેપ હતા. મહાતપ, મહાસત્ત્વ, મહાબ્રહ્મચર્ય અને મહાત્યાગના તેજસ્વી પ્રભુ અજિનમાં પડેલા શુદ્ધ સો ટચના સુવાર્ણની જેમ ચણકતા હતા. ખડ્યો પક્ષીના એક શ્રુંગની જેમ પ્રભુ એકાકી, અદ્વિતીય હતા. સાગરથી પણ અધિક ગંભીર, પવનથીય અધિક હલકા ફૂલ, ચંદ્રથી પણ અતિશય શીતલ, સૂર્ય કરતાંય તેજસ્વી, મેરુથીય વધુ અચલ, માખણ કરતાં પણ અધિક કોમળ,...વગેરે વગેરે શ્રેષ્ઠ ઉપમાઓ કરતાંય અતિશય ઊંચા ગુણોને ધરનારા પ્રભુ હતા.

આવા સર્વોચ્ચ ગુણો સહિત ઉચ્ચ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપની આરાધના કરી પ્રભુએ મોહનીય-જ્ઞાનાવરણીયાદિ ધાતીકર્મનો સર્વર્થા નાશ કર્યો એટલે પ્રભુ વીતરાગ-સર્વજ્ઞ-અરિહંત-તીર્થકર બન્યા. વીતરાગ એટલે રાગ-દ્રેષ-કામ-ભય-હાર્યશોકાદિ દોષના લેશમાત્રથી પણ અસ્પૃષ્ટ; સર્વજ્ઞ-સર્વદર્શી એટલે અનંતજ્ઞાન-દર્શનવાળા, અરિહંત એટલે આઠ પ્રતિહાર્ય-સમવસરણ-સુવર્ણ-કન્દળ વગેરે દ્વારા દેવોનેય પૂજય, અને તીર્થકર એટલે ધર્મશાસન અને ધર્મસંદ્ધ સ્થાપનારા પ્રભુ બન્યા. હવે ખરેખર પરમાત્મા બન્યા. રાગ-દ્રેષનો જય કરી. જિન, અજ્ઞાન સાગર તરી તીર્ણ, અને કેવળજ્ઞાન પામી બુદ્ધ બન્યા. ધાતી કર્મથી મુક્ત (જીવન મુક્ત) બન્યા. હવે સર્વર્થા કર્મરહિત થઈ વિદેહમુક્ત થશે. આવા પરમાત્મા પાછા ભવ્ય જીવોને એવા બનાવનારા છે; એટલે કે પ્રભુ જાપક-તારક-બોધક અને મોચક છે. સદેહાવસ્થામાં પણ પ્રભુને વિદેહમુક્તિના ગુણોનો વ્યવહાર કરી શકાય એવું જવલંત

પરમાત્મ સ્વરૂપ એ ધારણ કરનારા હોય છે. તેથી જ મહા કવિઓ પરમાત્માના ગુણો સત્તવનાં પ્રભુને નિરંજન (કર્મલેપ રહિત), નિરાકાર, (રૂપ રહિત), અક્ષર, અજર, અમર, અવ્યાબાધ, અવિનાશી, શુદ્ધાત્મા, ચિદ્ગધન, આનંદધન, પરમબ્રહ્મ, વગેરે કહે છે. બાકી સદેહાવસ્થામાંય હવે પરમાત્મા અજ, અકલ, અચિન્ય, અવિકાર, નિર્મભ, નિર્વિકટ્ય, નિરીહ, નિર્દ્ઘષ, તત્ત્વમૂર્તિ, યોગમૂર્તિ, ધ્યાનમૂર્તિ, શુણમૂર્તિ, દેવાધિદેવ, પરમેશ્વર, પરમયોગી, પરમાદિત્ય વગેરે તો છે જ. ઉપરાંત જગતની પ્રત્યે પ્રભુ સર્વવિઘ્નહર, વિશેશ્વર, વિશ્વહિત, સર્વદાતા, સર્વપ્રકાશક, પરમેશ્વર, જગનાથ, જગતાતા, પરપ્રાણ, પરમધન, પરમશંકર, અનંત ઉપકારી વગેરે સ્વરૂપવાળા છે.

આ દરેક સ્વરૂપ ગુણનિષ્પત્તન છે, એટલે પરમાત્મા એટલા બધા ગુણોથી સુઅલંકૃત છે. એવા પૂર્વ ગુણો અને વર્તમાન ગુણોના મહાનિધિ સમા પરમાત્માની પ્રાપ્તિ થવી, પરમાત્માની ઓળખ થવી, અને એવા ખરેખરા પરમાત્મા ઉપર અવિહડ શ્રદ્ધા પ્રીતિ થવી, એ જીવનમાં એક પરમ ભાગ્યોદયનો પ્રસંગ છે, માનવજીવનની સાચી સફળતાનું એક સાધન છે, ભવોભવના ભ્રમણ અટકાવવાનો અમોદ ઉપાય છે. આવા જ ગુણભર્યા પરમાત્માના આલંબનથી આપણી દાસ્તિ નિર્મળ બને છે; આપણને તત્ત્વ-અત્તત્વનો વિવેક આવે છે; ઊડા તત્ત્વનો બોધ મળે છે; પવિત્ર જીવનના કંબિક સુયોગ્ય માર્ગ દાસ્તિપથમાં ઉત્તરે છે, એજ પરમાત્માના આદર્શ ગુણોના કારણે જ આપણા આત્માને દોષ મુક્ત અને ગુણસંપત્તન બનાવવાની પ્રેરણા મળીને એની મુખ્ય તમના રહે છે; તેમજ એમના આધારે જ આપણામાં દોષનાશ અને ગુણ-ઉદ્ય કરવાનો ભગીરથ પુરુષાર્થ જાગે છે; અને એ પ્રભુના જ આલંબને ગુણના માર્ગમાંથી જરા પણ ચસક્યા વગર ઠેઠ ગુણોની પરાકાઢા સુધી પહોંચવાનું બને છે. આ થથો પરમાત્માના ગુણોનો અલ્ય વિચાર. હવે એમની શક્તિ વિચારીએ.

### ● પરમાત્મ-શક્તિ ●

શ્રી વીતરાગ સર્વજ્ઞ તીર્થકર પરમાત્માની અનાદિસિદ્ધ મહાન શક્તિ બીજા જીવો કરતાં ચઢીયાતી જાત્યરન જેવી વિશિષ્ટ યોગ્યતાની છે, એને વિશિષ્ટ તથાભવ્યત્વ કહે છે. એ એકલા તીર્થકરના જ જીવમાં હોય છે. એથી જ એમના સિવાય બીજાને જો કે મોક્ષમાર્ગની અને મોક્ષની સુલભતા થઈ શકે છે. પરંતુ તીર્થકર બની તેવા વિશિષ્ટ જગદુક્ષારક થવાની સુલભતા થઈ શકતી નથી. આનો અર્થ એ નથી કે ‘તો પછી આપણે એવા પરમાત્મા એટલે કે જગદુક્ષારક બનવાની આશા મૂકી દેવાની’ કેમકે એવા તીર્થકર પરમાત્મા બની શકે એવા પણ અનંત ભુવનભાનું એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ” (ભાગ-૧૮)

કાળ માટેના અનંતા આત્માઓ હજ સંસારમાં છે. એમાંના આપણે પણ એક કાન હોઈએ ? એમ તો કહું કે ભવ્ય હોય તેનો જ મોક્ષ થાય; તેથી શું આપણે મોક્ષની આશા મૂકી દઈએ ? ના, આપણે પણ કાં ભવ્ય નહિ, એમ માની મોક્ષમાર્ગની આરાધનામાં જ ઉજમાળ રહેવાનું. એવી રીતે અહીં પણ અરિહંત બનાવનારી પૂર્વ કહેલી વીસ સ્થાનકની સાધનામાં રક્ત રહેવાનું. જ્યારે ભરત અને ઐરવત ક્ષેત્રોમાં દસ-દસ કોટાકોટિ સાગરોપમ પ્રમાણ ઉત્પસર્પણી-અવસર્પણીના ગાળામાં માત્ર ચોવીસ ચોવીસ તીર્થકર ભગવાન થાય છે, ત્યારે તેટલા જ ગાળામાં મહાવિદેહ ક્ષેત્રોમાં અસંખ્યાતા તીર્થકર દેવો ધર્મશાસનની જ્યોત પ્રસરાવી-પ્રસરાવી મોક્ષ પામે છે. તો આવી અસંખ્ય સંખ્યામાં જગત-દ્યાળું થઈ જગતના તારક તરીકે બનવાનો આપણોય નંબર કેમ ન લાગે ? લાગવો જ જોઈએ એ વિશ્વાસે વીસ સ્થાનકાદિની આરાધનામાં ઓતપ્રોત થવાનું છે. માત્ર એમાં બીજ કોઈ સમવસરણાદિના માન મેળવવાની આશંસા નથી રાખવાની. આશંસા માત્ર એક કર્મવશ દુઃખી જગતને ધર્મ પમાડવાની જ રાખવાની, પછી એ વીસ સ્થાનકની આરાધનામાં કદાચ અમુક અપેક્ષાએ તેવું બળ નહિ આવે અને કદાચ તીર્થકર નહિ બનીયે, તો પણ મોક્ષપદ તો નક્કી મળવાનું છે. ફીઝી એટલું ખાસ ધ્યાનમાં રહે કે આમાં માત્ર જગતના જીવોની કારમી દુઃખમય દશા પર અનુપમ ભાવદ્યા ઉભરાવવાની છે અને અનું કલ્યાણ કરવાની તમના કેળવવાની છે પણ ઈંગ્રંદ્ય, જગત-પૂજ્ય, ગણધરાદિ સેવિત વગેરે બનવાની લેશમાત્ર કામના નથી કરવાની.

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદધિ”

વર્ષ-૪, અંક-૨૫, તા. ૧૩-૩-૧૯૫૬



### શ્રી અરિહંત પરમાત્માની ઓળખાણ

**જ્ઞાનશક્તિ સ્વયંબુદ્ધતા :-** તીર્થકર પરમાત્માના આત્માની બીજ શક્તિઓમાં એ માતાના ગર્ભમાં આવે ત્યારથી એમનામાં અવધિજ્ઞાન અને સ્વયંબુદ્ધતાનો ભાવ હોય છે. તેમજ જન્મયા પછી કોઈ ગુરુઉપદેશનું શ્રવણ, કે શાસ્ત્ર-અધ્યયન નહિ, છતાં અવસરે સ્વયં ચારિત્ર લેવાની વિધિ કરીને ઉત્કૃષ્ટ ચારિત્રપાલન અને ધ્યાન-યોગ આરાધે છે. પછી ભલે પૂર્વ પણ ત્રીજા ભવમાં તીર્થકર નામકર્મ ઉપાર્જતી વખતે ચારિત્રનો અભ્યાસ ન ય કર્યો હોય. આ જીવનમાં વગર ગુરુ ઉપદેશેય ચારિત્ર લેવાના એવા પ્રત્યેકબુદ્ધ તરીકે ઓળખાતા આત્માઓ હોય છે; પણ એમને પૂર્વ જીવનમાં ચારિત્રનો અભ્યાસ હોય છે, અને તેનું અહીં સ્મરણ થાય છે. ત્યારે ૮૮ ભુવનભાનું એન્સાઈક્લોપીડિયા-શ્રી અરિહંત પરમાત્માની ઓળખાણ (ભાગ-૧૮)

તीર्थकर બનનારની વિશિષ્ટ શક્તિએ વગર અત્યાસે પણ ચારિત્રવિધિનું જ્ઞાન અને પાલન હોય છે. તે પાલન પણ અગાધ કડકતાવાળું હોય છે. જેનું કાઈક વર્ણન પૂર્વે ‘જીવન’ પ્રકરણમાં કર્યું છે. ત્યારે કહો કે પરમાત્મા બનવા પૂર્વે આવી અગાધ અવધિજ્ઞાન અને સ્વયંબુદ્ધતા સાથેની ઉત્કૃષ્ટ ચારિત્ર પાલનની શક્તિઓ વિનાનાને પરમાત્મા કેમ મનાય ? અને માનવાથી શો લાભ ?

### જન્મથી અનંતબળ :-

વળી પરમાત્મામાં જન્મથી અનંતબળ હોય છે. જેના દિશાન્તરપે, લાખ જોજનના સદા સ્થિર શૈલેશ મેરુને મહાવીર પ્રભુએ ઈન્દ્રની શંકા નિવારવાર્થે અંગુઠો ચાંપવા માત્રથી ડેલાયો ! પણ પ્રભુ આવા અનંત બળનો ઉપયોગ પોતાના આંતરશત્રુઓના નાશમાં કરે છે; ગમે તેવા ઉપર્સર્જમાંય ઉચ્ચ ક્ષમાસમતાદિ સત્ત્વ અખંડિત રાખવામાં કરે છે; પણ નહિ કે ઈતરોએ કલ્પેલા પરમાત્માની જેમ દુષ્ટ માણસો કે રાક્ષસોનો સંહાર કરવામાં.

### માત્ર ત્રણ પદથી અન્યમાં શ્રુતસાગર પ્રગટાવવાની શક્તિ :-

વળી પરમાત્માની એક અજબ શક્તિ ગણધર મહારાજને માત્ર ત્રિપદી (‘ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, સ્થિર રહે છે’ એ ત્રણ પદ) આપવાની એવી છે કે જેથી ગણધર દેવોને ત્યાં ને ત્યાં શ્રુતના સાગર, શ્રુતજ્ઞાનના નિધાન પ્રગટ થાય છે; અને તેથી સમસ્ત દ્વાદશાંગીની નવી રચના કરે છે; અને તે દ્વાદશાંગી અકસ્રે અક્ષર પ્રભુના અનંતજ્ઞાનથી પ્રમાણિત કરાય છે; સર્વથા સત્ત્વ ઠરાવાય છે ! એના જ્ઞાન પર ગણધર ભગવાન કેવળજ્ઞાનીના જેવી પૂર્વભવો સુદ્ધાં કહેનારી દેશના આપે છે. આને શ્રુતકેવળીપણું કહેવાય છે. એ થવામાં મૂળ શક્તિ પ્રભુની.

**૩૪ અતિશય, ૩૫ વાણીગુણ :-** બાકી શ્રી અરિહંત પરમાત્માની જ ખાસ મહાન શક્તિઓમાં ચોત્રીસ અતિશયો અને વાણીના પાંત્રીસ અતિશયો આવે છે. ચોત્રીસ અતિશયોમાં ચાર મૂળથી હોય છે, ઓગણીસ દેવના કરેલા થાય છે, અને અગીયાર રાગદ્રેષાદિક્ષય થઈ કેવળજ્ઞાન પ્રગટે તરત જ જન્મે છે.

અહીં આટલું ખાસ ધ્યાનમાં રહે કે પ્રભુની પૂર્વના ગ્રીજા ભવે જે પ્રખર વીસ-સ્થાનકની સાધના છે, અખિલ વિશને ઉદ્ધરવા સુધીની જે અનંત કરુણા છે, તથા જે સમ્યગ્દર્શનની જીવલંત નિર્મળતા છે, એના પ્રતાપે અનુપમ તીર્થકર નામકર્મ સાથે અતિ ઉત્તમ યશ-આદેયતા-સૌભાગ્ય-શાતા-રૂપરસાદિ-શરીર વગેરે યોગ્ય પ્રકૃષ્ટ પુણ્ય કર્મ લઈને આવ્યા પછી એના પ્રભાવથી ‘અતિશયો’ વગેરે વિશિષ્ટ શક્તિઓ પ્રાપ્ત થવી યુક્તિ યુક્ત છે. કર્મ સિદ્ધાન્તની પૂર્ણ શક્તા ન કરનારાઓ આમાં શું કે બીજે શું, કુવિકલ્પો કરે એનો કોઈ અર્થ નથી.

શ્રી તીર્થકર દેવના ઉચ્ચ અતિશયો આ પ્રમાણો છે.

### ● ૪. મૂળ અતિશય. ●

(૧) અદ્ભુત દેહ, (૨) સુગંધિ શાસ, (૩) રુધિર સફેદ અને માંસ સારા વર્ણાદિવાળું, (૪) અદેશ્ય આહાર-નિહાર.

### ● ૧૮ દેવકૃત અતિશય. ●

(૧) દાઢી-મૂદ્ધ-માથાના વાળ ન વધવા, (૨) જઘન્યથી કોડ દેવ સાથે, (૩) ચાલતાં સ્વર્ણ કમળ, (૪) કાંટા ઊંધા થાય, (૫) વૃક્ષ-નમન, (૬) પંખી પ્રદક્ષિણા, (૭) અનુકૂળ પવન, (૮) ઋતુની અનુકૂળતા, (૯) ધર્મચક, (૧૦) રત્નમય ધજ, (૧૧) સમવસરણ : ત ગઠ, (૧૨) હુન્કુભિનાદ, (૧૩) અશોક વૃક્ષ, (૧૪) ત્રણ છત્ર, (૧૫) જલવૃષ્ટિ, (૧૬) પુષ્પ વૃષ્ટિ, (૧૭) રત્ન સિંહાસન, (૧૮) પ્રભુ ચતુર્મુખ, (૧૯) ચામર.

### ● ૧૯ કર્મક્ષયકૃત અતિશય. ●

(૧) સવાસો જોજનમાં લોકમાં રોગ નહિ, (૨) પરસ્પર-વૈર વિરોધ નહિ, (૩) ઉદ્ર વગેરેના ઉપદ્રવ નહિ, (૪) મારી (ખેગ, કોલેરા) નહિ, (૫) અતિવૃષ્ટિ (હેલી) નહિ, (૬) અવૃષ્ટિ (વર્ષનો અભાવ) નહિ, (૭) દુષ્કાળ (ભિક્ષાનો અભાવ) નહિ, (૮) આંતરબળવો કે પર રાજાનું આકમણ નહિ, (૯) પ્રભુના મસ્તક પાછળ ભામંડલ, (૧૦) જોજનમાં સમવસરણમાં કોટાકોટિ દેવ-મનુષ્ય-તિર્યચ સમાય, (૧૧) પ્રભુની વાણી જોજન સુધી સંભળાય, ને તે તિર્યચ-મનુષ્ય-દેવતાની ભાષામાં પરિણામે. તે પાંત્રીસ અતિશયવાળી હોય.

**અતિશયોનું કાઈક વિવરણ :-** દેવાપિદેવ શ્રી અરિહંત પ્રભુનો આત્મા કેવી કેવી અલૌકિક શક્તિઓ ધરાવે છે, તે આ ચોત્રીસ અતિશયોમાંથી જુઓ.

**૪. મૂળ અતિશય :-** પ્રભુ માતાના ગર્ભમાં આવતાં જ, (૧) પ્રભુનો દેહ અદ્ભુત તૈયાર થાય છે. સર્વોત્તમદેવ-અનુતરવાસી દેવના દેહ કરતાં અતિશય ચરીયાતા આહારકલબ્ધિના સુંદર દેહથી પણ અતિશય રૂપાળો જે ગણધરદેવનો દેહ, તેના કરતાંય અનંતગુણ લાવાય સૌન્દર્યવાળું અને રૂપાળું તીર્થકર પરમાત્માનું શરીર હોય છે. માતાના ગર્ભના અશુદ્ધિ પુદ્ગળોમાંથી આવા દેહનું નિર્માણ થવું એ વિશિષ્ટ લોકોત્તર પુણ્ય-શક્તિ છે. દેહના પુદ્ગળોની ગંધ પણ મનોહર હોય છે. એ દેહમાં જીવનભર કદી રોગ થતા નથી; અરે ! પરસેવો સરખો પણ થતો

નથી, કે મેલ જામતો નથી, ત્યારે શરીરના બલનું તો વળી પૂછવું જ શું ? તાકાત તો ગજબ કોટિની હોય છે. (૨) એવા એ દેહમાં શાસોશાસ કમળ જેવો સુગંધિદાર હોય છે; (૩) લોહી ગાયના નિર્મળ દૂધ જેવું સફેદ, દર્શનીય અને દુર્ગંધ વિનાનું હોય છે; તથા માંસાદિ ધાતુઓ જરાય બિભત્તસ નહિ, જરાય દુર્ગંધવાળી નહિ, પણ ઊલટી રમણીય, દર્શનીય, ને સારા વણાદિવાળી હોય છે. (૪) પ્રભુના દેહથી થતી આહાર લેવાની કિયા કે મળમૂત્ર વિસર્જનની કિયા અદૃશ્ય રહે છે, જેથી બીજાઓ ચર્મચક્ષુથી એ જોઈ શકતા નથી. પરમાત્માના મહાપુણ્ય સિવાય આ બીજામાં ક્યાંથી સંભવે ?

### • ૧૮ દેવકૃત અતિશય •

(૧) પ્રભુ ચારિત્ર લે તે વખતે પંચમુષ્ઠિથી દાઢી, મૂછ અને મસ્તકના કેશનો લોય કરી નાખે છે, પછી ઠેઠ નિર્વાણ સુધી ત્યાં વાળ વધતા નથી; નખ પણ વધતા નથી. દીક્ષાસમય જેવી સ્થિતિ રહે છે. (૨) તે પછી પ્રભુ કેવળજ્ઞાન પામે એટલે ઓછામાં ઓછા એક કોડ ભવનપતિ વગેરે દેવતાઓ પ્રભુની સેવામાં સાથે જ રહે છે. દેવતાઈ મહાસુખને પણ દુઃખના પાતાલ કૂવા સમજી આત્મકલ્યાણ ગંભીર દેવતાઓ આત્મકલ્યાણની મૂર્તિ સમાં શ્રી વીતરાગ અરિહંત નાથને સેવે એમાં શી નવાઈ ? (૩) હવે પ્રભુને ચાલતાં પૃથ્વી પર પગ અડાડવાનો હોતો નથી; કેમકે ચાલતી વખતે પગ મૂકવાના સ્થાન પર નીચે સુવર્ણ કમલ રચાઈ ગયા હોય છે. તેમાંથી બે પર પગ પડેલા દેખાય છે, બીજા સાત કમળ હોય છે. એમાં આગળ પહેલાં માંડતા ઠેઠ પાછળમાંથી કમળ ઓદ્ધું થાય છે, અને આગળ કમળ ઉપસ્થિત થઈ જાય છે. સુવર્ણના આ કમળ પાછાં માખણના પિંડ જેવા અતિ કોમળ, મહામુલાયમ હોય છે. (૪-૬) પ્રભુ ચાલે ત્યાં કાંટા ચત્તા હોય તે ઊંઘા થઈ જાય છે; અર્થાત્ અણીયો જમીન તરફ નીચી વળી જાય છે. વળી આજુબાજુના વૃક્ષ પ્રભુને નમી જાણે નમસ્કાર કરતા દેખાય છે. ત્યારે પંખીઓ વળી પ્રભુને પ્રદક્ષિણા દે છે. (૭-૮) પરમાત્મા વિચરે ત્યાં પવનના ઉપદ્રવ મરીને વાયુની લહેરી અનુકૂળ વહેતી થઈ જાય છે; અને વસંત વગેરે છ એ ઋતુઓને યોગ્ય સારાં પત્ર-કૂલ-ફળ વગેરે પદાર્થો ખીલી ઉઠે છે. (૮-૧૩) પરમાત્મા ચાલે ત્યાંય ધર્મચક્ષાદિ પાંચ વિશિષ્ટ વસ્તુઓ સાથે જ અદ્ધર આકાશમાં ચાલે છે. એમાં ધર્મચક બહુ તેજસ્વી હોય છે, આરાથી શોભતું હોય છે, અને એ હરણનું જોડલું સેવતું હોય છે. બીજો રત્નમધ્યજ પણ ઊંચા કંચનમધ્ય દંડ ઉપર રત્નની અનેક બીજા નાની ધજાઓથી દીપી રહ્યો હોય છે. વળી પાદપીઠ (બેઠા પગ મૂકવાનો બાજુ)

સહિત સિંહાસન પણ અદ્ધર સાથે જ ચાલે છે. તેમજ પ્રભુના માથે એકેકથી મોટા એવા દેદીયમાન ત્રણ છત્ર મોતીઓના ઝુમખાથી પરિવરેલા સાથે જ ચાલે છે. વળી પ્રભુને ચાલતાં બે બાજુ યક્ષના હાથમાં ચામર વીજાય છે. (૧૪) પ્રભુ જ્યાં સ્થિર થાય ત્યાં જોજન જેટલી ભૂમિ પર ધૂળ ન ઉંચે એ માટે સુગંધિત જલનો વરસાદ થઈ જાય છે. (૧૫) પ્રભુને દેશના દેવા માટે એક જોજન પ્રમાણ ભૂમિ પર ભવનપતિ જ્યોતિષ અને વૈમાનિક દેવો અનુકૂમે ચાંદીનો, સોનાનો, ને રત્નનો એમ ત્રણ કિલ્લા રત્નની કાંગરીવાળા એકેકની ઉપર રહે છે. (૧૬) એના પર પુષ્પની વૃષ્ટિ થાય છે. એ પુષ્પોના ડીટીયા નીચા હોય છે અને પાંખડી ઊંચી હોય છે. ત્યાં ચાલતા-બેસતા તિર્યચ મનુષ્યોથી અને પરમાત્માના અતિશયના પ્રભાવે કિલામણ નથી થતી; પણ ઊલટું વિકસ્વરતા અનુભવે છે. (૧૭) સમવસરણની મધ્યમાં અશોકવૃક્ષ રચાય છે તે આખા સમવસરણમાં આવેલા જીવોને છાયા આપે છે. એની સુગંધિ વળી એવી અદ્ભુત હોય છે કે ભમરા દોડી આવી એની આસપાસ ગુજજતા રહે છે. (૧૮) પરમાત્માને બેસવા માટે જાડ નીચે પૂર્વ દિશા સન્નુખ મુખ્ય રત્ન સિંહાસન સ્થપાય છે; અને બાકીની ત્રણ દિશામાં પણ બચાબર પ્રભુના જેવી આકૃતિવાળા પ્રતિબિંબ સિંહાસન પર સ્થપાય છે; જેથી ચારે દિશામાં સૌને એમ લાગે કે પ્રભુ અમારી સામે છે. આમ પ્રભુની ચતુર્મુખતા થાય છે. (૧૯) ત્યાં દેવતા ઊંચે દુન્દુમિ બેરી વગાડે છે જેથી ચારે બાજુના પ્રદેશને આ ધર્મનરેસર પરમાત્મા પધાર્યાની બખર પડે છે, અને આવીને દર્શન-વંદન-વાણી-શ્રવણનો લાભ લઈ સમ્યક્ત્વાદિ ધર્મ પામે છે.

તીર્થકરપણું પ્રાપ્ત કરવા યોગ્ય પુષ્પ ઉપાર્જવામાં કેવીક જોરદાર અરિહંતભક્તિ આદિ સાધના કરી હોય કે જેના અલોકિક પ્રભાવે આવું બધું અચ્યિત્ય-અકલ્ય બને ! એ મનમાં લાવવા જેવું છે. ધોર દુઃ્ખયોના ધોર નીચા ફળ મળે તો અતિ ઊંચા સુકૂતોના આવા ઉચ્ચ ફળ કેમ ન નીપજે ? ઉપર કહેલા ઓગણીસ અતિશયો ખાસ દેવો પરમાત્મા ઉપરની અનુપમ ભક્તિથી પ્રેરાઈને રચે છે. એ વખતે જનતામાં ડેવુંય મહાન આકર્ષણ થતું હશે ! એ તો નજરે જોનાર કે વિશિષ્ટજ્ઞાની અનુભવી શકે. એના યોગે લાખો કરોડો બાળ જીવોને પરમાત્મા તરફ બેંચાણ થાય છે; એમાં કેટલાકને તો આ સમૃદ્ધિ-ભપકો જોઈને જ મિથ્યાત્વાદિ દોષો ભાગી જાય છે; ત્યારે બીજાઓને પ્રભુની વાણી સાંભળીને એવું બને છે. ભરત ચક્રવર્તીના પુત્ર મરીયિને ઋષભદેવપ્રભુની સમવસરણાદિ ઋષિ જોતાં વૈરાગ્ય થઈ ગયો હતો અને તરતજ ચક્રવર્તીનું ઘર મૂકી ચારિત્ર લીધું હતું.

**કર્મકષય કૃત ૧૧ અતિશય :-** પરમાત્મા આ જીવનમાં પણ ઉચ્ચ સાધના કરીને જ્યારે શુક્લધ્યાનના દાવાનળમાં અનંતા ધાતીકર્મના દળીયાને જડમૂળમાંથી બાળીને ભસ્મીભૂત કરે છે ત્યારે વીતરાગ-સર્વજ્ઞતાની જેમ તીર્થકર નામકર્મનો ઉદ્ય પ્રગટે છે. બીજા પણ યશ-આદ્ય વગેરેના પુણ્યના ઉચ્ચ દળીયાં ઉદ્યમાં આવે છે. આ બધાના પ્રતાપે સહજજ્ઞાવે આ અગીયાર વિશેષતાઓ પ્રગટે છે :

(૧-૮) શ્રી તીર્થકર પ્રલુબ વિચરતા હોય ત્યાં આસપાસના સવાસો જોજનમાં આ આઈ પ્રકારના ઉપદ્રવો પૂર્વે થયા હોય તો શાંત થઈ જાય છે, અને નવા થતા નથી : (૧) તાવ વગેરે રોગો; (૨) પૂર્વના ચાલી આવેલા, કે પરસ્પર જીતિના વૈર-વિરોધ; (૩) વિશેષ પ્રમાણમાં ઉદ્ર, ખડમાંડિ, તીડ વગેરે ઉપદ્રવો થાય છે તે; (૪) મારીમરકી, ખેગ, કોલેરા કે તેવા બીજા જીવલેણ ઉત્પાત; (૫) અતિવૃદ્ધિ=વરસાદની ડેલી; કે જેમાં મોટા નુકસાન થાય; (૬) અવૃદ્ધિ=તદ્દન વરસાદ જ નહિ કે અતિ અલ્ય વરસાદ જેથી લોક પાણી વિના અને ગરમીથી પીડાય; (૭) દુષ્કાળ=જેમાં ધાન્યની અછત થઈ જાય અને તિક્ષાય ન મળે; અને (૮) સ્વપર ચક્કભય=તે જ દેશના અમુક લોક કે લશકર બળવો ઉઠાવે તેનો ભય તે સ્વચ્છકભય. દુશ્મન રાજી લશકર લઈને ચડી આવે તેનો ભય તે પરચક્કભય. આ આઠેમાંથી એક પણ ઉપદ્રવ પ્રભુના આસપાસના ૧૨૫ યોજમાં હોતો નથી. વળી (૯) પ્રભુને અંતરમાં લોકાલોકનો પ્રકાશક કેવળજ્ઞાનરૂપી સૂર્ય પ્રગટવાની સાથે બહાર પ્રભુના મસ્તકની પાછળ જગમગતા કિરણોના જૂથવાળું એક ભામંડલ તેજનો પુંજ પ્રગટ થાય છે. તેથી સામેથી જોનારને પ્રભુના મુખની ચારેબાજુ દેદીઘ્રમાન અને અતિ મનોહર ગોળાકાર પ્રભુને દેખાય છે. (૧૦-૧૧) છેલ્લા બે અતિશય સમવસરણમાં કામ કરે છે. એમાં એક દર્શન-શ્રવણાર્થે ગમે તેટલા કરોડો દેવતા તથા મનુષ્ય-તર્તિયચોના મહેરામણ ઊભરાય છતાં એ બધા માત્ર એક જોજનના સમવસરણમાં પ્રભુના અચિંત્ય પ્રભાવે સુધે સમાઈ જાય છે, અને બીજો અતિશય એ, કે એ જુદી જુદી જીતના તર્તિય પ્રાણીઓ, માનવો અને દેવો પોત-પોતાની ભાષામાં સમજ જાય એ રીતે પ્રભુની વાણી તે તે ભાષામાં પરિણમી જાય છે. દા.ત. આકાશમાંથી પડતું વરસાદનું પાણી એક પ્રકારનું, પણ નીચે જુદી જુદી જીતની જમીન અને જુદા જુદા પ્રકારના બીજને તે તે રૂપે મળી જાય છે.

વાણીની આ એકજ વિશેષતા નથી; જિનની વાણીના પાંત્રીસ અતિશયો છે. તેને વિચારતાં પહેલાં એ જુઓ કે ઉપર કહેલા ઉછ અતિશયોમાં અને પૂર્વે કહેલ અદાર દુષ્કાળોમાં શાસ્ત્રમાં કયાંક મતાન્તર આવે છે. બીજી વસ્તુ એ છે કે

પૂર્વે જે બાર ગુણ અરિહંતના ગણાવ્યા છે, તેમાં આઈ પ્રાતિહાર્યના આઈ ગુણ છે. એ આઈમાંથી છ પ્રાતિહાર્ય દેવકૃત ૧૮ અતિશયોમાં, ને કર્મકષયકૃત, ૧૧ અતિશયમાં એક ‘ભામંડલ,’ એમ સાત ગણાવ્યા છે. એટલે બાકી ‘દિવ્યધ્વનિ’ નામનો પ્રાતિહાર્ય જુદો સમજવાનો છે. એમાં જેમ કોઈ કોકિલ કંઠ જેવું મધુરું ગાનારા સંગીતકારના સુરને વાજિત્રનો સુર વધુ શોભિતો કરે, તેમ દેવો પ્રલુબ ભક્તિથી પ્રેરાય મનોહર વાંસળીના દિવ્યધ્વનિથી પ્રલુબની માલકોશ રાગની દેશનાના અતિ મધુર સુરને વળી વધુ અલંકૃત કરે છે.

### ● જિનની વાણીના ઉચ્ચ અતિશય :- વાણી કેવી કેવી ●

1. સંસ્કારવતી, ૨. ઉદાત્, ૩. ઉપચાર પરીત, ૪. મેઘ ગંભીર,
૫. પ્રતિનાદ યુક્ત, ૬. દક્ષિણ, ૭. રાગયુક્ત, ૮. મહાર્થ, ૯. અવ્યાધાત,
૧૦. શિષ્ટ, ૧૧. અસંદેહકર, ૧૨. અન્યોતર, ૧૩. હૃદયંગમ, ૧૪. સાક્ષિ,
૧૫. ઉચિત, ૧૬. તત્ત્વનિષ્ઠ, ૧૭. અપ્રકીર્ણ પ્રસૂત, ૧૮. સ્વશ્રાધા-પરનિદા રહિત, ૧૯. અભિજાત્ય, ૨૦. સ્નિગ્ય મધુર, ૨૧. પ્રશસ્ય, ૨૨. અમર્મવેણિ,
૨૩. ઉદાર, ૨૪. ધર્મર્થ સંબદ્ધ, ૨૫. વિષર્યાસરહિત, ૨૬. વિભ્રમાદિ મુક્ત,
૨૭. આશર્વકારી, ૨૮. અદ્ભુત, ૨૯. અતિવિલંબિત નહિ, ૩૦. અતિવિચિત્ર,
૩૧. વિશેષ મેળવતી, ૩૨. સત્ત્વમુખ્યા, ૩૩. વર્ણપદાદિવિવિક્તા, ૩૪. વિચેદરહિત, ૩૫. બેદરહિત.

**અર્થ :** (૧) સંસ્કારવાળી એટલે કે સંસ્કૃત વગેરે લક્ષણવાળી. જેમ કાવ્યમાં શબ્દાલંકારો અને અર્થાલંકારો હોય છે, એમ પ્રભુની વાણીમાં શબ્દ અને અર્થના એવા તો અનેક સુંદર લક્ષણો અને અલંકારો હોય છે, કે એકલા એનાથીજ શ્રોતા દીર્ઘકાળ સુધી એક સરખી આતુરતા અને રસથી સાંભળવામાં લીન થઈ જાય. (૨) ઉદાત્ એટલે માંદા સુરવાળી નહિ, કે બોબડાતા અક્ષરવાળી નહિ, પણ દૂરવાળનેય બરાબર સંભળાય એવા ઊંચા સુરવાળી અને સ્પષ્ટ ઊંચા અક્ષરવાળી હોય છે. (૩) ઉપચારપરીત અર્થાત્ તોઢીની શિષ્ટાચાર બાબુ એવી ગામડીયા ભાષા નહિ પણ ઉદાર, શિષ્ટાચારી ને સંસ્કારી શહેરી બોલે તેવી ભાષા. એથી એ વિદ્ધાનોનેય ખૂબ ગમી જાય છે. (૪) મેઘાંભીર=પ્રભુની જોજન ગામદીની વાણી, ઉપર કદ્યું તેમ, માત્ર ઉદાત્ અર્થાત્ એકલી ઊંચા અવાજવાળી નહિ, પણ વાદળોનો ગડગડાટ થતાં કે સમુક્રનું મંથન કરતાં જેવો ગંભીર ધ્વનિ નીકળે એવા ગંભીર ઘોષવાળી હોય છે. પાછી એ, (૫) પ્રતિનાદ્યુક્ત=શબ્દો કે ઘંટનો નાદ જાણે

ગુજરાતી અથડાઈ રણકાવાળો પડવો પાડે એવા રણકાળા પડઘાવાળી હોય છે. વાણીની પાછળ કેમ જાણે ઘંટનો મધુરો આલાપભર્યો રણકાર ન ચાલતો હોય. વળી એ વાણી, (૬) ‘દક્ષિણ’=બોલવામાં અને સમજવામાં બહુ જ સરળ હોય છે એ વાણી. (૭) અતિ મીઠા માલકોશ રાગમાં ચાલે છે; પણ નહિ કે સંગીત વિનાના શુષ્ઠ ગઘમાં. એમાં વળી દેવોની દિવ્યબંસરીના સૂર પુરાતા રહે છે પછી એ સાંભળવાના રસનું પૂછવું જ શું? ગંધર્વના ગીત અને દેવાંગનાના સુકોમળ કંઠના કોયલ જેવા કે ઘંટડી જેવા રણકાર તો એની આગળ કાંઈ જ વિસાતમાં નહિ; જાણે એ બધા પ્રભુની વાણી આગળ બેંસાસુર જેવા લાગે. ત્યારે પ્રભુની વાણી માત્ર મધુર રાગવાળી એટલું જ નહિ પણ (૮) મહાર્થ એટલે કે વિશાળ અને ઊંડા અર્થવાળી હોય છે. પ્રભુના વચનોનો અર્થ ઘણો ઊંચો હોય છે, પણ નહિ કે એ ફાસફુસીયા અર્થવાળી વાણી. તેમજ (૯) અવ્યાધાત પ્રભુની ચાલતી એક સરખી વાખ્યારાના પૂર્વા પર કથનોમાં ક્યાંય પરસ્પર વ્યાધાત નથી આવતો; એક વચન પૂર્વના બીજા વચનનો વિરોધ કરે એવું નથી બનતું. ઊલટું વચનો એક બીજાની પૃષ્ઠ કરી વસુતત્ત્વનું સુંદર સમર્થ પ્રતિપાદન કરનારા હોય છે. વળી એ વાણી (૧૦) શિષ્ટ એટલે કે મહાસજજન પુરુષો બોલે એવી શિષ્ટતાવાળી; તેમજ સ્વમાન્ય સિદ્ધાન્તોને અનુસરતા પદાર્થને કહેનારી હોય છે; પણ નહિ કે સિદ્ધાન્ત વિરુદ્ધ અર્થવાળી અને અશિષ્ટ. (૧૧) ‘અસંદેહકર’ અર્થાત્ જેમાં શ્રોતાને ક્યાંય શંકા રહે એવાં વચન જ હોતા નથી. દરેક દરેક વચન નિશ્ચિત બોધ કરાવે છે; ટકશાળી નાણાંની જેમ વચન સીધા હદ્યમાં જઈને શ્રોતાને જચી જાય છે. (૧૨) ‘અન્યોત્તર રહિત’ એટલે કે પ્રભુના એક પણ વચન પાછળ કોઈ ઉત્તર, પ્રશ્નોત્તર કરી દૂધણ કાઢી શકે એવું હોતું નથી. કોઈ પણ વાક્જાળના કે બીજા દૂધણ પ્રભુના વચનમાં ઊભા થઈ શકતા નથી. વાણી (૧૩) અતિ હદ્યંગમ એટલે કે હદ્યને સુગ્રાહ અને ગમી જાય એવી હોય છે. વાણીના વચનો અરસપરસમાં (૧૪) સાકાંક એટલે કે પદો અને વાક્યો એક બીજાની સાથે અપેક્ષાવાળા ને સંગતિવાળા હોય છે; પણ નિરાકાંક અર્થાત્ કોઈ વચનને બીજા સાથે કાંઈ જ સંબંધ નહિ પણ છૂટક છવાયા અર્થવાળા એવું નથી હોતું. એક પદી બીજું વચન નીકળે તે પૂર્વપૂર્વની સાથે વ્યવસ્થિત સંબંધવાળું, ને સણંગ ધારાબદ્ધ પદાર્થને વર્ણવનાંદું હોય છે. વાણીમાં (૧૫) ઔચિત્ય ભારોભાર ભરેલું હોય છે. એટલે કે શાખે શાખે પ્રકરણ-પ્રસ્તાવ, અને દેશ-કાળને ઉચિત હોય છે. તેથી શ્રોતા ઉપર ગજબની ચમતકારી સારી અસર થાય છે. તેમ એમાં ક્યાંય કોઈને અનુચ્છિત લાગી મન ખોટું થવા જેવું

બનતું જ નથી. વાણી (૧૬) ‘તત્ત્વનિષ્ઠ’ એટલે જે વસ્તુનું પ્રતિપાદન કરવું હોય તેના સ્વરૂપને અનુસરનારી વાણી હોય છે; પણ નહિ કે વસ્તુનું સ્વરૂપ અમુક હોય, ને પ્રતિપાદન કંઈક જુદું જ કરાતું હોય. વળી વાણી (૧૭) ‘અપ્રકીર્ણ પ્રસૂત’ હોય છે; અર્થાત્ સુ-સંબદ્ધ પદાર્થને કહેનારી હોય છે. એમાં સંબંધ વિનાના પદાર્થોનો અધિકાર ચાલતો નથી, તેમ વિનાનો અતિ વિસ્તાર એટલે કે ખોટું લંબાવવાનું પણ હોતું નથી. વાણી (૧૮) સ્વશ્વાધા-પરનિનાથી રહિત હોય છે. ક્યાંય પ્રભુ પોતાની પ્રશંસા કરનારું વચન નથી બોલતા; તેમજ સામે બેઠેલા શ્રોતાના ગુપ્તમાં ગુપ્ત દોષો અને એના ઉપરની જીવોની સફાઈબંધ ચાલબાળ પ્રભુ રજે ૨૪ જાણવા છતાં કોઈનીય નિંદાનો એક પણ અક્ષર પ્રભુ નથી ઉચ્ચારતા. પ્રભુની વાણી (૧૯) ‘અભિજ્ઞાત્’ એટલે ઉત્તમ કોટિની અર્થાત્ વક્તાની પોતાની અને વિવેચવાના વિવેચનની ભૂમિકાને અનુસારે વાણી હોય છે. પોતે જગદીશ પરમાત્મા છે, તો ભૂમિકા બહુ ઊંચી તેથી વાણી પણ તેવી ઊંચી બોલાય છે. વળી વાણી (૨૦) સ્નિધમધુર એટલે કે સાકર, શેરડી તો શું પણ દિવ્ય અમૃત કરતાંય અતિશય ચઢી જાય એવી સ્નિધતા અને માધુર્યવાળી હોય છે. એવી એ મધુર વાણી સતત દિવસોના દિવસો સાંભળતાંય થાક, કંટાળો, નિદ્રા, ભૂખ, તરસ, ટાઢ, ગરમી વગેરે કોઈ પણ પીડા લેશમાત્ર રહેતી નથી. એટલી અનુપમ મધુરતા એમાં છે. આવી વાણી (૨૧) પ્રશંસનીય છે. હોય જ ને? કેમકે એ સાંભળી જનારા એના અનુપમ શુણોથી આકર્ષાઈને બહાર પણ બીજું બધું ભૂલીને એકલી એની જ પ્રશંસા કર્યા કરે છે. લોકમાં ચારે કોર જિનવાણીના શુણગાનના ધોષ ચાલી રહ્યા છે. વળી એ વાણી (૨૨) અમર્મદેધી અર્થાત્ કોઈ પણ શ્રોતાના મર્મને ન ખોલનારી હોય છે. નહિતર અનંતજ્ઞાની પ્રભુની જાણકારી તો બધી જ છે; પણ બીજાની રહસ્યમય વાતોને બહાર ન પ્રકાશવાની પરમ ગંભીરતા પ્રભુમાં સાગરથીય અધિક હોય છે. વાણી (૨૩) ‘ઉદાર’ છે અર્થાત્ કહેવાનો વિષય ઉદાર એટલે કે મહાન અને ગંભીર હોય છે; નહિ કે અલ્ય અને તુચ્છ. તેમજ (૨૪) ‘ધર્માર્થપ્રતિબદ્ધ’ વાણી ધર્મ અને અર્થ સાથે સંબદ્ધ છે. વચનનો સારો અર્થ પણ છે, અને વાણી ધર્મ ઉપદેશનારી હોય છે. વાણીમાં (૨૫) ‘કારકાદ્દિનો અવિપર્યાસ’ અર્થાત્ વ્યાકરણની દાસ્તાને કર્તા-કર્મ વગેરે છ કારક, એક વચનાદિ વચન, પુલિંગ વગેરે લિંગ, વર્તમાન વગેરે કાળ, ઈત્યાદિમાં ક્યાંય જરા પણ સ્વલ્પના, ઊલટસુલટ, કે ફેરફાર જેવું હોતું નથી. (૨૬) ‘વિભાગિવિયુક્ત’ વક્તાના મનમાં ભાન્તતા, વિક્ષેપ વગેરે કોઈ દોષ નથી હોતા. (૨૭) ‘ચિત્રકારી’=વાણી શ્રોતાના દિલમાં અવિચિન્ન

રસ અને આતુરતા જ્ઞાની રાખનારી હોય છે. આતુરતા એટલે ‘હવે શું કહેશે, હવે શું આવશે’ એ જિજાસા. (૨૮) ‘અદ્ભુત’ હોય છે. દુનિયાના બીજા ભલ ભલા વક્તાની વાણી કરતાં અતિશય ચઢીયાતી અને ચમત્કારિક વાણી હોય છે. તેમ એ (૨૯) ‘અનતિવિલભ્યી’ હોય છે; એટલે કે ઝટપટ ઝટપટ બોલાઈ ગયેલી નહિ, તેમ બહુ જ ધીરે ધીરે જાણે અટકી અટકીને વિચાર કરી કરીને વિલંબે બોલાતી હોય એવું પણ નથી. (૩૦) ‘અનેક જ્ઞાત વિચિત્ર’ વાણીમાં વર્ણનીય વસ્તુના સ્વરૂપના વર્ણનો અનેક જાતના આવે છે; તેથી વાણી દળદાર, માલદાર હોય છે. વળી એ (૩૧) “આરોપિત વિશેષતાવાળી” હોય છે; એટલે કે પ્રભુના વચને વચનમાં બીજા વચન કરતાં વિશેષતા સ્થપાઈ ગયેલી હોય છે, તેમજ વાણી (૩૨) ‘સત્ત્વપ્રધાન’ હોય છે અર્થાત્ પરાક્રમ ભરેલી હોય છે; માયકાંગલી કાયર કે તામસી નથી હોતી. (૩૩) ‘વિવિક્ત’=વાણીમાં દરેક અક્ષર, દરેક પદ અને દરેક વાક્ય સ્પષ્ટ છૂટો હોય છે; પણ ગરબીયો નહિ. (૩૪) ‘અવિશ્વાન’=કહેવાના વિષયની યુક્તિ-દસ્તાવિધિ સારી સિદ્ધિ કરનારી વાણી હોય છે; તેથી એ વચનોની પ્રામાણિકતા સદા માટે હોય છે. (૩૫) ‘અખેદ’ અર્થાત્ વાણી પ્રકાશવામાં પ્રભુને જરાય બેદ, થાક કે પરિશ્રમ નથી લાગતો. શ્રોતાને એ વાણી થાક્યાની નથી લાગતી, કે વિચાર અથવા મહેનત કરી કરીને બોલાતી નથી લાગતી. સહજભાવે એનો એકધારાએ ગંગાપ્રવાહ પ્રભુના મુખમાંથી ચાલ્યો આવે છે.

આવા પાંત્રીસ અતિશયવાળી વાણી વીતરાગ સર્વજ્ઞ શ્રી તીર્થકરદેવોની જ હોય છે. એના એકેક વચનથી કરોડો શ્રોતાઓના દિલના જુદા જુદા સંશયો એકી સાથે ભેદાઈ જાય છે; અને મહાન તત્ત્વોના નિઃખ્ય હૈયામાં બેસી જાય છે. ખૂબી તો જુઓ કે એ વાણીના ઉપદેશમાં નાની કીડી કે તેથીય સૂક્ષ્મ જંતુની પણ દ્યા કરવાનું મહાશિકારી સિંહ-વાઘ જેવા પ્રાણીઓય આનંદથી સાંભળે છે. પ્રભુની એક નિકટાનો જ એવો પ્રતાપ છે કે એ સિંહ હરણીયા સાથે, વાઘ બકરી સાથે, સગાં ભાઈબેનની જેમ વૈર-વિરોધ વિના બેસે છે. તીર્થકર પરમાત્મા સિવાય બીજે ક્યાં આ બધું હોઈ શકે?

આમ તીર્થકરપણાના પુણ્યોદયે અને ધાતીકર્મના ક્ષયે નીપજતી આ પાંત્રીસ વિશેષતાઓ અને ચોત્રીસ અતિશયો વગેરે અજબ શક્તિઓ શ્રી અરિહંત પ્રભુમાં એવી હોય છે કે જેનું યથાર્થ વર્ણન મુશ્કેલ છે; છતાં એનું ચિંતન, મનન, અને ગુણગાન આત્મામાં શુભ અધ્યવસાયોને પોષી મહાન પાપક્ષય કરાવે છે.

(નોંધ :- ૨૮ કમાંકમાં જે ‘અદ્ભુત’ જ્ઞાવેલ છે ત્યાં ‘અદૃત’ પાઠ મળે છે. જેનો અર્થ થાય છે, પ્રભુની વાણી ઝટપટ ઝટપટ બોલાઈ ગયેલી ન હોય.)

## • પરમાત્માનો ઉપકાર •

વિશ્વ ઉપર ભગવાન શ્રી જિનેશ્વરદેવ તીર્થકર પરમાત્માના અનંત ઉપકાર છે. એ ઉપકાર લૌકિક અને લોકોત્તર, બંને પ્રકારના છે. લૌકિકમાં જગતમાં જે કાંઈ સાંદું ગણાય તે આપનાર પરમાત્મા છે; પરંતુ તે સીધેસીંદું, વસ્તુ બનાવીને કે હાથોછાથ આપીને નહિ. દા.ત. પહેલું તો અનુકૂળ હવા, પાણી, ભોજન, ક્ષેત્ર વગેરે સાંદું જીવને જે મણ્યું, તે હવા તે પાણી વગેરેને કાંઈ પ્રભુ બનાવવા બેસતા નથી. કેમકે ઉપરોક્ત વર્ણનથી એ સમજાયું હશે કે પરમાત્મા વીતરાગ હોવાથી એવી ખટપટમાં પડતા નથી. એ તો જીવોના કમન્જુસારે બને છે. પ્રભુએ તો એ કરવાનું હોઈ શકે જ નહિ.

પ્ર.- તો પછી પરમાત્મા જીવોનું સાંદું કરનારા શી રીતે ?

૩.- પરમાત્મા જીવોનું સાંદું થવામાં મહાન નિમિત્ત છે, અસાધારણ કારણ છે, તેથી પરમાત્મા સાંદું કરનારા છે એમ કહી શકાય છે. કારણ આ રીતે : જગતની સુખ-સગવડો મળવામાં હેતભૂત પુણ્યનો ઉદ્ય છે. એ પુણ્યનું ઉપાર્જન પરમાત્માના દર્શન, વંદન, પૂજન, સ્તવન, પ્રશંસા, પ્રભાવના, આજ્ઞા-પાલન, સ્મરણ, ધ્યાનાદિથી થાય છે. આમાં મુખ્ય આલંબન પરમાત્મા જ બન્યા, તેથી પ્રભાવ પરમાત્માનો પરમાત્મતાવનો જ કહેવાશે. અહીં પ્રશ્ન થશે કે,

લૌકિક ઉપકાર : કેવી રીતે ? :-

પ્ર.- પુણ્યબંધ તો શુભ અધ્યવસાયથી થાય છે; પરમાત્મા ક્યાં પુણ્યબંધ કરી આપે છે ?

૪.- વાત સાચી છે કે પુણ્ય એ શુભ-કર્મ હોઈને શુભ અધ્યવસાયથી, શુભ ભાવથી બંધાય. પરંતુ પરમાત્માના દર્શન વંદનાદિથી સહેજે એ શુભ અધ્યવસાય જાગે છે; તેથી એમાં પરમાત્મા તો કેન્દ્રીભૂત છે જ, એક પરમાત્માને તદ્દન છોડી દો, પછી ગમે તેટલી દોડધામ કરો, એમના ઉપદેશ વિનાની ગમે તે પ્રવૃત્તિ કરો, તો એ કાંઈ જ કિમતના નહિ. ગુરુદર્શન-ગુરુવંદન વગેરે પણ પરમાત્માની આજ્ઞાપાલનરૂપ છે, તેથી એમાં પણ કેન્દ્રમાં પરમાત્મા જ છે. ઉત્કટ સંયમનું પાલન લ્યો, તો એમાં પણ પરમાત્માનો આદર્શ અને આદેય નજર સામે છે; એ પરમાત્માની આજ્ઞાનાં પાલનરૂપ છે, એટલે પરમાત્મા તો કેન્દ્રીભૂત બન્યા જ. એમ દેઠ મિથ્યાદિના સત્ય, દ્યા, દાન જુઓ, તો તેમાં પણ મૂળ પરમાત્માની આજ્ઞામાંથી લીધું હોવાથી, પરમાત્મા તો મુખ્યપણે આવશે જ. શાસ્ત્રે કહ્યું છે કે જગતના બીજા ધર્મોમાં જિનના સદ્-ધર્મરૂપી મહાસાગરના બિંદુ ઉંલા છે. આમ, ધ્યાન

કરો, કે વંદન, સંયમ પાળો કે આદર્શ ધરો, એમાં અલબત્ત પોતાના આત્માના હાર્દિક શુભ ભાવ પર પરિણામનો આધાર છે, છતાંય એ ધ્યાન પરમાત્માનું કર્યું હશે, આદર્શ કે આદેશ પરમાત્માનો ધર્યો હશે તો જ શુભતા આવવાની; અને તો જ શુભભાવપણું બનવાનું. તેથી બધે શુભભાવમાં મુખ્ય તો પરમાત્મા જ બન્યા. માટે જ કહો કે પરમાત્માથી શુભભાવ જગવા દ્વારા પુણ્યોપાર્જન થાય છે; અને પુણ્યોદયથી જગતની પણ સુખ-સગવડ મળે છે. આમ પરમાત્મા મહાઉપકારી છે. પરમાત્મા વિના તો એક ડગ પણ ભરી શકાય એમ નથી. તેથી જ બધું સારું પરમાત્મા આપે છે, એમ કહી શકાય. તે પણ માત્ર આટલું નહિ, કિન્તુ આગળ વધીને કર્મક્ષય અને મોક્ષ પણ પરમાત્મા જ આપે છે. આમ પરમાત્માનો આ મહાન ઉપકાર છે કે સુખ એજ આપે. તેમ એ પણ પરમાત્માનો જ ઉપકાર છે કે સર્વ પ્રકારના દુઃખ નિવારે. ઉપર કહ્યું તેમ દર્શનાદિ દ્વારા પૂર્વપાપનો કષય થાય છે, અને શુભ ભાવ રહેવાથી નવાં પાપ આવતાં નથી, તેથી દુઃખ નાશ થાય એ સહજ છે.

**વર્તમાનમાં ઉપકાર :-** પરમાત્મા આ રીતે દુઃખનાશ અને સુખદાન કરનારા હોવા ઉપરાંત વર્તમાનમાં પણ જીવને ઉપકાર કરે છે. પૂર્વ પાપના ઉદયરૂપે જીવને કષ આપતી આવવા છતાં જે એ શ્રદ્ધાળું છે, તો એને પરમાત્માના જીવન અને ઉપદેશમાંથી એવું અલોકિક બળ મળે છે કે જેથી એને જરાય દુઃખરૂપતા લાગતી નથી, બલ્કે કર્મભાર ઓછો થવાનો અને આત્મશુદ્ધિ વધતી જવાનો મહાન આનંદ અનુભવાય છે. આમાંય પોતાની આત્મજગતિમાં મુખ્યપણે મૂળ-ઉત્થાન પરમાત્મા જ છે, તેથી પરમાત્મા આ રીતે પણ દુઃખનાશ અને સુખદાન કરવા દ્વારા ઉપકારક છે.

**પાપી પર ઉપકાર :-** જગતના પાપી અને ધર્મહીન જીવો ઉપર પણ પરમાત્માનો એ રીતે ઉપકાર છે કે એ જગત-દ્યાળું ભગવાન જગતને દયા, અહિસા, સત્ય વગેરેનો ઉપદેશ કરી અનેક જીવોને એવા ધર્મત્વા બનાવે છે કે જે જીવનમાં દયા, અહિસા સ્વીકારી પેલા પાપી જીવોને હિસાદી દુઃખ આપવાનું બંધ કરે છે.

### અર્થશાસ્ત્રાદિ જુદી જુદી દિલ્લીએ ઉપકાર :-

અર્થશાસ્ત્રની દિલ્લીએ જુઓ કે પરમાત્માના અપરિગ્રહના શિક્ષણથી શ્રદ્ધાળું જીવો જેટલો વ્યાપાર અને પરિગ્રહ ઓછો કરશે તેટલો એ પરિગ્રહ બીજાઓના દુન્યવી સુખને માટે મોકલો રહેશે.

ત્યારે રાજકીય દિલ્લીથી જુઓ કે પરમાત્માના ઉપદેશથી જગતના જે ઓછાવતા

જીવો ગુના કરવામાંથી પાછા હશે, એટલા પ્રમાણમાં સરકારને પોલીસ, કોર્ટ, જેલ વગેરે ઓછું રાખવું પડશે; તો એટલે અંશે એને તથા પ્રજાનેય શાંતિ અને નિરાંત રહેશે. નહિતર ધારો કે પરમાત્માના ઉપદેશનો અંશ પણ આ પૃથ્વી પર ન હોય તો ગુનેગાર કેટલા બધા હોય? ગુના કેટલા બધા બને? કાંઈ એવું નથી કે કાયદા, કોર્ટ, પોલીસ વગેરે વધારે રાખવાથી ગુના બંધ થાય છે. આજે જ દેખાય છે ને કે પરમાત્માની સાચી શ્રદ્ધા ઉડાવવા જતાં કાયદા અને પોલીસ વધારવા છતાં ગુના કેટલા બધા પડ્યા છે?

અરે! સામાન્ય એક આરોગ્યની દિલ્લીએ જુઓ તો દેખાશે કે પૂર્વેકાળમાં પરમાત્માના આદેશાનુસાર ઈન્દ્રિય સંયમ વગેરે હતા તો આરોગ્ય ઘણું જળવાતું; અને વૈદી ઓછા હતા. તેથી લોકોને જંગી ડાક્ટરી ખર્ચના દુઃખ નહોતા. આજે પરમાત્મા ભૂલાયા, તો એ તોફાન પણ એટલું બધું વધ્યું કે એક બાજુ ઈન્દ્રિયવશતાથી રોગ વધ્યા અને રોગમાં પછી એ પરમાત્માને ભૂલેલાઓ તૃષ્ણાધીન ડોક્ટરો પાસે દોડ્યા! તો એણે એવી સ્થિતિ કરી આપી કે તત્કાલ કદાચ રોગ શમે તો પણ પરિણામે રોગની સુલભતા અને પાછા એજ ડોક્ટરોનું શરણ!... એમ રોગવૃદ્ધિથી ડાક્ટરવૃદ્ધિ અને ડાક્ટરવૃદ્ધિથી રોગવૃદ્ધિ, એ રીતનું વિષચક ચાલ્યું. ઈન્દ્રિયનિશ્ચહ અને તૃષ્ણાસંયમનો પરમાત્માનો ઉપકાર ન જીલવામાં શો સાર? શરીરે ખુલારી! પૈસે ખુલારી! અને પાપવૃદ્ધિથી પરભવમાં હિતની ખુલારી!

**કૌટુંબિક વગેરે ઉપકાર :-** માટે જ એવી ખુલારીઓ અટકાવવામાં પણ પરમાત્મા જ ઉપકાર કરી શકે છે; અને કરે છે. શું વૈયક્તિક જીવન, કે શું કૌટુંબિક અને સામાજિક જીવન, સર્વત્ર પરમાત્માનાજ આલંબનથી સુખ-શાંતિ, સંપ-સુલેહ અને સાચી આબાદી ઉન્તિ વર્તે છે. અમેરિકામાં એક માનસ ચિકિત્સકે હજારો માણસોની જીવનમાંથી જુદી જુદી ફરીયાદોની ચિકિત્સા કરી એક તારવણી એ કાઢી કે મોટે ભાગે ફરીયાદ કરનારાઓ ચર્ચ (દ્વણ)માં નહિ જનારા છે. અર્થાત્ ઈશ્વરથી અને ધર્મથી પરાડુમ્બ રહેનારા છે; માટે જ જીવનમાં કલેશ અને અશાંતિ ભોગવે છે.

**પરમાત્મા શું શું ઉપકારક :-** પરમાત્મા ઉપકારક બનવામાં એમના નામથી માંડીને, ઉપદેશ સુધીની વસ્તુઓ છે. અર્થાત્ પરમાત્માનું નામ, પરમાત્માની મૂર્તિ-પ્રતિકૃતિ (ધબી-ચિત્ર), પરમાત્માનો દેહ, પરમાત્માનું ગુણોભર્યું જીવન, પરમાત્માનો ઉપદેશ અને પરમાત્માનું શાસનદાન-ધર્મદાન, એના દ્વારા, પરમાત્મા તરફથી સુખદાયી ઉપકારનો મેધ દુઃખગ્રસ્ત જગત ઉપર અનંતકાળથી વરસાતા આવ્યા છે. આ પરમતત્ત્વ ને ન સમજનાર અજ્ઞાન જીવો કોઈ તો પરમાત્માને જ ઉડાવે છે.

અને પરમાત્માનું બધું જ ઉડાવે છે ! તો કેટલાક સ્વાલંબનને જ સ્વપુરુષાર્થને જ મુખ્ય કરી પરમાત્માનું આલંબન ઉડાવે છે ! ત્યારે કેટલાક વળી એમના ઉપદેશનું આલંબન રાખી નામ-જ્ઞાપ વગેરેને નકામાં ગણે છે ! તો કોઈક લોકો પરમાત્માની મૂર્તિ નિરૂપયોગી ગણી, પોતાની જાતને પરમાત્માના ભક્ત માનવા છતાં પરમાત્માની જ મૂર્તિ સામે મોરચા માંડે છે !! કેવું કારમું અજ્ઞાન ! કેમ જાણે એમને મન જગત ઉપર પાપના સ્થાનકો અને પાપની વાત-વસ્તુઓએ જે જુલબ નથી કર્યો તે પ્રશ્નમરસ ઝરતી પ્રભુમૂર્તિ કરે છે !!!

**અરિહંતના નામનો ઉપકાર :-** અરિહંત પ્રભુના નામસ્મરણથી ભવોભવના બ્રમણ મીટે છે. “આસ્તામાચિન્ત્યમહિમા જિન ! સંસ્કરસ્તે, નામાપિ પાતિ ભવતો ભવતો જગન્તિ ! હે પ્રભુ ! આપના અચિંત્ય મહિમાવાળા ગુણગાનની તો શી વાત કરવી, આપનું નામ પણ ત્રણેય જગતને ભવથી (સંસારથી) બચાવી લે છે.” બાકી જગતમાં જીવને કર્મવશ રહેવું પડે ત્યાંસુધી પણ પરમાત્માનું નામ સ્મરણ અપૂર્વ સુખશાંતિ અને પાપક્ષય સાથે પુણ્યની સાથે પૃષ્ઠિ આપે છે. અરિહંત પ્રભુના નામસ્મરણથી સમગ્રી રાજકુમારી થઈ, સર્પ ધરણેન્દ્ર થયો, સતી સુરસુરુઈના ધોર વિધન ટથાં, આજે પણ ગુંડા ટોળાના ઘાતકી આકમણ, વહાણનો ડેલમ ડેલ, અટવી બ્રમણ વગેરેમાંથી અરિહંત પ્રભુના નામસ્મરણે બચાવ્યાનો દાખલો બન્યા છે.

**અરિહંતની મૂર્તિના ઉપકાર :-** ત્યારે પ્રભુની મૂર્તિનું આલંબન ભવ્ય ઉપકાર કરે છે એ યુક્તિસિદ્ધ અને અનુભવસિદ્ધ વાત છે. જ્યારે કામની પુતળી એવી ઉન્મત સ્ત્રીનું માત્ર ચિત્ર પણ કામ-રાગ અને મોહોન્માદને પ્રેરે છે, તો વીતરાગની પ્રશાંત મૂર્તિ વૈરાગ્ય અને પ્રશાંતતા પ્રેરે એમાં શી નવાઈ ? તેમ, વિદેશ ગમેલા પતિના ફોટોને ફૂલહાર વગેરેથી પૂજનારી સતીના દિલમાં પતિ પ્રત્યેનો પૂજ્યભાવ-સંદ્ભાવાદિ વધે છે, તો પછી શ્રી અરિહંતની મૂર્તિની પૂજા ખુદ અરિહંત પ્રત્યે પૂજ્યભાવ બહુમાનાદિ કેમ ન વધારી શકે ? શ્રી શર્વંજ્ય જેવા મહાતીર્થ અને તીર્થ પરના જિનાબિની પૂજાભક્તિથી પૂર્વની જેમ અનેક ભવ્યાત્માઓ આજે પણ આત્માની નિર્મણતા સાધી રહ્યા છે. બાકી તો નાગકેતુએ મૂર્તિની ફૂલપૂજા કરતાં કરતાં કેવળજ્ઞાન મેળવ્યું હતું. દમયંતીએ પૂર્વભવે શ્રી અધ્યાપદજ ઉપર ચોવીસ પ્રભુની મૂર્તિને રતના તિલક ચઢાવ્યાની પૂજા કરી હતી, તો તેના પુણ્ય પ્રભાવે દમયંતીના ભવમાં કપાળે જન્મથી દેટીયમાન કુદરતી તિલક મેળવ્યું હતું. જે અંધારામાં પ્રકાશ આપતું હતું. તેમ પરમાત્માની વિશેષ શ્રદ્ધાભક્તિ પણ એવી મૂર્તિ-પૂજાદિ દ્વારા મેળવી હતી. અનાર્થિશનો રાજપુત્ર આર્દ્રકુમારે મોકલેલી

ભુવનભાનું એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ” (ભાગ-૧૮)

૧૦૧

જિનમૂર્તિથી પ્રતિબોધ પાખ્યો હતો. શય્યભવસૂરિજી શુતકેવલી ભગવાન બ્રાહ્મણપણે યજ્ઞસ્તંભ નીચેથી મળેલી જિનપ્રતિમાથી બોધ પાખ્યા હતા. અરિહંત પ્રભુની મૂર્તિ તો, જો દર્શન કરતાં આવડે તો, મહાશાંતિ, ધર્મવીર્ય પ્રેરણા, માનસિક સુભભાવના, ને એકાગ્ર ધ્યાનાદિ આપે છે.

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદધિ”

વર્ષ-૪, અંક-૨૭, તા. ૨૪-૩-૧૯૫૬



## શ્રી અરિહંત પરમાત્માની ઓળખાણ

દેહદ્વારા પ્રભુનો ઉપકાર તો પ્રસિદ્ધ છે. જન્મથી માંડીને અનેક ભવ્ય જીવોને આનંદ અને વિરાગની પ્રેરણા આપવા ઉપરાંત તીર્થકર બન્યા પછી તો જગતને દર્શન, વંદન, વાણી શ્રવણ, પૂજન, સ્તવન વગેરેના અનુપમ લાભ આપે છે. કેવળજ્ઞાન પાખ્યા પછી તરત મોક્ષ નથી પામતા, પણ હજી માનવદેહે આ પૃથ્વી ઉપર વિચરે છે, તો જ એ દેહથી જગત ઉપર અપૂર્વ ઉપકારોનો પુષ્ટરાવત્ત વરસાવે છે. બાકી સંસારી જીવ પ્રભુની ગેરહાજરીમાં જે પ્રભુનું સ્મરણ કરી લાભ મેળવે છે તે પણ પ્રભુના દેહનું જ સ્મરણ કરીને લાભ મેળવે છે. એટલે એ દેહ એ રીતે ભવ્ય જીવોને પરમાત્માના સ્મરણ અને ધ્યાનનું આલંબન બની અન્ત ઉપકાર કરે છે. ખરી રીતે દેહ તો જડ છે, છતાં સાક્ષાત્ પૂજાય છે, અને આમ પણ સ્મરણ ધ્યાનાદિ દ્વારા પૂજાય છે. અને ઉપકાર કરે છે તો મૂર્તિ પણ પૂજાવા દ્વારા ઉપકારક થાય એમાં શો સંદેહ ?

**પ્રભુના જીવનનો ઉપકાર :-** ત્યારે પ્રભુનું ગુણો ભર્યું જીવન જગતને સાધનાના મહાન આદર્શ આપે છે, અને જ્ઞાનદિદ્ધિવાળા તથા ગુણમય બનવામાં પ્રબળ પ્રેરણા આપે છે. એ રીતે પણ પ્રભુ જગત પર અનંત ઉપકાર કરનારા છે. આમાં પ્રભુના જીવનના વિવિધ પ્રસંગોને પૃથક્કરણ-રહસ્યતારણ કરવા પૂર્વક વિચારવાના. ત્યાં “તીર્થકર પ્રભુએ સ્વજીવનમાં અવસરે અવસરે આવા આવા ગુણો વિકસાવ્યા હતા, તો હું પણ એ આદર્શ આંખ સામે રાખીને ગુણોનો મારાથી શક્ય વિકાસ સાધું ! ઠેઠ સમ્યક્તવના ભવથી પ્રભુએ ઉચ્ચ ઉચ્ચ ધર્મસાધનાઓ કરી હતી, તો હું પણ એ કરવા લાગું ! ચરમભવમાં તો અવધિજ્ઞાની પ્રભુ તે ભવને અંતે જ નક્કી મોક્ષ જાણવા છતાં એ આંતર શત્રુ સામે ખૂબ જરૂર્યા, કર્મનો સંહાર કરવા એમણે જીવન-સંગ્રહ ખેલ્યા. ધોર તપ અને ભયંકર પરીસહ-ઉપસર્ગ સહન કર્યા તો હું પણ એવું જ જીવન બનાવું...” વગેરે વગેરે નિર્ધાર કરી ભવી જીવો ૧૦૨ ભુવનભાનું એન્સાઈક્લોપીડિયા-શ્રી અરિહંત પરમાત્માની ઓળખાણ (ભાગ-૧૮)

ભગીરથ પુરુષાર્થી બને છે, તે પ્રભુનો જ ઉપકાર છે. ઉપદેશકો ઉપદેશથી શ્રોતાને જે બુઝવે છે તેમાં પણ પરમાત્માનું ગુણભર્યું જીવન આગળ કરીને.

### શાસનદાન-ધર્મદાનનો-શ્રેષ્ઠ ઉપકાર :-

ત્યારે પરમાત્માનો શ્રેષ્ઠ સચોટ ઉપકાર ધર્મના મૂળ ઉપદેશક તરીકેનો અને શાસનદાન તથા ધર્મદાન કરવાનો છે. જે બીજાઓ ધર્મના ઉપદેશ અને દાન કરે છે તે એમની પછી. આ અવર્સર્પણીના યુગમાં શ્રી ઋષભદેવ પ્રભુએ પહેલ વહેલો શુદ્ધ ધર્મ બતાવ્યો. પછીથી બીજા સાંખ્યાદિ ધર્મો નીકળ્યા.

ત્યારે હવે શાસનદાન અને ધર્મદાન કરવાનો અરિહંત પ્રભુનો, જુઓ કે, કેવો ગજબ ઉપકાર !! ઈન્દ્રભૂતિ ગૌતમ બ્રાહ્મણ શ્રી મહાવીર પરમાત્મા પાસે વાદ કરીને જીતવા આવ્યા હતા, પરંતુ પ્રભુએ તત્ત્વનો એવો ઉપદેશ કર્યો, કે ઈન્દ્રભૂતિ ઊલટા શરણે આવી ગયા. ત્યાં પ્રભુએ મિથ્યાત્વસહિત ગૃહવાસને ઓકાવી, સમ્યક્તવપૂર્વ ચારિત્રધર્મનું દાન એવું કર્યું કે એમને અનંત સંસારના કૂવામાંથી ઉંચક્યા ! વળી ત્રિપદીનું શાસન-દાન એવું કર્યું કે એમને સમગ્ર દ્વાદશાંગીના રચનારા મોક્ષગામી ગણધર બનાવ્યા ! તેમ એમની પાછળ જગતને પણ ધર્મદાન કરી એમાંથી સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા બનાવ્યા. આમ વ્યવસ્થિત સંઘની સ્થાપના કરવા પૂર્વક તેમાંના દરેકને પાળવાના આચાર-વિચાર-મર્યાદાની વ્યવસ્થાનું એવું સુંદર શાસનદાન કર્યું કે એથી સંખ્યાબંધ જીવો, અને ઋષભદેવ પ્રભુ થકી તો અસંખ્યાતા જીવો મોક્ષમાર્ગના આરાધક બન્યા ! એમાંથી કેઈ મોક્ષગામી થયા ! અને બીજા મોક્ષની નિકટ બન્યા ! ઉપરાંત, પૂર્વે કહ્યું તેમ આ શાસન-સ્વરૂપ સાગરના બિદુઓ જગત ઉપર ઉડીને જગતમાં સામાજિક-રાજકીય-કૌટુંબિક-ધ્યાદારી વગેરે સંસ્થાઓમાં ન્યાય-નીતિ-દયા સત્ય વગેરે સદ્ગ્યવહાર પ્રવર્તાવિવા દ્વારા કરીક પણ સુખ-શાંતિ વરસાવનારા બન્યા. નહિતર તો આખુંય જગત નરકાગાર હોત. ત્યારે વિચારો કે શ્રી તીર્થકર પ્રભુએ ઉપદેશદાન, ધર્મદાન, શાસનદાન, સદ્ગ્યવહારદાન વગેરે કરવાનો કેટલો બધો નિસ્સીમ ઉપકાર કર્યો છે ! ઉપકાર તે આને કહેવો ? કે સૃષ્ટિ રચવી, જગત પર નિયંત્રણ રાખવું, જીવોને જન્મ-મરણ-ખાનપાન-સુખદુઃખ આપવા એ ઉપકાર ?

પરમાત્મા લોકના નાથ છે તે લોકને આ ધર્મદશના, ધર્મ, અને ધર્મ-શાસન તથા સદ્ગ્યવહારની પ્રાપ્તિ કરાવવા અને રક્ષણ કરવા દ્વારા. પરમાત્મા લોકમાં ઉત્તમ છે તે સ્વયં ધર્મ સિદ્ધ કરી પરમપુરુષ બનવા દ્વારા. પરમાત્મા લોકના હિતરૂપ છે તે એ ધર્મ અને શાસનને ખીલવનારું ધર્મસ્તિકાયાદિ પંચસ્તિકાય લોકનું યથાર્થ નિરૂપણ કરવા દ્વારા. ભવ્ય જીવોને એ ધર્મશાસનના પ્રકાશ તથા

ગણધર દેવોને ચૌદ પૂર્વના મહાપ્રકાશ આપવા દ્વારા પ્રભુ લોકપ્રદીપ અને લોકપ્રધોત્તર છે. સર્વજ્ઞ અરિહંત પરમાત્મા સિવાય આવા અપૂર્વ ધર્મદાન અને શાસનદાન કોણ કરી શકે ?

મોહાન્યકાર અને કર્મ-દુઃખથી વ્યાપ્ત એવા આ જગત ઉપરથી એ કર્મદુઃખાદિ ટાળવામાં મૂળમાં એક માત્ર શ્રી તીર્થકર દેવનો જ મહાન ઉપકાર છે. કેમકે એ પરમાત્માએ મોહાન્યકાર અને કર્મદુઃખ ટાળવા માટે ધર્મ ઉપદેશથી ભવ્ય જીવોને બુઝવી સમ્યક્તવ ધર્મ, દેશ વિરતિધર્મ, સર્વ વિરતિ ચારિત્ર ધર્મ, તપોધર્મ, સંલેખના ધર્મ, વગેરે ધર્મ આપે છે. પાછું એને બરાબર પાળી અંતિમ ફળે પહોંચવા સચોટ અને વ્યવસ્થિત માર્ગદર્શન આપે છે. જેમાં સિદ્ધાંત, તત્ત્વ-આચાર-મોક્ષમાર્ગ-સાધના-શુદ્ધિ-અપવાદ-ઉત્કાન્તિ-વિકાસ-યોગ-જ્ઞાન-ભક્તિ-ક્રિયા-ધ્યાન વગેરે કોઈ વિશિષ્ટ પદાર્થોના પ્રકાશ, (જેનું વર્ણન આગળ કરાશે તે) આવે છે. તેમજ જીવોને ધર્મમાં દોરવામાં, પહેલાં પોતે સાચા ધર્મનાયક એટલે કે સ્વજીવનમાં અતિ કઠોર ધર્મના આરાધક બની રહે છે, એટલું જ નહિ પણ ધર્મ-સાધનામાં જીવો શિથીલ ન પડે એ માટે પરમાત્મા સારથિપણું કરે છે. તે સાક્ષાત્ રોકીને અથવા અપ્રમાણના ઉપાય બતાવવા દ્વારા. આ ઉપરાંત.

(૫) શ્રી અરિહંત પરમાત્મા ધર્મ સામ્રાજ્ય ઉપર ચક્રવર્તીપણું ભોગવી ધર્મને ત્રિકાલાબાધ્ય અને અનંતાનંત કાળ માટે એક સરખો સુવિશુદ્ધ તથા અવ્યબિચારી અર્થાત્ સચોટ ફિલદાયી બતાવે છે.

આવા અદ્ભુત ઉપકારના યોગે જ શ્રી તીર્થકર દેવો જગતના જીવોને અભયદાના છે.

જેમ કોઈ પ્રવાસીને લૂંટારા લૂંટીને આંખે પાટા બાંધી જંગલમાં રખડતો મૂકી દે; ત્યાં (૧) શિકારી પશુઓની ભયંકર ચીસીયારીઓથી પ્રવાસીને ભારે ભય થતો હોય; પાછો (૨) આંખે પાટાથી દેખી શકતો ન હોય, (૩) તેથી પોતાનો રસ્તો ભૂલી અટવીમાં ફર્યી કરતો હોય, (૪) વળી ત્યાં કોઈનો આશરો ન હોય, અને (૫) ભૂખ-તરસ વગેરેની ભારે પીડા તથા અશક્તિ હોય;

એવાને જો ત્યાં કોઈ દ્યાળું હિથિયારંધ ધોડેસવાર આવી (૧) શસ્ત્રના બારથી નિર્ભય કરે, (૨) આંખના પાટા છોડી નાખે, વળી (૩) માર્ગ બતાવે, પાછો (૪) પોતાનો આશરો આપે, અને (૫) ખાનપાનથી પ્રવાસની શક્તિ આપે જેથી પ્રવાસી સ્વસ્થાને પહોંચી જાય; તો એ કેવો ઉપકારી ગણાય ?

એવી રીતે (૧) મિથ્યાજ્ઞાન કષાયો વિષયો વગેરે લૂંટારાઓથી લૂંટાયેલો આ જીવ-મુસાફર પળે પળે દુઃખના ભયથી ફફડતો છે, (૨) તીવ્ર મિથ્યાત્વાદિ કર્મના

પાટાથી મોક્ષ તરફ જોવા માટે અંધ બન્યો છે, (૩) તેથી મોક્ષમાર્ગના બદલે સંસાર વનમાં ભટક્યા કરે છે, (૪) ત્યાં એને કોઈ આશરો નથી, તેમજ (૫) એને ત્યાં મોક્ષમાર્ગની મુસાફરી યોગ્ય ખાનપાન કે તાકાત પણ મળતી નથી. આવી પાંચ દુર્દ્શાથી સંસારી જીવના હાલ બેહલ છે.

એને પરમાત્મા (૧) તત્ત્વદર્શન અને આત્માની અનંતીશક્તિના ભાનથી દુઃખના ભય મૂકાવે છે; (૨) તીવ્ર મિથ્યાત્વાદિ કર્મના પાટા છોડાવી મોક્ષ તરફની અંધતા દૂર કરે છે; (૩) મોક્ષમાર્ગનો બોધ આપે છે; (૪) વળી પોતાના આદર્શ જીવન અને ગુણો વગેરેનો આશરો (આલંબન) આપે છે, પોતાના નામ-સ્મરણ-ભક્તિ-સમર્પણાદિ દ્વારા શરણ આપે છે; અને છેવટમાં (૫) સમ્યક્ત્વ-સમ્યગ્જ્ઞાન-સમ્યક્યારિત્રદુપી ધર્મ સાધનાના ભોજન આપી મોક્ષ તરફ આગેકુચ કરવાની તાકાત આપે છે. તેથી જીવ પોતાના મોક્ષનગરે પહોંચી જાય છે. કેવી રીતે ?

પરમાત્માએ ભવ્ય જીવને એ સાધના આપવા દ્વારા (૧) જીવને સંસાર સમુદ્રમાંના રાગદ્વેષમોહાદિ મોટા મગરમથ્રો સામે જીતારી એની પકડમાંથી છોડાવે છે; (૨) અજ્ઞાનાદિના જગ્યી સમુદ્ર તરાવે છે, તરી પાર કરાવે છે; (૩) કેવળજ્ઞાનદુપી અનંત બોધ કરાવે છે; અને (૪) અંતે સર્વ કર્મશત્રુથી મૂકાવી મોક્ષે પહોંચાડે છે ! તો આવા પરમાત્માના કેવા અગાધ્ય નિર્સીમ ઉપકાર !!

### ● શ્રી અરિહંત પ્રભુએ વિશેષ શું આપ્યું ? ●

હવે જરા બીજા કહેવાતા પરમાત્મા કરતાં તીર્થકર પરમાત્મા શ્રી વીતરાગ સર્વજ્ઞ અરિહંત ભગવાનનો મુખ્ય ઉપકાર જે વિશેષ ઉપદેશ કર્યાનો છે, તે ઉપદેશની થોડી વિશેષતાઓ જોઈએ. એથી બરાબર સમજાશે કે ‘ખરેખર ! આવા ઉપદેશ કરનાર જ સાચા સર્વજ્ઞ અને વીતરાગ હોય. તેથી જ એજ એક માન્ય, પૂજ્ય અને શ્રેદ્ધેય હોઈ શકે. તેથી હવે બીજાની મિથ્યા આસ્થાઓ મૂકી એમનું જ શરણ લઈએ; એમના જ ફરમાવેલા માર્ગે ચાલીએ.’

**સ્યાદ્વાદનો સિદ્ધાંત :-** શ્રી જિનવાણીની પહેલી બક્ષીસ સ્યાદ્વાદ સિદ્ધાંતની છે. સ્યાદ્વાદ કહો કે અનેકાન્તવાદ કહો, એકજ વસ્તુ છે. એ કહે છે કે જગતની પ્રત્યેક વસ્તુ ને પ્રત્યેક ઘટના કોઈ એકાન્ત ધર્મવાળી નહિ પણ અનેકાન્ત ધર્મવાળી છે. અર્થાત્ એમાં રહેલ ધર્મનો સમોવડીયો ધર્મ પણ એમાં છે. અનું કારણ સ્પષ્ટ છે. વસ્તુ માત્ર જે સ્વરૂપે છે તે પોતાના ઉપાદાનદ્વય-ક્ષેત્ર-કાળ-ભાવના હિસાબે છે, પણ નહિ કે બીજાના ઉપાદાનદ્વય-ક્ષેત્રાદિ હિસાબે. તેથી વસ્તુ કે ઘટના માત્રાનું સ્વરૂપ એકી વખતે એકી સાથે વિરુદ્ધ દેખાતા એવા પણ ‘છે’ અને ‘નથી’

જેવા ધર્મોથી સંકળાયેલું જણાશે. ઘડો માટીનો છે એમ દેખાય છે, તેવી રીતે સુતરનો નથી, તન્તુમય નથી એ પણ પ્રત્યક્ષિદ્ધ છે. તેથી માટીમયતાનું અસ્તિત્વ અને તન્તુમયતાનું નાસ્તિત્વ બંનેય ધર્મો ઘડામાં છે. જો આમાંથી કોઈ એક જ ધર્મ છે એમ કહે તો તે એકાન્તિક કથન હોવાથી મિથ્યા થાય. ઘડામાં આવા તો કેઈ યુગલ ધર્મો છે; જેવા કે નાનાપણું-મોટાપણું, જૂનાપણું-નવાપણું, ઉજળાશ-ઝાંખાશ. એવી રીતે પિતામાં પિતાપણા સાથે પુત્રપણું પણ છે જ. જેમ વસ્તુમાં, તેમ ઘટનામાં પણ એવું છે. દા.ત. ઉત્પત્તિની ઘટના એ સાથોસાથ વિનાશથી અને ધ્રુવતાથી સંકળાયેલી છે. નવાની ઉત્પત્તિ, જૂનાનો વિનાશ; અને મૂળભૂત દ્વયની ધ્રુવતા. (કાયમીપણું) આ ગ્રણે એકી સાથે એક જ વસ્તુમાં બને છે. સોનાના કડામાંથી કુંલ ઉત્પન્ન થયું, ત્યાં કડાનો વિનાશ કુંલની ઉત્પત્તિની સાથે જ છે; તેમ મૂળભૂત પદાર્થ સુવર્ણની ધ્રુવતા પણ સાથે જ છે. એટલે, સુવર્ણ ઉત્પન્ન પણ થાય છે (કુંલરૂપે), ને નાશ પણ પામે છે (કડારૂપે) આવા વ્યવહારમાં ઢગલાંબંધ દાખલા મળે. બરફી સારી છે નિરોગી માટે; ખરાબ છે રોગીને માટે. આ સ્યાદ્વાદ છે.

શ્રી અરિહંતદેવે આપેલા બીજા વિશેષ સિદ્ધાન્તોમાં નયવાદ, ભેદાભેદવાદ, પંચકારણવાદ, કર્મસિદ્ધાન્ત, આત્મોઽકાન્તિ અને ચૌદ ગુણસ્થાનકનો સિદ્ધાન્ત...વગેરે સિદ્ધાન્તો સમગ્ર વિશ્વમાં ખૂબ અસાધારણ કોટિના છે. એવા કે જૈન દર્શનના જ આ ખાસ ખજાના કહી શકાય.

### ● નયવાદ ●

જગતના ઈતર દર્શનો પ્રમાણજ્ઞાનને માને છે, પણ નયજ્ઞાનની એમને ગંધ સરખી નથી; અને નયજ્ઞાનની સત્તા જુદી છે ખરી. કેમકે પ્રમાણ વસ્તુને સમગ્રરૂપે સર્વાશરૂપે જુદે છે, ત્યારે નયજ્ઞાન વસ્તુને અંશે જુદે છે. દા.ત. ચક્ષુ ખોલી અને જ્ઞાન થયાં ‘આ ઘડો’ ‘આ અજિન...’ વગેરે, આ પ્રત્યક્ષ પ્રમાણજ્ઞાન કહેવાય. અથવા ધૂમાડો જોઈ કલયું ‘અહીં અજિન હોવો જ જોઈએ,’ આ અનુમાન પ્રમાણજ્ઞાન કહેવાય. પણ જે એવું જ્ઞાન થયું કે ‘ઘડો મોટો છે,’ એ ઘડાનું અંશે જ્ઞાન છે. કેમકે ઘડામાં અમુક અપેક્ષાએ ‘મોટાપણું’ અને અમુક અપેક્ષાએ ‘નાનાપણું,’ એમ બે અંશ છે. એમાંથી એક અંશે ઘડાને જાણ્યો. અને પ્રમાણજ્ઞાન તો કહેવાય નહિ. નહિતર પછી પ્રમાણજ્ઞાનના વિષય તરીકે જેમ ઘડો એટલે ઘડો જ, અઘડો નહિ, એમ મોટો એટલે મોટો જ, નાનો નહિ. પણ ઘડો તો નાનો પણ છે, તેથી મોટા તરીકેનું જ્ઞાન સમગ્રાંશે નથી એટલે એને પ્રમાણજ્ઞાન નહિ કહેવાય. ત્યારે એને

અપ્રમાણ જ્ઞાન પણ નહિ કહેવાય. કેમકે ‘અપ્રમાણ’ એટલે તો જૂદું જ્ઞાન. આ કાંઈ જૂદું જ્ઞાન નથી. ત્યારે પ્રશ્ન થાય કે એ છે શું ? જેમ દા.ત. સમુદ્રમાંના એક ભાગ માટે પ્રશ્ન પૂછ્યા કે ‘બોલો ભાઈ, આ સમુદ્ર છે કે અસમુદ્ર ?’ તો શું કહેવાય ? જો સમુદ્ર કહો તો એવા તો ત્યાં કેટલાય ભાગો છે, તો શું દરેક ભાગ એ એક સમુદ્ર, એ હિસાબે તેટલી સંખ્યામાં ત્યાં સમુદ્રો સમજવા ? ના, સમુદ્ર તો એક જ છે. ત્યારે પછી એ ભાગને શું અસમુદ્ર કહેવો ? એમ કહીએ તો બધાય ભાગો અસમુદ્ર કહેવાથી કુલ મળીને પણ સમુદ્ર નહિ બને. દા.ત. સો માણસમાંનો જો દરેક દરેક હિંદુ નથી, અહિંદુ છે, તો એ સોનો સમૂહ પણ અહિંદુ જ રહેશે. એવી જ રીતે અસમુદ્ર પણ નહિ કહેવાય. ત્યારે એ છે શું ? કહેવું જોઈએ કે એ ‘સમુદ્રકદેશ’ (સમુદ્રનો એક દેશ) છે, અને સમગ્ર સમુદ્રથી ભિન્નાભિન્ન છે. એવી રીતે નયજ્ઞાન એ પ્રમાણજ્ઞાન નથી, અપ્રમાણ પણ નથી. પ્રમાણથી જૂદું સ્વતંત્ર જ્ઞાન છે.

પ્ર.- સમુદ્રકદેશના દસ્તાન્તથી તો ‘ઘડો મોટો છે’ એ જ્ઞાનને ‘પ્રમાણોકદેશ’ કહો, જૂદું ‘નયજ્ઞાન’ કેમ કહો છો ?

ઉ.- ટોકરી અવસરે લગાવી. પણ એ સમજે કે સમુદ્રમાં તો ભાગો છે, અહીં ‘ઘડો’ એવા પ્રમાણજ્ઞાનમાં ભાગો નથી કે જેથી એક ભાગને પ્રમાણોકદેશ કહી શકીએ. મોટાઈ-નાનાઈ એ તો ઘડાના અંશ છે, જ્ઞાનના નહિ. તો પ્રશ્ન છે કે અંશે જણાતા ઘટના જ્ઞાનને શું કહેવું ? માટે એને જૂદું ‘નયજ્ઞાન’ માન્યું. શ્રી અરિહંત પરમાત્માએ જ આ બતાવ્યું છે એ એમનો વિશિષ્ટ ઉપકાર છે.

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદ્ધિ”

વર્ષ-૪, અંક-૨૮, તા. ૩૧-૩-૧૯૫૬



## ૧૫ શ્રી અરિહંત પરમાત્માની ઓળખાણ

નયજ્ઞાન અંશને પકડે છે; માટે એને અપેક્ષા રહે છે. તેથી નયવાદને અપેક્ષાવાદ કહેવાય. એ વસ્તુમાં રહેલા અનેકાનેક સામસામા ધર્મોને ન્યાય આપે છે. એ ધર્મો જે જે અપેક્ષાએ છે, તેને તેને ‘દિલ્લી’ પણ કહે છે. એથી નય જુદી જુદી દિલ્લીમાં વહેંચાઈ જાય છે. દા.ત. દ્રવ્યાર્થિકદિલ્લી પર્યાર્થિક દિલ્લી; અલંકાર દ્રવ્યાર્થિક દિલ્લીએ નિત્ય છે, કેમકે અલંકારનું મૂળ દ્રવ્ય સોનું, એ કાયમ રહેનારું છે; પણ એજ અલંકાર પાછું પર્યાર્થિક દિલ્લીએ અનિત્ય છે, કેમકે એ કું મટી જાય

છે, અને કંઈ રૂપે બને છે. આ નયજ્ઞાનની વિશેષતા છે. એવી રીતે કારણદાસ્તિ-કાર્યદાસ્તિ નિશ્ચયદાસ્તિ-વ્યવહારદાસ્તિ-એને જ નય કહી શકાય. એવા બીજા નયો જ્ઞાનન્ય-કિયાન્ય; દ્રવ્યન્ય-ભાવન્ય; વગેરે યુગલો છે. તેમ, મૂલ સાત નયો નેગમ-સંગ્રહ-વ્યવહાર-જ્ઞાન્સૂત્ર-શબ્દ (સાંપ્રત) -સમભિરૂઢ-એવંભૂત, એ નામે છે. એ દરેક નય વસ્તુનું જુદી જુદી ઠબે દર્શન કરે છે, અને એકેકમાંય પાછા દર્શનભેદ પડવાથી અનેક પ્રકાર બને છે. પ્રશ્ન કરવામાં આવ્યો ‘આપણે ક્યાં રહીએ છીએ ?’ તો એ વિવિધ નયની દિલ્લીએ આ પ્રશ્નના વિવિધ જવાબ મળે છે; ‘લોકમાં રહીએ છીએ.’ ‘મધ્ય લોકમાં રહીએ છીએ.’ ‘જંબૂદ્વીપમાં રહીએ છીએ’ ‘ભરતક્ષેત્રમાં...’ ‘દક્ષિણાર્ધભરતે’ ‘હિંદુસ્તાનમાં’ ‘મુંબઈ પ્રાંતમાં’ ‘મુંબઈ શહેરમાં’ ‘જવેરી બજારમાં’ એમ પણ જવાબ મળે છે ‘અમે તો ઉસ્તાદના માળામાં રહીએ છીએ, તમે ક્યાં રહો છો તે ખબર નથી.’ એથી પણ આગળ વધીને ‘ચોથે મજલે’ ‘અમુક નંબરની રૂમમાં...’ યાવત્ ‘હાલમાં તો હું પથારીમાં રહું છું.’ અને તત્ત્વદાષ્ટ વળી એમ ઉત્તર કરે છે કે ‘અવગાહિત આકાશ પ્રદેશમાં રહીએ છીએ’ ‘આપણા આપણા આત્મપ્રદેશમાં રહીએ છીએ.’ આટલા બધા ઉત્તર એટલે કે ‘રહેવા’ની વસ્તુના જ્ઞાન શાથી ? કહેવું પડે કે વસ્તુમાં અનેક અંશો છે, એની અનેક દિલ્લીઓ છે. એ એ દિલ્લી જૂદું જૂદું જ્ઞાન થાય એ સહજ છે. એ બધાં જ્ઞાન નયજ્ઞાન છે; પ્રમાણજ્ઞાન નહિ.

આ વિશેષતા સર્વજ્ઞ શ્રી અરિહંત પરમાત્મા સિવાય કોણે બતાવી છે ? જગત જો આજે આ નયવાદ અપેક્ષાવાદને અપનાવે તો કેઈ સમસ્યાઓ ઉક્લી જાય ! જગડા ટંટા શમી જાય ! એકેક કુટુંબમાં જગડા શાથી ? કોઈ પણ વસ્તુ કે પ્રસંગમાં તો અનેક અંશ છે. પરંતુ દરેક જગા પોતાની અપેક્ષાનો, પોતાની દિલ્લીનો અંશ જુએ છે, પણ સામાની અગર બીજી દિલ્લીનો અંશ નથી જોતો; તેથી જઘડો ઊભો થાય છે. શ્રી અરિહંત પ્રભુએ આ સર્વતોમુખી વસ્તુદર્શન શિખવી કેવો અદ્ભુત ઉપકાર કર્યો !

જૈન ધર્મ એ મૂળભૂત મહાધર્મ છે. જૈન દર્શન એ મહાદર્શન છે. એમાં બધી દિલ્લીઓને ન્યાય મળે છે. પણ મધ્યસ્થભાવ છોડી એકેક દિલ્લીને પકડીને બેંચાયેચય ચાલી એમાંથી જુદા જુદા એકાન્તવાદી અનેક ધર્મ નીકળ્યા, અનેક દર્શનો રચાયાં. એમણે તો પોતાનાથી સામેવાળાની દિલ્લીનો વિરોધ જ કર્યો, અને પોતાની જ એક દિલ્લીને સાચી માની; અને એમાં થતા જ્ઞાનને ‘પ્રમાણજ્ઞાન’ કહેવા માંઝું. નયજ્ઞાનની તો ગંધ સરખી ન રહી. પછી સ્યાદ્વાદીય ગંધ ક્યાંથી પામે ?

‘સ્યાદ્વાદ અને નય’ તો વસ્તુ કે પ્રસંગના સમન્વય સાધી આપે છે. તેમ એ બુદ્ધિમાં પણ બેસે એમ છે. માત્ર ભિથ્યાત્વનાં પડળ હઠી જવા જોઈએ. કોઈ કહે છે લાકડી નાની છે, કોઈ કહે છે મોટી છે. કોણ સાચું, કોણ ખોટું? સ્યાદ્વાદ કહે છે બંને સાચા હોઈ શકે. ત્યાં એનામાં અમુક બીજી મોટી લાકડીની અપેક્ષાએ અગર વર્તમાન જરૂરીયાતની અપેક્ષાએ નાનાપણાનો ધર્મ છે, અને અન્ય નાની લાકડીની અપેક્ષાએ કે અમુક આવશ્યકતાની અપેક્ષાએ એનામાં મોટાપણાનો ધર્મ છે. બંને અંશ છે. વ્યવહારમાં બીજે પણ આવું બને છે. દરજાએ સીવેલી ચડી નાના છોકરાના હિસાબે મોટી પડે છે, અને મોટા છોકરાના હિસાબે નાની પડે છે; તેથી છોકરાનો બાપ દરજાને કહે છે કે આ તો કંઈ જ કામની ન રહી; કેમકે એ આમ મોટી છે, ને આમ નાની છે. એક બીજું દષ્ટાન્ત જુઓ. આત્મામાં મૂળ સ્વરૂપની અપેક્ષાએ અનંતજ્ઞાન કાયમ છે, કર્મથી આવૃત્તતાની અપેક્ષાએ એ હંકાઈ જઈ, પ્રગતપણે અજ્ઞાનતા છે. અહીં જો અનંત જ્ઞાન કાયમ (અવિનાશ) ન માનવામાં આવે તો તદ્દન નાશ પામેલું અગર તદ્દન બીનહયાત હોઈ સ્વભાવ તરીકે પછી કદ્દિય અનંતજ્ઞાન પ્રગટી શકે નહિ. એમ વળી વર્તમાનમાં અજ્ઞાનતા આત્માની જ ન માનવામાં આવે તો પ્રશ્ન થાય કે જો એ અજ્ઞાન નથી તો પછી એ આજે કેમ સર્વજ્ઞ તરીકે બધું જોઈ જાણી શકતો નથી? માટે જ નયવાદથી સર્વજ્ઞતા-અજ્ઞાનતા બંનેય માનવી જોઈએ. બીજા દર્શનવાળાની દર્શિ એકલા પ્રમાણજ્ઞાન ઉપર દોડે છે, તેથી એ આત્માને કેવો કહે? જો અલ્પજ્ઞ કહે તો એટલો જ સ્વભાવ સમગ્રપણે થયો પછી ક્યારેય સર્વજ્ઞ ક્યાંથી બની શકવાનો? માટે જ નયજ્ઞાન જોઈએ. વળી ભલે એ નયવાદ, અપેક્ષાવાદનો વિરોધ કરે છે; પરંતુ પાછું એમને જ પોતાના શાસ્ત્રો અને પદાર્થોમાં અપેક્ષા લઈને ભિન્ન ભિન્ન ધર્મના સમન્વય-સમાધાન કરવા પડે છે. બૌધ્ધ, વેદાન્ત, ન્યાય વગેરે દર્શનો પર આ સંબંધમાં વિસ્તૃત વિચાર દાખલા સાથે થઈ શકે એમ છે. પણ એ મોટો વિસ્તાર માગે છે, જેને અહીં અવકાશ નથી. બાકી વિશાળ નયચક બતાવી શ્રી અરિહંત પ્રભુએ અનુપમ ઉપકાર કર્યો છે.

ભૈદાભેદવાદનો સિદ્ધાન્ત પણ જિન શાસનની વિશેષતા છે. વસ્તુ-વસ્તુના ધર્મ, કારણ-કાર્ય, વગેરેને બીજાઓ કાં એકબીજાથી કેવળ ભિન્ન માને છે, અગર કેવળ અભિન્ન માને છે, ત્યારે જિન શાસન ભિન્ન-ભિન્ન માને છે. દા.ત. વેદાન્તી કહે છે બ્રહ્મ (આત્મા) ખુદ જ્ઞાન સ્વરૂપ છે, ત્યારે ન્યાયદર્શની કહે છે કે આત્મામાં તદ્દન જુદો જ્ઞાન ગુણ છે, આમાં વેદાન્તીને એ દોષ આવે કે તો પછી આત્મા ‘જ્ઞાની’ એટલે કે ‘જ્ઞાનવાળો’ કેમ કહેવાય? તમારા મતે ‘આત્મા જ્ઞાન’

એવું હરે! નૈયાપિકને મતે ‘જ્ઞાનગુણવાળો’ બનવા છતાં એ દૂષણ લાગે કે જો જ્ઞાન આત્માથી તદ્દન જુદું પણ આત્મસ્વરૂપ નહિ તો આત્મામાં આત્માપણું શું? ચેતનપણાનો સ્વભાવ શો? પરંતુ જૈન શાસનને કોઈ દૂષણ નથી આવતું; કેમકે એ આત્માથી ભિન્ન-ભિન્ન જ્ઞાન માને છે. આ ભૈદાભેદથી ચેતન જીવ જ્ઞાનવાળોય બને છે અને જ્ઞાનસ્વભાવ પણ બને છે. જેમકે, એકલી સુંઠનો પિત દોષ છે, અને એકલા ગોળનો કંદ દોષ છે; પણ સુંઠ ગોળના યોગ્ય મિશ્રણથી બનેલ દ્વયમાં નથી રહેતો કંદ દોષ, ન પિત દોષ, પણ ઉપરથી વાતાદિ દોષ નિવારી એ ગુણકારક બને છે. એ સૂચયે છે કે એ બે દ્વયોનું માત્ર ભિન્નશા નથી, પણ કોઈ નવું જ દ્વય બન્યું છે. તેથી બંનેના દોષ ટળીને ઉપરથી ગુણ દેખાય છે.

### ● પંચકારણવાદ ●

પંચકારણવાદમાં જિનવચનનો વિજયંડકો છે. કોઈ ભિથ્યામતિ એકલા ઉપાદાન કારણને પકડી બેઠા; તો કોઈ બૌધ્ધ જેવા તાદાત્મ્ય તહુન્પત્તિ એ બેજ સંબંધ માની એકલા નિમિત્તને વળગી રહ્યા. ત્યારે કેટલાક નૈયાપિક વગેરે પ્રાગભાવ, અને ઈશ્વર વગેરે અસંગત કારણોમાં મુંજાઈ પડ્યા. જૈન દર્શને ૧ વસ્તુસ્વભાવ, ૨ ભવિતવ્યતા, ૩ કાળ, ૪ કર્મ અને ૫ પુરુષાર્થ એમ પાંચ કારણનો સમવાય (કાર્ય બનવા માટે સહમીલન) માન્યો. દા.ત. ચીકળી માટીમાંથી જ ઘડો બને પણ રેતીમાંથી નહિ, એ માટીનો ‘સ્વભાવ’ કારણ. માટી પડી છે પણ એમાં પાણી પજળવાનો તથા એ ગુંદળવાનો અમુક કાળ થાય ત્યારે જ રીતસર ઘડો બને છે. તો એ ‘કાળ’ કારણ બન્યો. અમુક અમુક ચોક્કસ કાળ વિલંબે થતા ઋતુના ફળ, ગર્ભનો પરિપાક, ટાઈઝોઇડ વગેરે તાવનું પાકવું-ઈત્યાદિ ‘કાળ’ને આધીન છે. હવે કાળથી તૈયાર માટી પણ, કુંભારનું ‘પુરુષકર્મ’ હોય અને કુંભારનો ‘પુરુષાર્થ’ હોય તો જ ઘડારૂપે થાય છે. એમાંય ભાગ્ય અને ઉદ્યમ બંને એકરૂપે હ્યાત છતાં ઘડા ઘડામાં સહેજ ફરક હોય છે, ભદ્ધીમાંથી પાડીને નીકળે તેમાંય ઘડાને કયાંક કાળું કે એવું ધાબું, તો બીજાને બીજે ધાબું, આવા ફરક પડે છે, એમ કેમ? તો કે ત્યાં તેવી તેવી ભવિતવ્યતાને કારણ કહેવું પડે; નહિતર પ્રશ્નનું સમાધાન ન થાય. વીર પ્રભુએ, ગોશાળાને ઓળખવા છતાં તેમ પોતે કશું અનુચ્ચિત ન કરાઈ જાય એવા જાગ્રત છતાં, એને તેજોલેશ્યા શિખવી, એ ભવિતવ્યતા. નિમિત્ત કારણો કુંભાર, ચાક, પાણી, દંડાદિ અને ઉપાદાન કારણ માટી પાંચમાં સમાઈ જાય છે, તેથી એને જુદા ન ગણ્યા. દા.ત. માટીનો જ સ્વભાવ છે કે એના લોચાને ગોળાકાર આપીને ઘડો કરી શકાય. એમ સ્વભાવના ઘરમાં માટી સમાશે.

માટીનો જ સ્વભાવ ઘડો બનાવવાનો છે. ત્યારે એ પણ છે કે કુલારનો પ્રયત્ન, એ પુરુષાર્થમાં ગણાશે. તેમ પુણ્યકર્મ હોય તો એને એ બધી સામગ્રી ચક, દંડ, વગેરે મળી શકે; પાછું ઘડાનો માલિક થવાનું પુણ્ય હશે તો ઘડો બનશે, નહિતર ઘડો બનાવતાં વચ્ચમાં જ કોઈ રોગાદિ ઉપદ્રવમાં એ સપદાઈ જશે. આમ કર્મ (ભાગ્ય) આગળ આવ્યું; અને એના પેટામાં બીજી સામગ્રી રહી. આવી રીતે પંચકારણવાદની વિશેષતા થઈ.

### ● કર્મસિદ્ધાન્ત ●

જેને બીજા અદદ કહે છે, ભાગ્ય કહે છે, એવા કર્મનો સિદ્ધાન્ત(Theory) તો જૈનોનો જ. શ્રી જિનેશ્વરદેવે અસાધારણ કોટિની કર્મની મહા-સૂક્ષ્મતા અને મહાવિસ્તાર વર્ણયો છે. કર્મના પ્રકૃતિ-સ્થિતિ રસ-પ્રદેશ બંધ, તેવા જ ઉદ્ય-ઉદ્દીરણા-સંકમણ-ઉદ્રત્નાદિ-નિદ્રત્તિ-નિકાયના, સત્તા, ઉપશમના, ને ક્ષપણા, પ્રકૃત્યાદિમાં મૂળભેદ-ઉત્તરભેદ, ધાતી-અધાતી, પુણ્ય-પાપ, પરાવર્તમાન-અપરાવર્તમાન, શ્રુત્વબંધી શ્રુત્વ ઉદ્ધ્ય, પુદ્ગલ વિપાકી, જીવવિપાકી,...વગેરે અનેકનેક વિષયો એમાં આવે છે. કર્મ સિદ્ધાન્તની આવી જટિલ યાન્ત્રિકતાને (મશીનરીને) સમજાવનારા શાસ્ત્રો જૈન ધર્મમાં જ છે. એ શાસ્ત્રોનો અભ્યાસ કરનારને એ સમજાય એવું છે કે સર્વજ્ઞ વિના કર્મની આવી સૂક્ષ્મ મર્શીનરી બીજો કોઈ જીતે પ્રત્યક્ષ પણ ન કરી શકે, અને મૂલતા: ઉપદેશી પણ ન શકે. એનું કારણ એ છે કે આત્મા પર જન્મોજન્મના લાગેલા અનંતા કર્મસંક્ષો એટલા બધા સૂક્ષ્મ છે કે એમાં શ્રી પ્રક્રિયા બધાતી વખતે ચાલી હોય છે, સંકમણ સ્થિતિઝ્લાસ-સ્થિતિવૃદ્ધિ વખતે ચાલી હોય છે, રસ-હ્લાસ-રસવૃદ્ધિ વખતે અને નિદ્રત્તિ-નિકાયના-ઉદ્દીરણા વગેરેમાં ચાલી રહી હોય છે, એ ર્યામ્યક્ષુથી અદદય અને તર્ક કલ્પનાથી અચિંત્ય છે. માટે જ મૂળ જોનાર-કહેનાર તરીકે સર્વજ્ઞ ભગવાન જ જોઈએ. એટલે એ શાસ્ત્રોને મૂળમાં કહેનાર અરિહંત પ્રભુ સર્વજ્ઞ પૂરવાર થાય છે. ત્યારે, એમણે કેવો સુંદર કર્મવાદ કહ્યો ! એવો કે જેમાં જીવનમાં આકસ્મિક જેવી બનતી અનેકનેક વિચિત્ર ઘટનાઓનાં સમાધાન મળે છે; એટલું જ નહિ પણ સમસ્ત વિશ્વનું સંચાલન કેવી રીતે ચાલી રહ્યું છે, એનું સચોટ અને સુજ્ઞેય સ્પષ્ટીકરણ મળે છે. જે લોકો વિશ્વકર્તા અને વિશ્વ સંચાલક તરીકે ઈશ્વરને માને છે, અભનેય જ્યાં ઠેર ઠેર અટકી જવું પડે છે. ત્યાં સમાધાન કર્મવાદથી જ સુંદર સુયુક્તિક અને સચોટ થાય છે. દા.ત.

### ● ‘ઈશ્વર કર્તા’ માનનારને પ્રશ્નો ●

- (૧) સર્વ શક્તિમાન ઈશ્વરના રાજ્યમાં સ્વપ્રયત્ન, બીજ, ધરણી વગેરે સમાન છતાં પાકમાં નાના-મોટા દાઢા કેમ પાક્યા ?
  - (૨) જગત દ્યાળું ઈશ્વરના સામ્રાજ્યમાં અજ્ઞાન ગુનેગારને કેમ દ્યાથી માફી અને વાત્સલ્ય નહિ ?
  - (૩) સર્વજ્ઞ અને સર્વહિતકામી જગતકર્તા ઈશ્વરની હાજરીમાં જીવો કેમ જ નવા ગુના કરી શકે ? સમજુ અને હિતેથી માતા પુત્રને ગુનો કરતાં જ અટકાવે છે, તો ઈશ્વર તો સર્વ શક્તિમાન હોવાથી કેમ પહેલેથી ન અટકાવે ?
  - (૪) દ્યાળું ઈશ્વર પાપની સામગ્રી કેમ આપે છે ?
  - (૫) ઈશ્વરે સૂચિ સર્જ તો અમુક વખતે જ કેમ સર્જ ; અને
  - (૬) સૂચિની પ્રારંભમાં જ જીવોને ઊંચા-નીચા સ્થાન કેમ આપ્યા ?
- આ બધી સમસ્યાઓનો ઉકેલ કર્મવાદમાં જ મળી શકે છે. તેથી જ જગતકર્તૃત્વ ઈશ્વરનું ખોઢું છે; કર્મનું સાચું છે. અર્થાત્ ખરેખરી રીતે કર્મ એ જગતકર્તા છે, પણ નહિ કે ઈશ્વર. ઉકેલ આ મુજબ છે.

### ● ઈશ્વર પર પ્રશ્નોના ખુલાસા ●

- (૧) પાકમાં નાના મોટા દાઢા થાય છે ત્યાં દરેક દાઢો એ કોઈને કોઈ જીવનું શરીર છે, અર્થાત્ દાઢા એ જુદા જુદા જીવે ધારણ કરેલા શરીર છે. એમના દરેકના કર્મ જુદા છે, તેથી શરીર નાના-મોટા વગેરે જુદી જુદી સ્થિતિવાળા બને છે.
- (૨) વીતરાગ પરમાત્મા જગતદ્યાળું છે, તે નિષ્પક્તપાતપણે હિતનો માર્ગ બતાવનાર તરીકે અને પોતાનું અનંત સુખદાયી અચિંત્ય શક્તિવાળું જે સ્વરૂપ તેનું આલંબન આપનાર તરીકે દ્યાળું છે. તેથી એમને બીજી દ્યા કરવાની નથી. તેમ એ વીતરાગ છે. તેથી એમને શિક્ષા કરવાનીય નથી, અને ઈનામ પણ આપવાનું નથી. તેમ એ કૃતકૃત્ય છે, તેથી બીજાનાય સંસારની ખટપટમાં એમને પડવાનું નથી. ઈશ્વરની દરમિયાનગીરી ન હોય, છતાં અજ્ઞાનવશ ગુનો કરનાર જીવને ગુનાના પ્રમાણમાં સજ્જિલા કર્મ જે ફળ ભોગ આપે છે, એને કોણ અન્યથા કરી શકે ? દા.ત. માતા સજી કરવા ન જાય તોય તોઝાન કરતાં પડનાર બાળકને વાગવાની સજી થાય જ છે.
- (૩) જીવ નવા ગુના કરે છે તેમાં એક કારણ એનો નવો અસ્ત્ર પુરુષાર્થ

(યોગનું વીર્ય) છે; અને બીજું કારણ એવા સંયોગ સ્થિતિમાં મૂકનારા એનાં પૂર્વના કર્મ છે. તેથી જ જગત્કર્તા ઈશ્વર નપુંસક ઠરે છે. અને વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા એવા અસત્પુરુષાર્થથી બચાવી લેવા જીવોને સર્જર્મ અને તત્ત્વો ઉપદેશી મહાન ઉપકાર કરે છે.

(૪) કર્મવાદમાં કોઈ અમૂક કાળ પહેલાં કશું જ નહોતું અને પછી એકાએક સૂછિ બની, એવું નથી; પણ અનાદિ કાળથી કર્મની સાથે બીજા બીજા કારણો હોવાને લીધે, અમુક દસ્તિએ નિયત અને અમુક દસ્તિએ ચિત્ર વિચિત્ર જગત ચાલ્યું આવે છે. અર્થાત્ જીવો તેવા તેવા પૂર્વકર્મના હિસાબે અહીં જન્મતા પૃથ્વી, પાણી, તેજ, વાયુ, વનસ્પતિ કીડા, ઢોર મનુષ્ય વગેરેના શરીર બનાવે છે. અને કર્મના હિસાબે સામશ્રી સંસ્કારો અનુભવતાં નવાં કર્મ ઉપાર્જ છે, તેથી પાછા નવાં જન્મ પામે છે. આમાં પૂર્વપૂર્વનું વિચારવા જતાં જીવમાં અનાદિનો કર્મસંબંધ યુક્તિયુક્ત ઠરે છે. તેથી જ જગત પણ અનાદિસિદ્ધ ઠરે છે.

આમ કર્મવાદથી જગતનું સંચાલન સમજાવા સાથે સ્વજીવનમાં પણ સુખદુઃખ, માન-અપમાન, યશ-અપયશ વગેરે અનેકાનેક બાબતોના સમાધાન મળે છે. એવા કર્મવાદમાં દરેક કર્મ કેવી કેવી રીતે બંધાય, ભોગવાય વગેરે જીણવટથી કહેનાર શ્રી અરિહંત પરમાત્માનો કેટલો અગાધ અપરંપાર ઉપકાર !! કોટિકોટિ નમન હો એ ત્રિલોકનાથ સૂર્યને !

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદ્વિ”

વર્ષ-૪, અંક-૨૮, તા. ૭-૪-૧૯૫૬

## ૧૬ શ્રી અરિહંત પરમાત્માની ઓળખાણ

### ચૌદ ગુણસ્થાનક :- આત્મઉત્કાન્તિકમ

આનો વિશિષ્ટ સિદ્ધાંત પણ શ્રી સર્વજ્ઞ જિનેશ્વરદેવના ધરમાં જ છે. ઉત્કાન્તિ એટલે ઊંચી ઊંચી ભૂમિકાએ ચદ્વાંતું તે. શ્રી જિનેન્દ્રના શાસનમાં ઉત્કાન્તિના ચૌદ ગુણસ્થાનક છે. એમાં વિશ્વભરના લગભગ સંઘળા જીવો પહેલે ‘મિથ્યાત્વ’ ગુણસ્થાનકે છે. એમાં જેનું મિથ્યાત્વ મંદ પડ્યું છે, જે ચરમાવર્તકાળમાં આવ્યો છે, અને આત્મામાં અમુક શુદ્ધિકારક મોક્ષરુચિ, ભવદ્વેષ, પાપભય, અપુનર્ભક્તતા, વગેરે ગુણો જેને પ્રગટ થયા છે, તેના એ ગુણોની અપેક્ષાએ મિથ્યાત્વ અવસ્થાને પણ ‘ગુણ સ્થાનક’ કહેવાય છે. એ પછી આગળ ચોક્કસ પ્રકારના શમ-સંવેગાદિ,

સમ્યક્તવ-દેશવિરતિ, આદિગુણોથી આત્મામાં અમુક અમુક જાતની વિશુદ્ધિ આવતી જાય છે, તેમ તેમ ઉપર ઉપરના ગુણસ્થાનકે આત્મા ચઢતો જાય છે, ત્યાં સુધી કે અંતે ચૌદમા ગુણસ્થાનકની પરાકાણાએ પહોંચીને જીવ મોક્ષ પામે છે. આત્મામાં મિથ્યાત્વ વગેરે અમુક જાતના ચોક્કસ દોષો છે. (એનું વર્ણન નીચે છે.) એથી સમયે સમયે આત્મા કર્મથી બંધાય છે. એ દોષોની ઓછાશ થતા થતા ઊંચા ઊંચા ગુણસ્થાનક પામી શકાય છે. જે અવસ્થામાં મિથ્યાત્વ દોષ ઉદ્યમાં નથી, પણ અનંતાનુંબંધી કષાય ઉદ્યમાં છે, ત્યાં ‘સાસ્વાદન’ નામનું બીજું ગુણસ્થાનક હોય છે. મિથ્યાત્વ સાથે જ્યાં અનંતાનુંબંધી નામના પહેલા અતિ ઉત્ત્ર કષાયનો ઉદ્ય પણ ટળે છે, અને છતાં તત્ત્વ ઉપર હજુ આકર્ષણ નથી જગ્યું, તેમ અના પ્રયે અરુચિય નથી, ત્યાં ત્રીજું ‘મિશ્રગુણસ્થાનક’ છે. સર્વજ્ઞોક્ત તત્ત્વરુચિ જગતાં ‘સમ્યક્તવ’ નામનું ચોથું ગુણ પમાય છે. એમાંય વળી બીજા નંબરના ઉત્ત્રકોટિના અપ્રત્યાખ્યાનીય કષાયનો ઉદ્ય ટળે છે ત્યારે શ્રાવકના બાર પૈકીના વ્રત લેતાં પાંચમું ‘દેશવિરતિ’ ગુણસ્થાનક આવે છે; ત્યારે મધ્યમ પ્રત્યાખ્યાનાવરણ કષાયનો ઉદ્ય ટળી સર્વવિરતિભાવ પ્રાપ્ત થતાં છઈ પ્રમત્તા’ (સંયત) નામનું ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. હજુ પ્રમાદ હોવાથી ‘પ્રમત્તા’ કહેવાય છે. પછી પ્રમાદ ટળતાં ‘અપ્રમત્તા’ નામનું ઉમું...એમ દોષો ટળતાં, ને ગુણજન્ય આત્મશુદ્ધિ તથા ધ્યાનધારા વધતાં ઉપર ઉપરના ૮-૯-૧૦માં ગુણસ્થાનક ‘અપૂર્વકરણ’ ‘અનિવૃત્તિ’ ‘સૂક્ષ્મસંપરાય’ નામે પ્રાપ્ત થાય છે. દશમા ગુણસ્થાનકના અંતે કષાયનો તદ્દન અનુદય થાય છે. ત્યારે આત્મા વીતરાગ બને છે. એ જો કષાયને તદ્દન શાંત કરીને હોય તો ૧૧મે ‘ઉપશાંત મોહ’ કહેવાય છે, અને તદ્દન નાશ કરીને હોય, તો ૧૨મે ‘ક્ષીણમોહ’ વીતરાગ કહેવાય છે. બારમા ગુણસ્થાનકને અંતે સર્વથા અજ્ઞાનાદિ ટળી, ૧૩મા ગુણસ્થાનકના પહેલા સમયે આત્મા સર્વજ્ઞ કેવળજ્ઞાની ‘સયોગી કેવળી’ બને છે. ત્યાં હજુ વચન-કાયાની અને કવચિત્ દ્રવ્યમનની પ્રવૃત્તિરૂપ યોગ છે, તેથી ‘સયોગી’ કહેવાય છે. આયુષ્યની સમાપ્તિ અને મોક્ષગમનના પાંચ હુસ્પોન્યારણ જેટલા સમય પૂર્વે એ મન-વચન-કાયાના બાદર અને સૂક્ષ્મ યોગનો નિરોધ થઈને શૈલેશ (મેરુ) જેવા બેનેલ આત્માને ૧૪મું ‘અયોગી કેવળી’ ગુણસ્થાનક લાયે છે. ત્યાં અંતે સર્વ અધાતી કર્મનો ક્ષય થઈ તરત જ પરમપદ-મોક્ષની અવસ્થા પ્રગટે છે; જે હવે શાશ્વતકાળ માટે ટકે છે. આ ગુણસ્થાનકો અંગે પણ મહાવિસ્તૃત સૂક્ષ્મતાભર્યો અને અનેક અવાન્તર વિષયોથી ભરચક વિચાર સર્વજ્ઞના શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે; અને એમજ ઉત્કાન્તિની નિસરણીએ ચઢતાં ચઢતાં ઠેઠ મોક્ષ અવસ્થાએ પહોંચી શકાય છે.

## ૧૭ શ્રી અરિહંત પરમાત્માની ઓળખાણ

### • વિશિષ્ટ(કોટિનો) બંધહેતુ સિદ્ધાંત •

સંસારી આત્મા અનાદિકાળથી કર્મના બંધનથી બંધાયેલો છે; તેથી જ એ અનાદિકાળથી સંસાર અર્થાતું સંસરણ કરી રહ્યો છે; તિન્ન તિન્ન યોનિઓમાં જ્ઞાનણ કરી રહ્યો છે. આ કર્મબંધન ચોક્કસ પ્રકારના હેતુઓથી ચોક્કસ રૂપમાં થાય છે. એ હેતુઓ મુખ્યપણે મિથ્યાત્વ-અવિરતિ-કષાય અને યોગ એમ ચાર પ્રકારે અથવા એમાં ‘પ્રમાદ’ ભજીને પાંચ પ્રકારે છે. મિથ્યાત્વ=અતાવને તત્ત્વ માનવું તે. અવિરતિ=હિંસાદી પાપો પ્રતિજ્ઞાપૂર્વક બંધ ન કરવા તે. કષાય=કોષ-માન-માયા-લોભ-હાસ્ય-શોક...વગેરે. યોગ=મન-વચન-કાયાની પ્રવૃત્તિ. આમાં પહેલો હેતુ જે મિથ્યાત્વ, એના અનાભોગિકાદિ પાંચ, લૌકિકાદિ છે, એવા ખાસ ખાસ પ્રકારો છે, અને એથી ચોક્કસ પ્રકારના કર્મનો બંધ અવશ્ય થાય છે. એ વસ્તુ તથા એનો વિસ્તૃત વિચાર શ્રી સર્વજ્ઞ પરમાત્માના શાસનમાં જ વર્ણવાયો છે. બીજાને તો મિથ્યાત્વના પ્રકારો અને એના સ્વરૂપની તથા એથી કેવી કેવી જુદી પરિસ્થિતિમાં એટલે કે પૃથ્વીકાયાદિ એકેન્દ્રિય જીવો, દ્વિન્દ્રિયાદિ જીવો અને પંચેન્દ્રિય જીવોના ચાર પ્રકારોમાં કેવા કેવા કર્મના પ્રકારો બંધાય છે એની કશી ખબર નથી. ત્યારે બીજો અવિરતિ નામનો હેતુ અને એના પ્રતિપક્ષી તરીકેનો ગુણ જે ‘વિરતિ’ એ પણ તત્ત્વ શ્રી સર્વજ્ઞ ભગવાનની દાખિમાં જ છે.

### • (વિશિષ્ટ) વિરતિવાદ •

બીજાઓ તો કહેશે કે પાપકાર્ય સેવીએ તો પાપ લાગે; અશુભ ભાગ્ય ઉપાર્જિય; ન સેવીએ તો કાંઈ નહિ. ત્યારે જૈન શાસન કહે છે કે ભવે પાપકાર્ય સેવો નહિ છતાં જ્યાં સુધી એના ત્યાગની પ્રતિજ્ઞા અર્થાતું વિરતિ લઈ અનાદિ કાળથી ચાલી આવતી પાપ-કાર્ય સાથેની આત્માની આંતરિક છેડાગાંઠ (અ-વિરતિ) ન ત્યજાય ત્યાં સુધી પણ અશુભ કર્મ આત્મા પર બંધાવાનું બને છે. આમાં યુક્તિ અને કારણ પણ છે. પાપ ન સેવવા છતાં, તેમ સેવવાનું સારુંય ન લાગવા છતાં, જો મનમાં ક્યારેક પણ એ પાપ સેવવાની અપેક્ષા છે, તો તેથી તો પાપ-ત્યાગની

પ્રતિજ્ઞામાં ન આવતા છૂટા રહેવું ગમે છે. તેથી એ ભાવી પાપ-કાર્યની અપેક્ષા ઉપર કર્મબંધનો થાય એ સહેતુક છે. અથવા અજ્ઞાનતાના કારણે જ જો એ પ્રતિજ્ઞા નથી, તો એ પણ જીવની નબળાઈ છે, અને એથીય ધરખમ કર્મના બંધન આત્મા પર લદાય છે. આ સિદ્ધાંત અવિરતિ-વિરતિવાદનો છે. દા.ત. જિંદગીમાં તમે દારુ પીધો નથી, તેમ પીવાનું પસંદ પણ નથી કરતા; છતાં જો ‘જિંદગીભર દારુનો સર્વથા ત્યાગ’ એવી પ્રતિજ્ઞા કરવાનું કહેવામાં આવે, તો કેમ પાછા હઠો છો ? મનને એમ થાય છે ને કે ‘દારુ પીવો તો નથી, પણ કદાચ ક્યારેક દવા તરીકે પીવાનો પ્રસંગ આવે તો શું થાય ? તેથી પ્રતિજ્ઞા તો ન કરવી;’ આવું થાય છે ન ? તો એટલી પણ ક્યારેક પાપ કરવાની દિલમાં જે અપેક્ષા રહી એ પણ અવિરતિ નામનું બંધ સ્થાનક છે; એવા અનેકાનેક પાપના અને પાપસાધનોના હિસાબે ઘોર અવિરતિ નામનો દોષ આત્મામાં ઊભો રહ્યાથી થોકબંધ કર્મબંધ થાય છે. માટે જ એ ટાળવા વિરતિ નામનો ગુણ અતિ જરૂરી છે. અહીં એક ખૂબી એ છે કે કોઈએ અવિરતિ ટાળવા હિંસાદી પાપ-ત્યાગની પ્રતિજ્ઞા લીધી. પણ હજુ એનામાં જો મિથ્યાત્વ ઊભું છે તો ખરી રીતે એ અવિરતિવાળો જ છે, વિરતિનું ગુણસ્થાનક અને નથી મળ્યું. એવું જ કોષાદિ કષાયો અંગે સમજજવું. કષાયોનો ત્યાગ પણ મિથ્યાત્વ જવા ઉપર અને અવિરતિ જવા ઉપર છે. નહિતર તો બહારથી કષાયો તેવા ન દેખાતા હોય, બહારથી તો ક્ષમાદિ ગુણ જણાતા હોય છતાંય વસ્તુઃ અંતર્ગત એ છારથી ભારેલા અભિન જેવા કષાયોવાળો જ છે. શ્રી સર્વજ્ઞ પ્રભુના વચનથી જ આ બધું જાણી શકાય છે. જો અરિહંત પ્રભુએ જો આ વિરતિમાર્ગ ન બતાવ્યો હોત તો જીવ કેવો ઝોગટીયાં કર્મથી બંધાયો રહેતે ? ગૃહસ્થનો દેશવિરતિ ધર્મ અને સાધુનો સર્વ વિરતિ ધર્મ બતાવીને જ ઉપરના ગુણસ્થાનકોએ યાવત્ મોક્ષ ચંદ્રવાવાનો અનંત ઉપકાર એક માત્ર સર્વજ્ઞ શ્રી અરિહંત પરમાત્માએ જ કર્યો છે.

### • પંચાસ્તિકાય અને ઘડ્દ્રવ્ય •

સર્વજ્ઞ પરમાત્મા શ્રી તીર્થકરદેવો કહે છે કે જગત ગુણપર્યાયવાળા જ દ્રવ્યોનો સમૂહ છે, અને જગતનું સંચલન (Working) એટલે તે દ્રવ્યોની પલટાતી અવસ્થાઓ છે, પલટાતા પર્યાયો છે. જ દ્રવ્યોનાં જીવ, પુદ્ગલ, આકાશ, ધર્મ, અર્ધર્મ, કાળ આવે છે. એમાં કાળ સિવાયના પાંચ દ્રવ્યોને અસ્તિકાય કહેવાય છે, કેમકે એમાં અસ્તિનો કાય છે; અર્થાતું પ્રદેશનો સમૂહ છે. ત્યારે કાળ તો ગમે ત્યારે એક સૂક્ષ્મ

સમય રૂપ જ મૌજુદ મળશે; વધારે નહિ. પંચાસ્તિકાય પૈકી આકાશના લોક અને અલોક બે ભાગ છે. તેમાં લોકાકાશ જે અસંખ્ય યોજનો પ્રમાણ છે, માત્ર એમાં જ બીજા દ્વયો રહે છે. અલોકાકાશમાં કાંઈ જ નથી. એ માત્ર ખાલી જગાસ્વરૂપ છે, અને પ્રમાણમાં અનંત છે. એક નથે કાલ સિવાયના પાંચ આસ્તિકાય જ દ્વય છે.

### ● ઉત્પાદવ્યાઘોવ્યનો સિદ્ધાંત ●

ઉત્પાદ, વ્યય અને ગ્રૌવ્યયુક્ત હોય તે જ સત્ત કહેવાય; આ જૈનદર્શન જ કહે છે. સત્તનું આ લક્ષણ જ સાચું છે. કેમકે દ્વય દ્વયપણે કાયમ રહીને બિના બિના પર્યાયો (અવસ્થાઓ) રૂપે ઉત્પન્ન થાય છે, ને નાશ પામે છે; પૂર્વ પર્યાયરૂપે નાશ પામી તે જ વખતે નવીન પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે. પર્યાયો દ્વયથી કાંઈ એકાન્તે જુદી વસ્તુ નથી; પણ પૂર્વે કંધું તેમ બિનાબિના છે. એમાં અભિનન્તાની અપેક્ષાએ દ્વય એ પર્યાયરૂપે કહેવાય; તેથી પર્યાયની ઉત્પત્તિએ દ્વયની ઉત્પત્તિ, અને પર્યાયના નાશે દ્વયનો નાશ કહેવાય. આમ દરેક દરેક દ્વયમાં સમયે સમયે ઉત્પાદ, વ્યય અને ગ્રૌવ્ય એક સાથે રહે છે. છેવટે દરેક દ્વયનો સમય પર્યાય તો પલટાયા જ કરે છે; એ હિસાબે શુદ્ધ દ્વયના દોરા પર સમયે સમયે ઉત્પાદ-વ્યયના મહાકા છે જ. આ જે ઉત્પાદ-વ્યય-ગ્રૌવ્યયુક્તને સત્ત કહેવાય છે, તેથી જ એ સાચું છે કે સત્તનો અત્યંત નાશ નથી થતો. તેમ અત્યંત અસત્તની કદી ઉત્પત્તિ નથી થતી. મુખ્ય શુદ્ધ વસ્તુ ઉપર જ ઉત્પાદ-વ્યય ગોઠવાય છે. નેયાપિક વગેરે બીજાઓ પણ સત્તનો અત્યંત નાશ નહિ, અત્યંત અસત્તની ઉત્પત્તિ નહિ, આ સિદ્ધાંત માનવા છતાં એકમાંજ એકી સાથે ઉત્પાદ-વ્યય-ગ્રૌવ્યની વ્યવસ્થા માનતા નથી, તેથી એમનો સિદ્ધાંત પોકળ કરે છે; એટલે જ એમનાં દ્વયો અને એમના તત્ત્વો પણ વાસ્તવિક નહિ પણ માત્ર કાલ્યનિક કરે છે. ઉત્પત્તિ-વિનાશ-શુદ્ધવતાની મહાસત્તા કેઠ પરમાણુથી માંડી મોટા મેરુ તથા લોકાકાશ તો શું, પણ સમસ્ત અલોક પર પણ વાપેલી છે. એનું સાર્વત્રિક ભાજા માનવીના મદ, શોક, મમત્વ, દીનતા, રાગ-દ્વેષ વગેરેને ઓગાળી નાખે એમ છે. પંચાસ્તિકાયના અનંત પર્યાયો છે. એ દ્વય-પર્યાયોની વિચારણા અને ધ્યાન કેઠ સર્વોચ્ચ શુક્લધ્યાન સુધી લઈ જઈ કેવળજ્ઞાન-સર્વજ્ઞતાએ પહોંચાડવા સમર્થ બને છે. આ પ્રકાશનાર દાતાર શ્રી સર્વજ્ઞ અરિહંત પરમાત્માનો કેવો અને કેટલો બધો અનંત ઉપકાર !!! વિચારો કે જો પરમાત્મા આ આ અનંત પર્યાયોના બતાવનારને બદલે બનાવનાર હોત તો જગતને હુઃખના પર્યાયોની કેવી મહાન ભયંકરતા બક્ષનાર ગણાત ?

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદધિ”

વર્ષ-૪, અંક-૩૧, તા. ૨૮-૪-૧૯૫૯



### શ્રી અરિહંત પરમાત્માની ઓળખાણ

સાત તત્ત્વ પરમાત્માએ શ્રેષ્ઠ એવા મોક્ષપુરુષાર્થની દાખિએ શૈય-હેય-ઉપાદેય એમ ત્રણ પ્રકારના તત્ત્વ કહ્યા છે. એમાં શૈય તત્ત્વનું માત્ર શાન કરવાનું; અર્થાત્ એના શાનથી રાગ-દ્વેષ ન થવા દેતાં એ શાનને હેય તત્ત્વ તજવામાં અને ઉપાદેય તત્ત્વ આદરવામાં ઉપયોગી બનાવવાનું છે. અહીં શૈયમાં ‘જીવ’ અને ‘અજીવ’ એમ બે તત્ત્વ છે. હેયમાં ‘આશ્રવ’ અને ‘બંધ’ નામના બે તત્ત્વ તથા ઉપાદેયમાં ‘સંવર’ ‘નિર્જરા’ અને ‘મોક્ષ’ એમ ત્રણ તત્ત્વ છે. આ રીતે કુલ સાત તત્ત્વ થાય છે, એમાં પુર્વ અને પાપને ‘બંધ’માં સમાવેશ ન કરતાં, જુદા શુદ્ધવામાં આવે તો ‘નવ તત્ત્વ’ પણ કહેવાય છે; બંધ=આત્માનું કર્મથી બંધાવું તે. આશ્રવ=કર્મબંધના કારણો. સંવર=કર્મબંધ અટકવવાના ઉપાય. નિર્જરા=કર્મનો ધસારો. મોક્ષ=સર્વ કર્મનો કષય થઈ સંસાર ટળવા પૂર્વક આત્માને શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ; આ તત્ત્વજ્ઞાનને એ પરમદયાલુ શ્રી અરિહંત પરમાત્માએ જ આપેલું છે, અને એ જ સાચું છે. એમાં સમસ્ત શાસ્ત્રજ્ઞાન સમાઈ જાય છે. હવે અહીં પૂર્વે નયવાદ કહ્યો છીતાં સાત નયના નામ માત્ર આપેલા હતા. તેનું સ્પર્ધીકરણ જરૂરી છે.

**સત્ત નય :-** નયવસ્તુ સ્વરૂપને ઓળખવાના બિના બિનારૂપે જાણવા માટેની દાખિ. મુખ્ય દાખિબિનુ સાત છે : નેગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, સાંપ્રત (શબ્દ), સમભિરૂઢ, અને એવંભૂત. આમાં નેગમદાખિ અનેકાનેક પ્રકારે વસ્તુના સામાન્ય સ્વરૂપને અને વિશેષ સ્વરૂપને જુએ છે; તો સંગ્રહદાખિ માત્ર સામાન્યને, અને વ્યવહારદાખિ માત્ર વિશેષને જ મુખ્ય માને છે. ઋજુસૂત્ર વળી ઉપયોગીને માનનાર હોવાથી પોતાની જ અને વર્તમાન જ સ્થિતિ જુએ છે. ત્યારે સાંપ્રત (શબ્દ) દાખિ વસ્તુના નામ પર જાય છે, અને નામના પુટિંગ-સ્ત્રીલિંગ, એક વચન-દ્વિવચન વગેરેના બેદ વસ્તુ બિના માને છે. એવીય સૂક્ષ્મ એવો સમભિરૂઢ નય તો કહે છે કે નામની વ્યુત્પત્તિવાળો અર્થ જે વસ્તુમાં ધટે, તે જ વસ્તુ તે નામવાળી છે. દા.ત. દેવોનો સ્વામી તે જ ઈન્દ્ર છે. પરંતુ કાંઈ મનુષ્યનું નામ ઈન્દ્ર પાછું હોય, તો તે કાંઈ સાચું નથી. સૌથી સૂક્ષ્મનય એવંભૂતની દાખિ એવી છે કે વ્યુત્પત્તિઅર્થ પણ વસ્તુમાં જે વખતે ઘટતો હોય અર્થાત્ મોજુદ હોય તે જ વખતે તે નામવાળી તે વસ્તુ છે. એમ માનવું એટલે કોઈ બંધ થતા ન્યાયની ખુરસી પરથી નીચે ઉતરી ગયેલો અમલદાર ન્યાયારીશ નથી. આ સાતનયની વિચારણામાં ૧૧૮ ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-શ્રી અરિહંત પરમાત્માની ઓળખાણ (ભાગ-૧૮)

વस्तुનો વિશાળ, સર્વતોગ્રાહી અને અનેક મતને ન્યાય આપનારો બોધ મળે છે. સર્વજ્ઞ પરમાત્મા સિવાય આ કોણ બતાવી શકે ?

**સપ્તભંગ :-** ભંગ એટલે પ્રકાર. સ્યાદ્વાદ શૈલીથી વસ્તુના દરેક ધર્મ અંગેની જિજ્ઞાસાના સાત પ્રકારે પ્રશ્ન ઉઠી શકે છે. દા.ત. ઘડાનું અસ્તિત્વ, કે ઘડાનું નિત્યત્વ, એ ધર્મ લઈએ તો પ્રશ્ન થાય કે ધર્મ લઈએ તો પ્રશ્ન થાય કે (૧) શું ઘડામાં અસ્તિત્વ છે ? (૨) નાસ્તિત્વ છે ? (૩) ઉભય છે ? (૪) ઉભય એકી સાથે શું અવક્તવ્ય છે ? (૫) અસ્તિત્વ અને સાથે અવક્તવ્યત્વ છે ? (૬) નાસ્તિત્વ અને સાથે અવક્તવ્યત્વ છે ? (૭) અસ્તિત્વ, નાસ્તિત્વ, અને સાથે અવક્તવ્યત્વ છે ? આ સાતેનાય જવાબ હકારાત્મક છે; જેમકે (૧) ઘડો પોતાના ઉપાદાન દ્વયની અપેક્ષાએ છે, પોતાના ક્ષેત્ર કે સ્થાનની અપેક્ષાએ છે, પણ (૨) પારકાદ્વય-ક્ષેત્રની અપેક્ષાએ નથી. કાળી મારીનો ઘડો કાળી મારીનો જ ગણાશે, નહિ કે લાલ મારીનો. એમ મુંબઈનો ઘડો મુંબઈનો જ કહેવાશે, પણ દિલ્હીનો નહિ. (૩) પાછા એ અસ્તિત્વ અને નાસ્તિત્વ, ઉભય એક જ વસ્તુમાં રહે છે. છતાં (૪) બંનેનું કથન કમશા: થઈ શકશે, એકી સાથે કથન નહિ થઈ શકે. એક સાથે ‘અસ્તિ’ ‘નાસ્તિ’ બંનેને કોઈ એક શબ્દથી જણાવી નહિ શકાય. માટે જ તે યુગપત્ર (એક સાથે) અવક્તવ્ય છે. અસ્તિ-નાસ્તિ એમ ભેગું કરીને બોલીએ તો પણ અસ્તિશબ્દના ઉચ્ચારણ પછી જ નાસ્તિ શબ્દનું ઉચ્ચારણ છે. આવી રીતે આગળ વધતાં (૫-૭) અપેક્ષાએ ઘડો ‘અસ્તિ’ પણ છે અને ‘અવક્તવ્ય’ પણ છે...ઈત્યાદિ સમજવું. વસ્તુના કોઈ એક ગુણધર્મને માટે સાત જ જિજ્ઞાસા ઉઠે છે, સાત જ પ્રશ્ન થાય છે, તેથી સાત સમાધાનરૂપે સપ્તભંગી બને છે. આવી સપ્તભંગીઓ દ્વારા, વસ્તુના અનેક ધર્મોના સ્યાદ્વાદ જાણી શકાય છે, ને પ્રરૂપી શકાય છે. સપ્તનય-સપ્તભંગીનું વિજ્ઞાન બતાવવાનો ઉપકાર શ્રી અરિહંત પરમાત્માનો છે.

**નિક્ષેપ :-** નિક્ષેપ=વિભાગીકરણ. વસ્તુ માત્રને ઓછામાં ઓછા નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ એ ચાર વિભાગમાં વહેંચી શકાય છે. દા.ત. રાજાને ચારમાં વહેંચાય, નામથી રાજા નામરાજા, આકૃતિમાં રાજા સ્થાપનારાજા, રાજાની પૂર્વ-પશ્ચાદ ભૂમિકા એ દ્રવ્યરાજા, અને રાજાની વ્યાખ્યા બરાબર ઘટે એ ભાવરાજા. આમાં નામરાજા તરીકે કોઈ રાજા નામનો છોકરો, એ માત્ર નામથી રાજા છે. ત્યાં ભલે નામથી છતાં એને ‘રાજા’ કહેવામાં અસત્ય ભાષણ નથી; સત્ય ભાષણ છે. વસ્તુને તે રૂપે કહે તે સત્ય ભાષણ; તો નામ પણ વસ્તુનું સ્વરૂપ છે, એમ માનવું જ જોઈએ. એટલે જ એ પણ એક રાજા વસ્તુ જ છે. એમ રાજાના ફોટોને પણ

રાજા જ કહેવાય છે, એટલું જ નહિ પણ બજાર વચ્ચે રાજાના ફોટોને કોઈ તિરસ્કારમાં બાળે કરે તો એને ખુદ રાજાનો તિરસ્કાર કરનારો ગણી સજી થાય છે. આમ ફોટો, ચિત્ર, આકૃતિ પણ રાજા છે, સ્થાપના રાજા છે. વળી સવારીમાં કે દરબારે સિંહાસન પર બેઠેલો, ચામરે વીજાતો, મંત્રી આદિના પરિવારવાળો એ ભાવરાજા છે. એનામાં રાજા શબ્દનો બરાબર ભાવ (અર્થ) છે. ત્યારે એનો એ રાજા સવારી કે સિંહાસનેથી ઉત્થા પછી દ્વયરાજા છે; ભાવરાજાનું ઉપાદન દ્વય છે; મુખ્ય કરાણ છે. એમ જિન (તીર્થકર)ના પણ ચાર નિક્ષેપા-નામ જિન, સ્થાપના જિન, દ્રવ્ય જિન, ભાવ જિન. વળી કેટલાક પદાર્થમાં તો ચારથી વધારે પણ વિભાગ (નિક્ષેપો) પડી શકે છે. જેમકે, સંયોગમાં નામસંયોગાદિ આ ચાર ઉપરાત ક્ષેત્રસંયોગ, કાળસંયોગ,...એમ પણ વધારે નિક્ષેપા છે. તેથી જ કહેવાય છે કે મુંબઈમાં ખેતી માટે સંયોગ નથી અર્થાત્ ક્ષેત્રસંયોગ નથી. એમ ચોમાસામાં કેરી માટે સંયોગ નથી, અર્થાત્ કાળસંયોગ નથી. તેમજ દેવપણમાં ચારિત્ર માટે સંયોગ નથી એટલે કે ભવસંયોગ નથી. નિક્ષેપાના જ્ઞાનથી પદાર્થનો ઉડો અભ્યાસ અને વિવેક થઈ શકે છે. આ બતાવનાર અરિહંત નાથનો કેવો મહાન ઉપકાર !

**અનુયોગ :** અનુયોગ દ્વાર :- અનુયોગ=પદાર્થનું વ્યાખ્યાન. અનુયોગ દ્વાર=વ્યાખ્યાન કરવાના રસ્તા. વ્યાખ્યાનરૂપી નગરમાં પેસવાના દરવાજા. અનુયોગ ચાર પ્રકારે છે દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ અને ધર્મક્થાનુયોગ. શ્રી સર્વજ્ઞ પરમાત્માનું સકલ વાડ્મય (સાહિત્ય) આ ચાર અનુયોગમાં વહેંચાયેલું છે. એમાં દ્રવ્યાનુયોગ એટલે ધર્મસ્તિકાયાદિ દ્રવ્ય સંબંધી નિરૂપણ. એમાં બધું તાત્ત્વિક વિવેચન આવે છે. એનો વિચાર અતિવિસ્તૃત અને સૂક્ષ્મતાબર્થો છે; તથા અનુતરવાસી દેવો ગીત નૃત્યાદિને બદલે દ્રવ્યાનુયોગાદિ તત્ત્વના ચિંતનમાં મસ્ત રહી અસંખ્ય વર્ષો વીતાવે છે. એ શુક્લધ્યાન માટે ખાસ ઉપયોગી છે. એટલું જ નહિ પણ દ્રવ્યાનુયોગના ચિંતનમાં માણસ એવો લયલીન બને છે કે જેથી દોપો અને વિકારો દૂર ભાગી જાય છે; દુઃખ અને ચિંતા ભૂલાઈ જાય છે, નવા પાપ અને કુવાસનાઓના બંધનથી બચી જવાય છે. ચરણકરણાનુયોગમાં ઉત્તમ પ્રવજ્યા માર્ગ, સર્વ ચારિત્ર દેશચારિત્ર અને એના ઉત્તર ગુણોનો માર્ગ, ભૂલોના પ્રાયશ્ક્રિતોનો ઉત્સર્ગ-અપવાદનો વગેરે ઘણો વિસ્તાર આવે છે. ગણિતાનુયોગ, ધર્મક્થાનુયોગનો અર્થ સમજાય એવો છે.

કોઈ પણ અનુયોગમાં પેસવા માટે ઉપક્રમ નિક્ષેપ, અનુગમ અને નય એ ચાર દ્વાર છે. ઉપક્રમ=ઉપોદ્ઘાત; અનુગમ=સૂત્ર અને એના વિવેચનરૂપ નિર્યુક્તિ સાથે અર્થનો સંબંધ જોડી આપવો તે. નિક્ષેપ અને નયના અર્થ ઉપર કહેવાઈ ગયા

છે. આ ચારેય દ્વારા વ્યવસ્થિત સુંદર અનુયોગ પામી શકાય છે.

**પ્રકરણો :-** પ્રકરણ=જુદા વિષયો. સર્વજ્ઞ શ્રી જિનેશ્વરદેવની વાણીએ વિશિષ્ટ કોટિના અનેક પ્રકરણો પર એવા વિશાળ અને સૂક્ષ્મ પ્રકાશ પાથર્યા છે; કે (૧) વર્તમાન કેટલીક પ્રયોગથી ઉપજાવતી વૈજ્ઞાનિક શોધો પણ જેને અનુકૂળ ઉત્તરે છે; આધુનિક સાબિતિ રૂપ થતી આવે છે; તેમજ (૨) વર્તમાન ભૌગોલિક કે ખગોળ સંબંધી કે બીજી માન્યતાની ખામીઓનો જે બચાબદ રૂપી પણ આપે છે; તથા (૩) જગતમાં દુર્લભ એવા પદાર્થ વિજ્ઞાનના દાન કરે છે. દા.ત.

(૧) જૈન આગમમાં આવે છે કે જલની વાયુયોજિ હોય છે. તો આજના વિજ્ઞાને પણ શોધી કાઢ્યું છે કે  $H_2O$  હાર્ડ્રોજન વાયુ બે ભાગ અને ઓક્સિજનવાયુ એક ભાગ ભેગા થવાથી પાણી બને છે. એમ (૨) જિનાગમ કહે છે કે શબ્દ પુદ્ગલ છે, વિજ્ઞાન શબ્દની રેકર્ડ પર અસર લે છે. ન્યાયશાસ્ત્ર શબ્દને ગુણ માને છે. એ કેવળ ગુણ નહિ પણ ખુદ પુદ્ગલ દ્વય હોય તો જ બીજા દ્વય પર અસર કરી શકે. એવી રીતે (૩) જિનાગમ કહે છે કે દરેક પુદ્ગલમાંથી તેવા તેવા છાયા પુદ્ગલો નીકળે છે, ત્યારે વિજ્ઞાને ફોટો લેવાનું શોધ્યું; એ આ છાયા પુદ્ગલોની સાબિતિ રૂપજ છે. એમ (૪) વનસ્પતિમાં જીવ છે એ જે વસ્તુ જિનવાણી અસંખ્ય અનંત કાળથી કહેતી આવી છે એ વર્તમાનમાં જગદીશચંદ્ર બોજે પ્રયોગથી સાબિત કર્યું.

અહીં એક પ્રશ્ન એ થાય કે તો પછી જિનાગમે વસ્તુ કહેવા સાથે એની આધુનિક જેવી સાબિતિઓ અને એનાં કાર્ય કેમ ન બતાવ્યા? પણ એનો ઉત્તર એ છે કે એમ કરવામાં જીવોની હિસા થાય એવા આરંભ-સમારંભ તથા જગતનો મોહ વધી જાય; માટે એ ન બતાવ્યા.

(૨) આધુનિક વિજ્ઞાનમાં ઊભી થતી ખામીઓ પણ જિનાગમના પ્રતિપાદનોમાં ઊભી નથી થતી. દા.ત. વિજ્ઞાને પૃથ્વીને ગોળ માની, તો પ્રશ્ન એ થાય કે (૧) નીચેના અર્ધ ગોળા પર લોકવ્યવહાર કેવી રીતે હોય? (૨) તથા અમુક ગોળાર્ધ નીચેનો; ને અમુક ઊચેનો, એ વ્યવસ્થા શી રીતે નક્કી થાય? કેમકે ગુરુત્વકર્ષણના નિયમથી બધે જ પૃથ્વી પગ નીચે છે, અને આકાશ મસ્તક પર રહે છે. એ આખા ગોળા પર સર્વત્ર સરખું છે, પછી નીચે ઊચેનો ભેદ શી રીતે? જેનમતે તો પૃથ્વી સપાટ હોવાથી આ આપત્તિ જ નથી. વળી ‘સૂર્ય સ્થિર અને પૃથ્વી પોતાની ધરી ઉપર પણ ફરતી રહીને સૂર્યને પણ પ્રદક્ષિણા દેતી ફરે એ કેમ બને? બે સ્વરૂપમાં સતતું ફરવાનું ન બને. ભમરડો પણ પટકાવાના વેગના હિસાબે જરાક આગળ વધી પછી એક જ સ્થાને સ્થિર થઈ ખીલી પર ફર્યા કરે

છે. વળી (૪) સૂર્ય પૂર્વ કે પશ્ચિમમાં ફરે ત્યારે તો સૂર્યકિરણો કુમશઃ પૃથ્વીના ભાગો પર રેખાંશ પ્રમાણે આવ્યા કરે. પરંતુ સૂર્યને પ્રદક્ષિણા દેતાં ખૂણામાં કે ઉત્તર-દક્ષિણે પૃથ્વી આવે ત્યાં ધરી પર ફરતી પૃથ્વીને સૂર્યકિરણો કેવી દિશાથી મળે? ને કેવી રીતે વ્યાપી રહે? તેમ (૫) સૂર્યોદય-સૂર્યાસ્ત સમયે સૂર્ય લાલ કેમ દેખાય છે? જૈનદર્શન તો શિખવે છે કે સૂર્ય મેરુની આસપાસ ફરે છે, એમાં ઉદ્ય અસ્ત સમયે લાલ નિષ્ઠ પર્વતના છેડા પર એ હોય છે, એ વખતે એ પર્વત પર પેલા કિરણોથી ઉઠતા લાલ પ્રતિપ્રકાશ (Reflection)ની વચ્ચમાંથી આપણને સૂર્યદર્શન થાય છે, તેથી સૂર્ય લાલ જણાય છે. (૬) આજના વિજ્ઞાનમાં પુદ્ગલ (Matter)થી જુદી આત્મા જેવી વસ્તુ નથી, તો પછી એને તો પૂર્વ જન્મ પણ ન હોય તો વર્તમાનમાંય જે કોકને પૂર્વ જન્મનું સ્મરણ થાય છે; અને તે પ્રત્યક્ષ મળતું આવે છે. એ કેમ બની શકે? જૈન શાસન તો આત્મવાદી હોવાથી આનું સમર્થક છે.

(૩) ત્યારે જગતમાં દુર્લભ એવા જે પદાર્થના પ્રકાશ શ્રી જિનેશ્વરદેવોએ પાથર્યા છે, તેમાંના કેટલાક પૂર્વ સિદ્ધાન્તના તથા પદાર્થના વિભાગમાં દર્શાવ્યા છે. એમાં જ અવાન્તર વિષયોમાં જીવો સંબંધી વિસ્તૃત વિચાર, પુદ્ગલમાં ઔદ્ઘારિક-વૈક્લિય-આહારક-તેજસ-ભાષા-શાસોશ્વાસ-મન-કાર્મણ વર્ગણાઓ, કર્મબંધના સૂક્ષ્માતિસૂક્ષ્મ વિવિધ કારણોનો વિચાર, સમસ્ત લોક-સંસ્થાનનો વિચાર, વિશિષ્ટ-મંત્ર-તંત્ર વગેરેનો વિચાર તેમજ આગળ ઉપર કહેવાશે તે યોગ-ધ્યાન-જ્ઞાન-તપ-વિરતિ વગેરેનો વિચાર, એ બધી જિનવાણીમાંથી જ જરેલી વિશેષતા છે; આ પદાર્થના પ્રકાશમાં દરેક વિષયોના વિસ્તૃત નિરૂપણ સંબંધે તો પૂછવા જેવું નથી. દા.ત. જીવોના પંચેન્દ્રિય જીવોથી માંડી જીણામાં જીણા એકેન્દ્રિય જીવો સુધીની અનેકાનેક પ્રકારની જીતિભાતિઓ અને એની ઓળખાણ, લક્ષણો, ને સાબિતિઓ બતાવનાર કોઈ હોય તો તે શ્રી સર્વજ્ઞ તીર્થકર ભગવાન છે. વળી જીવોની સંખ્યા, અથ્વ બહુત્વની તુલના, એના દરેક પ્રકારમાં એનાં આયુષ્ય, એનાં શરીરમાન, વારંવાર એવા પ્રકારમાં જન્મવારૂપ એની કાયસ્થિતિનું માપ, એ દરેકની કેટકેટલા કર્મબંધની યોગ્યતા, કેટકેટલા કર્મ-ઉદ્યનો અવકાશ, દરેકમાં યોગો, ઉપયોગો, લેશ્યા, ગુણસ્થાન, વગેરે ધણી ધણી નક્કર બોધદાયી હકીકતો શ્રી અરિહંત પ્રભુ જ બતાવે છે. એમને ન માનનારથી જીવના વ્યવસ્થિત જ્ઞાન વિના જીવદ્યા પણ શી રીતે પળાવાની હતી? તો તે વિના મોક્ષ પણ ક્યાંથી?



## ૧૮ શ્રી અરિહંત પરમાત્માની ઓળખાણ

લોકસંસ્થાનમાં ભૂગોળ ખગોળના વિષયમાં ચૌદ રાજલોક, સ્વર્ગના દેવલોકો, મધ્ય લોકમાંના જ્યોતિષ વિમાનો, દીપો, સમુદ્રો, પર્વતો, નદીઓ, અને નીચે ભવનપત્ર-વંતર દેવોના ભવનો, નગરો; નરકના પાથડા, નરકાવાસો વગેરેનાં સ્વરૂપ અને તાંના સંયોગો તથા સુખ ફુખના વ્યવસ્થિત ખુલાસા આવે છે. તેની પણ વિશિષ્ટતા માત્ર શ્રી જિનવાણીથી પ્રકાશાઈ છે. આ વિશિષ્ટતાઓ અન્યત્ર દુર્લભ તો શું પણ અલભ્ય છે. શ્રી સર્વજ્ઞ જિનેન્દ્ર પરમાત્માની આ બધું પ્રકાશવામાં કેવી અનંત ઉપકારકતા !! અહો, નાથ, ! અહો, તારક ! એમ હૈયું અરિહંતચરણે છી પડે છે ! જગત પર જો આવા પરમાત્મા હોવાનું જાણવા મળે છે, તો પછી એમને છોડી બીજે કોણ હૈયું અર્પે ?

શ્રી સર્વજ્ઞ અરિહંત પરમાત્માના વિશિષ્ટ ઉપકારો પૈકી વિશિષ્ટ વસ્તુના ઉપદેશના ઉપકારની વિચારણા ચાલી રહી છે. એ ઉપદેશના વિશિષ્ટ વિષય તરીકે પણ (૧) વિશિષ્ટ સિદ્ધાન્તો, (૨) વિશિષ્ટવાદો, તથા (૩) વિશિષ્ટ પદાર્થો કંઈક વિચાર્યાં. હવે (૪) વિશિષ્ટ ઉપાસ્યોનો વિષય ટૂંકમાં જોઈએ. ઉપાસ્ય એટલે ઉપાસના કરવા યોગ્ય, આરાધવા યોગ્ય વિષયો.

શ્રી અરિહંત પ્રભુએ ઉપદેશેલી ઉપાસનાના અનેક પ્રકારના વિષયોમાં પંચપરમેષ્ઠી, રત્નત્રયી માર્ગ, શુત્સાધના માર્ગ, પુરુષાર્થ માર્ગ; વગેરે અનેક માર્ગની વિચારણા કરવી રહેશે. તે આ પ્રમાણે :

### • પંચપરમેષ્ઠી •

(૧) અરિહંત (અરહંત) :- પરમ પદે અર્થાત્ શ્રેષ્ઠ પ્રશસ્ત અને પૂજ્યપદે રહેનાર તે પરમેષ્ઠી કહેવાય. પ્રથમ પરમેષ્ઠી શ્રી અરિહંત પરમાત્મા પોતે છે. એમના અરહંત, અરિહંત, અરુહંત એમ સરખા જેવાં નામ છે. બીજા પણ જિનેન્દ્ર, પારગત, ત્રિકાલવિદ્બ, સાર્વ, તીર્થકર, વગેરે નામો છે. અરહંત એટલે અષ્ટ મહાપ્રાતિહાયાર્દિની પૂજાને યોગ્ય. અરિહંત એટલે આંતર શત્રુને હણનારો. અરુહંત એટલે જેમનામાં સંસારબીજ એવા બળી ગયા છે કે જે હવે કદી ઉગવાના નથી. પ્રાકૃત વાકરણના નિયમ મુજબ અરિહંત અને અરુહંત શબ્દ અરહંત શબ્દને સમાન હોવાથી એનો અરહંત જેવો પણ અર્થ થાય છે. આ અરિહંત પરમાત્માનું વર્ણન

ઠીક ઠીક થઈ ગયું છે. જેના સાર રૂપે એમ કહેવાય કે એમના આત્મામાં અનાદિની વિશિષ્ટ યોગ્યતા પડેલી છે; સમ્યક્તવ પાચ્યા પછી વીસસ્થાનકની આરાધનાના બળે તીર્થકરપણાનું વિશિષ્ટ પુષ્ય ઉપાર્જ ત્રીજે ભવે તીર્થકરનો લોકોતાર દેહ પામે છે. ત્યાં એ જન્મથી જ અવધિજ્ઞાનવાળા હોય છે, ને હંડો અને દેવોથી પૂજાય છે. વળી એ ચોત્રીસ અતિશય અને વાણીના પાંનીસ અતિશયોથી અલંકૃત હોય છે. ઉત્સર્ગનો વિશિષ્ટ ચારિત્રમાર્ગ આરાધે છે. આંતરશત્રુ રાગાદિનો નાશ કરી સર્વજ્ઞ તીર્થકરદેવ બને છે; અને ધર્મશાસનને સ્થાપી પ્રચારી અંતે મોક્ષમાં જાય છે.

### (૨) બીજા પરમેષ્ઠી શ્રી સિદ્ધ પરમાત્મા :

બીજા પરમેષ્ઠી પદે શ્રી સિદ્ધ ભગવાન વિરાજે છે. જીવનના મુખ્ય બે પ્રકાર-સંસારી. અને મુક્ત પૈકી મુક્ત જીવો એ સિદ્ધ પરમાત્મા છે. પરમાત્મા એટલે શ્રેષ્ઠ યાને સર્વથા શુદ્ધ શુદ્ધ આત્મા. એમનાં બીજા નામ મુક્ત, પારગત, અકલંક, અમર, અજ, અનંગ, પરમજ્યોતિ, સદાશિવ વગેરે છે. એ આઠે પ્રકારના કર્મના મળથી રહિત થઈ તદ્દન નિર્મણ અને નિરૂપાધિક બન્યા હોવાથી એમને સહસ્રિદ્ધ અનંતજ્ઞાનાદિ આઈ ગુણ હવે પ્રગટપણે સિદ્ધ બનેલા છે. તેથી એ સિદ્ધ છે, અથવા હવે એમને કશું સાધવાનું નથી, સાધી શકાય એ બધું પ્રાપ્ત થયું છે; સિદ્ધ થયું છે, માટે એ સિદ્ધ છે; અથવા સિત=બાંધેલા એવાં જે કર્મ તેને ધમી નાખ્યા છે, તેથી તે સિદ્ધ છે. ચાર ઘાતીકર્મના નાશથી અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત વીતરાગતા અને અનંતવીર્યાર્દિ લબ્ધિઓ પ્રગટ થયેલી છે. તેમજ બાકીના ચાર અધાતી પૈકી વેદનીય કર્મના નાશથી અનંત અવ્યાબાધ સુખ, આયુ:કર્મના નાશથી અક્ષય નજર અમર સ્થિતિ, નામકર્મના નાશથી અરૂપિપણું અને ગોત્ર કર્મના અભાવથી અગુરુલઘૃતા પ્રકટ થયેલી છે. સંસારમાં જે સારા-નરસા (શુભાશુભ) કર્મના યોગે યશ અને અપયશ, ઊંચ કુલ અને નીચ કુલ, સૌભાગ્ય ને દુર્ભાગ્ય, સાંસું શરીર-નરસું શરીર, આરોગ્ય અને રોગ, માન અને અપમાન, અજ્ઞાન અને મોહ, રાગ ને દ્રેષ, હર્ષ અને શોક, વગેરે દ્વંદ્વો વેદવા પડે છે, તેમાંનું સિદ્ધ અવસ્થામાં કાંઈ હોતું નથી. સંસારમાં પણ આત્માના મૌલિક-આંતરિક અપ્રકટ સ્વભાવમાં તો ઉક્ત દ્વંદ્વોથી તદ્દન વિનિર્મુક્ત (રહિત) એવી શુદ્ધ સ્થિતિ છે; પરંતુ પ્રગટપણે એ રાગદ્વેષાદિવાળી અશુદ્ધ સ્થિતિ છે. કેમકે પ્રવાહથી અનાદિકાળ થયા આત્મપ્રદેશો સાથે એકમેક થઈ આત્માને મલિન કરનાર જે પૌરુષાલિક કર્મ-સ્કંધો, તેના વિપાકને લીધે ઉક્ત યશ-અપયશ વગેરે દ્વંદ્વોની વિચિત્ર પરિસ્થિતિ આત્મા પર ઉત્તી થાય એમાં નવાઈ નથી એટલે ખરી રીતે વિચારતાં, એ યશ-અપયશ

વગેરે દ્વંદ્વોના અનુભવની વચ્ચે એનાથી તકન નિરાળું એવું આત્માનું અસલી શુદ્ધ સ્વરૂપ સ્વભાવગત કાયમ છે. એ સમજને રાગદ્વેષમાં તણાયા વિના જીવન જીવી શકાય છે. માટે પર ઉપાધિથી થનારા યશ કે અપયશ આરોગ્ય કે રોગીપણું વગેરે અવસ્થાઓને પરાઈ સમજું, એમાં આત્મા ઉન્માદ કે દીનતા કરતો નથી; પણ પોતે માત્ર સાક્ષી રૂપે એનો દાતા દસ્તા બની, એને ઉદાસીનભાવે અર્થાત્ અરકત-અદ્વિષ્ટ ભાવે વેદી લઈ અંતે એ સર્વથા મુક્ત થાય છે; એટલે કે સિદ્ધ બની ત્રિભુવનના છેક મથાળે જઈ વસે છે. એ હવે નિર્મભ-નિર્વિકાર છે, નિરંજન-નિરાકાર છે, સર્વજ્ઞ-સર્વદર્શી છે, અમમ, અવ્યય અને અક્ષય છે, કૃતકૃત્ય છે, નિર્મહી છે, શુદ્ધ જ્ઞાતા દસ્તા છે, સ્પર્શાદિ રહિત છે, પરમ પદાર્થ છે, શાશ્વત જ્યોતિ છે, સ્વતંત્ર છે, સ્વરમણમાં મળ છે, નિત્યધર્મ છે, જ્ઞાનથી સર્વવ્યાપી છે, તત્ત્વમૂર્તિ છે, પરમ બ્રહ્મ છે, પરમ આદિત્ય છે. પરમ ઈન્દ્ર છે, પરમ સદાશિવ છે, અનંત સુખભોક્તા છે, સર્વ શત્રુના ક્ષયથી, સર્વ રોગના નાશથી, સર્વ પદાર્થની પ્રાપ્તિથી અને સર્વ ઈચ્છાની પૂર્તિથી જે સુખ થાય તેના કરતાં અનંતગુણ સુખ સિદ્ધનું છે. પણ તે સુખ અસંયોગનું હોવાથી સંયોગજન્ય સુખના અનુભવીને અગમ અગોચર છે.

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદધિ”

વર્ષ-૪, અંક-૩૪, તા. ૧૮-૫-૧૯૫૬

## ૨૦ શ્રી અરિહંત પરમાત્માની ઓળખાણ

(૩) ગ્રીજા પરમેષ્ઠી શ્રી આચાર્ય ભગવંત :-

ગ્રીજું પરમેષ્ઠી પદ આચાર્ય ભગવંતથી અલંકૃત છે. આચાર્ય મહારાજનાં બીજાં નામ સૂરિ, ગણધર, ગુરુ, ગચ્છપતિ, અનુયોગકર ગણિપિટક, ઉદ્ઘોતકારી વગેરે છે. એ અને ચોથા પરમેષ્ઠી ઉપાધ્યાયજી મહારાજ સંસારત્યાગી સંયમી સાધુ તો છે જ, એટલે સાધુ તરીકેની એમની પંચાચાર વગેરે વિશેષતા પાંચમા સાધુપદમાં સમજાશે. પરંતુ આચાર્ય તરીકેની એમની વિશેષતામાં શ્રી અરિહંત પ્રભુની ગેરહાજરીમાં શ્રી જિનપ્રવચનની પ્રભાવકતા, સુરક્ષિત આગમ પરિપાટી, અનેક ભાષાઓનું જ્ઞાન, સ્વપરશાસ્ત્ર કુશલતા, પ્રજ્ઞાપના-શક્તિ, સુયોગ્ય શિષ્ય સમૂહનું નેતૃત્વ, ભવ્ય ઓજ્ઝસ દેશનાલભ્ય, પંચાચાર પ્રચાર, અપ્રમત્તતા, શુદ્ધ ધર્મકથા-કથન વગેરે અનેકાનેક વિશેષતાઓને એ ધરનારા છે. શાસ્ત્રીય પદ્ધતિ ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ” (ભાગ-૧૮)

૧૨૫

મુજબ યોગોદ્ધરનાદિપૂર્વક સૂત્રનું તથા અર્થનું અધ્યયન અને દેશાટન કરી ગુરુએ આપેલી આચાર્ય પદવીને એ વરેલા હોય છે. એ મંત્રપીઠાદિ પંચપ્રસ્થાને સૂરિમંત્રને આરાધનારા હોય છે. શિષ્યોને ગ્રહણ આસેવન શિક્ષા આપવા-અપાવવામાં, એમજ જનતામાં ધર્મબોધ દ્વારા શાસન પ્રભાવના કરવામાં એ કુશલ હોય છે. સારણા વારણા ચોયણા પદિચોયણાથી ગચ્છને સાધનામાં ઉદ્યુક્ત રાખે છે. ધર્મશાસનનું સામાજય ચલાવનારા એ સમ્પ્રાત રાજ છે. રાજ આ રીતે : ઉપાધ્યાય એમના દિવાન છે. સાધુઓ સુભટ છે. ગૃહસ્થ શ્રાવક-શ્રાવિકા પ્રજાજન છે. આચાર્ય પાસે દ્વાદશાંગી કે તે તે કાળે વિઘ્નમાન શુંત એ ખજાનો છે. એના વડે એ સૌને આબાદ રાખે છે. પ્રજાજનને પીડવા આવતા મોહના ધરના ચોર લૂંટારાઓ પર એ જિનનું શાસન ચલાવી એને દૂર કરે છે; અને લોકના ધર્મધનને રક્ષી અધ્યાત્મ-હિતની અનેકવિધ કાળજી તથા ઉઘમ કરે છે. એ મિથ્યામતિ પાખંડીઓ અને કુમતવાદીઓ વગેરેનો નિગ્રહ કરે છે.

આચાર્ય એટલે ભાવવૈદ : ગુણનો ખજાનો :-

જગતના જીવો કર્મરોગથી પીડાય છે, ને એમાં પાદ્ધા રાગદ્વેષરૂપી કુપથને સેવી સેવી કર્મરોગ વધારે છે. આની સામે આચાર્ય એ ભાવવૈદ બની ભવ્ય જીવોને ધર્મઔષ્ધ આપી વૈરાગ્ય અને ઉપશમનું પથ્ય સેવરાવી કર્મરોગ નાબૂદ કરે છે. અનાદિ અનંતકાલથી ભવાટવીમાં ભમતા રખડતા જીવોને આચાર્ય ભગવાન માનવ જીવનના મૂલ્ય અને કર્તવ્ય પથ્ય સુઝાડી ઉન્તિના મહામાર્ગ ચઢાવે છે. હદ્યની કુદ્રતા, સંકુચિત મતિ, ભૌતિક દિષ્ટિ, વાસના અને વિકાર, ઈર્ધા અને કલેશ, ગર્વ અને સ્વાર્થ, ભમતા અને માયા, ભવ અને હાયવોય વગેરે અનેકાનેક દર્દને શાંત કરી આચાર્ય એ જીવોને સુંદર સમાધિનું આરોગ્ય આપે છે. આચાર્યના ઉપકારથી લોકનું વ્યાવહારિક જીવન શાંતિભર્યું, સાંસારિકજીવન તૃપ્તિભર્યું, નૈતિક જીવન ઊંચું, કૌટુંભિક જીવન વિવેક વાત્સલ્યભર્યું અને ધાર્મિક જીવન તત્ત્વપરિણિતિ-ઉલ્લાસ અને સંવેગભર્યું બને છે.

આચાર્ય એ ગુણના ખજાના છે. એમનામાં ઉદ્-ઉદ ગુણોની એકેક છજીશી એવી છજીશ છજીશી ગુણોની હોય છે. એમાં આગળ કહેવાશે તે સાધુજીવનના ૨૭ ગુણો, નવ બ્રહ્મ ગુપ્તિ, ૮ પ્રભાવકતા, ૮ બુદ્ધિગુણ, ૮ પાપનિદાન ત્યાગ, ૧૨ પ્રતિમા, ૨૫ ભાવના, ૧૪ પ્રતિરૂપાદિગુણો, સુરૂપતા, તેજ, યુગપ્રધાનતા, બહુશુત્તતા, મધુર આદેય વચ્ચન, ગાંભીર્ય, પરમસંતુષ્ટતા, ઉપદેશકતા, અપરિશ્રાવિતા-અન્યના મર્મનું ગોપન-અપકટન, સૌભ્યતા, ગંધોપદ્ધિ-સંગ્રહ, અગમતા-અગમપણું, અવિકથન, (સ્વપ્રશંસા નહિ અને અચપલતા) આવા આવા ૧૨૬ ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-શ્રી અરિહંત પરમાત્માની ઓળખાણ (ભાગ-૧૮)

મહાન ઉચ્ચ ગુણો હોય છે.

#### ૪. ચોથા પરમેષ્ઠી શ્રી ઉપાધ્યાયજી મહારાજ :-

ઉપાધ્યાયજી સાધુઓને સૂત્ર સિદ્ધાન્તોના પાઠક હોય છે. એમના પચીસ ગુણ કહેવાય છે. તે આ રીતે : ૧૧ અંગ નામના આગમ+૧૪ ‘પૂર્વ’ નામના મહાશાસ્ત્ર (અથવા ૧૨ ઉપાંગ+૧ ચરણસિતરી+૧ કરણસતરી) એમ રૂપ ના એ ભાષાવનાર છે. એથી પચીસ ગુણોને ધરનારા કહેવાય છે. એમ તો પાંચ મહાવ્રતની પચીસ ભાવના અથવા વંદનના પચીસ આવશ્યક, કે પચીસ કિયા-આશ્રવના ત્યાગ, અથવા બાવીસ પરિસહસ્રન અને ત્રણ ગુપ્તિપાલન મળીને પચીસ ઈત્યાદિ ઈત્યાદિ લઈને પચીસ ગુણ થઈ શકે છે. પરંતુ તે તો સાધુમાં પણ હોય છે. બાકી ઉપાધ્યાય વર્તમાન કાળે અંગ, ઉપાંગ, પયન્ના, છેદસૂત્ર, મૂળસૂત્ર વગેરે સૂત્રોને નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા સાથે ભાષાવે છે. એ રીતે શુતપ્રવાહને વહેતો રાખનાર હોઈ શ્રી જિનપ્રવચનના એ સ્તંભ છે. પથ્થર જેવા અબુજ શિષ્યને પણ વિદ્યાથી પત્લવિત કરતા હોઈ એ અજબ માન્યિક છે; મહા ઉપકારક છે. શાંતિ, સમતા અને ઉત્સાહથી શિષ્યને તૈયાર કરતા હોઈ શ્રી સંધના મહાન આધાર છે. એમની સુદૃષ્ટિ એવી છે કે ચાય રાજાપણામાંથી આવેલ શિષ્ય હોય કે રંકપણામાંથી, પરંતુ બન્નેને નિષ્પક્ષપાત રીતે સૂત્રદાન કરે છે. સ્વયં અહોર્નિશ દ્વારાશાંગીના સ્વાધ્યાયમાં લીન રહે છે. ભવસાગરથી તરવા માટે એ અદ્ભુત નિર્યામિક છે. પરવાદીરૂપી ઉન્મત હાથીઓ માટે સિંહસમા છે. ઉપાધ્યાયનાં બીજાં નામ વાચક, પાઠક, સ્થવિર, કુત્રિકાપણ (દ્વારાઈ દુકાન), આત્મપ્રવાદી વગેરે છે.

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદ્વિ”

વર્ષ-૪, અંક-૩૫, તા. ૧૮-૫-૧૯૫૬



#### ૨૧ શ્રી અરિહંત પરમાત્માની ઓળખાણ

##### (પ) પાંચમા પરમેષ્ઠી શ્રી સાધુમહર્ષિ :-

પાંચમા પરમેષ્ઠી પદે સાધુ મહર્ષિઓ બિરાજે છે. ગૃહસ્થપણાનો ત્યાગ કરી લોકસંજ્ઞા મૂડી સર્વ પાપવ્યાપારોને પ્રતિજ્ઞાપૂર્વક છોડવારૂપ અલોકિક સાધુતાને અંગીકાર કરનારા એ હોય છે. પાંચમહાવ્રતની ભીખ પ્રતિજ્ઞા સ્વીકારી એ સૂક્ષ્મજીવનની પણ હિંસા મનથી જાતે કરતા નથી, બીજા પાસે કરાવતા નથી, અને કરનારને સારો માનતો નથી. એવી રીતે સૂક્ષ્મ પણ જૂઠ, ચોરી, વિષયસેવન

કે પરિગ્રહધારણના એ નવ કોટિએ ત્યાગી હોય છે. નવ કોટિ ત્યાગ એટલે મન, વચન, કે કાયાએ ન કરવું, ન કરાવવું, કે ન અનુમોદવું. પહેલા વ્રતના શુદ્ધ-પાલન માટે એ સ્વયં તો પચન-પચાવવાના ત્યાગી હોય છે જ, પરંતુ સાધુ માટે બીજાએ રાંધું હોય તો એ પણ ત્યજે છે; અને ગૃહસ્થ સાધુના ઉદ્દેશ વિના પોતાના ઉદ્દેશો બનાવેલી વસ્તુમાંથી વહોરાવે તો એ થોડુંક જ લેતા ઘર ઘર ફરી માધુકરી વૃત્તિએ ભિક્ષા ગ્રહણ કરનારા હોય છે. એમને ઘર, માલ-મિલકત, કુટુંબ વગેરે કાંઈ હોતું નથી. સ્ત્રીને તો એ અડતા પણ નથી. મસ્તકના તથા દાઢી-મૂઢ્ઝના કેશ પણ હાથે ચૂંટી કાઢે છે. ગાડી વગેરે વાહનમાં કદીય બેસતા નથી. કાચું પાણી, માટી, અંનિ, વનસ્પતિ વગેરેને સ્પર્શતા પણ નથી. જીવન આખુંય શાસ્ત્રાધ્યયન-ચિંતન-અધ્યાપન, ધ્યાન, ત્યાગ, તપસ્યા, ઈન્દ્રિયનિગ્રહ, મનશુદ્ધિ, ક્ષુધા-તૃષ્ણા-માનાપમાનાદિ પરિસહોનું સહન...વગેરેમાં પસાર કરે છે.

**સત્તાવીશ ગુણસાધના :-** સાધુના સત્તાવીસ ગુણ ગણાય છે. તે આ રીતે : અહિસાદિ પાંચ મહાવ્રત અને એક રાત્રિભોજનવિરમણ એમ વ્રત દ+પૃથ્વીકાયાદિ સંરક્ષણ દ+ઈન્દ્રિયનિગ્રહ પ+ભાવવિશુદ્ધિ ૧+કથાયનિગ્રહ અને ક્ષમાદિ ૪+અકુશલ મન-વચન-કાયાના નિરોધ દ+પરિસહસ્રન ૧+ઉપસર્ગ પણ સમતા ૧=૨૭. અથવા બાધાયાભ્યન્તર તપ ૧૨+સુડતાલીસ દોષરહિત આણાર ૧+અતિકમાદિ દોષત્યાગ ૪+દ્રવ્યાદિ અભિગ્રહ ૪+વ્રત દ=૨૭ વગેરે. આમાં બાહ્યતપમાં અનશન, ઉનોડરિકા, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ ને સલીનતા એ છ આવે. આભ્યન્તરતપમાં પ્રાયશ્વિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ એ છ આવે. આહારના સુડતાલીસ દોષમાં ગૃહસ્થ થકી થયેલા ઉદ્ગમના દોષ ૧૬, સાધુએ લગડેલા ઉત્પાદનના દોષ ૧૬ અને એષણાના દોષ ૧૦, એમ ગવેષણા-ગ્રહણેષણાના દોષ ૪૨, તથા મંડલીના દોષ ૫ મળી કુલ ૪૭ આવે. અતિકમાદિ ચારમાં અતિકમ, વ્યતિકમ, અતિચાર અને અનાચાર આવે. દ્રવ્યાદિ અભિગ્રહમાં દ્રવ્ય-કૈત્રા-કાલ ભાવની અપેક્ષાએ વિવિધ પ્રતિજ્ઞાઓ આવે.

**અનુમોદનીય સાધુતા :-** સાંસારિક સર્વ સંબંધો અને સર્વ પ્રવૃત્તિઓ ત્યજી દીધી હોવાથી, સાધુ આત્મપરિણાતિને વિશુદ્ધ કરવાની પ્રવૃત્તિમાં જ મસ્ત રહે છે. બીજાઓ માટે પણ એ ભાવદ્યાના બંડાર હોય છે. (કર્મના કૂર સંકંજામાંથી જીવો કેમ બચે ? એ માટે, તથા મોહની માનસિક વૃત્તિ, વાચિક શબ્દ અને કાયિક વર્તાવથી કેમ છૂટે એ માટેની દ્યા તે ભાવદ્યા.) વિષ ગરલ અને સંમૂર્ખીભ અનુષ્ણાનને ત્યજી તદેનું અને અમૃતકિયારૂપે પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ અનુષ્ણાનના કમિક વિકાસને એ સાધનારા હોય છે. એ માટે તેર કાઠીઆને તજી,

આર્ત અને રૌત્ર ધ્યાનને પરિહારી, કૃષ્ણાદિ અશુભ લેશ્યાને નિવારી, ચાર દુઃખશાયા, સાત ભય, આઈ મદ, નવ પાપનિદાન, સંકલેશ વગેરેને તિલાંજલિ આપી સામાયિક, ભાવસમાધિ, મૈત્રાદિ ભાવના, આત્મતૃપ્તિ, ક્ષમાદિ ધર્મો વગેરેના અભ્યાસી બન્યા રહે છે. સમિતિ ગુપ્તિ, પંચાચાર, દ્વિવિધ તપ, ઈચ્છાકાર, અપરાધનો મિથ્યાદૃષ્ટ, ગુરુવચન પર ‘તથાસ્તુ’ કરવું, વગેરે દશ પ્રકારની ચકવાલ સામાચારીનું નિત્યપાલન કરે છે. ટૂંકમાં સાધુમહાત્મા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર અને તપની ઉપાસનાનું જ જીવન જીવે છે. એમને પંચમહાત્મત એ નિવૃત્તિ માર્ગ છે. અને પંચાચારનું પાલન એ પ્રવૃત્તિમાર્ગ છે.

ગૃહસ્થને સમ્યક્તવ મૂલક બાર પ્રતરૂપ શ્રાવકર્ધમની જેમ સાધુને દશ પ્રકારે યત્નિર્ધમ પાળવાનો છે. તે આ પ્રમાણે : ક્ષમા, મૃહૃતા, ઋજુતા, નિર્લોભતા, તપ, સંયમ, સત્ય, શૌચ (મનની પવિત્રતા) બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. સાધુનાં બીજા નામ મુનિ, યત્ન, યોગી, બિશ્વ, માહશ, નિર્ઝન્થ, મહાત્મતી, સંન્યાસી, વાચયમ, મોહજ્યી, અંકિયન, શ્રમણ, ક્ષમાશ્રમણ, દીક્ષિત, પ્રવજિત વગેરે છે.

**ઉપાસના માટે આવા અન્યત્ર અલાભ્ય એવા પંચ પરમેષ્ઠીના સ્વરૂપને બતાવનાર શ્રી અરિહંત પ્રભુ જ છે. પરમેષ્ઠી બનવાનું એમના શાસનમાં જ છે.**

**યોગ :- મોક્ષ સાથે આત્માને જે યોજી આપે તેને યોગ કહેવાય, અનેકાંત પદ્ધતિએ એવા અનેક યોગો શ્રી અરિહંત પ્રભુએ બતાવ્યા છે. એમાં મુખ્ય રત્નયત્રી યોગ, દર્શન-જ્ઞાન-ચારિત્ર યોગ છે. જૈનશાસનના વિશિષ્ટ યોગો જુઓ :**

**રત્નત્રયી યોગ : આરાધના માર્ગ : મોક્ષમાર્ગ :-** ઉપાસનાના વિષયમાં પરમેષ્ઠીના જેમ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર છે. એ મોક્ષ ખરીદવા માટે સાચાં ત્રણ રત્ન હોવાથી રત્નત્રયી તરીકે ઓળખાય છે. સંસાર-ભ્રમણનો અંત લાવી મુક્તિપદ પામવા માટે આજ ત્રણ સાધન છે; ને તે પણ ત્રણે ભેગાં મળીને મોક્ષે પમાડવા સમર્થ છે. તેથી સૂત્રકાર કહે છે, સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગ : ।

**નવપદ :-** આમાં ચારિત્રમાંથી તપને જુદો પાડીએ તો દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ ચાર ઉપાસનીય બને, તે પૂર્વના પાંચ પરમેષ્ઠીની સાથે ગણતાં કૂલ નવ-પદ થાય. તેને સિદ્ધયક પણ કહેવાય છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ દરેકનું વિસ્તૃત સ્વરૂપ તટસ્થ રીતે જોતાં જરૂર એમ લાગે કે આ રત્નત્રયી માર્ગ શ્રી જિનેન્દ્રશાસનની જ એક વિશેષતા છે. બીજા તો કોઈક ન્યાયદર્શન જેવા એકલા રત્નજ્ઞાનથી મોક્ષ કહે છે, તો મિમાંસક જેવા ક્રિયાથી (કર્મકાંઠી) મોક્ષ કહે છે. ત્યારે યોગદર્શન જેવા જ્ઞાન-વૈરાગ્યથી મોક્ષ માને છે. પણ જ્ઞાન કે ક્રિયા કે જ્ઞાન-ભૂવનભાનું એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ” (ભાગ-૧૮)

૧૨૮

વૈરાગ્ય એ બધું અધું છે, અને એ માનેલા તત્ત્વજ્ઞાન, કર્મકાંઠ વગેરે યથાર્થ મોક્ષમાર્ગ બનવા યુક્તિયુક્ત પણ નથી. આ વસ્તુ જો કે પૂર્વે દર્શવિલ વિશિષ્ટ વિષયોના વિસ્તૃત બોધથી બરાબર સમજી શકાય એમ છે, છતાં એટલું ખરું કે સંસાર જે મિથ્યાત્વ, અને જે અજ્ઞાનયુક્ત અચારિત્ર, (મલિનવૃત્તિ, પ્રવૃત્તિ અને અવિરતિ)થી છે, તેને ટાળનારા સર્વજ્ઞોક્ત સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર જ છે. આમાં જ્ઞાનયુક્ત ચારિત્રથી વિરતિભાવ, ક્ષાયનિગ્રહ અને (અસતુ) પ્રવૃત્તિ નિરોધ રૂધાય છે.

**પંચાચારયોગ :-** ઉપર કહેલ રત્નત્રયીની ઉપાસના માટે વિશિષ્ટ કોટિનો પંચાચાર પાલનનો માર્ગ છે. એમાં આઈ આઈ પ્રકારનો જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચારિત્રાચાર તથા બાર પ્રકારનો તપાચાર અને છત્રીસ પ્રકારનો વીર્યાચાર છે. આના વિવેચનનો અહીં અવકાશ નથી. એવું આગળ ઉપર પણ સમજવું. તેથી માત્ર નામનિર્દેશ જેવું કરવામાં આવે છે.

**વિશિષ્ટ સમ્યગ્દર્શન યોગ :-**

સમ્યક્તવ એટલે તત્ત્વજ્ઞાન છે. પરંતુ સમ્યક્તવ એટલે તત્ત્વભૂત દેવગુરુ ધર્મ ઉપર શ્રદ્ધા કર્યાનું કહેવા માત્રથી નથી પતતું. એ માટે જિનશાસસન ૪ શ્રદ્ધાન, ૩ લિંગ, ૩ શુદ્ધિ, ૫ લક્ષ્ણા, ૧૦ વિનય, ૮ પ્રભાવક, ૫ ભૂષણ, ૫ દૂષણ-ત્યાગ, ૬ ભાવના, ૬ આગાર, ૬ સ્થાન, અને ૬ યતના-એમ ૬૭ પ્રકારનો સમ્યક્તવનો વ્યવહાર પાળવાનું શિખવે છે. વળી શ્રદ્ધામાં પણ ક્ષાયિક, ક્ષાયોપશમિક, અને ઔપશમિક સમકિત તથા સંક્ષેપરુચિ, વિસ્તારરુચિ, બીજુચિ વગેરે દશ પ્રકારની રુચિનો વિસ્તાર આવે છે.

**જ્ઞાનયોગ :-** જિનશાસનમાં મુખ્ય પાંચ જ્ઞાન છે. એમાં ૨૮ પ્રકારે મતિજ્ઞાન, ૧૪ (ઉત્તરભેદ ૩૪૦) ૧૪ પ્રકારે શુત્રજ્ઞાન (અન્ય રીતે ૨૦ પ્રકારે પણ), ૬ પ્રકારનું અવિજ્ઞાન, બે પ્રકારે મન:પયાયજ્ઞાન અને એક પ્રકારે સર્વજ્ઞતારૂપ કેવળજ્ઞાન એ ૫૧ બેદે વિશિષ્ટ કોટિની જ્ઞાન પ્રરૂપણ છે. એમાં પણ શુત્રજ્ઞાનમાં ચૌદ પૂર્વો, અંગ, ઉપાંગ, મૂળસૂત્ર, છેદસૂત્ર, પ્રતીર્ણિક વગેરે આગમ શાસ્ત્રો, સન્મતિતર્ક અનેકાંત જ્યાપતાકા-શાસ્ત્રવાર્તા-સ્વાદ્વાદ રત્નાકર વગેરે દર્શનશાસ્ત્રો, ઉપદેશમાળા-ઉપદેશ સપ્તતિકા, ઉપદેશ તરંગિણી, ઉપદેશ રહસ્ય, ઉપદેશ રત્નાકર વગેરે ઉપદેશ ગ્રન્થો, લોક પ્રકાર પ્રવચન સારોદ્વાર, જીવ વિચાર, નવ-તત્ત્વ, સંગ્રહણી વગેરે પ્રકરણ ગ્રન્થો, પંચસંગ્રહ, ક્રમપયરી, કર્મગ્રન્થ, વગેરે કર્મસાહિત્ય; યોગબિન્દુ, યોગદાસિ, પોડશક, અધ્યાત્મસારાદિ યોગ-અધ્યાત્મગ્રન્થો, ઈત્યાદિ ઈત્યાદિ અનેકાનેક વિષયોના અનેક શાસ્ત્રોમાં વર્ણવાયેલા વિશિષ્ટ પદાર્થોના આદ્યપ્રરૂપક શ્રી સર્વજ્ઞ જિનેશ્વર ૧૩૦ ભુવનભાનું એન્સાઈક્લોપીડિયા-શ્રી અરિહંત પરમાત્માની ઓળખાણ (ભાગ-૧૮)

દ્વો જ છે. આ જૈન આગમ અને જૈન શાસ્ત્રોના જ્ઞાનયોગમાં લીન થનારને અહીં મોક્ષનો અનુભવ થાય છે.

**ચારિત્રયોગ :** વિરતિમાર્ગ એ પણ જૈનશાસનની જ વિશેષતા છે. વિરતિ=પાપથી વિરામ પામવાની પ્રતિજ્ઞા સાથે નિવૃત્તિ. સામાન્ય સમજ એવી હોય છે કે 'કરે તે ભરે' અર્થાત્ પાપાચરણ કરે તેને દંડ ભરવો પડે, ન કરે તેને કાંઈ નહિ. શ્રી અરિહંત પરમાત્મા એમ કહે છે કે પાપ ન આચરવા છતાં પાપત્યાગની જ્યાં સુધી પ્રતિજ્ઞા ન કરે ત્યાંસુધી પણ દંડ ભરવો રહે છે. કારણ એ છે કે પ્રતિજ્ઞા ન કરવા દેનારું એક ખરાબ તત્ત્વ હદ્યમાં બેઠું છે. તે છે પાપ પ્રત્યેનો અપેક્ષાભાવ. 'વર્તમાનમાં નહિ સહી, તોય ભવિષ્યમાં કદાચ તે પાપ સેવવું પડે માટે પ્રતિજ્ઞા નહિ લઈએ' આ વલણમાં પાપની અપેક્ષા બેઠી છે. તે પણ ગુનો છે. તેનો ત્યાગ પ્રતિજ્ઞાથી થાય છે. શ્રી અરિહંત પ્રભુ પણ જન્મથી મહાવૈરાગી અને સંસારથી અલિપ્ત જેવા છતાં એમને એમ સાધુજીવનમાં ન પેઢા, પરંતુ 'કરેમિ સામાઈએ...' ની પ્રતિજ્ઞા કરીને પેઢા. કેમકે તો જ પાપના બંધનથી બચાય.

**વિરતિ બે પ્રકારે :** વિરતિ સાધુમાર્ગની તે સર્વવિરતિ, અને ગૃહસ્થધર્મની તે દેશવિરતી કહેવાય છે. સર્વવિરતિમાં હિંસા-જૂઠ-ચોરી-મૈથુન-પરિગ્રહ એ પાંચ પાપોનો સર્વથા ત્યાગ કરવાની પ્રતિજ્ઞા હોય છે. સર્વથા એટલે મન-વચન-કાયાથી જિંદગીભર માટે તે તે પાપ કરવા, કરાવવા, કે અનુમોદવાના નહિ. આને ચારિત્ર કહે છે, સંયમ કહે છે. તે એકજ પ્રકારે છે. દેશવિરતિમાં સ્થૂલપણે પ્રતિજ્ઞા કરાય છે. અમુક અમુક પાપ કરીશ નહિ, કે કરીશ-કરાવીશ નહિ. તેમાં અહિસાદી બારત્રત આવે છે. બધાનો મુદ્રો પ્રતિજ્ઞા સાથે પાપત્યાગ છે. અનાદિના પાપસંગ એમ જ છૂટે છે.

**અહિસાયોગ :-** શ્રી અરિહંત પ્રભુએ ફરમાવેલ અહિસામાર્ગ સૂક્ષ્માતિસૂક્ષ્મ છે. ઈતરોમાં સંસારત્યાગ કરી વાનપ્રસ્થ કે સંન્યાસ લે તો પણ અજિ-પાણી-વનસ્પતિ વગેરેના આરંભ ઊભા રહે છે. જૈન સાધુદીક્ષામાં તો એને અડવા જેટલી પણ હિસાનો ત્યાગ હોય છે. એટલું જ નહિ, પણ ઉપર કહું તેમ મનથીય હિસાની અનુમોદના વર્જ્ય છે તેથી દા.ત. ભગતે સાધુ માટે કોઈ ચીજ રાંધી તો તે પણ સાધુ લઈ શકે નહિ. સાધુને તો નિર્દોષ અને નિર્જવ આદાર મધુકરી વૃત્તિથી લેવાનો હોય છે. નિર્દોષતા ત્યાં સુધીની કે ગૃહસ્થ સાધુને વહોરાવતાં કાચા સજ્જવ પાણી વગેરેને અડી જાય તો ય તેની પાસેથી સાધુ વહોરતા નથી. એમ અપ્રકાયની અહિસા ત્યાં સુધીની કે સૂર્યાસ્ત થવાના થોડા પૂર્વકાળથી માંડી સૂર્યોદય પછીના થોડા કાળ પર્યત આકાશમાંથી જે સજ્જવ ઓસ પડે છે તેનીય દયા કરવાની

હોય છે. તેથી ન છૂટકે બહાર જવું પડે તો ગરમ કામળીથી શરીર ઢાકીને જાય છે. કેવો જીણો અહિસામાર્ગ પ્રભુએ બતાવ્યો ! આવી અહિસા સહિતનો સૂક્ષ્મકોટિનો વિરતિ માર્ગ એ ભવબ્રમણમાં હુઃખ્યથી રીબાતા સંસારી જીવોને ઉદ્ધરવા માટેની શ્રી અરિહંત પરમાત્માની અલોકિક બક્ષિસ છે. અહો ! અનંત ઉપકાર એ દેવાધિદેવનો ! નહિતર ક્યાંથી જીવો સર્વથા નિખાપ બની કર્મરહિત થઈ શકત ? કેવી રીતે મોક્ષ પામી શકત ?

**સંયમયોગ :-** ત્યારે વિશિષ્ટ કોટિનો સંયમમાર્ગ પણ શ્રી સર્વજ્ઞ જિનેશ્વરદેવોની જ એક બક્ષિસ છે. એમાં ચરણસિતરી અને કરણસિતરી એમ બે વિભાગમાં ૭૦-૭૦ ગુણોનો માર્ગ પાળવાનો હોય છે. એમાં પૂર્વ કહ્યા તે વિરતિમાર્ગના મુખ્ય પાંચ મહાક્રતોની સાથે ક્ષમાદિ શ્રમણધર્મ-પ્રેક્ષાદિસંયમ-વૈયાવચ્ચ-બ્રહ્મવાડ-કખાયનિગ્રહ-પિંડવિશુદ્ધિ-સમિતિ-ભાવના-બિક્ષુપ્રતિમા-ઈન્દ્રયનિરોધ-પ્રતિલેખના-ગુપ્તિ અને દ્રવ્યાદિ અભિગ્રહો આવે છે. આના વિસ્તારનો અભ્યાસ કરનાર સમજ શક્ષે કે આ બતાવવામાં પણ અરિહંત પરમાત્માનો જ અનુપમ ઉપકાર છે. એ ઉપકારમાંથી પછી ઝરણાંઓ લઈને ઈતર મટવાળાઓઓ અહિસાદિનો ઉપદેશ કર્યો છે.

**તપો-યોગ :-** ૧ અનશન, ૨ ઉનોદરિકા, ૩ દ્રવ્યસંક્ષેપ, ૪ વૃત્તિસંક્ષેપ, ૫ વિકૃતિત્યાગ, ૬ રસત્યાગ, ૭ પાદવિહાર લોચ, ૨૨ પરીસહ, અને ઉપસર્જનું સહનરૂપ કાયકલેશ, ૯ મનોવાક્યાયસંલીનતા-આ ખૂલ્યિય ‘ભાવાતપ’ છે; ૧ પ્રાયાશ્રિત-૨ વિનય-૩ વૈયાવૃત્ય ૪ સ્વાધ્યાય-૫ ધ્યાન, ૬ કાયોત્સર્જ આ છ પ્રકારે ‘આભ્યન્તર તપ’ નો માર્ગ, એ પણ માત્ર શ્રી તીર્થકરદેવોની ભેટ છે ! અરે ! એકલા ‘અનશન’ નામના પહેલા પ્રકાર અંગે જોઈએ તો હેંમેશને માટે સૂર્યાસ્તથી સૂર્યોદય સુધીના સમયનો રાત્રિભોજનનો ત્યાગ બીજે ક્યાં જોવા મળે છે ? ત્યારે બારે તપના વિસ્તારની સમજૂતી લેવામાં આવે તો શ્રી જિનશાસનની ખરેખર લોકોત્તરતા અને અનંત ઉપકારકતા જણાયા વિના રહે નહિ.

**ધર્મમાર્ગ :-** ઉપર કહેલ વિશિષ્ટ કોટિના અહિસા, સંયમ અને તપોમાર્ગની ત્રિપુરીરૂપ ધર્મ જ ઠેઠ મોક્ષે પહોંચાડવા સમર્થ છે; તેથી એ મુખ્ય ધર્મમાર્ગ છે તો કહી શકાય કે એવા ધર્મમાર્ગને પણ શ્રી સર્વજ્ઞ પ્રભુએ જ બતાવ્યો છે.

**આશ્રવત્યાગ-સંવર-નિર્જરોપાદાન યોગ :-** આ પણ શ્રીઅર્હટકથિત અનન્ય મોક્ષયોગ છે. આશ્રવ=કર્મબંધના કારણ. સંવર=કર્મબંધને અટકાવનારી ચર્ચા, તકેદારી. નિર્જરા=કર્મક્ષયનાં કારણ. ઉપર કહેલા ધર્મમાર્ગને યથાસ્થિત પાળવા માટે જીવનમાંથી કર્મબંધના હેતભૂત આસ્ત્રવોને ત્યજ સંવર-નિર્જરાનું સેવન કરવાનું હોય છે.

**આશ્રવોમાં :-** મિથ્યાત્વ, ઈન્દ્રિયોની અવિરતિ, હિંસાઈ-અવિરતિ, કોથાદિ કષાયો કામ અને હાસ્યાદિ નોકષાયો, અપ્રશસ્ત મનવચન કાયાના યોગો અને આગળ વધીને અંતે પ્રશસ્ત પણ યોગો તથા એમાં સમાતી પચીસ કિયાઓ આવે છે. એમાંય જ્ઞાનાવરણીયાદિ કર્મો બંધાવનારા પ્રત્યેકના પાછા નિર-નિરાળા અનેક આશ્રવો છે. મુમુક્ષુએ એ બધું ત્યજવાનું છે.

**સંવરયોગમાં :-** પ સમિતિ અને ઉ ગુપ્તિનું પાલન, ૨૨ પરીસહોનું સમભાવે સ્વેચ્છયા સહન, ૧૦ યત્નિર્ધર્મસેવન, ૧૨ અનિત્યાદિ ભાવનાનું ચિંતન, પ ચારિત્ર-એમ સત્તાવન પ્રકાર પાળવાના આવે છે. આમાં સમિતિ ગુપ્તિને અષ્ટ પ્રવચન માતા કહેવાય છે. સાંગોપાંગ તે પણ જો જિનશાસન વિના બીજે ક્યાંય જોવા નથી મળતી, તો સંપૂર્ણ સંવરમાર્ગની તો વાતેય શી ?

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદધિ”

વર્ષ-૪, અંક-૩૬, તા. ૨-૬-૧૯૫૬



## શ્રી અર્ધંત પરમાત્માની ઓળખાણ

**નિર્જરાયોગમાં :-** ઉપર કહેલ બારે પ્રકારનો તપોમાર્ગ આવે છે. મુમુક્ષુએ સંવર અને નિર્જરામાર્ગને સતત આદરવાના છે.

**શુદ્ધિયોગ :** (પ્રાયશ્વિત માર્ગ) :- મોક્ષમાર્ગની આરાધના કરતાં કરતાં જાણે-અજાણે માનસિક-વાચિક-કાચિક જે કોઈ દોષ સેવાઈ જાય, એ પણ નિર્મલ કરી શુદ્ધ થવા પ્રાયશ્વિત વિધિ છે. દરેક દરેક દોષ કેવા કેવા પ્રકારે લાગે છે, ક્યા ક્યા સંયોગમાં લાગે છે, અને તેની શુદ્ધિને માટે દરેક દરેકના કેવા કેવા પ્રાયશ્વિત હોય છે, એનું પ્રતિપાદન પણ શ્રી સર્વજ્ઞ ભગવંતોએ જ કર્યું છે. તેથી એવા મહાવિસ્તારથી ને એવી સૂક્ષ્મતાવાળું કર્યું છે કે જે બીજા શાસનમાં ક્યાંય જોવા નથી મળતું, માત્ર આ વિષયના પણ અનેક છેદગ્રંથો નામના શાસ્ત્રો ભર્યા પડ્યા છે. તેમાં દોષના કલ્ય, દર્ષ અને આકૃષ્ણ વગેરે પ્રકારો, દોષના પ્રતિ સેવકોની યોગ્યતા, પૂર્વ પ્રાયશ્વિતની બાકી, પ્રાયશ્વિત-વહનના કાળ પ્રાયશ્વિતનું પ્રમાણ વગેરે અનેકાનેક બાબતો આવે છે. આમાં પાછા અપવાદના પણ વિશિષ્ટ માર્ગ હોય છે, કેમાં સ્વલ્ય પ્રાયશ્વિત આવે, કે જરાય પ્રાયશ્વિત ન આવે. આ શુદ્ધિયોગ અપેક્ષાએ જ્ઞાનયોગ કર્મયોગ, ભક્તિયોગાદિ કરતાંય વિશેષતાવાળો છે.

**સાધનમાર્ગ :-** ઉપર કહેલા અનેકવિધ માર્ગને જીવનમાં સરળતાથી અને

સચોટપણે ઉતારવા માટે શ્રી વીતારાગ સર્વજ્ઞદેવોએ કમિક સાધનાનો માર્ગ બતાવ્યો છે, એમાં સામાન્યધર્મ અને વિશેષધર્મ એમ બે મુખ્ય ભેદ પડે છે. પહેલામાં શ્રી જિનના શાસનને નહિ પામેલો આત્મા પણ પાણી શકે એવો માર્ગનુસારી જીવનનો પાંત્રીસ ગુણની સાધનાનો માર્ગ આવે છે. ત્યારે બીજા વિશેષધર્મમાં અપુનર્બધકદશાના ગ્રણ ગુણપૂર્વક ગૃહસ્થધર્મના સમ્યક્તવ સહિત ૫ અણુવ્રત, ૩ ગુણવ્રત અને ૪ શિક્ષાવ્રતની સાધનાનો માર્ગ આવે છે. એમાંય આગળ વધતાં શ્રાવકની ૧૧ પ્રતિમા (માસ-બે માસ-ગ્રણ માસ વગેરેના દ્વદ્દ સમ્યક્તવ-સામાયિકાદિ સાધવાનો ઘોર અભિગ્રહો) આરાધવાનું આવે છે. તે પછીના ઉચ્ચ વિશેષ ધર્મમાં સાપેક્ષ યત્નિર્ધમ અને નિરપેક્ષ યત્નિર્ધમ સાધવાનો હોય છે. એમાં પહેલો ઉત્સર્ગ અને અપવાદરૂપે સાધુ સમુદ્દરમાં રહીને, અને બીજો તે પછી બાધ્ય-આન્તર સંલેખના-તુલનાદિ દ્વારા પરિપક્વ થયેલા આત્માએ અસહાય એકાકી વિચરીને ઉત્સર્ગરૂપે આરાધવાનો હોય છે.

**યોગ્યતામાર્ગ :-** ઉપરોક્ત સાધના જો યોગ્ય આત્મા કરે તો જ તે સફળ બને છે. એ માટે શ્રી જિન-શાસનમાં ભિન્ન-ભિન્ન યોગ્યતાના જુદા જુદા ગુણો બતાવ્યા છે. એમાં શ્રાવકધર્મની યોગ્યતાના ‘અક્ષુદ્રતા, પ્રકૃતિ સૌમ્યતા...’ વગેરે એકીવિસ ગુણો છે, અને સાધુધર્મની યોગ્યતામાં અધાર દોષના ત્યાગપૂર્વક વિશિષ્ટ જાતિ કુલસંપન્નતા, અવભુદ્ધ સંસાર-નિર્ણયતા વગેરે સોણ ગુણો છે.

**લક્ષણમાર્ગ :-** જેને અંતરત્મામાં દેશવિરતિ ગુણ અને સર્વવિરતિ ગુણની સ્પર્શના થઈ હોય તે કમશ : ભાવશ્રાવક ને ભાવસાધુ કહેવાય છે. એ દરેકના કિયાગત અને ભાવગત મૌલિક તથા અવાન્તર (મુખ્ય અને પેટા) લક્ષણો હોય છે. તેમાં ભાવશ્રાવકના ૧ કૃતપ્રતકર્મા, ૨ શીલવાન, ૩ શુણવાન, ૪ ઋજુવ્યવહારી, ૫ ગુરુશુષ્પક અને ૬ પ્રવચનનુશલ, એ કિયાગત ૭ મૂળભૂત લક્ષણો છે. એ દરેકના પાછા કોઈના પાંચ, કોઈના ૭, ચાર એમ પેટાભેદ છે. ત્યારે શ્રાવકના ભાવગત ૧૭ લક્ષણ છે; તેમાં શ્રાવક સ્ત્રી-ઈન્દ્રિય-અર્થ-સંસાર-વિષય-આરંભગૃહ...વગેરે સતત બાબતોના દરેકના પારમાર્થિક સ્વરૂપનો સતત વિચારશીલ રહે છે. ભાવસાધુના કિયાગત ૪ લક્ષણોમાં ૧ સક્લા માર્ગનુસારિણી કિયા, ૨ ધર્મે પ્રવરશ્છા, ૩ ઋજુપ્રજ્ઞાપનીયતા, ૪ કિયામાં અપ્રમાદ, ૫ શક્યાનુઝાન-પ્રારંભ, ૬ મહાન ગુણાનુરૂપ, અને ૭ ગુર્વીજ્ઞારાધન આવે છે. એ દરેકના વળી અનેક અવાન્તર લક્ષણો છે. તેમ ભાવગત અનેક લક્ષણ છે.

**પુરુષાર્થ યોગ :-** ચાર પુરુષાર્થમાંથી અર્થકામ પુરુષાર્થનો ત્યાગ કરી ધર્મપુરુષાર્થ અને મોક્ષપુરુષાર્થને આદરવાના છે; એ માટે ખાસ કરીને તામસભાવના અને

૧૩૪ ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ” (ભાગ-૧૮)

તेनाथी भिश्रित राजसभावना लक्षणो त्यज्ञ सात्त्विक भावना लक्षणो केणववा साथै विशिष्ट कोटिना १. प्रशिधान, २. प्रवृत्ति, ३. विघ्नज्य, ४. सिद्धि अने ५. विनियोग ए पांच आशयो आदरवा ज्ञोईछे. जैन-दर्शने आनी विशिष्ट विचारणा करी छे. आ प्रमाणे उपरोक्त मार्गो अने योगोनी साधना थाय तो ज सङ्कल बने छे.

**कर्तव्ययोग :-** अनादि अनंत काणथी भवमां भटकता ज्वने दुःखमय, दुःखफलक अने दुःखानुभंधी संसारमांथी धूटवा माटे पापकर्मोनो नाश करवापूर्वक शुद्ध धर्मनो उद्यम करवो पडे छे, अने तेनो प्रारंभ तथाभव्यत्वादिना परिपाकथी थाय छे. ते परिपाक करनारा त्रष्ण साधन छे; यतुःशरणगमन, दुष्कृतगर्ही, ने सुख्तानुमोदना. ए कर्या पछी आगण कर्तव्यमां अशुक्रत सहित अनेक गुणसेवन तथा ‘को मम कालो, किमेऽस्स उचितं’ = आ भारे क्यो अवसर छे, अने आने उचित कर्तव्य शुं छे,’ ऐनी सतत धर्मज्ञागरिका आवे छे. अनु नाम साधु धर्मनी परिभावना छे. अमां पक्व थये, पछीना कर्तव्य तरीके माता-पिताने अनेक उपायोथी प्रतिबोध अथवा समजूती करवानुं, ते यावत् ज़रुर पह्ये अटवी ग्लान औषध न्यायथी परमार्थथी अत्यागदृप अमनो त्याग अने गुरु आगण सविधि प्रवज्या ग्रहण आवे छे. त्यारबादना कर्तव्यमां गुरुसेवा, स्वाध्यायादि अनेकानेक उपासनाओदृप प्रवज्या पालन आवे छे. ते ठेठ समन्तभद्रतादि गुण सुधी पहोचे छे. छेवटे प्रवर्जयाना अंतिम फ्ल तरीके अनंतशान सुखादिमय निर्वाणपद नीपजे छे. आवो कर्तव्यमार्ग पश्च मात्र श्री सर्वज्ञ अरिहंतप्रभुनी कृपाप्रसादी छे.

**क्रियायोग :-** मोक्षमार्गना साधक साधु अने गृहस्थने चोक्कस प्रकारनी क्रियाओ करवानी होय छे. अमां साधुने पूर्वे कडेला पंचाचारमां आवती विविध क्रियाओ, तथा अमां विशेष करीने ज्ञतव्यवहार सहित सूत्रोक्त उत्सर्ग-अपवादना चारित्र मार्ग साथे दशविध सामाचारी, ओधसामाचारी अने पदविभाग सामाचारीनुं पालन करवानुं होय छे. त्यारे श्रावकने अनेकानेक दिनकृत्यो, रात्रिकृत्यो, पर्वकृत्यो, तथा यातुर्मासिक कृत्यो, अने पर्युषणा कृत्यो, वार्षिक कृत्यो अने ज्ञवन कृत्योनी क्रिया आयरवानी होय छे. आ पश्च श्री सर्वज्ञ परमात्मानी वाणीमां ज झगमगे छे.

**उत्कान्तियोग :-** सौथी नीयेना प्रथम गुणस्थानके भिथ्यात्वमंदताना अनेक उपायो साधतां भिथ्यात्वनो उपशम-क्षयोपशम करी योथा अविरति सम्यक्त्व गुणस्थानके यढवानुं; ते पछी उत्तरोत्तर आंतर रागद्वेषादि दोषोना विशिष्ट विशिष्ट नाशने साधतां साधतां पांचमे छहै... अम ठेठ तेरमे गुणस्थानके यढवानुं. त्यां

सर्वज्ञता प्राप्त थाय छे. ते पछी अंतकाळे सर्व कर्म खपावतां मोक्ष मणे छे. आ यौद गुणस्थानकना आरोहणनी विशिष्ट प्रक्रिया छे, ए बताववानो अनन्य उपकार एक मात्र श्री अरिहंत परमात्मानो ज छे.

**विकासयोग :-** अनादि अनंत काणथी ज्ञव भावमणथी युक्त होईने नवनवा कर्मो बांधी तिर्यग्यादि गतिओमां भम्या करे छे. अमां श्री सर्वज्ञ भगवाने ज दशविलो अनंता काणयक्कमय जे महाजंगी ‘पुद्गल-परावर्त’ काण तेवा पश्च अनंता वीती गया. परंतु ज्यारे ज्वने मोक्षे ज्वा पूर्वे एक ज पुद्गल परावर्तथीय ओछो काण बाडी रहे छे, त्यारे ते चरमावर्तमां अर्थात् चरम पुद्गल परावर्तमां आव्यो कहेवाय छे. भावमण अल्प थयेथी ज अमां आवी शके छे. ते पूर्वनो काण भवबाणकाण छे. ए वटाव्या पछी चरमावर्तमां ज्ञव आवे त्यारे ज ते धर्म पामे छे; अने त्यां अनो धर्म यौवनकाण गाणाय छे. अमां ए आत्मविकास साधे छे. आ आत्मविकास तेवा केवा कमे थाय छे तेनु पश्च विशिष्ट विवेचन श्री अरिहंत प्रभुआे ज करी भताव्यु छे. ए आत्मविकासमां बीज-अंकुर-कांड-पत्र-पुष्पादिरुपे डेय-उपादेयादि भावोनु ज्ञान-डेयनो त्याग अने उपादेयनु आराधन करनारा ज्वो पर बहुमान, ए त्याग-आराधनानी प्रशंसा, अने ए करवानी अभिलाखा उपरांत दृढ लालसा-उपायोनी शोध, प्रवृत्ति अने गुरुयोगादिरुप उपायनी प्राप्ति-गुरुदेशनानु श्रवण-अनो पर श्रद्धानपूर्वक मोक्षरुचिनी प्राप्ति सम्यक्त्व-ज्ञानदान, अभयदान, धर्मपक्षरणदान-समंतभद्रा देवपूजा-सर्व भंगला देवपूजा-परतत्वगता देवपूजा-श्रावक धर्म-प्रतिपक्षजुगुप्सा, परिषत्या लोचन, ईत्यादि विकासयोगनी अनेक साधना करतां करतां श्राद्ध प्रतिमा-यतिधर्म-ग्रहण आसेवन शिक्षा-वगेरे कमे ठेठ सिद्ध अवस्थानी विकास पराकाढा आवे छे. आ पश्च सर्वज्ञ परमात्मानी विशिष्ट भेट छे. आनु वर्षनि ‘विंशति विंशिका’ ग्रन्थमां आवे छे.

**भावनायोग :-** सर्व साधनानी मूणभूत जे चित्तविशुद्धि, अना माटे उत्तम भावनाओनी ज़रुर छे. ते मैत्री-करुणा-प्रमोद-माध्यस्थ भावना, अनित्य-अशरण-संसारादि द्रादश अनुप्रेक्षा, काण-अधिकरणादि नवविध चित्तन, पूर्वोक्त भावश्रावकना भावगत १७ लक्षणनी स्त्री-अर्थ वगेरे १७ भावना, साधुना पांच महात्रतनी २५ भावना, ईत्यादि भावनाओनो पश्च अमूल्य योग श्री तीर्थकरदेवे ज फ्रमावेलो छे.

**ध्यानयोग :-** मुमुक्षुओ यार यार प्रकारना आर्त अने रौद्र हुध्यनने टाणी धर्मध्यान अने शुक्लध्यान ध्याववानुं आवश्यक छे. धर्मध्यानमां आज्ञाविचय-अपायविचय-विपाकविचय, अने संस्थानविचय, तथा शुक्लध्यानमां पृथक्त्व सवितर्क

સવિચાર, એકત્વ અવિતર્ક અવિચાર-સૂક્ષ્મકિયાનિવૃત્તિ, સમુચ્છિન્ન કિયા અપ્રતિપાતી-એમ ચાર ચાર પાયા છે. ધ્યાનનો આ નક્કર અને સક્રિય યોગ છે. એમાં શુક્લધ્યાનના પહેલા બે પાયા ધ્યાવવા માટે જરૂરી એવું દ્રવ્યો અને એના પર્યાયોનું જે સૂક્ષ્માતિસૂક્ષ્મ સ્વરૂપનું જ્ઞાન, તે ચૌદ પૂર્વોમાં જ વાણવેલું મળે છે. તથા ધર્મધ્યાન માટે પણ જરૂરી પદાર્થોનું યથાસ્થિત વર્ણન શ્રી જિનવાણી દ્વારા જ મળે છે. ધ્યાનમાં આરૂપ થવા માટે પુનઃપુન: અભ્યાસ જરૂરી છે. એ માટે ૧ જ્ઞાન, ૨ દર્શન, ૩ ચારિત્ર અને ૪ વૈરાગ્યની ‘અનિત્યતા’દિભાવનાઓને, સંશય, સંમોહ, અન્યાસંગ અને ભયનો નાશ કરીને, ખૂબ ભાવતાં ભાવતાં ધ્યાનારોહણની યોગ્યતા આવે છે. એમાં બાધ્યાર્થની નિસ્પૃહ અને તત્ત્વચિત્તનનું પુનઃપુન: આવર્તન દ્વારા મનોનિગ્રહ કરવો પણ બહુ જરૂરી છે. ધ્યાન માટે જ્ઞાન સ્વી, પણ, નપુંસક, દુઃશીલથી રહિત જોઈએ. બાકી કણ અને આસન ગમે તે હોઈ શકે છે, માત્ર પોતાના મન, વચન અને કાયાના યોગો સમાધિમાં રહેવા જોઈએ. ધ્યાનની ભૂમિકા માટે આલંબન તરીકે ધ્યાનનો (૧) અથાગ આદર તથા (૨) સૂત્રાર્થ વાચનાદિ કિયા અને સદ્ગર્ભના આવશ્યકોમાં ઓતપ્રોતતા જોઈએ. આ ઉપરાંત કૃષ્ણ-નીલ-કાપોત લેશયા તથી પીત, પચ કે શુક્લ લેશયાનો અભ્યાસ તથા આગમશ્રદ્ધ વિનય અને સદ્ગુણસ્તુતિ પણ બિનહરિફ જીવન વ્યાપ્ત બને એ જરૂરી છે.

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદધિ”

વર્ષ-૪, અંક-૩૭, તા. ૮-૬-૧૯૮૬



## ૨૩ શ્રી અરિહંત પરમાત્માની ઓળખાણા.

ધ્યાનના વિષયમાં પૂર્વે કહ્યું તેમ આર્તધ્યાનના વિષયો (૧) ઈધનો સંયોગ કે અવિયોગ, (૨) અનિષ્ટનો વિયોગ કે અસંયોગ, (૩) રોગમાં વિદ્ધવલતા, (૪) પૌદ્રગલિક નિદાન (આશંકા) આ ચારેયના ચિંતનનો જરાય સર્શ ન જોઈએ. અર્થાત્ આ ચારેય પૈકીના કોઈની પણ મનમાં ગડમથલ ન જોઈએ. એ નથી અનું પ્રમાણ એ કે ઈધાનિષ્ટ કથા પ્રીતિ, પરસંપત્તિ પ્રશંસા, પરપ્રાર્થના, હર્ષ, શોક, પશ્ચાત્યાપ, રુદ્ધ, હાયવોય ગૃહ્ણિ, ધર્મ પરાજ્યમુખતા વગેરે ન હોય, જો એ નહિ તો રોદ્રધ્યાનના વિષયો (૧) પ્રહારવધ-બંધનાદિચિત્તન; ૨ અસત્ય-મિથ્યાભાષણની લેશયા, ૩ માયા ચોરી અનીતિનું લક્ષ, સર્વત્ર આશંકા તથા ધનાદિના રક્ષણની ચિત્તા, અને કલુષિતચિત્તતા એ તો ન જ ફરકવા જોઈએ. એ સમજાય એવું છે. એથી જ એના લક્ષણ તરીકે નિર્દ્યતા, દોષબહુલતા, અનાચાર, હિંસાદિપ્રવૃત્તિ, ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ” (ભાગ-૧૮)

૧૩૭

ગર્વ, અકાર્યનો અ-સંતાપ, પરદુઃખમાં આનંદ, વગેરેનુંય નામનિશાન ન હોવું જોઈએ. આ તો થઈ બાદબાકીના વિસ્તારની વાત કે ધ્યાનના વિષયમાં શું શું ન ફરકવું જોઈએ;

હવે એ જોઈએ કે ધ્યાનના વિષય તરીકે શું શું આવવું જોઈએ. એમાં પૂર્વોક્ત ધર્મધ્યાન અને શુક્લધ્યાનના વિષયો જોઈએ. એમાં પહેલાના ચાર વિષય :- આજ્ઞા-અપાય-વિપાક-સંસ્થાન. આજ્ઞા એટલે નય, નિક્ષેપ, અનુગમ, સપ્તભંગી, પ્રમાણ, હેતુ, દષ્ટાન્ત વગેરેથી પૂર્ણ એવું શ્રી જિનવચન; અપાય એટલે રાગદ્રેષાદિના કટુકણ; વિપાક એટલે સ્વરૂપ પૂર્વકર્મના જ ફળનો ભોગવટો, તથા સંસ્થાન એટલે ઉત્પાદ-વ્યય અને પ્રૌદ્યની મહાસત્તાથી વ્યાપ્ત એવા અનેક દ્રવ્યો અને તેની વિવિધ પરિસ્થિતિઓથી ખૂણે ખૂણે ભરચક એવો સમસ્ત ચૌદ રાજલોક. આનું ધ્યાન કરવાનું. દા.ત. લોકમાં પોતાનો આત્મા કર્મનો કર્તા, સ્વકર્મનો ભોક્તા, ભિન્ન ભિન્ન ગતિમાં જન્મ-મરણથી સંસર્તા (ભટકનારો) છતાં મૂળસ્વરૂપે અરૂપી, અવ્યય, શુદ્ધજ્ઞાનાદિ લક્ષણવાળો છે, એ ચિંતિતે. અથવા એકાગ્રપણે વિચારે કે સંસાર એક સમુદ્ર છે. એમાં કથાયરૂપી પાતાલકલશો, જન્મજરામૃત્યુરૂપી પાણી, મહામોહના આવર્તા, કામનો વડવાનલ, આશાપવન, વિકલ્પોરૂપી મોજાં ઈદ્રિયોના આવેગની ભરતી, અજ્ઞાન-દુર્દીન, કદાગ્રહ વંટોળ, દોષની ભેખડો, આધિવ્યાધિ વગેરે જળજતુઓ છે. આવા સમુદ્રને તરવા એક માત્ર ચારિત્ર વહાણ સમર્થ છે. પણ એમાં જ્ઞાન સુકાની છે, બહુ દઢ-શીલાંગના મજબુત પાટીયાં, દઢ-સમ્યક્તવના બંધન, આશ્રવના છિદ્રો બંધ કરી સંવરના ઢાંકણ દેવાનું, સદ્યોગ (પ્રવૃત્તિ) રૂપી કૂપસ્તંભ, તપોનુકૂલ પવનથી સંવેગનો વેગ, ને અસંખ્ય સદ્ગ્યાશયોરૂપી યોદ્ધાઓ જોઈએ. એમાં, સમ્યગ્દર્શન મિથ્યાત્વનો નાશ કરે, પ્રશમાદિ એ કથાયનો, શીલ કામનો નાશ કરે, વૈરાગ્ય હાસ્યાદિનો, શાસ્ત્રઊદ્ઘમ નિત્રાવિકથાદિનો, ઈન્દ્રિયદમન અસંયમનો, ધર્મ એ રાગદ્રેષ મોહનો, ધર્મશુક્લ ધ્યાન એ આર્ત-રૈદ્રનો, અને પુઝ્યોદય એ અશાતાદિનો નાશ કરે છે. આમ ચારિત્ર જહાજ આગેકૂચ કરતું જીવને મોક્ષનગરે પહોંચાડી દે છે. શુક્લધ્યાનનો વિષય બહુ તીંચો છે, તેનો નામનિર્દેશ પૂર્વ કર્યો છે. ચૌદ પૂર્વ જે કહેવાય એવા મહાશાસ્ત્રના જ્ઞાતા એ ધ્યાન સારી રીતે કરી શકે છે.

આમ મહાગંભીર એવો વિશિષ્ટ કોટિનો નક્કર, સક્રિય અને સફલ ધ્યાનમાર્ગ સર્વજ્ઞ શ્રી અરિહંત પરમાત્માએ જ બતાવ્યો છે; અને એમ કરીને જગત પર અનંત ઉપકાર વરસાવ્યો છે.

૧૩૮ ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-શ્રી અરિહંત પરમાત્માની ઓળખાણા (ભાગ-૧૮)



## શ્રી અરિહંત પરમાત્માની ઓળખાણ

**ભક્તિયોગ :-** વિશિષ્ટ ભક્તિમાર્ગ પણ એજ પ્રભુની બક્ષીસ છે. ભક્તિ બે પ્રકારની : દ્રવ્યભક્તિ અને ભાવભક્તિ. દેવની દ્રવ્યભક્તિમાં એક સામાન્ય અંજલિ જોડવા રૂપ કે એક સ્તુતિ બોલવા રૂપ નમસ્કારથી માંડી અભિષેક, ચંદન-કેશર, પુષ્પ, વસ્ત્રાભરણાદિ પૂજા, વાસચૂર્ણ પૂજા, પૃષ્પવૃષ્યાદિ પૂજા, ધૂપ-દીપ-અક્તત-ફલ નૈવેદ્ય પૂજા, સ્તવન-ગીત-વાજીત્ર-નૃત્યાદિ પૂજા, જાપ સ્તોત્રાદિ, સ્નાત્ર, શાંતિસ્નાત્ર બૃહત્સ્નાત્ર, અંજનશલાકા પ્રતિષ્ઠાવિધિ, અષ્ટાક્નિકા ઉત્સવ, મહાપૂજા વગેરેનાં વિધાન છે, ભાવભક્તિમાં શ્રી અરિહંત પરમાત્મા સંબંધી શુભ અધ્યવસાયથી માંડી નિર્જામ હદ્યે એક માત્ર કર્મનિર્જરા અને આત્મશુદ્ધિના હેતુથી કરાતા જિનાજ્ઞાપાલનના અનેક પ્રકારો આવે છે.

**યોગમાર્ગ :-** શ્રી જિનેશ્વરદેવના શાસનમાં મુખ્ય રાજ્યોગ છે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો. એને એકમાત્ર સંયમયોગ અર્થાત્ સામાયિક્યોગમાં સમાવી શકાય; અથવા શુતર્ધર્મયોગ અને ચારિત્રધર્મયોગમાં સમાવી શકાય. એને સાધવાની ત્રણ કક્ષા છે. (૧) ઈચ્છાયોગ, (૨) શાસ્ત્રયોગ અને (૩) સામદ્ધયોગ. એને આરાધવાના ઈચ્છા-પ્રવૃત્તિ-સ્વૈર્ય અને સિદ્ધિ એમ ક્રમશઃ ચાર પ્રકારના યોગથી બને છે. યોગની પાંચ ભૂમિકા છે : ૧. અધ્યાત્મ, ૨. ભાવના, ૩. ધ્યાન, ૪. સમતા અને ૫. વૃત્તિસંક્ષય. એ પાંચને પણ યોગ કહેવાય છે. પ્રાથમિક અભ્યાસી માટે એટલે કે નિરતિચાર ચારિત્રનિર્ઝતા નથી આવી ત્યાં સુધી સામાયિક-ચતુર્વિશતિસ્તવ-વંદન-પ્રતિકમણ-કાયોત્સર્ગ-પ્રત્યાખ્યાન, એ પ્રાવશ્યક યોગ છે. બાકી સાવિકલ્પ-નિર્વિકલ્પ યોગ, સાપેક્ષ-નિરપેક્ષયોગ, વગેરે પણ યોગો છે, આમ એકવિધ, દ્વિવિધ, ત્રિવિધ, ચતુર્વિધ, પંચવિધ, ષડવિધયોગનાં મહાવિસ્તારવાળા સ્વરૂપ, જેવાં કે યોગલક્ષણ, પૂર્વસેવા, અપુનબંધક, સમ્યગદ્ધિ યોગભેદ, યોગવિવેક, યોગાવતાર, યોગમાહાત્મ્યાદિ; એને સાધવાની પદ્ધતિ-પ્રક્રિયા; એમાં ઉપસ્થિત થતા વિઘ્નોનો પ્રતિકાર તથા એનાં ફળ આ બધાનો ભવ્ય પ્રકાશ કે જે અન્યત્ર દુર્લભ છે, અને જે વિશિષ્ટ કોટિનો છે, તે ભવ્ય પ્રકાશ સર્વજ્ઞ શ્રી અરિહંત પરમાત્માએ આયો છે. આવશ્યક, યોગશાસ્ત્ર, યોગબિન્દુ, યોગવીસી, બગ્રીશ બગ્રીશી વગેરે ગ્રન્થોમાં અનું વર્ણન મળે છે.

**યોગદાસિમાર્ગ :-** યોગસાધના માટે આત્માએ અનાદિની ભવાભિનંદીપણાની અર્થાત્ સંસારરસિકતાની ઓઘદાસિના વલણ મિત્રાવી દઈને ઉત્તરોત્તર વિશુદ્ધ વિશુદ્ધ યોગદાસિના બોધાત્મકવલણ કેળવવાની જરૂર છે. એ યોગદાસિ મિત્રા-તારા બલા-દીપા-સ્થિરા-કાન્તા-પ્રભા-પરા, એ નામે આઠ યોગદાસિ છે. તેને ક્રમશઃ સિદ્ધ કરતાં સાથે વિશિષ્ટકોટિના યમ-નિયમ-આસન-ભાવ પ્રાણાયામ-પ્રત્યાહાર-ધારણા-ધ્યાન-સમાધિ, એ આઠ યોગાંગ; અદ્ભેદ-જિજ્ઞાસા-શુશ્વરા-શ્રવણ-બોધમિમાંસા-પ્રતિપત્તિ-પ્રવૃત્તિ, એ આઠ ગુણસ્થાન; તથા ખેદ-ઉદ્દેગ-ક્ષેપ-ઉત્થાન-ભાન્તિ-અન્યમુદ્ર-રોગ-આસંગ, એ આઠ દોષનો ત્યાગ; એ બધુંય સિદ્ધ કરવાનું હોય છે. આ ચારેય અષ્ટકના બગ્રીશ મુદ્રા પૈકી પ્રત્યેકનું અદ્ભુત પ્રતિપાદન પણ શ્રી અરિહંત પ્રભુના શાસનની વિશેષતા છે. યોગદાસિસમુચ્ચ્યય વગેરેમાં અનું વર્ણન મળે છે.

**શાનપરિણિતિમાર્ગ :-** આ પણ એક વિશિષ્ટ કોટિનો આરાધ માર્ગ છે. અલ્ય કે અધિક જ્ઞાન આત્મામાં જો પરિણામ પામ્યું, પચ્યું, ઉન્તિકારક બન્યું, તો એના (૧) ચરમ મુખ્ય ફળ રૂપે આત્મામાં પૂર્ણતાની સર્વોચ્ચ સ્થિતિ બની આવે છે; અને (૨) અવાંતર ફળ તરીકે મળતા, સ્થિરતા, મોહત્યાગ, જ્ઞાન, શમ, ઈન્દ્રિયજ્ય, ત્યાગ, વિવેક, કિયા, તૃપ્તિ, નિર્લેપતા, નિસ્પૃહતા વગેરે અનેકાનેક ગુણો ખીલી ઉઠે છે. એ વિશિષ્ટ કોટિના શાનપરિણિતિના માર્ગનો પ્રકાશ પણ શ્રી અરિહંત દેવનો ઉપકાર છે.

**અધ્યાત્મમાર્ગ :-** પ્ર.- અધ્યાત્મ એટલે શું ?

૩.- ગતમોહાધિકારણામાત્માનમધિકૃત્ય યા ।

**પ્રવર્તતે ક્રિયા શુદ્ધા તદધ્યાત્મ જગુર્જિના:-** ॥

શ્રી સર્વજ્ઞ જિનેશ્વરદેવો કહે છે કે આત્માની મોહનો અધિકાર છોડી દઈને આત્માને આશ્રીને જે શુદ્ધ કિયા પ્રવર્તે છે તે અધ્યાત્મ છે. અનાદિ કાળથી જીવ જે પ્રવૃત્તિ કરતો આવ્યો છે તે મોહને આધીન થઈ. દા.ત. પેસા લેવા ગયો તે લોભથી; ખાંધું તે રાગથી; બોલ્યો તે કોથી કે ગર્વથી; બીજાને બોલાવ્યા તે માયાથી. આમ મોહના અધિકાર નીચે રહીને પ્રવૃત્તિઓ કરી; તે પણ પાપ પ્રવૃત્તિઓ કરી. અહીં કહે છે કે આત્માને આશ્રીને શુદ્ધ કિયા કરાય તે અધ્યાત્મ કહેવાય. કિયાનો ઉદેશ આત્મા જોઈએ. દેવદર્શન કર્યા - આત્માના પાપ ધોઈ આત્માને નિર્મણ કરવા, તપ કર્યો આત્માને કર્મબંધનોથી મુક્ત કરવા. મુનિએ આહાર વાપર્યો સ્વાધ્યાય આદિ માટે આત્માને સશક્ત બનાવવા. તો આ બધી પ્રવૃત્તિ અધ્યાત્મમાં ગઈ. માત્ર મોક્ષ માટે જ નહીં પણ જગતમાંય સુખ અને ઉન્નતિ માટે અધ્યાત્મની

જરૂર છે. કેમકે અધ્યાત્મી જ સાચા સુખી અને ઉન્નત હોય છે. આધ્યાત્મિકને બદલે આધિભૌતિક ને આધિમોહિક પ્રવૃત્તિ કરનારા તો બિસારા મહાદુઃખી અને અવનતિની દશામાં હોય છે.

આ અધ્યાત્મનો પણ એક વ્યવસ્થિત માર્ગ છે. એમાં ઘણું ઘણું સમજવાનું હોય છે; જેમકે, અધ્યાત્મનો મહિમા, અધ્યાત્મનું સ્વરૂપ; અધ્યાત્મ ક્યાંથી શરૂ થાય; ક્યાં ક્યાં ઉત્તોતર વધતો અધ્યાત્મ; વિષય-આત્મા-અનુબંધ શુદ્ધકર્મ, દંભત્યાગ, ભવસ્વરૂપ, વૈરાગ્યની શુદ્ધ વ્યાખ્યા અને સ્વરૂપ, જ્ઞાનગર્ભિતાદિ ત્રિવિધ વૈરાગ્ય, વૈરાગ્યના વિષયો, મમતાત્યાગપૂર્વક સમતા, વિષ-ગરલાદિ પંચવિધ શુદ્ધ-અશુદ્ધ અનુષ્ઠાન, મનઃશુદ્ધિ, મિથ્યાત્વત્યાગ-સમ્યક્ત્વ, ઓહિસાદિ યમનિયમની કયા સિદ્ધાન્તવાદમાં શક્યતા, અસદ્ગ્રહત્યાગ, કર્મયોગ-જ્ઞાનયોગ, ધ્યાન, વ્યવહારદિનિશ્ચયદિનિ, શુદ્ધ આત્મસ્વરૂપ-નિશ્ચય, નયો-તત્ત્વવિવસ્થા, આત્માનુભવ.

આવા ભવ્ય વિશિષ્ટ અને વિશુદ્ધ અધ્યાત્મમાર્ગનું યથાર્થ પ્રકાશન અનંતજ્ઞાની શ્રી અરિહંત પરમાત્માએ કરીને અનંત ઉપકાર કર્યો છે.

આ રીતે બહુ સંકિપ્ત અને આધ્યાત્મ સ્વરૂપમાં શ્રી અરિહંત પરમાત્માના સ્વરૂપ, જીવન, ગુણો, શક્તિ અને ઉપકારનું અવલોકન કર્યું. એકલા ઉપકારના વિષયમાં તે તે જ્ઞાન પ્રકાશનો વિસ્તાર વર્ણવવા બેસીએ તોય પાર ન આવે, તો પાંચેના સંબંધમાં તો પૂછવાનું જ શું? આવા સ્વરૂપાદ્ધિવાળા પરમાત્મા એ જ ખરેખર પરમ આત્મા છે; એ જ આ ભવ-પરભવ અને ભવોભવના હિતકારી, ઉપકારી અને સુખકારી છે. આ જગત ઉપર જો આવા પરમાત્મા ઓળખવા-સમજવા મળે છે, તો એ છોડીને પરમાત્માનું બીજું ત્રીજું નામધારી ભળતું સ્વરૂપ કે જીવન-ગુણો વગેરે શા સાંદું માનવું? ત્યારે, અન્ય દેવદેવી ઉપરેય શી આસ્થા કરવા જેવી છે? તેમજ, એ વિશુદ્ધ પરમાત્મા પર પૂર્ણ શ્રદ્ધા, અનુસરણ અને આત્મસમર્પણ કર્યા વિના રહેવા જેવું નથી. માટે જ એક જ્ઞાનાય વિલંબ વિના એમના વચન પર પણ અસ્થિમજજા દઢ શ્રદ્ધા કરીને એમણે આદેશેલા મોક્ષોપ્યોગી અનેક પ્રકારના યોગો, તથા વિવિધ માર્ગોની આરાધના જ આ ઉચ્ચ માનવભવમાં કરી લેવી જોઈએ. બીજી આજપંપાળ બધીય માત્ર ફોગટ છે એટલું જ નહિ, કિન્તુ એ આ અલૌદિક તક અહીં ગુમાવરાવીને જીવને ભવિષ્યના દીર્ઘકાળ સુધીય આવી તકથી વંચિત રાખી ઉપરથી દુગીતિના વિવિધ ત્રાસમાં રોળાવી નાખનારી છે. માટે જ શ્રી અરિહંત પ્રભુના શરણને જ સ્વીકારી એમની આજ્ઞાનું શક્ય જીવન બનાવવું હિતાવહ છે.

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદધિ”

વર્ષ-૪, અંક-૮, તા. ૫-૧૧-૧૯૫૨



## જૈન શાસનમાં ભાગવતી દીક્ષાનું સ્થાન

(મુંબઈ ધારાસભામાં દાખલ થઈ ગયેલ ‘બાલદીક્ષા-પ્રતિબંધક બીલ’ જો કાયદારૂપે પસાર થાય તો તે સંસ્કૃતિ અને ધર્મની તેમજ પ્રજાની સુખશાંતિની ભયંકર વિનાશક પરિસ્થિતિને સર્જનારું બનશે. સમસ્ત જૈન-જૈનેતર પ્રજાએ જો આવો એકાદ ધર્મધાતક કાયદોય થવા દીધો, તો પછી એવા બીજા કાયદાની હારમાળા ચાલી સમજો. માટે સંઘળા પ્રયત્નો અજમાવી આ બીલને સરકાર પાસે પડતું મૂકાવી દેવું જ જોઈએ. અમે એટલા જ માટે હવેથી આ બીલના વિરોધ અંગે લખાણો વગેરે પ્રગટ કરીએ છીએ. ૧૨ મી જાન્યુઆરી સુધીમાં સરકારના દફતરે પ્રજાના દરેક દરેક માણસ તરફથી બીલને રદ કરવા યુક્તિપૂર્વકના અભિમાયો મોકલાઈ જવા જોઈએ. એની નકલ મુંબઈ સમિતિ તરફથી બહાર પડી છે. આ પત્રમાં પણ જુદી જુદી દલીલો રજૂ કરવામાં આવશે.)

- પ્રકાશક

જૈન દર્શન જગતમાં ઊંચામાં ઊંચું આત્મદર્શન છે. કર્મના બંધનમાં ઝકડાયેલા આત્માની મુક્તિ શી રીતે થાય તે જ એમાં ઉપદેશવામાં આવ્યું છે અને તે જ હેતુથી આત્મા બંધનમાં શી રીતે ફસાયો છે તથા નવાં નવાં બંધનોથી શી રીતે બચાય તેમજ જૂનાં બંધનો શી રીતે છૂટે એ બધી જ હકીકતો યથાસ્થિત છણીને પરમપદ પ્રાપ્તિ સુધીની સંઘળી જ પ્રક્રિયાઓ આ દર્શનમાં બતાવવામાં આવી છે. ભૌતિક પદાર્થો ઉપરના રાગ વગેરે દોષોથી પ્રત્યેક આત્માનું શુદ્ધ સ્વરૂપ બગડયું છે તે તેના ત્યાગ વગેરે ગુણકારી જીવનથી જ સુધરે, આ એક મૌલિક પાયાની હકીકત જો હદ્યથી સમજવામાં આવે તો ભાગવતી દીક્ષાનું મહા ઉપકારી સ્થાન કોઈનાથી પણ નકારી શકાશે નહિ.

સંસારમાં અનેકવિધ યોનીઓમાં જીવનાં જન્મ-મરણ થાય છે. પશુ વગેરે અન્ય કોઈ યોની એવી નથી કે જેમાં આ ત્યાગની સાધના સંપૂર્ણ શક્ય હોય,

સિવાય એક મનુષ્ય યોની. આ મનુષ્ય યોનીમાં પણ જીવના અનેક વખત અવતાર થઈ ગયા હોય છે; છતાં ત્યાગની ઈષ સાધના તો કોઈ વિરલ અવતારમાં જ શક્ય બને છે. મોહ-માયાના અનાદિ સંસ્કારોનું જેર તૂટ્યા વિના જીવને ત્યાગ જીવન સાચી રીતિએ સાંપડતું નથી, એ માટે જ સુખના કામી મનુષ્યોઓએ મુમુક્ષુભાવે પોતાના આ મોંધા જીવનમાં છેક બચપણથી મરણ પર્યત ત્યાગી જીવનનો પ્રયોગોત્મક અભ્યાસ પાડવો એ પણ ઘણું જરૂરી હિતાવહ છે. યોગ્યતા પૂર્ણ આ સુંદર સ્વાર્પણ યજ્ઞમાં રૂકાવટ ન હોય, કિન્તુ સહાનુભૂતિ જ હોય.

આત્મા-પરમાત્મા, આ જન્મ-પુનર્જન્મ, આ લોક-પરલોક, સંસાર-મોક્ષ વગેરે માનનાર દુનિયાનો કોઈ ધર્મ, કોઈ સમાજ, કોઈ રાષ્ટ્ર કે કોઈ ધર્મશ્રંખ એવો નથી કે જેમાં ત્યાગની મહત્વાના માનવામાં ન આવી હોય. જે મનુષ્યો સંસારમાં રહીને પણ પોતાના સ્વાર્થ ત્યાગપૂર્વક સેવા પરાયણ બને છે તે આ દેશમાં કે પરદેશમાં સર્વત્ર પૂછય છે, આ એક હક્કિકત છે. તો પછી જેઓ પોતાની શીશુ વયમાંથી સર્વત્યાગનો પદાર્થપાઠ સ્વીકારી મહાસેવા પરાયણ બને છે તેના તરફ સુગ રાખવી એ અધુરી સમજનું પરિણામ છે. દીક્ષા જનતાને સર્વ ત્યાગનો પદાર્થપાઠ આપે છે અને એનાથી મનુષ્યનું જીવન ઉન્નત બની જગતના દરિદ્ર નારાયણાદિ સર્વપ્રાણી-ગણની મહાસેવામાં દીક્ષિત પોતાના સમસ્ત જીવનને અર્પણ કરી દે છે. એવા ભયમાર્ગમાં અંતરાય કરવાનું દુઃસાહસ જેઓ પોતાને સત્ય-સુધ્વરેલા-અને સુશ્રાવિત ગણાવે છે તેમનાથી હરગીજ થઈ શકે નહિ, એમ અમારું નિશ્ચિત માનવું છે.

જેન ધર્મમાં સંસાર ત્યાગની દીક્ષા આઠથી સીતેર વર્ષની ઉંમર સુધી ગ્રહણ કરી શકાય છે, છતાં એમાં જેને તેને મુંડી સાધુ બનાવી દેવામાં આવતા નથી, તે નીચે રાખવામાં આવેલી સાવચેતી ઉપરથી જોઈ શકાશે.

## ● દીક્ષા કોને આપી શકાય ? ●

જેન શાસ્ત્રોનું એ ફરમાન છે કે (૧) જે આર્થ દેશમાં જન્મેલો હોય, (૨) વિશિષ્ટ અનિંદ્ય જાતિ કુલ સંપન્ન હોય, (૩) ખૂન ચોરી જારી આદિ દુષ્ટ કર્મી ન હોય, (૪) ઠગબુદ્ધિ ન હોય, (૫) સંસાર કેવલ જન્મ-જરા મરણાદિક વિવિધ દુઃખોથી ભરેલો છે એમ જ્ઞાનનારો હોય, (૬) એથી જ સંસારના રંગ-રાગાદિક ભોગ સુખોથી પણ ઉભગેલો-વૈરાગ્યવાન હોય, (૭) શાંત પ્રકૃતિ હોય, (૮) ઝગડાખોર ન હોય. (૯) વફાદાર હોય, (૧૦) નમ્ર હોય, (૧૧) રાજવિરોધિ ન હોય, (૧૨) સમાજ રાષ્ટ્રના વિશાળ હીતને બાધાકારી ન હોય, (૧૩) ખોડ-ખાંપણવાળો ન હોય, (૧૪) ત્યાગ ધર્મની સચોટ શ્રદ્ધાવાળો હોય, (૧૫) પ્રતિજ્ઞા

પાલન કરવામાં અડગ હોય, અને (૧૬) આત્માનો મોક્ષ કરવાના હેતુથી ચારિત્ર લેવા માટે ખડો થયેલો હોય.

જૈન શાસ્ત્રકારોએ પુરુષની સોળ વર્ષની ઉંમર પછી સ્વતંત્ર અધિકાર માન્ય રાખેલો છે. તેવા પુરુષે પણ પોતાની પાછળ પોતાના આધારે જીવતા કુટુંબીઓની આજવિકાની યોગ્ય વ્યવસ્થા કરેલી હોવી જોઈએ તેમ જ તેના માથે કોઈનું ઋણ બાકી હોવું ન જોઈએ. તેવા યોગ્ય ઉમેદવારને દીક્ષા આપવામાં સાધુને ચોરીનો દોષ લાગતો નથી. આઠથી સોલ વર્ષ સુધીનો પુરુષ તેના વાલીની સંમતિ વિના દીક્ષા ગ્રહણ કરી શકતો નથી અને જો સાધુ તેવાને દીક્ષા આપે તો તેને ચોરીનો દોષ લાગે છે, જેથી તેઓ આપતા પણ નથી. જ્યારે સ્ત્રીથી તો તે જેના તાબામાં હોય તેની અનુમતિ મેળવીને જ દીક્ષા લઈ શકાય છે. સગર્ભ કે બાલવત્તસા હોય તો તે પણ એ સંયોગમાં લઈ શકતી નથી.

આથી સ્પષ્ટ સમજી શકાશે કે જૈન દીક્ષા એ ઈતર બાવાઓ આદિની જેમ કોઈ ઉઠાઉગીરીની ચીજ નથી. આવી દીક્ષામાં આવનારને દીક્ષામાં શું કરવાનું હોય છે ? મફતના માલમલીદા ઉડાવવાના કે સમાજને ભારભૂત જીવન જીવવાનું હોતું નથી, કિન્તુ સખત સાધના કરવાની હોય છે. કોઈ પણ જીવની માનસિક હિંસા પણ એનાથી કરી-કરાવી કે અનુમોદી શકતી નથી, એવી જ રીતે અસત્યનો, ચોરીનો, સ્ત્રીસંગનો, પરીગ્રહ સંગ્રહનો એણે સંપૂર્ણ ત્યાગ કરવાનો હોય છે. પોતાની જાત ઉપર પણ ચાહે તેવું કષ આવે તે સહન કરવાનું હોય છે. વિજીતીય સ્પર્શ પણ ન થાય તેવું નવવાડે શુદ્ધ બ્રહ્મચર્ય પાળવાનું હોય છે. પૈસાને અડવાનું પણ હોતું નથી. રાત્રીભોજનનો પણ સંપૂર્ણ ત્યાગ પાળવાનો હોય છે. ગાડી-મોટર-પ્લેન-સ્ટીમર કે હાથી-ઘોડા કશાની સવારી કરી શકતી નથી. ઉઘાડા પગે, ઉઘાડા માથે-પગપાલા વિહાર કરવાના હોય છે. ગાડી-તકીઓ કે પથારીઓ વાપરી શકતી નથી. ભૂમિ ઉપર સંથારા પાથરી સુવાનું હોય છે. હજામત કરવાતી નથી. મસ્તકના કેશ કે દાઢી-મૂછના વાળ હાથે બેંચી કાઢવાના હોય છે. ગમે તેવી ભૂખ-તરસમાં જાડ-પાન કે તેનાં ફળ-ફૂલ તથા કૂવા-તલાવ, નદી કે નળ વગેરેનાં પાણીનો ઉપયોગ કરી શકતો નથી. કડકડતી કંડીમાં અભિ વગેરેને તાપવાનું પણ હોતું નથી. ગરમીમાં પંખા-હીંચકા આદિનો પવન પણ ખવાતો નથી. છત્રી પણ રખાતી નથી. આ એકેદ્વિદ્ય જીવને દુઃખ ન થાય એ માટે કાચી માટી આદિને આંગળી પણ અડાતી નથી. સ્નાન, દંતધાવન કે સેન્ટ લવંડર તેલ વગેરેના એશાચારામ કાંઈ જ કરાતું નથી. નાટક, ચેટક, સીનેમા, તમાસા, જલસા, પાના બાજી, કિકેટમેચ વગેરે પણ કાંઈ જોવાનું કે રમવાનું હોતું નથી, પગમાં બૂટ વગેરે

પણ નખાતા નથી. બાળક પણ આ સમજને જ દીક્ષા લેવા તૈયાર થાય છે; અને લઈને હોંશથી પાળે છે. ત્યાં ફોસલાવા-લલચાવા જેવું શું કહી શકાય ?

આ દીક્ષામાં તો હાલવા-ચાલવા-બેસવા-ઉઠવા-ખાવા-પીવા-બોલવા-કરવા બધામાં ખુબજ સંયમ પાળવાનો હોય છે. જીવદ્યાના હેતુ માટે જ ઓધો, મુહુપત્તિ અને બીજા પરિમીત વસ્ત્ર પાત્ર (તે પણ કાણના) સ્વીકારવાનાં હોય છે. ગૃહસ્થોને ત્યાં તેઓને માટે જ થયેલી રસોઈમાંથી થોડી થોડી શુદ્ધ ભીક્ષા ગ્રહણ કરવાની હોય છે. તે માટે તેમનો કશોયે બળાત્કાર હોતો નથી, સ્વેચ્છાથી આપે તો લેવાનું હોય છે. મધ્ય-માંસ-માખણ-મદિરા-કંદમૂળ વગેરે અભક્ષ્ય અપેયનો સંદર્ભ ત્યાગ જ કરવાનો હોય છે. દહી-દૂધ-ઘી-તેલ-મીઠાનાં આદિ ભક્ષ્ય પદાર્થોના રસાસ્વાદોનો પણ ઘણો ત્યાગ કરવાનો હોય છે. છષ્ટ-અષ્ટમ-ઉપવાસ-આયંબીલ-એકાસણા આદિ નિરંતર તપશ્ચર્યા કરવાની હોય છે. ઉગ્ર કે અસભ્ય ભાષણ કરતું નથી. શાસ્ત્રોનો અભ્યાસ કરવાનો હોય છે. બાલ-વૃદ્ધ-ગ્રલાન-માંદા આદિ સૌની સેવા કરવાની હોય છે. ગુર્વાદિકોની આજ્ઞામાં રહેવાનું હોય છે. મંત્ર-તંત્ર-દોરા-ધાગા-કામણ-ટુમણ-ભાવ-તાલ આદિ કશા જ અવળા ધંધા કરી શકતા નથી. ફક્ત તત્ત્વચિંતિવન અને તત્ત્વ ધર્મની જ વાત કરવાની હોય છે. પરિસહ-ઉપસર્જ સમભાવે સહન કરવાના હોય છે. રાજ્ઞિ-પ્રજ્ઞા-રાજ્ય-રાખ્ર-પ્રાણી માત્રાનું ભલું ચાહવાનું છે. કોઈની હંસી-ઠંડા-મશકરી-કે નિંદા વગેરે વિરુદ્ધ વાત-વિકથા કરતી નથી. નિંદા-પ્રમાદ વધારે ન થઈ જાય તેની સતત સાવધાની રાખવાની હોય છે. ઉભ્ય ટંક પ્રતિકમણ-પડિલેહણ-સ્વાધ્યાયચૈત્યાદિ વંદન-પ્રત્યાખ્યાન તથા સૂક્ષ્મ બારીક સ્ખલનાનું પણ પ્રાયશ્વિત્તા-ક્ષમા-દયા આદિ સદ્ગુણાનું પરિવર્ધન હંમેશાં ઉપયોગપૂર્વક કરવાનું હોય છે. આમાં કોઈને લાલચ થાય કે કોઈના ઉપર શીરજોરી થાય એવાં કોઈ સંજોગો જ નથી, એ દિવા જેવું દેખાઈ આવશે.

## ● ભાવ ઉત્પાદનના ઉપકાર ●

આવા દીક્ષાત થયેલા મહાત્માઓ પોતાના ઉચ્ચ જ્ઞાનથી અને ઉચ્ચ ચારિત્રથી લોકોને ધર્મનું સાચું જ્ઞાન આપે છે, અંધકારમાંથી પ્રકાશમાં દોરે છે, તેઓમાં નીતિમય જીવનના ઉચ્ચ સંસ્કારો રેતે છે, તેઓને પાપકર્મો કે ખરાબ કામો કરતા વારે છે, સંસારના ત્રિવિધતાપથી પીડાએલાઓનો તેઓ આધ્યાત્મિક વિસામા બને છે. સરકારને અભીષ્ટ પ્રજાના નૈતિક ઉત્થાન કાર્યમાં આવા સાધુપુરૂષોનો સદૃપુદેશ ઘણો મદદગાર બને છે.

## ● કુલાચારથી સુલભ સંસ્કાર ●

જૈનદીક્ષામાં નાના કે મોટા કોઈને પણ બદ ઈરાદાથી તેમનું જીવન ખરાબ થાય તે માટે દીક્ષાઓ અપાતી નથી. જૈન કુળોમાં જન્મેલા નાનાં બચ્ચાઓને પણ આ દીક્ષાની કલ્યાણકારિતાની તથા તેમાં પાળવાની ત્યાગકરણીની જન્મ સિદ્ધ સમજદારી હોય જ છે, જૈન ગૃહસ્થ જીવનમાં પણ નાની ઉંમરથી લગભગ ધરે ધરે સામાચિક, પ્રતિકમણ, પૌષ્ઠથ, ઉપવાસાદિક તપશ્ચર્યા, શાસ્ત્ર શ્રવણ-અભ્યાસ-સાધુસત્સંગ-શ્રમણ સેવા ભક્તિ-રાત્રિ ભોજન ત્યાગ, કંદમૂળાદિ અભક્ષ્ય ત્યાગ, વ્યસન બંધી, અહિસાદિક વ્રત-નિયમ-બ્રહ્મચર્યપાલન, વિવિધ અભિગ્રહ-પચ્યાખાણ, ઉપધાન વગેરે ધાર્મિક દસ્તિના આચાર-વિચાર નિરંતર એવા સેવાતા હોય છે કે સાધુજીવનની તાલીમ તેઓને સ્વાભાવિક મળી જાય છે. આથી બીજાઓની માફક તેઓને સાધુ જીવનની કઠોર ચર્ચા કઠોરરૂપે ભાસતી નથી અને જેઓને પૂર્વ જન્મના કોઈક સારા સંસ્કારો જાગે છે તેઓને જ સાધુ જીવનની દીક્ષા અંગીકાર કરવાના કોડ જાગે છે, બીજાઓને તે થતા પણ નથી. આવી દીક્ષાઓ કેવી ધામધૂમથી પ્રભાવના પૂર્ણ લેવાય છે તે તો આજકાલનો ઈતિહાસ પણ પ્રગટ કરી આપે છે. સંસારના વાયરા ખાઈને આવેલાઓ કરતાં તેનાથી અલીપત રહેલા નાની ઉંમરનાઓની દીક્ષા વધારે સારી સફળ નીવડે છે, એની કોઈથી ના પડાય તેમ નથી. આ જ કારણથી જૈન શાસ્ત્રકારોએ જૈન શાસનની હ્યાતી ટકાવી રાખવા માટે બાલ દીક્ષા ઉપર ખુબ ભાર મૂક્યો છે. જે જે યુગ પ્રધાન અને મહાસમર્થ પ્રભાવક આચાર્યાદિ મુનિવરો ભૂતકાળમાં થઈ ગયા છે તેમાંનો મોટો ભાગ બાલ દીક્ષિતોનો છે, તેની આજે પણ ઈતિહાસ સાક્ષી પૂરે છે. આવી અગત્યની દીક્ષાઓને કાયદાની એક કલમે રુંધવી તે જૈન શાસનની પ્રગતિને રુંધવા બરાબર છે, એ કંદ ભૂલવું ન જોઈએ અને એમાં હિંસા-જૂઠ-ચોરી-વ્યબિચાર વગેરે જેવાં અનિષ્ટ તત્વો છે પણ કયાં ? કે જેથી એ રુંધવા લાયક મનાય ? આ ભવ્ય આદર્શ જીવનની બાળ લગ્ન વગેરે સાથે સરખામણી કરવી તે તદ્દન સમજ વીહોણી વાત છે.

હા, એ સાચું છે કે આ દીક્ષાની પ્રતિજ્ઞા જીવનપર્યત્ત પાળવાની હોય છે. સમયના વહેવા સાથે કોઈક ન પાળી શકે તો એથી એનું જીવન પોરણ બગડી જતું નથી. તે સંસારમાં પણો જાય છે. ત્યાં એની લાયકાત મુજબ સામાજિક દરજાઓ પણ પ્રાપ્ત કરી લે છે, એવા કોઈ દાખલા ભૂતકાળમાં બન્યા છે અને હાલમાં પણ સારા ધાર્મિક શિક્ષક વગેરે બનેલા પ્રત્યક્ષ જોઈ શકાય છે. મનુષ્યને પોતાના આત્માનો

ઉત્કર્ષ સાધવા માટેની આ શાસ્ત્રઆજ્ઞા સિદ્ધ સાધના કોઈ પણ ઉમરમાં અંગીકાર કરવાનો પવિત્ર હક્ક અભાવિત જ રહેવો જોઈએ.

## ● આત્મ સુધારણાનો મહાપથ ●

એ યાદ રાખવું જોઈએ કે જૈન દીક્ષાની પ્રતિષ્ઠા સંસારમાં આત્માનો મોક્ષ સાધવા માટે છે. સંસારના ભોગો વગેરેના રાગાદિથી આત્માને સંસારવર્ધક કર્મો બંધાય છે; તે તેના ત્યાગ વિના અટકી શકતાં નથી અને તપશ્ચર્યા વિના દૂર થઈ શકતાં નથી. આ કાંઈ એક જન્મમાં બની જતું નથી. મોહ-માયાના અનાદિ સંસ્કરોને જરૂરી ઉભેડવા માટે કોઈ ભવોના અભ્યાસની આવશ્યકતા હોય છે. બાલક જેમ ચાલતાં પડે તો પણ એથી એના ચાલવાનો કે ચઢવાનો અભ્યાસ છોડાવી શકાય નહિ તેમ વ્યક્તીગત કોઈક સ્ખલનાઓ કોઈકમાં આવી જાય કે દેખાઈ જાય તો પણ તેથી આત્મ-સુધારણાનો આ મહાપથ અને તે પંથે વારંવાર ચાલવા ચઢવાનો અભ્યાસ જરાએ લુલો પાતી શકાય નહિ કે ડામી શકાય નહિ. ચિદાનન્દમય શાશ્વત મુક્તિ મહાલયમાં પવેશ કરવા માટે મુમુક્ષુને જે અપ્રમત્ત યોગથી ક્ષપકભાવે ગુણશ્રેષ્ઠીનાં ઉચ્ચ ઉચ્ચતર પગથીયાં ચઢવાનાં છે તે સંસારના સંગમા રહીને બીલકુલ આરોહી શકતાં નથી. એ માટે તો સમ્યક્તવ આદિ ગુણોની સપાટી ઉપર આવીને આ દીક્ષાને પ્રથમ પગથીયે ચઢવું પડે છે. તેનો અભ્યાસ ખુબ આત્મસાત્ર કરી શકનારો ઉપરનાં પગથીયાં આરોહી કેવલ્યજ્ઞાનનો પ્રકાશ લાવી મુક્તિપદ મેળવી શકે છે. જે અન્ય લિંગમાં કે અન્ય સંજોગોમાં પણ મુક્તિવર્યા છે તેઓને પણ પૂર્વ જન્મોમાં આ દીક્ષાઓ સ્વીકારીને પાડેલા ઉત્તરોત્તર સુંદર અભ્યાસોનો જ ઉપકાર થયેલા હોય છે. જ્ય હો એ દીક્ષા દેવીનો, જેમને “સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષ માર્ગ :-”

જૈન શાસ્ત્રના આ સૂત્રમાં શ્રદ્ધા છે તેઓ ભાગવતી દીક્ષાને વંદન કર્યા વિના રહેશે નહિ, તેમજ પોતાને માટે બચપણથી આ દીક્ષાનો ઉદ્ય ચાચ્યા વિના પણ રહી શકો નહિ. જે જૈનને બાળ ઉમરમાં દીક્ષા મળી નથી તે તો પોતાની જતને ઠગાયેલી માનનાર હોય છે. આ જૈન જીવનના માનસ ઉપરથી શ્રી ભાગવતી દીક્ષાની અનિવાર્યતા સૌ કોઈની સદ્ગુદ્ધિમાં સારી રીતે ઉત્તરે એ જ શુભ મનોકામના.

...બાલ-સંન્યાસ દીક્ષા પ્રતિબંધક વિધેય અંગે...

## ● અમારો અભિપ્રાય. ●

### જૈનો તરકનો વિરોધ પત્ર

**સૂચના :-** નીચે પ્રમાણેના અભિપ્રાય પત્રની દરેક ગામવાળાએ હજારો નકલ છપાવી તેના પર એકેક વક્તિની સહી લઈ તે પત્રો, સહી કરનારના નામોના લીસ્ટ સાથે, મુંબઈ સમિતિ ઉપર મોકલી આપવાના છે. જે ત્યાંથી કાઉન્સીલ હોલ પર ઓફિસિયલ પદ્ધતિએ મોકલાશે-(બાલ સં. દીક્ષા પ્રતિબંધક વિધેય વિરોધ સમિતિ, બુલીયન એક્સચેન્જ બીલીંગ, રૂમ નં. પ૪. મુંબઈ-૨.)

મંત્રીશ્રી,

મુંબઈ રાજ્ય વિધાન પરિષદ,

કોટ, મુંબઈ.

૧ મુંબઈ રાજ્ય વિધાન-પરિષદમાં બાલ-સંન્યાસ-દીક્ષા-પ્રતિબંધક-વિધેય શ્રી પ્રભુદાસ બાલુભાઈ પટવારીએ રજૂ કરેલ છે, અને તે જનતાના અભિપ્રાય માટે મુંબઈ સરકારના તા. ૧૬-૯-૫૫ના ગેઝેટ વિભાગ-૫-માં પ્રગટ થયેલ છે.

૨ પ્રસ્તુત વિધેયને અમે ગંભીર નજરે નિહાળીએ છીએ અને એ અંગે અમારો અત્યંત વિરોધ આથી વ્યક્ત કરીએ છીએ.

૩ અમે માનીએ છીએ કે આજે જ્યારે રાષ્ટ્રના ઉત્થાન માટે ભગીરથ પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે રાષ્ટ્રની પ્રગતિ અવરોધક વિધેયની પાછળ આપણા સમય અને શક્તિ વેરફી નાંખવા, એ અનિયધનીય છે.

૪ જૈન જનતાની ધાર્મિક લાગણી આ વિધેયથી અત્યંત હુભાઈ છે. બાલદીક્ષા એ અમારી ધાર્મિક શ્રદ્ધાનો પ્રશ્ન છે. ભગવાન શ્રી મહાવીરના આદેશ અનુસાર બાળકની દીક્ષાને અમે પૂજનીક લેખીએ છીએ. અમારી એ પવિત્ર માન્યતાના અનલમાં અંતરાયરૂપ કંશું ન બને એ જોવાનું રાજ્યનું કર્તવ્ય છે, એમ અમે ગંભીરપણે માનીએ છીએ.

૫ અમારી ધાર્મિક શ્રદ્ધાના પ્રશ્નમાં શાસ્ત્રજ્ઞાનને અનુસરીને અમારા અંતરના અવાજ મુજબ વર્તવાનું અમારું કર્તવ્ય છે. એમાં બાધ્ય દરમ્યાનગીરી અસહ્ય છે. અમારી ધાર્મિક શ્રદ્ધાના પ્રશ્નો નિર્ણય જનતાના મત ઉપર મૂકવામાં આવે છે, એનું અમને ભારે હુંબ છે.

૬ જે ઉચ્ચતમ જીવનને અમે આદર્શ લેખીએ છીએ અને જે જીવનદ્વારા અમે

પરમપदની સાધના કરવા મથીએ છીએ, તે જીવનના મૂળમાં જ વિધેય કુદારાધાત કરે છે. અમારા બાળકોને સન્માર્ગ જોડવાની અમારી પવિત્ર ફરજ બજાવતાં વિધેય અમને અટકાવે છે.

૭ અમે માનીએ છીએ કે સુંદર જીવન જીવવા માટે બાલ્યવયથી જ સંસ્કારનું સિંચન થવું ઘટે. દીક્ષા એ બાળકને ઉત્તમ બનાવવાનો એક અનુપમ કોટીનો સંસ્કાર છે. એ સંસ્કારથી બાળકનું મહાન હિત સધાય છે. માત્ર બાળકનું પોતાનું જ નહિ પરંતુ આખા યે વિશ્વનું હિત એથી સધાય છે, એવું અમારું નમ્ર મંત્વ છે.

૮ બાળકને દીક્ષા આપવાથી અમે બાળકને તરણોડીએ છીએ અને એના પ્રત્યેની જવાબદારી ત્યજ દઈએ છીએ, એ જાતનો આક્ષેપ અમને અન્યાય કરે છે. એ સુવિદિત છે કે બાળકને તેના દીક્ષિત જીવનમાં કોઈ પણ મુશ્કેલી ન નહે તેની ખૂબ જ કાળજ રાખવામાં આવે છે. તેની પ્રત્યેક જરૂરીયાતો સુંદર રીતે પૂરી પાડવામાં આવે છે. માત્ર માતાપિતા જ નહિ. પરંતુ સમગ્ર જૈન સમાજ તેમની સેવામાં ખડે પગે તૈયાર રહે છે.

૯ સત્ય તો એ છે કે બાળદીક્ષાની પ્રથા જગતને આશીર્વાદ રૂપ છે. પવિત્ર ભાવિ જીવનના પાયા બાલદીક્ષામાં નંબાય છે. બાલ્યવયથી સંસારથી અલિપ્ત રહેનાર મહાત્માઓએ ભારતની સંસ્કૃતિ પરાપૂર્વથી ટકાવી રાખી છે. જગતભર ઉપર જે અમાપ ઉપકાર બાલ્યવયથી જ સન્યસ્ત સ્વીકારનાર મહાપુરુષો કરી ગયા છે, અને કરી રહ્યા છે, તે કલ્યનાતીત છે. એના અસંખ્ય દંદાંતો આપણી સમક્ષ મોજું છે.

૧૦ અમારી સાધુ-સંસ્થા કેવળ દુઃખથી કંટાળેલા કે જગતમાં ક્યાંય સ્થાન ન મળે એવા માણસોની બનેલી નથી. ઊલટું મોહક સુખો અને દુન્યવી આબાદીને તુચ્છ માની આત્મકલ્યાણ સાધવા કર્મરહિત બનવાના એક માત્ર ધ્યેયથી પ્રેરાયેલા ઉત્તમ આત્માઓની બનેલી છે. એવા ઉત્તમ મહાપુરુષો યોગ્ય રીતે જ દીક્ષા આપે એ સ્વાભાવિક છે. અયોગ્ય રીતે દીક્ષા આપવાથી અમારી આવી ઉત્તમ સાધુ સંસ્થાને હાનિ થાય એ દસ્તિએ એ જાતની દીક્ષા અમારે ત્યાં આપવામાં આવતી નથી.

૧૧ સંન્યાસ-દીક્ષા જેવી પવિત્ર વસ્તુ પ્રત્યેક બાળકને આપી શકતી નથી. પૂર્વ જન્મના સુસંસ્કાર સાથે લઈને આવેલ બાળકને જ્યારે દીક્ષાની ઈચ્છા જાગે છે, ત્યારે તેની ભાવનાની યોગ્ય તપાસ કર્યા પછી તેની શક્તિનું માપ કાઢીને, તેના માતાપિતાની પૂર્ણ સંમતિ મેળવીને અને દીક્ષિત જીવનની

જવાબદારીનું તેને ભાન કરાવ્યા પછી જ વિધિવિધાન પૂર્વક દીક્ષા અપાય છે, અને એ પણ તેની ઓછામાં ઓછી આઈ વર્ષની (૮ વર્ષની) ઉમર વીત્યા પછી.

૧૨ બાલદીક્ષાની સુંદર પ્રથાનો હુરુપયોગ ન થાય તે માટે અત્યંત કડક નિયમો અમારા શાસ્ત્રોએ મૂકેલા છે. એ નિયમોનું સંપૂર્ણ પાલન કરીને અમારા મુનિવર્યો બાળકને દીક્ષાના સંસ્કાર આપે છે. એ નિયમોનું પાલન કરવામાં ક્ષતિ આવે કે શિષ્ય-મોહની વૃત્તિ જાગે તો મુનિવરને દોષ લાગે છે, અને તેનું પ્રાયશ્રિત કરવું પડે છે. આ સંયોગોમાં બાલદીક્ષા અંગેના શાસ્ત્રીય નિયમોનું પાલન થવું સહજ છે. શાસ્ત્રીય નિયમોના પાલનમાં ક્ષતિ આવે તો તે પ્રત્યે લક્ષ ખેંચવાનો પ્રત્યેક જૈનને અધિકાર છે. જૈન સંધ એ અંગે ઘટતું કરે જ છે. એની ફરજ અદા કરવામાં જૈન સંધ સૌથી વધુ જાગ્રત છે. વળી ચોરી છૂપી અને બળાત્કાર અટકાવવા માટે કાનૂની જોગવાઈઓ આજે પૂરતી છે.

૧૩ દીક્ષા પ્રત્યે જૈન બાળક આકખ્ય તેમાં આશ્રય નથી. ક્ષત્રિય બાળકને જેમ શૌર્ય વારસામાં મળે છે, તેમ ભગવાન શ્રી મહાવીરના શાસનમાં તપ અને ત્યાગ વારસામાં મળે છે. બીજાઓને કષ્ટદાયક લાગતી વસ્તુઓ પણ જૈન બાળકો નાની ઉમરમાં સહેલાઈથી કરી શકે છે. જીવન પર્યત રાત્રિ ભોજનનો ત્યાગ, આયંગિત તપ, પર્યુષણ પર્વમાં છંદ-અદ્ભુત (વાગટ બે, ત્રણ ઉપવાસ) વગેરે હસ્તાં હસ્તાં બાળકો કરતા દેખાય છે.

૧૪ બાળકે પોતાનું ધાર્મિક જીવન કેવી રીતે વ્યતીત કરવું, માતાપિતાએ બાળકમાં કયા પ્રકારના ધાર્મિક સંસ્કારો રેઝવા અને મુનિવરોએ બાળકને દીક્ષાના સંસ્કારો કયા સંયોગોમાં આપવા એ પ્રશ્નો સ્પષ્ટ રીતે ધાર્મિક છે. આ પ્રશ્ન બાળકના ધાર્મિક હિતનો હોઈને તે સામાજિક નથી, કિંતુ ધાર્મિક છે. સમાજને સ્પર્શી છે એટલા માત્રથી જ કોઈ પ્રશ્ન સામાજિક બને તો પ્રત્યેક પ્રશ્ન સામાજિક બની જાય અને ધાર્મિક, સામાજિક, આર્થિક, રાજકીય કે વૈજ્ઞાનિક પ્રશ્નોનું સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહે. કેવળ ધાર્મિક પ્રશ્નને સામાજિક પ્રશ્ન તરીકે અયોગ્ય રીતે લેખાવીને ધાર્મિક સ્વતંત્ર્ય ઉપર અને માતાપિતાના ધાર્મિક અધિકાર ઉપર કાપ મૂકવામાં જનતાને અન્યાય છે.

૧૫ આ વિધેયના હેતુમાં એમ જ્ઞાનવામાં આવ્યું છે, ‘બાલ્યવયથા તથા યુવાનીને શોષણ વિરુદ્ધ અને નૈતિક તથા ભૌતિક ત્યાગ વિરુદ્ધ સંરક્ષણ મળે,’ એ વસ્તુ સ્પષ્ટપણે દર્શાવે છે કે આ વિધેય લાવવા પાછળ હેતુ કેવળ ભૌતિક

રક્ષણ આપવાનો છે. એ હેતુ ભારત સિવાયના દેશ માટે કદાચ યોગ્ય ગણાતો હશે. પણ ભારત જેવા અધ્યાત્મપ્રધાન દેશમાં ભૌતિક હિતની સાથે આધ્યાત્મિક હિતનો તેથી પણ વધારે વિચાર કરવાનો છે. ખાસ કરીને અમે જૈનો ભૌતિક હિતને તુચ્છ અને ક્ષણિક સમજાએ છીએ. તેની ખાતર બાળકના શાશ્વત અને અનંત આધ્યાત્મિક હિતનો નાશ સર્જય એવું પગલું લેવું એ ખરેખર ભયંકર છે.

- ૧૬ અમને આશા છે કે લોકશાહીના આ યુગમાં બિનસાંપ્રદાયિક રાજ્ય તરફથી અમારા ધાર્મિક અધિકારને સંપૂર્ણ રક્ષણ મળશે.  
ઉપર્યુક્ત કારણોસર આ વિધેય સામે અમારો પ્રબળ વિરોધ છે.

સહી .....	
પૂર્ણ ડેકાશું .....	
ગામ .....	જલ્લો .....
ઉંમર .....	
તા. ....	
નં.....	

## બાળ સંન્યાસ દીક્ષા પ્રતિબંધક વિધેય વિરોધ સમિતિ

### તરફથી બહાર પડેલું નિવેદન.

બુલિયન એક્સચેન્જ બીટીંગ, બીજે માળે,  
રૂમ નં. ૫૫, જવેરીબજાર, ટે.નં. ૨૩૨૨૮,  
મુંબઈ, તા. ૨૨-૧૦-૫૫.

રા.રા.શ્રી .....

જ્ય જિનેન્નપૂર્વક લખવાનું કે અમદાવાદના શ્રી પ્રભુદાસ બાલુમાઈ પટવારીએ મુંબઈ રાજ્ય વિધાન પરિષદમાં બાલસંન્યાસ દીક્ષા પ્રતિબંધક નામનો જે વિધેય રજૂ કર્યો છે તેનો સરકારે સ્વીકાર કે અસ્વીકાર ન કરતાં પ્રથમ વાંચનમાં પસાર થવા દઈ જનતાના અભિપ્રાય માટે રજૂ કર્યો છે અને તેની મુદત ૧૨-૧-૫૬ ની રાખેલી છે

આ વિધેય પસાર થતાં આપણી શ્રમણસંસ્થાને મોટો ધક્કો લાગે તેમ છે અને મુંબઈ રાજ્યના અનુકરણરૂપે બીજા પ્રાંતમાં પણ આવા વિધેય પસાર થવાની

ભુવનભાનુ એન્સાઈલોપીડિયા-“પ્રવચન મહોદશિ” (ભાગ-૧૮)

૧૫૧

પૂરી શક્યતા રહેલી છે, તેથી આ વિધેયનો પૂરેપૂરો વિરોધ થાય તે જરૂરી છે.

આ વિધેય અંગે વિરોધ પ્રદર્શિત કરવા માટે નીચેની કાર્યવાહી થવાની જરૂર છે.

- ૧ સમિતિએ તૈયાર કરેલા જૈનો માટેના વિરોધપત્ર પર અઢાર વર્ણની ઉંમરના જૈન સ્ત્રી કે પુરુષની સહી કરાવવી અને તેને એક જુદા કવરમાં બીડવું. આ વિરોધપત્ર કાળી શાહીમાં છાપેલું છે.
- ૨ સમિતિએ તૈયાર કરેલા જૈનેતરો માટેના વિરોધપત્ર પર અઢાર વર્ણની ઉંમરના જૈનેતર સ્ત્રી કે પુરુષની સહી કરાવવી અને તેને એક જુદા કવરમાં બીડવું. આ વિરોધપત્ર વાદળી શાહીમાં છાપેલું છે.
- ૩ સંઘો, સંસ્થાઓ, મંડળો, પાઠશાળાઓ, શાળાઓ, તથા બીજી જે જે સંસ્થાઓ પાસે તેના વિરોધમાં ઠરાવો કરાવી શકાય તે કરાવવા. આ ઠરાવોમાં માત્ર વિરોધ ન કરતાં વિરોધ કરવાનાં કારણો પણ દર્શાવવા. તે માટેની સામગ્રી ઉપરના વિરોધપત્રમાંથી મળી રહેશે.
- ૪ આ વિષયમાં લાગણી ધરાવનાર ગૃહસ્થો તથા સંસ્થાઓને તે તે ગામ કે પ્રદેશમાં વિધેયનો વિરોધ કરવા અંગે પ્રેરણા કરશો અને તે રીતે જે કાર્યવાહી કામે લાગ્યા હોય તેના સમાચાર અમને આપશો.
- ૫ વિરોધપત્રો, ઠરાવો વગેરે નીચેના સરનામે મોકલવા :-  
સેકેટરી,

### બોમ્બે લેજલસ્ટેટીવ કાઉન્સીલ

કાઉન્સીલ હોલ, કોટ, મુંબઈ ૧.

- ૬ આપના જૈનો માટેના વિરોધ પત્ર નં. .... જૈનેતરો માટેના વિરોધ પત્ર નં. .... મોકલ્યાં છે, તેની વધારે જરૂર હોય તો તુરત જ મંગાવી લેશો કે ત્યાં જ છપાવી લેશો.
- ૭ આપને હસ્તક નં. ૧,૨,૩, કલમમાં જણાવેલા કેટલા પત્રો રવાના થયા તથા કઈ કઈ સંસ્થાઓના ઠરાવો ગયા તેની નોંધ આ સમિતિ પર તરત જ મોકલવા કૂપા કરશો.
- ૮ આ વિષયમાં કઈ પણ પૂછપરદ કરવા જેવું હોય તો સમિતિ સાથે શીશ્ર સંપર્ક સાધશો.
- ૯ હાલમાં દોઢ માસ સુધી આ બાબતમાં જોરદાર પ્રવૃત્તિ થલાવશો.
- ૧૦ આ વિધેયનો વિરોધ કરનારા લેખો લખી સ્થાનિક પત્રોમાં તેમજ મુંબઈના વર્તમાનપત્રો પર મોકલશો.

૧૫૨ ભુવનભાનુ એન્સાઈલોપીડિયા-જૈન શાસનમાં ભાગવતી દીક્ષાનું સ્થાન (ભાગ-૧૮)

૧૧ આ કાર્ય અંગે સમિતિને ઘણો ખર્ચ છે, તો ત્યાથી શક્ય હોય તેટલી આર્થિક મદદ મોકલવા પણ ફૂપા કરશો.

લી. સેવકો,

ધીરજલાલ ટોકરશી શાહ  
નટવરલાલ નેમયંદ શાહ  
મંત્રીઓ.

બા.સં.ડી.પ્ર. વિરોધ સમિતિ.

...મુંબઈ ખાતે શરૂ થયેલી...

સમાજની ઘોર નિદ્રા ઉડાડનાર, કર્તવ્યનું સાચું ભાન કરાવનાર

### જાગૃતિ વ્યાખ્યાનમાળા.

અનાદિ કાળથી ચાલ્યા આવતા જૈનધર્મનો પ્રચાર જૈન શ્રમણસંઘદ્વારા થાય છે. આ સંધ તેના ત્યાગ, તપશ્ચર્યા, ઉચ્ચ ચારિત્ર અને વિશુદ્ધ ધર્મोપદેશ માટે ભારત વર્ષના જ નહિ, પણ જગતના સુપ્રસિદ્ધ વિચારકોની પ્રશંસા પામેલો છે.

જે કાર્ય સરકાર કોડો રૂપીના ખર્ચને કે કાયદાના જોરે નથી કરી શકતી, તે કાર્ય આ નિઃસ્વાર્થ ત્યાગી મહાત્માઓના ઉપદેશથી વિના ખર્ચ થાય છે. આ સંસ્થા જેટલી ઉન્નત અને વિશાળ બને તેટલો પ્રગતને લાભ છે. આમ છતાં ભૌતિકવાદની અસર નીચે આવી ગમેલા કેટલાકો તરફથી એવો પ્રયાસ થાય છે, કે જે આ શ્રમણ સંધ પર વિધાતક અસર ઉપજાવે અને પરિણામે જૈન ધર્મને મહાન ફટકો પડે.

અમદાવાદના એક જૈનેતર સીનીયર એડવોકેટ શ્રી પ્રભુદાસ બાલુભાઈ પટવારીએ મુંબઈ રાજ્ય વિધાન પરિષદમાં બાલ-સંન્યાસ-દીક્ષા-પ્રતિબંધક-નામનો વિધેય રજૂ કરીને તેવી જ સમસ્યા ઊભી કરી છે.

શું જૈન સમાજ તેને મુંગા મોઢે સહી લેવા તૈયાર છે? ધાર્મિક વિષયમાં એક વાર હસ્તક્ષેપનો સ્વીકાર થયો કે પછી એનો અંત જ નહિ આવે. અનેક જાતના ચિત્રવિચિત્ર વિધેયો આવતા રહેશે ને ધર્મપરાયણતાને જમીનદોસ્ત કરશો.

આ બાબતમાં સમાજ સાચી સ્થિતિ સમજતો થાય અને પોતાનું કર્તવ્ય અદા કરે તે માટે પ્રસ્તુત વ્યાખ્યાનમાળાની યોજના કરવામાં આવી છે; તેમાં સર્વને પધારવા આગ્રહભરી વિનંતી છે.

### ● કાર્યક્રમ ●

વ્યાખ્યાતા	વિષય	સ્થળ	સમય-દિવસ
પ.પૂ.વિશાનસૂરીથરજી પ્રશિષ્ઠ શ્રીચંદ્રાદ્યવિજયજી	ત્યાગની મહત્તમા ઉન્નતિનો સાચો માર્ગ વિજયજી ગણિ	શ્રી કેટ જેન ઉપાશ્રય શ્રી મલાડ જેન ઉપાશ્રય	તા. ૨૬-૧૦-૫૫ બુધવાર સવારે ૮ વાગે
પ.પૂ.પંન્યાસજી શ્રી પ્રવીણ ગણિ	ઉન્નતિનો સાચો માર્ગ વિજયજી ગણિ	શ્રી મલાડ જેન ઉપાશ્રય	તા. ૨૬-૧૦-૫૫ બુધવાર સવારે ૮ વાગે
પ.પૂ.પંન્યાસજી શ્રીચામવિજયજી ગણિ	બાલદીક્ષા શા માટે?	શ્રી જેન ઉપાશ્રય વિલેપાલ્લી	તા. ૨૭-૧૦-૫૫ ગુરુવાર સવારે ૮ વાગે
પ.પૂ.મુ.શ્રી ન્યાયવિજયજી	શ્રમણ જીવનની ઉપયોગિતા	જૈન ઉપાશ્રય ભાયભલા	તા. ૨૮-૧૦-૫૫ શનિવાર સવારે ૮ વાગે
પ.પૂ.પંન્યાસજી શ્રી ધુરંધરવિજયજી ગણિ	સર્વ વિરતિની વિરોધતા	શ્રી જેન ઉપાશ્રય દોલતનગર બોલીવલી	તા. ૩૦-૧૦-૫૫ રવિવાર સવારે ૮ વાગે
પ.પૂ.ઉપાધ્યાય શ્રીગુણસાગરજી ગણિ	સાચી સમાજસેવા	શ્રી જેન ઉપાશ્રય લાલવાડી	તા. ૩૦-૧૦-૫૫ રવિવાર સવારે ૮ વાગે
પ.પૂ.પંન્યાસજી શ્રી ભર્દંકરવિજયજી ગણિ	બાળ દીક્ષા	કરમયંદ હોલ, અંધેરી	તા. ૩૦-૧૦-૫૫ રવિવાર સવારે ૮ વાગે
પ.પૂ.મુ. શ્રી રોહિતવિજયજી	જૈન દીક્ષા	લાલબાગ જૈન ઉપાશ્રય	તા. ૩૦-૧૦-૫૫ રવિવાર સવારે ૮ વાગે
પ.પૂ.આચાર્ય શ્રી વિજયઅમૃત- સૂરીથરજી	જૈન ધર્મનાં સાંસ્કૃતિક પ્રવાહો	શ્રી શાંતિનાથજી જૈન દહેરાસરજી, દાદર	તા. ૩૧-૧૦-૫૫ સોમવાર સવારે ૮ વાગે
પ.પૂ.પંન્યાસજી શ્રી પ્રેમવિજયજી ગણિ	આરાધનાના પ્રતાપે	જૈન ઉપાશ્રય શાંતાકુંજ	તા. ૩૧-૧૦-૫૫ સોમવાર સવારે ૮ વાગે

પ.પૂ.મુ. શ્રી વિકાસવિજયજી ગણી	આજની પરિસ્થિતિ	આદીશ્વરજની ધર્મશાળા પાયધુની	તા. ૪-૧૧-૫૫ શુક્રવાર સવારે ૮ વાગે
પ.પૂ.આચાર્ય શ્રી વિજયકસ્તુર-સૂરીશ્વરજી	પ્રમાદ છિડો	શ્રી અબજીભાઈ જ્ઞાન મંદિર, માટુંગા	તા. ૬-૧૧-૫૫ રવિવાર સવારે ૮ વાગે
પ.પૂ.પંન્યાસજી શ્રી શુભંકર-વિજયજી ગણી	ત્યાગની સુંદરતા	શ્રી નમિનાથજી ઉપાશ્રય પાયધુની	તા. ૬-૧૧-૫૫ રવિવાર સવારે ૮ વાગે
પ.પૂ.પંન્યાસજી શ્રી દક્ષિણાંના ગણી	સુધારાની સાચી દિશા	જૈન ઉપાશ્રય, જ્ઞાનવિદીગલી, બોરીવલી	તા. ૬-૧૧-૫૫ રવિવાર સવારે ૮ વાગે
પ.પૂ.મુ. શ્રી વલ્લભવિજયજી	જૈન સંધનનું કર્તવ્ય	જૈન ઉપાશ્રય સેન્ટહસ્પેચોડ	તા. ૬-૧૧-૫૫ રવિવાર સવારે ૮ વાગે
પ.પૂ.મુ. શ્રી પદ્મવિજયજી મહારાજ	બાળસંક્ષિપ્તાનાં સુંદર પરિશામો	શ્રી લભ્યસૂરીશ્વરજી જ્ઞાન મંદિર, દાદર	તા. ૭-૧૧-૫૫ સોમવાર સવારે ૮ વાગે
પ.પૂ.પંન્યાસજી શ્રી પ્રિયંકર-વિજયજી, ગણી	શ્રમણસંધની ભવ્યતા	શ્રી જૈન ઉપાશ્રય શીવ	તા. ૧૩-૧૧-૫૫ રવિવાર સવારે ૮ વાગે

બીજાં વ્યાખ્યાનોનો કમ હવે પછી જાહેર થશે.

બુલિયન એક્સચેન્જ બીલીંગ,  
બીજે માળે, રૂમ નં. ૫૫,  
અવેરી બજાર, મુંબઈ, ૨. ટે.નં. ૨૩૨૨૯

લિ. મંત્રીઓ,  
બાળ સંન્યાસ-દીક્ષા-પ્રતિબંધક-વિજ્ઞાન-વિરોધ સમીક્ષા.



“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદધિ” વર્ષ-૪, અંક-૧૦, તા. ૧૨-૧૧-૧૮૫૨



## બાળ સંન્યાસ દીક્ષા પ્રતિબંધ વિ. વિરોધ સમીક્ષા અગત્યનું નિવેદન

મુંબઈની વિધેય સભામાં ૨૯ થયેલ ઉપરોક્ત શ્રી પટવારીના બીલની વિરુદ્ધમાં અનેક સ્થળોએથી હજારો અભિપ્રાયો સહિતો થઈને, મંત્રી શ્રી મુંબઈ રાજ્ય વિધાન પરિષદ, કાઉન્સીલ હોલ મુંબઈ, ઉપર રવાના થયાના સમાચારો અનેક સ્થાનોના શ્રી સંધો અને સંસ્થાઓ તરફથી અમોને મળે જાય છે. ૧૮ વર્ષ ઉપરની ઉમરના પ્રત્યેક ભાઈબહેને સહી જુદા જુદા ફોર્મ ઉપર કરવાની છે. પરંતુ તે તે દરેક જુદા જુદા કવરમાં મોકલવાની જરૂર નથી. ગમે તેટલી સંખ્યામાં ફોર્મ એ રજીસ્ટર બુક્પોસ્ટથી સરકારને મોકલી શકાય છે. બુક્પોસ્ટ ઉપર ફોર્મની સંખ્યા અને મોકલનારનું આખું નામ, ઠેકાણું લખવું, કે જેથી સરકાર તરફથી તરત પહોંચ મળી જશે. સંસ્કૃતિ અને ધર્મપ્રેમી દરેક ભાઈબહેનને સં. દીક્ષા પ્રતિબંધક બીલના વિરોધમાં પોતાનો અભિપ્રાય તાકીટે મોકલી આપવા અમારી નમ્ર વિનંતિ છે અને બીજાઓને પણ આ નુકશાનકારક બીલના ગેરજાયદા જણાવી જાગૃત કરે.

### ● બાળસંન્યાસ દીક્ષા પ્રતિબંધક ખરડાની સમીક્ષા ●

#### બાળસંન્યાસ દીક્ષા ખરડાની સમીક્ષા :-

મુંબઈ રાજ્યની ઉપરી ધારાસભાના સંભ્ય શ્રી પટવારીએ બાળ સંન્યાસ દીક્ષા પ્રતિબંધક ખરડો રજૂ કર્યો છે. તે મુજબ કાનુન ઘડાય એટલે,

૧૮ વર્ષની ઉમર સુધીની કોઈ પણ યોગ્ય વ્યક્તિ પણ આ દગ્ગા-પ્રપંચ-છળકપટ્ઠી ભરેલા સંસારથી અને સ્વાર્થી સંસારીઓથી દૂર થઈ પ્રતિશા લઈને મહાપવિત્ર જીવન જીવવાનું કરી ન શકે !!

અને તેવા મુમુક્ષુઓને પવિત્ર ત્યાગ માર્ગ અપાવનાર તેના માતાપિતા કે હિતરક્ષક વાલી જે કોઈ હોય તેને ગુનેગાર ગણી જેલની યા દંડની યા બંને સજાઓ કરવી !

અને જે કોઈ સાધુ પુરુષ એવા મહાપવિત્ર સંન્યાસને આપે, કે જે કોઈ સજજન એવી દીક્ષા લેવામાં મદદ કરે તેને પણ તેવો ગુનેગાર ગણવો, અને તે જ

પ્રમાણે દંડની અને જોલની તેને સાજા થાય !

વધુમાં જે મુમુક્ષુએ સંન્યાસ-દીક્ષાની મહાપ્રતિજ્ઞાઓ જીવનભર પાળવા માટે સ્વેચ્છાએ જાહેરમાં ગ્રહણ કરી હોય, તેની તે પ્રતિજ્ઞાઓને ફોક ગણવી ! એટલે કે એ ઉચ્ચ જીવનના માર્ગ ગયેલાને વચનભંગ કરવા રાજ્યે ફરજ પાડવી !

એવી એવી શ્રી પટવારીના ખરડામાં જોગવાઈ છે.

માત્ર શુભાશય બસ નથી :-

આ જાણીને સુસંસ્કાર વાંચ્યુ કોને દુઃખ નહિ થાય ? બાળ દીક્ષા પ્રતિબંધક ખરડો રજૂ કરનાર શ્રી પટવારીના શુભાશય માટે શંકા રાખવાની કે વિવાદ કરવાની જરૂર ના ગણાય, પરંતુ આ ખરડો જો કાયદાનું સ્વરૂપ લે તો તેથી ૧૮ વર્ષની ઉંમરસુધીનાનું હિત થશે કે અહિત થશે, તે વિચારવાની જરૂર છે. મારો શુભાશય છે એમ જાહેર કરવા માત્રથી શ્રી પટવારીની આ પ્રવૃત્તિ પરિણામે હિતકારી છે, એવું તો તેઓ પોતે કે કોઈ પણ કહેવાને હિંમત ન જ કરી શકે.

ખરડાની ચકાસણી :-

આ ખરડાની ચકાસણી માટે જૈન દીક્ષા ગ્રહણ કરનારને કેવા પ્રકારનું જીવન જીવવાનું છે. અને તેને માટે કેવી પ્રતિજ્ઞાઓ લેવી પડે છે, તેના ઉપર દાખિ કરવાની જરૂર છે.

સાધુ જીવનની પ્રતિજ્ઞાઓ :-

જૈન સાધુ થનાર પહેલી પ્રતિજ્ઞા એ કે છે કે હું કોઈ પણ જીવને મારીશ નહિ, મરાવીશ નહિ, અને મારનારને સારો માનીશ નહિ. એટલે કે માનવ જીવનમાં શક્ય વધુમાં વધુ અહિસક મનથી, વચનથી અને કાયાથી, બનવાનો એ મહાભાગ નિર્ણય કરે છે. બીજી પ્રતિજ્ઞા : જૂઠ નહિ બોલવાની પ્રતિજ્ઞા કરે છે. જૈન સાધુ વિના જરૂરે બોલવા કરતાં મૌન ઉત્તમ ગણે છે અને જ્યારે બોલવાનો પ્રસંગ આવે છે ત્યારે પણ મૂખા-જૂઠું તો ન જ બોલવું એ પ્રત અહિસા પાલનની દાખિએ પાણે છે. ત્રીજી પ્રતિજ્ઞાથી : જૈન સાધુ પોતાના સાધુ જીવનના પાલન માટે ઉપયોગી હોય તો પણ કોઈ ચીજ વસ્તુ તેના માલિકે યા રક્ષકે આપ્યા સિવાય કે તેની પરવાનગી સિવાય લેતા નથી વાપરતા નથી. અથવા તેનો ઉપયોગ પણ કરતા નથી. જૈન સાધુની ચોથી પ્રતિજ્ઞા : સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવાની છે. આ પ્રતિજ્ઞાથી જૈન સાધુ સ્ત્રીનો સંગ તો કરતા નથી. પરંતુ એથી ય આગળ વધીને એને પાંચે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાને ખૂબ ખૂબ કાળજી સેવવાની હોય છે અને યમ, નિયમ, તપ દ્વારા એની તાલિમ લે છે. પાંચમી પ્રતિજ્ઞા : જૈન સાધુની અપરિગ્રહી જીવનની છે. જૈન સાધુ પોતાની પાસે એક કોડી પણ રાખતો તો

નથી. પરંતુ ગૃહસ્થોના પણ પરિગ્રહનાં અયોગ્ય સંગ્રહને અને ઈન્દ્રિયોના સુખો માટે કરાતા દ્વય યા પરિગ્રહનાં વ્યયને તો વધારે પાપ માને છે. પ્રથમથી ચાર પ્રતિજ્ઞાના સ્થૂલથી પાલક ગૃહસ્થ પણ હોય છે. એમને પરિગ્રહની તો આવશ્યકતા રહે છે. પરંતુ સુક્ષ્મતાથી પાલન કરનાર મહાસંયમીને પરિગ્રહની જરૂર શું હોય ? જૈન સાધુ તેમના સાધુજીવનને પોષક અલ્યવસ્ત્ર પાત્ર આદિ, તેઓની મર્યાદા પ્રમાણે, મમત્વ રહિતપણે, ગૃહસ્થો પાસેથી માગી લે છે અને ત્યાગી જીવનને ઉજમાળ કરે છે.

આ સિવાય (૬) ચાત્રિભોજનનો ત્યાગ, એક સમયના પણ પ્રમાદ વિના અધ્યયન કરવું; (દર્શન ધર્મ) શાસ્ત્રોનો અભ્યાસ કરવો, નિયત ધર્મ કિયા કરવી, પાદવિહારી બનીને કોઈના પણ આશ્રય કે મદદની ઈચ્છા વિના સાચું સ્વતંત્ર જીવન જવવું, સંસારીઓની ખટપટમાં ન પડવું. એટલે કે કાદવમાં કમળ ઉગે છે ને રહે છે પણ ત્યાં, પરંતુ કમળ કાદવ સાથે લેપાતું નથી, પણ અલિપ્ત રહીને શુદ્ધ રહે છે. તેવી રીતે જૈનસાધુ થનાર આત્મા સંસારથી કાંઈ બીજા ગ્રદેશમાં ભાગી જતો નથી; ભાગી જવાનું શક્ય પણ નથી. પણ સંસાર અને સંસારીઓની વચ્ચે રહેવા છતાંય તેનાથી લેપાયા સિવાયનો રહીને ઉપરોક્ત ઉચ્ચ જીવન દ્વારા તેણે મહામાનવતા પ્રાપ્ત કરવાની છે. જૈન સાધુ જીવનની મહત્તમાનો સંપૂર્ણ ઘ્યાલ મેળવવા માટે તેના ઘણા બીજા નિયમો, પેટાનિયમો અને અપવાદો જાણવા જરૂરી છે. પરંતુ તે અતે નોંધતા ખૂબ લંબાણ થઈ જાય. જેથી એ પવિત્ર અને ઉપકારી જીવનનો સામાન્ય ઘ્યાલ આવી શકે, તેટલી હકીકિત અતે બહુ ટૂંકમાં જણાવી છે. આટલા ઉપરથી પણ સ્પષ્ટ સમજ શકાય છે કે આવી મહાપ્રતિજ્ઞાઓ ગ્રહણ કરનારને અટકાવી શકાય જ નહિ. તો પછી નાની ઉંમરથી પોતાની ઈચ્છાથી આવી તાલીમ લેવા તૈયાર થનારને અને તે પ્રમાણે જીવનભર જીવવા માટે નિકળનારને તો અટકાવાય જ કેમ !

મહામાનવતાના એક અંશનો પ્રભાવ :-

ખરી રીતે તો પ્રજામાં ન્યાય, નીતિ, ઉદારતા, સદાચાર આદિ ગુણો આવે અને ખીલે તથા દુર્ગુણો પ્રવેશે નહીં તે માટે કોઈ પણ સુજ્ઞે અને સુરાજ્યમાં ગણવાનો દાવો કરવા ઈચ્છતી કોઈ પણ સરકારે આ કરવું જોઈએ. દુન્યવી સુખો અને તેની લાલસાઓનો ત્યાગ કરી સામાન્ય માનવમાંથી મહામાનવ બનવા ઈચ્છતા; વયથી નાના હોય કે મોટા; પણ એવા ઉચ્ચતમ આત્માઓને સંપૂર્ણ સહાય આપવી જોઈએ. એક મહાવિદ્યાલય કે યુનિવર્સિટી પ્રજાને કેળવવાનું જેટલું કાર્ય કરે છે; તેથી કેઈકગુણું અધિક કાર્ય પ્રજામાં ઉચ્ચ સંસ્કારો આપવાનું એક સાચો ત્યાગી કરે છે.

આ માત્ર કલ્પના નથી. પરંતુ આપણો ભારતવાસીઓએ અને દુનિયાની દરેક દેશની પ્રજાએ અનુભવેલું સત્ય છે. મહામાનવતાનો એક અંશ પણ જે આત્મામાં પ્રગટે છે, તેનું જીવન, તેની જલક ઓર પ્રકારની હોય છે. ભાનુના ઉદ્યનો પ્રકાશ, હાથ આડો ધર્યે કે છાબડાં ઊભા કર્યે અટકાવાતો નથી. તેમ ગુણના પ્રાદુર્ભાવના એક અંશનો ચમકારો પણ છાનો રહેતો નથી. માત્ર તે જોવા દષ્ટિ તો જોઈએ જ.

### પ્રલોભનનો હાઉ :

જૈન સાધુનું જીવન, તથા ચર્ચા અને આદર્શ આટલાં બધાં ઉચ્ચ છે ! પરંતુ ભોગપિપાસુની દષ્ટિએ એ કષ્ટમય અને પાળી ના શક્ય અનુભૂતિ લાગે, એ સ્વાભાવિક છે. તો યાં સુધી તો એ ક્ષમ્ય છે. પરંતુ જ્યારે એવા સંસારમાં માથા બુડ ઢૂલેલા મહાનુભાવો અનુભવીનો અને દ્યાળુનો સ્વાંગ સજ્જને સંન્યાસદીક્ષામાં તો લાલચો અપાય છે, એના પ્રલોભનો કરાય છે, એવી ખોટી વાતો કરીને ભ્રમ ફેલાવે છે, ત્યારે સત્યના પક્ષે રહેવા ઈચ્છતા સૌની ફરજ થઈ પડે છે, કે એવા ભ્રમનું વિદારણ કરી ખોટા માર્ગ ધસડાઈ જતા આપણા બાંધવોને બચાવવા. આવી ખોટી વાતો કરનારાને જો પૂછવામાં આવે કે જૈન સાધુ જીવનમાં જેંચવા માટે શું લાલચો આપે છે ? યા પ્રલોભનો હોય છે, તો તેઓ વ્યાજબી ઉત્તર દેવામાં બંધ થઈ જાય છે; ખીસીયાણા પડીને સ્વર્ગને મોકનાં સુખની વાતોને આગળ કરીને ગમે તેમ બોલવા માંડે છે. શું એ લાલચ છે ? એવી લાલચથી વર્તમાન આખા જીવનના આવા કઠોર ચારિત્રના કષ્ટ ઉડાવવાનું કાર્ય શું સહેલું છે ? તેમ કોઈ પણ યોગ્ય આત્મામાં સદાચારની કે મોકની આકંક્ષા-ઈચ્છા પેદા કરવી અને ઉચ્ચ અહિંસા, સત્ય, વગેરેનું પાલન કરતા કરવા એ શું ચુન્હો છે ? અને જો તેને ચુન્હો ગણાય તો તો જગત ઉપર વિદ્યા-ન્યાય-નીતિ-સદાચાર-દારુત્યાગ, જુગારત્યાગ, આદિ સદ્ગુણોનો પ્રચાર કરનારાઓને માનવ જીતના મહાદુર્શમનો ગણીને જેલના સળીયા પાછળ ધૂકેલી મૂકવા જોઈએ ! શ્રી પટવારી પણ આમાં તો સંમત નહીં જ થાય. પ્રાથમિક ભૂમિકાના ગુણોને આવકારદાયક ગણનાર શ્રી પટવારી કે કોઈ પણ સજજન શું તેથી ખૂબ ઉચ્ચ કક્ષાના અહિંસા-સત્ય-અસ્તેય-બ્રહ્મચર્ય-અપરિગ્રહ વગેરે મહાગુણોને, યા તેના વિકાસને યા તે માર્ગ જનારને, યા તેમાં મદદ કરનારને જેલની સજીથી શું દડવા યોગ્ય ગણે છે ? આર્ય સંસ્કૃતિ ચાહક કોઈપણ ભાઈ કે બહેન એમાં સંમત હોય જ નહીં.

### ત્યાગના માર્ગને અભિવનારને રોકો :

દુનિયામાં ગમે તે સારા માર્ગના ઓઠે કવચિત્ત કોઈ પોતાનો સ્વાર્થ સાધતા

હોય, હોવાનું કોઈકને દેખાય તો તેથી શું સારો માર્ગ જ સંદંતર બંધ કરવાનું ન્યાય યુક્ત લેખાશે ? નહીં જ. વળી એવો આક્ષેપ કરે કે દીક્ષા લેનાર, આપનાર કે અપાવનારમાં અશુદ્ધ હેતુ યા કારણ છે; પરંતુ શું તેવા ત્યાગના કલ્યાણકારી પવિત્ર માર્ગને અભિવનારને અટકાવવા માટે વર્તમાન કાયદાના હાથ પુરા પહોંચેતા નથી ? મનુષ્ય હરણ, મનુષ્ય નયન, અયોગ્ય અટકાયત, વગેરે ન્યાયની કોર્ટમાં સાબિત કરીને બધું થઈ શકે છે. આમ હોવા છતાંય મતિકલ્પનાથી દોરવાઈને ઉચ્ચ માનવતા પ્રાપ્ત કરવાના રાજમાર્ગને ઉછેદવા કાયદાબંધીનો પુરુષાર્થ કરવામાં કઈ ભલાઈ છે ? કયું માનવહિત છે ? કઈ સજ્જાન અને ન્યાયની પ્રવૃત્તિ છે ?

### સંસ્કારની અસર :

આપણો સામાન્ય આત્મા ભાવુક દ્રવ્ય છે એટલે કે જેવા સંયોગ અને વાતાવરણમાં રહે છે, તેવો બહુધા ઘડાય છે. જૈન સંસ્કારમાં ઉછરેલા ઉ થી જ વર્ષના બાળકને પણ રાત્રિભોજન એ પાપ છે, એવો સામાન્ય જ્યાલ હોય છે ! રાત્રે પાણી પણ ન પીવું એ એને માટે સરલ છે ! પાંચ છ વર્ષનો બાળક એકસણું, આયંબિલ અને પ્રસંગે તો ઉપવાસનો કઠીન તપ પણ હસતે મોંઢે કરી લે છે ! જૈન સંસ્કાર કે જૈન કુળની શિસ્તથી અનન્બિજ્ઞ ગમે તેટલી ઉંમરનાં હોય, અને ડાદ્યા કે બળવાન ગણાતા હશે, તો યે તેમને આ આચાર સમજાવતાં કે ગળે ઉતારતાં ઘણી મુશ્કેલી અનુભવાય છે. છતાંય તેઓ પણ સમાગમ અને દફનિશ્ચય થતાં આવું બધું એ કરી શકે છે. સત્ત સમાગમ કે શુદ્ધ વાતાવરણનો અભાવ થતાં નિશ્ચય બળ નબળું બને છે, અને નાનો કે મોટો માણસ તેમાંથી ચ્યુત થાય છે, પતન પામે છે. આવું બનતું જગતની મધ્યમ સપાટીએ દેખાય છે, સામાન્ય વર્તનમાં પણ દેખાય છે, તો ભાગવતી દીક્ષાની ઉચ્ચ ભૂમિકાએ પહોંચી અનેક ઝંઝાવતો વચ્ચે ઊભા રહી સાધના કરનારા સેંકડે હજારોમાંથી એકાદનો પગ ડગી જાય અને મોહમાયાની જપાટામાં લથરી જાય, તો તેમાં શું આશર્ય છે ? છતાં હડીકતમાં આવું કવચિત્ત જ બને છે. આપણે સૌ ઈચ્છાએ કે આવું અપવાદિક પણ ના બને. આ ભાવના ઉચ્ચ છે. પરંતુ આત્મા અનેક કર્મજળથી જ્યાં સુધી જકડાયેલો છે, ત્યાં સુધી સર્વથા નિરપ્વાદ એ શક્ય નથી. આ સૌ કોઈ જાણે છે, છતાં એ જ્યારે “આવી ઉચ્ચ સપાટીએથી પડનારાનું શું થાય ? જગતમાં એનું કોણ ? એ બિચારો નહિ ઘરનો કે નહિ ઘાટનો બને છે.” એવી એવી ઉતેજક વાતોથી પ્રજાને જે ઉશ્કેરે છે; તેણે સમજવું જરૂરી છે કે ગ્રહણ કરેલી પ્રતિજ્ઞાનો ભંગ કરવો એ અંગ્ની પ્રવેશ કરતાંય ખરાબ છે, વગેરે શાસ્ત્રોની અને નીતિની શિખામણોનો જ્યાલ રાખવા છતાં, નથી ને કદાચ કોઈ પડે છે તો યે જો કે એણે દીક્ષા લેતાં પોતાના

સંસારી સંબંધીઓના મમતવને છોડ્યું હતું, પરંતુ સંસારમાં રહેલાઓએ તેના પ્રત્યેના રાગને છોડ્યો નથી; છોડી પણ શકે નહિ. તેથી હવે તે સંબંધીઓ તેને, આવે છે તો ધરમાં રાખે છે. ભિલકતનો ભાગ-લાગ પણ આપે છે, તેમની દણિએ ઠેકાણે પાડે છે. આવો દાખલો મોજુદ છે. માની લઈએ કે એમ પણ ના બન્યું, અથવા તેના કોઈ સંબંધી હ્યાત નથી, તો તેના દીક્ષિત જીવન કાળમાં તેણે જે ઉચ્ચ વિદ્યા પ્રાપ્ત કરી હોય છે, તેના દ્વારા તે આજીવિકા અને સામાજિક મોભો પણ મેળવે છે. આવો પણ દાખલો આજે છે. આજના સમાજનું આ સાચું ચિત્ર છે.

**શું સગીર બધી બાબતમાં અજ્ઞાન છે ? અણસમજું છે ?**

૧૮ વર્ષથી નીચેની ઉંમરની વ્યક્તિને દીવાની કાયદાએ વારસા-હિસ્સો કે બીજી એવી ધનસંપત્તિ મેળવવાની બાબતમાં પુરતી સમજદાર માની નથી, એ હકીકત છે. પરંતુ એથી સાક્ષી જુબાની કે ગુનાની બાબતમાં અણસમજદાર માનીને નકામી ગણી નથી કે કોઈ એને છોડી દેતી નથી. ઊલંટું એવા અનેક દાખલાઓ નોંધોયેલા કોઈની રેકર્ડ ઉપર છે કે ૧૦-૧૨-૧૩-૧૫ વર્ષની ઉંમરનાઓએ યોજના પૂર્વક ચોરી-વ્યાભિચારી, ખૂન-લૂંટ અને એવા ભયંકર ગુના કયાનું સાબિત થયું છે અને તેવા સગીરોને કડક સજાઓ પણ થઈ છે. જ્યારે આવા ભયંકર કાર્યો કરવામાં કેટલાક એવા ૧૮ વર્ષની નીચેના જેઓને બાળક કહેવામાં આવે છે, તેમની બુદ્ધિ ચાલે છે, તો સદાચાર અને ત્યાગના રસ્તે કોઈ પૂર્વના સંસ્કારી ૧૮ વર્ષની નીચેનાં પુષ્યવાન આત્માની વૃત્તિ થાય, એમાં શું આશ્રય છે ? અને આજના કાળમાં કે જ્યારે ૧૯ વર્ષનો કે તેથીએ ઓછી ઉંમરનો છોકરો કે છોકરી મેટ્રીકની પરીક્ષા આપી પાસ થઈ શકે છે. ત્યારે એટલી ઉંમરનાને બધી બાબતમાં અજ્ઞાન કે આણસમજું કહેવાનું સાહસ કોણ કરશે ? ૧૨-૧૩ વર્ષના બાળકને તેનાં વાલી માતા-પિતા પોતાની ઈચ્છાનુસાર લશ્કરી, વહાણવટાની, સિનેમાના નટ કે નટી થવાની, કે એવી કોઈ પણ શિક્ષા કે કેળવણીમાં જોડી શકે છે, અને સ્વાર્થ ખાતર સોલ્જર બનીને હજારોના જીવ લેવામાં કે વખતે કમોતે મરવામાં, કે જ્યાં ચારિત્રણીન જીવન થવાની ઘણી સંભાવના છે, તેમાં યોળ્ણને એ વિશ્વાસે રહેલા બાળકના જીવનના કચ્ચરધાણ કરી શકે છે; છતાં આમાં સગીરની અજ્ઞાનતા કે હિતના નામે કોઈ રોકટોક નહિ, ઊલંટું-સંસારી અને સરકાર સૌ એને ઉતેજન આપવાની વાતો કરે છે; અને સંન્માને છે તો પછી માબાપ ખુશીથી દીક્ષાર્થી સગીરને અહિસાદિના સંત જીવનમાં જોડે એમાં તો ખાસ ઉતેજન હોય, કે પ્રતિબંધક કાયદો હોય ? શાંતિ અને સદાચારનો જે પ્રજાને ખપ હશે તેણે તો ત્યાગી તપસ્વીઓને ખાસ સંન્માનવા જોઈશે, તેઓને પ્રોત્સાહન મળે તેવું જ કરવું પડશે. બાકી તો સિનેમાના

નટનટી અને બીજાઓના સંન્માનાદિ કરવાથી, કે આદરભાવ વધારવાથી શું મળે છે, તે ભાગ્યે જ કહેવાની જરૂર છે. પોતાના બાળકના સ્વાભાવિક વલશ અને વર્તન કલ્યાણકારી ત્યાગ પ્રત્યે જતા જોઈને તેના માતાપિતા પોતાના દુન્યવી સ્વાર્થનો ભોગ આપીને બાળકના અને જગતના ભલા માટે તેને દીક્ષાના યા સંન્યાસના પવિત્ર માર્ગ જવાની અનુકૂળતા કરી આપે, તેનો ઉત્સવ કરે, તેમાં તેઓ બાળકનું શું બગાડે છે ? અને બાળક શું ખોટું કરે છે ? કે જેથી એવા ભાગ્યશાળી માતાપિતાને અભિનંદન આપવાને બદલે જેલમાં ધકેલવાની વાતો કરાય છે ? અને એ બાળકને જાણો કોઈ ગુન્હાહિત કૂત્ય કરતો હોય અને અટકાવાય તેમ અટકાવાની દલીલો થાય છે ? બાળ સંસ્કાર અને બાળ કલ્યાણની છાપાઓમાં દરરોજ વાતો કરનારાઓએ આવા પ્રસંગે વિચારવાની જરૂર છે. ત્યાગ અને સદાચારનો દ્વાર બંધ કરવામાં આવે યા તેમાં સહેજ પણ આડખીલી કરવામાં આવે તો પ્રજાનું અને તેમાંય ઉગતી પ્રજાનું ભાવી કેટલું ભયંકર છે; તે તેઓએ સમજીને સમજાવવાની જરૂર છે. જૈન દીક્ષા એ સદાચાર, ત્યાગ, તપ, વિદ્યા અને સંયમમય પવિત્ર જીવન છે. જૈન સાધુ જગત ઉપર દાન-શીલ-તપ-શાંતિ-મૈત્રી આદિ ગુણોનો પ્રચાર કરે છે. દીક્ષા પ્રતિબંધક ખરડો ઉત્તમ બાળકોને અને ઉત્તમ માર્ગ જનાર બાળકોને સજી સમાન છે. એનાથી સગીરોનું મહાાહિત જરૂર થશે. માટે તેને હરગીજ પસંદ કરી શકાય જ નહીં. પોતાના બાળકને ઉચ્ચતમ માર્ગ જવામાં સંમતિ આપવાના અને તેમાં ચઢાવવાના માત-પિતાના જન્મસિદ્ધ હક્ક ઉપર ભયંકર લૂંટ સમાન છે. જગતની સર્વ સુધરેલી પ્રજાએ સદાચારમય ઉત્તમ જીવન જીવનારને તો સહાય કરવાનું સ્વીકારેલું છે. એનો ઈન્કાર થઈ શકે જ નહીં. માટે શ્રી પટવારીને તેમનો બાળ સં. દીક્ષા પ્રતિબંધક ખરડો હજ પણ પાણો ખેંચી લેવા અગર સરકારે તેને નામંજુર કરવા અમારી વિનંતિ છે.

**સુઝેષુ કિં બહુના ।**





## વિધાનસભામાં ‘ભાલ-સંન્યાસ પ્રતિબંધક બીલ’ રજૂ કરતાં શ્રી પટવારીએ કરેલા આક્ષેપોનો પ્રતિકાર

અહિંસાદિ ગુણોનો અભ્યાસ જન્મથી જરૂરી :

પવિત્ર આધ્યાત્મિક સંસ્કૃતિથી હુનિયાના સમગ્ર દેશોમાં ગૌરવ લેતા આ ભારત દેશમાં આજે આધ્યાત્મિક જીવનની ઉચ્ચ કક્ષારૂપી સંન્યાસ દીક્ષા ઉપર પ્રતિબંધનો ખરડો લાવવામાં આવે છે. એ સમગ્ર ભારતવાસીઓને મહાન દુઃખજનક છે. માનવજીવનની ખાસ વિશેષતા ઈન્દ્રિયોની ગુલામી અને વિષયસુખોની ચકચુરતામાં નથી, કેમકે એ તો કીડા અને પશુપંખીઓ પણ ધરાવે છે; માનવજીવનની સફળતા મહાન ત્યાગ, સહિષ્ણુતા, સંયમ અને અહિંસા, સત્યાદિનો શક્ય વિકાસ સાધવામાં છે. જન્મ જન્મની મલિન વાસનાઓ સામે જીજુમવામાં આવે ત્યારે આ અહિંસા, સત્ય, સંયમ વગેરે ગુણોનો અભ્યાસ જેટલો વધુને વધુ કરવામાં આવે તેટલા પ્રમાણમાં તે ગુણો સારા ખીલી ઉઠે છે અને નાનપણથી એવો અભ્યાસ કરનાર વ્યક્તિ જગતને પણ તે ગુણોનું ઉત્તમ શિક્ષણ આપી શકે છે. ધમ્પત્રીમી બંધુઓ અને બેનોમાંથી કોઈ આનો વિરોધ નહિ કરે એમ હું માનું છું. એટલે જ સાહુજીવન કેટલાક પૂર્વ જન્મના સંસ્કારી બાળકોને એની ઈચ્છાથી અહિંસા, સત્ય, ઈન્દ્રિય-સંયમ વગેરે ગુણોની તાલીમ આપે છે, અને એમને સંત મહાત્મા બનાવે છે; જે પછી જગતમાં એ ગુણોનો ઐચ્છિક અને અવેતનિક પ્રચાર કરે છે. તે જોતાં જો બાળકને અટકાવવામાં આવે તો એનો અને જગતનો કેટલો બધો દ્રોહ કર્યો ગણાય ?

શ્રી પટવારીના આક્ષેપોના સચોટ રદીયા :

મહાનુભાવો ! આ ખરડો સગીર દીક્ષા તદ્દન બંધ કરીને પૂર્વ જન્મથી “યોગબ્રાષ્ટ” (યોગની સાધના કરતાં કરતાં મૃત્યુ થવાથી અટકેલા) મહાન આત્માઓનો અને જગતનો ભયંકર દ્રોહ કરી રહ્યો છે. ખરડો લાવવાના હેતુમાં શ્રી પટવારી ભાગ્ય કરી ગયા કે (૧) ઘણા ડિસાઓમાં સંમતિ લેવાતી નથી. આ કથન જો સાચું હોત તો એમણે ઘણા દાખલાઓ રજૂ કર્યા હોત, જૈન સમાજમાં સગીરને

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ” (ભાગ-૧૮)

૧૬૩

મા-બાપની સંમતિ કિના દીક્ષા અપાઈ હોય એવા ઘણાં તો શું પણ આંગળીના ટેરવે ગણાય એટલા પણ દાખલા બન્યા નથી. (૨) તેઓ કહે છે કે અમારે અપહરણ (Kidnapping)ના કેટલાયે કેસોમાં પોલીસની મદદ લેવી પડી. પરંતુ આ કંઈ બીલ લાવવા માટે સાચી દલીલ નથી કેમકે આજની સરકાર અને વ્યવસ્થામાં એ અનિષ્ટ રોકવા કાયદા મોજુદ છે. સાચું તો એ છે કે એવા દાખલા તેઓ ટાંકી બતાવે. “સોશીયલ વર્કરની મદદ માટે આ બીલ છે.” એમને હું પૂછું છું કે તમે વધારે શ્રેષ્ઠ ભૌતિક ઉન્નતિ માનો છો કે આધ્યાત્મિક ? સોશીયલ વર્કરની જેમ રિલિઝસ વર્કરને કદાચ તમે સહાય ન કરો; પણ કમમાં કમ એની આડે આવવાનો શું અન્યાય નથી કરતા ? દીક્ષાનો પ્રશ્ન માત્ર સોશીયલ નહિ; પરંતુ રિલિઝસ પણ છે; તેમજ દીક્ષિત બાળક સોશીયલ વેલફેરની આડે નથી આવતું, કિંતુ પોતાની માલ-મિલકત સોસાયટીના લાભમાં જતી કરે છે તથા સોસાયટીને સંપ, સદાચાર, સહિષ્ણુતા, વગેરે ગુણો શીખવીને જીવનમાં શાંતિ અને સુખ અનુભવાવે છે. ત્યારે કહો જોઉં બાલદીક્ષા અટકાવીને છોકરાને વાસનાનો શિકાર બનાવી અનેક આર્થિક, શારીરિક વગેરે ઉપાયિઓમાં ઉતારવો. તેમજ બીજાના શોષણ કરતો બનાવવો, શું એ સોશીયલ વેલફેર છે ? માતાપિતા અને બાળક બંનેની પૂર્ણ ખુશીથી દીક્ષાર્થી બનનાર સગીરની દ્યા ખાવા નીકળી પડેલા દેવના દૂત સમા આ ખરડો રજૂ કરનાર દ્યાળુ ધારાસભ્ય એ બતાવશે કે એવા દીક્ષાર્થી એકલા મુંબઈ પ્રાંતની બે ત્રણ કરોડની વસ્તીમાં કેટલા નીકળશે ? બહુ બહુ તો પાંચ પંદર નીકળતા હશે, પરંતુ બીજી બાજુ જુઓ કે પૈસાની તંગીથી કેળવણી ન લઈ શકનાર અથવા પૌણ્ટિક ખોરાક ન પામી શકનાર અથવા યોગ્ય દવા વગેરેના ઉપાય નહિ કરી શકનાર લાખો સગીરો છે. એની દ્યા ખાઈ શ્રી પટવારી જેવાએ શું કર્યું તે બતાવશે ? કોઈ માબાપો અજ્ઞાનતાથી છોકરાને અવળી કેળવણી કે ધંધા ગુલામીમાં છોકરાનું જીવન કચરી નાખે છે, એના માટે એમને કંઈ કાયદો કરવાનો છે ખરો ? (૪) આ ખરડો રજૂ કરનાર ધારાસભ્ય કહે છે કે રજાથી કે રજા વિના બાળકેને દીક્ષા આપવી એ બંને અયોગ્ય છે, કેમકે એ અજ્ઞાન છે. આની સામે તેમને આપણે પૂછીએ કે સગીરને કેળવણી કે ધંધાર્થે પરદેશ મોકલી શકાય ? સગીરને થોડા ઘણા પૈસા સોંપી શકાય ? બાપ પોતાની ઈચ્છાથી સગીરને એની ઈચ્છા કે શક્તિથી વિસુદ્ધ લાઈનમાં જોડી શકે ? જો આવા પ્રશ્નોમાં એ અજ્ઞાન કહેવાના છતાં જોડી શકાય પણ કાયદાથી અટકાવાય નહિ, તો પછી સગીરને દીક્ષામાં સ્વેચ્છાએ જોડાતો કેમ અટકાવાય ? બીજું, સાધુ જીવનની તકલીફો સમજવા અનુભવવામાં શું સગીર અજ્ઞાન છે ? ત્યારે ગુનેગાર સગીરોને કોઈ પણ શું, એ

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-જેન શાસનમાં ભાગવતી દીક્ષાનું સ્થાન (ભાગ-૧૮)

અજ્ઞાન છે માટે, એને સજા નથી કરતી ? ગુનો કરવાની સજાનતા સમજીને જ એને સજા કરાય છે. વળી તેટલી તેટલી સજાનતાના હિસાબે જ કેળવશીમાં આગળ વધે છે, ને સમાજના જીવન નિયમો બરાબર પાળે છે. તો એ હિસાબે દીક્ષા પણ કેમ ન લઈ શકે ? રાત્રે ન ખાવું ! હિવસે પણ પોતાના માટે નહિ બનાવેલો આહાર જે મળે તેથી ચલાવવું ! ઘણાંએ ખાદ્ય રસદાર પદાર્થો જીવનભર ત્યજવા ! ગામે ગામ પગે ચાલીને ફરવું ! ચાતી પાઈ પણ પાસે ન રાખવી કે રખાવવી ! વગેરે કષ્ટમય સાધુચર્ચા વર્ષોના વર્ષો પાળવી એ સજાનદશા નથી શું ? અરે, એ જ બાલદીકિંત યુવાન બન્યા પછી જરાય એવો પશ્ચાત્તાપ નથી કરતો, કે મને વૈભવ-વિલાસના આનંદથી વંચિત રાખવામાં આવ્યો. ઉલંટું એ ત્યાગ અને અહિસાદિમય જીવનમાં મહાઆનંદ માને છે.

**બાલદીકાથી સરકારને લાભ :** શ્રી પટવારીની નોંધપોથી :-

આવા દાખલાઓ આજે મોજુદ છે. પછી ભલે પુષ્યથી. સદ્ગતિની લાલથી કે પાપના ભયથી એ ત્યાગજીવનની બધી ચર્ચા આનંદપૂર્વક પાળે, અને જિંદગીભર એ આનંદમાં મસ્ત રહે; તો પણ એમાં તો એ એક ભવ્ય સ્વપર ઉપકારી અને સુખી સાધુ નાગરિક તરીકે અહિસા, સત્ય, સદાચાર વગેરે આચરી રહે છે એમાં ખોટું શું છે ? સરકારને એના તરફની નિરાંત રહે છે; પોલીસ કોર્ટ વગેરેનો ખર્ચ સરકારને આવા સંતના માટે કરવો પડતો નથી. પછી સગીરદીકાશમાં શું અનિષ્ટ થયું ?

**દીક્ષાથી ભવિષ્ય રદ-બાતલ નહિ પણ ઉજ્જયું :-**

(પ) કહે છે, “દીક્ષા એની ભવિષ્યની જિંદગી રદ-બાતલ કરે છે.” આ કથન, એ આર્ય તત્વજ્ઞાનની દષ્ટિએ પાશવીરૂપ ગણાતી જે વૈષયિક વૃત્તિ, તેમાં જીવનની સફળતા માનવાનું સૂચ્યે છે. નહિતર પવિત્ર અહિસા, સત્ય, પ્રભાર્ય વગેરે ઉચ્ચ વૃત્તિઓમાં રદબાતલ શી ? એમ તો જે છોકરાને જૂઠ કે ચોરીમાં આનંદ આવે છે એને બાલપણથી પરાણે પણ એ અટકાવવામાં એનું ભવિષ્ય રદબાતલ થતું મનાશો ! કેમકે ત્યાં એને સત્ય અને નીતિ પર પૈસા પૂરા મળતા નથી એવું પણ બને છે; એના બદલે જો જૂઠ ચોરી ચાલવા દીધી હોત તો મોટો થઈને ઓટકોટ કરી પૈસા સારા ભેગા કરત. પણ જેમ આ ખોટું છે એને બાળપણથી ગુના ટાળવામાં સાચું કલ્યાણ છે; તેવી રીતે સગીરને નાનામાં નાની હિસા-જૂઠ-પરિગ્રહ વગેરે પાપોથી બચાવનારી દીક્ષાથી આ જન્મ અને પરલોકમાં પણ એનું મહાન કલ્યાણ છે. એવું માનનાર માબાપને; છોકરા જો એની ખુશીથી દીક્ષા માર્ગે જતા હોય તો, તેમાં સંમત થવામાં કાયદો આડો કેમ આવી શકે ? ત્યારે મા-બાપો

જીવનભાનું એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ” (ભાગ-૧૮)

૧૬૫

છોકરાને દીક્ષામાં વેચે છે આવો આક્ષેપ જો કરે તો તેવા કેટલા દાખલા કયાં કયાં, અને ક્યારે ક્યારે બન્યા ? તેમજ બે ગ્રાસ કરોડની વસ્તિમાં કેટલા ટકા બન્યા કે જેથી કાયદો લાવવો પડે છે ? જો એની અસહાયતાનો લાભ લેવાય છે એમ કહેતા હો તો બુદ્ધિશાળી છોકરાના માથે આખા કુટુંબનો ભાર નાખી અને ઊંચી કેળવણી વગેરેની અમૂલ્ય તકોથી ખસેડી નોકરીમાં ધકેલવામાં પણ શું એની અસહાયતાનો લાભ લેવાતો નથી ? આવા આવા તો કેટલાય દાખલાઓ છે. સમાજ સુવારણા કરવાનો દાવો-રાખનાર આ ખરડાવાળા માનનીય સભ્યની નોંધપોથીમાં એ બધું હઠાવવાની યોજનાઓ અને અમલ છે ખરા ?

**ભૂદાન અને બાલદીકા મિન છે : બાલદીકા સહાયક ધારો લાવો :-**

વળી તેઓશ્રી શ્રીમાન મોરારજીભાઈના અમદાવાદના ભાખણમાંથી “ઉત્સાહમાં આવેલી ઘેલણાનો લાભ ન લ્યો. એનું હદ્ય પરિવર્તન હોય તો જ ભૂદાનમાં મદદ લેવી.” એ શબ્દો લઈને કહે છે કે એ મુદ્દો અહીં લાગુ પડે છે. પણ આ કથન માયાજ્ઞાળ છે. બાળકને દીક્ષા પણ હદ્ય પરિવર્તન પછી જ અપાય છે અને એ પણ હદ્ય પરિવર્તન પછી જ લે છે. નહીંતર પછીથી એ કઠોર ઈન્ડ્રિય સંયમ, પાદવિહાર, તપસ્યા, કેશલોચ, વગેરે સાધુચર્ચામાં ખુશીથી ટકી શકે નહિ. તેમજ ઘેલણાથી ભૂદાન કરનારને તો પછીથી પશ્ચાત્તાપ કરવાનું બને છે, અહીં તો ઢગલા બંધ બાળદીકાના દાખલા છે, જે સાધુ જીવનમાં મહાઆનંદ અનુભવી રહ્યા છે. એટલે બાળકનું વૈરાગ્યથી હદ્ય પરિવર્તન થયું હોવાથી ખરી રીતે આ ખરડો રજૂ કરનાર ધારાસભ્યે “બાલ સંન્યાસ સહાયકધારો” લાવવો જોઈએ.

**વડોદરા વખતે પણ જંગી વિરોધો : મુંબઈની અપૂર્વ સભા :-**

વડોદરા રાજ્યમાં કાયદો આવ્યો હતો. પણ વિરોધી વિરાટ લોકમતને અવગણીને એ ઠોકી બેસાડવામાં આવ્યો હતો. શ્રે. કોન્ફરન્સે પણ જૈનચાર્યો, જૈનશાસ્ત્રો “અને જૈન સંધના વિરોધને જોઈ” સમય પારખીને બાલ દીક્ષા વિરોધનો ઠારવ ફાલનાના અધિવેશનમાં પાછો બેંચી લીધો છે. આજે પણ મુંબઈમાં સુધારક ગણાતી એવા લગભગ બધા આગેવાનો તેમજ જૂના વિચારના આગેવાનો મળી ૧૪ આગેવાનોએ બીલનો વિરોધ કરવા બોલાવેલી મુંબઈના જૈનોની જંગી સભાએ સર્વાનુમતે આ બીલને ધૂતકારી કાઢ્યું હતું. અમદાવાદમાં જુદી જુદી સભાઓએ તેમજ ગામેગામના સંઘોએ આ બીલનો વિરોધ કર્યો છે.

**સાધુ પુરુષોની બદનક્ષી :**

આ ખરડો રજૂ કરનાર ધારાસભ્ય કહે છે કે સાધુઓને શિષ્ય વધારવાની ઘેલણા હદ વગરની થઈ ગઈ છે. તો શું સ્ક્રૂલો, કોલેજો, ખાનગી, વેપાર, ઉદ્યોગાદિ

૧૬૬ જીવનભાનું એન્સાઈક્લોપીડિયા-જૈન શાસનમાં ભાગવતી દીક્ષાનું સ્થાન (ભાગ-૧૮)

શીખવતી શાળાઓ વગેરેના સંચાલકોને હદ વગરની નફાની ઘેલણા, પોતાના વિદ્યાર્થી વધારવાની, કે પોતાની આબરુ ફેલાવવાની ઘેલણા લાગી છે માટે વિદ્યાર્થીઓને સંધરે છે ? જો એમ હોય તો તો લાગે છે કે શ્રી પટવારીજી હવે એ સ્કૂલો વગેરેને પણ બંધ કરવાવાના કાયદાની યોજનામાં હશે ! જ્યાં, આ શાળાઓ વગેરે બાળકનું જે કલ્યાણ અર્થાત્ સગીરના સનાતન આત્માનું જે હિત કરી શકે એના કરતાં અતિ ઉચ્ચતમ કલ્યાણ પવિત્ર દીક્ષામાર્ગથી સધાય છે, ત્યાં દીક્ષા આપનાર પર શિષ્ય મોહનો આક્ષેપ કરવો એ સાધુ પુરુષોની ભયંકર બદનક્ષી છે.

**દીક્ષિત નહિ બનેલા બાળકોનું શું હિત કર્યું ? :-**

ભારતમાં સાધુ સંસ્થા પણ એક મોટી સંસ્થા છે એમાં બીજી સંસ્થાઓ વગેરેમાં બને છે તેમ સંભવ છે, કદાચ કોઈ એકલા શિષ્ય મોહી હોય પરંતુ તેથી બધાને હલકા ચીતરવા, એ શું પોતાના જ હદ્યની તેવી કક્ષા નથી સૂચવતું ? હું એમને કહું છું કે સાધુઓએ તો કેટલાય બાળકોનો મહાન ઉદ્ઘાર કરી અહિંસા, સત્ય, સંયમના માર્ગ ચઠાવ્યાના, તેમ જગદુદ્ઘારક બનાવ્યાના નક્કર દાખલા છે. પણ આવા બીલના સમર્થક ભાઈઓએ કેટલાના કલ્યાણ કરી એમને મહાન બનાવ્યા છે ? કોઈક વિરાગી બાળકને ફોસલાવી અગાર કોર્ટ બળે અટકાવી સંસારના મોહમાં પાડ્યાના પરાકમની નોંધ એ બતાવી શકશે. પરંતુ તેમને પૂછવાનું કે હવે એમણે સંસારમાં ફસાયેલા આત્માઓને પૈસે ટકે અને કુટુંબ વગેરે બાબતમાં સુખી કર્યા છે ને ? હવે એમનું કોઈ દુઃખ નથી રહેવા દીધું ને ? ત્યારે જે માબાપ દીક્ષા લેતા હોય, તેના સગીર પુત્ર-પુત્રી દીક્ષાર્થી હોવા છાતાં તમારા કાયદાથી દીક્ષા ન લઈ શકે; તો તેનું સંરક્ષણ-સંવર્ધન તમે માથે લઈ લીધું છે ને ? તમારા પુત્રની જેમ જ તેનું પાલન, તમારી મિલકતમાં વારસા હક, વગેરેની યોજના કરી દીધી છે ને ?

**દોષ સર્જક દસ્તિ :-**

આ ખરડો રજૂ કરનાર ધારાસભ્ય કહે છે કે જૈનોમાં કંટ્રોલ કરનાર કોઈ બોડી નહિ હોવાથી આ બીલ લાવવું પડ્યું છે. શું આ દલીલ છે ? તો તો પછી આટલું જ શા માટે ? જૈનોમાં કંટ્રોલીંગ બોડી નથી માટે સગીર કે ઉંમરલાયક બધાને દીક્ષા બંધ, મંદિર બંધ, ધર્મસાધના બંધ, ઈત્યાદિના બીલ લાવ્યા કરો. કેમકે તમારી વિલક્ષણ દસ્તિમાં બધે વાંધા દેખાયા કરશે. પછી આગળ વધીને કોટુંબિક જીવન, વેપાર, ધંધા વગેરેમાંય દોષ-સર્જક આંખે વાંધા દેખાશે. માટે જૈન સમાજની દાઝથી, જૈનોમાં કંટ્રોલીંગ બોડી ન હોવાના કારણો એ વેપાર પણ બંધ કરવાના કાયદા લાવો.

**જૈન પ્રજ્ઞાન તેજોદેષથી બીલ લવાયું છે :-**

આ બીલ રજૂ કરનાર ધારાસભ્ય કહે છે કે ઓપોર્જીશન મુખ્યત્વે જૈનોનો છે. આ પહેલું તો એ સૂચવે છે કે જૈનોને જ આ બીલ સાથે લાગે-વળગે છે તેથી માત્ર જૈનો સામે જ આ બીલ લાવવાનું પુરવાર થાય છે. વળી એ બાલ દીક્ષાના અનિષ્ટના દાખલા વાંધા વિરોધ વગેરે પણ જૈનોના જ રજૂ કરે છે. આ સૂચવે છે કે બીલ લાવવામાં એમની સામે માત્ર જૈનો છે. એ બાવા, સંન્યાસી કે ફીરીનું નામ ભલે છે, પણ એના અનિષ્ટના પુરવા એમણે એક ટકો પણ રજૂ કર્યો નથી, તો માત્ર જૈનો જેવી લઘુમતિ કોમ સામે આવું ગોઝારું બીલ લાવવું, એ શું તેજોદેષ નથી ? પક્ષપાતી વિરોધ નથી ? જૈનોનો મુખ્યત્વયા વિરોધ હોવાનું કારણ એ છે કે જૈન ધર્મ માનવ જીવનનું સર્વ શ્રેષ્ઠ કાર્ય તરીકે આઠ વર્ષની ઉંમર પછી દીક્ષા અર્થાત્ સર્વ ત્યાગમય નિષ્પાપ જીવન સ્વીકારવાનું માને છે. માત્ર માન્યતા જ નહિ પણ હજારો વર્ષથી આજ સુધી કેટલાયે ભાગ્યશાળી આત્માઓએ એને અમલમાં ઉતાર્યું છે. એથી નિજના અને જનતાના જીવન ભવ્ય બન્યા છે અને બને છે. એમના પર આવા બીલનું આકમણ એ ભયંકર અન્યાય છે...ત્યારે જૈનોનું ઓપોર્જીશન (વિરોધ) થોડું હોવાનું આ ખરડો રજૂ કરનાર ધારાસભ્યનું કથન તદ્દન વાહિયાત છે, કેમકે મુંબઈનો મોટો જૈન સંધ, અમદાવાદનો મોટો જૈન સંધ, તેમજ કોઈ નાના મોટા ગામ શહેરોના સંઘનો આ બીલ સામે સજ્જડ વિરોધ નોંધાયો છે. ઊલંઘું બીલ તરફેણમાં તો મુંબઈમાં માત્ર ૫૦ માણસની યુવક સંધની સભાએ, તેમજ અમદાવાદની એક નાની સભાએ આ બીલને ટેકો આપ્યો છે.

**બીલને પાંગળો ટેકો :**

આ ખરડો રજૂ કરનાર ધારાસભ્ય કહે છે કે એમના બીલના સમર્થનમાં ઠરાવો અને તારોના ઢગલા આવ્યા છે, પણ એમણે સમર્થક ઠરાવો, તારો અને વિરોધના ઠરાવો તારોના આંકડા રજૂ કર્યા હોત તો, એમના પ્રતિપાદનની પોકળતા ખૂલ્લી પડત. આ તકે જો સરકાર તરફેણ અને વિરોધના આંકડા રજૂ કરે તો આપણને સાદું જાણવા મળે.

**દેવદાસી-પશુ વધ વગેરે સાથે બાલ દીક્ષા સરખાવાય નહિ :**

આ ખરડો રજૂ કરનાર શ્રીયુત પટવારીની એક દલીલ એવી છે કે દીક્ષા માટે અજ્ઞાન જીવોને મૂર્ખતાભરી પરલોકની ખોટી ખાલચમાં ફસાવાય છે, એમ પૂર્ણી શકીએ કે શું શ્રીયુત પટવારી પરલોક માને છે ? જો માનતા ન હોય તો પરલોકની માન્યતાવાળા જૈન ધર્મમાં એમને હસ્તક્ષેપ કરવાનો જરાય ન્યાયી અવિકાર નથી. જો પરલોક માનતા હોય તો શું જૈનોની શૈલીથી પરલોક સુધારવાનું માને

છે ? જો નહિએ, તો જૈન શૈલીથી માનનારા સમાજ પર પ્રશ્ન કે આક્ષેપ કરી પ્રતિબંધક બીલ લાવવાનું એમનું ફૂટ્ય તદ્દન ન્યાય વિરુદ્ધ છે. એટલું ધ્યાનમાં રહે કે જ્યારે અહીં બાળ દીક્ષા બાળક અને માભાપની ઈચ્છાથી જૈન શાસ્ત્રની વિવિધ અનુસાર અપાય છે અને એમાં ત્યાગ, અહિંસા, સત્ય સંયમ વગેરેનું એકાંતે સ્વપર કલ્યાણકારી જીવન જીવનાનું હોય છે, ત્યારે અને ધર્મ કે પરલોકના નામ હેઠળ ચાલતા દેવદાસી, પશુવધ જેવા ધોરકાર્ય સાથે સરખાવાય નહિએ; એ સરખાવનારા સાક્ષરો રાક્ષસો બને છે.

**બીલને ટેકો ધણા ધણા સોશીયલ વર્કરોનો નથી :**

બાકી ધારાસભ્ય બીલ પ્રત્યે અતિ અલ્પસોશીયલ વર્કરોનું અનુમોદન જગ્ઝાવે છે, એ અનુમોદક વર્કરો એમની સ્ક્લુલમાં પાસ થયેલા કે બીજા ? પહેલું તો સોસાયટીને જંગી પ્રમાણમાં અનેક પ્રકારની સેવા-રક્ષા આપનારી સોશીયલ વર્કર સરકારનું જ અનુમોદન એમને ક્યાં મળ્યું છે ? ત્યારે સોસાયટીને સત્ય, સદાચાર, મનઃશાંતિ કુટુંબશાંતિ, સહિષ્ણુતા, સંતોષ વગેરે શીખવી સાચી મહાન સેવા આપનારા સોશીયલ વર્કર સાધુ પુરુષોનું અનુમોદન ક્યાં મળ્યું છે ? વળી પોતાના બાળકોને ધર્મશર્દ્ધા, પરલોકભય અને પાપજુગુપ્સા શીખવી સારા સજ્જન નાગરિક બનાવવાનું મહાન સોશીયલ કામ બજાવનાર ધર્મી મા-બાપોનું આ બીલ પ્રત્યે અનુમોદન તો દૂર રહ્યું પણ જંગી પ્રમાણમાં વિરોધ છે. આવા બધા સોશીયલ વર્કરોની વિરાટ સંભ્યા સામે એમના ગણ્યા ગાંધ્યા સોશીયલ વર્કરોનું અનુમોદન એ કેટલું બળવાન ગણાશે ? સાધુ-સંતોની સમાજ-સેવા તો સર્વોદયના પ્રચારમાં ધણી ધણી સહાયક છે. એમના જીવન અને ઉપદેશે જુગાર, મહિરાપાન, પરસ્તીગમન, ચોરી-ઝઘડા વગેરેના વ્યસનોથી લાખોને બચાવ્યા છે.

**શ્રી જવાહરલાલજી શું કહે છે ? :**

એમ કહેવામાં આવ્યું છે કે શ્રી જવાહરલાલ નહેરૂજીએ આ બીલને આશીર્વાદ આપ્યો છે. પણ બરી વસ્તુસ્થિત એવી છે કે આ બીલની તરફેણમાં અમદાવાદમાં એક સભા થઈ (જેમાં હાજરી અલ્ય હતી) એ સભા માટે શ્રી નહેરૂજી ઉપર એક પત્ર લખવામાં આવ્યો. ત્યારે એના ઉત્તરમાં એમના સેકેટરી તરફથી રાબેતા મુજબના શિષ્ટાચારવાળો (Formality નો) પત્ર લખાયો હોય કે તમે જે મિટીંગ લેવાના છો તેની સફલતા ઈચ્છું છું, પણ નહિ કે જે કામકાજ લેવાનું છે તેને સંમતિ. તો આ કાંઈ બીલના તત્ત્વ ઉપર અનુમોદન નથી. શ્રી જવાહરલાલજીને જો ખરેખર રીતે બીલની વસ્તુને ટેકો આપવો હોત તો સભાપ્રમુખને બાલ દીક્ષા પ્રતિબંધમાં પોતાનો સંપૂર્ણ ટેકો જણાવ્યો હોત. બાકી તો સેંકડો પત્રોના એવા ટ્રેડિશનલ (શિરસ્તા ભુવનભાનુ એન્સાઈસ્લોપીલિયા-“પ્રવચન મહોદધિ” (ભાગ-૧૮)

મુજબના) ઉત્તર આજના આગેવાનો તરફથી અપાય છે.

**સારી કળા, વિદ્યાર્થીની જેમ પ્રભુભક્તિનું જીવન લેવા દરેક હક્કાર છે :-**  
દીક્ષા-બીલ લાવનાર શ્રીયુત પટવારી કહે છે કે જૈનોને જ્યારે કોઈ બાબત આવે ત્યારે ‘ધર્મ ધોખામાં છે’ એવી ફરિયાદ કરવાની કુટેવ છે; પરંતુ આ તેમનું કથન યુક્તિ યુક્ત નથી. કેમકે પ્રજાના નાનાથી મોટો કોઈ પણ માણસને એમ ઈચ્છા થાય કે મારે અમુક કળા, અમુક પ્રમાણિક ધંધો, ઈત્યાદિમાં જોડાવું છે, તો તેમ કરવાનો તેને હક છે. એવી રીતે કોઈને એમ થાય કે મારે પાઈનીય મિલકત રાખ્યા વિના સાંસારિક સંબંધો છોડી કેવળ પ્રભુભક્તિ અને પરમાત્મ ધ્યાનમાં લીન થવું છે, તો તે તેમ કરવા હક્કાર ખરો કે નહિ ? ત્યાં આવા બીલના આકમણ વખતે થતી ‘ધર્મ ધોખામાં છે’ એવી હદ્યની જે બળતી લાગણી, તેને અવગણી કાયાના બળે પવિત્ર દીક્ષા અટકાવવાનું શું કારણ ત્યાં મળે છે ? નથી તો એ બાલદીક્ષિત સોસાયટીને બાધા પહોંચાડતો કે નથી એ રાજ્ય કે જન-કલ્યાણની આડે આવતો. ધ્રુવ, પ્રલાદ, શંકરાચાર્ય, વગેરે પર આવા પ્રતિબંધક હોત તો એ મહાન બનત ? તો આજે પણ શું મહાન સંતો પકવવાની જરૂર નથી ? આજે તો ચોમેર વિવિધ ગુના વધવાથી સંતોની વધારે જરૂર છે.

**યોગ અધ્યાત્મના આનંદની કલ્યાના ભોગમસ્તને ન આવી શકે :-**

બીલના બચાવમાં કહેવામાં આવે છે, ‘બચ્યાઓને દીક્ષા આખ્યા પછી એમનું જીવન દુઃખી થાય છે. એમની પાસે ધારીની જેમ કામ કરાવે છે.’ આ પ્રતિપાદન પણ વસ્તુસ્થિતિની અજ્ઞાનતા કે અપલાપને સૂચવી રહ્યું છે. કેમકે જૂના બાલ દીક્ષિતો આજે પણ ભર યુવાનીમાં આવીને સંયમી, બ્રહ્મચારી અને ત્યાગમય જીવનમાં સારા આગળ વખેલા છે; તેમજ શરીરે સશક્ત અને ખૂબ જ આનંદમાં મસ્ત મળે છે. આવી આવી કેટલીયે વજુદ વિનાની હકીકતો રજૂ કરીને શ્રી પટવારીજી જે બીલનું સમર્થન કરે છે, તેની અવાસ્તવિકતા સાબિત થાય છે. યોગ અને અધ્યાત્મના અવર્જનીય આનંદો અનુભવ ભોગ અને ભૌતિકતામાં સુખ માનનારને ક્યાંથી કલ્યાનમાંય ઉત્તરી શકે ? સાધુઓ શિષ્યોની પાસે ધારીની જેમ કામ કરાવે છે એવું અસત્ય, અશિષ્ટ અને દ્રેષ્ટભર્યું વચન સુજ્ઞ સભ્યના મુખમાંથી કેમ નીકળ્યું એ વિચારણીય છે. કેમકે સાધુઓ પાસે એવું કામ હોતું નથી કે જેથી ધારીની જરૂર પડે. બાકી શિષ્ય પોતાના ઉપકારી અને જ્ઞાનાદિગુણસપન્ન ગુર્વાદિક પત્રે કૃતજ્ઞતા, પૂજ્યતા તથા ગુણાનુરાગ દાખિથી ખૂબ સેવા કરવા ચાહે છે, પરંતુ એને માસુલી સેવા મળવાથી અસંતોષ રહે છે. આમાં ધારીનો આક્ષેપ જો લાગુ કરાય તો તો પછી ગરીબ પતિ માટે પત્ની, ગરીબ માતા-પિતા માટે પુત્ર, એ

બધા શું ઘાટી સમજવા ? મોટા સમ્રાટ રાજાઓને પણ વંદનીય એવા સાધુ ભગવંતો માટે આવું અધિકતું હલકું વચન કેમ જ બોલાય ?

**સમજ અને અંતરવૃત્તિ ભિન્ન છે :-**

કહે છે કે દીક્ષાધેલા ગૃહસ્થો પોતે દીક્ષા લેતા નથી અને પારકાના બચ્ચાઓને દીક્ષા અપાવવા આવે છે. આ યુક્તિ પણ બીલના સમર્થન માટે જરાયે સર્મથ નથી. કેમકે પારક બચ્ચા અને એના મા-બાપ બંને જો ખુશી હોય અને બચ્ચા ચારિત્ર (દીક્ષા) લે, તો એમાં બીજાઓ પોતાના બચ્ચાને છોડી અહીં મફતીયા સહાયક થતા આવે છે, એ દલીલ કાંઈ પેલાને દીક્ષા લેતો-લેવરાવતો અટકાવી શકે નહિં. વળી બીજાને દીક્ષા અપાવનારાએ પોતાના સંતાનોને પણ દીક્ષા અપાવ્યાના દાખલા આજે મોજુદ છે. પોતે દીક્ષા ન લઈ શકવાનું કારણ એ છે કે પોતાની તેવી પૂર્વ જીવનની પ્રબળ શુભ સાધના નથી, તેમજ અહીંયા હજુ વાસના ઉપર તેવો વિજય નથી એ છે. જ્ઞાન એટલે કે સમજવું, એ જુદી ચીજ છે; અને અંતરમાં વૃત્તિઓ શરીરી જવી એ જુદી વસ્તુ છે.

**વૈજ્ઞાનિક પ્રલોભનોમાં તો ધર્મ વધુ વ્યાપક બનાવવો જોઈએ :-**

હાઇકોર્ટના જજ ગજેન્ડર ગડકરના શર્જદો ‘હિન્દુધર્મની જૂની કલ્યનાઓ વર્તમાન વિજ્ઞાને બદલી નાખી છે’ લઈને બાલદીક્ષાનું ધોરણ બદલવું જોઈએ, એવું બીલના સમર્થન માટેનું કથન પણ યુક્તિ બાબ્ય છે, કેમકે વિજ્ઞાને જૈન ધર્મની આરાધના અને કલ્યનામાં કાંઈ જ ફરક પાડ્યો નથી. મન બગાડનારા ચલચિત્રો ન જોવાં, હોટલોમાં ન રખડવું, અશ્રીલ ગાયનો ન સાંભળવાં, તીર્થના પર્વત ઉપર શક્યતાએ પગેથી ચઢવું, ઉપવાસાદિ તપશ્ચિય યથાશક્તિ કરવી, વગેરે પૂર્વની જેમ જ ચાલુ છે. નરનારીના અન્યોન્ય નિકટ સંપર્કના યુગમાં પણ સ્ત્રીને શેક હેન્ડ (Snake hand) તો શું પણ રૂપની દાખિએ પણ જોવી નહીં, હત્યાદિ પ્રાચીન નિયમો આજે કેટલાયે જૈનો પાળે છે. પછી ત્યાં દીક્ષાનો ધર્મ બદલવાની જરૂર શી ? ઊલદું હિસાદી પાપો અને અધિક વૈજ્ઞાનિક પ્રલોભનોમાં ધર્મને વધારે કડક અને વ્યાપક બનાવવો જોઈએ. હા, બાલદીક્ષાએ સમાજને નુકશાન પહોંચાડવું હોય તો એનું ધોરણ બદલવાની વાત વિચારનીય ગણાત. બાકી ‘વિજ્ઞાને જૂની કલ્યનાઓ બદલી’ એ દલીલ લગાડવી હોય તો તો સાંસારિક જીવનમાં સગીર હોય ત્યાં સુધી નિશાળે ન મૂકવો, દુકાને ન બેસાડવો, હાથમાં પૈસો ન દેવો, વગેરે ધોરણ ઊભા કરવા જોઈશે !

**દેશ-કાળ જોવાનાં તે ધર્મની પુષ્ટિ માટે :-**

કહે છે, “જૈનો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને મહત્વ આપે છે, તો આ

વિષયમાં એનો વિચાર કેમ નથી કરતા ?” આનો સીધો ઉત્તર એ છે કે જૈનો દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને જોવાનું કહે છે. તે ધર્મની વધુ પુષ્ટિ અને રક્ષા અર્થે; પણ નહિં કે ધર્મના તથા સંસ્થાના વિધાત અર્થે. દુનિયામાં પણ કેળવણી સંસ્થાઓ, વેપારી સંસ્થાઓ, વગેરે સૌ કોઈ પોતાના દેશકાળને પોતાના મિશનને બાધ ન પડાંયે તથા પુષ્ટિ મળે એ માટે જુએ છે. બાકી દેશકાળ ફર્યો છે એટલે બધું જ ફરવી નાખવું એવો મેનીયા જો ધારણ કરાય, તો તો સદાચાર, નીતિ, શિષ્ટાચાર વગેરેના ધોરણ બદલી નાખવા પડશે. અલબત આજના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની દાખિએ બાલદીક્ષા પૂર્વે એ જોવાય છે કે આજના નવા રોગો વગેરેથી બાળક પીડિત નથી ન ? બાળક કોઈ કુટેવોનો ભોગી નથી બન્યો ને ? હત્યાદિ.

**ઈતિહાસની અનભિજનતા :-**

બીલ રજૂ કરતાં માનનીય સભ્ય કહે છે, ‘શંકરાચાર્ય અને હેમચંદ્રાચાર્ય બાલદીક્ષા લીધી તે અપવાદ છે.’ આ કથન પણ શાસ્ત્ર અને ઈતિહાસની અનભિજનતા સૂચવી રહ્યું છે કેમકે જૈનોમાં શ્રી જંબુસ્વામી, શ્રી અર્થમુત્તાકુમાર મહામુનિ, શ્રી વજસ્વામીજી, શ્રી બખ્યભદ્રી આચાર્ય મં, શ્રી મુનિયંદ્રસૂરિજી મં, શ્રી આત્મારામજી મં, વિજયનેમિસૂરિજી મં, વિજયપ્રેમસૂરિજી મહારાજ, વિજયરામયંદ્રસૂરિ મહારાજ, વગેરે અનેકાનેક સગીર દીક્ષિતો જુના કાળથી આજ સુધી થતા આવ્યા છે; અને એવાઓએ હજારો ભવ્ય જીવોને સારા નાગરિક, સંયમી, સદાચારી અને પરોપકારી બનાવ્યા છે. એ કાર્ય પણ સ્વેચ્છાથી, કાંઈ પણ મહેનતાણું લીધા વિના, અને કોઈ પણ રાજદ્વારી હોદ્દો સ્વીકાર્યા વિના બજાવે છે.

બીલ જૈનો માટે જ લાવવામાં આવ્યું છે :- કહે છે કે આ બીલ એકલા જૈનો માટે નથી, બધા માટે છે; પરંતુ જ્યારે જૈનોની બાલ-દીક્ષા પોતાના આત્માને મહાન કલ્યાણ સાધવા સાથે બીજા અનેકને હિત માર્ગ દોરનારી હોવાનું જો કબુલ છે, તો બીલમાંથી જૈનોને બાકાત કેમ ન રાખ્યા ? બાકી બીલ લાવનાર માનવંતા સભ્ય વીણી વીણીને અરુચિઓ જૈન દીક્ષા પ્રયોગ કરતાવે છે. પોતાના ભાષણમાં ૫૦-૧૦૦ વખત “જૈનો” “જૈનો” શબ્દ વાપરે છે. એ સૂચવે છે કે બીલ મૂકતાં એમની નજર સામે જૈન દીક્ષા જ છે. બે ત્રણ કોડની મોટી વસ્તીમાં એ લધુમતી કોમમાં થતી અલ્પ બાલદીક્ષાના પર કુઠારાધાત માટે લવાતા આ કાયદાને લધુમતી સંરક્ષક ગણી સરકાર જરૂર એના નજન સ્વરૂપે ઓળખી લેશે, અને એને આજથી જ રદ કરશે, અગર ચચને અંતે માન્ય નહિં જ કરે, એવો અમે વિશ્વાસ રાખીએ છીએ.

તीર्थकરोએ કર્યું તે નહીં પણ કહ્યું તે કરવાનું :- વળી ભગવાન મહાવીરદેવે ત્રીસ વર્ષે દીક્ષા લીધી, એવો દાખલો મૂકીને આપણા માનવંતા સભ્ય “ત્રીસ વર્ષે દરેકે દીક્ષા લેવી” એવું જાણે નક્કી કરાવી રહ્યા છે. ખરી રીતે જૈન ધર્મમાં તીર્થકરોએ કર્યું તે બીજાએ કરવાનું નથી, પણ એમણે કહ્યું તે બીજાએ કરવાનું છે. નહિતર ઉપર ગણાવેલા બાલદીક્ષિત મહાન જૈનાચાર્યો મૂળમાં જ અપ્રમાણિક ઠરે. ત્યારે બાળદીક્ષાથી બાળકોનું “એક્સપ્લોઈટેશન” (શોખણ) થવાની દલીલ માત્ર ભૌતિક દાખિને સૂચવી રહી છે. જ્યાં બાળક સ્વેચ્છાથી સત્ય, સદાચાર, સંયમ, ત્યાગ વગેરેના માર્ગ ચેદે છે, અને જ્યાં માનવભવની સફળતા વિષયસુખોથી બચી મહાનયોગી બનવામાં છે, ત્યાં પછી બાળપણથી એનો અભ્યાસ એ એક્સપ્લોઈટેશન (શોખણ) નહિ પણ સ્પીરીચ્યુઅલ અપલીફ્ટ (આધ્યાત્મિક ઉન્નતિ) છે.

પરીક્ષા માટે દરવાજા ખુલ્લા છે :- શ્રી પટવારી કહે છે, “પૂનાના ઉપાશ્રયમાં બાલદીક્ષિતોને ખુણામાં લઈ જઈ વાત કરો તો તેનું અનિષ્ટ સમજાશે.” તે કથન તદ્દન અસત્ય છે. પરીક્ષા કરવી હોય તો દરવાજા ખુલ્લા છે. કેટલાકોએ પરીક્ષા કરી પણ છે. વળી પૈસા માટે મા-બાપ છોકરાને દીક્ષા અપાવે છે એવો કુતર્ક પોકળ છે કેમકે દીક્ષાની કપરી ચર્ચા અને મનોનિગ્રહમાં બાળક અનિષ્ટાએ ક્યાં સુધી ટકી શકે ?

સાધુથી ગૃહસ્થની ભક્તિ ન કરાય :- બાકી સગીરને સાથે રાખી ભજાવો, દીક્ષા મોટો થાય પછી આપજો. એમ કહેવામાં આવે છે ત્યાં ખાસ સમજવાનું એ છે કે સાધુજીવન માટે જ્ઞાન ઉપરાંત વર્તનનો પણ જીવનમાં આનુભવિક અભ્યાસ કરવાનો હોય છે. જીવ જીતુની રક્ષા અર્થે નીચે જોઈને ચાલવું, વચન નિષ્પાપ બોલવું, માથે પ્રતિજ્ઞાનો ભાર રાખી અહિસા, અપરિગ્રહ વગેરેને મનમાં પરિણાત કરવા, ઈત્યાદિ આત્મસાત્ત્વ કરવાનું દીક્ષિત થઈને જ બની શકે. વળી સાધુની પોતાની સાધુમયર્દિઓ એવી હોય છે કે પોતાનું દરેક ટંકનું ભોજન પણ માધુકરી વૃત્તિથી કેટલાય ઘરોમાંથી માગી લાવીને કરવાનું હોય છે. સાધુથી ગૃહસ્થની ભોજનભક્તિ કે બીજી સેવાભક્તિ કરી શકતી નથી. આચાર વિચારના શાસ્ત્ર સાધુને જ ભજાવી શકાય છે, વગેરે વગેરે કારણે સગીરને ગૃહસ્થ તરીકે પાસે રાખી કેળવવાનું શું બની શકે ?

બીલ લાવનાર મહાનુભાવને સંભતિ આવો એવું ઈચ્છી મારું વક્તવ્ય સમાપ્ત કરું છું.

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદધિ”

વર્ષ-૪, અંક-૧૧, તા. ૨૬-૧૧-૧૯૫૫



## સ્થાનકવાસી કોન્ફરન્સના મંત્રી શ્રી ખીમચંદ મગનલાલ વોરાનું નિવેદન જનતાને અવળે રસ્તે દોરનારું છે

તા. ૧૯-૧૦-૫૫ના મુંબઈ સમાચારમાં મુંબઈ રાજ્ય વિધાન પરિષદમાં રજૂ થયેલ બાલદીક્ષા પ્રતિબંધક બીલ અંગે ઓ.ઈ. શેતાંબર સ્થાનકવાસી જૈન કોન્ફરન્સના માનદ મંત્રી ખીમચંદ મગનલાલ વોરાનું એક નિવેદન પ્રગત થયેલું છે. તેમાં કેટલીક હકીકતો એવી રીતે રજૂ થયેલી છે કે જેથી જનતા અવળા માર્ગ દોરાય, તેથી આ લેખ લખવાની જરૂર પડેલી છે.

(૧) અમદાવાદ મુકામે વિ.સં. ૧૯૮૦માં અધિલ ભારતવર્ષાય જૈન શેતાંબર મૂર્તિપૂજક મુનિઓનું સંમેલન મળ્યું હતું. તેમાં સર્વાનુભતે એવો ઠરાવ કર્યો હતો કે ધર્મમાં બાધાકારી રાજ્યસત્તાના પ્રવેશને આ સંમેલન અયોગ્ય માને છે, અને તે અનુસાર આજે મૂર્તિપૂજક સમાજના બાવને બાવન આચાર્યનો આ વિધેયની સામે પ્રબળ વિરોધ છે, ભારતવર્ષના એક છેઉથી બીજા છેડા સુધી વ્યાપેલા જૈન શેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયના સંધો અને સંસ્થાઓ તેનો પ્રબળ વિરોધ કરી રહી છે.

(૨) શેતાંબર તેરાપંથી સંપ્રદાય પણ ધર્મમાં બાધાકારી રાજ્યસત્તાના પ્રવેશને બાધાકારી માને છે, અને તેથી આ બીલનો સખત વિરોધ કરે છે.

(૩) દીગમ્ભર સમાજ પણ ધર્મમાં રાજ્યસત્તાના પ્રવેશને અયોગ્ય માને છે.

(૪) બાકી રહ્યો સ્થાનકવાસી સમાજ. તે ધર્મમાં રાજ્યસત્તાની દખલગીરીને આવકારતો હોય તેમ માનવાનું કારણ નથી. કલકત્તામાં બીલના વિરોધ અંગે હમણાં જ જાહેર સભા થઈ, તેમાં શેતાંબર મૂર્તિપૂજકો, સ્થાનકવાસીઓ અને તેરાપંથીઓ ત્રણે સામેલ હતા. વળી અનેક સ્થળોએ સ્થાનકવાસી ભાઈઓએ આ બીલની વિરોધમાં સહીઓ કરેલી છે અને આજે પણ કરી રહ્યા છે. એટલે સામાન્ય જૈન જનતાનું માનસ શું છે, તે તો સ્પષ્ટ રીતે સમજ શકાય તેવું છે.


(૫) સ્થાનકવાસી જૈન કોન્ફરન્સના મંત્રી ભારતવર્ષની ૨૦ લાખની જન જનતામાંથી ગીજા ભાગના જૈનોનું પ્રતિનિધિત્વ ધરાવવાનો જે દાવો કરે છે, તે પોકળ છે. કારણ કે પ્રથમ તો તેમની તેટલી વસ્તી જ નથી અને દલીલની ખાતર

માની લઈએ કે તેમની તેટલી વસ્તી છે, તો પણ સ્થાનકવાસી કોન્ફરન્સ સમસ્ત સ્થાનકવાસી સમાજનું પ્રતિનિધિત્વ ધરાવતી નથી. આજે ઘણા સ્થાનકવાસી પૂજ્ય સાધુ મુનિરાજો અને તેમના પગલે ચાલનારા ધર્મશ્રદ્ધાળું સ્થાનકવાસી ભાઈઓ સ્થાનકવાસી કોન્ફરન્સની પ્રવૃત્તિમાં કેટલાક અંશે જરૂરાદની છાયા જુએ છે અને તેથી તેનું વર્ચસ્વ સ્વીકારવા તૈયાર નથી.

(૬) સ્થાનકવાસી કોન્ફરન્સના મંત્રી શ્રી ખીમચંદ વોરાએ મદ્રાસ ખાતે મળેલા અગિયારમા અધિવેશનના જે ઠરાવનો હવાલો આપ્યો છે, તે ઠરાવનો અર્થ બાલદીક્ષા પર સંદર્ભ મૂકવાનો નથી, પણ બાળવયમાં જે આત્માઓ તે પ્રકારની યોગ્યતા ધરાવતા હોય તેની ખાતરી કરીને દીક્ષા આપવાનો છે અને તે માટે જ પ્રમુખને ખાસ સત્તા આપેલી છે. એટલે સ્થાનકવાસી કોન્ફરન્સના અગ્રણીઓને આ બીલનું સમર્થન કરવાનું કોઈ કારણ રહેતું નથી.

જ્યાં વ્યવસ્થા છે, નિયમન છે, અને તેનું પાલન થાય છે, ત્યાં સરકારની બિનજરૂરી દખલગીરી કરનારું બીલ લાવવું એ ખરેખર બેદજનક છે અને તેને વગર વિચાર્ય ટેકો આપવો, અથવા ટેકો છે તેવું દેખાય તે માટે બહાર પડવું એ તેથી પણ વધારે બેદજનક છે.

મારી તમામ સ્થાનકવાસી સાધુ મુનિરાજોને તથા ધર્મપ્રેમી ગૃહસ્થોને વિનંતિ છે કે તેઓ ધર્મમાં બાધાકારી આ બીલનો સખત વિરોધ કરે અને કેન્દ્ર સમાજના બાકીના ત્રણે ફીરકાઓ સાથે હાથમાં હાથ મીલાવીને કામ કરે. એક બાજુ તમામ ફીરકાઓ સાથે સંગઠનની વાત કરવી અને બીજી બાજુ બધા ફીરકાઓથી જુદા પડી કુહાડાના હાથા જેવું કામ કરવું એ સ્થાનકવાસી કોન્ફરન્સ મંત્રી મહાશય કે તેમના સાથીઓ માટે શું યોગ્ય છે ?



"દિવ્ય-દર્શન"-“પ્રવચન મહોદધિ”

વર્ષ-૪, અંક-૧૨, તા. ૩-૧૨-૧૯૫૫



## સંન્યાસ દીક્ષા જેવી પવિત્ર ધાર્મિક બાબતમાં હસ્તક્ષેપ કરતો શ્રી પટવારીનો કાયદા ખરડો

મુંબઈ ધારાસભામાં રજૂ કરવામાં આવેલ પ્રસ્તુત ખરડો ભારતીય સંસ્કૃતિના મૂળમાં ધા કરે છે અને યુગ જૂના અમૂલ્ય આધ્યાત્મિક તત્ત્વો કે જે કરોડો માણસોને ખૂબ પ્રિય બનતા આવ્યા છે એને ધક્કો પહોંચાડે છે. શાસ્ત્રોએ જે સિદ્ધાંતને સંમતિ આપી છે, અને કરોડો માનવોએ જેને શ્રદ્ધાનો વિષય બનાવ્યો છે, એ ધાર્મિક સિદ્ધાંતને ઉદેડી નાખવાની કેવી સચોટ ધારણા !

ભારતીય ધર્મો અને ભારતીય સંસ્કૃતિ મુખ્યપણે જન્મ-જન્માંતરમાં પ્રવાસ કરતા અલગ આત્મતત્ત્વની માન્યતા ઉપર રચાયા છે. વૃક્ષ, કીટ, પશુપંખી, વગેરે યોનિઓમાં રખડતો આત્મા અનંતાયુગ વીત્યે કોઈ મહાન સદ્ગુરૂએ મનુષ્ય જેવી ઉમદા યોનિમાં જન્મ પામે છે; પણ એ જો કીટ-પશુ-પંખીની જેમ શદ્ધાદિ વિષય, પરિગ્રહ, આદાર અને નિદ્રાની સંજ્ઞાઓની તથા કામ-કોધ-લોભાદિની જીવનચર્યા અને ધોરણો રાખે તો પાછો પૂર્વની જેમ શ્રીયાદિ હલકી યોનિઓમાં ભટકતો થઈ જાય છે. માટે જ આત્માને એવા નિરાધાર દુઃખદ પરિબમણથી બચાવી લેવા માટે ઉત્તમ એવા મનુષ્ય જન્મમાં એ વિષયાદિ સંજ્ઞાઓની વિવશતા ઓછી કરી નાંખવી જોઈએ. સંયમ, સદાચાર, સહિષ્ણુતા, વિશ્વવાત્સલ્ય, પરોપકાર, ઈન્દ્રિયનિગ્રહ, કષાયજ્ય વગેરેને જીવનમાં સર્વાંશે અગર મુખ્યાંશે સ્થાન આપવું જોઈએ. જેથી કમશા: સંસારનાં બંધનોથી છૂટી, આત્મા પરમપદ સત્ત્ર-ચિત્ર-આનંદમય મોક્ષને પામે. આ થઈ પર જન્મની વાત.

(૨) આ જન્મમાં પણ એ છે કે માણસ પશુ કે રાક્ષસ હદ્યનો ન બની જાય એ માટે પણ આ સંયમાદિની જરૂર છે. એથી એ સાચો માનવ બની જતાને અને જગતને માટે આશીર્વાદભૂત બને છે. આધ્યાત્મિકતાના પાયા ઉપર રચાયેલી સંસ્કૃતિ અને ધર્મના કલ્યાણ-ઉદેશ આ છે : આ ઉદેશ સિદ્ધ કરવામાં ઉપયોગી એવા-સંયમ-સદાચારના માર્ગ જો કોઈ ચાહીને જતો હોય, એમાં એનું શોષણ કેવી રીતે કહેવાય ? કેમકે સંન્યાસ દીક્ષાનું જીવન સ્વીકારી મહાન સંયમી-સદાચારી બનનારો પોતાને અહીં કરતાં કોઈ ગુણો મહાન આધ્યાત્મિક આનંદ અનુભવાવે છે અને

પરભવે દુર્ગતિ બ્રમજ મિટાવી સદ્ગતિના પ્રબળ પુણ્ય અને અપૂર્વ આત્મોન્નતિ અર્પે છે. આ તો થઈ વ્યક્તિની દણિએ વિચારણા.

હવે સમાજની દણિથી જુઓ.

(૩) આજે પ્રજામાં નેતિક ધોરણ બહુ નીચું ઉત્તરી ગયું છે. નાના-મોટા પરોપકારના પ્રકારો ભૂલાતા જાય છે. સ્વાર્થિતા વિરાટ સ્વરૂપ લે છે. સંયમ-સદાચારની મર્યાદાઓના લોપ થતા દેખાય છે. સહિષ્ણુતા લોપાઈ કલેશ-કંકાસ વધ્યા છે. કોર્ટ-કાયદાઓ અને વ્યવસ્થાપક પોલીસ ખૂબ વધારવી પડી છે. છતાં ગુનાનું પ્રમાણ ઘટ્યું નથી; વધ્યું છે. કેવું આશર્ય ! બીજુ બાજુ સુરાજયના સ્વખની સિદ્ધ કરવી છે. સર્વોદયનો વ્યાપક પ્રચાર કરવો છે. સંસ્કારી નવસમાજનું નિર્માણ કરવું છે. સંસ્કૃતિના ઉત્થાન... વગેરે કેઈ વાતો સિદ્ધ કરવી અભિલષિત છે. આ બધું કાર્ય, સર્વોશે ભોગ આપીને તેમજ પોતાનું જીવન આદર્શ બનાવીને અસરકારક રીતે કોણ કરશે ? એ એક આજનો જટિલ પ્રશ્ન છે.

પૂર્વે તો ઋષિ-મહર્ષિઓ, પરમાર્થી તીર્થકરદેવો, સાધુ-સંતો અને શ્રમજી ભગવંતોએ ભારતીય સંસ્કૃતિને વિશ્વમાં સર્વોચ્ચ કક્ષાએ અવસ્થિત કરી હતી. એના જ પ્રતાપે ભારતમાં નીતિ-સદાચારની સર્વજન વ્યાપિતા હતી. લોકને અતિથિસત્કાર અને પરમાર્થ-પરોપકારના સ્વભાવ ઘઢાઈને સંપ, શાંતિ અને સધાનુભૂતિ તથા રામરાજ્યના નિર્માણ સુલભ બન્યા હતા, તેમ આજે પણ ભલે અલ્ય સંખ્યામાં ય સાચા સાધુ-સંત અને શ્રમજી-મહાત્માઓ સંસાર ત્યજ્ઞને ઉચ્ચ અહિસા, સત્ય, અપરિગ્રહ વગેરેના જીવન સ્વયં જીવતાં જીવતાં જનસમાજને સત્ય-નીતિ-સદાચાર-પરોપકાર વગેરેના ભવ્ય ઉપદેશ અને વિશેષ પ્રેરણા આપી રહ્યા છે. જેના જીવનમાં મોહના સંબંધ તથા ભાર નથી, સંપૂર્ણ ભોગત્યાગ અને નિઃસ્વાર્થવૃત્તિ છે, હદ્ય વિશ્વવાત્સલ્ય અને પરોપકારથી છલકાતા છે. એ જગતને અહિસા, સત્ય, નીતિ, સદાચાર હોંશે હોંશે પાઈ શકશે. તેવું બીજો કોણ કરવા સમર્થ છે ? તેમ જગત બીજા કોનું જટ જીવશે ?

બેદની વાત છે કે આવા મહાન સ્વોપકાર-પરોપકારના સાધક સર્વત્યાગ અને મહાસંયમ-સદાચારમય સંન્યાસ-દીક્ષાના પવિત્રતમ માર્ગ ઉપર કાયદા દ્વારા આકમજ કરવા અમદાવાદના વડ્કિલ શ્રી પ્રભુદાસ પટવારી તૈયાર થાય છે. આશર્ય તો એ છે કે જગતમાં ચોરી-લૂટફાટ, મારપીટ, વ્યભિયાર, વિશ્વાસધાત વગેરે અટકાવવાના ઉદેશથી અને સત્ય-નીતિ, અહિસા, સંયમ, સદાચાર વગેરે વિકસાવવાની શુભભાવનાથી સમાજ સુધારક કાયદા ઘડે; પણ આ સમાજસુધારક(!) શ્રી પટવારી અઠાર વર્ષની વય સુધીના શાખસને અહિસા, સત્ય, સદાચાર વગેરેનું જીવન સ્વીકારતો

અટકાવવા માટે કાયદો કરાવવા કમર કસીને તૈયાર થયા છે. એટલું જ નહિ પણ મા-બાપ અને સાધુ-પુરુષને એના એવા અહિસા, સત્યાદિનું જીવન લેવામાં સહાયક થવા માટે ત્રણ મહિના જેલમાં ખોસાવી દેવાની પણ જોગવાઈ કરાવી રહ્યા છે. પશુતા સાથે માનવતાની આ કઈ વિશેષતા કે જ્યાં મહા-સદાચારી સંત બનતા અટકાવવાય ?

આજે જ્યારે દેશને સંસ્કારી નવસમાજના સર્જનની, સર્વોદયની સિદ્ધાંતોના વ્યાપક પ્રચારની, માનવતાના ઉત્કર્ષની અને અહિસા પ્રધાન જીવનની અત્યંત આવશ્યકતા છે, ત્યારે સમજવું જોઈએ કે એ બધું કરવામાં વિશેષ પ્રેરક તો નાની વયથી સારા ઘડાયેલા સંસારત્યાગી સંતપુરુષો બને છે. સંત બનનારા અને વિશ્વમાં પવિત્રતા પ્રચારનારા સંતોનો પાક વધે એવી યોજના કરવાથી દેશસેવા, સમાજસેવા અને માનવતાની સેવા થાય છે. એના બદલે એવા પવિત્ર સંતો બનતા અટકાવવાનો બળાત્કાર કરવો એમાં તો અમને દેશદ્રોહ, સમાજદ્રોહ અને માનવતાનો દ્રોહ કરવા સરખું લાગે છે.

કહે છે, “સાધુ ન બનાવો, પાસે રાખી શિક્ષણ આપો,” પણ એ સમજવાનું છે, કે અહિસા-સત્ય-સંયમ-બ્રહ્મચર્ય વગેરે ગુણોનું જીવન એ માત્ર શિક્ષણની (Educational) વસ્તુ નથી, પણ સંસ્કરણ અને અભ્યાસની (Inculcational and practical) વસ્તુ છે. સૂક્ષ્મ અહિસા શું, મહા સદાચાર શું, ઈત્યાદિનું જ્ઞાન જુદી વસ્તુ છે, અને તેનું અચૂક પાલન જુદી ચીજ છે. સાધુપણાનો વેશ અને જીવન વિના એ પાલન શક્ય નથી. સાધુજીવન હોય તો મહાસદાચાર-સંયમ-અહિસા-સત્ય, અપરિગ્રહ વગેરેના સતત પાલન થવાથી એના સંસ્કાર મજબૂત બને છે અને કૂમળા છોડની જેમ નાની વયથી આત્માનું એવું ઘડતર અને સંસ્કરણ વધુ સરળ અને સાદું બને છે.

સમાપ્ત.

### બાળ સંન્યાસ દીક્ષા પ્રતિબંધક બીલ બાળકોને ભયંકર અન્યાય કરે છે.

સગીર એટલે-બધી બાબતોમાં અણસમજુ-એ ઘ્યાલ ખોટો છે.  
(શ્રી ચીમનલાલ કેશવલાલ કરીયા. મંત્રી ધી યંગમેન્સ જૈન સોસાયટી.)

શ્રી પટવારીએ મુંબઈ ધારાસભામાં રજૂ કરેલું બાળ સં. દીક્ષા પ્રતિબંધક બીલ લોકમત માટે ગેજેટમાં પ્રગટ થયું છે. સરકાર જ્યારે આ બીલ ઉપર પ્રજાને અભિપ્રાય જણાવવા આખ્યાહન કરે છે ત્યારે ભારતના સંસ્કૃતિપ્રેમી સૌ કોઈની

ફરજ થઈ પડે છે, કે ધર્મમાં હસ્તક્ષેપ કરનાર આ બીલનો વિરોધ કરે. આ બીલ રજુ કરનાર શ્રી પટવારી તેમનો આ પ્રયત્ન બાળકના હિતનો ગણાવે છે, પરંતુ આપણા અનુભવને નજર સામે રાખી વિચારીએ તો જણાશે, કે સગીરને બધી બાબતોમાં તદ્દન અણસમજુ માની લેવાની ભૂમિકા નિરાધાર યા તો ખોટી છે. ચૌદ્દ-પંદર વર્ષની ઉમરે મેટ્રિક પાસ થનાર સગીર ગણાય એથી શું એ બાળક છે એમ કહેશો ! અને એ મેટ્રિક સુધી પાસ થનાર કેળવાયેલો યુવક એના ભાવિના સારાસારનો કંઈ જ વિચાર કરી શકે તેમ નથી-એમ કોઈ કહે તો તેને કોણ માનશે ? આ બાળ સં. દીક્ષા પ્રતિબંધક બીલ ધારાસભામાં રજુ થયું તે પ્રસંગે આપણા મુંબઈ પ્રાંતના પંતપ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈએ ખૂબ વિદ્વત્તપૂર્ણ પ્રવચન આપ્યું હતું. સરકાર તરફથી આ ભાષણ પ્રગટ કરવામાં આવ્યું છે. શ્રી મોરારજીભાઈએ આ બીલના ઘણા મુદ્દાઓ તેમના ભાષણમાં ચર્ચા છે અને તેનો ઉકેલ આપ્યો છે. જેઓ તટસ્થ છે અને સગીરોના સાચા હિતચિંતકો છે તેવાઓને તો આ ભાષણે વિચાર કરતા કરી દીધા છે. તેઓ સગીરની સમજદારી બાબતમાં જણાવે છે, “એક સગીર પણ આપણા જેવા માણસો કરતાં વધારે વિશાળ બુદ્ધિ ધરાવી શકે છે. આ બાબત પૂર્વ કર્મને આધીન છે, તે આપણે ભૂલવું ન જોઈએ.” જેઓ ઉમરની સાથે જ સમજ, ડહાપણ અને બુદ્ધિના વિકાસને જોડવાની જડતવાળા છે તેઓ આ ઉપર વિચાર કરશે. વળી જેઓ અત્ર મોટી ઉમરના છીએ માટે વધારે સમજવાળા છીએ એવું અભિમાન રાખનારને શ્રી મોરારજીભાઈના ભાષણમાંથી સરસ અનુભવપાઠ મળી આવે તેમ છે. તેઓ કહે છે, “આપણે એમ નહિ માનવું જોઈએ કે આપણે વધારે વરસ કાઢવા તેથી આપણે વધુ રાખ્યા છીએ, ઊલટું જેમ જેમ આપણે મોટા થતા જઈએ છીએ તેમ તેમ કદાચ આપણે ઓછા રાખ્યા બનતા હોઈએ છીએ.” આગળ ચાલતાં તેઓશ્રી કહે છે, “જો આધ્યાત્મિક બાબતમાં આપણે લોકોને કોઈ પણ રીતે સ્વાતંત્ર્ય ન આપીએ તો પછી સ્વતંત્રતા ક્યાં રહેશે ? પૂર્વજન્મ અને પુનર્જન્મ, પુણ્ય અને પાપ અને સારા-માઠા કર્મને માનનાર કોઈ પણ ભારતવાસી પૂર્વના સંસ્કારથી દીક્ષા યાને સદાચારના માર્ગ જતાં ૧૮ વર્ષથી ઓછી ઉમરવાળાને માત્ર તે સગીર છે માટે અણસમજુ છે, એમ માનીને રોકવાની હિમાયત કરે-તો એ સગીરને ભયંકર અન્યાય કરનાડું કૃત્ય છે.” માટે જ શ્રી પટવારીના આ સં. દીક્ષા પ્રતિબંધક વિધેયના વિરોધમાં અનેક સ્થળોએથી અવાજ ઉઠ્યો છે, પરંતુ હજુ એ અવાજ જોઈએ તેટલો પ્રયંક બન્યો નથી. જેઓ હજુ બેદરકારી સેવી રખ્યા છે તેઓએ જાગૃત થઈને લોકશાહીના આ કાળમાં સં. દીક્ષા પ્રતિબંધક વિધેય વિરોધ સમિતિ-મુંબઈ અને ધી યંગ મેન્સ ઝૈન સોસાયટી-

અમદાવાદનો પત્રથી યા રૂબરૂ સંપર્ક સાધવો.

બાળ સં. દીક્ષાના હિમાયતીઓને વગોવવા માટે આ બીલની તરફદારી કરનારાઓ તરફથી નસાડવા, ભગાડવા, સંતાડવા, વેચાતી લેવા વગેરે પ્રકારની અનેક કપોલકલ્પિત વાતો વહેતી કરવામાં આવી છે. છેલ્લાં ૨૭ વર્ષથી હું ધાર્મિક અને સામાજિક કાર્યોમાં મારી શક્તિ પ્રમાણે રસ લઉં છું, તેથી મારી જાણ મુજબની અને આધારભૂત હકીકોથી જણાવી શકું છું કે- દીક્ષાના વિરોધીઓના ઉપરોક્ત વિધાનો અતિશયોક્તિવાળાં અને સત્યથી વેગળાં છે. બાળદીક્ષા બંધ કરાવવા માટે આકાશ-પાતાળ એક કરનારો વર્ગ જો કોઈ સાધુએ કોઈ સગીરને માતા-પિતા કે વાલીની સંમતિ વિના દીક્ષા આપી હોત કે નસાડ્યો-ભગાડ્યો હોત તો-એ સાધુ ઉપર કેસ કરીને તેને જેલમાં ધકેલ્યા સિવાય એ વર્ગ જંખ્યો હોત !!! હજુ સુધી આવા ગુન્હા માટે કોઈ સાધુને શિક્ષા થઈ નથી. જાહેર પ્રજાએ આ દીવા જેવી હકીકિત શાંત ચિત્તે વિચારવાની જરૂર છે. દીક્ષાના વિરોધીઓએ આજના જમાનાના પ્રેસ અને પ્લેટફોર્મના સાધનથી ભાગવતી દીક્ષાની બાબતમાં એટલો બધો ઘોંઘાટ બ્રિટિશરોના અને રાજાઓના સમયમાં ફેલાવી દીધો છે કે-આપણને સ્વરાજ્ય મળ્યે સાત-સાત વર્ષ થયાં છતાં યે તેના પડ્યા અને અસર હજુ સામાન્ય પ્રજામાંથી ભૂસાયા નથી. પરંતુ હવે પેલા અજ્ઞાન ગોરા અવિકારીઓ નથી કે કાચા કાનના મનસ્વી રાજાઓ રહ્યા નથી કે જેથી ખોટી બૂમરાણ કરનારા વડોદરામાં ફાયા હતા તેમ આ સરકારમાં ફાવી જાય ! મારા જત અનુભવથી અને વિશ્વાસપાત્ર પુરાવાઓ સાથે કહેવાની મને હિમત છે કે-દીક્ષાના વિરોધીઓએ પૂ. સાધુઓને અને દીક્ષાથીઓને રંજાડવા માટે મોટી ઉમરે દીક્ષા લેનારાને નાની ઉમરના સગીર જણાવીને કોઈમાં કેસો કર્યા છે, પોલીસને ગમે તે રીતે અવળે માર્ગ ચડાવીને પૂ. સાધુઓને બેચીઓ પહેરાવી બજારમાં ફરવ્યા છે, કંઈકના દૂરના સગાંઓને ચઢાવીને દીક્ષાની અને પૂ. શ્રમણોની ફજેતી વર્તમાનપત્રોમાં કરી છે. આ બધાં કુકૃત્યોમાં તેઓ પાછા પડ્યા છે. આ સિવાયનાં એટલાં અનિચ્છનીય કાર્યો તેઓના તરફથી થયાં છે કે જે રજુ કરવાનો સમય આવે સરકારમાં અને જાહેર પ્રજા સમક્ષ રજુ થશે જ અને સૂજી પ્રજા સમજ શક્શે કે સત્ય શું હતું ? અને છે ? પૂર્ણ.

### ● બાલ દીક્ષા વિરોધ બીલની અપ્રમાણિકતા. ●

લેખક:- પં. પ્રજલાલ વાલજી ઉપાધ્યાય, વેદાન્ત શાસ્ત્રી ફર્સ્ટ કલાસ, વેદાન્તાચાર્ય ફાઈનલ, સહમંત્રી સૌરાષ્ટ્ર વિદ્તપરિષદ, પ્રાધ્યાપક શ્રમણ સંસ્કૃત વિદ્યાલય. શાંતિભુવન, જામનગરથી લખે છે કે-

અ, મનુષ્ય સંન્યાસ દીક્ષાનો અધિકારી છે કે નહીં ? જો નથી... તો... તો... ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિનો સૂર્ય સદાને માટે આથમી ગયો જ માનવો રહ્યો ?

ब, જો અધિકારી છે તો પ્રશ્ન ઉठે છે કે-બાળક સંન્યાસનો અધિકારી કિંવા નહીં ? યુવાન અધિકારી છે કિંવા નહીં ? પ્રોઠ અધિકારી છે કિંવા નહીં ? વૃદ્ધ અધિકારી છે કિંવા નહીં ?

‘બાળક સિવાય કોઈ પણ વ્યક્તિ સંન્યાસ દીક્ષાનો અધિકારી બની શકે છે.’ આવો જવાબ પણ બુદ્ધિરૂપ શરાણ ઉપર કુન્દન નીવડી શકતો નથી. કારણ કે, જવાબ આપનારે દીક્ષા એ મહાન વસ્તુ છે અને એના લેનાર પણ મહાન હોવાની અપેક્ષા રાખી હોય ત જ એ પૂર્વાક્ત જવાબ આપી શકે. હવે એ દીક્ષા લેનારની મહત્તમા વયોજન્ય છે કે ગુણજન્ય છે એ વિવાદસ્પદ હોવા છતાં ય અનુભવી મહાકવિઓની અનુભવ વાણી દ્વારા જલદીથી ઉકેલી શકાય એવી સરળ છે. “તેજસાં ન કયાં સમીક્ષ્યતે” તેજસ્વી મહાપુરુષોની વય-અવસ્થા જોવાતી નથી. “ગુણાં પૂજાસ્થા ન ગુણિષુ ન ચ લિંગાં ન ચ કયાં” ગુણીજનોમાં ગુણો એ જ પૂજનીય-પૂજવા લાયક છે. વેશ કે વય પૂજાને યોગ્ય નથી. “બાલાદાપિ સુભાસિતં ગ્રાહમ्” બાળક પાસેથી પણ સુભાસિત ગ્રહણ કરવું જોઈએ. આથી સ્પષ્ટ સમજ શકાય છે કે બાલ્યાવસ્થા માત્રથી જ તેનો અનધિકાર ઠરાવી શકાય નહીં તેમજ પ્રૌઢતા માત્રથી તેને અધિકાર આપી શકાય નહીં.

દીક્ષાનો નિષેધ કરાવી કરું પ્રયોજન સિદ્ધ કરવા માગો છો ? (અ) લૌકિક પ્રયોજન કે (બ) લોકોત્તર પ્રયોજન ?

અ, જો લૌકિક પ્રયોજન સિદ્ધ કરવા માગતા હો તો એ કહેવું ઢીક નથી. લૌકિક પ્રયોજન એટલે હુન્યવી અનુભવો, વિષયોનો સંપર્ક, ભોગોપભોગ સામગ્રીનો સહવાસ, એ જ હોઈ શકે ? આ અનુભવો જીવાત્માને કરી નવા નથી. સર્વથા વણસ્પર્શ્યા છે એમ પણ નથી. ભવ, ભવાન્તરોમાં અનેકવાર એનો એણો સંગ કર્યો છે. એનો સ્વાદ લીધો. વર્તમાનમાં એનો એ અનુભવ તિરોભૂત છે અન્તાહીત છે એટલું જ.

બ, લોકોત્તર પ્રયોજન પણ માની શકતું નથી. કારણ કે બાળકને સ્વયંસિદ્ધ સંન્યાસ-દીક્ષા પરતે અનધિકારી ઠરાવી, દીક્ષા-સંન્યાસ જેવી લોકોત્તર સિદ્ધિની તેને માટે અસિદ્ધ માને-મનાવે છતે લોકોત્તર પ્રયોજન ઈધન્માત્ર પણ ટકી શકતું નથી. અસ્તુ.

આ તો આગમ નિરપેક્ષ યુક્તિવાદનો આશ્રય કરીને અવસ્થા માત્ર-દીક્ષા-સંન્યાસનું સાધક કે બાધક બની શકતી નથી એ સૂચ્યં. હવે આગમ સાપેક્ષ-સંન્યાસ-દીક્ષાની અવસ્થા પરતે વિચાર કરાય છે. પ્રવજ્યા ક્યારે લેવી, આત્મબોધ કરવાની અવસ્થા કરી હોઈ શકે ? તેના જવાબમાં ભગવતી શ્રુતિના બે આદેશો છે-

“ગૃહી ભૂત્વા વની ભૂત્વા પ્રવજેત् ।”

“યદહરેવ વિરજેતદહરેવ પ્રવજેત् ॥”

ગૃહસ્થી બની, વાનપ્રસ્થીપણે સંન્યાસ લેવો જોઈએ.

— અથવા —

જે દિવસે વૈરાગ્ય જ્ઞગે તે જ દિવસે સંન્યાસ લેવો.

બ્રહ્મચર્ય કાર્યમાંથી ગૃહસ્થાશ્રમમાં ગ્રવેશ કરી, વાનપ્રસ્થી બની અન્તે પ્રવજ્યા-સંન્યાસ સ્વીકારવો જોઈએ. જે વ્યક્તિમાં સાહજિક વૈરાગ્ય જિજ્ઞાસા ન હોય તેવી વ્યક્તિએ પણ કમશઃ વૈરાગ્ય લાવવાના આ માર્ગ છે. પરંતુ જન્મ-જન્માંતરોની સાધનાથી આગળ વધેલો જીવ આ ભવમાં પણ વૈરાગ્ય પામે ત્યારે તે પ્રવજ્યા લઈ લે ! કેવું સુંદર સચોટ દીલસ્પર્શી આગમનું ફરમાન છે. પ્રવજ્યાનો અધિકાર આંતરિક વૈરાગ્ય પરતે હોઈ શકે. નાની વયમાં આંતરિક વૈરાગ્યનો અસંભવ છે એમ કહેવું એ જીવાત્માની મહાન શક્તિને અન્યાય આપવા બરાબર છે. ભવાન્તરોની અધૂરી સાધનાને આ ભવમાં પૂર્ણ કરવા આવેલ જીવાત્મા જન્મથી જ વિશિષ્ટ શક્તિ સંપન્ન અને અલોકિક પ્રતિભા પરિપૂર્ણ પણ હોઈ શકે છે. એવા ઉદાહરણો કરી એકાદ નથી. જગદ્ગુરુ આદ્ય શ્રી શંકરાચાર્યજીએ આઠેક વર્ષની વયે સંન્યાસ લીધો હતો અને એ સંન્યાસે તો સંસારને નવું જીવન, નવું તેજ, નવું નગદ સત્ય સંભળાયું. તે કાળે તેમનું અનધિકારીપણું હોત તો આધ્યાત્મિક સંપત્તિની જે ભેટ ભારતને મળી તે મળી શકત નહિ. તેમજ કલિકાળ સર્વજ્ઞ શ્રી હેમચંદ્ર સૂરીશ્વરજીએ પણ નાની વયમાં દીક્ષિત બનીને પોતાની અસાધારણ મેધાશક્તિનો પરિચય જગતને જ્યારે આઘો ત્યારે જગત આશ્રયાગરકાવ બની ગયું. જે કોઈ મહાપુરુષો થયા છે તે પ્રાય: લઘુ વયમાં દીક્ષિત બનીને તેવા નિમિત્તના સૌજન્યથી વિશ્વહિતૈથી અનુપમ હિંદ્ય સંદેશની ભેટો જગતને આપી ગયા છે, અને સ્વયં તરી ગયા છે. આવી અણમોલ સંપત્તિ નાની વયથી જ દીક્ષિત થનાર વ્યક્તિ સહજ સ્વાયત્ત કરી શકે છે. બાળકના અધિકાર માટે નિઃસંદેહ અને પ્રયોજન પરિપૂર્ણ પ્રમાણ અને યુક્તિઓ હોવા છતાં તેનો કાનુન દ્વારા નિષેધ કરવો યા કરવા પ્રબંધ યોજવો એ શાસ્ત્રીય દસ્તિથી, ન્યાયી દસ્તિથી કે સદાચારની દસ્તિથી વિચારતાં

જરા પણ પ્રમાણિક ઠરી શકતો નથી.

માનવજીવનનું લક્ષ્ય છે પુરુષાર્થની સિદ્ધિ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ; -આ ચાર પુરુષાર્થ છે. આ પુરુષાર્થમાં પ્રધાનપુરુષાર્થ મોક્ષ છે અને ભારતીય તત્ત્વચિત્તક મહર્ષિઓએ મોક્ષપ્રાપ્તિનું અનિવાર્ય સાધન સંન્યાસ નિષા ગણાવી છે, સંન્યાસ નિષા એટલે અંદર અને બહાર અનાત્મ વસ્તુમાં આત્મબુદ્ધિનો ત્યાગ, ભારોભાર પરમ વૈરાગ્ય. ત્યાગ અને વૈરાગ્ય સંન્યાસ નિષાનાં પગથિયાં છે. ત્યાગ અને વૈરાગ્ય વિના જ્ઞાન સ્થિતિ પામી શકતું નથી અને જ્ઞાનની સ્થિરતા વિના પરમ સુખની વંધા કદાપિ પરિપૂર્ણ થઈ શકવાની નથી... તથાપિ... ભૌતિક પરિબળોનાં આકર્ષણીયી બેંચાઈને કદાચિત્ત જીવાત્માને સંશય ઉત્પન્ન થવા પામે કે દશ્ય સુખ સાચું છે ? અથવા દશ્યથી પર અદશ્ય એવું આત્મસુખ (મોક્ષ) સુખ સાચું છે ! પ્રયોજન ભાવીમાં છે. તો આ બેમાંથી સ્વીકાર્ય કયું દશ્ય સુખનું પ્રયોજન વર્તમાન છે. અદશ્ય સુખનું ગણાવી શકાય ???? (સંપૂર્ણ)

## ॥ જૈન જીવિ શાસનમ् ॥

### બાલ સંન્યાસ દીક્ષા પ્રતિબંધક વિરોધ વિધેય વિરોધ સમિતિ

ટે.નં. ૨૩૨૨૮

બુલિયન એક્સચેન્જ બીલીંગ,  
બીજે માળે રૂમ નં. ૫૫.  
મુંબઈ, તા. ૫-૧૧-૫૫.

અનેક ગુણગણાલંકૃત પૂ.પા.શ્રી ૧૦૦૮ શ્રી. ....  
..... શ્રી સ્થળ .....

જોગ શ્રી મુંબઈથી લિ. બાલ સંન્યાસ દીક્ષા પ્ર.વિ. વિરોધ સમિતિની ૧૦૦૮  
વાર વંદના અવધારશોજી.

આપ પૂજ્યપાદ શ્રી સર્વેના પુષ્યદેહ સુખશાતા ઈચ્છાએ છીએ. અતે શ્રી  
સંઘમાં દેવગુરુ કૃપાથી કુશળતા વર્તે છે.

(૧) પ્ર.વિ. સાથે નિવેદન કરવાનું કે જે અગાઉ સમિતિ તરફથી એક  
વિનંતિપત્ર આપશ્રીને મોકલ્યો હતો અને આ ધર્મ વિદ્યાતક ભયંકર નુકસાનકારક  
બીલનો સખત વિરોધ થાય તે માટે આપશ્રીએ યોગ્ય પ્રયત્નો શરૂ કરી-કરાવી દીધા  
હશે, એમ અમે માનીએ છીએ.

(૨) આ બીલનો વિરોધ કરવાનો સમય ટૂંકો છે અને ચાતુર્માસ પણ પૂરો  
થઈ ગયો છે, તો આપશ્રીની સ્થિરતા અને નિશ્ચામાં જ આ બીલનું વિરોધકાર્ય  
સારા પ્રમાણમાં થઈ જય અને આપશ્રીના વિહાર પછી પણ એ કાર્ય વ્યવસ્થિત  
ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદશ” (ભાગ-૧૮)

૧૮૩

રીતે ચાલુ રહે તે માટે સ્થાનિક જૈન અને જૈનેતર ગૃહસ્થો અને આજુબાજુના ગામો  
અને પ્રદેશના આગેવાનોને અને કાર્યકર્તાઓને નિશ્ચિત દિવસ ઠરાવી તે દિવસે  
ખાસ આમંત્રાણ આપી મીટિંગ ગોઠવે અને તે પ્રસંગે આપશ્રી તેઓને બીલના  
અનિષ્ટો સમજાવી આ બીલના વિરોધની બધેથી સહીઓ-ઠરાવો વગેરે કરાવવાનું  
કાર્ય અમુક અમુક ભાઈઓ અને બહેનો ઉત્સાહપૂર્વક અને નિશ્ચય બળથી ઉપાડી  
લ્યે તેમ કરવાની જરૂર જણાય છે. તો આપશ્રી એવી યોજના કરવા તેઓને પ્રેરણા  
કરવા કૃપા કરશોજ અને કાર્ય કરવા માટે નક્કી થયેલા ભાઈ-બહેનોનાં નામ તથા  
તે તે પ્રદેશની નોંધ સમિતિને જણાવે તેમ કરશોજ તથા જે સલાહ સૂચના જોઈતી  
હોય તે ખુશીથી પૂછાવે તેમ સૂચવશોજ.

(૩) વધુમાં ત્યાં સ્થાનિક અને આજુબાજુના પ્રદેશમાં જે જે સંસ્થાઓ હોય,  
મહાજનો હોય, વ્યાપારી મંડળો હોય, તે દરેકના જુદા જુદા ઠરાવો કરીને તેમના  
છાપેલા લેટર પેપરો હોય તો તેના ઉપર લખીને રજીસ્ટરથી મુંબઈ સરકારને તરત  
મોકલે એ વધુ ઈછ છે, તેવી જ રીતે જાણીતા વહેપારીઓ તેમના છાપેલા લેટર  
પેપર ઉપર જુદી જુદી રીતે વિરોધ લખીને મોકલે તે પણ અત્યંત જરૂરી છે.

(૪) આપશ્રીનો ત્યાંથી જ્યારે વિહાર થાય ત્યારે જો વિરોધ મોકલવાની  
મુદ્દટ હોય તો વિહારમાં આવતા દરેક શહેર યા ગામની જૈન-જૈનેતર પ્રજા ઠરાવ  
કરીને તથા વિરોધ દર્શક ફોર્મો ઉપર પ્રત્યેક ભાઈ બહેન જુદી જુદી સહી કરીને  
મોકલે તેવી પ્રેરણા કરવા વિનંતી છે. પેન્સીલથી કરેલી સહીનું વિરોધપત્ર રદ થાય  
છે, માટે ૧૮ વર્ષની ઉપરની ઉમરના ભાઈ બહેનોએ શાહીથી નામ ઠેકાણા સાથે  
સહી કરવાની છે, આવા વિરોધ એક સાથે રજીસ્ટર બુક પોસ્ટથી, તેના ઉપર  
વિરોધપત્રોની સંખ્યા અને મોકલવાનારનું નામ, ઠેકાણું લખીને “મંત્રીશ્રી” મુંબઈ  
રાજ્ય વિધાન પરિષદ, કાઉન્સિલ હોલ; કોટ, મુંબઈ ૧. એ સરનામે મોકલવા  
અને તેની અમને પણ જાણ કરવી. આ રીતે વિરોધ પત્ર મોકલવાનારને સરકાર  
તરફથી પહોંચ મળશે.

(૫) આપશ્રી સર્વેનો વિરોધી અભિપ્રાય સરકારનાં દફ્ફતર નોંધાય એ પણ  
અત્યંત આવશ્યક છે. તો આ બીલના ગેરવાભો જણાવતા આપ સર્વે પૂ. આચાર્ય  
મહારાજાદિ મુનિરાજો તથા પૂ. સાધીંજ મહારાજોના ટૂંક નિવેદનો પત્રથી કે  
તારથી સરકારને મોકલશોજ. તેની નકલ અતે પણ નોંધ રહે તે માટે મોકલવા  
કૃપા કરશોજ.

(૬) છેલ્લા ૨૫ વર્ષમાં, ૧૮ વર્ષથી ઓછી ઉમરમાં થયેલી દીક્ષાઓની  
આધારભૂત નોંધની તાત્કાલિક આવશ્યકતા છે. તો આપશ્રીના સમુદ્દરયમાં અને  
૧૮૪ ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-જૈન શાસનમાં ભાગવતી દીક્ષાનું સ્થાન (ભાગ-૧૮)  
E:/Divya-Darshan(Part-18)(Prav.. Maho..)(Adhyatmik Pravachan).pmd/prf.3

આપશ્રીના આજ્ઞાવર્તી પુ. સાધ્વીજી મહારાજોમાં તેવી જે જે દીક્ષાઓ થઈ હોય તેની વિગત આ સાથેના પત્રમાં ભરીને બનતી તાકીએ મોકલવા કૃપા કરશોજુ.

(૭) આ બીલનો અસરકારક વિરોધ કરવા માટે આપશ્રીને જરૂર જણાય તે સૂચના અમોને જરૂરથી લખી મોકલશોજુ.

આ બીલના વિરોધનું કાર્ય મોહું છે પરંતુ શાસન જયવંતુ છે અને શ્રી ચતુર્વિધ સંઘના ઔક્યબળથી, પ્રેરણાથી અને આશિર્વાદથી તે યશસ્વી રીતે પાર પડશે તેવી આશા છે.

લિ. સેવકો,

જીવતલાલ પરતાપશી	અમૃતલાલ કાળીદાસ દોશી
નટવરલાલ નેમચંદ શાહ આદિ	ભોગીલાલ લહેરચંદ જવેરી
સમિતિના સભ્યોની ૧૦૦૮ વાર વંદના સ્વીકારશોજુ.	
તા.ક. ફોર્મો કેટલાં સહી કરાવીને મોકલ્યાં છે તે જણાવવા કૃપા કરો.	
બાળ-સંન્યાસ-દીક્ષા-પ્રતિબંધક વિધેય અંગે	

### મારો અભિપ્રાય

મંત્રીશ્રી,

મુંબઈ રાજ્ય વિધાન પરિષદ, કોટ, મુંબઈ.

આપના તરફથી-બાળ-સંન્યાસ-દીક્ષા પ્રતિબંધક નામનો જે વિધેય જનતાના અભિપ્રાય માટે મુંબઈ સરકારના તા. ૧૬-૧૦-૫૫ ના ગેજેટ વિભાગ પાંચમાં પ્રગટ કરવામાં આવ્યો છે, તે વિધેય અંગે મારો અભિપ્રાય નીચે મુજબ છે :-

- ૧ સંન્યાસ-દીક્ષા એ ધર્મશાસ્ત્રોએ સ્વપરના કલ્યાણ માટે સ્વાનુભવથી ફરમાવેલો આત્માના વિકાસનો રાજમાર્ગ છે, એટલે એ ધાર્મિક બાબત છે, માટે તેમાં સરકારે હસ્તક્ષેપ કરવો યોગ્ય નથી.
- ૨ આઠથી અઠાર વર્ષથી ઉંમર સુધીના સગીરને પૂર્વજન્મનાં સંસ્કારોથી ત્યાગને માટે યોગ્ય જોઈએ તેનું ઉત્તમોત્તમ હિત જોનારા માબાપ સંન્યાસ દીક્ષા માટે તેને રજા આપે છતાં યે સગીરને એ માર્ગથી રોકવો એ તેનું અહિત કરનારું અન્યાયી કાર્ય છે. વધુમાં માબાપ યા વાતીના કાયદેસરના વ્યાજની જન્મસિદ્ધ હક્ક ઉપર તરાપ મારનારું છે.
- ૩ સંન્યાસ-દીક્ષામાં અહિસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહી જીવન જીવવાનું છે. આવું સંયમી જીવન સહુને માટે ઉપકારક છે. ત્યાગીઓ જગત ઉપર રહીને સદાચારનો પ્રચાર કરનારા હોય છે. આ વિધેય ત્યાગી

સંસ્થાના મૂળમાં કુઠારાધાત કરનારો છે. જે પ્રજા અને સર્વોદ્યમના ધ્યયવાળી સરકાર માટે પણ નુકસાનકારક છે.

- ૪ વિધેય રજૂ કરનાર શ્રી પટવારીએ બીલના સમર્થમાં સગીરને નસાડવા, ભગડવા, ધૂપાવવા, ભોળવવા, વેચાણ આપવા-લેવામાં આવે છે, વગેરે પ્રકારની જે વાતો કરી છે તે આધાર વિનાની છે. ઉપર પ્રમાણે ગુંઝો કરનાર માટે વર્તમાન ફોજદારી કાયદામાં પૂરતી જોગવાઈ છે. એટલે સગીરના રક્ષણ કે હિત માટે પણ બાળ સંં દીક્ષા પ્રતિબંધક કાયદો કરવો બીનજરૂરી છે.
  - ૫ સંસારના ભોગો જીણે માનવ જીવનનું ધ્યેય છે, એવી આ વિધેયની ભૂમિકા છે. અને એના આધારે સગીર માટે ત્યાગ અને સંયમનો પ્રતિબંધ કરવાની સલાહ આપે છે. આવા સંસ્કૃતિ ઘાતક વિધેયની વધુ ચર્ચા ધારાસભામાં સરકારે ઉદારતાથી થવા દેવી એ પણ નુકસાનકારક છે.
- ઉપર જણાવેલા પ્રત્યક્ષ તથા બીજા અને પરોક્ષ નુકસાનો હોવાથી આ વિધેયનો હું સખત વિરોધ કરું દું તેની નોંધ લેશોજુ.
- સહી .....  
ઠેકાણું .....  
ગામ .....  
ઉંમર વર્ષ .....  
તારીખ .....  
ખાસ નોંધ : (૧) વાંચી-વિચારીને સહી શાહીથી કરવી, પણ પેનસીલથી ન કરવી.  
(૨) એક વખત સહી કરી હોય તો બીજી વખત ન કરવી.

### ● બાળકો તેમના હિતની રક્ષાર્થે પ્રયાસ કરે-એમાં ખોડું શું છે ? ●

તા. ૧૨ મી નવેમ્બરના મુંબઈ સમાચારમાં ભાઈ ચીમનલાલ જે. શાહીની સહીથી એક લખાણ પ્રસિદ્ધ થયું છે. આ ભાઈને બાળકો બાળ સંં દીક્ષા બીલ વિરોધપત્રકોમાં સહીઓ લેવા નીકળ્યા એ ગમ્યું નથી, અને એ હકીકતોને આગળ કરીને જેઓ બીલનો વિરોધ કરી રહ્યા છે તેઓને ઉતારી પાડવાની તક ભાઈ ચીમનલાલે ઊભી કરી છે અને મુંબઈ સમાચારના દ્વારે દોડી ગયા છે એમ મને તો લાગે છે. બાળ સંં દીક્ષા પ્રતિબંધક બીલ ૧૮ વર્ષની ઉંમર સુધીના સગીરોના આધ્યાત્મિક વિકાસને રૂધે છે, તેમના ધર્મ સ્વાનુભવમાં દખલગીરી કરે છે. તો

જેઓને અન્યાય થાય છે, તે બાળકો તેમના હિતની રક્ષાના પ્રયત્નમાં બાળ સંદીક્ષા પ્રતિબંધક બીલનો વીરોધ કરાવવા પ્રયાસ કરે એમાં ખોટું શું છે? જો બાળકો બાળકોની સહીઓ કરાવતા હોય ને ઉમર ખોટી લખાવતા હોય તો તો ભાઈ ચીમનલાલ શાહની ટીકા વાજબી લેખાત, પરંતુ તેવું તો તેઓ પણ કહી શક્યા નથી. આપણી આજાદીની લડતમાં ૧૮ વર્ષ સુધીના સગીરોએ ઘેર ઘેર ફરીને ફંડફણા ઉઘરાવ્યા છે, કોંગ્રેસના સભ્યો બનાવવા માટે મહોલ્યે મહોલ્યે ફર્યા છે અને ફરે છે. આ સિવાય પ્રભાતફરીઓ, સંધ્યાફરીઓ કાઢીને પ્રજાને જગૃત કરવાનું કર્ય આ વાનર સેનાઓએ કર્યું છે, આ બધું ભાઈ ચીમનલાલ ભૂલી ગયા લાગે છે. સગીરો વિરોધપત્રકો લઈને જય ને ૧૮ વર્ષ ઉપરના એટલે ભાઈ ચીમનલાલની-દાણિએ સંપૂર્ણ સમજદાર માણસો વાંચી-વિચારીને સહી કરે એમાં સગીરનો અધિત્ત ઉપયોગ શું થયો? સમ્યગ્ વિચારણાના અભાવે અથવા તો અશક્તિએ ભાઈ ચીમનલાલ જે.શાહ અને એવા બીજા ભાઈઓ બાળદીક્ષાની એટલે સદાચારના માર્ગની વિરુદ્ધનો અભિપ્રાય ધરાવતા થઈ ગયા છે એવું આવા પ્રચાર ઉપરથી આમ જનતા સમજશે. સુણેષુ કિ બહુના.

શીવલાલ નીભોવનદાસ દોશી  
અમદાવાદ.

### ● સમિતિના સમાચાર ●

સમિતિના કાર્યવાહકો વારંવાર મળે છે અને દરેક અગત્યની બાબતો પર સંભાળભરી વિચારણા કરે છે.

સમિતિનું કાર્યાલય સવારના ૮-૩૦થી રાત્રિના ૧૦-૦૦ વાગ્યા સુધી ખુલ્ખું રહે છે અને ત્યાં કોઈ પણ વખતે કાર્યક્રમોનો સંપર્ક સાધી શકાય છે.

અત્યાર સુધીમાં ૭૩૬ કેન્દ્રો પર સાહિત્ય મોકલાયું છે અને તે દરેક સ્થળે બાલ સંન્યાસ દીક્ષા પ્રતિબંધક વિધેયનો વિરોધ કરતી સહીઓ લેવાનું તથા ઠરાવ કરવાનું ચાલુ થઈ ગયું છે.

મુંબઈમાં યોજાયેલી જાગૃતિ વાખ્યાનમાળાએ જૈન સમાજમાં સારી જાગૃતિ આણી છે. આ વાખ્યાનમાળાને લીધે જનતાને આ વિધેયથી આવનારાં ભયંકર પરિણામોનો સ્પષ્ટ ઘ્યાલ આવ્યો છે ને તેથી સારા પ્રમાણમાં વિરોધની સહીઓ થઈ રહી છે.

એકલા મુંબઈમાં જ ૧૨૫ શ્રી ૧૫૦ જેટલા ધર્મપ્રેમી ગૃહસ્થો આ અંગે ઉમદા સેવા બજાવી રહ્યા છે.

ધારાસભાના સભ્યોએ આ બીલ સંબંધમાં તા. ૮-૮-૫૫ અને ૧૨-૮-૫૫ ને રોજ કરેલાં ભાષણો સરકાર તરફથી બહાર પડ્યાં છે. દરેક દિવસના ભાષણોની નકલ ૦-૩-૦ માં સરકારી પ્રેસ, ચર્ચારોડ મુંબઈમાંથી મળી શકે છે.

સમિતિના કેટલાક સભ્યોએ આ અઠવાડિયે પૂજ્ય આચાર્ય મહારાજે તથા સાધુ મુનિરાજેને એક વિજ્ઞપ્તિપત્ર પાઠવીને આ વિષયમાં યોગ્ય પ્રવૃત્તિપ્રેરણ કરવાની વિજ્ઞપ્તિ કરી છે.

દિવાળી પછી આ બીલની વિરુદ્ધમાં વધારે મોટા પાયે આંદોલન શરૂ થઈ ગયું છે.

પ્રકાશક-

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદધિ”

વર્ષ-૪, અંક-૧૩, તા. ૧૦-૧૨-૧૮૫૫



### દીક્ષાનો પ્રશ્ન સામાજિક નહિ કિન્તુ શુદ્ધ ધાર્મિક જ છે

શ્રી પ્રભુદાસ બી. પટવારીજી તરફથી એક બાલસંન્યાસ-દીક્ષા-પ્રતિબંધક ખરડો મુંબઈ વિધાન સભામાં રજૂ કરવામાં આવેલો તે મુંબઈ સરકારના પ્રકાશન ખાતા તરફથી તા. ૨૧-૮-૫૫ના રોજ પ્રગટ કરવામાં આવેલી યાદી અનુસાર ચાર મહિના માટે હાલ જાહેર પ્રજાના અભિપ્રાય અર્થે મૂકવામાં આવેલ છે. તેની મુદ્દત તા. ૧૨-૧-૫૬ ના દિવસે પૂરી થાય છે; તે પહેલાં જાહેર પ્રજાએ આ ખરડાની તરફેણ કે વિરુદ્ધમાં પોતાનો મત બહુ વિચાર કરીને આપવાની જરૂર છે.

આ ખરડાના જન્મદાતા કહો કે સમર્થકોમાં મુંબઈ જૈન યુવક સંઘનો ફાળો નોંધપાત્ર છે. એ યાદ રાખી લેવું ઘટે કે દીક્ષા-દેવદ્રવ્ય-મંદિર-મૂર્તિ આદિ ધાર્મિક સિદ્ધાંતો સામે જેહાં જગાવવા માટે આ સંસ્થાનો જન્મ આજથી પચીસ વર્ષ પૂર્વે થયેલો છે, તેઓ દીક્ષા-દીક્ષા લેનાર-દીક્ષા આપનાર-દીક્ષા અપાવનાર આદિ સામે ગમે તેવા અસત્ય પ્રચારો કરી લોકલાગણી ઉશ્કેરે એમાં કાંઈ નવાઈ નથી. સારા નસીબે મુંબઈ સરકાર આ વિષયમાં સજાગ છે અને શ્રીયુત પટવારીજી આદિ કેટલાક સભ્યોનાં ઝન્નુની ભાષણો સામે વડપ્રધાન શ્રી મોરારજીભાઈ આદિએ ઘણાં સારાં મંત્ર્યો રજૂ કર્યા હતાં. આપણે હવે ખરડાના સમર્થકોની દલીલો કેટલી પોકળ છે તે તપાસીએ :

(૧) તેઓ કહે છે, “સગીર ઉમરના બાળકોને દીક્ષા આપનાર એમની કુમળી વયનો લાભ ઉઠાવે છે.” આપણે જાણીએ છીએ કે લોહીનો વેપાર કરતી ટોળીઓ અને ગુંડાઓ, કે જેઓ બાલક-બાલિકાઓને ફસાવી અને ઉઠાવી જઈ, લલચાવી અનેક દુષ્કૃત્યો કરે છે, તેઓ તેમની કુમળી વયનો જરૂર ગેરલાભ ઉઠાવે છે. દીક્ષા આપનારા ત્યાગી ઉપકારપૂર્વક સાધુ મહાત્માઓ માટે આ આક્ષેપ કરવો તે સરાસર જૂહો છે.

સૌરાભ્ર રાજ્યમાં બાળ નવસંસ્કરણ ખાતાનાં ડિરેક્ટર ડૉ. જ્યોતસના શાહે “નાજુક ભયસ્થાનો” આવેખતાં નીચે પ્રમાણે લખ્યું છે :

“લોહીનો વેપાર કરતી ટોળીઓ દ્વારા ઉઠાવી જવાતી યુવાન કન્યાઓ અને બાલભિખારીઓનો પ્રશ્ન તો રોજ આપણે સમક્ષ આવે છે. ગુંડાઓની ટોળીઓ વ્યવસ્થિત રીતે બાળકોને હાથા બનાવીને પોતાની તરકીબો અજમાવે છે. આવી ટોળીઓની જાળ ખાસ કરીને શાળાએ જતા નિર્દોષ બાળકોમાં પાથરવામાં આવે છે. પૈસા ધીરીને સિનેમા કે સહેલગાહના ખર્ચ ઉઠાવીને બાળકોને હેળવવામાં આવે છે, અને એકવાર ઉપકાર નીચે આવેલા બાળકોને દ્વાષા લાવીને ઉધાડા પાડવાના ભયે આ ગુંડાઓ ફાવે તેવાં દુષ્કૃત્યો પડા પાછળ રહીને કરાવે છે.”

બાળકીની કુમળી વયનો ગેરલાભ ઉઠાવનારાં આ ખરાં ભયસ્થાનો છે. આમાં જો સાધુઓ તે પ્રકારના હોત તો જરૂર તેનો ઉલ્લેખ પણ આમાં થયો હોત. બાળકોથી કુમળી વયનો ગેરલાભ ઉઠાવનારાં આ ભયસ્થાનો સરકારને અને સમાજને મુંજવણમાં નાખનારાં છે. દીક્ષાના માર્ગ વળનારા બાળકો, તેમાં સહમત થનારાં માબાપો અને તેમનો ઉદ્ઘાર કરનારા સાધુ મહારાજો તો ઊલટા સરકાર તથા સમાજને આ મુંજવણમાંથી ઉગારી લે છે એ દીવા જેવી સ્પષ્ટ હકીકત છે.

(૨) બીજી દલીલ તેઓ એ કરે છે, “નાના બાળકોને દીક્ષાની સમજણ હોતી નથી, દીક્ષાથી તેઓનું જીવન દુંધાઈ જય છે. આ તેઓની ભૌતિક ત્યક્તદશા અને નૈતિક શોષણમાંથી તેઓને રક્ષણ મળવું જોઈએ.” દીક્ષાના આદર્શને ઉતારી પાડી ભડ્ક સમાજને લોળવી નાખવાની કહો કે ગેરસમજના માર્ગ દોરવાની આ એક તેઓની માયાવી તરકીબ છે.

દીક્ષા જે સંસારત્યાગનું પ્રત છે તે આઠ વર્ષથી નાની ઉમરનું બાળક હજ ન સમજી શકે એ માની લઈએ પરંતુ આઠથી ઉપરની ઉમરવાળો ન સમજી શકે એ બિલકુલ માની શકાય તેમ નથી અને સિદ્ધાંતકારોએ આઠથી નાની ઉમરના બાળકને તો દીક્ષાના અધિકારી ગણ્યા નથી, આઠથી અધિક ઉમરના બાલકને ગણ્યા છે, પછી અણસમજનો સવાલ રહે છે જ ક્યાં ?

આજનાં કેટલાંક ચપળ બાળકો ચોરી કરવામાં, બિસ્સાં કાતરવામાં જૂદું બોલવામાં, જૂદી ભીખ માગવામાં, વ્યભિચાર સેવવામાં, ખૂન કરવા વગેરેમાં પણ જો અમુક વાતાવરણની અસર નીચે સમજી શકનારાં હોય છે તો સારા વાતાવરણની અસર નીચે દીક્ષા-પાલનમાં પણ કેમ સમજી શકે નહિ ? આજનાં એવાં બાળકોનું ચિત્ર જોવું હોય તો જુઓ આ રહ્યું :

### “આજના બાળકો”

“કોઈ બાળક ન સમજાય તેવાં કારણોને લીધે નાની મોટી ચોરી કરે છે અને અધીચ્છનીય સોબત બાળકોને ભગાડી જઈ શકે છે, જૂદું બોલાવી શકે છે, આજ તો આવા બાળગુનેગારોની મંડળીઓમાં ફરતાં એમ જોવા મળે છે કે બાળકો ભીખ માગે છે, જુગાર રમી શકે છે, દાડુ-ગાંઝો પી શકે છે, અશ્વિલ ચિત્રામણ કરવું એ તો આજના કુમારનો જાણો કે એક વ્યવસાય બની ગયો છે. ૧૩-૧૪ વર્ષની ઉમરનું બાળક વ્યભિચાર સેવી શકે છે અને અત્યાચાર પણ કરી શકે છે. એ જ ઉમરનું બાળક બીજાનો જાન લેવાનો પ્રયત્ન કરે અને આપદ્યાત કરવાની કોશીષ કરે. આજનાં નાટક-સિનેમાઓ ઢીક અંશે બાળકના મનને ગુનાહિત બનાવી શકે છે. આપણી હોટેલો, રેસ્ટોરાં ધાડી વખત ગુનો કરવાની પૂર્વભૂમિકાની ગરજ સારનારાં હોય છે. સમાજનાં જીવનનીતિની દણિએ કનિષ્ઠ ગણાતા વ્યવસાયો પણ બાળકોને અનિષ્ટ માર્ગ દોરી જવામાં કારણભૂત બની શકે છે. આજનાં સામયિક પ્રકાશનો દ્વારા અને અનેક પ્રકારનાં વાંચન સાહિત્ય દ્વારા બાળકને ગુનાની ઉતેજના આપવાનું કામ ન હેખી શકાય તેવી રીતે ચાલી રહ્યું હોય છે.”

આ પ્રમાણે શ્રી હરીભાઈ ત્રિવેદી તા. ૨૩-૧૦-૫૫૮ના જન્મભૂમિમાં ઉલ્લેખ કરે છે.

શ્રી પ્રભુદાસ પટવારી અને શ્રી પરમાનંદના જૈન યુવક સંઘને બાળકોની ભૌતિક ત્યક્તદશા તથા નૈતિક શોષણ માટે જો ખરું જ લાગતું હોય તો તે માટે ઉપર ખાસ જવાબદાર ગણવામાં આવેલા આજનાં નાટક-સિનેમા, હોટેલ-રેસ્ટોરાં, કનિષ્ઠ વ્યવસાયો તથા સામયિક પ્રકાશનો સામે પ્રતિબંધ લાવવાની તેમણે ભારતના કલ્યાણ રાજ્યમાં કોશીષ કરવી જોઈએ, નહિ કે પવિત્ર દીક્ષા સામે. દીક્ષા તો બાળકોનું જીવન સુધારનારી છે, ઉપરના પતન માર્ગોથી બચાવી લેનારી છે. સંસારત્યાગની દીક્ષામાં સંસારીઓ સાથેના મોહ સંબંધનું સ્થાન સારાયે જગત સાથેનો ધર્મસંબંધ ગ્રહણ કરે છે, આપું જગત એનું કુટુંબ બને છે, તેથી દીક્ષિતને કંચન-કામિની વિના પણ ખાન-પાન-દવા-વસ્ત્ર-પાત્ર-વસતિ-અભ્યાસનાં સાધન આદિ

ચારિત્ર કાયાના રક્ષણ વર્ધન માટે જોઈએ તે મળે છે અને અહિસા-સત્ય-સદ્ગ્યાર-પરોપકાર આદિ નૈતિક સંપત્તિના તો તેઓ લોકોતેર સ્વામિ બને છે. નથી આમાં ભૌતિક ત્યક્તિદ્શા કે નૈતિક શોષણ. છતાં બાળકોના આ કલ્યાણ માર્ગને જ પ્રતિબંધિત કરવાની એ મહાશયો આટલી બધી જે વિધાતક ઝુંબેશ ચલાવે છે, તે તેઓના હૃદયમાં ઠાંસી ઠાંસીને ભરેલો આધ્યાત્મિક ત્યાગભાવ સામેનો કેવળ દ્રેષ્ટભાવ જ સૂચ્યવે છે.

અને દીક્ષાજીવન એ એક ઉચ્ચ કોટિનું પ્રતિજ્ઞાબદ્ધ જીવન છે. એ જીવન માટે માન ઉપજવું જોઈએ તેને બદલે તેનાથી બાળકનું જીવન રુંધાઈ જતું કહેવું એ કેટલી બેહૂદી વાત છે? એનો અર્થ એ જ છે કે આવું કહેનારાઓને માત્ર પણ જેવું સ્વેચ્છાચારી જીવન જેટલું પ્રિય છે તેટલું સંયમના ઉચ્ચ આદર્શવાળું જીવન પસંદ નથી. જગતમાં જેમણે મહાન સ્થાન શોભાવ્યું છે તેમને માટે સ્થાનના મોભાનુસાર નિયમોનાં બંધન તો રહેલાં જ છે. એમ તો આપણા રાષ્ટ્રપ્રમુખો કે પ્રધાનો કે ન્યાયમૂર્તિઓ આદિ માટે પણ બંધનો ક્યાં નથી? અને નિશાળ, કોલેજ કે દ્વાખાનામાં દાખલ થનાર નાના મોટા માણસ માટે પણ શું નિયમનો નથી? આવા નિયમોથી શું જીવન રુંધાઈ જાય છે કે વિકાસ પામે છે? ઈંગ્લેનના રાજકુટુંબના પ્રણાલિકાગતું રહેલાં બંધનોનો જ એ પ્રતાપ કહેવો પડુશે કે માઝ રાજ એડવર્ડને ગાદી છોડવી પડી જાયારે વર્તમાનમાં રાજકુમારી માગરિટને છૂટા-છેડા લીધેલા પોતાના સામાન્ય પ્રેમી સાથે લગ્ન કરવાનો વિચાર છોડી દેવો પડ્યો. જેઓને આયદ્ધશની નૈતિક સભ્યતા તથા આધ્યાત્મિક સંસ્કૃતિનું મૂલ્ય આંકવાની સાચી દાણ છે તેઓ બાલકોના પવિત્ર દીક્ષા જીવનનો વિરોધ મુદ્દલ કરી શકે નહિ અને તેથી જ સગીર દીક્ષાને પ્રતિબંધિત કરવાની અનર્થકારી કલ્યાણ સરખી પણ કરી શકે નહિ. સદર દીક્ષા પ્રતિબંધક બીલની રજૂઆત સમયે મુંબઈ રાજ્યના વડાપ્રધાન શ્રી મોરારજીભાઈએ સાચું જ કહ્યું છે,

“આ દેશની સભ્યતા અને સંસ્કૃતિ ત્યાગ ઉપર આધારિત છે અને ત્યાગની ભાવના ધર્મ સાથે જોડાયેલી છે. ધર્મ માનવજીવનનો સાર છે. તો ૨૧ વર્ષની ઉપરનો જ તે માટે યોગ્ય હોઈ શકે એવું કર્યું નથી. જ કે ૮ વર્ષનો પણ હોઈ શકે. તે પૂર્વજન્મના સંસ્કારને લીધે પૂરી સમજણવાળો હોય અને દીક્ષા લેવા માગતો હોય તો તેને હું કેમ રોકી શકું?”

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદધિ”

વર્ષ-૪, અંક-૧૨, તા. ૧૦-૧૨-૧૯૫૫



## અમદાવાદમાં ભરાયેલી જૈનોની જાહેર સમારો પસાર કરેલ દ્રાવ

નગરશેઠ શ્રી વિમલભાઈ મયાભાઈ વગેરે પંદર પ્રતિષ્ઠિત આગેવાનો તરફથી શ્રી પટવારીએ વિધાનસભામાં રજૂ કરેલ બાળ સંદીક્ષા પ્રતિબંધક બીલનો વિરોધ કરવા માટે તા. ૧-૧૨-૫૫ને વાર ગુરુવારના રોજ સવારના ૯-૩૦ વાગે અમદાવાદમાં ધીકાંટા રોડે, નગરશેઠના વંડે જાહેરસભા બોલાવવામાં આવી હતી. આ બીલ પ્રત્યે જૈન સમાજનો ખૂબ જ અણગમો હોવાથી સભાના સમય પહેલાં બધા જૈન આગેવાનો અને હજારો ભાઈઓ-બહેનો આવી પહોંચ્યા હતાં. શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ ખૂબ જ રોકાણને લીધે આવી શક્યા નહોતા; જેથી તેઓના યુવાન સુપુત્ર શ્રી શ્રેષ્ઠીકભાઈ કસ્તુરભાઈને પ્રમુખસ્થાન લેવાની વિનંતી શેઠ નરોત્તમદાસ મયાભાઈએ કરી હતી, જેને શેઠ કસ્તુરભાઈ મયાભાઈએ ટેકો આઘ્યો હતો; શ્રી શ્રેષ્ઠીકભાઈએ સ્વીકાર કર્યો હતો. શરૂઆતમાં જાણીતા કાર્યકર્તા શ્રી ચીમનલાલ કેશવલાલ કરીયાએ પહેલા વાંચનમાંથી બીલ નીકળ્યું, એટલે ‘સરકાર તેને ટેકો આઘ્યો છે.’ એવા બીલના ટેકેદારો તરફથી પ્રજામાં ગેરસમજ ફેલાવવામાં આવે છે તેનો ખુલાસો ભાઈ પટવારીને મુંબઈ રાજ્યના વડાપ્રધાન શ્રી મોરારજીભાઈએ આપેલો, “સરકાર આ બીલના સિદ્ધાંતને સ્વીકારે છે કે સરકારનો એને ટેકો છે એમ માનવાનું નથી” તે જાહેર કર્યો હતો.

બીલની સામે જૈનોનો ઉગ્ર વિરોધ કેમ?

કેટલાકો કહે છે કે બધા ધર્મો માટે આ બીલ શ્રી પટવારી લાલ્યા છે, તો જૈનોનો આટલો બધો વિરોધ કેમ છે? તે બાબતમાં શ્રી કરીયાએ જણાવ્યું, “બીજી ધર્મોવાળાનો વિરોધ તો છે જ; પણ જૈનોના દેવ, શુરુત્યાગી, એના પર્વો પણ ત્યાગના, જૈન ધર્મ એટલે ત્યાગ ધર્મ, ભોગ ધર્મ નહિ. આથી જેઓને જૈન ધર્મના તત્ત્વજ્ઞાનમાં શદ્ધ છે, તેઓને ત્યાગ સામે કોઈ લાભે કે ત્યાગીનું કોઈ અપમાન કરે તો જૈનને દુઃખ થાય છે. આથી દીક્ષા પ્રતિબંધક બીલ સામે જૈનો ઉગ્ર વિરોધ કરે એ સ્વાભાવિક છે અને વધારે દુઃખનો વિષય એ છે કે જે રીતે અને જે આધારો ઉપર શ્રી પટવારીએ આ બીલ રજૂ કર્યું છે તે જોતાં તેમની નજર સામે જૈન દીક્ષા હોય એમ જણાય છે. વળી તેમણે બધા ધર્મને લાગુ પાડવાની જે ચેષ્ટા કરી છે

તेमાં કાઈ ખાસ દમ નથી.”

### નસાડચા ભગાડચાનો જુઠો આક્ષેપ

આના અંગે બોલતા તેમણે જણાવ્યું, “૨૭ વર્ષથી હું જહેર કામ કરું છું, તેની વાત પછી કરીશ; પરંતુ શ્રી પટવારીએ આવા ગુંજા માટે કોઈ જૈન સાધુને કોર્ટમાં સજી થયાનો દાખલો રજૂ કર્યો નથી. ઉલટું આ બીલના ટેકેદારો એટલે દીક્ષાના વિરોધીઓએ ૧૮ વર્ષની પુખ્ત ઉંમરનાને જૈન સાધુએ દીક્ષા આપેલી અને તેને ૧૪ વર્ષનો જણાવી જૈન સાધુ ઉપર ખોટી ફરીયાદ કરી તથા બેડીઓ પહેરાવી પાટણના ભરબજીરમાં ફેરવ્યા, છેવટે વીરમગામમાં કેસ ચાલ્યો અને જૈન સાધુને કોર્ટ નિર્દ્દિષ્ટ જહેર કર્યો. આ સિવાય આ ત્યાગના વિરોધીઓએ દીક્ષાર્થી આત્માઓ ઉપર કેવા વિતકો કર્યા છે તેની હકીકતો તો સમયે થશે.” એમ તેમણે જણાવ્યું હતું.

### પૂર્ણ સદાચારના માર્ગ જનારનો વિરોધ શા માટે ?

આ બાબતમાં તેમણે જણાવ્યું હતું કે જેઓ પુદ્ગલાનાંદિ છે, ભૌતિક સુખોમાં જ માનવજીવનની સફળતા માનનારા છે, તેઓને અહિસા, સત્ય, અસ્ત્રે, બ્રહ્મચર્ય અને અપરિગ્રહી જીવનના માર્ગ જઈ આધ્યાત્મિક વિકાસ સાધે એ રૂચિનું જ નથી, એમાં એમનો ઉપરનો દોષ પ્રાધાન્ય છે. કમળાવાળાને ધોળું પણ પીળું લાગે એમાં તેનો રોગ એ જ કારણ છે, તેવું આમાં પણ છે. બાકી તો આપણે સમજ શકતા નથી કે માબાપ, વાલીની સંમતિ હોય. પૂર્વના સંસ્કારથી કોઈ સગીર દીક્ષા લેવા નિકળે તેમાં શહેરને, સમાજને કે દેશને નુકશાન શું છે ?

### વિરોધી પ્રચાર સામે ખુલાસો કરવો જ જોઈએ.

આપણા કેટલાક ભાઈઓ દીક્ષા સામેના જુઠા પ્રચાર સામે મૌન રહ્યા તેથી પેલા બ્રાહ્મણની બકરીની વાત જેવું થયું છે ને દીક્ષા માટે કેટલાકોના મનમાં ખોટો ભ્રમ બંધાઈ ગયો છે માટે રેડીયો અને એરોપ્લેનના આ જમાનામાં ખોટા પ્રચારની સ્હામે રદીઓ આપવો જ જોઈએ. આ બાબતમાં સમાજે જાગૃત થવાની જરૂર છે. ભાઈ પટવારી અને એવા કેટલાય ખોટા પ્રચારથી દોરવાયા છે એમ હું માનું છું.

શ્રી પટવારીના બીલનો વિરોધ કરો :- બાળ સં દીક્ષા પ્રતિબંધક બીલથી ઘણા ભયંકર નુકશાનો થાય તેમ છે, ભાવિ મહાપુરુષો પાકવાની જે તક છે તેને ઉચ્છેદી નાંખે છે, ધર્મમાં હસ્તક્ષેપ કરે છે. માટે બધાએ આ બીલનો સજજડ વિરોધ કરવો જોઈએ અને રદ કરાવીને જ જંપવું જોઈએ.

ત્યારપછી શ્રી મફન્ટલાલભાઈ પડિત બીલના ઘણા નુકશાનો જણાવી બીલ રદ કરવા અપીલ કરી હતી. શેઠ અમૃતલાલ જેશિંગભાઈ (બી.કોમ.), શ્રી

ચીમનલાલ શેઠ-પ્રોફેસર બી.ટી. કોલેજ, વકીલ શાંતિલાલ જેઠાલાલ, શ્રી ઉજમશી જુઠાભાઈ, શ્રી મહુલીકર વગેરેએ આ બીલની સખત શબ્દોમાં જાટકણી કાઢી હતી અને તે રદ કરવા જણાવ્યું હતું.

પ્રમુખસ્થાનેથી શેઠશ્રી શ્રેષ્ઠિકભાઈએ નીચેનો ઠરાવ રજૂ કર્યો હતો જેને સભાએ મહાવીર દેવની જયનાદોથી વધાવી લીધો હતો અને ઠરાવ ઘટતે સ્થળે મોકલી આપવાની સત્તા આપી હતી.

ઠરાવ “મુંબઈ રાજ્યની વિધાન સભામાં શ્રી પ્રભુદાસ પટવારીએ બાળ સંન્યાસ દીક્ષા પ્રતિબંધક વિધેય રજૂ કરેલ છે, તે ભારતના ત્યાગ પ્રધાન સંસ્કૃતિની અવગણના કરનાર તથા ધર્મના મૂળમાં ઘા કરનાર છે અને મુખ્યત્વે જૈન ધર્મને અસર કરે છે, તેથી ધર્મના કાર્યોમાં હસ્તક્ષેપ કરનારો આવો કાયદો નાં સરકારે મંજુર કરવો જોઈએ નહિ, તેમ અમદાવાદની આજે મળેલ જૈનોની જહેરસભા માને છે અને તેનો સખત વિરોધ કરે છે.”

છેલ્લે શ્રી કડીયાએ પ્રમુખશ્રીનો આભાર માનતા આવા યુવાન પ્રમુખશ્રી ધર્મરક્ષાના કાર્યમાં મોખરે આવવા માટે આનંદ વ્યક્ત કર્યો હતો અને તેઓને ધન્યવાદ આપતા મહાન સમર્થ પિતાના પગલે ધર્મસેવાના કાર્યો શ્રેષ્ઠિકભાઈ શેઠના હાથે થાય તેવી પ્રાર્થના કરી હતી.

### • પવિત્ર આર્યસંસ્કૃતિ પર આક્રમણ •

મુંબઈ રાજ્ય વિધાન પરિષદમાં શ્રી પ્રભુદાસ પટવારીએ સંન્યાસ દીક્ષા જેવી સ્વપર ઉપકારક ધર્મપ્રવૃત્તિમાં ઉખલ કરતો કાયદા ખરડો રજૂ કર્યો છે. એના પર અમારો અભિપ્રાય નીચે પ્રમાણે છે :

(૧) જીવનમાં અહિસા, સત્ય, બ્રહ્મચર્ય, નીતિ, નિઃસ્પૃહતા આદિ સદ્ગુણોનું આગમન થાય, પવિત્રતા સધાય, એનાથી વધીને ઊંચું સુખ બીજું કર્યું છે ? એવી પવિત્રતા અને સુખવાળી દીક્ષા મોટાની હો કે નાનાની, પણ એ પવિત્રતાની જનત્રી છે. સાથે સાથે,

(૨) દીક્ષા એ પવિત્ર પ્રાચીન શાસ્ત્રો, તત્ત્વજ્ઞાન, સંસ્કૃતિ વગેરેના સંરક્ષણમાં મુખ્ય સાધન છે.

(૩) કોઈ પણ સરકારી હોદ્દો કે પાઈનોય પગાર લીધા વિના ગામેગામ પગે ફરી દીક્ષિત સાધુ-સંતો જનતામાં પણ માનવતા, સદાચાર, વ્યસનત્યાગ, સદ્ગ્રાહ, સજજનતા, પરોપકાર વગેરેના પ્રવર્તક છે. લોકને એ માયાળું ને ઉદાર, સહિષ્ણુ અને ગુણજ્ઞ બનાવે છે, તેથી પ્રજા ઉમદા બને છે.

(૪) સંસારી સુખસમગ્રીના સર્વસ્વ ત્યાગરૂપ હોઈને દીક્ષા એક મહાન ધર્મિક અને આધ્યાત્મિક પ્રશ્ન છે. એના પર અભિપ્રાય અથવા અંકુશની વિચારણા ધર્મશાસ્ત્ર આચાર્યો અને મુનિઓ શાસ્ત્રને વળગીને સાધક દેશ કાલાદિ અનુસારે હજ્ઞય કદાચ કરી શકે; પણ ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિને ગૌણ કરીને પાશ્ચાત્ય સંસ્કૃતિને અનુસરી જડવાદના પૂર્વગ્રહથી બંધાઈ ગયેલા માણસો કેવી રીતે કરી શકે ?

(૫) દીક્ષા એવા સંતપુરુષને પકવે છે કે જે લોકોને સત્ય, નીતિ, પ્રમાણિકતા વગેરે ઉપદેશે છે તેથી પહેલેથી જ ગુના અટકાવવા દ્વારા પોલીસ કરતાંય વધુ અગત્યનું કાર્ય કરે છે.

(૬) દેશનું કલ્યાણ ધર્મ ઉપર ટકે છે. જવાળામુખી, હુલ્લડ, પૂર વગેરે ઉપદ્રવો ધર્મથી ઓછા રહે છે. દીક્ષા એ મહાન ધર્મ છે. એ ઉપદ્રવને ન જાગવા દુંહને સુખ આબાદી સર્જ છે. એના પર પ્રતિબંધ એ દુભૂંય પેદા કરે છે; જે દેશને દુઃખમાં પટકે છે.

(૭) કોઈ પણ જાતના સુસંસ્કાર ૧૮ વર્ષની વય પૂર્વેજ સારી રીતે નાખી શકાય. તેમજ બાળ દીક્ષિતોને કુસંસ્કારો અને કુમિત્રોથી બચવાનો વહેલો અવસર મળે છે. વાસના અને વિકારોનો ભોગ બનેલો ન હોવાથી ઊંચી વિરાગદશા અને પવિત્ર ભાવનાઓને સ્થિર કરવાની સગવડ હોય છે.

(૮) જો શ્રી પટવારી એમ કહે, “મોટા થયા પછી વાસના અને વિકારોની વસ્તુ બચાવની સમજને અનાથી દૂર રહે એ સારો ત્યાગી વિરાગી થાય,” તો તો એ એવું થયું કે ‘ચોરનો કે વ્યસનીનો છોકરો પણ મોટી વયે ચોરીની કે વ્યસની વસ્તુ બચાવની સમજયા પછી અનાથી દૂર રહે, એ સારો શાહુકાર ગૃહસ્થ બનશે, માટે એને નાની વયથી ચોરીથી, વ્યસનથી, દૂર નહિ રાખવો !’ કેવું કારમું અજ્ઞાન ! ખરું જોતાં તો અણસમજમાં જ દુર્ગુણોથી બચાવાય છે. એમ વાસના અને વિકારના પાપથી નાની વયમાં જ બચી જાય એ વધારે ઈચ્છનીય છે; એમાં કશું ખોઢું નથી.

(૯) ત્યારે જો એમ દલીલ કરે, “સંસારસુખનો સ્વાદ ચાખ્યા પછી એનો ત્યાગ કરે તો એને પછીથી પશ્ચાત્યાપ નહિ થાય,” તો તો એમને કહો કે એનો અર્થ એ છે કે ‘માંસ-મદિરાનો ત્યાગ એનો ઉપભોગ કર્યા પછી કરવો. જેથી પછીથી પશ્ચાત્યાપ ન થાય...હિંસાનો ત્યાગ થોડાં ખૂનનો સ્વાદ કર્યા પછી કરવો એટલે પછીથી સંતાપ ન થાય...જુગારનો ત્યાગ એના વ્યસની બન્યા પછી કરવો !...વેશ્યા-પરસ્તીનો ત્યાગ એના રંગ ઉડાવ્યા પછી કરવો ! જેથી પછી

પશ્ચાત્યાપ ન થાય.’ કેવી વિપરીત મતિ !

(૧૦) ત્યારે શ્રી પટવારી દલીલ કરે છે, “આ બીલથી બાળકને ભૌતિકત્યાગ વિરુદ્ધ સંરક્ષણ આપીને એના સંસારસુખ ન રહી જાય એ દ્યા ખાઈ દીક્ષા અટકાવીએ છીએ.” આ પણ અજ્ઞાન કથન છે. એમ તો પછી જે સગીરને જુગાર-મદિરાપાન-માંસાહાર-હુરાચાર વગેરેના સ્વાદિષ્ટ સુખ ગમે છે, એ ભોગવવા રહી ન જાય એ દ્યા ખાઈને એને એ જુગારાદિ પાપ કોઈ ન ત્યજાવે એનાય એ બીલ લાવશે ન ? એમની દલીલ મુજબ તો સગીરને એ જુગારાદિ પાપોથી દૂર રહેવાનો ઉપદેશ કરી એ પાપોના ત્યાગનો સંકલ્પ કરાવવાનો પ્રયત્ન નહિ કરી શકાય. ત્યારે ખરી રીતે જે જુગારાદિ પાપને તો સગીરની ઈચ્છા વિરુદ્ધ પણ છોડાવવામાં વાંધો નહિ; તો પછી સંસાર-પાપને સગીર સ્વેચ્છાથી છોડે એમાંય વાંધો ? બળાત્કાર તો કરાતો જ નથી, એ ધ્યાનમાં રહે.

(૧૧) દીક્ષા પ્રતિબંધક બીલ અટકાવે છે ૧૮ વર્ષ સુધીની ઉંમરવાળાની દીક્ષા; અને એને કહે છે ‘બાળ’ની દીક્ષા ! આજે જગતમાં ૧૭ વર્ષની ઉંમરવાળા તો પરણેલા અને બચ્ચાના બાપ બનેલા મળે છે. એ ઉંમરવાળાને બાળ કહેવા એ ભાખાનો છણ છે ! ખરી રીતે બાળ બિચારો શું સમજે ? બાળકની દીક્ષા તો ન જ જોઈએ. આમ લોકને ભમમાં નાંખી લોકલાગણીને વશ કરવાનો આ ધંધો છે. ૧૬-૧૭ ની ઉંમરવાળા તો શું, પણ ૧૧-૧૨ વર્ષની ઉંમરવાળાય કોઈ છોકરા સમજદાર હોય છે. નોકરી-ધંધો કરતા હોય છે. તો એ દીક્ષાનો ઉધાડા કષ્ટ કેમ ન સમજ શકે ? ઇતાં જો એ પૂર્વસંસ્કાર અને અહીંના ઉપદેશ-શ્રવણથી સ્વીકારવા ખુશી હોય તો એના પર પ્રતિબંધક કાયદો લાદવો એ અન્યાયી જુલ્દ છે.

(૧૨) જેને ત્યાગ વિરાગની શુભ ઉચ્ચ ભાવના આપણે નથી તો જગાવી કે નથી તો ટકાવવાનું આપણે માથે જેને અધિક લેતા, એવા એને એ ભાવના સફળ કરવાની આડે કાયદા ઊભા કરવાના આપણને શો હક છે ?

(૧૩) જેને દીર્ઘ આયુષ્યની બાંહેધરી આપણે આપી શકતા નથી, તેમ જેને જીવનપર્યત્તની નિરોગિતા-ધનવતા-કુટુંબ સુખ ઈચ્છાદિના જોગવાઈ (સગવડ) કરવાનું આપણે માથે ધરતા નથી, અને પરલોકમાં જેની સદ્ગતિ આપણે નક્કી કરાવી શકતા નથી, એવા અને જાતે અહિસાદિમય પવિત્ર આધ્યાત્મિક જીવન સ્વીકાર બીજો સ્વોપકાર-પરોપકારથી આયુષ્ય સફળ કરતો હોય અને સદ્ગતિ જાતે મુક્રર કરતો હોય તો તેમાં કેમ જ અટકાયત ઊભી કરી શકીએ ? અટકાવવાથી પછી દુનિયામાં એને ધનકુટુંબ વગેરે સુખનો શો ભરોસો ? આયુષ્યનો શો વિશ્વાસ ?

(૧૪) જગતમાં પાપો સાંસારિક (વૈષ્યિક) સુખવૃત્તિના પોષણથી થાય છે;

નહિ કે ત્યાગથી. ગુન્હાહિત ફૂત્યો હુન્યવી સુખો લૂટવાની લાલસા પાછળ થાય છે. આજે કોઈ શરાફ-શાહુકારની ઘ્યાતિવાળા અને ધોળાં કપડાવાળા પણ લક્ષ્મી અને લીલાના લોભમાં કાળાં ફૂત્યો કરતા થયા છે. એવા અવસરે કરે કે કોક પાંચ પંદર જણ એ લોભ અને હુન્યવી સુખની આશક્તિ છોડી દઈને ગુન્હાહિત ફૂત્યોથી રહિત પવિત્ર સાધુ જીવન સ્વીકારી જનતા અને સરકારને પોતાના તરફથી નિરાંત આપતા હોય, ઉપરથી જનતામાં ગુન્હા ઘટાડી પવિત્રતા ફેલાવતા હોય, તો અને એમાં કાયદાના ડંડથી એમાં જતા અટકાવી હુન્યવી લક્ષ્મી અને લીલાવાળા પ્રપંચી જીવનમાં જકડી રાખવા, એ અનિષ્ટપોષક અને માનવતા વિરુદ્ધ પ્રવૃત્તિ છે.

(૧૫) ખરી રીતે આજે જ્યારે ગુનાનું પ્રમાણ વધી ગયું છે ત્યારે રાષ્ટ્રના હિતની ખાતર આવા હજારો નાના મોટા પવિત્ર સંતો પકવવાની યોજના અને સહાય જોઈએ. જેથી એ સંતો પવિત્ર જીવન અને ઉપદેશ દ્વારા ગુના અટકાવે.

(૧૬) આ કાયદા બીલ ધર્મમાં હસ્તક્ષેપ કરી ધર્મસ્વાતંત્ર હણે છે, તેમ ધર્મમાં સહાય અને રક્ષણ આપવાના બંધારણીય હક પર ત્રાપ મારે છે.

(૧૭) પવિત્ર જૈન દીક્ષાથી સગીરનું પણ કોઈ અહિત નથી, તેમજ નૈતિક-સામાજિક કે રાજકીય પણ કોઈ જ નુકસાન નથી; બલ્કે કલ્યાણસિદ્ધ છે. પછી એને રૂંધવાનો કાયદો લાવવો એ કેવો જુલ્દુ ! બીલના ઉદ્દેશમાં બાળકના ભૌતિક રક્ષણનો જે મુદ્રે છે તે તો હુન્યવી જીવનમાં કારખાનામાં ધંધાની તાલિમ, મનોરંજન, રમત-ગમત કે બીજા સંસ્કાર બાબત હોઈ શકે છે. બાકી દીક્ષા એ તો પરમ પવિત્ર ઉચ્ચ આધ્યાત્મિક સંસ્કારની વસ્તુ છે તે બાલકના અને જગતભરના હિતમાં છે. તેના બાધક કાયદા અધ્યાત્મમાં વિરુદ્ધ સીક્યુલર સ્ટેટ કેમ સ્વીકારી શકે ?

(૧૮) જેમ કેટલાક બાળકો કુદરતી રીતે વક્તિલ, ડોક્ટર, ઈજનેર કે શિક્ષણ થવાની યોગ્યતા ધરાવે છે, તેમ કોઈ કોઈ સગીરો પૂર્વની સંસ્કાર મુખીથી કુદરતી રીતે જ સંત અને ધર્મગુરુ થવાની લાયકાત ધરાવતા હોય છે, તેને તેમ થતા અટકાવનારો કાયદો તેની તારક શક્તિઓને ગુંગળાવી નાખનારો, વ્યક્તિ સ્વાતંત્ર્ય હણનારો, વિકસને રૂંધનારો અને તેની મહત્વાકાંક્ષાને કચુનારો છે.

(૧૯) બીલ લાવનાર શ્રી પત્વારી બાળકોને નસાડી ભગાડીને દીક્ષા આઘાના દાખલા આપી શક્યા નથી, કેમકે હોય તો આપે ને ? છતાં એવો આક્ષેપ કરે છે તે વાહીયાત અને ઉપજાવી કાઢેલો છે. કેમકે એમાં તો ઝોજદારી ગુન્હો હોવાથી વાતી કાયદેસર પગલાં લઈ શકે છે. માટે પ્રસ્તુત બીલ તો સગીરની દીક્ષા અટકાવતું હોવાથી તદ્દન જ અયોગ્ય છે. ખરી રીતે તો દીક્ષામાં માબાપ રાજ, સંતાન રાજ અને ગુરુ યોગ્ય છતાં એમાં ખોટા વિધન ઊભા કર્યા છે, યાવત્ત જુલ્દુ પણ કર્યા છે.

સાચા સમાજ હિતચિતકે તો આ નિવારવા પગલાં લેવા જેવાં છે. જેથી જનતામાં સત્પુરુષો વધે અને સદાચારાદિ ગુણો વધે.

(૨૦) પટવારીએ બીલ રજૂ કરતાં ભરપૂર આક્ષેપો માત્ર જૈનસાધુ પર કર્યા છે, બે કિસ્સા પણ જૈન દીક્ષાના રજૂ કરે છે. એ સૂચવે છે કે એમનું બીલ જૈન સાધુ પરના દેખપૂર્વક જૈન સગીર દીક્ષાને જ અટકાવવા માટે જ રજૂ થયું છે. એટલે જ એ અંગત આક્ષેપક બનીને તદ્દન અયોગ્ય ઠરે છે.

(૨૧) રાષ્ટ્રીય સ્વરાજ માટેની ચળવળ વખતે પ્રમાત્રફરી, પીકેટીંગ, સત્યાગ્રહ વગેરે કરવા માટે જો બાળકો સમજુ ગણાયા હતા, અને પોતાના શાળા શિક્ષણ વગેરેનો ભોગ આપીને પણ દેશસેવા કરવામાં યોગ્ય મનાયા હતા; તો દીક્ષાના પ્રસંગમાં સગીરને અણસમજુ કહી દેવા, એનું શોષણ થવાનું કહેવું, અને એની દીક્ષા અટકાવવી એ અત્યંત અનુચિત છે.

(૨૨) સરકારને નાના કે મોટા સંયમી, સદાચારી, અને નિસ્પૃહી લોકની સંખ્યા વધારવી ગમતી હોય તો શ્રી પત્વારીના સંન્યાસ દીક્ષા બીલને જરાય ટેકો ન આપે.

(૨૩) બાલ દીક્ષિતો સારા સાધુ પાકીને ગુણોપદેશ કરતા હોવાથી રાજ્યના કાયદા તત્ત્વના હેતુને સાક્ષાત્ સાધે છે.

(૨૪) દીક્ષિતો અને ઉપદેશકો વધવાથી સરકારી પોલીસ, કોર્ટો અને જેલખાનાને અંશે પણ રાહત મળે છે.

(૨૫) સંસ્કારનું ઘડતર બાળવયમાં સહેલાઈથી અને સારું થાય છે. આજ્ઞાધીનતાના ગુણીથી અને પાપના ભયથી બાળક એનું જલદી ગ્રહણ અને અમલ કરે છે. તેમજ એ પણ છે કે બાળકનું મન મોટાઓના જેવા બીજા ત્રીજા વિચારોથી પીડિત નથી, તેથી સાધુયર્યા અને સાધુવૃત્તિમાં જલદી પલોટાઈ જાય છે.

(૨૬) બાળકને પાપનો ડર જલદી લાગે છે, તેથી અકાર્યથી અટકે છે. તેમ શાસ્ત્રોને મુખપાઠ સારું કરી શકે છે. વહેલી દીક્ષા લીધાથી સાંસારિક પાપોથી વહેલો છૂટે છે. તેથી બાળ દીક્ષા વધુ ઈચ્છનીય છે.

(૨૭) બાળ દીક્ષિતો હુન્યવી દિણિએ પણ વધુ સુખી છે. કેમકે એને આ ત્યાગપૂજક ભારત દેશમાં જીવનની જરૂરીયાતો સહેલાઈથી અને સન્માન સાથે મળે છે. તેમજ શ્રીમંતો પણ એમને પૂજ્ય માની નમતાથી એમનો ઉપદેશ જીવે છે. ત્યારે વિષયભોગ કરતાં બ્રહ્મચર્યમાં એ અદ્ભુત નિર્વિકાર પ્રશાંત સુખ અનુભવે છે. પછી આમાં એનું શોષણ થવાનો શ્રી પત્વારીનો આક્ષેપ તદ્દન ખોટો છે.

(૨૮) આ બીલ લાવનાર શ્રી ધારાસત્ય બાળકોની અનહદ દ્યાથી પ્રેરાઈ સુવનભાનુ એન્સાઇક્લોપીડિયા-જૈન શાસનમાં ભાગવતી દીક્ષાનું સ્થાન (ભાગ-૧૮)

આ બીલ લાવી રહ્યા છે. એમ તેમના બીલ રજૂ કરતાં થયેલા ભાગણ પરથી સમજાય છે તો એની સામે એ વિચારણીય છે કે શું સાધુજીવન સ્વીકારતા બાળકમાં જ સર્વતઃ અનિષ્ટતા જન્મે છે? સાધુ-જીવનથી દૂર રહેલા બાળકો જ સર્વાંશે શું સુખી છે? દ્યાપાત્ર માત્ર આ દીક્ષા જેવા પવિત્ર જીવનને અપનાવતા બાળકો જ છે? કે દીક્ષા-જીવન નહિ સ્વીકારતા પણ ગરીબી, વ્યસનો, કુસંગ, હુર્ગુણોથી પીડાતા એવા ભારતના હજારો બાળકો પણ છે? અધિક અનિષ્ટતા સંન્યાસી જીવનમાં શું તેમને દેખાય છે, કે જેથી એ અનિષ્ટતા દૂર કરવા તે મેદાને પડ્યા છે?

(૨૮) વળી, આ કાયદાથી બાળદીક્ષા અટકાવી બાળકોની ઉન્નતિની શું તેમની પાસે એવી યોજનાઓ છે? કે જેથી તે બાળકો પોતાનું જીવન સર્વાંશે સુખી-શાંત અને પ્રસન્નપણે વીતાવી શકે? દીક્ષિત નહિ બનેલા અત્યારે લાખો બાળકો ભારતમાં છે, તેમના કલ્યાણની તેમણે શું શું યોજનાઓ કરી છે? શું શું સુખ પીરસ્યું છે? કથી કથી અનિષ્ટતાઓ દૂર કરી છે? શું નાના બાળકો વ્યસની ન બને તેનાં તાલીમ કેન્દ્રો તેમણે શરૂ કર્યા છે? નાના બાળકોમાં જૂઠ, ચોરી, વાસનાની ચેષ્ટાઓ વગેરેને સચોટ પગલાં ભરી અટકાવી છે? આવું કંઈ જ ન કરતાં, ઊલદું તેવું ઉચ્ચજીવન જીવવા તૈયાર થતા બાળકોને અટકાવવા એ તેમની ઉભરાતી દ્યા છે કે આધ્યાત્મિક ઉન્નતિમાં પથરા છે?

(૨૯) ભારતમાં પૂર્વભવથી સાધુ-સંન્યાસીઓની સંસ્થાનો દેશને ઉન્નત બનાવવામાં અદ્વિતિય ફાળો છે. તેમાં કંઈ પણ શંકા નથી. આવી લોકોપકારી સંસ્થામાં નાની ઉભરથી જ દાખલ થઈ સદાચારી તથા સંયમી જીવન ગાળવું, શાસ્ત્રોનો અભ્યાસ કરવો, યોગાદિવિષયોનું શિક્ષણ લેવું-તેને બાળપણાનો દુરુપ્યોગ થવાનું કહેવું તે અયુક્ત છે. દુરુપ્યોગ તો અસંયમ અને દુરાચારના માર્ગ જવામાં છે. નહિ કે સંયમ-સદાચારના માર્ગ જવામાં. એટલે યોગ્ય બાળકોને સંન્યાસ દીક્ષા લેતા અટકાવવા એ ન્યાયયુક્ત નથી.

(૩૦) મા-બાપ કે વાલીઓને પોતાના રક્ષણમાં રહેલા બાળકોને તેના કલ્યાણ માટે યોગ્ય લાગે તેવા બીજા જીવનમાં જોડવાનો અધિકાર છે, તો શું ધાર્મિક-જીવનમાં જોડવાનો અધિકાર નથી? અવશ્ય છે. તે અધિકારને કાયદાના બળે છીનવી લેવો તે એક પ્રકારનો જુલમ જ છે.

(૩૧) માનવ જીવનનું અંતિમ લક્ષ્ય પરમાત્મદશા પ્રાપ્ત કરવાનું છે અને એ લક્ષ્યને અનુસરીને પ્રત્યેક ધર્મો અને તે તે ધર્મોના પ્રચારકો ભારતમાં ચિરકાળથી આધ્યાત્મિક સાધનો ઉપદેશી રહ્યા છે. કોઈ આત્માઓ તે સાધનાને સાધતાં નિજનાં ભૂવનભાનું એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ” (ભાગ-૧૮)

૧૮૮

જીવન અજવાળી ગયા છે અને વર્તમાનમાં અજવાળી રહ્યા છે. આ સિદ્ધ હક્કિકતને કોઈ ભારતીય નહિ જ નકારે.

(૩૨) આ આધ્યાત્મિક સાધનાનું કેન્દ્ર છે સંન્યાસ જીવન-સાધુ જીવન, એ કેન્દ્રમાં પ્રવેશ નાની વયથી મળો તો સારા સંસ્કાર તેળવી શકે છે. પરંતુ “એ અદ્ધાર વર્ષની ઉભરથી નીચેના છે.” તેટલા માત્રથી તેના સાધના કેન્દ્રને તાળું મારવું તે તો જીતના સમજુપણાના ધમંતર્ભયું અને તદ્વાન અજ્ઞાનતાભર્યું પગલું ગણાય. સાધના એવી ચીજ છે કે જ્યાં કેટલીક વાર મોટા ન પણ જોડાય અને નાના જોડાય. ત્યાં સગીર વય માત્રથી સાધના પર અંકુશ ન મૂકવાથી બીજા સાધકોની ઉન્નતિ રૂંધાય છે, વિકાસ બંધ થાય છે.

(૩૩) પૂર્વના સંસ્કારથી જેમ બાળક વિવિધ ભૂમિકામાં જોડાય છે, તેમ બાલ્યકાળમાં જો યોગનું જીવન સ્વીકારવા તૈયાર થતો હોય અને ઉચ્ચ આધ્યાત્મિક તાલિમ લઈ ઇન્દ્રિયો તથા મન પર અંકુશ મૂકવાનો સુંદર-કલ્યાણકારી અભ્યાસ કરતો હોય, વળી આવા જીવને એ માર્ગ જવા દેવા માટે એના મા-બાપ ખુશી હોય તાં આ પ્રકારનો કાયદો આ વ્યક્તિ સ્વાતંત્ર્યના યુગમાં લાવવો તે લોકશાસનના સિદ્ધાન્તનો ભંગ કરનારો છે; અને યોગ્ય આત્માના હિતનો ઘાતક છે.

(૩૪) મા-બાપ બેદરકારીથી બાળકને ચોરીના ધંધામાં જવા દે એને શિક્ષા નહિ, પણ પવિત્ર સંન્યાસ ધર્મમાં જવા દે તો એને ત્રણ માસની સજા! આ કેટલું બેહુદું! પવિત્ર જીવન લેવરાવે કે લેતાને જોઈ ખુશ થાય, એમાં એનો ભયંકર ગુનો! અને જેલમાં જવું પડે!

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદધિ”

વર્ષ-૪, અંક-૧૪, તા. ૧૭-૧૨-૧૯૫૫



## બાળ સં. દીક્ષા પ્ર. બીલના ટેકેદારોનો પોકળ પ્રચાર પારકાં છોકરાંને જતી કરવાના આક્ષેપનો જવાબ

ઉપરોક્ત બીલના રજૂ કરનાર શ્રી પટવારી અને બીલના ટેકેદારોની મુખ્ય દલીલ ૧૮ વર્ષની ઉભર સુધીનો સગીર ગણાય છે માટે તે અજ્ઞાન છે અને તેથી તે ત્યાગમાં સમજે શું? આ પોકળ દલીલનો હું કંઈ જવાબ આપું તે કરતાં મુંબઈ રાજ્યના વડા પ્રધાન શ્રી મોરારજીભાઈએ સગીરની સમજણ સંબંધમાં જે કહ્યું છે

૨૦૦ ભૂવનભાનું એન્સાઈક્લોપીડિયા-જેન શાસનમાં ભાગવતી દીક્ષાનું સ્થાન (ભાગ-૧૮)

ઓટલું જ બીલની તરફેણ કરનાર વિચારે તો સીધા રસ્તે આવી જાય. માનનીય શ્રી મોરારજ્જભાઈ કહે છે, “સગીરનો અર્થ એવો નથી કે હમેશાં સગીર એટલે તે કે જે વસ્તુ સમજતો નથી.” આગળ વધીને તેઓ કહે છે, “એક સગીર પણ આપણા જેવા માણસો કરતાં વધારે વિશાળ બુદ્ધિ ધરાવી શકે છે. આ બાબત પૂર્વકર્મને આવિન છે તે આપણે ન ભૂલવું જોઈએ.” આવી સીધી ને સમજવા યોગ્ય હડીકતને જેઓએ જુદા રંગના ચ્યાન્સા પહેર્યા છે તેને ન સમજાય; એથી તેવાઓ કહે છે કે આવું તો કવચિત્ બને. બધાં બાળકો યાને સગીરો કંઈ એવી બુદ્ધિ ધરાવતા નથી. તો આની સામે કહી શકાય છે કે દીક્ષા પણ કયાં બધા બાળકો યાને સગીરો લે છે, એમાં પણ કવચિત્ જ કોઈ પૂર્વ કર્મના સંસ્કરના યોગે જ જન્મથી વિરાગી હોય છે. માનનીય શ્રી મોરારજ્જભાઈ પણ એથી જ કહે છે, “દુનિયાનું ભલું એવા બહુ થોડા જ માણસોએ કર્યું છે.” મુંબઈ પ્રાંતના વડા પ્રધાન શ્રી મોરારજ્જભાઈ આટલું ઊંચું જ્ઞાન અને વિચારણા ધરાવે છે તે માટે તેઓને અભિનંદન ઘટે છે. આધ્યાત્મિક વિષયમાં નિરરપણે સાચી વિચારણા રજૂ કરવા માટે હું તો તેઓને ધ્યન્વાદ આપું છું. આજાદ ભારત રાજ્યની નીતિ સમજાવતાં તેઓ કહે છે, “બીન સાંપ્રદાયિક રાજ્ય એટલે ધર્મનું વિરોધી નહિ અને ધર્મનું વિરોધી નહિ એટલે કેવળ ભૌતિક ઉન્નતિમાં જ પ્રજા સુખી માનનાર નહિ.” આ વિષે પણ તેમણે મુંબઈની ધારાસભામાં બાળ સંં દીક્ષા પ્રતિબંધક બીલ ઉપર તા. ૧૨-૯-પપ ના દિવસે બોલતાં કહ્યું છે, “કોઈ પણ ભૌતિક આબાદી વિના માણસ સુખી હોઈ શકે છે અને ભૌતિક આબાદી વિઘ્નમાન છતાં પણ માણસ હુઃખી હોઈ શકે છે.” વળી તેઓ કહે છે, “હું એવું પ્રતિપાદન નથી કરતો કે ભૌતિક આબાદી ખાત્રીથી મનુષ્યને સુખના માર્ગ દોરી જાય છે, પરંતુ જો ભૌતિક આબાદી ઉપર ભાર મૂકુવામાં આવે તો માનવજીતના ભાગ્ય વિષે હું ધ્યાન જ દીક્ષારી થાઉં.” સગીર ઉંમરમાં સંસાર ત્યાગ કરે તો એ બિચારો ઈદ્રિયસુખો, ભૌતિકસુખો અને સંસારના સુખો ક્યારે ભોગવશે ! અરે ! એ ભોગથી વંચિત રહી ગયો ! એવા વિષયાનંદી માનવોને સમજવા માટે શ્રી મોરારજ્જભાઈનું ઉપરનું વિધાન ખુબ જ ઉપયોગી છે. વિધાનના ટેકામાં તેઓશ્રી કહે છે, “કેમકે માનવ અને પણ જગત વચ્ચે ધારું જ થોડું અંતર રહેશે. પણ કરતાં માનવ ઊંચો શાથી ? તેનામાં સાચું અને ખોઢું પારખવાની વિવેકશક્તિ છે માટે. સંસાર-સુખમાં જેઓ ગળાખૂડ તુલેલા છે તેઓને આવી ઉચ્ચ વિચારણા આવે જ ક્યાંથી !” સગીર એટલે બધી બાબતમાં અજ્ઞાન તથા ભૌતિક આબાદીમાં જ માનવ સુખી એ બંને માન્યતા માનનીય શ્રી મોરારજ્જભાઈના ઉપરોક્ત વિધાનોથી મુદ્દલે ટકી શકતા નથી. બાળ સંં દીક્ષા

બીલના ટેકેદારોની સગીરને તેના વાલીની સંમતિ વિના દીક્ષા આપી દેવામાં આવે છે તે પ્રચાર તો બીનપાયાદાર દરી ચૂક્યો છે અને બીલ રજૂ કરનાર શ્રી પટવારી પણ આવા કોઈ ગુંડા બદલ સાધુને સંજી થયાનો નક્કર પુરાવો રજૂ કરી શક્યા નથી. હવે શ્રી પટવારીએ “પારકા છોકરાંને જતી કરવાનું સૌને ગમે” એવી જે વાત બીલના સમર્થનમાં કરી છે, તેને વિચારીએ.

મને તો લાગે છે કે શ્રી પટવારીએ રજૂ કરેલ આ ઉક્તિ દુનિયાના મોટા ભાગના લોકો આત્માના વિકાસ માટે ચિંતા યા કાળજી સેવનારા હશે તે સમયે પ્રચયિત બની હશે ? કારણ કે તેઓને મોક્ષનો રાજમાર્ગ સંસારનો ત્યાગ જ હોય તેની પ્રતિતિ હોય છે, એટલે તેઓ સંપૂર્ણપણે મોહથી છૂટેલા નહીં હોવાથી જ્યારે તેમના પોતાના અંગત સગાં-સંબંધી દીક્ષા લેવા નીકળે ત્યારે રાજ્યપો ન રાખી શકતા હોય એ બનવાજોગ છે, પરંતુ જ્યાં તેવા પ્રકારની મોહાવિન સ્થિતિ ન હોય ત્યાં તો એક સજજની રીતિ-જીતિ પ્રમાણે બીજા કોઈ પુણ્યશાળી દીક્ષા લે તો બધા તેમાં પૂરો ભાગ લે, પણ આજની દુનિયાના મોટા ભાગના માણસોની માનસિક સ્થિતિ જુદી દેખાય છે. આજે તો કોઈ ઊંચે ચઢે તો તેને ધસીને નીચે નાંખનારા પરોપકારીઓ ઘણા નીકળી આવ્યા છે.

ધારાસભાની જે બેઠકમાં શ્રી પટવારીનું આ બીલ રજૂ થયું હતું તે વખતે હાજર રહેલા માનનીય ધારાસભોમાંથી વધુ સંભાસે બીલના ટેકામાં ભાષણો કર્યાનું જણાય છે, આ ભાષણો યોગ્ય છે કે કેમ ? તેમાં બીલના સમર્થનમાં કરવામાં આવેલી દલીલો કેટલે અંશે ખરી છે ? એની ચર્ચા બીજા સમય ઉપર રાખીએ, પરંતુ એક વાત તો ચોક્કસ છે કે આમાંના કોઈ ધારાસભ્યના સગીર પુત્ર કે પુત્રીએ દીક્ષા લીધી નથી કે લેવા નીકળ્યા નથી, એટલે કે બધા પારકા છોકરાં-છોકરી દીક્ષા લેવા નીકળે છે તેમને અટકાવવા માટે પ્રતિબંધક કાયદો કરવાની તરફેણ કરે છે. પારકો છોકરો સંસાર-ત્યાગ કરે તેમાં પણ રાજ થવાને બદલે તેઓ નારાજ થાય છે અને ખોઢું થાય છે એમ માને છે. આ ઉપરથી તો શ્રી પટવારીનું “પારકા છોકરાને જતી કરવાનું સૌને ગમે” એ વિધાન ભોગાસક્ત દુનિયા માટે સત્ય હરતું નથી અને જેનું કારણ અભાવિત ન હોય તો તેનું કાર્ય યોગ્ય એટલે મજબૂત-ન્યાયપૂર્ણ ક્યાંથી હોય ! શ્રી પટવારીને મારી તો હજુ પણ જાહેર ભલામણ છે કે તેઓ આ સંબધમાં ઊંડા ઉત્તરી વિચાર કરે. મારા છેલ્લા ૨૮ વર્ષના અનુભવી શ્રી પટવારીજીને અને આ બીલને ટેકો આપવાની જેઓ ભૂલ કરી રહ્યા છે તેઓને હું જ્ઞાનવું છું કે જેઓ એક સમયે બીજાને ત્યાગમાર્ગ જતા જોઈને રાજ થતા હતા અને થાય છે, તેઓમાંના જ મોટા ભાગના ગૃહસ્થોએ, બહેનોએ પોતે અથવા

તેમના પુત્ર-પુત્રીઓએ, ભાઈ-બહેનોએ અને કુટુંબીજનોએ ભાગવતી દીક્ષાઓ અંગીકાર કરી છે, કરે છે અને કરશે. આ સ્થળે એ બધાં નામ-ઠામ બહુ લખાણ ન થઈ જાય તેથી હું રજૂ કરતો નથી, પરંતુ શ્રી પટવારીજ તે જાણવાની ઈચ્છાથી મને પૂછાવશે તો તેમને જણાવીશ. ‘સુશેષુ કિં બહુના’

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદધિ” વર્ષ-૪, અંક-૧૫, તા. ૨૪-૧૨-૧૯૫૫

મુંબઈ વિધાન સભામાં તા. ૮-૮-૧૯૫૫ ના રોજે શ્રી પટવારીએ રજૂ કરેલ  
“બાલ-સંન્યાસ દીક્ષા પ્રતિબંધક બીલ” ઉપર



## પ્રધાનમંત્રી શ્રી મોરારજુભાઈ દેસાઈએ કરેલું ઐતિહાસિક ભાષણ

સાહેબ,  
અતિવિધાન :-

કોઈ બીલ અથવા ઠરાવની ચર્ચામાં આટલું વહેલું વચ્ચે પડવું એ મારે માટે જરા અસાધારણ છે. પરંતુ આ એક અસાધારણ બાબત છે તેથી માનવંતી સભાની સમક્ષ આના સંબંધમાં કેટલાક મુદ્દાઓ મૂકવા મારે જરૂરી છે, કે જેથી આ બીલ બાબતની વિચારણા આવેશરહિત અને યોગ્ય રીતે થઈ શકે. મારા માનવંતા મિત્ર શ્રીયુત્પત્ત પટવારીએ પોતાના પક્ષને ભારપૂર્વક રજૂ કર્યો છે. પરંતુ મને એ ભય છે કે તેમણે કેટલીક બાબતોમાં અતિવિધાન કર્યા છે અને સારા હેતુ માટે પણ અતિવિધાન (વધુ પડતું કહેવું) એ એક જોખમી પગલું કહી શકાય. આ સુધારાને આપણે એના યોગ્ય દાખિલાથી વિચારવો જોઈએ.

પ્રશંસનીય ઉદ્દેશ, પણ માંગણી હિતમાં કે અહિતમાં ?

આ બીલને લાવવા માટેની મારા માનવંતા મિત્રની પ્રવૃત્તિને હું એટલા માટે વખાણું હું, કેમકે હું ધારું હું કે નાના બાળકોનું કોઈ પણ રીતે શોષણ ન થઈ જાય એક એક એમની ઈચ્છા છે. ખરેખર, આ તેમનો ધારો જ પ્રશંસનીય ઉદ્દેશ છે. પ્રશ્ન એ ઉપરિથિત થાય છે કે તેમણે કરેલી માંગણી સમગ્ર રાજ્યના ખરેખર હિતમાં છે ? કે તેના હિતની વિરુદ્ધમાં છે ? મારે એ સ્વીકારવું જોઈએ કે આ

વિષયમાં સરકાર પોતાનો નિર્ણય કરી શકી નથી. કારણ કે આ ઘણી મુશ્કેલી ભરી બાબત છે. જો આ સુધારો કેવલ સામાજિક જ હોત તો મારો નિર્ણય કરી લેતાં હું જરા પણ અચકાત નહિ. પરંતુ આ સુધારો ખરેખર કેવલ સામાજિક સુધારો નથી જ, કિન્તુ એ સુધારો ધાર્મિક પણ છે.

સુધારો વધારે ધાર્મિક છે :- વળી એ સુધારો સામાજિક કરતાં પણ વધારે ધાર્મિક છે. એક ક્ષણ માટે હું એમ નથી કહેવા માગતો કે, જે કંઈ ધર્મના નામે કહેવાય તે બધું ધાર્મિક જ હોય. પરંતુ જો સંસારનો ત્યાગ એ ધાર્મિક બાબત ન હોય તો કોઈ પણ બાબત ધાર્મિક દાણીએ ધાર્મિક રહે જ નહિ. તેથી હું કહું છું કે સાંસારિક જીવનના ત્યાગનો પ્રશ્ન એ ધાર્મિક વસ્તુ છે અને તેનો તે જ રીતે વિચાર થાય જોઈએ. પરંતુ એ બાબત એક સામાજિક સુધારો પણ બની શકે છે. કેમકે તે બાળકોને લગતો છે.

બધે સંસાર ત્યાગ વિનાળો નથી હોતો :-

જો પુખ્ત ઉમરના માણસો વડે કરાતા સંસારત્યાગ પરત્વે કોઈ પણ જાતનું નિયંત્રણ માગવામાં આવ્યું હોત તો એવી ચળવણનો વિરોધ કરવામાં હું જરા પણ અચકાયો ન હોત; કેમકે હું નથી માનતો કે સંસારનો ત્યાગ કરતા આવા કોઈને પણ તે લાગણીવશ થઈને તેમ કરે છે, પરંતુ યોગ્ય વિચારણાથી નહિ’ એવા ઓઠા હેઠળ કોઈ તેના સંસારત્યાગને અટકાવે તે યોગ્ય કે ઉપયોગી ગણાય. પરંતુ જ્યારે તે બાળકો સાથે સંબંધ ધરાવે છે ત્યારે તો તે ખરેખર ! એક વિચારણીય બાબત બની જાય છે.

આ કાયદાથી સુધારાનો ઉદ્દેશ પ્રાપ્ત થશે ? : બીલના વિરોધમાં વધારે તારો :-

તેથી જ મારા માનવંતા મિત્રના ઈરાદા માટે એક બાજુ મને ધારો જ આદર છે, ત્યારે બીજી બાજુ હજુ સુધી મને જાતી નથી કે જો આ બીલ કાયદો બને તો તે સુધારો યોગ્ય માર્ગ થશે અને આ કાયદાના સાધનથી આપણે તે ઉદ્દેશને પ્રાપ્ત કરી શકીશું. તેથી જ સરકારે આ સંઘળીય બાબત ખૂબ જ સાવધાનીપૂર્વક વિચારી છે અને તે એવા નિર્ણય ઉપર આવી છે કે આ વિષયમાં જનતાનો મત યોગ્ય રીતે મેળવી લેવો એ વધુ ઠીક છે. આ બીલ પર જનતાનો અભિપ્રાય કેટલેક અંશે દર્શાવામાં આવ્યો છે. આ બીલની તરફેણામાં અને વિરુદ્ધમાં બંને પ્રકારના તારો મળતા રહ્યા છે. જેમાંના બીલની તરફેણ કરતાં વિરોધમાં વધારે તારો છે.

મહત્વની વસ્તુનો નિર્ણય લાગણીના ઉશ્કેરાટ ઉપર નહિ થાય :-

આ બીલની બાબતમાં જાહેર સભાઓ પણ યોજાઈ છે, પરંતુ મારા મતે આ વિષયમાં કે બીજા કોઈ પણ વિષયમાં જાહેર સભાઓ એ કંઈ માપક યંત્ર નથી,

નિશ્ચયાત્મક ધોરણ નથી; કારણ કે સભાઓ તો યોજુ શકાય છે, પરંતુ માત્ર સમાચાર-પત્રોમાં એવું છપાય છે કે અમુક સ્થળે એક મોટી જાહેર-સભા યોજાઈ હતી. હું ધૂં ધૂં ધૂં કોઈ પણ મહત્વની વસ્તુનો નિર્ણય જનતાની લાગણીના ઉષ્ણેરાત ઉપર કરી લેવો ન જોઈએ. તે તેના યોગ્ય દાખિબિદુથી જ વિચારવો જોઈએ. અભ્યાસપૂર્ણ અને ગણતીપૂર્વકની લોકલાગણી અને સમૂહ માનસશાસ્ત્રની જગઠેલી લાગણી વચ્ચે હું તફાવત સમજુ ધૂં, જો તમે સમૂહ માનસશાસ્ત્ર પ્રમાણે ચાલશો તો આગળ વધવું જોખમકારક બનશો. ત્યારે

**અભ્યાસપૂર્ણ ઘડાયેલા લોકમતને અવગણાય નહિ, સરકાર બીલનો છેવટનો સ્વીકાર કરતી નથી :-**

અભ્યાસપૂર્ણ અને ગણતીપૂર્વકના લોકમતને તરણેડી કાઢવામાં પણ જોખમ રહેલું છે; અને એથી જ સાહેબ, આપણે ધારીએ છીએ કે આ બીલ ઉપર લોકોનો વ્યવસ્થિતપણે ઘડાયેલો મત મેળવવો એ વધુ સારું રહેશે અને જ્યાં સુધી બીલ પ્રથમ વાંચનામાંથી પસાર કરવામાં ન આવે ત્યાં સુધી આ વસ્તુ બની શકે નહિ. તેથી જ સરકાર પ્રથમ વાંચન વખતે બીલનો વિરોધ કરવા માગતી નથી. પરંતુ તેનો અર્થ એવો નથી થતો કે સરકાર આ બીલનો છેવટનો સ્વીકાર કરવા માગે છે. આ હકીકત મારે પ્રથમથી જ આ તબક્કે સ્પષ્ટ કરી દેવી જોઈએ.

**બધા ધર્મ જોતાં દીક્ષાવિધિનો કેટલોક દુરુપ્યોગ થયો છે :-**

સાહેબ, એમાં શંકા નથી કે દીક્ષાવિધિના કેટલાક કિસ્સાઓમાં તેનો દુરુપ્યોગ કરવામાં આવ્યો છે. હું આ બાબત માત્ર કોઈ એક ધર્મને અનુલક્ષીને કહેતો નથી. હું ખરી રીતે સર્વધર્મને એટલે કે જે ધર્મોમાં બાલદીક્ષાની ધૂટ છે (બાલદીક્ષા માન્ય કરેલી છે) તે બધા ધર્મોને અનુલક્ષીને કહું ધૂં. એવા કેટલાક ધર્મો છે કે જેમાં બાલદીક્ષાનો નિષેધ નથી. પરંતુ આપણે તે પ્રશ્ન પહેલો વિચારી લેવો જોઈએ કે બાળક સંસારનો ત્યાગ કરે એ દરેક પ્રસંગમાં અનુચ્છિત જ માની લેવું કે કેમ ?

**જો કર્મસિદ્ધાંત માનીએ તો પૂર્વસંસ્કારી બાળની દીક્ષા અટકાવવી વ્યાજબી નથી :-**

જો આપણે કર્મના સિદ્ધાંતમાં માનતા હોઈએ તો તે બાળકનાં સંસારત્યાગના વિષયમાં કોઈ પણ અટકાયત વ્યાજબી હોઈ શકે નહિ. જે બાળક આ જીવનમાં તેવા પૂર્વ-સંસ્કારો સાથે આવેલ હોય. આપણી પાસે લોકોના એવા અનેક જીવલંત ભબ્ય ઉદાહરણો છે કે જેમાં એમણે પોતાના ઉગતા બાલ્યકાળમાં સંન્યાસ કે દીક્ષા લીધી હોય. મારા માનવંતા મિત્ર કહે છે કે આવા પ્રકારના ઉદાહરણો ધણા જ થોડા મળે છે.

**જગતનું ભલું બહુ થોડા જ લોકે કર્યું છે : સંસારત્યાગી પણ મોટી સંખ્યામાં ન હોય :-**

પણ હું તેમને કહી શકું કે આ જગતનું ભલું કર્યું હોય તેવા માણસો પણ ધણા જ થોડા છે. એ ક્ષેત્રમાં કોઈ એકાદ જ એવી વ્યક્તિ હોય છે કે સમગ્ર જગતમાં કાન્નિકારી ફેરફાર કરી શકે છે. જો આવી વ્યક્તિઓ સંખ્યાબંધ હોય તો તે એટલી બધી અસરકારક બની શકે નહિ. તે જ રીતે જગતનું ભલું ધણી જ થોડી વ્યક્તિઓએ કર્યું છે, નહિ કે અનેક વ્યક્તિઓએ. વળી સંસાર ત્યાગ કરનાર લોકો મોટી સંખ્યામાં હોઈ શકે નહિ, તેથી આ રીતે ‘જગતનું ભલું બહુ થોડા લોકો જ કરી શક્યા છે’ એવી દલીલ કરવી એ યોગ્ય નથી. એટલે મારે ફક્ત આ વિષયમાં થતા દુરુપ્યોગના સવાલ પર જ વિચાર કરવો રહ્યો. જો બાલદીક્ષા થોડા પણ કિસ્સાઓમાં મને લાભદાયી દેખાય તો મારે મારું ધ્યાન તેના થતા દુરુપ્યોગને માત્ર અટકાવવા તરફ દોરવું જોઈએ, પણ નહિ કે આખી પ્રથાને જ સંદર્ભ અટકાવવા તરફ. આ જ રીતે આના પર વિચારણા થવી જોઈએ.

**જુના કાયદા અપહરણ તો અટકાવે જ છે. રાજી માબાપને કાયદાથી રોકાય ? :-**

ગમે તેમ પણ હાલ મોજુદ કાયદાઓ બાળકોનું કોઈ પણ રીતે અપહરણ થતું અથવા તો માતાપિતાની ઈચ્છા વિરુદ્ધ ઉપાડી જવાનું અટકાવે જ છે, પરંતુ જે માતાપિતા પોતે જ પોતાના બાળકોને સૌંપી દેવા તૈયાર હોય તો તે વખતે “માતાપિતાને હું તેમ નહિ કરવા દઉં” એવું કહેવું એ મારે માટે યોગ્ય છે કે કેમ તે હું જાણતો નથી. જો કે હું એ કબુલ કરું ધૂં કે અમુક સંયોગોમાં રાજ્યને દરમ્યાનગીરી કરવી પડે છે. ધારો કે કોઈ માતાપિતા પોતાના બાળકને ચોરી કરવા માટે કે ભીખ માગવા માટે અથવા તો કોઈ બીજા એવા ચુન્દા માટે ઉપયોગમાં લેવાનો પ્રયત્ન કરે, તો તે માતાપિતાને તેમ કરતાં હું બેલાશક અટકાવું; અને જો તેમ કરવામાં ન આવે, તો રાજ્ય પોતાની ફરજમાંથી અવશ્ય ચૂકે છે.

**બાળક પ્રત્યે માબાપ ઉપરાંત રાજ્ય અને સમાજની પણ ફરજ છે :-**

એવું નથી કે બાળકો પ્રત્યે માત્ર માતાપિતાના માથે જ ફરજ છે, કિન્તુ રાજ્ય અને સમાજની પણ બાળકો પ્રત્યે ફરજો છે જ; જો તેમ ન હોય તો સમાજનો કંઈ જ અર્થ નથી, રાજ્યનો પણ કંઈ અર્થ નથી. આપણે રાજ્યને એટલા માટે સ્થાપ્યું છે કે વ્યક્તિઓ પોતાનું સંરક્ષણ જાતે કરી લેવા શક્તિમાન નથી, તેમજ જેઓ સમાજના નિયંત્રણથી દ્બાતા નથી તેવા માણસોને દ્બાવવા માટે રાજ્ય સિવાય બીજો કોઈ માર્ગ નથી, તેથી જ રાજ્ય એ આવશ્યક વસ્તુ છે.

વડીલ તરીકેની પોતાની ફરજી બજાવવાને અયોગ્ય એવા પણ કેટલાક માતાપિતાઓ છે, એ વાતનો આપણે ઈન્કાર નહિ કરી શકીએ.

### અયોગ્ય માબાપનો કાલ્યનિક દાખલો :-

તહુપરાંત કોઈ માબાપ એવાય નહિ હોય કે જે પોતાના બાળકોને દીક્ષા માટે દૂરવર્તી હેતુઓને લઈને સોંપત્તા નહિ હોય તેમ પણ હું નહિ કહી શકું. વળી એવા પણ કેટલાક માતાપિતા હશે જેઓ, પોતાના એક બાળકને દીક્ષા લેવામાં સંમતિ એટલા માટે આપત્તા હોય કે જેથી બીજા બાળકો પોતાના વારસાનો હક કરી શકે. આવા દાખલાઓ અનેક હોઈ શકે છે. હું તો અત્રે આ એક જ દાખલો આપું છું. આ દાખલો માત્ર કાલ્યનિક છે. એવો કોઈ બની ગયેલો દાખલો મારી પાસે નથી; પરંતુ એવા પ્રસંગો આકસ્મિક રીતે બની જવાનો સંભવ હોઈ શકે છે. તેથી તેવી વસ્તુ કેમ અટકાવવી તે આપણે વિચારવાનું છે.

આ દેશની પરંપરામાં સંસારત્યાગીઓએ આ દેશનું મહાન ભલું કર્યું છે :- પરંતુ સાથે સાથે જેમ મેં કહું તેમ આ દેશની એક પરંપરાગત વસ્તુ છે કે સંસારનો ત્યાગ કરીને જેઓ સંન્યાસનો સ્વીકાર કર્યો છે, તેઓએ આ દેશનું મહાન ભલું કર્યું છે. વસ્તુસ્થિતિએ આ દેશની સંસ્કૃતિ સંન્યાસ ધર્મના સિદ્ધાંતના પાયા ઉપર રચાયેલી છે.

**શ્રી આર.એસ. બેદ્ઝીકર :-** એવું નથી કે બધા સંન્યાસમાં લાગી ગયા છે.

**શ્રી મોરારજ્ઞભાઈ દેસાઈ :-** એ બરાબર છે, પરંતુ ધર્મનું પ્રતિપાદન તેઓએ જ કર્યું છે, કે જેમણે સંસાર ત્યાગ કર્યો હોય છે. કેટલાક સંસારી માણસોએ પણ પોતાનો ઘણો ફાળો આપ્યો છે, એમ છતાં સામાન્ય રીતે ધર્મનું પ્રતિપાદન સાંસારિક માણસોથી થયું નથી. જો આ બાબત આમ જ હોય તો હું ચોક્કસ કહીશ કે તેની વિચારણા વધારે ધીરજથી અને વધારે કાળજીપૂર્વક કરવી આવશ્યક છે. બસ, આ સંબંધમાં મારે જે કાંઈ કહેવું છે, તે આટલું જ છે.

**ધર્મ એ માનવજીવનનો અર્ક છે :** બધા સંપ્રદાયોથી ઉપદેશાયેલો, તે ધર્મ :- હું માનું છું કે ધર્મ એ માનવજીવનનો અર્ક છે અને તેથી જ હું પોતે આ સત્યનો ઈન્કાર કરી શકતો નથી. અહીં હું કોઈ અમુક ધર્મને નામથી સ્પર્શિતો નથી. ધર્મનો અર્થ હું માનવતાનો ધર્મ કરું છું. જેને ખરેખર બધા જ ધર્મપંથોએ, સંપ્રદાયોએ ઉપદેશ્યો છે. હું માનું છું કે હાલમાં જે રીતે ધર્મ આચરવામાં આવે છે તે તો સંપ્રદાય છે; પણ ધર્મ નથી. ધર્મ તો માત્ર એક જ હોઈ શકે અને ધર્મ તેજ છે કે જે બધા સંપ્રદાયો વડે ઉપદેશાયો છે. બીજી બધી વસ્તુઓ તો તે સંપ્રદાયોના અનુસર્જનો છે.

**મૂળભૂત ધર્મના આચરણ વિના માનવ એ માનવ નથી :-** જ્યાં સુધી માનવ એ મૂળભૂત ધર્મને આચરતો નથી ત્યાં સુધી માનવ માનવ બની શકતો નથી. જો તમે માનવમાંથી ધર્મને ઉપાડી લો તો માનવ અને પણ વચ્ચે કોઈ તફાવત રહેતો નથી. ઈશ્વરની માન્યતા સાથે સંબંધ ધરાવનાર ધર્મ અને સત્યમાં શ્રદ્ધા રાખવાનું કહેનાર ધર્મ વચ્ચે હું ભેદ પાહું નહિ. હું એમ નથી કહેતો કે ઈશ્વરને માનનારો જ માણસ ધાર્મિક છે અને તેને નહિ માનનારો ધાર્મિક નથી. તેટલી હદે ધર્મની વ્યાખ્યા હું સંકુચિત કરું નહિ. છતાં એટલું ચોક્કસ છે કે જ્યાં સુધી માણસને આવી કોઈ વસ્તુમાં શ્રદ્ધા ન હોય, ત્યાં સુધી સંઘળા સંયોગમાં સત્યને વળગી રહેવું એને માટે શક્ય નથી. અને હું સમજું છું ત્યાં સુધી.

**સત્ય કે ઈશ્વરમાં શ્રદ્ધા,** એ આ દેશની સંસ્કૃતિનો પાયો :- આ બાબત આ દેશની સંસ્કૃતિના પાયારુપ છે. સંભવ છે લોકો કદાચ મારી સાથે સંમત ન પણ થાય. તેઓ કદાચ મને ખોટો પણ ગણે. અને હું કદાચ ખોટો પણ હોઉં. હું એવો દાવો નથી કરતો કે હું જે કહું છું તે સત્ય જ છે, અને સત્ય સ્થિતિ બીજું કાંઈ નથી. હું તો આ અભિગ્રાય ધરાવું જ છું અને તેથી જ તેને આ માનનીય સભાગૂહ સમક્ષ મુકું છું, જેથી તેના ઉપર વિચારણા થઈ શકે.

**સત્ય અને ઈશ્વરની શ્રદ્ધાની સંસ્કૃતિમાં સંસારત્યાગને રોકવો શું ન્યાયી છે ?** સગીર એટલે સદા અણસમજું નહિ :- જો મારી વિચારણા મુજબ જ વસ્તુસ્થિત હોય અને જો લોકોને સંસારનો ત્યાગ કરવો હોય તો તેમને તેમ કરતાં અટકાવવા એ શું કોઈ સરકારને માટે ન્યાયી ગણાય ? સગીરનો અર્થ એવો નથી કે હંમેશાં સગીર એટલે તે કે વસ્તુ સમજતો નથી. સગીરનો અર્થ એટલો જ છે કે “જે ૨૧ વર્ષની ઉમરની અંદરનો હોય,” જો તેવા કોઈને સંસારત્યાગ કરવો હોય અને તેમ કરવાનો તે આશ્રહ રાખતો હોય તો તેને તેમ કરતા અટકાવવો એ શું સરકાર માટે ઉચિત છે ? કદાચ અટકાવવો તોય તેઓ જગતને છોડી દેશ અને બીજે ક્યાંય ચાલ્યા જશે. તો એવાઓને કઈ રીતે અટકાવી શકાશે ? અને જગતમાં આવા લોકોનો અટકાવવા આપણે શક્તિમાન થયા નથી. આવા લોકોને અટકાવવાના પ્રયત્ન કરાયા છે. સંસાર ત્યાગ કરીને બહાર ચાલ્યા જતા બુદ્ધને અટકાવવાનો પ્રયત્ન થયો હતો, છતાં એ તેમ કરતાં રોકી શકાયા નહિ.

**ત્યાગી બનવામાં સગીરતાનો પ્રશ્ન નથી;** સગીર પણ વિશાળ બુદ્ધિ ધરાવી શકે છે :- ત્યાગી બનવામાં સગીર હોવાનો પ્રશ્ન નથી. એક સગીર પણ આપણા જેવા માણસો કરતાં વધારે વિશાળ બુદ્ધિ ધરાવી શકે છે. આ બાબત પૂર્વકર્મને પણ આધીન છે, એ આપણે ન ભૂલવું જોઈએ. આ જગતમાં બાલવિભૂતિઓ પણ

થયેલી છે. આપણી પાસે આવાં બધાં ઉદાહરણો છે. આપણે એમ નહિ માનવું જોઈએ કે આપણે વધારે વર્ષો કાઢ્યા તેથી આપણે વધુ ડાખ્યા છીએ. ઊલદું, જેમ જેમ આપણે મોટા થતા જઈએ છીએ તેમ તેમ કદાચ આપણે ઓછા ડાખ્યા બનતા હોઈએ છીએ; આ હકીકત કેટલીક બાબતોમાં સત્ય પણ હરે છે. બધી બાબતોમાં કાંઈ તે સત્ય હરી શકે નહિ અને તેથી તેવા પ્રકારનો અહંકાર શા માટે રાખવો? આ ઉપરથી મારે કહેવાની ભત્તલબ એ નથી કે દરેક બાળક વધારે સારું છે અને દરેક બાળક તે સમજ શકે છે. મારો આશય જરાય એવો નથી. મારી સમજ પ્રમાણે આવાં બાળકો ઘણાં જ થોડાં છે. અને છતાં,

**સમજું બાળકને પોતાનો માર્ગ જતા અટકાવવામાં પ્રગતિ અટકી જશે :-** જે તેમનો આંતર પોકાર રોકી શકાય એવો નહિ હોય અને તેમને તેમના પોતાના માર્ગ નહિ જવા દેવામાં આવે તો તેમની પ્રગતિ અટકી જશે. આ પોકાર અપરિહૃદ્ય છે કે નહિ એ ખૂબ જ કાળજીબરી વિચારણા માર્ગી લે છે. હું તે ચોક્કસ માન્ય કરીશ જ. આપણે તે માટે કોઈ માર્ગ શોધી શકતા હોઈએ તો તેવો માર્ગ શોધી કાઢવામાં સમ્મત થનારાઓમાંનો ખરેખર હું એક અવશ્ય હોઈશ.

સાચા ધાર્મિક જીવનને સ્વીકારતા સગીરને પણ રોકવાનું હું પસંદ ન કરું. આધ્યાત્મિક સ્વતંત્રતા એ પ્રજાશાસનનો અર્ક છે :- પરંતુ સાચા જ અર્થમાં ધાર્મિક જીવનને પુખ્તવયની કે સગીર વયની કોઈ પણ સ્વી કે પુરુષ વ્યક્તિને સ્વીકારતી રોકવાનું કોઈ પણ પગલું ભરવાનું હું પસંદ ન કરું. નહિ તો પછી આપણી માનવતા વિકૃત બનેલી ગણાય. જો આપણે લોકોને આધ્યાત્મિક બાબતોમાં કોઈ પણ રીતે સ્વાતંત્ર્ય ન આપીએ તો પછી સ્વાતંત્ર્ય ક્યાં રહેશે? આપણે તો પ્રજાશાસનની વિચારણા કરીએ છીએ. પ્રજાશાસનનો અર્ક સ્વતંત્રતા છે અને તે પણ ખાસ કરીને માનસિક સ્વતંત્રતા છે. આનો અર્થ એ નથી કે એક ક્ષાણભર હું એ વાતનો સ્વીકાર કરી લઉં હું કે આ બીલ બંધારણમાં મુકરર કરાયેલા મૂળભૂત હકોનો ભંગ કરનાર બનશે. મને તેવી કોઈ ભ્રમણા પણ નથી. હું તેવા દાખિબિન્દુથી એટલે કે આધ્યાત્મિક અને ભૌતિક બાબતના દાખિબિન્દુથી હું દલીલ કરતો નથી અને આપણે એવું તો ન કહી શકીએ કે આપણે આધ્યાત્મિક બાબતોમાં માનતા નથી. માટે આધ્યાત્મિક બાબતને આપણે લક્ષમાં ન લેવી જોઈએ. આ માનવંતા સભાગૃહમાં આપણને તેની સાથે લાગતું-વળગતું નથી, કેમકે આપણે એક બિનધાર્મિક રાજ્યમાં છીએ.

**રાજ્યમાં બિનધાર્મિક એટલે અધ્યાત્મ વિરોધી નહિ :-** પરંતુ બિનધાર્મિક રાજ્યનો એ અર્થ નથી કે તે આધ્યાત્મિક વિરોધી છે, અથવા તે ફક્ત ભૌતિક છે.

ઊલદું, બિનધાર્મિક રાજ્યનો અર્થ એ છે કે ધર્મમાં માથું મારે નહિ અને જો આ બિલ ખરેખર ધર્મમાં દાખલ કરનાર બનતું હોય તો હું બેધડક કહીશ કે આવું પગલું ભરવું વ્યાજબી નથી. આ બિલ ધર્મમાં ખરેખર દખલ કરે છે કે કેમ એ બાબતમાં હજુ મને ખાત્રી નથી. આ બિલની વિચારણા ખૂબજ કાળજીપૂર્વક થવી જોઈએ. એટલે જ કે આ બિલ સંબંધી મારી વિચારણા હજુ સુધી સ્પષ્ટ નથી. મારે જે કહેવાનું છે તે આ જ છે. આ એવી વસ્તુસ્થિતિ નથી કે જેને સ્વીકારતાં મારે અભિમાન લેવું જોઈએ, પણ આ એક હકીકત છે જે મારે સ્વીકારવી જોઈએ. “હું ગુંચવાતો નથી” તેવું હું હંમેશા નહિ કહી શકું. પરંતુ જો “હું ગુંચવાયો છું” એમ સ્વીકાર કરું તો હું પ્રકાશને અવશ્ય જોઈશ. પરંતુ ગુંચવાયા છતાં જો હું ઈન્કાર કરું તો હું હંમેશા ગુંચવાયેલો જ રહીશ. તેથી જ આ બાબતમાં વધુ પ્રકાશ મેળવવો મને અવશ્ય પસંદ છે, કે જેથી બિલની ગુણવત્તા ઉપર અને આવા કાયદા ઘડવાની જરૂરિયાત ઉપર હું નિર્ણય લઈ શકું.

**કાયદો ઘડતાં જોવું જોઈએ કે એ અમલી બનશે ? :-** બીજી બાબત એ છે કે કોઈ પણ કાયદો ઘડતી વખતે, એ અમલી બનશે. કે કેમ તેનો પણ વિચાર અવશ્ય કરવાનો હોય છે. એવી એક દલીલ કરવામાં આવી હતી કે આપણે, એક પત્નીપત્રનો કાયદો હિંદુઓ માટે ઘડ્યો છે અને તેવો કાયદો ઘડનારા માત્ર આપણે જ હતા, પરંતુ જ્યારે આપણે તે કાયદો ઘડ્યો ત્યારે આપણને એ ખાત્રી જ હતી કે આપણે તેનો અમલ રાજ્યમાં કરાવી શકીશું; તદ્વપરાંત આપણને એ પણ ખાત્રી હતી કે ભારત સરકાર પણ વહેલી કે મોડી તે કાયદો ઘડવાની જ છે. પરંતુ આ એક એવી બાબત છે કે જે ટાળવી બહુ સુગમ છે અને તેથી અસરકારક રીતે તેનો અમલ કરાવી શકીશું નહિ. મને જે લાગે છે તે આ છે. ગમે તે માણસને રાજ્યની બહાર લઈ જઈ શકાય અને દીક્ષા આપી શકાય તેની સામે કોઈ પ્રતિકાર રહેશે નહિ. આગળ ઉપર તે માણસ જ્યારે આ રાજ્યમાં આવે ત્યારે આપણે એ બાબતમાં કાંઈ પણ કરી શકતા નથી. તેથી જ આ એક ઘણી જ મુશ્કેલીભરી બાબત છે, આમ હોવાથી હું તો એવું ઘણું ઈથું કે આ બાબતને ભારત સરકાર હાથમાં લે અને તેનો વિચાર તે જ કરે. ત્યારે હું એમ નથી કહેવા માગતો કે ભારત સરકારે તે બાબત ઉપાડી લેવી જોઈએ અને તેને પસાર કરી દેવી જોઈએ, તેમ કંઈ હું કહેતો નથી. હું તો એટલું જ કહું છું કે આ એક એવી બાબત છે કે જેના પર કોઈ એક પ્રાંત રાજ્ય ધોરણ કરતાં સમગ્ર ભારતના ધોરણે વિચાર થવો જોઈએ. મારું દાખિબિન્દુ આવા પ્રકારનું છે.

**લોકમત મેળવ્યા ઉપર નિર્ણય કરાય :-** આ બીલ પર લોકમત જાગ્રવામાં

આવે ત્યાં સુધી બેચ પ્રસ્તુત બાબતોમાં મારો નિર્ણય હું અનામત રાખું એ જ ઠિક છે. લોકમત મેળવ્યા બાદ આપણે અહીંના માનવંતા સભ્યોએ દર્શાવિલા વિચારો ધ્યાનમાં લઈએ તો કદાચ આપણે સાચા નિર્ણય ઉપર આવી શકીએ. હાલના તબક્કે સરકાર આટલી સ્થિતિએ છે.

**શ્રી.વી.બી. દેશમુખ :-** સાહેબ, માનવંતા વડાપ્રધાન રજા લે તે પૂર્વે જાણવાની દાખિએ મારે બે મુદ્દા ઉપર સ્પષ્ટીકરણ જોઈએ છે. પ્રથમ તો મારે એ જાણવું છે કે (૧) આ કહેવાતા દુષ્ટાની વિશાળતા બાબતમાં કાંઈ પણ માહિતી ઉપલબ્ધ છે કે કેમ? કેટલી સંખ્યામાં નાના બાળકો અને બાળિકાઓને આ દીક્ષા મળી છે? બીજું એ જાણવું છે કે, (૨) માનવંતા વડાપ્રધાનની જેમ હું પણ ગુંચવાયો છું. તેઓશ્રીએ કરેલી સમીક્ષા ઉપરથી એવું જણાય છે કે સરકારે આ બાબતમાં પોતાનો નિર્ણય કરી લીધો છે. આ સમસ્યાની ગુરુતા માટે સરકાર પાસે કે બિલના રજૂ કરનાર પાસે કાંઈ પણ માહિતી ઉપલબ્ધ છે કે કેમ, તે જાણવાને હું આતુર છું. જો કાંઈ પણ માહિતી ઉપલબ્ધ ન હોય તો એ બાબતનો નિર્ણય કરવો એ દરેકને માટે મુશ્કેલીભર્યું કાર્ય છે.

**શ્રી મોરારજીભાઈ દેસાઈ :-** બેચ મુદ્દા ઉપર હું સ્પષ્ટ ઉત્તર આપી શકું છું.

**બીલ મૂકનાર પણ આંકડા નહિ આપી શકે :-** આ સરકાર દ્વારા રજૂ થતું બિલ નથી તેથી સરકાર કોઈ પણ માહિતી આપી શકે નહિ, અને મને કહેવા દો કે મને આંકડાઓની માહિતી બાબતમાં કશી જ કલ્યાના નથી. આ પ્રશ્ન બિલના માનવંતા રજૂ કરનાર સામે જૂકી શકાય. મને ભય છે કે તેઓ કોઈ પણ ભરોસાપાત્ર માહિતી આ બાબતમાં નહિ આપી શકે. એ બદલ હું તેમનો દોષ કાઢતો નથી, કારણ કે આ બાબત જ એવી છે કે ટૂંકા સમયમાં તેની આંકડી કરવી એ ઘણું દુર્વટ છે. તેથી જ લોકમત ભેગા કરવા સારુ આ બિલને જાહેરમાં ફેરવવાની મારી દરખાસ્ત છે જેથી આવી બધી બાબતો આંખ સામે ઉપલબ્ધ બની શકે.

**બીજા મુદ્દા પર મારા માનવંતા મિત્રો,** “સરકારે પોતાનો નિર્ણય કરી લીધો છે” એવું કહીને મને અન્યાય કર્યો છે. મેં કહું હતું તેમ બીલના પ્રથમ વાંચનને લાગે-વળગે ત્યાં સુધી તો મેં મારો નિર્ણય જરૂર કરી લીધો હતો. મારું એ કહેવું હતું કે બીલના પ્રથમ વાંચનને અને લોકમત માટે તેને મૂકવાનું સમર્થન અમે કરવાના છીએ. પરંતુ મેં તેમ નહોતું કહું કે બીલ વિષે મેં નિર્ણય કર્યો નહોતો.

**શ્રી.વી.બી. દેશમુખ :-** હું તો કેવળ શબ્દો પાછળનો મર્મ જ જોઈ રહ્યો છું.

**શ્રી મોરારજીભાઈ દેસાઈ :-** વસ્તુ જ્યારે બીજી જ રીતે ગોળ ગોળ છે, ત્યારે મારા માનવંતા મિત્ર વસ્તુનો મર્મ પારખવામાં કાંઈક વધુ પાવરધા જણાય છે.

## ભાષણ બીજું. તા. ૧૨-૯-૫૫

સરકાર બીલનો સિદ્ધાન્ત સ્વીકારતી કે અસ્વીકારતી નથી :-  
સાહેબ,

બીલની રજૂઆત કરનારા મારા માનવંતા મિત્રો મારા કાર્યને કાંઈક કઠિન કરી દીધું છે, કારણ કે તેઓ એવું માની લે છે કે જો બીલ પ્રથમ વાંચનમાંથી પસાર થયું તો સરકારે બીલના સિદ્ધાન્તનો સ્વીકાર કરી લીધો. પરંતુ હું બીલના સિદ્ધાન્તને સ્વીકારેય નથી કરતો તેમ અસ્વીકાર પણ નથી કરતો. પરિસ્થિતિ આ છે. એટલા માટે હું સ્પષ્ટ કરવા માગું છું કે બીલના સિદ્ધાન્તને હું સારો કે ખરાબ કંઈ કહેતો નથી. સવાલ એ છે કે શું આ એવી બાબત છે કે જેના પર આપણે કાયદો કરવો જોઈએ? કેટલીક બાબતો એવી હોય છે કે જેના વિષે આપણે કાયદો ઘડવો જોઈએ? કેટલીક બાબતો એવી હોય છે કે જેના વિષે આપણે કાયદો ઘડવો જોઈએ. ત્યારે કેટલીક બાબતો એવી હોય છે કે જેના વિષે આપણે કાયદો ઘડવો ન જ જોઈએ. મારે માટે એ કહેવું મુશ્કેલીભર્યું છે કે ધર્મની બાબતોમાં કાયદા ઘડવાથી ધર્મમાં કોઈ પણ રીતે સુધારો થશે અથવા તો ધર્મનું મૂલ્ય વધશે. હું આ માત્ર ખરેખરા ધાર્મિક આચારોનેજ અનુલક્ષીને કહું છું; નહિ કે લગભગ દરેક ધર્મમાં ધાર્મિક પ્રકાલિકાઓ તરીકે ગણાતા ધાર્મિક આચારોને અનુલક્ષીને આ બે વસ્તુઓ ઉપર હું બેદ પાડવા ઈચ્છા કરું છું. આ બીલના સંબંધમાં એમ તો નહિ કહી શકાય કે આ માત્ર સામાજિક સુધારો છે. આ કાયદો સામાજિક સુધારાનું સ્વરૂપ ધારણ કરે છે કેમ કે તે બાળકો અને બાળકોના હિતને લગતો છે અને તેટલે અંશો તે જરૂર સામાજિક સુધારાનું સ્વરૂપ ધારણ કરે છે. તેથી જ તેને પ્રથમ વાંચનમાંથી પસાર થવા દેવા પૂરતો અને લોકમતમાં ફેરવવા પૂરતો હું સંમત થાઉં છું. જેથી આ ચોક્કસ બાબતમાં કાયદો ઘડવો તે સરકાર માટે યોગ્ય છે કે નહિ તેના નિર્ણય ઉપર આવવા માટે અને જો તેમ કરવું યોગ્ય હોય તો તેને જે રીતે ઘડવાની અપેક્ષા રાખવામાં આવે છે તે રીતે બરાબર છે કે નહિ તેના પણ નિર્ણય ઉપર આવવા માટે દરેકને વધારે સમય મળી શકશે.

**ભૌતિક ઉન્નતિ અંગે જેટલું વિચારાય છે એટલું ધર્મ જેવી અગત્યની બાબત અંગે નહિ; એ ભૂલ છે.**

સાહેબ, પહેલાં મેં કહું તે મુજબ આ કાયદો આપણા મૂળભૂત હક્કો ઉપર ગ્રાપ મારે છે. અથવા તો બંધારણને ધક્કો પહોંચાડે છે એવી દલીલ ઉપર હું

જરાયે વજન મૂકતો નથી. બંધારણની દૂર જઈને ધાર્મિક બનતી બાબતોમાં ધારાસભાઓ બંધારણની રૂએ હસ્તક્ષેપ કરી શકે છે. પરંતુ એટલું તો કોઈ પણ હંમેશ ન કહી શકે કે આ બાબત ધર્મના સંબંધની છે યા નથી; અને એ બધુંય ન્યાયમંદિર તે સંબંધમાં કેવું ધોરણ લે છે એના ઉપર અવલંબે છે. વર્તમાન સંયોગોમાં ધાર્મિક સુધારો કે સામાજિક સુધારો એ બે વચ્ચે ભેદ પાડવાનું લોકોને માટે કઠીન છે; કારણ કે ધર્મ વિષેની આપણી કલ્પનાઓ ઘણે અંશે વધારે પડતી બની ગયેલી છે. તે કંઈ ધર્મનો દોષ ન કહેવાય પરંતુ એ દોષો, જે લોકો ધર્મનો પ્રચાર કરનારા છે તેમનો હોઈ શકે. વળી ભૂલ આપણી પણ છે, કારણ કે ભૌતિક ઉન્નતિના વિષયમાં વિચારવાની જેટલી તકલીફ આપણે ઉઠાવીએ છીએ તેટલી તકલીફ આ અગત્યની બાબતમાં આપણે ઉઠાવતા નથી.

**ભૌતિક નહિ પણ આંતરિક રીતે સુખી તે સાચો સુખી :** - માણસ ફક્ત ભૌતિક રીતે સુખી છે તેથી સાચો સુખી છે તેવું નથી. તે ત્યારે જ સુખી કહેવાય કે જ્યારે તે આંતરિક રીતે સુખી હોય. કોઈ પણ ભૌતિક આબાદી વિના પણ માણસ સુખી હોઈ શકે છે, અને ભૌતિક આબાદી વિદ્યમાન છ્તાં પણ માણસ દુઃખી હોઈ શકે છે. મનુષ્ય સ્વભાવનું ઘડતર આ રીતે થયેલું છે. માટે હું એવું પ્રતિપાદન નથી કરતો કે ભૌતિક આબાદી ખાનીથી મનુષ્યને સુખના માર્ગ પ્રતિ દોરી જાય છે. પરંતુ જો ભૌતિક આબાદી ઉપર જ ભાર મૂકવામાં આવે તો માનવ જતના ભાગ વિષે હું ઘણો જ દીલગીર થાઉં; કેમકે માનવ અને પણ જગત વચ્ચે ઘણું જ થોડું અંતર રહેશે.

**સાચા ધર્મની શ્રદ્ધાથી માનવ એ શ્રેષ્ઠ છે :-** બધાંય સર્જનોમાં માનવ સર્જન એ શ્રેષ્ઠ સર્જન છે. તેનું ફક્ત એ જ કારણ છે કે સામાન્ય રીતે સાચા ધર્મમાં શ્રદ્ધા ધરાવે છે. આ વ્યાખ્યામાંથી નાસ્તિકને પણ હું બાકાત રાખતો નથી. ઈશ્વરમાં નહિ માનતો માણસ અધાર્મિક છે; એવી મારી માન્યતા નથી. હાલમાં હું તો આ રીતે દાખિબિદ્ધ ધરાવું છું. સત્યમાં શ્રદ્ધા ધરવા માટે અને સત્યને વળગી રહેવા માટે અતિ તીવ્ર ધાર્મિક શ્રદ્ધાની આવશ્યકતા રહે છે. જો તીવ્ર ધાર્મિક શ્રદ્ધા નથી હોતી, તો સધણા મુશ્કેલીભર્યા સમયમાં અને કટોકટીના પ્રસંગોમાં મનુષ્ય સત્યને છોરી દે છે; ને આધ્યાત્મિકતાની વિરુદ્ધ ભૌતિક આબાદીનો પક્ષપાત્રી બની જાય છે. ધાર્મિક શ્રદ્ધા જ્યારે ઘણીજ તીવ્ર હોય ત્યારે જ મનુષ્ય સત્યને અનુસરે છે. તેમજ સત્યની ખાતર જરૂર પડ્યે સર્વસ્વ ફના કરી દે છે. હું માનું છું કે સર્વધર્મનો ઉદેશ અને હિરાદો માનવને આ બળ આપવાનો હોય છે. જો લોકોએ તેવું બળ પ્રાપ્ત કરવામાં સફળતા ન મેળવી હોય, તો તે દોષ એટલો ધર્મનો નથી જેટલો આપણા બધાનો

છે; કારણ કે આપણને કાં તો ધર્મમાં શ્રદ્ધા નથી; અથવા તો આપણે ધર્મને યોગ્ય રીતે સમજી શકતા નથી. અથવા ધર્મને યોગ્ય રીતે આચરતા નથી.

**સંન્યાસ દીક્ષાની મનાઈ અતિ અગત્યના ધર્માચારમાં દખલગીરી :-** આ ધોરણો જો વિચાર કરીએ તો મારે કહેવું કઠિન છે, “સંન્યાસ દીક્ષાની સર્વથા મનાઈ કરી દેવી તે કેવળ સામાજિક સુધારો જ કહેવાય અને અતિ અગત્યના એક ધાર્મિક આચારમાં દખલગીરી કરી ન કહેવાય.” આ કહેવું મારે માટે મુશ્કેલ થઈ પડે. ધર્મને તે લોકો પ્રરૂપે છે કે જે કોઈ પણ બીજી બાબતમાં ન પડતાં સંપૂર્ણ રીતે પોતાનું જીવન ધાર્મિક બાબતમાં સમર્પા દે છે, કારણ કે એકલા તેઓ જ ખૂબ ખૂબ ચુસ્તપણે અને કડકતાથી ધર્મને આચરી શકે છે. સંસારનો માનવ તેટલી ચુસ્તતા અને કડકતાથી આચરી શકતો નથી. છતાં સાચી નીતિમત્તાના સાંકડા માર્ગ ઉપર સંસારના માનવોને ચલાવવાનું ઈચ્છિત હોય તો તેઓની વચ્ચે કેટલાક એવા આદર્શ માનવો હોવા જરૂરી છે, કે જે જ્યારે જ્યારે આ સંસારીઓ ઉન્માર્ગ ચાલ્યા જાય ત્યારે ત્યારે, તેમની ફરી પાછા સીધા રસ્તે લાવે, હું સમજું છું ત્યાં સુધી આ જ ધર્મનું સત્ત્વ છે અને તેની ઉપર જ આપણે જાણીએ છીએ તે રીતે, સંન્યાસીઓના અને સાધુઓના સંપ્રદાયો રચાયેલા છે. ભારતમાં આ વર્ગ દેશની સંસ્કૃતિ અને સંસ્કૃતિમાં મોટો ફાળો આપ્યો છે. છતાં હું કહેતાં અચકાતો નથી કે આ વર્ગમાં અધ્યપતન પણ ભારે થયું છે. પણ એટલું છે કે એક વસ્તુનો ઉપયોગ કરી શકાય કે દુસ્રુપયોગ કરી શકાય તે મુદ્રો વસ્તુને સર્વથા રદ્દ-બાતલ કરવાની ભૂમિકા ગણી શકાય નહિ. પરંતુ તે વસ્તુના હાનિકારક પાસાંઓને દૂર કરવા અથવા એનાથી દૂર થવું અને માત્ર એના લાભદાયક પાસાંઓને જાળવી રાખવાં એ આપણી ફરજ છે. શું આપણે તેમ ન કરી શકીએ ?

**શું જે પુખ્ત વયના તે જ ડાખ્યા ? શું જ્ઞાનેશ્વર, રાજચંદ્ર વગેરે બાળસંતોથા અટકાવવા ? :-** મારા મનમાં ગડમથલ ઉપજાવતો સવાલ એ છે કે સંન્યાસ દીક્ષાની આપણે સર્વથા મનાઈ કરી શકીએ કે કેમ ? અહીં આપણે બધા તો એમ જ સમજું છીએ કે જે પુખ્ત વયના છે તે જ બધા ડાખ્યા છે અને બાળકો નહિ. આપણે એ વાત ભૂલી જઈએ છીએ કે શ્રી જ્ઞાનેશ્વર પોતાની સોણ વર્ષની બાલ્યવયમાં જ ‘જ્ઞાનેશ્વરી’ નામનું પુસ્તક લખ્યું હતું અને આ જ્ઞાનેશ્વરને સૈકાઓ વિતવા છતાં આજે ઘણા પુખ્તવયના માણસો પૂજે છે. આ કંઈ ધૂઢું-છવાયું એકાઢું ઉદાહરણ નથી; આવા તો અનેક દાખલાઓ છે. મહાત્મા ગાંધી પણ જેમને માનતા હતા તે શ્રીમદ્ રાજચંદ્ર પોતાની બાર કે સોણ વર્ષની નાની વયે પુસ્તકો લખવાનું શરૂ કર્યું હતું અને આજે પણ એમનાં પુસ્તકોને લોકો વાંચે છે; જો કે તેઓ સંન્યાસી ન

હતા પરંતુ તેઓ પોતાની પસંદગીનું વિદ્વજજન તરીકેનું જીવન જીવ્યા હતા. આવા લોકો સંન્યાસ સ્વીકારે કે ન સ્વીકારે એ કાંઈ અગત્યની બાબત નથી. પરંતુ ધારો કે આવા કોઈ બાળકને દીક્ષા લેવી હોય તો શું મારે તેને અટકાવવો ? આપણી સામે ઉપસ્થિત થયેલા પ્રશ્નનું એ મર્મરસ્થાન છે. આ કાયદાખરડાએ જે પ્રશ્ન ખડો કર્યો છે તે આ છે કે મારે તેમ કરવું જોઈએ કે કેમ ? (અર્થાત્ તેવા બાળકની દીક્ષા અટકાવવી કેમ ?)

**બિલ ૨જી કરનારે આંકડા આપ્યા નથી, માત્ર બે જ પ્રસંગ ટાંક્યા છે :-** બીલ ૨જી કરનારાં માનવંતા સભ્યે સભાગૃહ સમક્ષ આ બાબતમાં આંકડા ૨જી કર્યા નથી. તેમણે તો એક જ ધડકે જણાવી દીધું છે કે એવા અનેક કિસ્સાઓ બનેલા છે, અને અનેક કિસ્સાઓ ટાંકી શકાય તેમ છે. અંતે તેમણે દીક્ષા અપાવેલી ત્રણ બાળિકાઓના માત્ર બે જ પ્રસંગો ટાંક્યા છે. આમાંના એક કિસ્સામાં દીક્ષાવિષિ રોકવામાં આવી તે બાબત હતી, જ્યારે બીજામાં તેમ કરી શકાયું ન હતું. હું તેમના શબ્દોમાં ક્ષણભર શંકા લાવતો નથી.

**ખોટી દોરવણીમાં કોર્ટે કામ ચલાવી શકાય છે :-** અથવા તો કેટલાક કિસ્સાઓમાં અયોગ્ય રીતે અપાતા સંન્યાસ કે દીક્ષાની શક્યતા વિષે પણ હું ઈન્કાર કરતો નથી. આથી આપણે વિચારવાનું એ રહે છે કે એવી કસોટી આપણે યોજી શકીએ કે કેમ જેથી સંન્યાસ દીક્ષાના ઉચિત કિસ્સાને કરો સ્પર્શ થાય નહિ, અને અયોગ્ય વ્યક્તિઓને અટકાવી શકાય ? આજે પણ જો તેવા કોઈ કિસ્સા ન્યાયમંદિરમાં આવે તો સંરોવાયેલી વ્યક્તિ ઉપર ખોટી રીતે દોરવણી કરવા માટે, કામ ચલાવી શકાય છે. મારા માનવંતા મિત્રે દશવિલા બીજા કિસ્સાની બાબતમાં દીક્ષાવિષિ થવાનું જાણ્યા બાદ તરત જ ન્યાયમંદિરમાં એવી ખબર આપી શકતી હતી કે માતાપિતાની ઈચ્છા વિશુદ્ધ તે બાળકને ઉપાડી જવામાં આવ્યા છે. જો આ બાબત ન્યાયમંદિરમાં લઈ જવામાં આવી હોત તો ન્યાયમંદિરે તેની તપાસ કરી હોત. હું નથી જાણતો કે એ કિસ્સાઓ શા માટે એટલી સ્થિતિએ છોરી દેવામાં આવ્યા. જો માતાપિતાની અથવા વાલીઓની સંમતિ વગર જ બાળકોને લઈ લેવામાં આવે તો કાયદાની રૂએ તેનો ઉપાય હંમેશ લઈ શકે છે.

**માતાપિતા પોતે બાળકોને આપી દે છે, એ તો ટીક જ છે :-** કેટલીક વાર એવી દલીલ કરવામાં આવે છે કે માતા-પિતાએ પોતે જ પોતાનાં બાળકો સાધુઓને આપી દે છે. પરંતુ એની સામે મારો પ્રશ્ન એ છે કે શું તે બાળકો તેવા માતાપિતાએ સાથે રહીને સુખી થાય ? કે જે સંન્યાસીઓ તેમને કદાચ સારું શિક્ષણ આપતા હોય તેમની સાથે રહીને વધુ સુખી થાય ? હું તો માનું છું કે માતાપિતા પોતાનાં

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદશિ” (ભાગ-૧૮)

બાળકોનો ઉપયોગ સર્વ પ્રકારની ખરાબ બાબતોમાં ઉપયોગ કરવા આગ્રહી હોય એવા માતાપિતા સાથે એ બાળકોને રહેવા દેવા ન જોઈએ. આવા કિસ્સાઓમાં આપણે શું કરવા ઈચ્છાએ હીએ ?

**શું સરકાર બાળકોને સંભાળવામાં પહોંચી વળે ?**

શું આપણે તેવા બધા બાળકોનો કબજો લઈને તેમને સારું શિક્ષણ આપવું ? તેમ કરવાની શું આપણી તૈયારી છે ? જો તેવી તૈયારી હોય તો હું ધારું છું કે એવા અનેક માતાપિતા મળશે કે જે પોતાનાં બાળકોને આપણાને સુપ્રત કરી દેવા માટે આગળ આવશે. મને આ બાબતમાં શંકા નથી. સવાલ એટલો જ રહે છે કે આવી માગણીને સરકાર પહોંચી વળી શકે કે કેમ ? આ બધા કારણોને લીધે મેં કહું હતું કે આ બાબત બહુ સાદી અને સરળ નથી. મેં જો એમ કહું કે આ બાબતમાં હું ગુંચવાયો છું તો તે કથન નિષ્કારણ હતું; કારણ કે હું બહુ સહેલાઈથી કોઈ બાબતમાં ગુંચવાઈ જતો નથી.

**આર.એ.ખેડ્ગીકર :- ધાર્મિક બાબતો સિવાય જ કેમ વારું ?**

**શ્રી મોરારજીભાઈ દેસાઈ :-** ધાર્મિક બાબતોમાં પણ હું ભાગ્યે જ ગુંચવાઉં છું. હું તો મારા બિનધાર્મિક ઐહિકવાદની બાબતોમાં જ ગુંચવાઉં છું. ધાર્મિક બાબતો મને ગુંચવણમાં નાખતી નથી. મારે ક્યા ધર્મને અનુસરવું જોઈએ તે હું જાણું છું. તે હિસાબે મારા મનમાં મને કોઈ શંકા નથી. પરંતુ આવી બાબતમાં કોઈ પણ નિષ્ઠય કરી લેવા પૂર્વે હું જરૂર વિચાર કરું કે સંન્યાસ દીક્ષાની મનાઈ કરતો કાયદો પસાર કરવો કે કેમ ?

**શું બીલ ખાસ કરીને જૈનોની દીક્ષા માટે નથી ?**

સાહેબ, આ તો ખું જ છે કે બીલના માનવંતા રજી કરનારા સભ્યે જે ઉદાહરણો આયાં છે તે બીજા કોઈના પણ કરતાં જૈનોનાં વધુ છે, અને તેથી જ જો જૈનો એમ માનતા હોય કે ‘આ બીલ જે લાવવામાં આવ્યું છે તે વધારે તો તેઓ દ્વારા અપાતી દીક્ષાઓ માટે જ છે કે જે દીક્ષા સર્વ સામાન્ય હેતુઓ માટે અપાય છે.’ તો હું નથી ધારતો કે જૈનોનું તેમ માનવું બહુ ખોંટું હોય. મને સેકદો વિરોધો પણ મળ્યા છે, તેમ તારો પણ મળ્યા છે. જે બધાય જૈનો તરફથી જ મળ્યા છે.

**જૈનોના સાધુઓનું તપ અને આત્મભોગમાં મહત્વ :-** એક બીજી પણ એવી બાબત છે કે જેને મારે સ્પષ્ટ કરવી જોઈએ કે સાધુઓ અને સંન્યાસીઓના જે સંપ્રદાયોને મેં જોયા છે તે બધાય સંપ્રદાયોમાં મારે જૈનોને ગૌરવ આપતાં કહેવું જોઈએ કે જૈનોના સાધુઓએ આજે પણ તપ અને આત્મભોગને વિશાળ પ્રમાણમાં

૨૧૬ ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-જૈન શાસનમાં ભાગવતી દીક્ષાનું સ્થાન (ભાગ-૧૮)

જાળવી રાજ્યો છે; એટલો બીજા સંપ્રદાયોએ જાળવ્યો નથી. તેથી જ, સાહેબ એવા સંપ્રદાય પર આકમણ કરવાનો કોઈ અર્થ નથી કે જેની સાથે આપણે બિન્ન માન્યતાઓને કારણે સંગત ન થતા હોઈએ. હું પોતે સંન્યાસ જીવનને અપનાવી શકતો નથી, એ કારણથી સંન્યાસ દીક્ષા લેનારા બીજા કોઈને મારે અટકાવવા જોઈએ નહિ. માનવ પ્રાણીઓ સાથે વર્તવાની એ રીત ખોટી છે. જો હું સાંસારિક કે જીવનને સારું માનતો હોઉં તો એટલા જ મનથી મારે એવું તો ન જ કહેવું જોઈએ કે દરેક સાંસારિક જીવન જ ગુજરાવું જોઈએ. સાંસારિક જીવન સારું નથી, એવું સંન્યાસીઓ કહે છતાં હું સંન્યાસી થવાને તૈયાર નથી. સાંસારિક જીવન માત્ર મને સારું લાગે છે. એટલા માત્રથી જ હું એવો આગ્રહ કેમ રાખી શકું કે કોઈએ પણ સંન્યાસી ન થવું ?

આપણી રીતે જીવવા સ્વતંત્ર આપણે બીજાને ઉત્તમ લાગતી જીવન પદ્ધતિનું સ્વાતંત્ર્ય લૂટી ન શકાય :- જેવી રીતે મારું જીવન મને જેમ ઉત્તમ લાગે તે રીતે જીવવાનું સ્વાતંત્ર્ય હું ઈચ્છું દ્ધું, તેવી રીતે બીજાઓને જે રીતનું જીવન ઉત્તમ લાગે તે રીતે જીવવાનું તેમનું સ્વાતંત્ર્ય મારે અખંડ રાખવું જોઈએ. અલબત્ત, સાંસારિક જીવન કરતાં સંન્યાસ જીવનમાં વધારે સુખ લાગે એવાઓની જગતમાં નાની જ લઘુમંત્ત હશે, પરંતુ તેનો અર્થ એવો નથી કે તેવા લોકો ઘણી અલ્ય સંઘ્યામાં છે; માટે આપણે વગર વિચાર્ય બસ, ગમે તે વિષયમાં કાયદા ઘડ્યે જ જવા, કુમળી વયના બાળકોનો અજુગતો લાભ ઉઠાવતા હોય તેવા બેદરકાર લોક અથવા તો હદ બહારના ઉત્સાહી ધાર્મિક માનસવાળા લોકોને તેમ કરતાં જરૂર અટકાવવા જોઈએ, પરંતુ મને તો ચોક્કસ ખાત્રી છે કે બાળકોનું અપહરણ કરતા અથવા તો તેમનો દુરુપયોગ કરતા એવા લોકોને અટકાવવા માટે હાલમાં અસ્તિત્વમાં રહેલા કાયદાની અંદર પૂર્તી જોગવાઈ છે. અલબત્ત, સવાલ એટલો જ છે કે આવા ડિસ્સાઓને ખોળી કાઢવા અને તેની સામે પગલા ભરવા કોણ જવાનું છે ? તો ત્યારે સાહેબ, કેવળ પોલીસને કાર્ય સોંપી દેવાથી શું કાર્ય થઈ જવાનું છે ? આખરે કેટલી બાબતો અને તેમાંય ખાસ કરીને સામાજિક સુધારાની કેટલી બાબતો આપણે પોલીસને સુપ્રત કરવા તૈયાર છીએ એ પણ આપણે વિચારવું જ પડશે.

બાળલગ્નની વસ્તુ તદન જુદી છે :- કેટલાક માનનીય સભ્યોએ બાળલગ્નના કાયદાનો નિર્દેશ કર્યો છે; પરંતુ બાળલગ્નો એ સંન્યાસ દીક્ષાઓ કરતાં તદન બિન્ન વસ્તુ છે. મને નથી સમજાતું કે આ બે વસ્તુઓને સરખાવી જ શી રીતે શકાય ? લગ્ન એ સામાન્ય વસ્તુ છે, જ્યારે સંન્યાસ દીક્ષા એ અસાધારણ વસ્તુ છે. બેમાંથી એક ઘણે બનતી વસ્તુ છે, જ્યારે બીજી તેવી નથી, છતાં પણ જો

એક લાખ પ્રસંગોમાંના એક જ પ્રસંગ ઉપર પણ કાયદો ઘડવાનું આપણે માટે એકાંતે આવશ્યક હોય તો તેમ કરવું તદન વ્યાજબી ગણાય. એક કાળે આપણે જ અસ્તિત્વમાં રહેલા કાયદાની રૂએ ગેરકાયદેસર ગણાતા એક જ લગ્નને કાયદેસર ઠરાવવા માટે કાયદો પસાર કર્યો છે. આપણે એ લગ્ન કાયદેસર ઠરાવવું જ હતું અને માત્ર એક જ યુગલ ખાતર કાયદો પસાર કરવો હતો. પરંતુ તે કાયદો બીજા લોકોને સ્પર્શતો ન હતો. જ્યારે અહીં તો આ સર્વવાહક બીલ બધી બાળદીક્ષાઓને મનાઈ કરવા તરફ જય છે. તેથી જ જો કે મેં બીલનું પ્રથમ વાંચન પસાર કરવાનું અને લોકમત માટે ફેરવવાનું મંજુર કર્યું છે. તો પણ સાથે સાથે હું એ સ્પષ્ટ કરવા માગું છું કે બીલને આગળના કોઈ પણ કાયદો વાચનમાં પસાર કરવા માટે હું બંધાયેલો નથી.

સર્વથા બાળસંન્યાસ રોકવો એ જગતના સંતને ચોરવા જેવું છે :- હું નથી ધારતો કે શંકરાચાર્ય, હેમયંડસ્કુરી અને જ્ઞાનેશ્વર જેવા આત્માઓના માર્ગમાં અવરોધ કરવાનું આપણે માટે યોગ્ય હોય. જો આપણે એમ કરીએ તો તો તેનો અર્થ એવો થશે કે આપણે માત્ર આપણા દેશ પાસેથી જ નહિ પરંતુ આખાય જગત પાસેથી આવા અત્યંત અસાધારણ પુરુષોને ધીનવી રહ્યા છીએ. સામાજિક સુધારાને નામે હું નથી ધારતો કે આપણે ક્યારેયે આવો પ્રયત્ન કરવો જોઈએ. ભલે પછી તે અનેક માણસોને મનગમતો હોય. સામાજિક સુધારો એ ઘણી પ્રશંસનીય વસ્તુ છે, પરંતુ એ પણ વસ્તુ છે કે સામાજિક સુધારો સામાજિક જુલ્મ પણ બની શકે છે, અને તેથી ખાસ કરીને લોકશાસનમાં તો આવું કાંઈ જ ન બને એની આપણે કાળજી રાખવી જોઈએ. નહિતર તો આપણા બંને સભાગૃહો પાસે ઘણી વિશાળ સત્તાઓ છે, કે જેના બણથી આપણે કોઈપણ કાયદો પસાર કરી શકીએ. લોકસભા અને રાજ્યસભા બંધારણમાં પણ સુધારણા કરી શકે છે અને ભારતમાં સર્વ ધર્મની મનાઈ પણ કરી શકે છે. પરંતુ શું તે યોગ્ય થશે ?

ધર્મની મનાઈ થઈ શકે નહિ :- અરે ! રશિયા પણ એ પરિણામ સિદ્ધ કરી શક્યું નથી. તેને પોતાની ગોળી ગળી જવી પડી છે. (વાત સંકેતી લેવી પડી છે.) અને ધર્મનો વિકાસ થવા દેવો પડ્યો છે. કદાચ દબાણ અને મોટી મુશ્કેલીઓ હેઠળ એમ થયું હોય. માનવસ્વભાવમાં એવી એ જંખના છે કે જેને દબાવી શકતી નથી અને જેને દબાવવી પણ ન જોઈએ. આપણે જ્યારે એમ કહીએ ધીએ કે બાળકોને અમુક ક્ષેત્રમાં પ્રવેશવા દેવા જોઈએ ત્યારે આપણે તેમને બીજા ઘણાય ક્ષેત્રોમાં પ્રવેશવાની પણ સંમતિ આપી છે, એ પણ આપણે યાદ રાખી લેવું ઘટે.

**સ્વાતંત્ર્યની લડતમાં બાળકોને સામેલ કરી... :- શું આપણે આપણી સ્વાતંત્ર્ય**

માટેની લડતમાં બાળકોને સામેલ કર્યા નથી ? અને લાંબા વખત સુધી સ્વાતંત્ર્યની ચળવળમાં એમની જિંદગી ખરચાવીને તેમના સમસ્ત ભાવિ જીવનના અવકાશ ઉપર શું નિયંત્રણ નથી મૂક્યું ? શું તેમની લાગણીઓને ઉશ્કેરવાનો આ સવાલ ન હતો ? શું આપણને એમ ત્યારે લાગતું હતું કે આપણે ખોટા હેતુ માટે બાળકોનો ઉપયોગ કરી રહ્યા છીએ ? ના, જરાય નહિ. એ તો એક મહાન હેતુ હતો. મહાત્મા ગાંધીએ બાળકો પાસેથી ઘરેણાં સ્વીકાર્ય હતાં અને તેમને આશિર્વાદ આપ્યા હતા. આ બધાં બાળકો શું જ્ઞાનતા હતા કે તેઓ શું કરી રહ્યા છે ? શું એમ પણ કહી શકાય કે એ બાળકો કંઈક ખોટું કરી રહ્યા હતા ? આપણને બધાને તે વખતે એવું જ લાગતું હતું કે ‘તે બાળકો યોગ્ય જ વસ્તુ કરી રહ્યા છે !’ અને મહાત્મા ગાંધી આપણી ભાવિ પેઢીને મહાન આત્મભોગનો પાઠ શીખવી રહ્યા છે અને હું ધારું છું કે તે બધું બરાબર હતું. મને તેમાં કંઈ ભૂલ જ્ઞાનતા નથી.

**સારી વસ્તુમાં કાયદો માત્ર તેના બેદરકારીભર્યા ઉપયોગ અંગે હોય :-**

તેથી જ જ્યારે જ્યારે લોકોને અને બાળકોને આપણે કંઈક સારું શીખવીએ છીએ, ત્યારે ત્યારે મને લાગે છે કે સાથે આપણે તેની પ્રવૃત્તિ પર અટકાયત ન કરવી જોઈએ, બલ્ક તેને વધાવી લેવી જોઈએ. હા, આપણે જે રોકું જોઈએ તે એવી તકો અને એવા હક્કોનો બેદરકારીભર્યા ઉપયોગ છે. એમ કરવું તદ્દન યોગ્ય છે. તે બાબતમાં મને જરાય શંકા નથી. આ માનવંતા સભાગૃહમાં આપણે સામાજિક સુધારો અને કાયદો કરવાના કોઈ પણ કપરા પ્રકારને ઉપાડી લેવામાં આપણે જરાય અચકાયા નથી. હું એવી દલીલમાં જરાય માનતો નથી કે આ બીલ સભાગૃહના એક માનવંતા સભ્ય તરફથી રજૂ થતું હોવાથી તે બહુ અસરકારક નહિ બને, અને તેથી જ તે મને સ્વીકાર્ય નથી. મને જે વજુદ્વાળી બાબત લાગે છે, તે એ નથી. કારણ કે જો તે પરિણામે કંઈક પણ ફાયદાકારક લાગે તો આપણે તે કરવામાં માનીએ છીએ. જેથી આખોય દેશ તેને સ્વીકારે; એ માટેનું મહાન બળ પ્રગટ થાય, અને આપણે તેવા પ્રકારનું પગલું ભરવા તૈયાર છીએ. તેથી હું કહું છું કે મને જે વજુદ્વાળી વસ્તુ લાગે છે તે એ નથી.

**મારે મન વજુદ્વાળી વસ્તુ એ ધાર્મિક મુદ્રો છે :-** મારે મન તો આ બાબતમાં રહેલો મૂળભૂત ધાર્મિક મુદ્રો મહત્વનો છે. તેના પર બરાબર રીતે વિચારણા થવી જ જોઈએ; અને યોગ્ય રીતે નિર્ણય લેવાવો જોઈએ. તે જ કારણસર આવી જતના પગલા માટે સમય ખરચિય અને વધુ શાણી બુદ્ધિ વપરાય, એ મને ઢીક લાગ્યું છે.

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદધિ”

વર્ષ-૪, અંક-૧૬, તા. ૩૧-૧૨-૧૯૮૫



## બાળ સંન્યાસ દીક્ષા પ્રતિબંધક બીલ એટલે-ત્યાગના આદર્શ અને ધર્મનો મૃત્યુધંટ !

તાજેતરમાં જ બાળદીક્ષાનો વિરોધ કરતા તથા ધારાસભ્ય શ્રી પટવારીએ રજૂ કરેલા બાળ સંન્યાસ દીક્ષા પ્ર૦ બીલને ટેકો આપતા વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થયેલા શ્રી સુખલાલજી તથા શ્રી બેચરદાસના નિવેદનને વાંચતાં કોઈ પણ પ્રકારની આધ્યાત્મિક વિચારસરણી ધરાવતો, સામાન્યતઃ આર્થ અને આસ્તિક ગણાતો માનવી આધાત અનુભવ્યા વિના રહેશે નહિ. એ નિવેદનમાં અનેક અધાર્મિક અને નાસ્તિક વિધાનો કરવામાં આવ્યાં છે, એટલું જ નહિ પણ કેટલીક વસ્તુઓ અવળી રીતે રજૂ કરીને સત્તાધારી પક્ષને તથા સત્તાધારી વ્યક્તિઓને જૈન સાધુ સંસ્થા સામે ઉશ્કેરવાની યુક્તિ પણ પ્રયોજવામાં આવી છે. આમ હોવાથી સામાન્ય જનતામાં કોઈ પણ ગેરસમજ ન થાય તે ઉદેશથી આટલું લખવાની ફરજ પડી છે.

પ્રથમ તો પંડિતમાઈઓનું લેખનું શીર્ષક જ દીક્ષા પ્રત્યેના પૂર્વ ગ્રહયુક્ત છે. દેખીતી રીતે જ તેમણે દીક્ષાને ‘કઠોર’ માનીને જ ગગડાવ્યે રાખ્યું છે. બાકી નિજ આન્માનું પારમાર્થિક કલ્યાણ કરનારી દીક્ષા કઠોર શી રીતે કહેવાય ? કઠોર તો તેનો વિરોધ જ છે ! અંગ્રેજ કહેવત ‘One man’s meat is another man’s poison’ એ ન સમજવા જેવી જ આમાં ભયંકર ક્ષતિ થયેલી છે. જે માર્ગ સન્માગની કે સંયમીને પોતાના રોજિંદા જીવન જેટલો સરળ ને સુસાધ્ય હોય છે, તે દુર્જનને મન ધણો જ વિષમ, અધરો લાગે છે, તે તો રોજિંદુ વ્યવહારનું સત્ય છે. દાખલા તરીકે મધ્યપાન, ધૂમપાન, વ્યબિચાર આદિનો ત્યાગ સજજનને તો તેની પ્રકૃતિનો, જીવનનો એક અંશ જ બની રહેલો હોય છે ને તદ્દન સ્વાત્પાવિક ને સરળ લાગે છે, પરંતુ દુર્જનને તેનો ત્યાગ ‘કઠોર’ લાગે છે ! અરે, એનો ત્યાગ કરવા સમજાવનાર પણ ‘કઠોર’ લાગે છે ! આજ રીતે સંન્યાસ દીક્ષાનો આજન્મ સ્વીકાર કરનાર તો તેનો પ્રેમપૂર્વક સ્વીકાર કરે છે, ને તે પ્રાપ્ત થતાં પોતાની આત્મસિદ્ધિ, જીવનસિદ્ધિનો માર્ગ સંપદ્યો તેમ માનીને પરમાનંદ પ્રાપ્ત કરી પ્રકૃતલ બને છે; જાણે આદર્શ પ્રાપ્તિ જેટલો જ પુલક ને ઉન્માદ અનુભવે છે ! પણ આ પરમાનંદની વાત ઘરબાર, ધન, કીર્તિ કે પંડિતાઈ કે એવી

बीજे हुन्यवी महत्ताओमां रायनाराओने शे समजाय ! शे समजाववी ? परंतु पचास-साठ वर्ष धर्मशास्त्रोनु परिशीलन करनारने पण आ न समजाय तो कोनो वांक ? शास्त्रोनो के परिशीलन करनारनो ? परंतु **लोचनाभ्यां विहीनस्य दर्पणैः किं प्रयोजनम्** ? के पधी मात्र धर्मपरंपराना अध्ययनमां खुद धर्मनो ज अभ्यास बाडी रहो ? खरे ज, नीसरणीनां पगथीयां गणनाराथी भित्तिचित्रोनी कणा जेई शकाती नथी !

वैदिक परंपरामां उपनयन संस्कार ज दीक्षित बनाववानो, द्विज बनाववानो, मुख्य संस्कार गणाय छे. त्यारथी ज बाणक विद्यार्थी बनीने गुरुने त्यां विद्याभ्यास करवा जतो, परंतु त्यारे जो विद्यार्थीमां वैराग्यभावना जागती तो ते चार आश्रमोना कमिक स्वीकार विना ज सीधो प्रवज्या ग्रहण करतो. आ संयोगोमां चालणगाडी विना ज स्वयं चालतां शीघ्रेला बाणकने चालणगाडीथी ज चलाववानो मोह राख्यो ते अज्ञान ज छे, या तो एक प्रकारनो हठाग्रह ज छे ! अर्थात् वैदिक परंपरामां नानी उमरे संन्यासीनु विधान नथी तेम कहेवुं थोहुं आणनार माटे पण इस्यास्पद करे छे, तो पांडित्यनु बिरुद प्राप्त करेलाओ माटे विशेष करीने ! अने वैदिक परंपरामां पण उपमन्यु वगेरे नानी उमरना क्यां नहोता ! ध्रूवमां पण वैराग्य नानपणमां उद्भवेलो ने ? ने प्रद्वलादमां पण भक्तिनी ल्हे लागेली ते य बाल्यवयमां ज ने ? नज्ञकना काणमां नामदेवनी भक्तिथी कोण अज्ञाश छे ? संत ज्ञानेश्वर पण १६मे वर्षे गीताभाष्य रचेलुं ऐ कहेवानी जडूर पडशे ? खरुं छे के आ बधाये संन्यस्त लीधुं न हतुं, पण बाल्यवयमां गत जन्मना संस्कार संन्यस्त के वैराग्यनी भावना नथी जन्मावता एम कोण कही शकशे ? त्यारे जो आम उद्भवेला, जागृत थयेला पूर्व जन्मना संस्कार कोई मानवीमां बाल्यवयमां ज वैराग्यनी भावना जगावे ने ते बाल संन्यासना टूके रस्ते आत्माना उद्घारनी प्रवृत्ति आढरे तो एना एवा प्रयत्नमां आडे आववानो मने, तमने, तेमने के आपाङी राज्यव्यवस्थाने पण शो अधिकार ? अने आपणे कोण ? जेमने हजु एवी वैराग्यनी भावना समजवानी पण शक्ति सांपडी नथी ! एमने एवो वैराग्य अटकाववानो शो अधिकार ? खरुं जेतां तो एवा योगभ्रष्ट आत्माने तेनी आध्यात्मिक उन्नतिना यत्नमां सहाय करवानुं ज कर्तव्य भावनाशाणी माटे छे. त्यां आवुं ऊलटुं अनाडी हिरण्यकश्यप, कंस के हुर्योंधननुं पात्र भजववानुं कोने सूझे ? माटे तो वर्तमान शंकराचार्य जेवाओमे आवी बालदीक्षामां डस्तक्षेप करनार बीलनो स्पष्ट विशेष करेलो छे. सामान्य रीते ब्राह्मणने माटे उपनय गर्भथी आठमे वर्षे करवुं तेवुं मनु भगवाने विधान कर्यु छे; परंतु पात्र विशेषने माटे

गर्भथी पांचमे वर्षे पाण उपनयननु विधान कर्यु छे, काराण के मनु भगवान लजे छे के ते बाणक कदाच कोई देवनो अवतार होय ने तेनामां विशेष योग्यता होवा संभव छे. टीकाकार कुल्लूक भइ लजे छे के कोई वार बाणकमां पोतामां आवी भावना समजवानी शक्ति न होय तो तेनां मातापिता ते समजने ते ग्रमाणे संन्यस्त के दीक्षा अपावी शके छे. केणवणी, व्यापार के गृहस्थधर्म वगेरे बाबतोमां माबाप जेम बाणकना डित्नो विचार करी शके छे तेम तेओ पोताना बाणकना संन्यस्त के अध्यात्मविद्यानी बाबतमां पण तेना ज डित्नो विचार करी शके छे तेम पण कुल्लूक भइ कहे छे. त्यारे आ छे वैदिक भत, ने वैदिक परंपरा.

वणी पंडित भाईओनी मान्यता के शंकराचार्यनी बाणदीक्षा अपवाद के अक्समात छे ते पण भम छे. खरुं जेतां तो ते वैदिक संन्यास परंपरानो एक अंशमात्र ज छे. अलबत जेम दरेक गृहस्थ गांधीज के जवाहर थर्थ शक्तो नथी, तेम दरेक बाणब्रह्मचारी पण शंकर के डेमचंद्र न बनी शके ते पण स्पष्ट ज छे. परंतु ते उपरथी शंकराचार्य पधी बालदीक्षित थया नथी के थता न हता ते कहेवुं ते सामान्य समजनो अभाव अथवा विकृत रजूआतनी युक्ति ज छे ! एक उताम गृहस्थ मानवीने अपवाद लेखीने बीजा बधा गृहस्थोने जेम हलका गणीने उतारी पाडी शकाय नहि, तेम एकाद बाणदीक्षितनुं सांभणेलुं दृष्टांत सत्य मानी बधा बाणदीक्षितो अशसमजमां दीक्षा ले छे तेम मानवुं, मनाववुं ते पण एक प्रकारनुं अज्ञान ज छे. अपहरणथी के भरमावीने साधु बनावाय छे एम कहीने पण मारा पंडित भित्रो कायदाने के न्यायालयने योपदेथी कोई दृष्टांतो २४ करी शकता नथी, के बीलना प्राणेता पण तेम करी शकता नथी ते तेमना पक्षनी निर्बिता, तेमनी दलीलनी निर्बिता-असहायता नहि तो बीजुं शुं छे ? एक आर्य तरीके कर्म तथा पुनर्जन्मना सिद्धांतोमां माननार कोई पण मानवी बालसंन्यासनो विशेष करी शके नहि, तो तेने कुठाराधात करनार बीलने समर्थन तो करी ज शी रीते शके ?

बौद्धोमां, तिबेट जेवां स्थणे, दस बौद्धमांथी त्रश तो साधु ज होय छे. साधु परंपरानुं तो त्यां शासन चाले छे. कुटर्ती रीते ज त्यां बाल्यवयथी ज दीक्षा अपाय छे अने आपणा पंडितवर्यो स्वीकारे छे तेम तेओ भिक्षुवेष ले छे ने ते अनुसार ज ज्ञवन पण ज्ञवे छे अने कोई पणे न फावे तो गृहस्थज्ञवनमां पण पाणी फरे के फरवा मागे तो तेने कोई अटकावतुं नथी. आवा गृहस्थीओ आजे पण जैन समाजमांथी भणी आवे तेम छे. तेनी कोण ना पाडशे ? जन्मटीप के एवी बीज भयंकर गुण्डाओ माटे थती सजा भोगवी चुकेला पण ज्यारे समाजमां मानवंत ज्ञवन ज्ञवी शके छे त्यारे तेमने कोण अटकावे छे ? त्यारे आ तो

આધ્યાત્મિક પ્રયત્નમાંથી પાછા પડેલાને શા માટે કોઈ અપમાને ! ભાવિક જન તો માનશે કે તેનો કર્માદ્ય હાલમાં તેવો હશે, ને કર્માનો પુણ્યાદ્ય થશે ત્યારે તે જ કરી આત્માનનિને માર્ગ વળશે જ.

જે બૌદ્ધભિષ્ણુ પરંપરાનાં વખાણ પંડિતમિત્રો, જૈન સાધુઓને જાણે ઉતારી પડવા હોય તેમ કરે છે તે તો ખરું જોતાં જૈન ભિષ્ણુ પરંપરાના અનુકરણરૂપે જ ઉદ્ભવેલી છે. માટે જો જૈન પરંપરાની સ્થિતિ, તેઓ કહે છે તેમ જુદી હોય તો તે અધિક ગુણવત્તાની દર્શિએ જ, હીનતાની નહિ અને જૈન સાધુઓની આ ગુણવત્તાનો તો આપણા સન્માન્ય મુખ્ય પ્રધાન શ્રી મોરારજીભાઈએ પણ તેમના કાઉંસીલ સમક્ષના પ્રવચનમાં મુક્ત કંઠે કરેલો જ છે, ને તે પણ આપણા પંડિતવર્યોને સ્મરાવવું પડશે ? તેથી ઊલટી રજૂઆત કરનાર જૈનો માટે તો મારે શું કહેવું ? બાકી જૈન જનતા તો તેમના ઉદ્દેશ બરાબર સમજે છે, તેમાં લવલોશ શંકા નથી.

જૈન દીક્ષા બીજા ધર્માની સંન્યાસ દીક્ષા કરતાં સંપૂર્ણ છે. તેથી જ માત્ર બીજા ધર્માનોને કદાચ ગહન કે કઠોર લાગે, તે સ્વાભાવિક છે, પરંતુ જૈન પરંપરામાં જ ઉધરનારને મન તો તે સ્વાભાવિક ને પ્રકૃતિગત જ છે. મુસલમાનોને રોજે રાખવા કે જૈનોને અનેક પ્રકારનાં વ્રતો કરવાં તે એક સ્વભાવનો ભાગ જ બની જય છે, જૈનધર્મ જ ત્યાગપ્રધાન છે. તેનું મુખ્ય લક્ષ્ણ જ આચારશુદ્ધિ છે. એ ધર્મના આદર્શરૂપ મુનિઓ બીજાની દર્શિએ કઠળ આચાર પાળે તો તેમાં કાંઈ આશ્રય કે વધારા પડતું નથી. ખરું જોતાં તો સામાન્ય બાવાઓ કે સંન્યાસીઓ જેવાં પતનનાં સ્થાન કે છિદ્ર તેમાં નથી; તે જ તેની વિશિષ્ટતા છે. એવી વિશિષ્ટતાને દોષ ગણાવવા જેવી ને જેટલી દુર્બુદ્ધિ હજુ સામાન્ય જૈનોમાં પણ આવી નથી. પંડિતોની બાબતમાં અમે કાંઈ કહી શકતા નથી.

‘કારી’ ઉંમરમાં દીક્ષા સ્વીકારવાથી ભયસ્થાનો વધે છે તેવું વિધાન પણ માનસશાસ્ત્રના સિદ્ધાંતથી વિરુદ્ધનું છે. ખરું જોતાં તો વાધનું બચ્યું માંસાદિ ન ચાબે ત્યાં સુધી તે સામાન્ય પશુની જેમ જ જીવન જીવે છે, પરંતુ એક વખત તેનો પરિચય કર્યા પછી એ બચ્યા પાસેથી અહિસક વર્તન વાંછવું અધરું થઈ પડે છે. અલબત્ત, સરકસમાં તેમને કેળવીને કામ કરાવી શકાય છે, પણ તે કેટલું અધરું બને છે; તે તો તેને કેળવનાર અને જોનાર સમજ શકે તેટલું સ્પષ્ટ જ છે. ખરેખર, કેટલીક વખત ખરાબ વસ્તુનું અજ્ઞાન જ લાભદાયી હોય છે. તે આધ્યાત્મિક પ્રગતિના પંથીઓથી અજ્ઞાન નથી. પતિત થયેલા જૈનદીક્ષિતનું સમાજમાં પાછું ફરવાનું શક્ય નથી તે કહેવું જૈન સમાજ વ્યવહાર નિરીક્ષણનો અભાવ સૂચ્યવે છે. અલબત્ત, અસામાન્ય કામ કરનાર તરફ જેમ લોકો જુએ છે તેમ થવાનો સંભવ

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ” (ભાગ-૧૮)

૨૨૩

કુદરતી જ છે, આવી કમનસીબી હજારમાં એકાદને આવે તેથી ધાર્મિક બાબતમાં રાજ્યને વચ્ચમાં પડવા, હસ્તક્ષેપ કરવા આમંત્રણ આપવા જેવી મૂર્ખતા કોણ કરે ? પરંતુ ડાહી રાજ્યવ્યવસ્થા એવો હસ્તક્ષેપ કરશે નહિ, તેની જૈન સમાજને ખાતરી છે.

નીતિભંશના દાખલાઓ પંડિતો પાસે રાખે છે, જાહેર નથી કરતા ! પરંતુ આવા ભામમૂલક દણાંતો આપ્યા વિના જ બાંધેભારે જ વિધાનો કરવાં તે તર્કશુદ્ધ નથી એ પંડિતોથી કેમ સમજાતું નથી ? વિશેષમાં દીક્ષિત બાળાઓ માટે ભયસ્થાનો અને પતનની કલ્યાણાઓ કોઈ કોલેજ કન્યાઓ જેવી કે શાળાની શિક્ષિકાઓ જેવીને માટે હોય તેવી ઢબથી રજૂ કરવાની મેલી મુરાદ વિષે શું કહેવું ? બાકી હજારો માનવોમાંથી કોઈ (સંપૂર્ણ) શુદ્ધતાથી ચલિત થાય તેથી આખી સંસ્થા અને તેની પ્રણાલિકા દોષવંત છે તેમ કહેવું તે નરી બાલિશતા જ છે ! અપવાદથી વ્યાપ્તિ બાંધવા જેવું જ છે ! એક ગુણેગાર ઉપરથી ૮૮૮ ને ગુણેગાર ઠરાવવા જેવું જ છે ને ? જૈનોમાં બાલદીક્ષા લેનારા જ આંગળીએ ગણાય તેટલા, ને તેમાંથી ચળવાના દાખલા તો હજારમાંથીય પણ કેટલા ? અને એવી કલિયેત સંખ્યા ખાતર સાધુ સંસ્થાના પરમોજજવલ ભૂત, વર્તમાન તથા ભવિષ્ય ત્રણેનો વિધ્યંસ કરાવવો છે ? આવું ધર્મનું અપમાન કરનારું, તેને દગ્ધો દેનારું, ગોઝારું કાયદાનું શસ્ત્ર આવી પરમ પવિત્ર બાળદીક્ષાની પરંપરા સામે કેમ ઉગામી શકાય ? કયો જૈન, કયો આર્ય તેમાં મદદ કરી શકે ? સદ્ધભાગે હજુ આર્યભૂમિ સાવ નિઃસત્ત્વ કે અનાર્ય થઈ ગઈ નથી !

તટસ્થ રીતે વિચારતાં પણ જે પ્રથાએ વૈદિક ધર્મનો પુનરુદ્ધાર કરનાર આદ્ય શંકરાચાર્ય કે કલિકણ સર્વજ્ઞ શ્રી હેમયંદ્રાચાર્ય જેવા, આપણાને આપ્યા છે, તેના અસ્તિત્વની લાયકાત દર્શાવવા એ બે નામ જ પૂરતાં છે. આ બે મહામાનવ, Supermen આપીને બાલસંન્યાસ દીક્ષાની પરંપરાએ તેનું અસ્તિત્વ સફળ કર્યું છે. રખે આપણે કોઈ ભાવિ શંકરાચાર્ય કે હેમયંદ્રાચાર્યને આ બીલ જેવા અવિચારી ને મૂર્ખ કૃત્યથી ગુમાવી બેસીએ એટલું જ કરીએ તો ય બસ છે. જૈન પરંપરામાં તો હેમયંદ્રાચાર્ય પછી અનેક બાલદીક્ષિતોએ જૈન ધર્મની, જૈન સાહિત્યની સેવા કરી છે ને તે સર્વ વિદ્યાન જૈનો જાણે છે, છતાં નીચેની નામાવલિ તે સિદ્ધ કરવા પૂરતી છે :-

શ્રી હેમયંદ્રાચાર્ય પછી શ્રી દેવસૂરિજી, શ્રી સોમપ્રભસૂરિજી, શ્રી જિનકુશણસૂરિજી, શ્રી સિંહતિલકસૂરિજી, શ્રી જ્યાનંદસૂરિજી, શ્રી મેરુતુંગસૂરિજી, શ્રી કુલમંડનસૂરિજી, શ્રી સોમસુંદરસૂરિજી, શ્રી વિજયહીરસૂરિજી, શ્રી

૨૨૪

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-જૈન શાસનમાં ભાગવતી દીક્ષાનું સ્થાન (ભાગ-૧૮)

વિજ્યસેનસૂરિજી, ઉપાધ્યાયજી શ્રી યશોવિજ્યજી મ. વગેરે બીજા ઘડાય બાળદીકિતો મહાવિદ્યાન, મહાપ્રભાવિક અને ઉત્તમ ચારિત્રસંપન્ન થયા છે.

બાકી અઠાર વર્ષે પણ દીક્ષિતની પ્રતિભા તેટલી જ ચમકશે એમ પાંડિત્યથી કહેવું તે બ્રહ્મ ઉત્પન્ન કરી જનતાને ઊંઘે માર્ગ વાળવાનું જ છે. જે કાર્ય ગૃહસ્થધર્મ તજીને નાનપણથી જ, એક જ કાર્યમાં, ધર્મકાર્યમાં લાગેલો માનવી કરી શકે, કરે, તે ૧૮ વર્ષ પછી જ ધર્મનું જીવન ધ્યેય સ્ત્રીકારનાર શ્રી રીતે કરી શકે ? કિકેટ કે બીજી રમત-ગમત કે નૌકાદળ, ભૂમિદળ કે હવાઈદળમાં યુવાનોને તાલીમ આપવા માટે પણ ‘Catch them young’નું સૂત્ર અપનાવાય છે ! તો જ્યારે ધર્મમાં પણ આપણા પૂર્વજી એ સૂત્ર અપનાવી ચૂક્યા હતા ત્યારે તેને આજે આપણે દોષ કેમ દઈએ કે ગણીએ ! દુનિયાદારીની સિદ્ધિ માટે પણ ‘નાનપણથીજ પલોટ્યાની’ વૃત્તિ રાખનારે આધ્યાત્મિક સિદ્ધિ માટે એ સિદ્ધાંત બાજુ પર રાખી ક્યી આધ્યાત્મિક સિદ્ધિ કે ધર્મસેવાની દીક્ષિતો પાસેથી આશા રાખવાની રહી ? ખરે જ, આ બીલથી તો ધર્મકાર્ય, ધર્મ ઉન્નતિ, સાહિત્ય ઉન્નતિ, આત્મિકઉન્નતિ દરેકમાં એક મહાન અંતરાય જ ઊભો કરવા જેવું થશે. દુનિયામાં જીવન માટેની આવશ્યક વસ્તુઓ ખાનપાનાદિ માટે મર્યાદા નક્કી કરાતી નથી, માનવી પોતાની મેળે જ યથાશક્તિ તેનો ઉપભોગ કરે છે, ભૂલ હોય તો સહન પણ કરે છે, એમાં સમાજજીવનને હાનિ થતી નથી, એને પોતાને જ હાનિ થાય છે. એવી રીતે બાલદીકા એ વ્યક્તિગત પ્રશ્ન છે, સામાજિક નથી, અર્થાત્ માણસના પોતાના આધ્યાત્મિક જીવન સાથે તે સંકળાયેલો છે. એમાંથી નિપજ્ઞતાં પરિણામો એને જ ખપતાં છે, એને જ લગતાં છે, એમાં બીજાને હસ્તકેપનો અવિકાર નથી; વળી secular બિનધાર્મિક રાજ્ય પદ્ધતિને તો નથી જ, અને તે વાત રાજ્ય જાણે પણ છે. જે રાજ્ય પદ્ધતિ પ્રિસ્ટીઓના પાદરીઓને પણ ધર્મનીતર કરાવતાં જે કારણથી અટકાવતી નથી તે જ કારણોસર આવી બાલદીકા અટકાવવા જેવી ધાર્મિક બાબતને પણ પુષ્ટિ આપનાર નથી, આપે નહિ, તેની જૈન સમાજને ખાત્રી છે.

ખરું જોતાં તો જૈન તેમજ સર્વ આર્થદર્શનો અનુસાર આધ્યાત્મિક પ્રગતિની એક સંબંધ સાંકળ અનેક જન્મોથી ચાલતી આવેલી હોય છે, તેમાં શુભ કર્મોદય થતાં જ ત્યાગની દીક્ષાની ભાવના ઉત્પન્ન થાય છે. તેમાં આ જન્મમાં તે માનવને પાંચ કે સાત કે દસ વર્ષ થયાં છે તે અગત્યની વસ્તુ નથી. સાચી રીતે તો તે પાંચ કે સાત વર્ષમાં આગળના જન્મોના અનેક વર્ષોના અનુભવ તથા સંસ્કાર ઉમેરવાના છે, ને તે જ તેની, તેના આત્માની સાચી ઉંમર છે. શરીરની ઉંમર આવી આધ્યાત્મિક બાબતોમાં ગૌણ છે. નિરર્થક છે. આઠલી સાઢી ધાર્મિક સમજ જ કોઈ અપંડિતને

સુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ” (ભાગ-૧૮)

૨૨૫

પણ આ દેશમાં તો સુલભ છે, હું પંડિતવર્યોની વાત કરતો નથી.

બાલદીકા આમ કોઈ રીતે સામાજિક પ્રશ્ન નથી, એને સંપૂર્ણ રીતે ધર્મ સાથે જ સંબંધ છે, સમાજ સાથે નહિ. બાકી દરેક બાબતને અનેક પાંસા હોય છે ને દરેક બાબત ધાર્મિક પણ-રાજકીય, વૈજ્ઞાનિક, શૈક્ષણિક, નાગરિક કે સામાજિક છે એમ દલીલોથી સિદ્ધ કરી શકાય, ને તે તો જૈન પંડિતો સ્યાદ્રાદવિદો-સહેલાઈથી કહી શકે. વળી બાલદીકા ઝાંદ્યુસ્તાતાનો પ્રશ્ન નથી, એ તો જૈન ધર્મના અસ્તિત્વનો મૂળભૂત પ્રશ્ન છે. સહેજે પણ રાજ્યનો હસ્તકેપ જૈન ધર્મનાં મૂળ તત્ત્વોને વેરવિભેર કરી નાંખશે; તે પછી એનાં દૂરગામી પરિણામો શું આવશે તે આજે ખાડો ખોદનારે ન સમજાય પરંતુ બીજા અનેકને તે સમજાય છે. તે માટે જ આવા બીલનો વિરોધ સ્પષ્ટ કરવો પડે છે. જે મુસલમાન કે પ્રિસ્ટિ રાજ્યકર્તાઓએ પણ કર્યું નથી તે આજની પ્રજાકીય સરકાર નહિ જ કરે તેવી આશા રાખવી યોગ્ય જ છે.

પંડિતભાઈઓ આજના રાજકર્તાઓને સ્વતંત્ર્યના સંગ્રામ વખતે જૈન સાધુઓએ મદદ ન કરી તેમ કહીને સાધુઓને નિંદવાનું તો નથી ચૂકતા પણ હાલની કોંગ્રેસ સરકારને “જૈન સાધુઓએ લડતમાં આપણને મદદ કરી ન હતી, આજે ઠીક વખત આવ્યો છે, તેમને આપણે દંડીએ” એવી મનોવૃત્તિ જગાવવા પણ પ્રયત્ન આદરી રહ્યા છે તે જૈનમિત્રોને શરમાવનારું નથી શું ? પરંતુ રાજ્યનીતિશો આવાથી છેતરાય એવા ભોળાભટ હોતા નથી, તે તો દરેક વસ્તુનો તેનો સારાસાર વિચારીને જ નિકાલ કરે છે.

અમારા પંડિત બિરાદરોના કથન મુજબ બાલદીકાથી સાંપ્રદાયિકતા આવે છે. ઉલદુ દીક્ષિતોને તો સ્વે સ્વે કર્મણ્યભિરતઃ સંસિદ્ધ લભતે નરઃ ॥ ની માફક પોતપોતાનું કર્તવ્ય બજાવવામાં જ આનંદ રહે છે, સિદ્ધ પ્રાપ્ત થાય છે. પંડિતભાઈઓએ વધુવેલી સાંપ્રદાયિકતા હોત તો શ્રી હરિભદ્રસૂરિજી જેવા ખૂદરાશન ઉપર ગ્રંથ કેમ લખત ? ને હેમયંડ્રાચાર્યજી પ્રાકૃત વ્યાકરણ કેમ લખત ? ને બીજા તેને પ્રમાણ પણ કેમ ગણત ?

માટે અંતમાં એટલું જ કહેવાનું કે બાલદીકા નથી તો સમાજ માટે કે દીક્ષિત પોતાને માટે વિધાતક, ને જે તે બંનેને નુકશાન ન કરે, તે દેશને તો નુકશાન કરે જ શી રીતે ? બાલદીકાનો પ્રતિબંધ કરવો, એ ધાર્મિક સ્વતંત્ર્યનો મૃત્યુધંટ વગાડવા સમાન છે ને પ્રજાકીય સરકાર તેમ નહિ જ કરે ને તે બીલને કોઈ રીતે ટેકો નહિ જ આપે તેમજ પસાર પણ થવા નહિ જ દે, તેવી સર્વ કોઈ ધાર્મિકવૃત્તિવાળા, સાદી સમજવાળા પ્રજાજનને શ્રદ્ધા છે. બાકી પ્રતિબંધ કરવા યોગ્ય તો આજે ધંધું ચાલી રહ્યું છે. દાખલા તરીકે નાની ઉમરનાં બાળકોને આજે અયોગ્ય રંગદર્શનો,

૨૨૬ ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-જૈન શાસનમાં ભાગવતી દીક્ષાનું સ્થાન (ભાગ-૧૮)

ચલાયિત્રો વગરે જોવાની છૂટ અપાય છે. બીડી વગરે વ્યસનોની છૂટ અપાય છે, તે છે. રાજ્ય ભલે તેમના ઉપર નિયમન મૂકે, અમારો તેને ટેકો છે, બાકી બાળસંન્યાસ કે દીક્ષા ઉપર નિયમન મૂકવાનો ભયંકર વિચાર તો કોઈ વિચારે પણ નહિ. એજ અભ્યર્થના !

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદધિ”

વર્ષ-૪, અંક-૧૭, તા. ૨૧-૧૨-૧૯૫૫



## છવ્યીસ સ્ત્રીસંસ્થાઓના આશ્રયે મહેલી બહેનોની જહેર સભાના પ્રમુખ સ્થાનેથી શાવિકા સીતાબહેને આપેલું મનનીય વક્તાવ્ય

અમદાવાદ તા. ૨૧-મી ડિસેમ્બર, ૧૯૫૫

હૃતી બહેનો અને પુત્રીઓ,

આજની સભાનું પ્રમુખસ્થાન તમો બધી બહેનોએ મારી પ્રત્યેના સદ્ગ્રાવથી અને પ્રેમથી આય્યું છે એમ હું માનું છું અને મેં પણ ધર્મફરજ બજાવવામાં જો આ શુદ્ધ ખખેલું શરીર કામે લાગું હોય તો એ પણ સદ્ગુર્યોગ છે; એમ માનીને સહર્ષ સ્વીકાર્યું છે. મને પૂરી આશા છે કે તમો બધી બહેનોના ઉમળકાભર્યા સહકારથી મારી ફરજ હું પૂરી બજાવી શકીશ. આપણે અત્રે બાળ સંન્યાસ દીક્ષા પ્રં બીલનો વિરોધ કરવા માટે એકઢા મળ્યા છીએ. હજુએ કેટલાકો ગુંચાય છે કે આ બીલ લાવનાર ભાઈ શ્રી પટવારીને અને તેને જેઓ ટેકો આપી રહ્યા છે તે ભલે બહુ અલ્ય સંઝ્યામાં છે, પરંતુ તેમને શું કમાણી કરવી છે કે તેઓ આ પ્રયત્ન કરે છે ? આ ગુંચ આપણે ઉકેલીએ. માણસના દરેક કાર્યમાં પૈસાની કમાણી જ ધ્યેય હોય છે એવું નથી. કોઈક કાર્યમાં માનલાલસા હોય છે, કોઈકમાં કીર્તિની અપેક્ષા હોય છે, કોઈકમાં બીજાને રાજી કરવાનું હોય છે અને કોઈક વખતે પોતે જ વિચાર ધરાવતો હોય છે તે રસ્તે બીજાને લઈ જવાનો ભાવ હોય છે. આમાં બે પ્રકાર હોય છે, એક શુદ્ધ અને બીજો અશુદ્ધ. જે ઉદેશથી આ બીલ લવાયું છે અને તેને ટેકો અપાય છે, તેનો વિચાર કરતાં મને જણાય છે કે આ વ્યક્તિઓનું ધ્યેય આત્માના વિકસનનું નથી, પરંતુ ભૌતિક સુખ અને ભૌતિક સામગ્રીના વિકસને અવલંબે છે એટલે અશુદ્ધ છે. એમનું ચાલે તો સંસારનો ત્યાગ કરવાનું સર્વ વય માટે બંધ કરાવે, પરંતુ મનુષ્ય ઉંમર લાયક થયા પછી હાલના કાયદાથી પણ અને

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ” (ભાગ-૧૮)

૨૨૭

સ્વતંત્ર માન્યો છે જેથી ૧૮ વર્ષ પછીનાની વાત કરે તો તેમનું કાઈ ચાલે નહિ અને કોઈ તેમનું સાંભળે પણ નહિ; માટે પ્રથમ સગીર અજ્ઞાન છે અને તેને આવા પ્રતોનો ભાર લેવાની શી સમજ એવી એવી વાતો કરીને સરકારને અને જનમતને પોતાની તરફ વાળવાનો સહેલો માર્ગ પસંદ કર્યો છે અને એકલી સગીરની અજ્ઞાનતાની વાતથી પણ ચાલે નહિ, તેથી નસાડવા-ભગાડવા વગેરેના આક્ષેપો જોડી કાઢ્યા અને હવે તો આગળ વધીને બાળદીક્ષિત અને બાળદીક્ષિત ઉંમર-લાયક થાય ત્યારે વાસનાના ઉદ્યથી પડે તો ધર્મ વગોવાય અને શ્રમણ-સંસ્થાનું ખરાબ દેખાય, એવી ભામક દલીલની માયાજળ કેટલાકોએ શરૂ કરી છે, પરંતુ ભારતની જનતા અને સરકાર હવે જગૃત થઈ ગઈ છે. એટલે આવા જદુઈ બગોથી છેતરાશે નહિ એમ હું માનું છું, છતાં યે તમારે જગૃત રહેવાની જરૂર છે. જે બાળદીક્ષા બંધ કરાવવામાં જડવાદ ફાવે પછી તો મોટાઓની દીક્ષા બંધ કરાવવી અને માટે સહેલું છે. એ વખતે સ્ત્રી, છોકરાં, કુટુંબ, ઘરડાં માબાપ વગેરેની દ્યાની અને ભરણ-પોષણની વાતોથી યુવાન અને પ્રૌઢને અટકાવાશે અને વૃદ્ધને માટે પાંજરાપોળ ત્યાં ત્યાં જઈને શું કરવાના છે ? એ રીતે એમને રોકાશે એટલે આ બીલનો વિરોધ અને ટેકો એ વાસ્તવિક રીતે આ અથાત્મવાદ અને ભૌતિકવાદ વચ્ચેનો વિશ્રાંહ છે. આવા પ્રસંગોએ પ્રજાની નાડ પરખાય છે. આ બીલનો વિરોધ કરવામાં બીજા ધર્મોવાળા પણ જોડાયા છે, પરંતુ બહુ પારબું તો જેનોનું થવાનું છે. જડવાદીઓની નજર પણ જૈન દીક્ષા સામે છે. જૈનની ગણથુથીમાં ત્યાગ હોય છે, એની આ કસોટી છે. દીક્ષા ઉદ્યમાં આવવી એ તો ચારિત્ર મોહનીય કર્મના ક્ષયોપશમનું ફળ છે. એ કાયદાથી રોકાયે નહિ ને રુંધાયે નહિ. આત્માના વાસ્તવિક ગુણની પ્રભાને કોણ અટકાવી શકે ? કર્મની શક્તિ ધંધી છે, પરંતુ આત્મા માલિક છે, એ જાગે પછી પારોશીઓનું શું ચાલે ? માટે જ હું કહું છું કે સંસારત્યાગ એ આત્માની સ્વાભાવિક દશા છે, જ્યારે વિષય કખાયની આવિનતા એ આત્માની વિભાવ દશા છે. ભૂલા પેલાને જેમ સ્વગૃહે જવાનો અધિકાર છે, તેમ જે સ્વાભાવિક દશા છે તે પ્રાપ્ત કરવાનો દરેકને અધિકાર છે. માટે દીક્ષા એ પ્રત્યેક માનવનો જન્મ-સિદ્ધ હક્ક છે. જેઓ આ જન્મની વયને માત્ર જુએ છે તેઓ બાબ્યદાસ્તિ છે. કારણ કે કોઈક જીવનો ત્યાગનો અભ્યાસ હજારો-લાખો વર્ષોથી શરૂ થઈ ગયો હોય છે અને તેથી ૧૪૪૪ ગ્રંથના પ્રાણોત્તા શ્રીમાન હરિભદ્રસૂરિજી મં કહે છે કે ત્યાગનો સંબંધ વય સાથે નથી પરંતુ ચારિત્ર મોહનીય કર્મના ક્ષયોપશમ સાથે છે, માટે જ તેવા બાળને દીક્ષાના ભાવ થાય છે. અને સંસારમાં ગૃહ્ણિ હોય છે તેવા પ્રૌઢને કે ઘરડાને થતા નથી. વધુમાં એ મહાત્મા કહે છે કે જેણે સંસાર માંડ્યો નથી અને

૨૨૮ ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-જૈન શાસનમાં ભાગવતી દીક્ષાનું સ્થાન (ભાગ-૧૮)

દીક્ષા લે છે એના કરતાં જેણો સંસાર માંયો છે અને પછી દીક્ષા લ્યે છે એ બેમાં જે ભુક્તભોગી એટલે વિષયસુખો ભોગવ્યાં છે, તેને સ્મૃતિ આદિ અનેક કારણોથી પતનની સંભાવના વધારે છે. પતનનું કારણ અવિવેક પણ છે, એનો સંભવ તો બધી વયે સરખો છે માટે દીક્ષિતોને બાળ યા બાળા છે માટે પડવાનો ભય વધારે માનવો એ બરાબર નથી. આ ઉપરથી આપણો બધાયએ નિશ્ચય કરી લેવાની જરૂર છે કે પટવારીનું બાળ દીક્ષા પ્રતિબંધક બીલ આપણા અને આપણા પુત્ર-પુત્રીઓના આધ્યાત્મિક વિકાસના માર્ગમાં પથરા નાંખવા જેવું છે માટે તેનો વિરોધ હજુ ખૂબ પ્રયંડ થવો જોઈએ જેથી સરકારને તે તુરત રદ કરવાની ફરજ પડે.

❖ ❖ ❖



“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદધિ”

વર્ષ-૫, અંક-૧૮, તા. ૧૫-૬-૧૯૫૭

૩૬

## સંસ્કૃતિના સંરક્ષણ

(ભાગ-૧)

(ભાવનગર કૃષ્ણકુમારસિંહજ ટાઉન હૉલમાં તા. ૧૯-૫-૫૭ ને રવિવારે અપાયેલ જાહેર વ્યાખ્યાન અને તે પછીના વ્યાખ્યાનનું અવતરણ.)

રસ કેટલા ? :-

અન્તં ઉપકારી તત્ત્વજ્ઞાની મહાપુરુષો પોતાના દિવ્યજ્ઞાનની પ્રભાને જગત પર પાથરતાં એ વાત ફરમાવી રહ્યા છે કે મનુષ્યને જીવન રસવાળું ગમે છે. પ્રશ્ન એટલો જ છે કે જીવનનો રસ શામાં રહેલો છે ? આ ભારત ભૂમિ પર જ્યાં સુધી સંસ્કૃતિના વહેણ વહેતાં હતાં, ત્યાં સુધી માણસને જીવનમાં નીરસતાની ફરિયાદ નહોતી. આજે સંસ્કૃતિના વહેણ સૂકાઈ ગયાં; તો પરિજ્ઞામ સ્પષ્ટ દેખાય છે કે જ્યાં ને ત્યાં નીરસતાની ફરિયાદ છે. ત્યારે પહેલું તો એ જુઓ કે રસ કેટલા પ્રકારના છે ? તત્ત્વજ્ઞાની મહર્ષિ કહે છે કે કોઈને રસ કામ એટલે કે ઈન્દ્રિયના વિષયોમાં લાગે છે. તો કોઈને સારા ભોજનમાં રસ પડે છે. ત્યારે કોઈકને અધ્યાત્મના પોષક શાસ્ત્રોમાં રસ પડે છે. હવે આમાં એ જુઓ, કે રસ ક્યાં તૂટક વહે છે અને રસ ક્યાં ગંગાપ્રવાહની જેમ અતૂટ ધારાએ વહ્યો જાય છે. મહર્ષિ કહે છે;

કામમાં રસ ભોગ સુધી :- રસોભોગાવધિઃ કામે માણસ કામમાં, ઈન્દ્રિયોના વિષયોમાં રસ લેવા દોડે છે. એમ માને છે કે ‘મારા જીવનને આનાથી જ રસતરબોળ કરી દઉં;’ પણ રસ તરબોળતાનો વિચાર કરતાં દેખાય છે શું ? ઈન્દ્રિયોના વિષયોમાં રસ માત્ર એના ભોગવટા સુધી જ. ભોગવટો કરી લીધો કે રસ ખૂટી ગયો ! પછી એનો એ ભોગવટો ચાલુ રાખવાનો રસ રહેતો નથી. હવે તો પાછી નવા વિષયના રસની ભૂખ ઊભી થઈ ! એ રસમાં જ્યાં ભોગવટો કર્યો ન કર્યો કે રસ ખૂટ્યો ! સહરાના રણમાં દોડતું પામર હરણીયું પાણી જોઈએ છે માટે દોડે છે. અંજવાના નીરમાં રસ દેખે છે, ખરી રીતે ત્યાં હતું તો કંઈ નહિ; માત્ર સૂરજના કિરણ રેતીને ચકમક કરી રહ્યા હતા; પાણીનો માત્ર દેખાવ હતો. છતાં એવા જૂઠા પાણીમાં દોટ ક્યાં સુધી ? કલ્પેલા સ્થાને પહોંચે ત્યાં સુધી. જોયું કે પાણી નથી,

ત્યાં નિરાશા ! પતી ગણું. રસ ખૂટચો ! આશા જમીનદોસ્ત થઈ ગઈ. પાછો નવો રસ, નવી આશા, ને ફેર દોટ. ઈન્દ્રિઓના વિષયોની પાછળ દોડનારની પણ આવી જ મૃગજળીયા હરણ જેવી કંગાળ દશા છે. એક ગાયન એક વાર સાંભળું કે રસ ખૂટચો. હવે બીજાનો રસ જાગ્યો. સિનેમાનું એક દશ્ય જોયું કે રસ ખૂટચો. હવે બીજા દશ્યનો રસ જાગ્યો ! એક જાતનું ફૂલ સૂંધ્યું કે રસ ખૂટચો. બીજી જાતના ફૂલનો રસ જાગ્યો ! શું છે આ ? વિષયોનો ભોગવટો કર્યો કે રસ પૂરો થયો; હવે નીરસતા આવી.

### ધનમાલમાં રસ ઉપાર્જન સુધી :-

જગતનો એવો એક બીજો વર્ગ છે કે જેને પૈસા કમાવાની જ ભારે લગની હોય છે. એવા માણસને પૈસા મળે છે કે એ રસ પૂર્ણ થઈ ગયો ! હવે રસની આશા શી ? પણ ત્યાં તો વધુ પંચાતી ! સનેપાતના તાપવાળાને ડોક્ટર મેલેરીયા સમજ ઈજ્કેશન આપે તો વધુ સનેપાત ! એમ લક્ષ્મીનો સનેપાત પણ એવો જ. થોડા ઘણા કુકા હાથમાં આવ્યા કે સનેપાત ઓર વધે. મળ્યાનો રસ હવે નહિ; હવે નવું મેળવવાનો રસ ! શતવાનૂં સહસ્રમિચ્છતિ લક્ષણીં સહસ્રાધિપતિઃ । લક્ષપતિઃ કોટિમિચ્છતિ । સો ની ઈચ્છા હતી, સો મળ્યા કે હવે એ સો નો રસ ખૂટચો. હવે હજારોનો રસ જાગ્યો. ગુણાકાર ચાલ્યો. પહેલાં દસ ગુણો. સોના હજાર. પછી લાખની ઈચ્છા, એટલે સો ગુણો ! આ શું ? રસની વૃદ્ધિ છે ? ના અંદરનો સંતાપ શતગુણો વધ્યો.

### માનપાનમાં રસ મળવા સુધી :-

ત્યારે માનપાનમાં શું છે ? ચાર માણસ માનપાન આપે એનો રસ એ માનપાન મળ્યા કે પૂરો થયો ! હવે ચૌદ જણનાં માનપાન જોઈએ છે. તો જગતના માનપાનમાં ય રસ ક્ષિણિક છે.

### ખાનપાનમાં રસ ભોજન કરો ત્યાં સુધી.

ગમે તેવું જમણ હોય, તુંચા ખાનપાન હોય. મેવા પદ્ધવાન્ન ખાવા મળ્યાં હોય પણ એનો રસ ક્યાં સુધી ? ખાંધું નથી ત્યાં સુધી. ખાંધું એટલે રસ તીભો ને તીભો ભાગ્યો ! જજમાન મહેમાનને પછી ઘણો આગ્રહ કરે તો કહે : ‘હવે તો તુલટી થશે. ભાઈ સાહેબ, આંધું લઈ જાઓ !’

આ પરિસ્થિતિ જોતાં જીવનમાં રસની અતૂટ ધારા ન વિષયો પર, ન લક્ષ્મી પર, કે ન ખાનપાન પર !

તો રસની અતૂટ ધારા ક્યાં વહે છે, એ પ્રશ્ન છે.

**‘અધ્યાત્મ શાસ્ત્રની ઉપાસનામાં અખૂટ રસ છે :- મહર્ષિ કહે છે અધ્યાત્મ**

શાસ્ત્રની સેવા કરો પછી તમારો રસ ખૂટવાની વાત ન પૂછો. એ તો વધતો જ જશે. આ પવિત્ર ભૂમિ પર જ્યાં સુધી એ રસ પ્રત્યે આર્ય પ્રજાને માન-રુચિ હતી, ને તેથી જ અધ્યાત્મ શાસ્ત્રની વાતોના રટણ-મંથન ચાલતા, ત્યાં સુધી એ અતૂટ રસના અનુભવો ચાલુ હતા. આજે અધ્યાત્મ શાસ્ત્રની અભાવદશા છે પછી એનો કેવો રસ છે, તેની ખબર ક્યાંથી પડે ? શું કારણ બન્યું કે એ અધ્યાત્મ શાસ્ત્રની ઉપાસના લુપ્ત પ્રાય થઈ ગઈ ?

### સંસ્કૃતિના નાથથી અધ્યાત્મ શાસ્ત્રનો રસ ગયો ! :-

સંસ્કૃતિના નાથે અધ્યાત્મ શાસ્ત્ર સેવાના હાસ સજ્યા ! જ્યાં સુધી સંસ્કૃતિ જીવત હતી ત્યાં સુધી અધ્યાત્મ શાસ્ત્રના ગુંજન ઝગમગતા હતા. સંસ્કૃતિના પાયા હયમચી ઉઠયા કે જડવાદી શાસ્ત્રોની સેવા મહેકી ઊઠી ! પૂર્વ રાજસભાઓમાં પણ અધ્યાત્મ શાસ્ત્રના રસની છોળો ઉછળતી. વિકમાદિત્ય, ભોજ, વગેરેના દષાન્ત પ્રસિદ્ધ છે. આજે રાજસભાઓમાં કાયદા ને બજેટ ! સંસ્કૃતિ એટલે શું ? સંસ્કૃતિ શબ્દનો આજે છૂટથી ઉપયોગ થાય છે ! કલચર એન્ડ સીવીલીજેશન જ્યાં ને ત્યાં સંભળાય છે ! ને આપણે સંસ્કૃતિના સંરક્ષણ પર વિચારવાનું રાખ્યું છે. ત્યારે પ્રશ્ન થાય છે કે શું સંસ્કૃતિ આજે સંરક્ષિત નથી ? આજે તો કહે છે કે સંસ્કૃતિ વિકસિત બની છે. એના તીર્ણિમ પીટાય છે. ને તમે આજે ભાપણ કરવા તૈયાર થઈ ગયા છો કે સંસ્કૃતિના સંરક્ષણ કરજો; પણ સમજો કે સંસ્કૃતિ એટલે શું ચીજ છે ?

**સંસ્કૃતિ-વિકૃતિના અંતર ! :-** સંસ્કૃતિ એટલે માત્ર પુનરરૂપના કે ફેરફારી માત્ર નહિ ! ફેરફારી તો વિકૃતિના ઘરની પણ હોય. પુર્નરચના તો વિકૃતિના રૂપમાં ય હોય ! દૂધ જાંદું થયું, બાસુંદીનું રૂપક પકડ્યું, તો તો એ એનું સંસ્કરણ થયું; પણ ફોંદા દેખાયા તો ! એ ય ફેરફારી ખરી કે નહિ ? એને શું કહેશો ? સંસ્કૃતિ કે વિકૃતિ ? એ જુઓ કે વસુમાં સંસ્કાર થયો કે વિકાર ? ત્યાં તો કહેશો કે કોઈ ફોંદાને સંસ્કાર કહે નહિ, ફાટેલા દૂધને તો વિકાર કહે, બગાડો કહે. બસ એવું જ જીવનની સંસ્કૃતિ અંગે વિચારવાનું છે. આપણે સંસ્કૃતિના નામ નીચે વિકૃતિના ભોગ તો નથી બનતા ? સિંહને બદલે સિંહના ચામડામાં છૂપાયેલા શિયાળને તો નથી ભજી રહ્યા ?

સંસ્કૃતિ શાને કહેવાય ? એને કે જેમાં જીવન ઉન્નતિમય બને; જેમાં જીવન ગુણોથી મધ્યમધ બને; જેમાં જીવન અનેકને આત્માના ઉધીકરણમાં આધારભૂત બને. આને બદલે જો દોષો, કુટેઓ, અમાનુષીપણું, પરલોકચિત્તાનો સરાસર અભાવ વગેરે વાપી જાય અને કહે કે મેં જીવન સંસ્કારી બનાયું, સંસ્કૃતિવાળું બનાયું, તો તો રાક્ષસો ભલા નહિ ? માણસનો નાશ કરી પુષ્ટ થનારા વાધ-વરૂ ભલા

નહિ ? આ કોઈ જમાનો છે ? જંગલી પશુ કે રાક્ષસ માટે જે સંસ્કૃતિ શર્ષ નહિ, તે મનુષ્ય માટે ખરો ! માણસ પેટબરો બને, માત્ર પેટને સંભાષ્યા કરે, કીડી-મંકોડા કે પશુ-પંખીની જેમ ઈન્દ્રિયોની ગુલામીમાં વિષયોનો ભૂખ્યો બને, ત્યાં પશુ-પંખીનું જીવન સંસ્કારી નહિ અને માણસનું જીવન સંસ્કારી ! - એમ શી રીતે કહેવાય ?

### આ ભારત ભૂમિ પર આદિવે સંસ્કૃતિ સ્થાપી :-

સંસ્કૃતિના મંડાણ પ્રભુ શ્રી ઋષભદેવે આ ભારત ભૂમિ પર કર્યા. પહેલાં માણસો હતા, પણ કલ્પવૃક્ષના આધારે જીવતા. ખેતી, વેપાર, રોજગાર, કંઈ નહિ ! દેવતાઈ કલ્પવૃક્ષ ! માગો તે આપી દે ! કંઈ મહેનત નહિ, ને માયું મળે તો મજૂરી કોણ કરે ? ગોદરેજ તિજેરી પર તાળા કોણ લગાવે ? એવી સ્થિતિમાં એમની પાસે દાન-શીલ-ત્યાગ-તપની સંસ્કૃતિ, કે કોઈ ઉચ્ચ ભાવનાઓની સંસ્કૃતિ નહોતી. પ્રભુ શ્રી ઋષભદેવે જોયું કે હવે કલ્પવૃક્ષનો યુગ આથમી ગયો છે. હવે માણસ ખેતીવાડી વગરેમાં પડશે ને જીવન સંસ્કૃતિ વિહોણું હશે, તો પશુ ને માનવનો ફેર નહિ રહે. એટલે દયાળું પ્રભુએ સંસ્કૃતિ શિખવી.

હવે સંસ્કૃતિ જેની પર અસર કરે છે, તે ‘આત્મા’ને જ માણસો જો ન સમજે, તો એને શા માટે જીવનમાં સંસ્કૃતિની તમના જાગે ?

### આત્મા પર વિકૃતિની કારણી અસર :-

મારીના ખોળીયામાં કેદ પકડાયેલા નિજના આત્માના દર્શન કર્યા હોય તેને થાય કે મારો આત્મા ‘અનંતકાળથી અનેક પ્રકારની પુદ્ધગલની બેડીઓમાં જકડાઈ રહ્યો છે. એનું કારણ છે મિથ્યાવાસના. આહારાદિ સંજ્ઞાઓ, કોધ-લોભ-મદ-માયાના આવેશો અને હિંસાદિ અનેક પાપોની દોડધામ, - આ આત્માની વિકૃતિ છે. આત્મા વિકૃતિને વશ થઈ ગયો માટે અનંત અનંત કાળથી એ પરાધીન, દુષ્યિયો અને હડધૂત બની ગયો ! આત્માનું અસલી સ્વરૂપ તો અનંત જ્ઞાનમય, અનંત દર્શનમય, અનંત સુખ અને અનંત વીર્યમય છે; પણ આજે એની દશા કઈ છે ! અનંતું જ્ઞાન ક્યાં છે ? પોતાના માથા પાછળ શું છે, તે ય દેખાતું નથી ! માથાનો પાછલો ભાગ જોવા હેરકટીંગ સહુનમાં હજામ બે આરિસા ધરે છે, ત્યારે એનું પ્રતીબિંબ માત્ર જોઈ શકે છે. પોતાના શરીરનું પણ આટલું અજ્ઞાન ! ને કંઈ અલ્ય તૂટ્યું-ઝૂટ્યું જ્ઞાન થાય છે તે ય પણ કેટલી પરાધીનતા પછી ? ચક્ષુ બરાબર હોય, પ્રકાશ હાજર હોય, વચ્ચે કંઈ નડતું ન હોય, વસ્તુ નાની ન હોય, વસ્તુ સમાન વચ્ચે ભળી ગાએલી ન હોય, વસ્તુને ઓળખવાની શક્તિ હોય, ત્યારે વસ્તુનું જ્ઞાન થાય. વસ્તુ સમાનમાં ભળેલી ન હોય એટલે દા.ત. ઘઉંનો દાખણો હાથમાં આપે કહે બરોબર જોઈ લેજો. ને પછી તમારી સામે દાખણો ઘઉંના ઢગલામાં નાખે; ને પછી કહે શોધી લાવો એને. તો મુશ્કેલ

ને ? વસ્તુ મોટી છે. પ્રકાશ છે. આંખ છે; છતાં સમજ પડતી નથી ! મૂળ સ્વરૂપે અનંતજ્ઞાનના ધરી આત્માની આ કેવી વિકૃતિ ?

### સુખ ક્યાં છે ? :-

એવી સ્થિતિ સુખની ! સુખ જોઈએ છે માણસને. શાનું ? કંઈક ને કંઈક સુખ ! જોવાનું, સાંભળવાનું, પણ એ મેળવવામાં ગુલામીનો પાર નહિ. ને સુખની ધરી પાણીના પરપોટાની જેમ ફૂટી જતાં વાર નહિ. એક ભજ્યાં બનાવતાં જ્ઞાન કલાકની મજૂરી ! ને ખાતાં સુખ કેટલી ધરી ? મોંમા નીરસ લોટ ન થાય ત્યાં સુધી. પછી એનું સુખ ખતમ ! આ બધી પોકળીયા પરિસ્થિતિમાં સુખ ક્યાં છે ? ગરીબ માને છે : “પૈસાવાળો સુખી.” પૈસાવાળો પોક મૂકે છે : “છોકરો નથી.” છોકરાવાળા કહે છે : “છોકરા અંગારા પાક્યા. શું સુખ ?” પણ પૈસા અને સારા છોકરા બન્ને હોય તેને પણ પોક કે લ્યો હવે આવકવેરો ભરો, સંપત્તિવેરો ભરો, ને ખર્ચવેરો ભરો ! સુખ ક્યાં છે ?

વિકૃતિ જીવને કર્મ અને કાયામાં જકડે છે તેને પરવશ બનેલા આત્માઓ કર્મની બેડીઓથી. જકડાય છે કે જે કર્મની શૂંખલાઓ એના અનંત જ્ઞાન ને અનંત સુખાદિ પર તાળા મારી દે છે. જાણો કર્મ જીવને કહે છે, ‘સબ કુછ તુમારા મગર હુકમ હમારા !’ બધું જ છે અંદરમાં, ખોવાઈ નથી ગયું. માત્ર સીલ લાગી ગયા છે. કર્મ સરકારની ચિંઠી ફાટે તેટલું રેશન મળે ! કારણ જીવ સંસ્કૃતિ ભૂલ્યો ને વિકૃતિના પનારે પડી ગયો. આહારાદિ સંજ્ઞાઓ એ વિકૃતિ છે ‘હું ખાઈ લઉં-બેગું કરી લઉં-હું ભોગવી લઉં-હું એશારામી કરું,’ આ બધી વિકૃતિ રાજ્યસ તામસ ભાવના નાટક છે ! જીવને એ વારંવાર કાયાની કેદમાં પૂરૈ છે ! ગીતામાં કહ્યું છે,

**સત્ત્વ રજઃ તમ ઇતિ ગુણાઃ પ્રકૃતિસંભવાઃ ।**

**નિબધનિતિ મહાબાહો દેહે દેહિનમવ્યાયમ् ॥**

આત્મા તો અબ્યય અવિનાશી છે. નિરંજન નિરાકાર છે - છતાં જડ પ્રકૃતિ કર્મ એટલે આત્માને સત્ત્વ રજ ને તમોગુણની વિકૃતિમાં ફસાવી દે. દેહની કોટીમાં પૂરી દે છે. કહે છે, “આ તારો મહેલવાસ ! હજુ દુનિયાની જેલમાં રહેલો કેદી, એને દિનરાત જેલનાં રંગરોગાન કરવાનું મન ન થાય. પણ તને એવી જેલ એમાં જન્મે તે મરે ત્યાં સુધી હોંશપૂર્વક આ દેહ જેલની સેવા સરભરામાંથી ઉંચો ન આવે !” કહો તો ખરા કે !

**કંઈ ત્રિપુટીની સેવા ચાલી રહી છે ? :-**

કાયા રૂપી જેલની સેવા કેટલી ? ને અનંતગુણ સંપન્ન અનંત ઉપકારકારી પરમાત્માની સેવા કેટલી ?

સગાં સ્નેહીઓની સેવા કેટલી ને જીવનમાં દિવ્ય પ્રકાશ આપનાર ગુરુની સેવા કેટલી ?

પૈસા-ટકા, વેપાર-ધંધાની સેવા કેટલી ? ને તરણ તારણ એવા ધર્મની સેવા કેટલી ?

બે જાતની ત્રિપુટીમાં કયા હૈયાના આદર-બહુમાન ઉભરાય ? ક્યાં ચોવીસે કલાક સજાગ રહીએ ? ખરી રીતે આપડી કાયા કરતાં પરમાત્મા પર ઓવારી જઈએ; કામની ને કુટુંબ કરતાં ગુરુ પર આંદીન બની જઈએ, ધન કરતાં ધર્મને કમાવવાની ધગશ હોય; આ જોઈએ. આ બધું કોણે ભૂલાવ્યું ? સંસ્કૃતિને બદલે રાજસ-તામસ ભાવના તોફાનોએ ! આ વિકૃતિ !

સંસ્કૃતિ એટલે તામસભાવનો નાશ કરવો ને રાજસભાવને શાંત કરવો, ને શુદ્ધ સાત્ત્વિક ભાવને વિકસ્વર કરવો. એટલે પરિણામે કર્મ-પ્રકૃતિના બંધનમાંથી આત્મા છૂટે, ને સચ્ચિદાનંદ ધન બની જાય ! મિથ્યાવાસનાની વિકૃતિ જેના પર સદ્ગર બને છે એવી આદાર-વિષય-પરિશ્રહનિદાની વિકૃતિ સામે સમ્યગ્રદિષ્ટિની અને તપ-શીલ-દાન-ભાવની સંસ્કૃતિ છે. તો મનને પૂછો કે આદારની વિકૃતિ મૂકીને તપની સંસ્કૃતિ ગમે ? વિષયની વિકૃતિ મૂકી શીલની સંસ્કૃતિ ગમે ? પરિશ્રહની વિકૃતિ મૂકી દાનની સંસ્કૃતિ ગમે ? ઢોરને ગમે એવી અશાશ્વારામીની વિકૃતિમાંથી છૂટી ઉચ્ચ ભાવનાઓ અને તત્ત્વચિંતનની સંસ્કૃતિ જાગે ?

સંસ્કૃતિનાં સંરક્ષણ એટલે શું કરવાનું ?

ચાર સંજ્ઞામાં જડ જેવો જે બની ગયો છે ચેતન, એને હચમચાવી મૂકવાનો છે. એની આદારાદિ લતની ધૂળ ખંખેરી નાખી જીવનો ભૌતિકતાનો પ્રેમ મિટાવી દઈ એને આધ્યાત્મિકતાનો રસિઓ કરવાનો છે. સાચા જૈન ક્યારે બનાય ? એને માટે કહ્યું છે કે,

‘દેહે દ્રવ્યે કુટુંબે ચ સર્વસંસારિણાં મતિઃ ।

જિને જિનમતે સંઘે પુનર્મોક્ષાભિલાષિણામ् ।’

મોક્ષ રસિયો તે કહેવાય કે જેણે એક ત્રિપુટી પરથી દિલ્લિ ઉઠાડી બીજી ત્રિપુટી પર દિલ્લિ સ્થાપિત કરી દીધી હોય. પહેલી ત્રિપુટી-દેહ-દ્રવ્ય-કુટુંબ. એના પર મીઠી દિલ્લિ છે ત્યાં સુધી જીવ સંસાર-રસિક છે. દેહ-દ્રવ્ય-કુટુંબ, ઈન, મીન ને તીન કોણ આમાં ફસાયું નથી ? કીડી પણ કણનો સંગ્રહ કરે છે. દુકાળમાં જડુર પડ્યે શોધતાં એના દરમાંથી પાંચશેર દાણો નીકળે. દેહ પાછળ કોણ પાગલ નથી ? વિજાનો કીડો પણ દેહને ખૂબ સંભાળે છે. એને બચાવવા દોડાદોડ કરે છે. માણસ એટલે જ અટકે તો કંઈ વિશેષ નથી. એમાં તો એને કોઈ સંસ્કૃતિ ઉગી ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ” (ભાગ-૧૮)

૨૩૫

નથી. જ્ઞાની કહે છે હવે જો આત્માનું ભાન થતું હોય તો દિલ્લિ દેહ પરથી ઉઠાડી પરમાત્મા પર સ્થાપિત કર. એમ સમજ કે કાયાની સેવાની કોઈ કિંમત નથી જે કિંમત પરમાત્માની સેવાની છે. કાયા તો પાપની પ્રેરણાઓ કરે છે. નિત્ય નવી પ્રભાતે એની નવી ને નવી માગણીઓ ઊભી છે. કાલ સાંજ સુધી બરાબર આચ્યું હોય - આઈ આનાના રોટલી દાળ-ભાત ને બદલે મેવા પદ્ધવાન્નાની પતરાળી રૂપિયા આઠની આપી દીધી. કેટલા ગુણી થઈ ? ૧૬ ગુણી. હવે ૧૬ દિવસ સુધી કાયા કઈ ન માગે ને ? ના, સવાર પડે એટલી વાર ! કહેશે લાવો સ્ટોંગ ટી, કડક ચા લાવો. કેમ ? કાલે ભારે ભોજન કર્યું છે. માટે ! ખાતર પર દિવેલ ! પછી ૧૧ વાગ્યે રીતસર ભોજન જોઈએ; પણ પૂછો તો ખરા કે આજ સુધી કેટલું દીધું છે ? કાયા કહેશે, ‘ના ! માનું પેટ તો સાવ ખાલી છે.’ દીધેલું એ કશું જમે ન બતાવે તે શાહુકાર કે દેવાળીયણ ? ગઈ કાલે દસ રૂપિયાની કણા બજારની ટીકીટ ખર્ચને સિનેમા બતાવી. પછી ? બીજે દિવસે છાપામાં નવી ફિલ્મની જાહેરાત વાંચી કે કાયા કહે છે કે આ જોવી જોઈએ; પણ ગઈ કાલે જ બતાવી છે ને ? ના, ‘ખા ગયા સો ખો ગયા !’ એ તો સારું છે કે પૂર્વજીએ સદાચારનાં બંધનો ઊભા કર્યા છે. બાકી તપાસો, જીવની અંદરની વૃત્તિ કઈ છે ? આપમેળે સખણો બેસી ન રહે. ભોગની ખૂબ એમ કદી શમે એમ નથી. જીવને થવું જોઈએ કે ‘એવી ગલીય કાયા સામે મને પરમાત્મા મળ્યા ! હું તો ન્યાલ થઈ ગયો ! કાયા પર મને ભારે નફરત છૂટે છે. મને પાપમાં ફસાવી નાખ્યો !’ આ દિલ્લિ ફરી, એમ દિલ્લિ ધનમાલ પરથી ઉઠી પરમાત્માના માર્ગ પર, જિનની આજ્ઞા પર દિલ્લિ સ્થાપિત થાય. આજ સુધી ધોળા પીળા ચકમકતા પર ધનબુદ્ધિ થતી હતી, હવે દાન-શીલ-તપ-ભાવાદિ ધર્મમાં ધનબુદ્ધિ ! એ કમાઉ એમ થયા કરે. શા માટે એમ ? કહો, ધર્મ ભવિષ્યમાં જે જીવાબ આપનાર છે, એ જીવાબ આપનાર ધન નથી.

નાગદત્તનો બાપ :- ધન ઊભું રહ્યું અને નાગદત શેઠનો બાપ મરીને બોકડો થયો. કસાઈ ખરીદીને લઈ જાય છે. કહો ! પૈસાએ જીવાબ આચ્યો ? હજ આગળ જુઓ. રસે જતાં પોતાની દુકાન આવી. બોકડાને જોઈ પૂર્વ જન્મનું સમરણ થયું ! ‘ઓહો ! આ મારી દુકાન; ને મેં લાખો રૂપિયા મૂક્યા છે. આ દિકરો પણ મારો છે. લાવ અંદર જાઉં. બચાવી લેશો.’ એમ કરી બોકડો લાગ શોધી દુકાન પર ચઢી ગયો.

કસાઈ કહે છે : ‘શેઠ બોકડો નીચે ઉતારો !’

બોકડો નિશ્ચિત છે કે મને મારો દિકરો નહિ ઉતારે, પણ દિકરો તો ઉચ્ચ ઉચ્ચ કરે છે; હટહટ કરે છે ! બોકડો પોતાની કથની કહેવા ભરાડે છે. પણ એની ભાષા

૨૩૬

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-સંસ્કૃતિના સંરક્ષણ (ભાગ-૧૮)

કોણ સમજે ? સંસ્કૃતિ ભૂલીને વિકૃતિને પરવશ થયેલો, પરિણામ શું પામ્યો ? લાખો રૂપિયામાંથી દાન ન સૂઝ્યું ! રંગરાગ અને સંગ્રહ સૂઝ્યો ! એના પરિણામે એક બાજુ સમજીવવાની ઈચ્છા, બુદ્ધિ, ને પ્રયત્ન છતાં સમજીવી શકતો નથી કે હું તારો બાપ છું. બચાવી લે.

કસાઈ કહે છે, ‘શેઠ ઉતારો જલદી, નહિતર બે રૂપિયા ફેંકી દો ! બીજો બોકડો લઈ લઈશ.’

બોકડો વિચારે છે, ‘હાશ, હવે તો લાખમાંથી બે રૂપિયા ફેંકી દેશે તો કંઈ એને ખોટ નથી, ને હું બચી જઈશ.’

પણ અહીં તો છોકરો કહે છે : ‘રૂપિયા કંઈ જાડ પરથી પડે છે ?’ એણે તો ડંગોરો લઈને બોકડાની પીઠ પર ઠોક્ક્યો. બોકડો નિરાશ થઈ આંખમાંથી આંસુ સારતો નીચે ઉતર્યો.

દ્રવ્ય શું આપ્યું ? જીવને પરભવમાં આજ આપે ને ? જાણો છો છતાં રાત ને દિ શાની પાછળ મંડ્યા છો ? બસ એક જ ધૂન, ‘પૈસા ભેગા કરો ! વખત બારીક છે. મોંઘવારી બહુ છે, રૂપિયા ધર ભેગા કરો.’ આશ્ર્ય છે કે મોંઘવારી પૈસાની દેખાય છે. ધર્મની મોંઘવારી નથી દેખાતી. વખતની બારીકાઈ દેખાય છે. આણભોલા માનવબની તકની બારીકાઈ દેખાતી નથી ‘હાય ! ચીજ ભાવ મોંઘા થઈ ગયા ! હી દૂધ મોંઘા થઈ ગયા !’ એમ થાય છે. પણ એમ નથી થતું કે હાય ! નિષ્યાપ અને ધર્મભ્ય જીવન કેટલું મોંઘું થઈ ગયું ? સત્ય ને નીતિ કેવા મોંઘા થઈ ગયા ! પછી વગર વાઉચરવાળાના વેપારની અનુમોદના કરે છે, ‘માણા ડોક્ટર ઘણી વીજીટો કરે. પૈસા લીધા, નાચ્યા ખીસામાં, ન રસીદ ન વાઉચર ! ડોક્ટર થવું સારું,’ વિચાર છે કંઈ એમાં કે કેવા પાપ છે ? એમાં આજે ડોક્ટરી વિદ્યામાં તો ભણવાની શરૂઆતથી જ કેવાં પાપ ! જીવતા પંચેન્દ્રિય જીવને સોયાથી કોચવાના. પછી આગળ લોભ કેવો ? કેટલું પડાવવાનું ? ઈજેક્શનો કેવા ? દરદીને ભલામણ કેવી પેટંટ દવાઓની કરવાની ? આ બધાના ઓરતા કરવા છે ?

જીવાનંદ વૈદ્ય રૂપભદેવ ભગવાનનો જીવ ! એ અને મિત્રો ઊભા છે. મુનિ આવ્યા.

મિત્રો કહે છે : ‘તમે વૈદ્ય ને વેશ્યા સરખા. પૈસાના જ સગા ! આ મુનિ પીડાઈ રહ્યા છે ને તમને કંઈ લાગે છે ? કેમકે એ પૈસા ન આપે ને ?’

જીવાનંદ વૈદ્ય શરમાઈ ગયો. લાખ રૂપિયાનું લક્ષપાક તેલ લઈને તૈયાર થઈ ગયો ! મિત્રોને કહે છે : “હવે, ગોશીર્ષ ચંદન અને રત્નંબલ જોઈએ, પણ લાખ ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-‘પ્રવચન મહોદધિ’ (ભાગ-૧૮)

લાખની કિંમતે મળે.” મિત્રો બીજા કોઈ ન હતા. ભરત ને બાહુબલ, બ્રાહ્મી ને સુંદરી, ને શ્રેયાંસ,-પાંચેય મિત્રો હતા. પોતાના પૈસા ભેગા કરી દીધા. કોને માટે ? એક મહામુનિને પાહું મટાડવા માટે, એમને એમ ન થયું કે અરે પણ મહારાજ અમારા એકલાના છે કે સંઘના ? તે આટલો ખર્ચ અમે એકલા કરીએ ?

વિકૃતિના જમાનાનું આ તોફાન છે. એમાં સંસ્કૃતિ જીવંત રાખનાર શોધવા પડે ! કેટલા મળે ? કેવા વીણાય ? ઘઉમાં કાંકરા ? કે કાંકરામાં ઘઉં ?

પાંચે જણા વાણીયાની દુકાને ગયા. વેપારીને કહે છે : ‘લાવો રત્નંબલ અને ગોશીર્ષચંદન આપો.’

‘અરે પણ એની કિંમત જાણો છો ?’

‘હં, ખબર છે. લ્યો પહેલા રૂપિયા લ્યો, પછી માલ આપો.’

વાણીયો ચોંક્યો. નરમ પડ્યો, ‘કેમ ? આટલી કિંમતી ચીજની શી જરૂર પડી ?’

‘મહાત્માનું પાહું મટાડવાનું છે.’ વેપારી સ્તબ્ધ થઈ જાય છે ! મનને થાય છે, “અહો ! આ નાની ઉંમરમાં આમને બે લાખનું નાણણું ગાઠનું ખર્ચાને મહાત્માની સેવા કરવાનું સૂજે છે. ને હું અક્કમી આવા ઘોળા આવી ગયા છતાં બધું ધર ભેગું કરવાનું અને પાપી પેટ ભરવાનું જ સમજ્યો છું ! ધન્ય છે એમને ને વિક્કાર છે મને ! આ સોનેરી માનવબની આ વિટંબણા !” એનું હદ્ય ભરાઈ આવે છે ! આંખમાંથી આંસુ ટપકી પડે છે; કહે છે,

‘મારા લાલ ! લઈ જાઓ બધું વગર પૈસે-જાઓ મફત લઈ જઈ મહાત્માઓની ભક્તિ કરો ! ધન્ય છે તમારી જીવાનીને, તમારા વિવેકને કે તમને આ સૂજે છે ! તમે તો મને જગ્યત કરી દીધો.’

વણિકે રૂપિયા લીધા નહિ, ને માલ આપ્યો. ત્યારે પેલાઓએ પણ રૂપિયા ધરમાં રાખ્યા નહિ, એનું ભવ્ય જિનમંદિર બનાવી દીધું ! વણિક વેપારીએ તો આગળ વધી પોતાને હજુ સુધી લોભ અને મમતામાં ફસાવી રાખનારા સંસાર આખાને ઠગારો દેખ્યો, ત્યજ્યો અને પછી તરત જ દીક્ષા લઈ લીધી. આ હતી સંસ્કૃતિની જાહોજલાલી કે પેલા યુવાનો અને આ વૃદ્ધે સુકૃત સાચ્યા !

ક્યાં સંસ્કૃતિ ? ક્યાં વિકૃતિ ? :-

આપણી વાત હતી પાપધ્યાની અનુમોદનાની. આજે તો ડોક્ટર કેમ બનાય છે ? બન્યા પછી મનમાં શું ભાવનાઓ રહે છે ? માણસ ઉચ્કા ખાતો હોય, ને ડોક્ટર આવે ને જોઈ કહે : ‘આશા લાગતી નથી. હવે જે કંઈ કરવું હોય તે કરો.’ પણ મોટરમાં બેસી રાહ જોતો રહે, વિજિટના રોકડ રૂપિયાની ! ત્યાં કુંઠંભીઓ કાળો કકળાટ કરે છે. ત્યારે આ ડોક્ટર કાળજું કેટલું કઠીન કરી, ૧૦-

૨૩૮ ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-સંસ્કૃતિના સંરક્ષણ (ભાગ-૧૮)

૨૦-૩૦ ઝા. વિજિટ ફીના લેવા થોએ ! પણ મુંઝશો નહિ. આજેય સંસ્કૃતિને જીવનારા એવા વૈધો છે કે કોઈ માણસ એની વિજિટ અને દવા મહિના સુધી ઉધારે ખાધી પછી કદાચ મરી ગયો. વૈધને ખબર પડે પછી પેલાના કુટુમ્બી દવાનું બીલ આપવા આવે, પણ આ અડે ય નહિ. ‘તમે આખો માણસ ગુમાવ્યો તો મારે પૈસા શું કરવા છે ? મરદાના પૈસા અમે લઈએ નહિ.’

પણ સંસ્કૃતિની વિટંબણા આજે કેટલી હુદ સુધી થઈ રહી છે કે આજે દયા, સત્ય, ને નીતિની, સંતોષ અને સહદ્યતાની મોંઘવારી એટલે સુધી પહોંચી ગઈ છે કે હૃદયને ભારે કઠોર બનાવનાર અને આર્થ સંસ્કૃતિને ભૂલાવનાર પાપધંધા સારા લાગે છે !

એવા દેહ, દ્રવ્ય ને કુટુમ્બ પરથી દાખિ ઉઠાવીને પરમાત્મા, એમનો માર્ગ ને ગુરુ વગેરે સંધ પર દાખિ કેન્દ્રિત કરી દે, એ મોક્ષાભિલાષી. જીવ સંસ્કૃતિ ગુમાવી વિકૃતિની કેવી રામાયણ સર્જ કેવો ભવમાં ભટકતો બની ગયો છે ! એ સમજ આહારાદિ સંજ્ઞાની વાતો ઓછી કરી, દાનશીલાદિ રૂપ સંસ્કૃતિની વાતો હૃદયમાં ઝગમગાવો ! કામ, કોષ, લોભ ને અહંકારાદિના આવેશ મૂકી, બ્રહ્મયર્થ, સદાચાર, ક્ષમા-નિસ્પૃહતા-વૈરાગ્ય-નભ્રતા-લઘુતા વગેરેની સંસ્કૃતિ વિકસાવો.

#### હવે સંરક્ષણનો વિચાર :-

સંસ્કૃતિનો વિચાર કર્યો, હવે સંરક્ષણનો વિચાર કરવાનો છે - સંસ્કૃતિના લોપ થતા ચાલ્યા છે, માટે એના સંરક્ષણ જોઈએ ! આ ભારત ભૂમિ પર સંસ્કૃતિ સુરક્ષિત હતી. તે ક્યારથી એને ધોકો પહોંચ્યો, ક્યારથી સંસ્કૃતિ ડામાડોળ થવા લાગી, એ વિચારવાનું છે.

#### આત્માના ષટ્ટસ્થાન પર સંસ્કૃતિ :-

આમાં પહેલું એ ધ્યાન રાખો કે ‘સંસ્કૃતિ’ અને ‘વિકૃતિ’ શબ્દ આત્માને લાગુ પડે છે. પ્રાચીન ભારતની સંસ્કૃતિ આત્માના ષટ્ટસ્થાન પર સર્જયિલી હતી. જે સંસ્કૃતિ આદિદેવે સ્થાપી તે છ સ્થાન પર ઊભી હતી.

૧. આત્મા છે !                    ૨. આત્મા નિય છે.

૩. આત્મા કર્મનો કર્તા છે.            ૪. આત્મા કર્મના ફલનો ભોક્તા છે.

૫. આત્માનો મોક્ષ છે.                    ૬. મોક્ષના ઉપાયો છે.

#### ષટ્ટસ્થાનની માન્યતાનો જીવન પર પ્રભાવ :-

સમાજના સામાજિક રીતરિવાજો પણ આ માન્યતા ઉપર આવેખવામાં આવ્યા હતા. એટલે પ્રજામાં ન્યાય, નીતિ, પ્રામાણિકતા, એકવચનિતા, અતિથિસત્કાર, પરોપકાર વગેરે ગુણો સારી રીતે વિકસેલા હતા. ઈન્દ્રિય-સંયમ, ઉપશમભાવ,

અહિંસા, અપારિગ્રહ, બ્રહ્મયર્થ વગેરેની સાધનાઓ ચોમેર પ્રસરેલી હતી. સમાજમાં સમવેદિતા, સહકાર, સંપ, પરમાર્થ, તત્ત્વચિંતન, વગેરે જીવંત હતા. ભારતની આ સંસ્કૃતિના વિદેશમાં અનુકરણ થતા.

આજે તો આ મુશ્કેલી છે કે શરીરથી આત્મા જુદો છે એ વસ્તુ જ મગજમાં નથી બેસતી. વિદેશી વિકૃતિએ સંસ્કૃતિના નામ હેઠળ, આજના સમાજના માનસને એટલું બધું પ્રભાવિત કરી દીધું છે કે કુલ દાખિ શરીર પર જ સ્થાપિત થઈ ગઈ છે ! ત્યાં આપણે સંસ્કૃતિના સંરક્ષણ કરવાના છે.

#### આત્મા છે એની સાબિતિ :-

આત્મા શરીરથી જુદો છે. તે ય શરીર સાથે જન્મે છે, ને શરીર સાથે મરે છે એમ પણ નથી. આત્મા સનાતન છે, માત્ર નવાં નવાં ખોળિયામાં જકડાય છે અને એમાંથી તીસમીસ થાય છે, હાંકી કઢાય છે. આનું જ નામ જન્મ અને મરણ. પૂર્વ પૂર્વ જન્મોના કુસંસ્કારો, અભ્યાસો અને કર્મના વારસા લઈને નવા નવા દેહમાં જોડાય છે. એથી અહીં જન્મથી જ શું, પણ ગર્ભમાં હોય ત્યારથી કેટલી ખાસિયતો, સમજો પ્રગટ થઈ જાય છે. એક ગર્ભિણી બાઈને રસ્તામાં તોકાને ચઢેલા જનાવરે પેટમાં શિંગાં માર્યું. અહીં પેટમાં એવી પેટી કે એથી પેટમાં પહુંચ કાણું. એમાંથી ગર્ભના બચ્યાની આંગળી બહાર નીકળી આવી. હવે એ આંગળી પાઈ અંદર દાખલ કરી દેવા વૈદ ડોક્ટરના ઉપચાર લેવામાં આવ્યા પણ કાંઈ વળ્યું નહિ. પરંતુ એક અનુભવી માણસે સણગતી દિવાસળીની જ્યોત જરાક આંગળીની નજીક ધરી કે આંગળી અંદર બેંચાઈ ગઈ; ને પેટ પર તરત ટેભા ભરી લેવામાં આવ્યા. આ શું સૂચવે છે ? શરીરમાં આત્મા પૂર્વ જન્મોનો અભ્યાસી છે, તે વગર શિખવ્યે, સુખના સ્થાનની નજીક દોડે છે અને દુઃખના કારણોથી દૂર ભાગે છે. આ જીવનમાં યશ-અપયશ, સૌભાગ્ય-દૌભાગ્ય, માન-અપમાન, અકલ-મૂર્ખતા વગેરે અણધાર્યુ મળે છે એજ આત્માની સાબિતિ છે. આજે પૂર્વ જન્મના સ્મરણવાળા મળે છે એ શરીરથી જુદા આત્માને સાબિત કરે છે.

#### તત્ત્વજ્ઞાની કુબડો અને ચમાર પંડિતો :-

#### આયર્દેશમાં આત્માની મુખ્ય ચિંતા થતી.

એક રાજાની સભામાં એક કુબડો પહોંચી ગયો. સભામાં મોટ મોટા પંડિતો બેઠેલા, શાસ્ત્રચર્ચા કરતા હતા. એમણે પેલાને જોયો. જોતાં જ હસી પડ્યા ! ‘આ શું ? શરીર ઠીંગાણું ! માથું ત્રિકોણ ! પેટ ગાગર જેવું ને છાતી સાંકડી અંદર પેઠેલી ! હાથ-પગ ટૂંકા ! વાળ પીળા ! કાન સુપડા જેવા મોટા ! ને નાક બુચું !’ પંડિતો ચકિત થઈ ખડુંડ હસી પડ્યા. આ ઊભો રખ્યો ! બધા હસી રહ્યા

પછી, પોતે મંજ્યો ખડકાટ હસવા !

રાજ પૂછે છે : ‘તું હસે છે કેમ ?’

એ કહે છે, ‘તમારી મૂર્ખાઈ પર મને હસવું આવે છે !’

‘મારી મૂર્ખાઈ !’

‘હા, મેં જાણ્યું હતું કે તમે તો જ્ઞાનના પૂજારી છો એટલે સભામાં મોટ મોટા પંડિતો ભેગા કરો. તેથી હું અહીં આવ્યો. પણ અહીં તો મેં જુદું જ જોયું !’  
‘શું જુદું ?’

‘એજ કે તમે તો ચમારો જ ભેગા કર્યા છે. ચમારની નજર ચામડા પર પડે. ઢોર માંદું પડે કે એના ચામડા તરફ નજર નાખે. ઢોરના આત્માને બિચારાને શું થતું હશે, અથવા કોઈનું કિમતી ઢોર મરશે, એ ન જુઓ. એમ આ તમારા ભેગા કરેલાઓએ મારા ચામડાને નિહાળ્યું, પણ અંદરમાં રહેલા અનંત શક્તિવાળા આત્મા તરફ ન જોયું !’

પંડિતો પણ જ્યાં વિકૃતિમાં ભૂલા પડી જાય ત્યાં અભિષાનું શું પૂછવું ? દેહમાં સોસરો આત્માને દેખી શકે તે સાચો તત્ત્વજ્ઞાની છે ! આત્માને દેખે, સાથે આત્માના બંધનો દેખે. આત્માની તેથી થયેલા ભયંકર દુર્દ્દાને દેખે;—‘ક્યાં એ સંચિદાનંદ આત્મા !’ ને ક્યાં આ જડવત્ત બનેલ શુલામ ! ભૂતકળની કરણીનું દુંબ છે આ,’ એમ એને થાય, એટલે ગરીબને જોઈને દ્યા આવે કે પરમાત્માને આણો ભજ્યા નથી માટે આ છે ! ને જીતને માટે સાવધાની આવી જાય છે, કે હું અહીં ધનમાલ એકલા ખાઈ રહ્યો છું તો મારા હાલ પણ આગામી ભવે આવા જ છે ! આનું નામ આત્માને જાણ્યો કહેવાય !

ઘટસ્થાનની ટૂકી સમજ :-

આત્મા છે અને તે પણ નિત્ય છે. શુભાશુભકર્મ અને વાસના લઈને ભટકે છે. એટલે કર્મ પોતે જ કરે છે. કોઈ કરાવતું નથી. બૂમરાણ ખોટી છે કે, ભગવાન જેવી મતિ આપે તેમ કરીએ. તો તો શું કસાઈને મતિ ભગવાન આપે છે ? બીજાને મારવાની બુદ્ધિ જો ભગવાન આપતો હોય તો એ ભગવાન કેવો ખુની ? કમને કરનારો આત્મા પોતે જ છે; જે ફળ પણ ભોગવનાર પોતે જ છે. કરેલાં કર્મ એને ભોગવાં જ પડે છે. સેંકડો વાર કરોડો વર્ષો વીતે, ઇતાં કર્મ ભોગવા વિના છૂટે નહિ.

‘નાભુકતં ક્ષીયતે કર્મ, કલ્પકોટિશતૈરપિ’

સંસ્કૃતિમાં પતન કેમ થતું આવ્યું ? :-

સનાતન આત્મા તથા વાસના અને કર્મના સિદ્ધાન્ત ઉપર પ્રથમ યુગાદ્ધિદેવે

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ” (ભાગ-૧૮)

૨૪૧

એ ઉપદેશ આખ્યો : ‘માનવ જીવન એક એવું અદ્ભુત જીવન છે કે જેમાં હોંશથી સેવેલા સુસંસ્કાર કે કુસંસ્કારના અધિકપણે પુનરાવર્તન પછીના ભવોમાં ચાલે છે ! માટે આ ઉત્તમ ભવમાંથી મિથ્યામતિ, આહારાદિ સંજ્ઞાઓ, કોધાદિ કખાયો, ને હિંસાદિ પાપોની વિકૃતિના છાસ કરી સમ્યગ્દર્શન દાનાદિ ગુણો, ક્ષમા સમતાદિ સ્વભાવ અને અહિંસાદિ ધર્માની ખૂબ ખૂબ ઉપાસના કર્માઈ કરો.’ પ્રભુના આ ઉપદેશનું અને આ ઉપાસનાને અનુકૂલ ભાતાવેલી ચર્ચાઓનું જનતા પાલન કરવા લાગી. એમાં પ્રથમ નંબરમાં સમ્યગ્દર્શન એટલે કે સર્વજ્ઞ વીતરાગ પ્રભુએ કહેલ સર્વ વચ્ચન ઉપર અથાગ શ્રદ્ધા, તત્ત્વ ઉપર હાઈંક રૂચિ અને એ પ્રભુને જ પરમાત્મા તરીકે માનવા, પણ નહિ કે સરાગ અસર્વજ્ઞ વિકિતને. એમ ગુરુ તરીકે પણ કંચન કામિનીના ત્યાગી પંચમહાત્મારી પંચાચાર-મધુકરીભિક્ષા-શાસ્ત્રાનુસારી ઉપદેશ - વગેરે ચર્ચાના પાલક એવા સાધુ ભગવંતોને જ માનવા. ધર્મ વીતરાગ સર્વજ્ઞના કહેલાને જ માનવો. આ સમ્યગ્દર્શનની સંસ્કૃતિને પ્રથમ ફટકો, એ શ્રી ઋષભદેવ પ્રભુના કાળમાં જ લાગ્યો. એમની સાથે સંન્યાસ લીધેલા ચાર હજાર રાખ્યું, પણ સાધુચર્ચા ન સ્વીકારી. તેમજ મહાવીર પ્રભુનો જીવ જે તે વખતે મરીયિ નામે હતો અને પ્રભુ પાસે ચારિત્ર લીધું હતું. પાછળથી એ મરીયિએ અષ્ટ થઈ શિથિલ પરિવ્રાજક ધર્મ ચલાવ્યો. આમ સંસ્કૃતિ પર ફટકા શરૂ થયા. તેમ તત્ત્વોમાં ઘાલમેલ થઈ. ઉન્માર્ગનું સમર્થન કરવા તેવા તેવા કલ્પિત તત્ત્વો ઊભા કરાતા ગયા.

એ પછી પણ પવિત્ર સાધુચર્ચાને જીવનારી સંસ્થા બરાબર ચાલતી હતી. તેના અનુસારે જનતામાં પણ પોતાનાથી શક્ય સમ્યગ્દર્શન, આહારાવિષયાદિ સંજ્ઞાઓના રોધક દાનાદિગુણો, ક્ષમાદિ સ્વભાવો તથા સ્થૂલ અહિંસાદિ ધર્માના પાલન બરાબર ચાલતા હતા. પરંતુ અસંખ્ય વર્ષોના વહાણાં વીતી ગયા પછી સાધુવર્ગ શિથિલ પડતો ગયો; યોગને બદલે ભોગનો બૂધ્યો થતો ગયો. એમ છતાંય પાછું લોકના માનસન્માન અને પૂજા તો લેવી જ હતી. તેથી દેશકળના બહાના હેઠળ શાસ્ત્રોમાં ઘાલમેલ કરી નવાં કુશાસ્ત્રો રચ્યાં. ધર્મના નામે હિંસા, આરંભસમાર્બદ, વિષય સેવન, પરિગ્રહ, કુ-દાન, કુ-તપ વગેરે પાપો ચલાવ્યાં. પછી તો એવી વસ્તુ જીવનમાં જીવનારને ઈશ્વર પરમાત્મા તરીકે કલ્પા. એવી એની અને પોતાની પૂજાઓ ચલાવી. આમ સંસ્કૃતિ ઉપર જબરદસ્ત ફટકા પડતા ગયા.

પડતા કાળના મનુષ્ય સ્વભાવમાં સહજ એવા અહંકાર, ઈર્ષા, સ્વાર્થપદૃતા, ભોગાસક્તિ વગેરે દુર્ગુણોએ પછી તો નવા નવા મિથ્યા કલ્પિત દેવ-દેવીઓને પરમાત્મા અગર ઉપાસ્ય તરીકે સર્જન કર્યા. એમનામાં જ એવા કામ, કોધ, લોભ,

૨૪૨ ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-સંસ્કૃતિના સંરક્ષણ (ભાગ-૧૮)

મદ વગેરે દોષોને ગુણો તરીકે બેસાડ્યા કે જેથી પછી એ કલ્પકોને પોતાને જીવનમાં કામકોઢાદિના ધંધા ધર્મ તરીકે, કે કર્તવ્ય તરીકે સુખેથી આચરી શકાય. જો કે વચ્ચમાં વચ્ચમાં વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા પ્રગટ થતા ગયા અને અધર્મ ટાળી ધર્મના ઉદ્ધાર કરતા ગયા, છતાં જે મિથ્યામાર્ગો શરૂ થઈ ગયા હતા, એના સંપૂર્ણ નાશ ન થયા. એ તો ચાલતા જ ગયા.

અનું તોફાન તો એવું વધ્યું કે આ પવિત્ર ભરતક્ષેત્રમાં જે સારા ઉત્તમ ચરિત્રવાળી વિભૂતિઓ થઈ એના પણ જીવનો પાછળથી વિકૃત ચિતર્યા. શા માટે? માત્ર પોતાના ઉન્માર્ગને પોપવા માટે! એ કલ્પિત ચરિત્રોમાં ગપગોળા અને બિભસ ચર્યાઓ એવી ઘાલી કે જે ઉલટી એ મહાપુરુષોની હાંસી કરાવનારી બને! પાછું એમાંથી સંસ્કૃતિના જે મૂળ સ્થપાયેલા તેના અને તેના સ્થાપકોના તો નામનિશાન કાઢી નાખ્યા! આ સંબંધમાં એક રસિક અહેવાલ સાંભળવા જેવો છે.

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદધિ”

વર્ષ-૫, અંક-૨૦, તા. ૧-૭-૧૯૫૭



## ૩૭ સંસ્કૃતિના સંરક્ષણ

દક્ષિણા ગુજરાતીભાઈના ભાષણો રસિક અહેવાલ

દક્ષિણ દેશમાં એક દક્ષિણી સંસ્થાએ વિદ્યાર્થીઓને જુદા જુદા અનુભવ આપવા વીસેક વર્ષ પૂર્વે ભાષણમાળા ગોઠવી. ભાષણ માટે એમાં એક ગુજરાતી જૈનભાઈને આમંત્રણ આયું. એ ભાઈ કેટલી મુશીબતે ત્યાં ભાષણ કરવા તો ગયા, પણ ત્યાં એમણે વાત કરી કે

“હું અહીં આવી શકવાનો ન હતો. કેમકે મને મારા મિત્રો વળગ્યા હતા. એ કહેતા હતા : ‘ભાઈ ! કોણી આગળ ભાષણ કરવું છે તમારે ? તમે સમજો છો ખરા કે નહિ ?’

મેં પૂછ્યું, ‘કેમ ?’

એ કહે છે, ‘તમે જેની સામે ભાષણ કરવા જાઓ છો તેમણે સંસ્કૃતિ સામે કેવી લડાઈઓ જમાવી છે ? સંસ્કૃતિના મૂળ સ્થાપક તીર્થકરોને કેવા અવગણ્યા છે, એની તમને ખબર છે ? એમના પ્રાચીન શાસ્ત્ર તરીકે ગણાતા વેદમાં જુઓ ક્યાંય એમાં સંસ્કૃતિ - સ્થાપક ઋષભદેવ પ્રભુ, કે બીજા તીર્થકરોની વાત છે ? એમને તમારે શું સમજાવવું છે ?’

આ સાંભળી મારે મારા મિત્રોને કહેવું પડ્યું, ‘આજે તો કાળ ફરી ગયો. ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ” (ભાગ-૧૮)

૨૪૩

ક્યાં તમે જુના જમાનાની વાતો કરો છો ? એ વેદના લખનાર ગયા !’

ત્યારે મિત્રો મને કહે છે, ‘અરે, ચાલોને વેદ પછીનો રામાયણનો યુગ લ્યો ! ક્યાંય છે એમાં જૈન ધર્મનું કે જૈન વિભૂતિઓનું નામ ? અરે, એ કરતાં ય તમારી મહાન અહિસાની, કડક સાધુ જીવનની તત્ત્વજ્ઞાનની સંસ્કૃતિનો કોઈ ઉલ્લેખ છે ?’

મેં કહું, ‘અરે ભાઈ ! કેટલી જૂની વાત કરી ? આ તો મારા મિત્રો નવા જમાનાના છે.’

ત્યારે પેલા કહે, ‘તો એથી આગળ આવો, સંસ્કૃતિનું જ્યારે અધ્યપતન થાય છે ત્યારે કેટલી હદ સુધી ? પ્રભુ નેમનાથ તીર્થકર શ્રીકૃષ્ણના ભાઈ હતા, પણ જુઓ મહાભારતમાં તમારા નેમનાથનો ઉલ્લેખ છે ?’

તો મેં કહું, ‘એ પણ જૂની વાત છે. છતાં હું એજ લોકો પાસેથી ખુલાસો લાવીશ.’

તો પેલા કહે, ‘અરે એ ય જુનું ? લો, પ્રભુ મહાવીર સ્વામીએ કેવો અહિસાનો ઝંડો ફરકાવ્યો ! જ્યારે આજના આ તમારા મિત્ર ઈતિહાસકારોએ અહિસા ગૌતમ બુદ્ધના નામ પર ચંદ્રવી દીધી !’

વિદેશી સંસ્કૃતિએ કેટલું જેર પીરસ્યું ! કેવા નવાં નવાં તોફાન ઘાલી દીધા. આશર્ય છે કે અહિસા ગૌતમ બુદ્ધની જ, ને બુદ્ધનાં જ પુસ્તકો ઠેર ઠેર માંસાહારનું પ્રતિપાદન કરી રહ્યા છે ! આજે એને માનનારા ૭૦ કોડની પ્રજા ઘોર માંસાહારી છે. ક્યાં રહી એની અહિસા ? છતાં અહિસા મહાવીરની નહિ, બુદ્ધની !’

મારે મિત્રોને કહેવું પડ્યું, ‘તમે આકળા ઉતાવળા ન થાઓ. સાંભળનાર લોક સજજન છે. એમની પાસેથી આ જુના જમાનાની વાતોના હું ખુલાસા લઈ આવીશ.’

પેલા કહે, ‘અરે, મહાનુભાવ ! હજ ય તમને ભાષણનો મોહ છે ? એથી પણ નજીકના કાળની ઘણી વાતો છે ! જુઓ મહાન સંપ્રતિ રાજાએ ઈરાન ને ગ્રીસ સુધી આર્ય સંસ્કૃતિનો ફેલાવો કર્યો. દક્ષિણાની જડ પ્રજાને સંત સાધુની અને ધર્મની પૂજારણ બનાવી અહીંયાં સત્ય વગેરેના જબરજસ્ત પ્રચાર કર્યા પણ એ બધું છે આજના ઈતિહાસકારોની નોંધમાં ? અરે એણે જે શિલાલેખો કરાવ્યા, તે પણ અશોકના નામ પર ચંદ્રવી દીધા ! આ લોકોને જેણોનું હોય તે ન ખપે. હજ સાંભળું છે ? તો સાંભળો.

‘કલિંગનો રાજા સમ્રાટ મિયદર્શી મહાન રાજા થઈ ગયો. કલિંગની ગુફામાં એનો શિલાલેખ છે. એને આ ઈતિહાસકારોએ બૌદ્ધના શિલાલેખ તરીકે ઠોકી

૨૪૪

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-સંસ્કૃતિના સંરક્ષણ (ભાગ-૧૮)

બેસાડ્યો હતો ! સારું થયું, કે યુરોપીયન સ્કોલરો આવ્યા, ને માર્મિક નિરીક્ષણ સંશોધન કર્યું. ‘અંન નમઃ સિદ્ધમ્’ હતું શરૂઆતમાં. બૌદ્ધોમાં સિદ્ધ ભગવાન જેવું તત્ત્વ જ નથી તો એમને નમસ્કાર શેનો ? વળી શિલાલેખમાં લખ્યું હતું કે ‘બિબિસાર રાજી ભગવાન ઋષભદેવની પ્રતિમા ઉઠાવી ગયો, તેથી અહીં નવી પ્રતિમા સ્થાપિત કરી છે...’ બૌદ્ધોમાં ઋષભદેવ ક્યાં છે ? જૈનો પ્રત્યે કેટલો દેખ ? આજે તો હવે એ જૈન લેખ તરીકે પ્રસિદ્ધ થયો છે. પણ આ આકર્ષણોમાં સંસ્કૃતિના સંરક્ષણ શી રીતે થાય ? સંસ્કૃતને ટકાવનાર સામે જ વેર-જેર હોય, ત્યાં સંસ્કૃત શી રીતે ટકે ?

‘ભાઈઓ,’ આ સાંભળીને તો હું ય થંભી ગયો, મનને થયું મારે કોની આગળ ભાષણ કરવાનું ? છતાં હિમત કરી મેં મિત્રોને કહ્યું, ‘ભાઈ, જ્યા ધીરજ રાખો. આપણી વાત આપણા ઘરમાં રાખી મૂકવાથી જ લોકમાં એનું અજ્ઞાન પ્રવર્તે છે. એના કરતાં મને એ લોકો પાસેથી ખુલાસો પૂછી લાવવા ધો. ગમે તેમ તો એ બધી ગ્રાચીન કાળની વાતો છે. અવર્ચીન કોઈ વાંધો હોય તો બતાવો !’

તો મને મારા મિત્રો કહે છે, ‘અરે, હજુ તમારો મોહ કેમ ઉત્તરતો નથી ? લ્યો અવર્ચીન બનાવ સાંભળો.

‘શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ ને રાજી કુમારપાળ ! હેમચંદ્રસૂરિ મહારાજે સાહિત્ય અને મહાકાવ્યોનો યુગ પ્રવર્તાયો, ને કુમારપાળે પોતાના અદાર દેશમાંથી અહિસા દૂર કરાવી દીધી ! આજના લેખકો અને ઈતિહાસકારોએ એને કેટલો ન્યાય આપ્યો ? ક્યાં છે એના વિશિષ્ટ વર્ણન ? ક્યાં છે એની પ્રશંસસા ? એક જણે તો લખી માર્યું કે હેમચંદ્રાચાર્ય મંજરી પાછળ મોહિત થઈ ગયા હતા. મહાન યુગપુરુષ, મહાન બ્રહ્મચર્યને ધરનારા, એમના જેવા પર જૂઢા અધ્યાત્મ આક્ષેપ મૂકાય ત્યાં સંસ્કૃતિના સંરક્ષણ શી રીતે થાય ? જીવનમાં જે સાડાત્રણ કોડ શ્લોક પ્રમાણ વ્યાકરણ કોશ બનાવ્યું. શાધન, છંદ, લિંગશાસ્ત્રો, પ્રમાણ મિમાંસા, ત્રિપદીચરિત વગેરે સાહિત્યની રચના કરી, તે સરસ્વતીની સાક્ષાત્ પ્રસાદી વિના શી રીતે થઈ શકે ? ૧૦૦ વર્ષ લગાતાર જો લખે તો પણ શેં પૂરું થાય ? રોજ સરેરાશ નવા ૧૦૦૦ શ્લોક બનાવવાના, લખાવવાના, એમાં પણ સિદ્ધહેમ વ્યાકરણ, સૂક્ષ્મ વિચારણાનો ન્યાય, એની રચના કરવી,-એ સરસ્વતીની પ્રસાદી વિના બને ? અને સરસ્વતીની પ્રસાદી અંદર નિર્ભળ બ્રહ્મચર્ય વિના બને ? ત્યાં મંજરીમાં રાગલુધ્ય થવાની વાત કેટલી બાલિશ અને ઈર્ધા-જૂઠ-ભરી છે ! એ વિદ્વત્તા ક્યાં ? ને આજની વિદ્વત્તા કેવી ? લાયબ્રેરી ફેંટી ચુંટી કાઢવાના ક્વોટેશન્સ એન્ડ રેફરન્સીસ ! પછી કહેશે, ‘સો ગ્રન્થોને રીફર કરવામાં આવ્યા છે !’ આજની આ

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ” (ભાગ-૧૮)

૨૪૫

પોકળ પંડિતાઈ છે. એ ક્યાં ને ક્યાં શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજની નક્કર પ્રખર વિદ્વત્તા ! એઓશ્રીના નામ પર બાલિશ આક્ષેપ કરવો કે એ સ્ત્રી પર મોહિત હતા કેટલું બેહુદું ! સંસ્કૃતિના આવા જગ્બર સંરક્ષણ પર અત્યાચાર થાય, ત્યાં સંસ્કૃતિના સંરક્ષણ શી રીતે થાય ? માટે તમે, ભાઈશ્રી રહેવા ધો એ જમાતને સમજાવવાનું !’

મેં કહ્યું, ‘ભાઈ, આ તો તમે મને મુંજવી નાખો છો, તમારી પાસે કોઈ તાજી ઈતિહાસની એવી વાત છે ?’

તો એ લોકો કહે, ‘જુઓ ત્યારે આ અકબર બાદશાહ રોજ સવાશેર ચકલાની જીબ ખાનારો ! એમાં ચકલા કેટલાં મરે ? એવો માંસનો શોખીન ને પાછો કૂર પણ એટલો ! ચિત્રોડનો ડિલ્વો જીતતાં એને ભલે મુશ્કેલી પડી. તો અંતે જીતને શું કર્યું ? જાણો છો ? ભયંકર કલેઆમ ચલાવી બિચારા નિર્દ્દીષ બ્રાહ્મણોની ! સૈનિકોને હુકમ કર્યો : ‘એકે એક જાનવર અને એકે એક માણસને કાપી નાખો.’ એટલા બધા બ્રાહ્મણોને કાપી નાખ્યા કે એમની જનોઈના મોટા ઢગ કેટલાય મણ વજનના થયા ! ધાટકીપણું, રસનાનું લુબ્ધપણું, આર્યો પર તિરસ્કાર, આવી અમાનુષતાવાળા અકબરને, સારું થજો કે, જગદ્ગુરુ આચાર્યદિવ શ્રી હીરસૂરિજી મહારાજ મણ્યા, કે એ એમના સચ્ચારિત્ર અને વાણીથી એવો પ્રભાવિત થઈ ગયો કે ચકલાની જીબ ખાવાની બંધ કરી. શિકાર બંધ કર્યો ને પોતાના પાંચેય મોટા દેશમાં હ-હ મહિના માટે અહિસાના કડક ફરમાન કાઢ્યા ! કોઈએ જીવને મારવાનો નહિ ! સમસ્ત હિંદુઓ પાસેથી લેવાતો જળાવાવેરો કાઢી નાખ્યો, દયાની વેલડી એના હદ્યમાં ઊગી. યુરોપીયન વીન્સન્ટ સ્મીથના ઈતિહાસમાં આની નોંધ છે, છતાં લાવો આજના અહીના ઈતિહાસકારો પાસે આવા હીરસૂરિજી મહારાજની શક્તિનો, એમજે બતાવેલા અહિસાના જયનાદના ઉલ્લેખ છે ક્યાંય ? તમારે એમને ભાષણ સંભળાવું છે ? અરે ! ખુદ આઈ ની અકબરીમાં પૂરાવા મોજુદ છે ! ફરમાનો મોજુદ છે. છતાં આજના કાંલેજયનોનેય એની ગંધ પણ છે ? પણ એ બિચારાને કોણ બતાવે ? સંસ્કૃતિના સંરક્ષણ શી રીતે થતાં હશે ? આજના જોખમે જે મહાપુરુષો સંસ્કૃતિના સંરક્ષણ કરતા આવ્યા, તેમના પર આટલા બધા દેખ, ત્યાં તમારે ભાષણ કરવા છે ?’

મેં કહ્યું, ‘તમે ભારે કરી, બેર ! હું જઈને એનો પણ ખુલાસો પૂછીશ. પરંતુ આજના જમાનાની વાત અંગે કાંઈ દેખ જેવું તમને દેખાય છે ?’

તો પેલા કહે, ‘હા, જુઓ એ લોકને તુલસી, કથીર, તુકારામ, મીરા વગેરે સંતો જડ્યા. પણ કોઈ જૈનાચાર્ય, કોઈ જૈન સાધુ મહર્ષિ જડ્યા ? કોઈ સાધ્વી,

૨૪૬ ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-સંસ્કૃતિના સંરક્ષણ (ભાગ-૧૮)

કોઈ ન્યાયી જૈન મંત્રી, કોઈ સતી શાવિકા જડી ? આપણે ત્યાં તો પ્રખર ન્યાયાચાર્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કાશીના પંડિતોને જીતવા આવેલા વાદીને હરાવીને કાશીના પંડિતોની આબરુ સાચવી. વળી એમણે કેવા અદ્ભુત શાસ્ત્રરત્નો-ગદ્ય-પદ્યમાં રચ્યા છે ! ક્યાં છે એની નોંધ કે પ્રશંસા આ લોકો પાસે ? મહાન કવિઓ ઉદ્યરતન, વીરવિજયજી વગેરે અનેક થઈ ગયા. અરે તામીલ તેલુગુ ભાષામાંય મૌલિક જૈન કવિઓ થઈ ગયા છે કોણી કિંમત આ લોકોને છે ? આજની ભૂગોળો જુઓ. એમાં જૈનોની શિલ્પ સમૃદ્ધિ, તીર્થો, સ્મારકો, જ્ઞાન ભંડારો વગેરેની આજના કોણ નોંધ લે છે ? એમને તાજમહાલની ખબર છે, પણ એના કરતા અનેકગુણા મૂલ્યવાન અને કળામય રાણકપુર મંદિરની ક્યાં ખબર છે ! અરે લાવો તમારી પુનાની ભૂગોળ, એમાં પુનાના જોવા લાયક થણો પારવ્તી, કૌન્સીલહોલ વગેરે છે, પણ એમાં વેતાલપેઠના ભવ્ય મંદિર કે જૈન જ્ઞાન ભંડારનો ઉલ્લેખ છે ? જૈનો પાસે કુદ્દ નથી, જૈનો એટલે કંઈ નહિ, ઉપરથી એમની અહિસા બાયલા બનાવનારી.’

- એમ કરીને નિંદા કરે છે. પણ એ મૂર્ખ આક્ષેપ છે !’

એક પેશાને હજામત કરનાર હજામનો જરા અસ્ત્રો વાગી ગયો. લોહી નીકળ્યું. પેશાએ પેલાને તમાચ મારી. તો પેલો હસે છે.

‘અભ્યા કેમ હસે છે ?’

‘તમે જરા અસ્ત્રાની ધાર નથી ખમી શકતા, તો પછી લડાઈમાં ભાલા કેમ ખમી શકશો ?’

પેશા કહે છે : ‘લાવ તારો અસ્ત્રો.’ નીચે એનો હાથ, ને ઉપર પોતાનો હાથ રાખી એમાં અસ્ત્રો ધોંચ્યો, પેલાને જરા અણી અડતા બરાડ્યો ! ‘મૂર્ખ ! કેમ ? અભ્યાસ પાડ, તો અવસરે અક્સમાત આવે તો માર સહન કરી શકીશ. ત્યાં તો ના કહે છે. તો અવસરે ભાલા સહ્ય માટે શું રોજ છરીથી શરીરમાં ગોંચાગોંચ કરવી પડતી હશે ?’

એમ, શું વારંવાર ‘કીડી મારો, ને મંકેડા મારો !’ એમ કરનારા લડાઈમાં સારું લડી જાણશે ? એ માટે શું રોજ જીવોને માર્યા કરવાના ?

કુમારપાળ લડાઈ કરવા જવા તૈયાર થાય છે. ઘોડાના પલાણે પૂજણી બાંધેલી તેનાથી પલાણ પૂજણે ઉપર બેસવા ગયા. બાજુનો સામંત રાજા હસ્યો ! એટલે કુમારપાળ સમજ ગયા. બોલાવે છે,

‘આ પૂજયું એ ખૂંચ્યું કેમ ? અહીં આટલો કોમળ લડાઈ શું લડશે, એમ થયું, નહિ ?’

એનો પગ નીચે રાખી ઉપર પોતાનો પગ રાખી ભાલાની અણી

ધોંચી. પોતે પગ આખો વિંધાવા છતાં સ્થિર છે ! પેલાને અણી અડતાં જ ‘હંહ...’ થયું !

‘હું શું થયું ? નિર્દોષ જીવની જે રક્ષા કરે, તે અપરાધીને મારી નહિ શકે ? આપણા ક્ષત્રિય પૂર્વજીને ભૂલી ગયા ? નિર્દોષની રક્ષા માટે જતને સમર્પી દેતા, પણ અપરાધીને સજા કરવા બધું સહી છૂટતા ! અહિસાને જીવનારાઓએ તો આ દેશની અને એની સંસ્કૃતિની રક્ષા માટે પ્રાણના ભોગે ભારે પરાક્રમ દાખલ્યા છે. કહો, આ બધું ઓળવનારા સામે સંસ્કૃતિના સંરક્ષણ શી રીતે કરવા ?

એ દક્ષિણા ગુજરાતી ભાઈએ તો પછી ત્યાં સભામાં માગણી કરી, ‘ભાઈઓ તમે જરૂર આ બધી મારા મિત્રોની ફરિયાદ ખુલાસા આપજો. જેથી એમની ગેરસમજ હોય તો દૂર કરી શકાય.’ એમ કહી પછી જૈન ધર્મ વિષે કેટલીક વાતો કરી. એમાં એક વસ્તુ એ કહી કે કેટલાકો આક્ષેપ કરે છે કે,

‘જૈનો ઈશ્વરને નથી માનતા.’ પણ આ આક્ષેપ વિચારણીય છે. જૈનો પરમાત્માને જરૂર માને છે, પણ હા, જગતના કર્તા-સંહતાની તરીકે નહિ.

જગતકર્તા ઈશ્વરને માનનારા કહે છે, ‘પરમાત્માનો ઉપકાર કેવો ! જુઓ પરમાત્માએ પૃથ્વી-પદ્મા-નદીઓ-હવા-પાણી-જાડપાન બનાવ્યા. તો આપણે જીવી શકીએ છીએ.’

પણ જૈનો પરમાત્માને વિશ્વ ઘટનાના બનાવનાર તરીકે નહિ, પણ બતાવનાર તરીકે માને છે. પરમાત્માને વિશ્વના બનાવનાર તરીકે માનવાથી તો પરમાત્માને કૂર માનવા પડે; કેમકે એમણે નરકની ભણીઓ બનાવી માટે જીવને શેકાવું પે છે ! કસાઈનો છરો ક્રોણે બનાવ્યો ? ભગવાને ! મારવાની કિયામાં કસાઈનો હાથ તો દૂર રહો, પણ ભગવાનનો છરો ઠેક ગળા પર ફર્યો, એમ ગણાશે.

કહે છે, “જૈનો નાસ્તિક છે. પરમાત્મા માનતા નથી;

અરે માનનારને પૂછો કે તો પછી ભગવાને દુઃખના સ્થાનો અને સાધનો બનાવ્યા તો ભગવાન દુઃખદાયી નહિ ?

જવાબમાં કહે છે, ‘ભગવાન શું કરે ? જીવના કૂડાં કર્મ એવાં છે. ભગવાન તો માત્ર ન્યાયાધીશ છે.’

પણ અહીં એ પ્રશ્ન ઉઠે છે કે તો તો ભગવાને પહેલાં એને ગુનો જ કેમ કરવા દીધો ? ધારો કે રસ્તા પર કોઈ માણસ છરો લઈને કોઈને મારવા જતો હોય, ને પોલિસ જુએ કે ‘આ જાય છે મારવા, છતાં હું તો એને ખૂન કરતો પકું,’ એમ કરી અટકાવે નહિ, તો ? પોલિસ પહેલો ગુનેગાર ઠરે ને ? ઈશ્વર

તો અનંત શક્તિવાળા છે. તો ગુનો કરવા જ કેમ દે ? હિંસા કરવા જનારનો હાથ જ થંભાવી દે ! જૂં બોલનારની જ્ઞાન જ અક્કડ બનાવી દે ! નાનું છોકરું ગમે તેવું હઠીલું હોય, વારંવાર દાદર પાસે જતું હોય, પણ માતા, ‘ભલે પડ, તારું કર્મ તું જાણે’ એમ કરે ? છોકરો નાદાન હોય, માતાથી નાદાન ન થવાય.

જૈનો જે પરમાત્માને માને છે તેવા વીતરાગ સર્વજ્ઞ સત્ય તત્ત્વ પ્રરૂપક, મોક્ષમાર્ગદાતા કોણે માન્યા છે ? જૈનો જો પરમાત્માને ન માનતા હોત તો એકેક મંદિર કરોડેના ખર્ચે ઉભા કેમ કરત ? જૈનો પરમાત્માને ન માનતા હોત તો એમના કલ્યાણકોની ઉજવણી, મોટા શાંતિસ્નાત્ર-મહોત્સવ, મહાપૂજા, કેમ કરત ? ત્રિકાળ પૂજામાં ઊંચા દ્વય ખર્ચી લયલીન શા માટે થાત ? પોતે લુખ્ખા આંબેલના ભોજન કરે, ને પૂજામાં કિમતી ફણ-નૈવેદ્ય ધરે, એવું શા માટે કરત ? એમને તો પરમાત્માને ધર્યું એટલે ખલાસ. પછી એના પર પાછું જોવાનું નહિ ! ત્યારે જગતકર્તા ઈશ્વરને માનનારા તો ઈશ્વરને નૈવેદ્ય ભોગ ધરી એમાંથી ભગવાનને શેષ, ને બાકીનું ભગતને ખપે ! એમ કરે છે.

સંશોધકો કહે છે કે, જ્યારે જીવોની મોહ મૂઢ્ઠા વધી અને ધર્મના નામ પર સ્ત્રી પરણવાનું મન થયું, ત્યારે ઈશ્વરને પણ જોડે સ્ત્રી બેસાડી ! ઈશ્વરના જીવનમાં નારી સાથેની કીડાને કલ્યી એને ભગવાનની લીલા તરીકે જોડી ! એમ માણસને શસ્ત્રો લઈ લડવા ઝગડવાનું મન થયું, ત્યારે ઈશ્વરના હાથમાં શસ્ત્રો આયાં અને ઈશ્વરની કથામાં ઈશ્વરે લડાઈઓ કર્યાનું દાખલ કર્યું ! કહે ઈશ્વર તત્ત્વની કેટલી બધી વિટંબણા કરી !! શું આનું નામ ઈશ્વરને માન્યા કહેવાય ? કે પરમાત્મા એટલે તો શુદ્ધ નિરંજન શ્રેષ્ઠ આત્મા કહેનારે ઈશ્વરને ઠીક માન્યા કહેવાય ? પરમાત્મા શું રાગ-દ્વેષ-કામ-કોષ-મદ-લોભ-હાસ્ય વગેરે દોષોથી ભરેલા હોય ? કે સર્વ દોષોથી રહિત વીતરાગતાદિ અનંત ગુણ સંપન્ન હોય ? જેમ દુનિયાના સત્પુરુષો એ આદર્શ પુરુષો છે, તેમ પરમાત્મા તો મહા આદર્શભૂત પરમપુરુષ છે. એ કેવા હોય ? જ્યારે કામના ન હતી, ત્યારે તો ભગવાનની નિષ્કામ ભાવે પૂજા કરતો. મૂર્ખ્ય ઉત્તરે માટે પ્રલુનું બધું કરતો, પણ મફતીયું ખાવાની વૃત્તિ થઈ, એટલે ભગવાનને ભોગ ધરવાની કલ્યાના ઊભી થઈ. પછી ભગવાનના નામે બધું સાઝ કરી જાઓ, વાંધો નહિ. કોઈ કહે નહિ કે મફતીયું ખાધું. ભગવાન એટલે આપણા બાપ. ને બાપનું દિકરાને ખપે ! થાળના થાળ ભગવાનને ધર્યા કહેવાય, ને કામનું કામ થાય ! દેવ-દેવીની આગળ નાળીયેર આખું ઝોડવાનું, ત્યાં મૂકવાની એક નાની શેષ, ને બાકીનું વહેંચી ખાવાનું ! ત્યાગને બદલે ભોગની રુચિ વધે ત્યાં ધર્મને બદલે અધર્મ જ વધે ને ? વળી માણસને અભક્ષ્ય ખાવાનો અભખરો થયો, એટલે

પછી એ પણ ભગવાનના નામ પર ચાલ્યું. પછી માણસને ધર્મના નામ પર મરધા ખાવાનું મન થયું. એટલે કેમ ? તો કે એ ચાલ્યું કે ભગવતી દેવી, એના નામ પર મરધાં ધરો ! જેટલા વધારે મરધા ચઢાવો તેટલી દેવી વધારે તુષ્ટમાન ! પરલોકનો કોઈ ભય જ ન રહ્યો. પછી માણસને બોકડાનું માંસ ખાવું હતું, તો ધર્મના નામ પર ધર્તીંગ કટલ્યું. ધર્મની કિયાઓમાં બનાવટી મંત્રાક્ષરોથી બોકડા હોમવાનું ચાલ્યું ! ‘એ હિંસા ધર્મના નામ પર; માટે એ પાપ નહિ ! મહાધર્મ !’ એના માંસનો આહાર એ તો દેવપ્રસાદી ! સંસ્કૃતિની કેવી વિટંબણા ? ઈશ્વર તત્ત્વની કેવી વિટંબણા ! સંસ્કૃતિની કેવી મજાક !

### ● જૈનોનાં મુખ્ય શાસ્ત્ર ●

આર્થ સંસ્કૃતિની પ્રાણભૂત જૈન સંસ્કૃતિને વળી એક તિરસ્કાર એ થયો કે, કહે છે કે જૈનો પાસે ખાસ શાસ્ત્ર ક્યાં છે ? હિંદુઓ પાસે ગીતા, મુસલમાનો પાસે કુરાન, ખ્રીસ્તીઓ પાસે બાઈબલ. એવું જૈનો પાસે શું છે ? પરંતુ આમ કહેનારાઓને એ ગંધ સરખીય ક્યાં છે કે જૈનો પાસે ૧૧ અંગ વગેરે અદ્ભુત આગમો છે. વળી એકેક વિષય પર ટગલો સાહિત્ય છે. એ એકેક વિષયના સાહિત્યમાં એકેકો ચુનંદો ગ્રન્થ આગળ ધરી શકાય. જેમકે, આત્મા પર લાગતા કર્મબંધના સિદ્ધાન્તના વિષયમાં ‘કર્મ પ્રકૃતિ આદિ પંચસંગ્રહ’ અદ્ભુત ગ્રન્થ છે. તર્કના વિષયમાં ‘સન્મતિ તર્ક પ્રકરણ’ અજોડ શાસ્ત્ર છે. અનેકાન્તના વિષયમાં ‘અનેકાન્ત જય પતાકા’ વિજય ધજ સમો ગ્રન્થ છે. મૂલ આગમ અને દ્વાયાનુયોગના વિષયમાં ‘દૃષ્ટિવાદ’ નામનું મહાશાસ્ત્ર હતું. જે આજે વિચિન્ન છે. યોગના વિષયમાં ‘યોગદાસ્તિ, યોગબિન્દુ’ અનુપમ ચિંતનીય શાસ્ત્ર છે. વૈરાગ્યપ્રેરક ‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર’ અપૂર્વ આગમ ગ્રન્થ છે. આમ આવા આવા અનેકાનેક વિશિષ્ટ ગ્રન્થો છે. ત્યાં અનેકાનેક વિષયોનો સમાવેશ કરતો એક જ ગ્રન્થ શી રીતે હોઈ શકે ? હોય તો એમાં શો ન્યાય વિષયોને અપાય ?

### ઉંચો આદર્શ ભૂલાવવાના નુકશાન :-

આપણો મૂળ મુદ્રા એ છે કે સંસ્કૃતિના અધઃપતન થવાના કારણે એના સંરક્ષણ કરવાનું મહાન કર્તવ્ય બજાવવાનું છે. સંક્ષેપમાં જુઓ કે પૂર્વે કહ્યું તેમ માણસની વિષય તૃષ્ણા અને અહંકારવૃત્તિ વધવાના કારણે સંસ્કૃતિને બદલે વિકૃતિ પેઢી. પછી તો જીવનના આદર્શ પણ હલકા કરાયા. આજ કહે છે ને ગૌતમ બુદ્ધે ઉંચામાં ઉંચો ધર્મ માનવતાનો ધર્મ ઉપદેશ્યો ? એટલે ? માનવતા ઉપર ઉંચી કક્ષા જ કોઈ નથી એવો ભાસ કરાવ્યો ! વિદ્યાર્થને પહેલેથી જ જો કહેવામાં આવે કે વિદ્યાક્ષેત્રે તારે છેલ્લામાં છેલ્લી ચોથી ચોપડી પાસ કરવાની છે, તો એને આગળની

વિદ્યા માટે કહો જો, કોઈ જિજ્ઞાસા, મનોરથ અને ધગશ થાય ખરી ? ઉલદું ઉપરની ઊંચી ઊંચી વિદ્યા બતાવનારા હંબગ લાગે ! અજુગતું કહેનારા લાગે !

માનવતા સુધી જ છેલ્લી કક્ષા બતાવનારાઓએ આ પરિણામ આજે ઉભું કર્યું છે કે ૧. જનતામાંથી પરલોકદિનિ ખૂબ જ હ્લાસ પામી ગઈ છે ! ૨. તત્ત્વજ્ઞાન, યોગ, ધ્યાન, સમાધિની દિવ્ય કક્ષાઓ નિરૂપયોગી અને વાહિયાત જેવી મનાતી જઈ રહી છે ! ૩. મોક્ષ પ્રાપ્ત કરવાની ભૂખ અને એના ઉપાયોમાં પ્રવર્તવાની વૃત્તિ વિસારે પડી રહી છે ! ૪. આત્માના ષટ્ટસ્થાનના મૂળ પાયા પર ચાલી આવતી સામાજિક રીતરસમો પલટાઈ ગઈ છે. ૫. બહુમતી, ચૂંટણીવાદ, વ્યક્તિ-સ્વાતંત્ર્યના નામે અજ્ઞાન, સ્વચ્છંદાચાર વગેરે ક્યાં ઓછું ફાલ્યું-ફૂલ્યું છે ?

સંસ્કૃતિના આવા અધ્યપતન તો હમણાં હમણાં વિદેશી વિકૃતિઓ પેઢી ત્યારથી થવા માંડ્યા છે. ઈસુ ખ્રીસ્તે પણ માનવતાને જ છેલ્લો ધર્મ બતાવ્યો ! પરિણામે દિનિ કેવળ આ જીવન પુરતી મર્યાદિત થઈ ગઈ અને તેથી ભૌતિકતા ઉપર કેન્દ્રિત બની ગઈ. આર્ય સંસ્કૃતિને આંશો ઓછું નુકશાન નથી કર્યું.

**કોણ ભયંકર ? મંદિરનાશક કે સંસ્કૃતિનાશક ? :-**

અલબત્ત, ચંગીસખાન, નાદીરશાહ, અલાઉદીન ખીલજી, મહમદ બેગડો, ઔરંગજેબ, વગેરેએ જૈનો અને હિંદુઓના મંદિરો તોડીને મહાનુકશાન કર્યું છે; વળી એની મહીદી બનાવી તથા લોકને ઈલામ ધર્મમાં બળાત્કારે વટલાવી ભયંકર નુકશાન કર્યું છે, પરંતુ વસ્તુસ્થિતિ જુઓ કે છતાંય જૈનો અને હિંદુઓમાં ધર્મપ્રેમ, સંસ્કૃતિ-રક્ષા વગેરે ટકી રહ્યું હતું. જ્યારે આજે તો એમાં જ સરો પેઢો છે. આજે કેટલાક જૈનો અને મોટી સંઘામાં હિંદુઓ વિદેશી વિચાર પદ્ધતિ અને રીતરસમોના રવાડે ચઢ્યા છે ! ધર્મસ્થાનના નાશ કરતાં સંસ્કૃતિનો નાશ ભયંકર !

**ઇંગ્રેજ કેળવણીનો મહાવિજ્ય :-**

આનો ખરેખરો પાયો મહાન અંગ્રેજ લેખક લૉર્ડ મેઝ્લેલેએ નાઘ્યો. કંપની સરકારના વખતમાં એણે અહીં આવી ઇંગ્રેજ કેળવણીની યુનીવર્સિટી સ્થાપી. વળી એમાં એની નવી પરીક્ષા પદ્ધતિ તથા ડીગ્રીઓ આપવાનું શરૂ કરાયું. ડીગ્રીધરોને સરકારી નોકરીઓ આપવાનું પણ શરૂ થયું. જનસમાજમાં ડીગ્રીધરના બહુમાન ઊભા થયા. આવા બધા પ્રલોભનોમાં આર્ય પ્રજ્ઞા ફસાણી. ત્યારે મેઝ્લેલેએ વિલાયત લખી નાઘ્યું : “હિંદુસ્તાનમાં આપણો વિજ્ય થયો છે.” શો ? એજ, કે વિલાયતી સંસ્કૃતિનો મોહ અને પક્ષપાત જાગ્રત થઈ ગયા. આર્ય સંસ્કૃતિના મમત્વ ઘટ્યા ! રાજ્ય-હક્કુમતથી જે ગુલામી નહોતી લાદી શકાતી, તે આ કેળવણીનો મોહ અને

એની પદ્ધતિના અંધ અનુકરણ દ્વારા લદાઈ ! આર્ય સંસ્કૃતિના મહાનાશ એનાથી શરૂ થયા.

**કોંગ્રેસ સ્થાપના પર યુરોપીય વિજ્ય :-**

તો આજે જુઓ કે ભારતીય માનવ પણ વિચારમાં વેસ્ટનર્ડીઝ-પશ્ચિમીય રીતભાતતનો બની ગયો છે. આજથી પચાસેક વર્ષ ઉપર જ્યારે કોંગ્રેસની સ્થાપના થઈ ત્યારે પણ એક વુંજુસ કે બીજા કોઈક નામવાળા યુરોપીયને ભવિષ્ય ભાયું કે હવે આપણી સંસ્કૃતિનો ઠીક પાયો નખાયો. કેમકે પછી પ્રાચીન ચાલી આવતા ધર્મચાર્યો, સંધ, મહાજન, જ્ઞાતિઓ, નગરશેરઠ, રાજી, વગેરેના બંધારણ તોડી નાખે એવી અલગ અલગ સંસ્થાઓના સ્થાપન, ચૂંટણી પદ્ધતિ, ચૂંટાયેલા પ્રમુખ, સેક્ટરી વગેરેના હોદ્દા અને બહુમતી-વાદ, શાસ્ત્રીય ધર્મપદ્ધતિ અને શ્રદ્ધાના હ્લાસ, વગેરે ફાલવા-ફૂલવાના અને તે આજે સ્પષ્ટ દેખાય છે.

**ઇંગ્રેજનું એક મોહું નુકશાન :-**

ઇંગ્રેજ ફબની કેળવણી અને સંસ્થાઓ સ્થાપવાની પદ્ધતિમાં એક મોહું નુકશાન એ થયું કે કરોડો વર્ષો શું, અસંખ્ય વર્ષોથી ચાલી આવતી સંસ્કૃતિ, સજ્જાનતા અને આબાદીવાળા આ દેશના જ માનવો હવે એમ માનવા લાગ્યા કે આજ સુધી અમે જંગલી હતા, અજ્ઞાન હતા, પછાત હતા તે હવે આ પશ્ચિમીય કેળવણી અને પશ્ચિમીય સંસ્કૃતિએ અમને જાગતા કર્યા, સમજતા કર્યા, આગળ વધાર્યા ! કહો વારુ, ભારતની આ કેટલી મોટી કમનસીબી કે જેમ બકરાના ટોળામાં ફેસેલું સિંહકિશોર જાતે જ પોતાને બકરું માનતું થઈ જાય, એમ ભારતીય પ્રજ્ઞા પોતાને જાતે જ અસંસ્કૃત, અજ્ઞાન અને પછાત માનતી થઈ !

જુઓ આ બધી વિચારણા માન્યતા ખરેખર હકીકત સંબંધી છે. એટલે માત્ર અમારી સાધુ લોકોની કે જૈનોની જ નથી. શ્રી મુનશી જેવાને પણ લખવું પડ્યું છે,-

“નવો યુગ શરૂ થયો. અંગ્રેજ રાજ્ય આવ્યું અને પાશ્ચાત્ય સંસ્કૃતિ દાખલ કરવાનો પ્રયોગ શરૂ કર્યો. આ પર-સંસ્કારે આદરેલો કાર્યક્રમ આપણા જીવન, ધર્મ, ને સંસ્કાર વર્ણના પાયા ઉદ્દેશી નાખવાનો હતો. ‘આપણો ખરો ઈતિહાસ ઘાસીના યુદ્ધથી શરૂ થયો !’ ‘આપણા સુખનો સૂર્ય અંગ્રેજ રાજ્યથી ઉગ્નો !’ ‘આપણી ભાવનાઓની શરૂઆત અંગ્રેજ રાજ્યથી જ થઈ !’ અને ‘આપણો ઉદ્ધાર વિદેશી સંસ્કારથી જ થશે,’ એવી અનેક માન્યતાઓ પેદા કરવા મહેનત થઈ રહી છે !

“આ બધો ડિમિયો કરવાનું મુખ્ય સાધન પાદરીશાઈ-કેળવણી હતું. આ કેળવણીની પાછળ આપણે ગાંડા બની ગયા. ‘આપણે જંગલી હતા. આપણે ત્યાં

સ્વતંશુ ન હોતું. એટલે એ કેળવણી આપણને જતી કરવાની હતી. એ કેળવણીએ આપણને સુધાર્યા. આપણને માણસ બનાવ્યા. આપણને મોક્ષમાર્ગ ચઠાવ્યા. આપણે જંગલી હતા. આપણામાં જ્ઞાન નહોતું. ચારિશ્રદ્ધ નહોતું; ને મ૱કોલે જેવા જગ્ઘાદ્વારે આ કેળવણીના દ્વાર ખોલી સુવાર્ષ યુગ શરૂ કર્યો. અને તેણે સરવાળે શું કર્યું? આવી માન્યતાએ આપણી પ્રજાનું શારીરિક બળ ખોવરાવ્યું. ભૂતકાળના ગૌરવ માટે આપણને પ્રેમ હતો તે વિસરાવી પર સંસ્કારની ભીખ માગતા કર્યા. એણે જ્ઞાન અને શુદ્ધિ પર રચાયેલી વર્ણ વ્યવસ્થા તોડી, પૈસાદાર અને ગરીબના વર્ણો રચ્યા. એણે બ્રાહ્મણની વિંબના કરાવી, સાહેબ પૂજા શીખવી. એણે મર્યાદાની ભાવના તોડી સ્વચ્છંદા શીખવી, મિતાડારી જીવન ત્યજાવી કુદ્વાસનાઓ પાછળ ઘેલા કર્યા. એણે સંસ્કૃતિ વિસરાવી, અંગેળીની ભક્તિ દાખલ કરી. આપણું સાહિત્ય છોડાવી પર સાહિત્યની ગુલામગીરી કરાવી. આપણો ઈતિહાસ ભૂલાવી, પારકી મહત્વાના જ્ઞાપ જપાવ્યા. આપણી રીતને પહેરવેશ, આપણા આચારવિચાર, આપણી ભાવના ને ગૌરવ બધા કંલંકડુપ હોય, એમ ત્યાગતા શિખવ્યું, ભૂતકાળ વિસરાવી એણે આપણું ભાવી વેચાતું લઈ લીધું.”

એક બીજું જુઓ કે કેવી ખૂબીથી લોકમાનસમાં સંસ્કૃતિના વિસ્મરણ અને વિકૃતિ ધૂસાડાય છે. દા.ત. પ્રાય: લિપ્તન ટી કંપનીએ શું કર્યું, જાણો છો ? કેળવણીની ભાણપોથીમાં ‘મા ચા પા,’ નો પાઠ દાખલ કરાવવા કેટલાય પૈસા ખર્ચ્યા. એથી એને એની ચાની ખપત વધી અને અહીં ચાના વસન વધ્યા ! તેથી પ્રભાતે ઊઠીને શુદ્ધ ખાલી પેટે પરમાત્મ સ્મરણ ભજન વગેરે ભૂલાઈ, ચા દેવીની ઉપાસનામાં માણસને અવર્ચિનતાનો ભાસ સ્થિર થવા લાગ્યો. એ તો છાશ પીએ ત્યાં પ્રાચીનતા લાગે. નવીનતામાં સંસ્કૃતિ ક્યાંથી ટકે ? એવું એવું તો આજે દુનિયામાં કેટ કેટલું ગણાય ? આખી ડેક્ટરી પદ્ધતિ, કોર્ટ સીસ્ટમ વગેરેમાં શું છે ? પહેરવેશ આજના એટલે ? એનાથી જ માણસને પોતાને એમ લાગ્યા કરે કે ‘હું જુનો અંધશ્રદ્ધાળું નહિ, હું તો સુધરેલો, કેળવાયેલો !’ અર્થાત્ ? ‘હું વિદેશી સંસ્કૃતિનો, આર્ય સંસ્કૃતિનો નહિ.’

પણ આર્યસંસ્કૃતિના નાશથી માણસ નથી તો સુખી થઈ શકવાનો કે નથી એના આત્માના ગુણ સંપન્ન ઉધ્વીકરણ થઈ શકવાના. વાત વાતમાં ખૂન, ચોરીઓ, લાંઘ રુશ્વત, કોર્ટીમાં ભરયક કેસો, બિમારીઓ, કરવેરાના ભારે બોજ, વગેરેથી માપી શકો છો કે સુખશાંતિ વધ્યા ? કે હેયાહોળી-સંતાપ વધ્યા ? માટે હજ્ય જાગ્યા ત્યાંથી સવાર. સંસ્કૃતિના સંરક્ષણ માટે કટીબદ્ધ થાઓ. પ્રાચીન વિશુદ્ધ વ્યવહારોને સંસ્કૃતિ સંરક્ષક સમજો. પશ્ચિમીય વ્યવસ્થાનો મોહ છોડો. અધ્યાત્મ

અને તત્ત્વજ્ઞાનને પુનર્જીવન આપો. માનવજ્ઞવનનું ઊંચું લક્ષ મોક્ષ છે, એટલે કે આત્માને મોહપાશ અને કર્મબંધનથી વિમુક્ત કરી નિરંજન નિરાકાર અનંત જ્ઞાન અનંત સુખમય સ્થિતિમાં સ્થાપિત કરી દેવો, - એ ઉચ્ચ આર્દ્ધ ધરો, એને અનુસાર જીવન જીવો.

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદધિ”

વર્ષ-૫, અંક-૨૧, તા. ૧-૭-૧૯૮૭



## ૩૮ સંસ્કૃતિના સંરક્ષણ ભાગ-૨

સાચી માનવતા ક્યારે વિકસે ? :-

સંસ્કૃતિના પતન કાળમાં એના સંરક્ષણ કરવાના પ્રયત્નો આર્થિશમાં મહાપુરુષો અને એમને અનુસરનારા આર્થલોકો કરતા જ આવ્યા છે. આજે તો એવા પ્રયત્નો ખૂબ જરૂરી છે. આજે તો પ્રજાને મૂળમાં એ સમજાવવાની જરૂર છે, કે પૂર્વે આત્માના પદ્દસ્થાનની ઉચ્ચ શ્રદ્ધાના કાળમાં જે આબાદી, જે સુખશાંતિ અને જે સાચી માનવતાની ખીલવટ હતી તે આજે ક્યાં છે ? આત્માના એ પદ્દસ્થાનની શ્રદ્ધાનો આજે જો પુનરુદ્ધાન થશે. તો જ સુખ-શાંતિ, આબાદી અને માનવતાની ખીલવટ થશે. ‘આત્મા છે, નિત્ય છે, એણે કેરેલા કર્મના ફળ એને ભયંકર ભોગવવા પડે છે, જો એ લક્ષમાં જ ન હોય, એ માનવું જ ન હોય, તો પછી સંસ્કૃતિના જીવન એ શા સારું જીવે ? કેમકે દુનિયા તો પ્રત્યક્ષમાં ધન, સત્તાના, સત્ત્માન દેખાડે છે; તેથી એના મોહ કોણ મૂકે ? એમાં જરૂરી એવા તૃપ્ત્યા-કામ-કોધ-લોભાદિ બંધનો કોણ ત્યજે ? પદ્દસ્થાનની પાકી શ્રદ્ધા થાય તો સૂકે કે ‘હાય ! જો મોહ અને કર્મના બંધન ઊભા રાખ્યા તો એના ભયંકર કટુકણ મારે જ ભોગવવા પડશે ! માટે અહીં આત્માના બંધનો તોડી જ નાખવો જોઈએ. નહિતર ભાવી અસંખ્ય કાળ ભટકવું પડશે. માનવ-જીવનની આજ વિશેપતા છે કે જગતના બીજા ભવોમાં આત્માને બંધનોથી બાંધવાનું બને છે; ત્યારે અહીં એ બંધનોને ઓછા કરી શકાય છે ને મન-વચન-કાયાની શક્તિનો પૂર્ણ વિકાસ અમલી કરે તો સર્વ બંધનોના ક્ષયની એટલે કે વીતરાગતા અને મોક્ષની નજીક પણ પહોંચી શકાય છે. એ બંધન તોડવાની સોલ એજન્સીવાળા માનવભવમાં એ છોડી બીજો ધંધો કરવો એ સરાસર બિનસાવધાની છે, મૂર્ખતા છે, ચિંતામણીરતની અધિક એવા મનુષ્ય ભવને હારી જવાનું છે.’ આવું કંઈક વિચારે એજ ધન, સત્તા વગેરેના મોહ ઓછા કરી નાખશે. ત્યારે જ સાચી માનવતાની ખીલવટ થશે.

**બધું જ્ઞાનારે બતાવ્યું શું ? :-**

વીતરાગ સર્વજ્ઞ પરમાત્માનો આ ઉપકાર છે કે એમણે આત્માનું એવું સાયન્સ બતાવ્યું છે કે બંધનો કેવી રીતે આત્મા પર લદાય છે, ને તે તોડવા જીવનમાં ઊંચા ઊંચા ઉપાયો કેવા મોજુદ છે. પરમાત્મા અનંતજ્ઞાની છે. અનંતજ્ઞાનમાં કંઈ જોવામાં બાકી નથી. મંત્રો જગતમાં સુવર્ણ બજાવી દેનારી ઔષધીઓ, નિમિત્તો, જ્યોતિખાદિ બધું જ્ઞાનવા છતાંથી એ બતાવ્યું નહિ ! આ બતાવ્યું કે ‘આત્માનાં બંધનો તોડો.’ એટલા માટે કે જગતના ઋદ્ધિ વગેરેના ઉપાયો અપાયો છે. ક્ષણ વારની ભપકાવાળી સ્થિતિ બતાવી, દીર્ઘકાળ સુધી સંસારમાં રગદોળી નાખનારા છે. બંધનો તોડો તો જ ઉત્તરોત્તર ઊંચી ઊંચી સદ્ગતિઓ મળે છે.

**પરમાત્મા પાસે શું મળાય ? :-**

આ સર્વજ્ઞ વિના બીજો કોઈ ન બતાવી શકે. કેમકે, જેના જ્ઞાનમાં દરેક વસ્તુના પરિણામો દેખાય, તે જ એ વિવેક કરી શકે છે કે આજ વસ્તુ જીવને ખરેખરી લાભદાયી છે; ત્યારે આ બીજી વસ્તુ દેખાવમાં લાભદાયી છતાં અંતે તુકશાનકર્તા છે. પરમાત્માના અનંત ઉપકારનું કાર્ય આ, કે જીવોને તત્ત્વ ઓળખાવે અને જીવોને ઠેઠ મોક્ષ સુધીનો માર્ગ બતાવે. પરમાત્માનો ઉપકાર બરાબર સમજતા હોઈએ તો હરખાઈ જવાનું ન થાય. કે ‘મેં પૂજા ભજાવી, આંબેલ તપસ્યાની ઓળી કરી, ને એથી મને બાજરમાં લાભ સારો થયો.’ ‘ભગવાનનું ધોડીઆ પારણું ધરે લઈ ગયા, ને પુત્રવધૂને પારણું બંધાણું.’ એ તો સમજે કે પ્રભુપૂજાના, તપસ્યાના, ધર્મના ફળમાં તો મારે મોક્ષ લેવાનો છે; ભવવૃદ્ધિ નહિ ! પરમાત્મા એ મોક્ષમાર્ગ બતાવી મોક્ષદાતા બને છે, માટે એમનો ઉપકાર અનંત છે. જેને વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા મળ્યા, એને હર્ષનો પાર ન હોય. એને એમ થાય કે ‘અહો ! પરમાત્મા અમને કેવો મળ્યા !’

**સરાગ વીતરાગ ઈશ્વરમાં તરફાવત : સરાગ ઈશ્વરે શું આપ્યું :-**

બીજાઓ શ્રીકૃષ્ણને પરમાત્મા માને છે. પાંડવો ને કોરવોનું યુદ્ધ ઊભું થયું. ત્યાં ભગવદ્ ગીતા શું કહે છે જુઓ. શ્રીકૃષ્ણને અર્જુન કહે છે, ‘મારે લડવું નથી, કેમકે યુદ્ધ કોની સામે ? આ વિદ્યાગુરુ, આ ભાઈઓ, પિતામહ, એ બધાની સામે ? અરે ! મારે કોને મારીને રાજ્ય લેવાનું ? મહાન ગુણીયલ અને ઉપકારી પુરુષોને ? ત્બિભ પિતામહને ? દ્રોષાચાર્યને ? સારા ઉચ્ચ કુળમાં જન્મેલા કોરવ ને ? એમનો સંહાર કરીને રાજ્ય લેવાનું ? એવી ધોર હિંસા કરીને કુળનો ક્ષય કરી નાખવાનો ? સુકુલનો નાશ એટલે વર્ણસંકર પ્રજ્ઞાની ઉત્પત્તિ ! એટલે ધર્મધ્વંસ ! એ કામ મારે નથી કરવું.’ અર્જુન વૈરાગી બની ગયો ! દિલનો ઉદાર બની

ગયો ! આહેસાનો પ્રેમી બની ગયો ! એટલી નિસ્પૃહ વૃત્તિવાળો બની ગયો કે નિર્ધાર જાહેર કર્યો. “મને રાજ્યનો મોહ નથી. જરૂર પડ્યે હું તિક્ષા માગીને ચલાવીશ.” એ વખતે શ્રીકૃષ્ણે એને શું શીખવાડ્યું ? “કલૈબ્રં મા સ્મ ગમઃ પાન્થ !”- ‘અરે અર્જુન ! આ નામદારીને તું ભજ નહિ ! તું અજ્ઞાન છે. અભિમાની છે. તું માને છે કે ‘હું આ બધાને મારું છું !’ અરે ! આત્મા તો અજર અમર છે. એ મરતો નથી.”

અહીં પ્રશ્ન થાય છે કે આત્મા અમર છે તો પછી મારવાનો ઉપદેશ શા માટે ? ઊલદું એક પછી એક એવો ઉપદેશ આયો કે પેલાને પાછો ટટાર કર્યો ! શેમાં ? સામા પક્ષનો કચ્ચરધાણ કાઢી નાખવામાં ! અને ખરેખર ત્યાં ખૂનખાર યુદ્ધ ચાલ્યું. એમાં બંને પક્ષમાં ભારતની કેઈ વિભૂતિઓનો કચ્ચરધાણ નીકળી ગયો શું થયું ? વિરાગી અને ઉપશાંત બનેલો અર્જુન, રાગદેખમાં ઘસડાયો. કોનાથી ? સરાગ ઈશ્વરથી.

**અહ્નાણું ભાઈઓ કોધમાં ધમધમ્યા : વીતરાગ ઈશ્વરે શું આપ્યું ? :-**

હવે વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા શું કરે છે, તે જુઓ. ભરતને પૂર્ણ ચક્કવર્તિ થવું છે, માટે અહ્નાણું ભાઈઓને પોતાની આજ્ઞા માની લેવા દૂત મારફતે કહેવડાવે છે. ભાઈઓ ગુસ્સે થઈ ગયા. “રાજ્ય શું ભરતે આપ્યું છે ? બાપાજીએ આપ્યું છે. અને ખુમારી છે, પણ અમે અહ્નાણું છીએ. એવી એની આજ્ઞા અમને માન્ય નથી. જરૂર પડ્યે અમે લડી લઈશું, પણ લડવા પહેલાં પિતા ઋધભદેવ પરમાત્માને જણાવી દઈએ. જુઓ. પિતાજી, આપે તો અમને રાજ્ય આપ્યાં, તે તો અમે લઈને બેઠા સંતોષથી, પણ પેલો ભરત લોભી, તે આખા જગતને દબાવી આવ્યો, ને હજ્ય લોભ મટ્યો નથી. તે અમને કહે છે ‘તમે મારા ગુલામ બનો !’ તો બોલો, પિતાજી ! હવે એને બતાવી આપીએ ને ?’ કહો આ લડાઈ કરે તો પણ ન્યાયી કહેવાય ને ? છતાં પરમાત્માએ શું શિખવ્યું તે જુઓ.

**પરિત્રાણાય સાધૂનાં, વિનાશાય ચ દુષ્કૃતામ् । ...સંભવામિ યુગે યુગે ॥**

‘સાધુ પુરુષોના રક્ષણ માટે અને દુષ્ટોના વિધંસ માટે હું યુગે યુગે અવતાર લઉ છું.’...આવું કંઈ ન કહું.

**વીતરાગ શ્રી ઋધભદેવ પ્રભુએ શું કર્યું ? :-**

પેલા આવ્યા, બેઠા પર્દામાં. પરમાત્મા તો સર્વજ્ઞ છે. બસ, હવે જે જોઈએ છે તે ઔષધ પીરસવા માંડ્યું અને જ્યાં કખાયોના જેર ઉભરાઈ રહ્યા હતા, ત્યાં ઉપશમ વૈરાગ્યના અમૃત વહેતા કરી દીધા ! કહું “રંકડાઓ ! તમે ભરતને

હુશ્મન સમજો છો ! હુશ્મન તો તમારી અંદર બેઠેલા છે. કામ-કોથ-લોભ-મોહ-મદ-મત્સર-રાગ-દ્રેષ... વગેરે જે આત્માના ખરા હુશ્મનો છે, અનંતકણ ભવયકમાં ભટકાવનાર છે, એને ઉખેડી નાખો. ભરતને શું બતાવી આપવું છે ? ભરતને જેર કરવા જશો તો અંદરના હુશ્મનો વધુ પાવરધા થઈ જશે !” પણ મ્રભુ, એ અમારું રાજ્ય લઈ લે...” “રાજ્ય તમારું ? ધરતી કોઈની થઈ છે ? ધરતી તમને હસી રહી છે. કંઈકને મેં રવાના કર્યા, ઇતાં હું અહીં જ છું. તમને ય રવાના કરવાની છું.” ફોગટ ફાંકાં કં મારો ? કહો જો, ધરતી તમારી સાથે આવવાની ?” ‘ના,’ “તો પછી શાની મમતા ?” પરમાત્માએ એવો વૈરાગ્ય જરતો ઉપદેશ આપ્યો, સાથે એક અંગારક વેપારીનું એવું દણ્ણાંત આપ્યું કે એમના હૃદયમાં વૈરાગ્ય, ક્ષમા અને સમભાવના ગંગાપૂર વહેવા માંડ્યા.

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદધિ”

વર્ષ-૫, અંક-૨૨, તા. ૧૫-૭-૧૯૫૭



## ૩૮ સંસ્કૃતિના સંરક્ષણ ભાગ-૨

**અંગારક વેપારીનું દણ્ણાંત :-** એક વેપારી કોલસા બનાવવા ગયો. પાણીના પીપ ભરીને ગયો હતો ! લાકડાં સળગાવ્યાં. કામ ચાલ્યું. સૂર્ય પણ ઉંચે ચઢ્યો, ગરમી તો એકદમ વધી. પાણી અંગારા ઠારવામાં, શરીરે છાંટવામાં, પીવામાં, ધરતી શીતલ કરવામાં વગેરેમાં ખર્ચાઈ ગયું ! હવે પાણીની તપાસ કરે છે; પણ પાણી દેખાતું નથી. નજીક નહિ તો દૂર... પાણી લેવા દોડ્યો ! એટલી બધી તરસ દબાવી રાખી હતી કે એ દોડ્યો ખરો, પણ તરસ અસહ્ય તે ત્યાં એક જાડની હંડી છાયા આવી ને મૂચ્છાઈ ખાઈ નીચે પડ્યો. એને ત્યાં પાણીનું સ્વખનું આવ્યું !

સ્વખામાં મોટે ભાગે શું દેખવાનું ? દિવસની હૈયાહોળી કરી હોય તે જ ને ? કહો જો તમને એવા સ્વખન આવે છે ને કે હું મહાવિદેહમાં પહોંચી ગયો, સીમંઘર ભગવાન દીઠા ! દેશના સાંભળી ! દીક્ષા લઈ લીધી ! આવે છે ? ક્યાંથી આવે ? આખો દિવસ મનમાં રામાયણ બીજી કરી હોય, ત્યાં ક્યાંથી સારા સ્વખા આવે ? જીવ કેટલો જંજાળીઓ ! બાઈઓ દહેરાસરે જતી હોય, તો ય રસ્તામાં વાતો કરે કેટલી મૂખ્યાઈભરી ! ‘આજે તો દાળ હુણાઈ ગઈ હતી ! ને ભીડા ઘરડા આવ્યા હતા !’ ને ભાઈઓને બેસાડી ધો ! કઈ વાતો ચાલે ? દિનરાત એકલી તુચ્છ પુદ્ગલોથી રટના ! પછી સ્વખા સારા આવે ક્યાંથી ? મોટી નુકશાની એ છે કે એ તુચ્છ પદાર્થોની કરેલી રટણા ભવિષ્યના તુચ્છ ભવોની આગાહી કરે છે.

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ” (ભાગ-૧૮)

૨૫૭

ભવિષ્યમાં જેને હલકા ભવ હોય, તેને અહીં હલકું જ સૂઝે !

પેલાને સ્વખનું એ આવ્યું કે સામે એક તળાવ દેખાયું ! વિચારે છે, ટીક થઈ ગયું ! મને ખૂબ તરસ લાગી છે. સ્વખામાં દોડ્યો તળાવ પાસે. ઉંધો લાંબો પાટ સૂઈ ઢોરની જેમ મોહું બોળીને મંડ્યો ઢયક ઢયક પીવા. આખું તળાવ પી ગયો.

કોથ અને તૃષ્ણામાં ધમધમતા અહ્યાણું દીકરાને વીતરાગ ભગવાન ઉપદેશ આપે છે. આ તરસ કેવી છે ? પાણી પીને વધે એવી કે નામશેષ થાય એવી ? આગળ દોડ્યો, ગંગા જેવી મોટી નદી જોઈ, ગંગાના ડિનારે ઉંધો સૂઈ, એણે પાણી પીવા માંડ્યું, આખી ગંગા ખાલી કરી નાખી ! તમને આ સાંભળવા પર હસું આવે છે, કેમ ? એ હસવા પૂર્વે પોતાની અનંત તૃષ્ણા કેવી છે, અને શક્ય હોય તો જગત ભરનું ભેગું કરી લેવાની દાનત કેવી વિકરાળ છે તે વિચારી લેજો. અનંતા કાળમાં કેટલું ભેગું નથી કર્યું ? કેટલું અપાર ભોગવ્યું નથી ? વિચારીને પછી પેલાને મૂર્ખો કહેશો, તો જાતને શું કહેશો ? ગધેડો ?

પેલાએ તો પછી કામ ચાલુ જ રાખ્યું. આખી દુનિયામાં ફરી વળ્યો ! નદીઓ, કૂવા, સરોવર,... જે આવ્યા તે પી પીને ખાલી કરી નાખ્યા, ઇતાં હજ મનને છે કે જે આવે તે પી જાઉં ! તૃષ્ણા મટી નહિ !

આ જીવનું જો ચાલતું હોય તો તૃષ્ણાના બધા દરવાજા ખુલ્લા છે, એટલે દુનિયાના કોઈ ખૂણામાં ધન રહેવા દે નહિ. આ તો શું કરે ? મિયા મસાલા વિના રથા છે ! પુષ્ય એટલું પહોંચતું નથી.

તૃષ્ણાની આગ કેટલી સળગી છે ? અજિને પૂછો ‘તને કેટલાં લાકડાં ખપે ? કેટલાં મણ્યા પછી તું શાંત થાય ?’ અજિને જો, વાચા હોત તો શું કહેત ? લાવને, દુનિયાભરના ખપે છે. શાંત થવાની વાત શી ? શાનીઓ કહે છે, તૃષ્ણાની પણ આ ખાસિયત છે. માટે તો સંસ્કૃતિ એ ચાલી આવતી, કે સુખી થવું હોય તો તૃષ્ણા ઓછી કરો. પેલાએ આખી દુનિયાના પાણી પીધાં ! ઇતાં તૃષ્ણા મટી નહીં. હજ ય ફાંકા મારે છે. પણ હવે તો ક્યાંય પાણી દેખાતું નથી. એવામાં ત્યાં એક ખાખોચીયું દેખ્યું. તેમાં પાણી નથી, રગડો કાદવ છે. એમાં પોતાનું કપું કાઢી કાદવ પર પાથરી દીધું. કપું ભીજાયું. એનો લોચો લઈ ઊચો પકડી મોંમાં નીચોવે છે. એનું ટીપુ મોઢામાં પડે છે ને માને છે, ‘હાઆ...શ’ (હાશ.)

ત્રણભટેવ ભગવાન અહ્યાણને પૂછે છે, ‘કહો ભાઈ ! હવે એની તૃષ્ણા મટી જવાની ને ?’

‘અરે પિતાજી, વિશ્વભરના નદી-કૂવા-સરોવરો પી નાખ્યા, ને તૃષ્ણા ન મટી, તો એ કાદવીઓ પાણીના ટીપાથી મટે ? ન મટે’-

‘તો પછી હે પુત્રો ! આપણો જીવ નવ ગ્રેવેયક સુધી સ્વર્ગમાં જઈ જઈ અનંતીવાર વૈભવ-વિલાસ ભોગવી આવ્યો ! રન્નોના વિમાન, બગીચા-વાવડી, મણિ-માણેકના અલંકાર, સુકોમળ રૂપસુંદરી દેવાંગનાઓ...બધું દેવતાઈ અનંતીવાર મેળવ્યું-ભોગવ્યું ! (શ્રી પંચસૂત્ર ટીકામાં શ્રીહરિબદ્રસૂરીશરજી મહારાજ કહે છે, ‘ગ્રેવેયકેષુ અનન્તશઃ ઉપપાત શ્રવણાત् ।’ આ જીવનો અનંતીવાર ઠેઠ નવગ્રેવેયક સ્વર્ગમાં જન્મ થઈ ગયો, - એવું શાસ્ત્રમાંથી સાંભળવા મળે છે.) તો પણ એનાથી પણ જો જીવની તૃષ્ણા ન મટી, તો હવે અહીં કાદવીઆ જલના એક બિંદુ સમાન મળ-મૂન્ગાદ્દિના ગાડવા સમી માનવી પૂતળી, પૃથ્વીનો એક નાનો ટૂકડો, અને તુચ્છ સંપત્તિ જે મળી તેના તુચ્છ ભોગોથી શું જીવની તૃષ્ણા મટશે ? જો નહિ મટે તો શું એને પાછી વધારવાનું કરવાનું ? કે તૃષ્ણા મિટાવવાના સાચા ઈલાજ કરી લેવાના ?

પ્ર.- અહીંના ભોગ તુચ્છ કેવી રીતે ?

ઉ.- અહીં ખંડવાના ઘઉં પણ કેવી રીતે પાકે છે ? માંહી પડે વિષાદિ ખાતર ને ? ખાતર એટલે મેલું કે ઉજુંનું ? મેલું જ ને ? એના પુદ્ગલમાંથી તૈયાર થયું તે તુચ્છ કે ઉમદા ? બરફી-પેંડા-ગુલાબજાંબુ... એ જે દૂધમાંથી બન્યા તે દૂધમાં કેવા પુદ્ગલો આવેલા ? ગાય-ભેસના મોંની લાળથી મિશ્રિત ઘાસના પુદ્ગલ ને ? એ તુચ્છ કે ઉમદા ?

માણસ પોતાના ઉપરથી સુંદર દેખાતા શરીર પર શું મોહતો હશે ? માણસનું શરીર એટલે, બે પગ રૂપી થાંભલા, પછી ઉપર પાયખાનું, ને પેશાબખાનું એના ઉપર હોજરી રૂપી રસોંનું ! ને એના પર બધી શક્તિ પૂરી પાડનાર રુધિરવાહક હૃદય ! પછી જરૂરા - પાંચ ઈન્દ્રિયોના એવા કે એમાંથી ગંદવાડ વધ્યા જ કરતો હોય ! આ બધું શું બતાવે છે ? જેમ પેલાને ગંગાના પાણી આગળ કાદવીયું ખાબોચીયું, તેમ અહીં દેવલોકની અપેક્ષાએ આ માનવ જીવનના તુચ્છ ભોગો છે.

ભગવાન કહે છે, ‘રંકડાઓ, આના પર તમને રાગ ? એની તૃષ્ણા ? જે તૃષ્ણા અનંતવારના દિવ્ય ભોગોથી ય મોળી પડી નથી તે તૃષ્ણા અહીં મળેલાથી શરીરી જશે એમ માનો છો ?’ અહાંણું ભાઈઓ આ સાંભળી કંપી ઉઠ્યા ને થયું કેટલા રંકડા અમે ? કયાં ફાંઝા મારીએ છીએ, ચા આવી, ખાંડ જરા ઓછી છે ?... ‘પી જા હવે ?’ ‘ના, થોડી ખાંડ જોઈએ છે,’ મૂર્ખ ! જે તૃષ્ણા લાખો ટન સાકર ખાઈ નાખવાથી ય નથી શરીરી તે જરા સાકરથી શરીરી જશે ?’

લડવાનું પૂછવા આવેલા સંસારત્યાગ કરે છે :-

અહાંણુંને થયું : ‘અહો ભરતે આ સમજવાનો ઠીક મોકો આય્યો.’ ત્યાં ને ત્યાં અહાંણુંએ કપડાં ઉતારી નાખ્યા. પ્રભુને કહે છે, ‘હવે અમારે કર્દ સંપત્તિ કે

રાજ્ય ન જોઈએ. અમારે તો આપનું શરણ જોઈએ.’ શું સમજ્યા એ ? ખાવાની તૃષ્ણા ખાવાથી ન મટે. ‘ખાઈએ તો ભૂખ મટે,’ -એમ અજ્ઞાન લોકો બોલે. આપના લોકોતર શાસનવાળા તો એમ કહે કે ‘તપ કરવાથી આહારની તૃષ્ણા મટે.’ ઉનાળામાં જેમ જેમ સરબત પીવાનું મન થાય અને પીવાયે જાય તેમ તેમ તરસ વધે છે. એવી રીતે ખાનપાનાદિ ભોગથી તૃષ્ણા ઓર વધે છે. એમને સમજાઈ ગયું કે આ તૃષ્ણામાં તો મુખ્ય પડ્યા છીએ, હવે જો તૃષ્ણાની ગુલામી રાખીએ તો ખલાસ થઈ જવાના. એ તો બેસી ગયા પ્રભુ પાસે ચારિત્ર લઈ લીધું.

ભરતે દૂતો મોકલેલા. પણ આ તો પોલીટીકલ મેટર એટલે તે અહીં જોવા આવ્યા છે, પણ પોલીટીકલ શું જુએ ? પોલીટીકલ સવાલ એટલે ? માનવ જેવા માનવને ખુલાર કરવાની વાર્તા આવે ! અહીં તો એ બધા જોઈ જ રવા-કદાચ આજે ય એ રાજનૈતિક છણ સમજ્યા હોય. જઈને ભરતને કહી દીધું ત્યારે ભરત વિચારે છે કે ભાઈઓ રીસાઈને ત્યાં બેસી ગયા હશે. તે પસ્તાયો, આવીને અહાંણું- ને હાથ જોડીને કહે છે,

“મારા પર કૃપા કરો, મારે તમારા પર સત્તા નથી જમાવવી. ખુશીથી ઘેર પાછા પધારો અને સ્વેચ્છાએ રાજ્યપાટ ભોગવો. મારાથી રીસાશો નહિ”-

પણ પેલા બોલતા જ નથી. એટલે આ વધુ વિનવે છે.

પ્રભુએ ખુલાસો કર્યો : ‘તારી રીસથી નહિ, પણ સંસારથી વિરક્ત પામીને આ મહાનુભાવોએ તો ખરેખર ચારિત્ર જીવન સ્વીકાર્યું છે. ક્ષમાશ્રમણ બન્યા છે. તું ખોટી કલ્પના ન કર.’

ત્યારે વિરક્ત અજૂનને લડાઈ માટે ટારાર કરનાર શ્રીકૃષ્ણની પ્રેરણા જુઓ, ને ઋખબદેવ પ્રભુએ કષાયમાં સળગીને આવેલા અહાંણું પુત્રોને શાંત કરી દીધા એ જુઓ, એ સંસાર-ત્યાગી સાધુ બની ગયા, લોહી રેડાતું અટક્યું. ભરત પોતાની હુકુમત જમાવવાની ભૂલ પર પશ્યાત્તાપવાળો બન્યો; ને ક્ષમા પ્રાર્થવા સાથે અહાંણુંની પ્રશંસા કરે છે : ‘અહો સંસારના ઉદ્ઘેણી, ભવના વિરાગથી આ બંધુઓ સમસ્ત અંતરંગ બંધનો તોડી બેસી ગયા છે ! આમણે નિજના કાર્ય સંભાળ્યા છે ! ધન્ય જીવન ! ધન્ય અવતાર ! ઉત્તમ છે તે આત્માઓ કે જે વિષયોની તૃષ્ણા અને કષાયોને સંસારનું બીજ સમજી મોક્ષના પંથે ચઢી જાય છે. એને ન સમજનારા અધમ છે, પણ હું તો તે જાણવા છિતાં એને નથી છોડતો, તે અધમાધમ હું.’ કહો જો, શું લડાઈથી ભવ્ય જીવોના હૃદય પલટા થાય ? ને સાચી સંસ્કૃતિના સંવેગ-વિરાગ ભર્યા માર્ગ વિચરાય ? ભાઈઓ મહાસંત બન્યા ! ભરતે ક્ષમાપના માગી ! ભાઈઓની પ્રશંસા કરી. આ વીતરાગ પરમાત્માની જગતને ભેટ !

વિકસતા જડવાદમાં તૃષ્ણા પર સંયમ મૂકો, તો સુખી થશો. તો સંસ્કૃતિના રક્ષણ કરી શકાશે.

૪૦

## ગૃહસ્થધર્મ કેમ દીપે ?

ચક્રવર્તી મોક્ષ સાથે, રંક નરકે જ્ઞાય, એમ શાથી ? :-

પરમ ઉપકારી શાસ્ત્રકાર મહર્ષિ ભવ્ય જીવોના ઉપકારને માટે જીવનમાં અનુભવેલો આત્મશુદ્ધિનો માર્ગ પ્રકાશમાં મૂકે છે. એમાં એજ વાત આવવાની કે અનંતકાળથી આત્મા કર્મના મેલવાનો છે, તે મેલ દૂર કરી શુદ્ધ કેમ પ્રાપ્ત કરે. એટલા માટે પરમ ઉપકારી શાસ્ત્રકાર મહર્ષિનું આ શાસ્ત્ર હાથમાં લેનારે, લેતાં પહેલાં સમજ જ લેવાનું કે એમાં વાત આત્મશુદ્ધિની જ આવવાની. મલિનતાની વાત મળે તેમ છે કે નહિ, એમ ધારી શબ્દના અર્થ મરીને, મચીને કોઈ પ્રયત્ન કરે તો ફંઝા છે. આત્મશુદ્ધિની અને આત્મશુદ્ધિના ઉપાયો વિના બીજી વાત આમાં મળવાની નથી. કર્મથી મલિન તો ખરો, પણ અઠાર પાપ સ્થાનકથી ય આ આત્મા મલિન છે, અનંત કાળથી મલિન છે. એ ખૂબ ધ્યાનમાં રાખો. એટલે પ્રત્યેક પાપસ્થાનક ઊંઘું થતાં મલિનતાનો જ ખ્યાલ આવે, ને આત્મા ભડકતો રહે. પાપ બંધાવે તે પાપસ્થાનક. એના એ પાપસ્થાનક જ સેવાતા રહે તો કર્મનો મેલ દૂર ન થાય. એ મેલ ધર્મથી અથવા ધર્મસ્થાનકના સેવનથી દૂર થાય. ધર્મને જગાવે તે ધર્મસ્થાનક. અઠાર પાપસ્થાનકની સામે ધર્મસ્થાનકો વિચારી લેજો.

પાપસ્થાનકની ગુલામી :-

આવે છે ધર્મસ્થાનકનાં નામ ? ના, અઠાર પાપસ્થાનકનાં નામ કહો તો, કડકડાટ કહી આપીએ. કેમ એમ ? કહોને જીવન જ પાપસ્થાનકભર્યું છે માટે. ના, પાપસ્થાનકનાં નામ સારા જૈન કુળમાં જન્મ્યા એટલે ગોખાઈ ગયાં છે, ને વારતેહેવારે પ્રતિકમણમાં બોલવા-સાંભળવા મળે છે માટે એ બરાબર યાદ છે. છતાં એટલું ય સારું છે. એથી ય આ પાપસ્થાનક છે એવો ખ્યાલ આવે છે પણ એ ખ્યાલ ક્યારે ? પ્રતિકમણ કરો ત્યારે જ ને ? એના બદલે પાપસ્થાનક સેવાય ત્યારે પણ જો ખ્યાલ આવતો હોય કે- ‘હું જે આ પાપસ્થાનક સેવી રહ્યો છું એ મારા આત્માનો મેલ છે, અશુદ્ધ અવર્થા છે, આત્મા એથી ખરાબ-ખસ્ત થઈ રહ્યો છે,’ તો પછી જાગ્રત્ત કેવી રહે ? પાપસ્થાનક સેવવામાં હોંશ રહે કે ઉદ્દેગ ?

આરંભસમારંભના કાર્ય કર્યા એટલે કુમમાં કમ અસંખ્ય સ્થાવર જીવની હિંસાનું પાપસ્થાનક સેવાયું; એ વખતે બાહોશી કે બેહોશી ? થોડું પણ અસત્ય, અનીતિ આચરી એ પાપસ્થાનક, મેલ; એમાં બહાદુરી મનાય કે બાયલાપણું ? આત્માનું નિરીક્ષણ કરવાનું છે, ઉંચા ભવમાં ય કેવી ખરાબી સેવાઈ રહી છે એનું હદ્યવેધી દર્શન જગાવવાનું છે. પરરૂપ જોવાનો દાખિદોષ, પરિગ્રહ, કોધાદિ કષાયો, રાગ, દ્વેષ... વગેરે બધાં પાપસ્થાનક છે.

આંતર ખેદ :-

જીવને એમ આંતર ખેદ થાય કે ‘અહો ! આ તે મારું કેવું જીવન ! ગમે ત્યારે ને ગમે ત્યારે એક નહિ તો બીજું પાપસ્થાનક ચાલુ જ હોય છે ! શું આવો ઉચ્ચ ભવ, ઉંચા તત્ત્વસમજ મળવા છતાં, આમ જ પાપસ્થાનકની ગાઢ દોસ્તીમાં ને ગુલામીમાં જ પૂરો થવાનો ? એનાં સેવન વિના એક ઘડી ખાલી નહિ ? પાપસ્થાનક મિટાવી ધર્મસ્થાનક સેવવાની બહાદુરી કેળવવા માટે જ્યારે ભગવાન શ્રી જિનેશ્વરદેવનું અણમોલું શાસન મળ્યું છે, ત્યારે હું કંગળ પાપસ્થાનક સેવ્યે જીવાની કાયરતા કરી રહ્યો છું ? ના, અહીં તો મારે કોષ કરવો જ જોઈએ, અભિમાન બતાવવું જ જોઈએ, એ બધી ઘેલણામાં શી બહાદુરી છે ? ક્ષમાનમ્રતાદિ નથી જાળવી શકતો એ બાયલાપણું છે...’ આમ જાગ્રત્ત રહ્યા કરે તો તો પછી કેટલાંય પાપસ્થાનકને પાછાં વળાવાય, પાપસ્થાનક ન છૂટકે સેવાય, અને સેવાય તેમાં પણ કેટકેટલો કાપ મૂકાય, અને સેવાતાં પર મનને ભારે ખેદ અને ભય રહે.

ધર્મ-સ્થાનકનાં નામ :-

પાપસ્થાનકથી બચવા માટે સામે ધર્મસ્થાનકો છે, એનાં નામ ગણો. પહેલે પ્રાણાત્મિકાત એટલે કે હિંસાની સામે જીતે અહિંસા, અર્થાત્ જીવ ન મારવો તે; તથા બીજે જીવ મરતાં હોય તેની રક્ષા, દયા-હિંસાની સામે આ અહિંસા અને દયા એ ધર્મસ્થાનક થયું. જૂઠની સામે સત્ય, મૌન અને શાસ્ત્ર-સ્વાધ્યાય, પરમાત્મસોત્ર પાઠ વગેરે. ધ્યાનમાં રાખજો કે ધર્મસ્થાનક એવાં ઊભાં કરવાનાં છે કે જે આપણને પાપસ્થાનકથી બચાવે. તો જૂથી બચવું હોય તો કેટલીક વાર સત્યથી બચાય, ને કેટલીકવાર મૌન તથા અલ્યુભાષણથી બચાય; તેમ શાસ્ત્રસ્વાધ્યાય ને પ્રભુનાં સોતોપાઠ કરતાં રહીએ તો ગપાયા સપાટાથી બચવામાં જૂથી બચાય. અદ્યાતાદાનની સામે ન્યાયનીતિ-પ્રામાણિકતાનું પાલન, અને અધિક ખર્ય, જૂગાર વગેરેનો ત્યાગ. આગળ ટુંકમાં ગણો. મૈથ્યુનની સામે બ્રહ્મયર્થ અને સદાચાર. પરિગ્રહની સામે એની મર્યાદા અને પ્રભુભક્તિ વગેરે તથા દાન, કોષ-માન-માયા-લોભની સામે ક્ષમા-

નમૃતા-મુહુર્તા-સરળતા-નિસ્પૃહતા. રાગની સામે વૈરાગ્ય; દેખની સામે શાંતિ-સમતા; કલહની સામે સંપ, સહાનુભૂતિ અને મૈત્રીભાવ. અભ્યાષ્યાન એટલે કે આપ ચઢાવવાની સામે વિચારપૂર્વકની વાણી, આત્મલઘુતા, અને મૈત્રી કરુણાભાવ. પૈશુન્ય એટલે કે ચાડીયુગલીની સામે ગંભીરતા. રતિ અરતિ અર્થાત્ હર્ષ-ઉદ્ઘેગની સામે ઉદાસીનતા. ‘શુભાશુભ કર્મ એની મરજી મુજબ ફાવે ત્યારે સારું-નરસું કરે છે એમાં હું શું કામ લેવાઈ જાઓ, હું તો તટસ્થ રહી જોયા કરું’ એ ભાવનાપૂર્વકની તટસ્થતા, એનું નામ ઉદાસીનતા, અથવા હર્ષ-ઉદ્ઘેગ થવા જાય છે તો પ્રભુનું સ્મરણ એ ધર્મસ્થાનક. અર્થાત્ પૂર્વે પ્રભુને ભજ્યા છે તો સારું મળે છે, ને પ્રભુને ભજવામાં ખામી રાખી છે તો નરસું મળે છે, એ ચિંતન. પરપરિવાદ એટલે કે નિંદા નામના પાપસ્થાનકની સામે હદ્યમાં અસ્ખલિત વહેતો ગુણાનુરાગ, અને વાણીમાં અખંડ વહેતો ગુણાનુવાદ. માયામૃદ્ધાવાદની સામે સ્વદોષપ્રકાશન, અને સ્વકીય ગુણગોપન. મિથ્યાત્વશાલ્યની સામે સમ્યગ્દર્શન અને એનો હજ પ્રકારનો વ્યવહાર.

આ તો ટૂંકમાં નામ ગણ્યા. બાકી તો બીજા કેટલાં ય ધર્મસ્થાનક આમાં તે તે સ્થળે ગોઠવી શકાય. માનવભવ જેવો ઉચ્ચ ભવ સુવર્ણસમા આત્માનો પાપસ્થાનકનો મેલ દૂર કરવા માટે છે; ને તે ધર્મસ્થાનકના તેજાબથી હટાવી શકાય. પાપસ્થાનકના સેવનમાં તો તો હોંશ-હોશિયારી નહિ પણ નિરાશા-નિસાસા થવા જોઈએ. રોજ વિચારાય કે શું હજ મારે પાપસ્થાનક વિનાનું જીવન બનાવવું શક્ય નથી? અને જો એમ લાગે કે સરવાશે એ મેલ હાલ નીકળે એમ નથી તો શક્ય મેલ કાઢવા માટે, ગૃહસ્થધર્મના બાગ્રતભર્યુ ધર્મજીવન સ્વીકારાય. મેલ સરવાશે કાઢવાની તૈયારી ન હોય, અર્થાત્ સર્વવિરતિની તૈયારી ન હોય, તેવાઓ માટે જ્ઞાનીએ દેશવિરતિનો ધર્મ બતાવ્યો. અદારે ય પાપસ્થાનકના ત્યાગને એક સામટો નહિ તો ધીમે ધીમે થોડા થોડા ત્યાગ માટે જ્ઞાનીએ દેશવિરતિ બતાવી. જેથી ધીમે ધીમે પણ મેલ ઓછો થાય, ને આત્મા શુદ્ધિ પ્રાપ્ત કરતો જાય. એટલા માટે જ પરિગ્રહનું પરિમાણ રખાવ્યું, પર્વતિથિ આદિના બ્રહ્મચર્ય યોજ્યા, જૂઠ અને ચોરી સ્થૂલથી ત્યજાવી, ત્રસની હિંસાથી વિરમવાનો નિયમ રખાવ્યો.

પ્રત વિનાની જે પાપની છૂટ રાખી છે, એ પણ શુદ્ધિ છે, અગર શુદ્ધિમાં ઉપયોગી છે એવું માનવાની ભૂલ ન કરતા. એ માન્યતા હોય તો નીકળી જાય એ અતિ આવશ્યક છે. ખૂબી છે આ સમજવાની. એમાં ગફકલ થાય તો પ્રત લેવા છીતાં મિથ્યાત્વ ગુણસ્થાનકે રહેવાનું થાય, ને આત્મા લેપાયા કરે.

છૂટને શુદ્ધિ નહિ માનવાનું સમજવામાં આવ્યું? જુઓ, હાલતા-ચાલતા

જીવની હિંસા ન કરવી એ નક્કી કર્યું, હવે સ્થાવર જીવોની હિંસા છોડાય એમ નથી એટલે એ ઊભી રહી, તો શું એને શુદ્ધિ ગણવી? લાખ રૂપિયા ઉપર પરિગ્રહ ન રાખવો એમ મર્યાદા બાંધી, તો લાખ રૂપિયાની છૂટ રહી એને શું શુદ્ધિ કહેવાય. પણ જો લોચા વાળો કે- ‘ધર લઈ બેઠા એટલે એટલું તો કરવું પડે ને?’ એમાં ગેરવ્યાજબી શું? તો વિચારો કે મનની અંદરખાને આટલા પણ પાપસ્થાનક માટે અશુદ્ધિ, મેલ હોવાનું તરવર્યા કરે છે ખરું? તરવરે તો એમ થાય કે- ‘આ ય મારા આત્માનો કચરો છે, અને લાચાર છું કે મૂળમાં જ એવું પાપધર કરી બેઠો છું કે આટલો ય કચરો સેવવો પડે છે! પાયાનો ગુનો હોવાનું યાદ નથી આવતું તેથી એની ઉપર સેવાનાં પાપસ્થાનક માટે ‘એ તો કરવું જ જોઈએ ને?’ એવું વિચાર અને વાણીમાં આવે છે. એ શાના જેવું છે? હિસાબ ગણતાં પ્રારંભમાં સતર પંચા પંચાશું માંડ્યા પછી આગળ ગમે તેટલું સાચું ગણિત કરે, અને જવાબ સાચો ન આવે, છતાં પાછળના ગણિત પર મદાર બાંધી કહે- ‘જુઓને ભાઈસાહેબ! ૮૫ + ૧૫ એટલે ૧૧૦ આવે જ ને?’ એના જેવું છે. આ પણ આંશિક દસ્તાન્તમાં તો મૂળ ૧૭ x ૫ = ૮૫ ખોટું, છતાં ૮૫ + ૧૫ એટલે ૧૧૦ સાચો છે, જ્યારે અહીં તો મૂળ સંસાર રાખ્યો એ ય ખોટો છે, અને પછી સ્થાવર જીવોની હિંસા, ધનનો પરિગ્રહ, વિષયસેવન વગેરે ય પાપસ્થાનક જ છે, મેલ જ છે. આ વિવેક કેન્દ્રદર્શન આપે છે. સંસાર ચલાવો છો, આરંભ-સમારંભ, પરિગ્રહ વગેરે સેવો છો, પણ એ સેવતાં એટલું નિશ્ચિત સમજતાં ચાલો કે- ‘આ બધા પાપસ્થાનક સેવી રહ્યો છું અને એ આત્માને મલિન કરી રહ્યા છે.’ જો આ જાગ્રત્ત રહે તો પછી એમાંથી શક્ય એટલું બચવાનું દિલ રહેશે, કાળજી અને પ્રયત્ન રહેશે; તેમ એની પાછળ મફતિયા દુર્ગુણો સેવવાનું અને તેથી માર્ગનુસારીના ગુણ ગુમાવવાનું નહિ બને, અને એક દિવસ સર્વથા પાપસ્થાનક રહિત જીવન લેવાની તમના રહેશે.

વાત આ છે કે પહેલાં દસ્તિ ચોક્ખી થવી જોઈએ. શુદ્ધિને શુદ્ધિ અને મેલને મેલ તરીકે દેખ્યો જોઈએ; એટલું જ નહિ પણ મેલભર્યા જીવન પ્રત્યે ઉદ્ઘેગ અને અકળામણ રહ્યા કરવી જોઈએ, પછી ભલેને ધનના દેર અને પરિવારની વિશાલતા હોય. દસ્તિની નિર્મણતા સાચવતાં અને વિકસાવતાં આવડે તો છ બંડ, ચૌદ રત્ન અને નવ નિધાનનો માલિક ચક્કવર્તી પણ સંસારથી છૂટી જાય! પણ શુદ્ધિ ભૂલેલો ચાપ્યાનીઆવાળો નરકે જાય. રંક સાતમીએ ગમેલ છે કેમકે ચાપ્યાનીઆવે ય મેલ માનતાં ન આવડ્યો, જ્યારે છ બંડની રિદ્ધિસિદ્ધિને મેલ માન્યો તે ચક્કવર્તીએ મોક્ષ સાધ્યો છે.

## ભોગના ધરમાં મહાત્માગ :-

ઇ ખંડના પરિગ્રહમાં રહ્યા રહ્યા ચક્રવર્તી કેવળજ્ઞાન સુધી પહોંચે, એ ક્યારે બને ? અઠળક રત્નો પગે અથડાય, સેવામાં યક્ષ-દેવતાઓ હરેક પળે હાજર હોય, તેવા વૈભવનેય એ મેલ સમજે છે ત્યારે. આરિસાભવનમાં કેવળજ્ઞાન ! આરિસાભવન એ ત્યાગ-ભવન કે ભોગનું ભવન ? એ ભોગની ભાવના જગાએ કે ત્યાગની ? ચારે તરફ આરિસા જ આરિસા ! શાણગાર સજીને, બણી છણીને ત્યાં આવેલ હોય, છારો કરીને આવેલ હોય, ને આગળથી પાછળથી જ્યાંથી જુએ ત્યાં શું દેખાય ? પણ આ શાસન પ્રાપ્તિનું એ અહોભાગ્ય છે કે એ ય તુચ્છ માન્યું, ત્યાં આરિસાભવનમાં ત્યાગભાવના એવી ઊંચી કોટિની કેળવી કે ક્ષપકશ્રેણી પર આડું થઈ કેવળજ્ઞાન મેળવ્યું. આ ક્યારે બન્યું ? ઇ ખંડના ભોગમાં નિરંતર મહિનતા માનતા હતા ત્યારે ! હૈયામાં સતતું ઉદ્ઘેગ અને ભડક રહેતી હતી તો ! એ દઢ માન્યતા હતી કે- ‘પરિગ્રહનો મેલ આત્માને મહિન કરનાર છે, પરિગ્રહનું જેટલું પ્રમાણ વધારે તેટલો મેલ વધારે.’ પરિગ્રહ તરફ દણ્ઠ હોય, આસક્તિ હોય તો. આરિસાભવનમાં કેવળજ્ઞાન ન થાય, કેવળજ્ઞાન તો અનાસક્તિથી થયું છે, પણ એ અનાસક્તિ વસ્તુતઃ હતી. ‘પરિગ્રહ હોય તો શો વાંધો ? માત્ર એના પર આસક્તિ ન જોઈએ, આસવા તે પરિસવા,’ એમ કોરા પાઠથી કામ ન થાય.

## પાપ-સ્થાનક પાપની પ્રભાવના કરે, ધર્મની નહિ :-

આરંભ-સમારંભ, વિષયસેવન, અને પરિગ્રહ તો પાપસ્થાનક જ. એજ ભરતચ્કી ઇ ખંડ જીતીને આવ્યા પછી શું શું બન્યું છે એ વિચારી જુઓ. માત્ર એક બાહુબલી આજ્ઞાધારી બનવામાં બાકી રહ્યા હતા, અહ્ંકારું ભાઈએ તો દીક્ષા લીધી છે, ત્યાંય આજ્ઞા મનાવવાનો પ્રયત્ન કર્યો માત્ર બાહુબલી એક બાકી ત્યાંય ઊંચા-નીચા થઈ ગયા ! ઇ ઇ ખંડના વિજયથી સંતોષ પામ્યા ? યક્રતન શાળામાં પેસતું નથી.

ભરત ચકી પૂછે છે સેનાપતિને, ‘યક્રતન શાળામાં કેમ પેસતું નથી ?’

સેનાપતિ કહે છે : ‘શી રીતે પેસે ? તમે માનો છો ચક્રવર્તીપણું આવી ગયું, બધા જિતાઈ ગયા, પણ હજુ એક બાકી છે. નાનો ભાઈ ધમંડમાં બેઠો છે. એને સામે મળવા આવવાની કુરસદ નથી ! રાજ મહારાજાઓ દિવિજ્યના અભિનંદનમાં આવી ગયા પણ એ આવે છે ? એને તો એમ છે, ભરત મારે કોણ ?’

પાણી ચડાવે છે.

ભરત કહે છે : ‘એમ ? ત્યારે શું થાય ?’

‘શું થાય ? કહેણ મોકલવું જોઈએ, આજ્ઞામાં આવી જા !’

આ બધું શું અનાસક્તિ ભાવનું છે ? પરિગ્રહ એ પાપનું સ્થાનક, એ તે પાપની પ્રભાવના કરે કે ધર્મની ? પાપની કરે, ધર્મની નહિ. તમને ધરમાં પેસતાં શેના ભણકારા થાય છે ? ‘આ પાપ છે, તે પાપ છે’ એવા ? ત્યારે ? અહીંથી સાંભળીને જાઓ છતાં ત્યાં કયો અવાજ ? શેનું સ્થાનક ? ત્યાં અવાજ સુખના જ સંભળાય છે. ‘આમાં સુખ, તેમાં સુખ,’ મહારાજ તો કહે કે, ‘ચારિત્ર લઈ લ્યો,’ પણ તો પછી ગાઢી પાથરી બેસવાનું સુખ મળે ?’ આવું આવું થાય ને ? કહો જો, હદ્યથી ‘ધરમાં ને ધરના પદાર્થોમાં સુખ,’ એમ મનાયા કરે, એમાં કોઈ ભય ન રહે તો સમકિત રહે ?

## ઇ ઇ ખંડ ઓછા પડ્યા ? :-

ભરત ચકી તદ્દ્બવ મુક્તિગામી છે, આરિસા ભવનમાં કેવળજ્ઞાન મેળવનારા છે તેમને ભાઈની સાથે લડવાનો મોખ નથી. કહી દે છે ભલે ચક્રતન અંદર ન આવે, આપણે ભાઈ સામે યુદ્ધ નથી કરવું.

સેનાપતિ ચબરાક છે. કહે છે- ‘યુદ્ધ ક્યાં કરવું છે ? આ તો વ્યવહારું મયર્દાની વાત છે કે મોટાભાઈ આવો જંગી વિજય મેળવીને આવે, ત્યારે નાનાભાઈએ તો અભિનંદનાર્થે બીજાઓ કરતાં પહેલાં આવવું જોઈએ; કદાચ એ વ્યવહાર ભૂલે તો એને શિખામણ દેવી જોઈએ. તેમ કરવા છતાં ય જો એ ન માને અને અભિમાનમાં તણાય તો સામ-દામ-દંડ-ભેદથી એમને ઢેકાણે લાવવા જોઈએ એ રાજનીતિ છે. આપ વડીલ ભાઈ, પિતા જેવા; એમણે એમને ગમે તે રીતે રાહ પર લાવવા જોઈએ...’

સેનાપતિએ બરાબર ચડાવ્યા. હવે ભરત અટક્યા ? ના, બાહુબલી પાસે સુવેગ નામના દૂતને મોકલ્યો. દૂત એટલે ? મહાકુશલ, ખેલાડી, આજની ભાષામાં કહીએ તો, પોલિટીકલ મુત્સદી.

## બાહુબલીનું ભલ ઉપરાંત આદેયનામ કર્મ કેવું ! :-

દૂત ત્યાં પહોંચે તે પહેલાં રસ્તામાં તેને શો અનુભવ થયો ? એના રાજ્યની સરહદ આખીમાં લોડોને કલ્યોલ કરતા જોયા, આનંદ આનંદ કરતા જોયા, બધાના મૌંથી બાહુબલીની પ્રશંસાના એક સરખા શંદો કાને પડ્યા. આ જોઈને એનું પાણી અરધું તો શોખાઈ ગયું હતું. તે પહોંચ્યો બાહુબલીની રાજ્યાનીમાં, પહોંચ્યો કચેરીમાં. દૂતની ખૂબી એ કે સામા માણસની તથા સ્થાનની યોગ્યતા મુજબ શંદ્દ બોલે. આ તો ભરતનો દૂત એટલે પૂછવું શું ? એ શું બોલે છે, કેવી રીતે બોલે છે તે જોઈએ. રસ્તાના અનુભવથી અરધો તો નરમ થઈ ગયો અને કચેરીમાં પેઠો ત્યાં તેણે શું જોયું ? સ્વર્ગની અમરાપુરી કે અસુરની અલકાપુરી જાણે મૃત્યુલોકમાં ઉતરી આવી

એવી ભવ્ય શોભા ! કચેરીમાં આવી બાહુબલીને પ્રશ્નામ કરીને ઉભો રહ્યો. બાહુબલીનું પુષ્ય કેવું ! બલ તો મળ્યું હતું પણ એની હાક કેવી ! આદેયનામકર્મ એવું જોરદાર કે આખી સભા વફાદારીથી (પરાણે એમ નહિ) પડતો બોલ ઉપાડી લેવા તૈયાર ! અંજાઈને એમ નહિ પણ આકર્ષાઈને ! કેવો દેખાવ ! દૂત પણ ધૂજે !

**બાહુબલીએ પૂછેલું ભાઈનું કુશલ વગેરે :-**

બાહુબલીને શી ખબર કે કોણ છે ને કેમ આવ્યો છે, એટલે પૂછ્યું, ‘કોણ ?’ ચાલ્યું હવે. હું ભરતજીનો દૂત.’ ‘એમ ?’ ભરતનું નામ, મોટાભાઈનું નામ સાંભળી બાહુબલી ખુશી થયા, પૂછવા માંગ્યું, ‘મોટાભાઈ કુશલ છે ? ખુશી મજામાં છે ? સાંભળ્યું છે, દિવિજ્ય કરી આવ્યા, સારી રીતે દિવિજ્ય થયો ને ? તમામ રાજાઓ વ્યવસ્થાસર વશ થઈ ગયા ? પ્રજા ખુશી આનંદમાં છે ને ?’ દૂત જોયું ‘આટલો બધો આમને ભરતજી પર પ્રેમ છે, વિનય છે. હવે અહીં ‘તમને ભરતજીએ આજ્ઞામાં આવી જવાનું કહેવરાયું છે.’ એમ એકદમ કેમ કહેવાય ? પણ દૂત છે ને ? હોશિયાર છે, ધીરે ધીરે પગલું માંડે છે.

દૂત કહે છે,- જરા હસ્તીને, ‘હું હું હું - બહુ સારું પૂછ્યું. ‘જેની મહેરબાનીથી સમસ્ત વિશ્વમાં ધરે ધર કુશલ છે, તેના કુશલનું શું પૂછ્યું ?’ પહેલો પ્રશ્ન બાહુબલીનો ભાઈના કુશલ અંગે હતો ને ? કહે છે ‘ધર ધર કુશલ જેના યોગે તેની જાતના કુશલમાં પ્રશ્ન શો ? જેના પ્રતાપે જગત સુખી, તેની જાતના સુખમાં પૂછવાનું શું !’ દૂત ચતુર છે ! પોતાના સ્વામીનો પ્રતાપ પહેલેથી ગાવા લાગે છે. સ્વાર્થ છે સ્વામીનું ઓજસ પાડવાનો.

**મદાંધતા કોઈનું લીલું ન વાળે :-**

સ્વાર્થ શું કરાવે ? આ કરાવે. પોતાના માલિકનું ગૌરવ ગાવું છે, બાહુબલી કરતાં ભરત ઊચો એમ જ્ઞાવાવું-દસાવાવું છે. એને ખબર નથી કે એનું એવું કથન સાંભળ્યા પછી બાહુબલી ભરત માટે એવો શબ્દ સંભળાવશેને કે આખી સભામાં પોતે તો જાંખો પડશે પણ પોતાના સ્વામીને જાંખ્ય લાગશે. બાહુબલીના રાજ્યમાં પ્રજાને એટંદું સુખ છે કે સભામાં બેઠેલા તો જાણતા ય નથી કે ભરત વળી તોણ છે ? મદાંધસ્વામીના મદાંધ નોકરો ન પોતાનું સારું દેખાડે, ન સ્વામીનું લીલું વાળે, દૂતની વાગ્ધારા આગળ ચાલી, “તમારા મોટા ભાઈ જેના માલિક તે જગત કુશલ જ હોય ને ? ભગવાનના વચનમાં ભવ્યને અંશેય શંકા ન હોય, તેમ જેના રાજ ભરત ત્યાં વિભની શંકાય કરાય નહિ. દુશ્મનોને ધૂળ ભેગા કરી મહાન વિજ્ય મેળવનાર તમારા મોટાભાઈની પ્રજા લહેર કરે છે. સુરઅસુરો જેના ચરણો લોટે છે તેના દિવિજ્યની વાત શી કરવી ?”

**“આ દુઃખની કથની ક્યાં કહેવી ?” દૂતની વાડીની સફાઈ :-**

દૂત આગળ વધે છે, “માત્ર એક વાતનું એમને દુઃખ છે.” “ભાઈને, મોટા ભાઈને દુઃખ ?” બાહુબલના વદ્યમાં દુઃખ થાય છે, પણ એ પૂછે તે પહેલાં દૂત આગળ વધે છે. ‘હવે ય પોતે પોતાના ભાઈ સાથે નથી, એકલા છે, બસ ! આ વાતનું એમને દુઃખ છે.’ ચકોર દૂત આજ્ઞામાં આવવાની આજ્ઞા સંભળાવતા પહેલા ભૂમિકા કરે છે. આમાંથી એક બોધ લેવાનો કે સામાને કડવો અક્ષર કહેવો હોય તો ય ભૂમિકા બાંધીને કહેવાય. કોઈ જૂઠ બોલ્યો કે ચોરી કરીને આવ્યો હોય તો ય આવેશમાં આવીને એને સીધો ગુનેહગાર તરીકે ન ઢોકી બેસાડાય. દૂત કમસર બોલે છે. ‘એમને બંધુદ્દશનની જંખના છે. ભાઈ સાથે નથી, પોતે એકલા છે, એ જ એમને મોટું દુઃખ છે. દિવિજ્યના આનંદ આનંદ પ્રસર્યા, પણ કોઈ ભાઈ દેખાયો નહિ ! ઊલટું બન્યું એવું, અહાણું ભાઈને કહેવરાયું, પણ કોને ખબર, એ શું ઊંધું સમજ્યા, કે ભગવાન (પિતા) પાસે જઈને એમણે દીક્ષા લઈ લીધી. આ દુઃખની કથની ક્યાં કહેવી ?” દૂત કેવી સફાઈથી વાત કરે છે ! એ કહે છે, વચ્ચે કા દરિક્રતા ।

“છતાં એમને આપની આશા છે, એમણે કહું, ‘જાઓ નાનાભાઈ બાહુબલીને સંદેશ પહોંચાડો, ‘ભાઈ આવ ! તારા સંગમથી મને સુખ થશે, તારા દર્શનથી નેત્રને આનંદ મળશે; કલેજું ઠંડગાર બનશે.’

આટલું બોલી હવે દૂત મુદ્દા પર આવે છે, ‘અને ત્યાં આવવામાં આપને સંકોચ શાનો ? પિતાની ગેરહાજરીમાં મોટા ભાઈને જગત પૂજ્ય માને છે, સેવા કરે છે; પિતાની ગેરહાજરીમાં આપના આ મોટાભાઈ પાસે આવી એમની સેવા કરવામાં આપને કાંઈ લાંઘન નથી. ટેવો પણ જેમને નમે છે એવા તમારા મોટાભાઈને નમવામાં ગૌરવ છે. એમ ન માનતા કે તમે ન ગયા એટલે એમને ખોટું લાગ્યું હશે, રીસાઈ ગયા હશે; એ તો મોટા એ મોટા ! જ્યાં તમે એમની પાસે જશો ત્યાં એમના હદ્યને આનંદ થશે, છ ખંડ જીતીને આવ્યા છે, મહાન્દ રિદ્ધિસિદ્ધિના સ્વામી છે, વૈભવનો પાર નથી, રાજ્યાદ આપીને તમને ન્યાલ કરી નાખશે, ઈંડ અને ઉપેંડ જેમ સાથે બેસીને રાજ્ય કરે, તેમ ભરત બાહુબલ સાથે બેસી જગતનું રાજ્ય કરે; ભરતજી આ ઈંછે છે.’ વચ્ચે કા દરિક્રતા !

**પ્ર.- આવી ખૂબીને રાજ્યનીતિ કહેવામાં આવે છે. ‘નીતિ’ કેમ કહી ?**

**૩.- લઈ જાય તે નીતિ, આ શબ્દાર્થ. કોઈ પર્વત પર લઈ જાય, કોઈ રાજમહેલમાં લઈ જાય, કોઈ ભાંયરામાં લઈ જાય, પાપમાં લઈ જાય, તે પાપનીતિ, ધર્મમાં લઈ જાય તે ધર્મનીતિ. નીતિ બે પ્રકારની. પાપનીતિ, ધર્મનીતિ. આવી**

રાજનીતિ એ પણ પાપનીતિ છે.

દૂતે છેલ્ખે ધમકી પણ સંભળાવી દીધી : સુફીયાણી સલાહ આપી દીધી :-

“મોટા ભાઈ ભરત સાથે બેસી રાજ્ય કરવામાં આપને શરમાવાનું કારણ નથી, શરમાવાની જરૂર નથી, આપ જરૂર આ વાત વધાવી લેશો, ભરતજીના સંદેશને સ્વીકારશો; પણ જો હઠે ચઢશો તો કહેવું પડે, તમારા મોટાભાઈ એ સાંખી લે એવા નથી. યોગ્ય વાતમાં સામા માટે બધું ન્યોચણવર કરી દે, પણ અયોગ્ય વાતમાં સામો સગો ભાઈ હોય, બધું હોય તો પણ ચાલવા ન દે, સાંખી ન લે ! ધમંતીઓ, ગર્વિષ્ટો, મદાંધોને અંકુશમાં લેવા એ રાજ્યર્મ છે. કદાચ તમારા કાનમાં જુદો મંત્ર ઝૂકનારા, જુદી સલાહ આપનારા મળશે, એના દોરવાયા ન દોરાશો, ભરતજી અત્યારે કઈ પાયરીએ છે તેનો વિચાર કરશો. ઈંડ જેવો જેનું ગૌરવ કરે તેને નમવામાં લજજા શી ? વળી તમારે તો એ પૂજ્ય પિતાજીના સ્થાને મોટાભાઈ છે. એમને નમવાથી ને એમની આજ્ઞા ઉઠાવવાથી તમે યાવજ્જવ સુખી થશો, નહિતર પરિણામ સારું નહિ આવે.”

સંસારની અસારતાનું ચિત્ર :-

દૂતના આ બોલ સંસારની અસારતાનું ચિત્ર રજૂ કરે છે.

સંસાર કેવો સ્વાર્થરસિકતાને પોષે છે !

સ્વાર્થ સિદ્ધ કરવામાં કેવી કેવી પોલીસી રમવા પ્રેરે છે ! સ્વાર્થની વાતને કેવો ઉચિત વ્યવહારનો વાધો પહેરાવે છે !

વગેરે અનેક બાબતો એ શિખવી જાય છે. ભરતને આજ્ઞા મનાવવી છે; પછી ત્યાં વિચાર નથી કે બાહુભલ તો પોતાનો ભાઈ છે, તેમ પિતાએ દરેક ભાઈને સ્વતંત્ર રાજ્ય આપ્યું છે, પણ નહિ કે એકની નિશ્ચામાં બીજાએ રાજ્ય કરવાનું. હવે આજે ભરત પાસે પુણ્યાઈ છે, માટે.

પિતાએ ગમે તે કર્યું, ન્યાય ગમે તે કહેતો હોય, મોટાની મોટાઈ ખરી રીતે નાનાનું લેવામાં નહિ પણ નાનાને દેવામાં ભલે હોય, પરંતુ પુણ્યાઈના જોર પર જોહુકમી કરવી છે. નહિતર નાનાભાઈ બાહુભલની આમાં શી કસૂર છે ?

સંધ-વાત્સલ્ય :-

સમ્યગ્દર્શન ક્યારે ટકે ? :-

પુણ્યથી મળેલી લક્ષ્મી, બળ, સત્તા અને હોશિયારી એ વાત્સલ્ય ભૂલાવે છે. ગરીબ ભાઈ હજ પ્રેમ, વત્સલતા ધરાવતો હશે, પણ શ્રીમંત ભાઈ અરુચિ-અશાગમો અને અસદ્ભાવ ધરાવતો હોય, એવું ધાણું જોવા મળે છે. આ તો સગા ભાઈ-ભાઈની વાત જોઈએ છીએ કે બંનેએ એક બીજા ઉપર સદ્ભાવ અને વાત્સલ્ય

ભૂવનભાનું એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ” (ભાગ-૧૮)

૨૬૮

ધરવાના હોય; બાકી તો શાસ્ત્ર સમ્યગ્દર્શનના આઈ આચારોમાં, સંધ સાધાર્મિક પર વાત્સલ્ય અને ઉપબૂહણા અર્થાત્ પ્રશંસાનો આચાર પાળવાનું કહે છે. માત્ર આપણો સગો ભાઈ જ શું, કોઈ પણ જેન ભાઈ પ્રત્યે હૈયામાં હેત, સદ્ભાવ અને સમર્થન ઉછળવા જોઈએ. આ ત્રેવડ ન હોય અને એના બદલે અભાવ-અસ્ત્રિ અને અસૂયા-તિરસ્કાર રમ્યા કરતા હોય તો સમ્યગ્દર્શન ટકવું મુશ્કેલ છે.

સમ્યકૃતવને વર્તન સાથે સંબંધ ખરો ? :-

એમ માનતા નહિ કે સુદેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધા કરી, તત્ત્વની શ્રદ્ધા કરી, પછી દર્શનના આચાર ન હોય તો ય સમકિતને આંચ ન આવે ! માણસ બ્રમજામાં એવો તણાય છે ને એમ સમજે છે કે, ‘સમ્યકૃતવ તો માત્ર આંતરિક માન્યતાની વસ્તુ છે ને બાકીનું એનાથી કાંઈ ન બને છતાં એનો બેદ રાખે તો ચાલે.’ પણ આ માનવું ભૂલભરેલું છે. જો એવું હોય તો માનો કે કોઈ દેવદ્રવ્ય ખાઈ જતો હોય અને મનમાં બેદ કરતો હોય, કોઈ સાધીના શિયળ લૂંતો હોય ને મનમાં દુઃખ ધરતો હોય, અદાવતના કારણો કોઈ સાધુનું ખૂન સુધી કરાવવામાં ભળતો હોય ને કહે કે ‘શું કરું, આ ખોટું થાય છે.’ તો શું સમ્યગ્દર્શન રહે ? શાસ્ત્ર આવા પ્રસંગમાં સાફ સાફ કહે છે કે ‘મૂલગી બોહિલાભસ્સ’ – સમ્યગ્દર્શનના મૂળમાં એ અજિ સમાન છે. ત્યારે એ તો ન રહ્યું ને કે દિલમાં શ્રદ્ધા હોય પછી ગમે તેમ વર્તીએ પણ દિલમાં બટકો હોય તો સમ્યકૃતવ રહે ? કહો કે શ્રદ્ધા તો કરવાની, ઉપરાંત અમુક જાતના પાપ તો જીવનમાં હોવા જ ન જોઈએ. માટે તો સાધુના આચાર અને પ્રાયશ્ચિત્તના ગ્રન્થોમાં લખ્યું કે સાધુ અમુક હદ્થી આગળ દોષ સેવે તો તેને મિથ્યાત્વ લાગે; એવું જ કર્તવ્યને જો અમુક મર્યાદા બહાર ચૂકે તો ય મિથ્યાત્વ લાગે. સાધુની સાધુજોગી મર્યાદા અને સાધુ યોગ્ય કર્તવ્ય; ત્યારે વ્રતધારી શ્રાવકના કર્તવ્ય અને મર્યાદા અમુક કક્ષાની; તેમ જિનેશ્વરદેવમાં શ્રદ્ધા ધરાવનાર જૈનના કર્તવ્ય અને મર્યાદા અમુક કક્ષાની. એ કર્તવ્યનાં પાલન કરવાં જ જોઈએ, એ દોષની મર્યાદા બહારના દોષ નહિ જ સેવવા જોઈએ. જૈનપણું જીળવવું હોય તો અરિહંત ભગવાનના વચ્ચનમાં સંપૂર્ણ નિઃશંકતાની જેમ સંધસાધાર્મિકના પ્રત્યે વાત્સલ્ય અને પ્રશંસાનો આચાર ધરવો જ જોઈએ.

રગડા જગડાનું મૂળ : જેરી માનસ :-

વિચારો કે આ વાત્સલ્ય આચારનું બરાબર પાલન થતું હોય તો સંઘોમાં રગડા-જગડા, વેર-વિરોધ વગેરે જોવા મળે ? સંઘોમાં તડા અને ધડા, પક્ષ અને મનોભેદ દેખવા જરૂર તો નથી ? ત્યારે પ્રશંસાનો આચાર બરાબર પળાતો હોય તો પોતે ગમે તેવી ઊંચી તપસ્યા, શાનાદિ-સાધના, કે ધર્મ-પ્રભાવના કરતો હોય પણ એ બીજાની

૨૭૦ ભૂવનભાનું એન્સાઈક્લોપીડિયા-ગૃહસ્થ ધર્મ કેમ દીપે ? (ભાગ-૧૮)

નીચેની તપસ્યા, જ્ઞાનાદિ-સાધના કે પ્રભાવના પ્રત્યે હલકી દંષ્ટિથી જુઓ ખરો ? આજે તો હું સારો વક્તા ગણાતો હોઉં, પછી બીજા સામાન્ય વક્તવ્ય શક્તિવાળાની પ્રશંસા કરવાને બદલે ‘એમનામાં આવહત નથી, એ તો બાધોટા પાડે છે, કહેવાના વિષયમાં ક્યાંથી ક્યાંય ઉપડી જાય છે,...’ વગેરે વગેરે નિંદા, સૂગ કે ઉતારી પાડવાનું કરતાં કંઈ આંચકો નથી આવતો ! મારામાં જ્ઞાનશક્તિ વિશેષ હોય તો બીજા અલ્ય જ્ઞાનશક્તિવાળાને તુચ્છ લેખતાં વાંધો નથી લાગતો ! કંઈક તપસ્યા કરતો હોઉં તો બીજાઓ ખાઉકલા અને આહારના ગુલામ દેખાય છે ! જરા કદક ચારિત્ર પાળતો હોઉં તો ઓછી કદકાઈવાળાઓ ઠેકાણ વિનાના લાગે છે ! કઈ દુર્દ્શા ! કેવા જેરી માનસ ! વીતરાગ પ્રભુના ધર્મની સ્પર્શનામાં વીતરાગના ભક્ત પ્રત્યે શું આ અરુચિ ને તુચ્છતા સમાય ? ધનવાન શ્રાવક સામાન્ય શ્રાવકને જ્ઞાણે દબાયેલા ગણે છે ! ધર્મસ્થાનના વહીવટદારી શ્રાવકોને ભૂલ કરતા માને છે, ને નોકરોને વ્યાજબી વર્તનવાળા માને છે ! જૈન ભાઈઓ પર જેહુકમી, મિજાસ, તિરસ્કાર, ઈત્યાદિ બધું શું છે ? વાત્સલ્ય-ઉપબૂધણાનું દેવાણું ને ભિથ્યાત્વનું તાંડવ કે બીજું કંઈ ? સંઘર્ષણિના આ ચાળા હોય ?

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદધિ”

વર્ષ-૭, અંક-૩૧, તા. ૧૮-૪-૧૯૫૮

## ૪૧ ગૃહસ્થધર્મ કેમ દીપે ?

જૈન એ અજિ છે ! :-

ભૂલતા નહિ, જિનને માનનારો એ અજિ છે; એને વિધિપૂર્વક સેવશો તો મોહની ઠંડી દૂર થશે, ને સાધના તથા ગુણોની રસોઈ પાકશો; પણ જો એના બદલે એનો તિરસ્કાર વગેરે અવિધિ સેવન કર્યું તો બળી મરવું પડશે.

માંડવગઢના મહામંત્રી પેથડશાહ મૂર્ખ નહોતા અથવા વેવલા નહોતા કે નવા સાધર્મિકને શહેરમાં આવતો દેખી હાથીના હોદેથી ઉતરી પડી એને ભેટી પડતા.

જંગણા સંધ્વી અણસમજું નહોતા કે રાજાએ એમને સારા સારા માણસોને લઈ જમવા આવવા નોંટરું આપ્યું તો એમણે કહી દીધું કે મારે તો સંધના સમસ્ત માણસો સારા છે ! એ સંધ એટલે લાખો માણસોનો સંધ. એમાં નિર્ધન અને મધ્યમ, ભણેલા અને અણપદ, રૂપાળા અને સાદા, એમ કેઈ શ્રાવક-શ્રાવિકા હોય.

જંગણા કહે છે, ‘મારે તો બધા જ સારા છે.’ દિલમાં કેટલો ઉંચો સંધપ્રેમ અને સંધઆદર વસ્યો હોય ત્યારે પોતાને થોડા માણસો સાથે મળતાં રાજવીના સન્માન જતા કરાય ?

રાજા એ સાંભળી કહેવરાવે છે કે- ‘એમ કંઈ બધાને પહોંચી શકાય ? એમ તો તમે અમને કહો કે નગરના સારા સારા માણસો સાથે તમારું અમારે સ્વાગત કરવું છે. અને એમે કહીએ કે મારે તો બધા ય સારા છે, તો શું તમે પહોંચી શકો ?’

એ વખતે આ સંધપ્રેમી જંગણા રાજાને કુલ નગરવાસી સાથે આમંત્રણ દે છે, ને એમની સાત દિવસ સુધી ભારે ભોજન-ભક્તિ કરે છે ! લોકોને કહેવું પડે છે કે, ‘હવે એમે થાક્યા ! જૈન સંધ અને આવા ઉદાર સંધવીની ભારોભાર પ્રશંસા કરે છે !

પણ આ ક્યારે બન્યું ? સંધના પ્રત્યેક માનવી પ્રત્યે ભારે પ્રેમ-વાત્સલ્ય અને આદર હૈયે ઠસ ભરેલો હતો ત્યારે.

સંધ-વાત્સલ્યની બલિદારી છે. માતાનું પુત્ર પ્રત્યે, બેનનું ભાઈ પ્રત્યે, ને મિત્રનું મિત્ર પ્રત્યે વાત્સલ્ય પ્રસિદ્ધ છે. એમ સાચા જૈનના હદ્યે સંધ-સાધર્મિક પ્રત્યે વાત્સલ્યના ઝરા વહેતા હોય, એને જોઈને હૈયે હેત ઉભરાતા હોય, આનંદના ઉમળકા ઉછણે. એમ થાય કે,

‘અહો ! આ વિરાટ વિશ્વમાં મારા પ્રભુના સંતાન ક્યાંથી જોવા મળે ! એમને જોઉં ને ધર્મના સ્મરણ થાય ! જગતમાં સંધ-સાધર્મિકો છે તો જૈન શાસન ટકે છે.

‘જે મારું અને જગતનું ઉદ્ધારક શાસન, એના ટકાવનારા સાધર્મિકો એ તો મારે મન લાખોની કમાણી દેતી પેઢીના ટકાવનારા ભાગીદારો...’

આવી આવી સદ્ભાવનાઓ દિલમાં રમ્યા કરતી હોય, તો એ જૈન ભાઈ-બહેનો તરફ નીતરથું વાત્સલ્ય હૈયે વધ્યા કરે.

વાત્સલ્યના અભાવમાં ગંદવાડ :-

ત્યારે, જો વાત્સલ્ય વહે તો પછી એમની નિંદા કરવાનું, એમના દોખો ગાવાનું એમને ઉતારી પાડવાનું, એમની પ્રત્યે ઈર્ષા-અસૂયા કે અરુચિ-તિરસ્કાર કરવાનું ક્યાંથી રહે ? આજે આ રોગ ધર ધાલી ગયો છે. જાણે જ્યાં જુઓ ત્યાં સાધર્મિક સાધર્મિકનું વેતરતા હોય, એવું જોવા મળે છે. સાધર્મિકની પ્રશંસા, ગુણરૂપી, હર્ષના વેણ વગેરે મોંદું થઈ ગયું છે. મોટાનું જોઈ નાના શીખે છે; ને નાનાને પડેલી આદતના સંસ્કાર એવા દઢ બને છે કે પછી એ મોટા થયે ઉપદેશ સાંભળવા છતાં પડેલી આદત મિત્રવી શકતા નથી. ત્યારે એ નિંદા, વેરાઝેર, ઉતારી પાડવાનું

વગેરે વાતાવરણ કેટલું બધું ગંદું, અસર્ભ્ય અને બેહું દેખાય છે ! ક્યાં આ, અને ક્યાં વાત્સલ્ય, ગુણાનુવાદ અને પ્રોત્સાહનનું સુરમ્ય પવિત્ર વાતાવરણ !

**વાત્સલ્ય નહિ, તો શું શું જોખમાય ? :-**

ત્યારે એ સમજ લેવું કે વાત્સલ્ય અને પ્રશંસાના કિંમતી દર્શનાચાર પાળવાની બેદરકારી સમ્યક્તવને તો જોખમાવે, જોખમાવે, પણ બીજા ય કેટલા ગુણો, ત્યાગ-તપસ્યા અને ધર્મક્ષયાને જોખમાવે છે !

**પ્ર.- વાત્સલ્ય ન હોય એમાં બીજા ગુણો કે ધર્મ કેમ જોખમાય ?**

૩.- ગુણો અને ધર્મનો આધાર હદ્દય છે. હદ્દય ભાવુક હોય, કોમળ અને મધુર હોય તો એની સાથે સગાઈ થાય છે. ત્યારે જ્યાં વાત્સલ્ય નથી, સાધારિંકને જોઈ હૈયું હેઠથી ઉભરાતું નથી, પણ ઊલટું અરુચિ-અણગમો અને સ્વાભિમાન અનુભવે છે, ત્યાં કોમળતા-મધુરતા ક્યાં રહી ? ને એ નહિ, તો ગુણો અને ધર્મસાધના સગાઈ ક્યાંથી પામશે ?

સંધ્વવાત્સલ્ય ભૂલવામાં તો દિલમાં પરમાત્મભક્તિ પણ ટકરાય છે, અંગ્રેજમાં કહેવત છે 'Love me and my Dog,' 'મને ચાહો અને મારા કૂતરા સુદૂરાને પણ;' એમ 'પ્રભુને વહાલાં તે આપણને વહાલાં,' એ સૂત્રને પકડીને ચાલીએ તો પરમાત્માને ઘારા કરી શકીએ. જૈન માત્રને જોતાં જિનનાં સ્મરણ થાય; જગતના ઉદ્ધારક એક માત્ર જિન; અને જિનની સેનાના સુભટ એક માત્ર જૈનો; જિનની ધર્મપદી ચલાવનારા એક માત્ર જૈનો; પેઢીનું કામ ભલે ઓછું-વચ્ચું કરે. એવા જૈનનાં દર્શન-સમાગમે નેત્ર નાચે, અને હૈયું થનગને ! મન બોલે 'વાહ ! મારા ઘારા પ્રભુને માનનારા જૈનો ! તમને પ્રભુએ એમના ગાયા, અમે તમને અમારા ગણીએ.'

આવી ઉદાત્ત ભાવનાઓના હૈયે જુવાળ ચઢતા હોય, ત્યાં એમની કોઈ ભૂલભાલ દેખાતાં મન મોટું બની કહે, 'ભૂલ ? ભૂલ તો મારામાં હજારો છે ! બાકી એનામાં ભૂલ જોવા માટે મારા આંખ, હદ્દય અને આત્માને મલિન બનાવવા કરતાં એને જૈન, ભાવ અને શાસનના એક આધાર સંસ્ત તરીકે જોઈ એ જ મારી આંખ, હૈયું અને આત્માને ઉજ્જવળ કાં ન કરું ?'

ભરતે બાહુબલ પર વાત્સલ્ય વેરવાને બદલે આજ્ઞા મનાવવાના પ્રયત્ન આદર્યો ! એ પ્રયત્નમાં ભરતનો દૂર પોલીસીથી વાત કરે છે. ધ્યાનમાં રાખજો, પોલીસીની વાતમાં સામાની પ્રશંસાના ય શબ્દ હોય છતાં એ સાચી પ્રશંસામાં નથી ગણાતા. આજના માનસશસ્ત્રીઓએ આ તારણ કાઢ્યું છે કે 'સામાના, ખુશામતના ઘરના, વખાણ કરવા જશો તો તેની અસર સારી નહિ પડે. એ વખાણ એ વખાણ

સુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-'પ્રવચન મહોદધિ' (ભાગ-૧૮)

૨૭૩

જ નથી. તમે એનામાં રહેલા વાત્સલ્ય ગુણ શોધી કાઢો કે જે તમને ખરેખર આવર્જતા હોય, જેના પર તમને આદર ઉભરાતો હોય, ને તેને શુદ્ધ બુદ્ધિથી અનુમોદો.'

**સાફ દિલ :-**

દૂતની વાતમાં આ નહોતું. એમાં પોતાના દિલની ચોરી હતી. ત્યારે સારી પણ કિયામાં જો દિલની ચોરી હોય, તો એ કિયા શો લાભ કરે ? સાફ દિલ, પવિત્ર હૈયું, એ તો એક મહાન પાયો છે. એના પર ઉભેલો વ્યવહાર, ગુણ અને ધર્મ સ્થાયી રૂપ પકડીને વિકાસને અવકાશ આપે છે. વાત્સલ્ય અને પ્રશંસાના ગુણ માટે આ પાયો ખૂબ જરૂરી છે, ગુણસ્થાનકની પાયરીએ ચઢવા સારું પવિત્ર હદ્દયરૂપી શક્તિ અત્યંત આવશ્યક છે; એમાં ગફલત થતાં ઊંચે ચઢવાનું તો બાજુએ રહ્યું, પણ નીચે ગબડી પડાય છે. વર્ષોની જંગી જહેમતથી પ્રાપ્ત કરેલ ઊંચા ગુણસ્થાનક હૈયું મલિન થતાં સરકી ઘાયાના દષ્ટાન્ત સાંભળીએ ત્યારે એમ થાય કે અરે ! દિલ બગડતાં કેવું ભયાનક પરિણામ !

કંડરિકમુનિએ રાજ્યસમૃદ્ધિનાં પ્રલોભનને ફગાવી ચારિત્ર લીધા પછી હજાર વર્ષ દીક્ષા પાળી, મહાન તપસ્યાઓ કરી, પણ બિમારીમાં રાજવીની સરભરાએ સારા થવા છતાં દિલ બગાડ્યું, રસનાની ઉજાણીમાં લોભાયા, અને વિહાર કરી જવાને બદલે દંબથી પડી રહ્યા તો છેવટે બાણ થઈ સાતમી નરકે પહોંચ્યા ! ત્યારે એમના જ સાફ દિલવાણા ભાઈ પુંડરીક હજાર વર્ષ રાજ્ય કરવા છતાં માત્ર બે દિવસના ચારિત્રમાં ઠેઠ અનુત્તર વિમાને પહોંચ્યા ! મલિન અને સાફ દિલના પરિણામમાં કેવા ગજબનાક અંતર પડી ગયા !

દિલ બગડતું લાગે કે તરત સંયોગ ફેરવી નાખવા જોઈએ. હૈયાને બગાડનાર નિમિત્તોથી દૂર ભાગવું જોઈએ, અગર નિમિત્તોને દૂર કરવા જોઈએ. નહિતર, દિલનો બગાડો કદાચ રાક્ષસી કૃત્ય સુધી લઈ જતાં સ્ખલના નહિ પામે. તમને ખરબ હોય તો કુલવાલક મુનિનું દિલ મેલું થતાં મેલ એટલો બધો વધ્યો કે એ મેલા હદ્દે ચેડા મહારાજની નગરીનો પ્રભાવી જિન-સ્તૂપ તોડાવરાયો અને ન્યાય તથા પરોપકાર ખાતર લડતા મહાશ્રાવક ચેડા મહારાજનો અને એમના રાજ્યનો નાશ કરાવ્યો !

દિલ એક વાર બગાડ્યા પછી, યાને હદ્દયમાં એક વાર મેલ ઘાલ્યા પછી ફાલેફૂલે છે. જેવી રીતે વસ્ત્ર જ્યાં સુધી ઉજાણું હોય ત્યાં સુધી એને સાચ્યવી સાચ્યવીને વપરાય છે; માણસ બેસે ઉઠે તો વસ્ત્રની કાળજી રાખે છે. પરંતુ એજ વસ્ત્ર મેલું થવા માંડયું પછી એનાથી જ્યાં ત્યાં જેમ બેસાય છે, એટલે મેલ વધે

૨૭૪ સુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-ગૃહસ્થ ધર્મ કેમ દીપે ? (ભાગ-૧૮)

છ. બસ, એજ રીતે દિલ સાફ હોય ત્યા સુધી વર્તાવની કાળજી રહ્યા છે, પરંતુ દિલ મેલું કર્યુ પછી તો ગમે તેમ વર્તવાનું કરાય છે, ને તેથી હદ્યનો મેલ વધે છે.

ખૂબ સાવધાન બનો, હદ્ય એ કિંમતીમાં કિંમતી રતપેટી છે. એમાં ગુણોરૂપી રત્નો રાખવાના છે. જો એમાં મેલ ભર્યો, તો રત્નો મેલા થશે. જો હદ્યની પેટીમાં માયા, પ્રપંચ વગેરે કાણાં પાડ્યાં તો રત્નો બહાર નીકળી જશે. માટે એને ખૂબ સાચવો. બહારના નુકસાન કદાચ આવી પડે તો તેને ખમી લો, પણ હૈયું બગાડી ભયંકર નુકસાનીના રાકસી મુખમાં ન હડસેલાઈ જાઓ.

અને, જુઓ તો ખરા કે દિલ સાફ રાખવામાં કેવા ફોરા રહેવાય છે; હૈયું કેવું ફોરું ફૂલ લાગે છે ! જ્યાં માર્ગાનુસારી વગેરે ગુણોનો ઘાત કરવાનો પ્રસંગ આવે છે ત્યાં હૈયું ભારે થાય છે; કેમકે એમાં મેલ પેસે છે. પવિત્ર ફોરા દિલને તો એવો પ્રસંગ આવે કે તરત આંચકો લાગે; એમ થાય કે-‘અરે ! આ દિલ ક્યાં બગાડું ? મેલ ક્યાં ઘાલું ?’ વર્ષો જ નહિ પણ જીવનોની જહેમત પછી હૈયું સંંગ પવિત્ર રહે છે; સ્વચ્છ દર્પણ જેવું રહે છે. સ્વચ્છ દર્પણમાં બધું યથાવતું પ્રતિબિંબિત થાય પણ એ કાંઈ બગડે નહિ, એને કોઈ રાગ-દ્રેષ્ણની અસર નહિ. એમ, આપણને જગતમાં કેઈ જોવાનું મળે, ભેટવાનું મળે, પણ હદ્ય સ્વચ્છ આરિસા જેવું હોય તો એમાં ઉદાસીનભાવે દર્શન માત્ર થાય, પણ હૈયું બગડે નહિ; એમાં કોઈ મેલી અસર નહિ; કોઈ રાગ, દ્રેષ્ણ, પ્રપંચના મેલ ન ઉદ્ભબે. પવિત્ર હદ્યના જીવનની બલિદારી છે.

ભરતનો દૂત પોલિસીથી વાત કરે છે. બાહુબલીને કહે છે, ‘મોટાભાઈની આજ્ઞામાં આવી જવું એ કર્તવ્ય છે, અને કર્તવ્ય અદા કરવું ચૂકશો તો સોસંસું પડશે.’ સ્વાર્થની વાતને કેવો કર્તવ્યનો વાધો પહેરાવાય છે ! સ્વાર્થની અંધતા ચીજ જ એવી છે કે વસ્તુના શુદ્ધ સ્વરૂપનું ભાન ન થવા દે. નહિતર ઉચ્ચિત તો એ હતું કે ભરતે મોટાભાઈ તરીકે પોતાની કમાઈમાંથી નાનાભાઈને ભાગ દેવો હતો. ના, આ તો પોતાના બહારના મહાવિજય ઉપર હવે ઘરમાં પણ દમદારી કરવી છે. દુનિયામાં આવું ક્યાં ક્યાં જોવા નથી મળતું ? જરા વિશેષતા આવી કે દમામ અને દમદારી શરૂ થયા જ છે ! અને તે બધું પાછું સામાને જીણે કર્તવ્ય પળાવવા માટે ! પણ આ બીજાનું વિચારતાં પહેલાં જાતનું વિચારજો કે આપણા જીવનમાં પુણ્યાઈ વધતાં; વિશેષતા આવતાં, દમામ અને દમદારીમાં પડીએ છીએ કે નહિ ? ત્યારે શું પુણ્યાઈ કે વિશેષતા એવા પાપના જરા છે કે એમાંથી પાપ વહ્યા કરે ? અને તમે કહેશો કે શું કરીએ, લગભગ બને છે તો એવું જ, ’તો એ ઉપરથી માપ કાઢવા જેવું છે કે એવા સંસારને સારભૂત ગણવો કે નિઃસાર ?

**પ્ર.- આજના નવા વિચારવાળા કેટલાક એમ કહે છે કે- ‘સંસાર અસાર,’ ‘સંસાર અસાર,’ એમ માની માનીને તેમે PASSIMIST નિરાશાવાદી બનો છો; હંમેશાં ભગ્નહદ્ય રહ્યા કરો છો; અનું કેમ ?**

**૩.- એ વાત ઠીક નથી; કેમકે એ તો હકીકતનું દર્શન છે. સંસાર સારભૂત હોત તો તો જગતના જીવોએ સાર બેંચી બેંચી સ્વાત્માના મહાન ઉદ્ધાર કરી લીધા હોત; પરંતુ તેવું બન્યું નથી. તેમ જે કેટલાક ભવ્યાત્માઓએ સંસારની વસ્તુમાં સ્વાત્માને ગુણસ્થાનકે ચઢાવ્યો છે, તે જો જો કે, વસ્તુની સારભૂતતાના પ્રભાવે નહિ, પરંતુ દેવગુરુ ધર્મના પ્રભાવે. હોશિયાર વૈદ અફીશમાંથી એવી દવા બનાવી એના વડે લોકોને સાજી નિરોગી કરે, તો ય અફીશ તો મારનારું જ કહેવાય. એમ સંસાર, અને સંસારની વસ્તુમાં કોઈએ ધર્મપ્રાપ્તિ અને આત્મવિકાસ સાથ્યો હોય, તો ય તે દેવગુરુના પ્રતાપે; બાકી સંસાર તો અસાર જ. એ અસાર માન્યા પછી જ ધર્મની સાચી ઉત્કંઠા જાગે છે, તમના જાગે છે, હંશે હંશે ધર્મ કરવાની જ એકમાત્ર લગની રહે છે. જેમ જેમ ધર્મ સધાતો જાય છે, તેમ તેમ નવી નવી સુર્તિ, નવો નવો. ઉત્સાહ અને નવી નવી આશા જન્મે છે. આત્મસમૃદ્ધિ અને આત્મશાંતિના નવનવા અનુભવ થાય છે. આમાં નિરાશાવાદ કે ભગ્ન-હતાશ હદ્ય જેવું ક્યાં રહ્યું ? શબ્દની કરામત રચવી હોય એ જુદી વસ્તુ છે; બાકી સંસારના પદાર્થોને હાડોહાડ અસાર માન્યા વિના સાચા ત્યાગ અને ધર્મરાગ જાગવા-ટકવા અસંભવિત છે.**

**મોટાભાઈનો આ સ્નેહ સારો ! બાહુબલીનો કટાક્ષ :-**

ભરતના દૂતે બાહુબલને છેલ્લી વાત કહી દીધી. જે કહેવા આવ્યો હતો તે પહેલાં તો ગોળ ગોળ પીરસીને પછી છેલ્લે કર્યું. એ બોલી રહ્યો, અટક્યો, એટલે બાહુબલીએ પોતાના ખભા સામે જોયું, પછી સુવેગ તરરું નજર ફેંકી, એ રંક જેવો લાગ્યો ! છતાં એ હદ બહાર બોલે એ એ સહી ન શક્યા. એને કહે છે,

“દૂત ! ધ્યાન રાખ ! ભરત મારા મોટાભાઈ છે માટે પિતાજીની જેમ પૂજનીય છે, સેવનીય છે, કુલીનોનો વડીલોની સેવા કરવાનો કમ છે, એ તું શું શીખવતો હતો ? હું જાણું છું, પણ તને કહું છું, વડીલો કે ગુરુઓ જે મનાય છે, પૂજાય છે, સેવાય છે તે તેમની વડિલાઈને લઈને, ગુરુપણાને લઈને. ગુરુ સેવ્ય પણ ગુરુત્વથી; ગુરુ ગુરુ હોય તો સેવવા યોગ્ય. ગુરુ અગુરુ બને તો એની સેવા જગતે કહી નથી.”

બાહુબલીએ પણ ભૂમિકાપૂર્વક કહેવાનું કહેવા માંયું.

“ભરતે ગુરુતા સાચવી ક્યાં છે ? એ ગુરુ હોય તો અદ્વાણું નાના ભાઈઓના

રાજ્ય છીનવી લે ? ગુરુ તો તે કે જે નાનાની રિદ્ધિ કેઈ ગુણી કરી આપે ! છ છ ખંડ ઓછા પડવા કે અણાણનું રાજ્ય પડાવવા ગયા ? મોટા ભાઈનો આ સ્નેહ સારો !” બાહુબલી કટાક્ષ કરે છે, “હજુ તો મારે કહેવું જોઈએ કે લાયકીવાળા તો એ અણાણું ! બલ નહોતું માટે એ ચાલી નીકળ્યા એમ સમજતો ના; પણ, ‘ક્યા પિતાના અમે પુત્રો ! તે અમે તુચ્છ રાજ્ય માટે લડીએ ? એ તો અમને લાંદણ !’ એમ સમજને સંસાર છોડીને નીકળી ગયા. વડિલાઈ ભરતની કે અણાણની ? અણાણને ઉદારતા વાપરી છે. હું એવી ઉદારતાવાળો નથી એ ભરત સમજ લે; કહેજે ! આવો અન્યાય કરીને ભરત જગતમાં મહાલવા ઈચ્છે, વિજયવંત ગણાવવા ઈચ્છે, એ એની બ્રમણા છે. એમાં એ થાપ ખાશે ! મારી આગળ એ બ્રમણા નહિ ચાલી શકે.”

**આ વાણી કર્મની કે ધર્મની ? :-**

બાહુબલીનું આ ભાષણ ન્યાયનું કે અન્યાયનું ? બાહુબલીની આ વાણી મર્યાદાવાળી કે મર્યાદા વિહોણી ? બાહુબલીનું અભિમાન નથી, પણ ખોટી દમદારી સામે નિભક્તિ છે. ‘પિતાએ આપેલા રાજ્યમાં આવો અન્યાય ભરત કરે, એ હું નહિ ચલાવી લઉં,’ આવી બાહુબલીની વાણી કર્મની કે ધર્મની ? સમજો કે બાહુબલીની આ વાણીને ધર્મ કહેવામાં આવે તો થયેલા મોટા યુદ્ધને ય ધર્મ કહેવો પડે ને ? માટે તો જ્યારે અણાણું ભાઈઓ એવા યુદ્ધની તૈયારીપૂર્વક પ્રભુ પાસે સલાહ માટે આવ્યા ત્યારે પ્રભુએ એમને યુદ્ધથી નિવાય્ય.

**ગયા હતા ભરત સાથે લડવાનું પૂછવા, પણ થઈ ગયા સાધુ ! :-**

ભરતે જ્યારે અણાણને આજીવામાં આવવાનું કહેવરાવું ત્યારે એ અણાણને ભેગા થઈ ગયા વિચારવા, કે ‘શું કરવું ?’ ભરત સામે લડી લેવાની એમનામાં ધારશ હતી. છતાં પિતાજીની સલાહ લેવાનું મુનાસીબ ધાર્યું. ભરતને એવી સલાહ લેવાનું સુઝ્યું નહોતું. અણાણને થયું કે ‘જરાક સંમતિ જેવું મળી જાય તો કાનપદ્ધી પક્કીને ભરતને ઉઠાડી મૂકીએ ગાઈ ઉપરથી,’ આમ ધમધમી ગયા હતા. એ રીતે પિતાજી પાસે વીતરાગ પરમાત્મા ઋષભદેવજી પાસે ગયા. વિરાગી થઈને નહોતા ગયા, પણ સમર્થ રાજીવાના શાશપણા પર રાગી થઈને, ને ભરત પર દ્રેષી થઈને ગયા હતા. જગતની દસ્તિએ અણાણું ન્યાયી હતા, ભરત અન્યાયી હતો. આવ્યા ભગવાન પાસે. ભગવાન તો જોઈ રહ્યા હતા, જીણતા જ હતા, કે એ શા માટે આવ્યા છે. એ બોલે એ પહેલાં જ દેશના એમના પર એવી ઉતારી કે, અણાણને ઊભા થઈ ગયા ! વિરાગી બની ગયા ! ભગવાન પાસે ચારિત્ર માર્ગયું, ને લીધું ચારિત્ર ! ખલાસ ! લડાઈ તો શું પણ સમસ્ત સંસાર જતો કર્યો !

## • શ્રી ઋષભદેવપ્રભુનો ૮૮ પુત્રોને ભવ્ય ઉપદેશ •

પરમાત્માએ શું કહું, એ કથને શું કર્યું ? :-

એમને પરમાત્માએ શું કહું ? ‘તમે ભરતને દુશ્મન દેખો છો, પણ એ તો મામુલી દુશ્મન છે, એ એવો કમ તાકાત દુશ્મન છે કે તે તમારું ખરાબ કરવા ધારે તોય વાસ્તવિક ખરાબ કાંઈ ન કરી શકે. એને શત્રુ ન ગણશો. એ તો મામુલી અને એક છે, પણ એના કરતાં અનંતગુણી શક્તિવાળા, અને આત્મામાં ધર કરી ગયેલા આંતર શત્રુઓ કેટલાય છે તેને કાં નથી જોતા ? આ અજ્ઞાન છે. મનુષ્ય જીવન શા માટે છે ? આ જીવે ભૂતકાળમાં અનંતીવાર મહાન મહારથી જેવા શત્રુઓની છાતીમાં છરી હુલાવી છે, પણ કર્મે તો જીવની છાતીમાં માત્ર એક મુક્કી મારીને સંસારમાં કેઈ જન્મ-મરણમાં અનંતકાલ રુલતો કર્યો છે. કયો શત્રુ વધારે ? બાધ્ય કે આંતર ? મોહરાજા અને કર્મરાજા એ સર્વથી ભયાનક શત્રુ છે.

રાગ છે માટે દુઃખ છે :-

વસ્તુસ્થિતિએ વિચાર કરવામાં આવે તો સમજય એવું છે કે માણસ જે પીડાય છે તે બહારના દુશ્મનોથી નહિ, પરંતુ પોતાના આંતર દુશ્મનો રાગ-દ્રેષ્વ વગેરેથી. એક જમીનના નાના ટૂકડા ઉપર પણ જો રાગ છે તો એ ટૂકડા પર આંખ કરનારો દુશ્મન દુઃખકારી બને છે. ત્યારે જો મોટા પૃથ્વીના સામાજ્ય ઉપર પણ રાગ નથી, કિન્તુ કંટાળો છે કે ‘આ બલા કયાં માથે પડી !’ તો એને સંપૂર્ણ જૂટવી લેનારા દુશ્મનથી કાંઈ દુઃખ લાગતું નથી. કહો જો, મોટો બંગલો વેચી માર્ગી પછી જો કોઈ દુશ્મને એને સળગાવી નાખ્યો તો વેચનારને દુઃખ લાગશે ? ના, કેમ નથી લાગતું ? કારણ એજ કે વેચી નાખ્યા પછી એના પરથી રાગ ઉકી ગયો છે. રાગ ગયો એટલે દુઃખ ગયું. ત્યારે ખરીદનારે રાગ ઊભો કર્યો માટે સળગાવાથી દુઃખી થાય છે; સળગાવનાર એને પીડાકારી લાગે છે. તો દુઃખ કોણે આખ્યું ? સળગાવનારે નહિ, રાગે આખ્યું. એવા રાગ-દ્રેષ્વ જ આ સંસારમાં અનંતાનંત કાળથી આ લોક અને પરલોકમાં જીવને નિઃસીમ દુઃખ આપે છે.

એને દુશ્મન ન દેખવા અને બહારનાને દુશ્મન દેખવા એ કેટલું કારમું અજ્ઞાન કહેવાય ? તેમ,

એ બાધ્ય દુશ્મનોને દબાવવાના ધમપણડા કરવા છે, અને ખરા આંતર દુશ્મનોને મહલાવવા-કુલાવવા છે, તો કોઈ દીદુઃખનો અંત આવવાનો છે ? ત્યારે,

એ પણ વિચારવા જેવું છે કે આવા મનુષ્યભવમાં કે જ્યાં રાગાદિ દુશ્મનોને દૂર હટાવવાનો, નષ્ટ કરવાનો અવકાશ છે, અવસર છે, સામગ્રી-સંયોગ અને સમજ

છ, ત્યાં એને પાણ્યા-પોણ્યા તો પછી ક્યા ભવમાં એનો નાશ કરી શકશે ?”

અણાણુનો પ્રશ્ન :-

અહીં અણાણુ ભાઈઓના મનમાં, એમ થાય છે કે- ‘ઠીક છે, મોટા ભાઈ ભરતને દુષ્મન ન ગણીએ અને એની સામે ન લીધે, તો પણ જે રાજ્ય-સંપત્તિ પાસે છે, એના પરનો રાગ કેમ છૂટે ? દુનિયામાં તો જેને નથી મળ્યું એને ય ઓરતા થાય છે, તો અહીં મળેલા ઉપર મમતા કેમ ન રહે ?’

પ્રભુનો ઉત્તર :-

આ પ્રશ્નના ઉત્તરમાં ઋષભદેવ ભગવાન કહે છે કે, ‘એ માટે એ વિચારે કે જીવની તૃષ્ણાનો અંત ક્યારે ? ને જો અંત નહિ તો અનેકાનેક ભવોના પરિભ્રમણમાં જીવની દુર્દ્દશા કેવી ? તૃષ્ણાના રાક્ષસી રૂપ પર એક દષ્ટાન્ત છે.

કોલસા પાડનારનું દષ્ટાન્ત :-

એક ધ્યાદારી માણસ કોલસા પાડવા માટે જંગલમાં ગયો, ત્યાં એણે લાકડાં ભેગા કરી સણગાવ્યા. અડધા-પડધા બળે છે એટલે સાથે લાવેલ પાણી છાંટી એને ઓલવી નાખે છે. બીજી બાજુ ભર ઉનાળાનો સૂર્યનો અને તપેલી ધરતીનો તાપ, પેલી આગનો તાપ, તેથી કેટલુંક પાણી છંટકાવમાં વાપરે છે. એમ કરતાં પાણી પૂરું થઈ ગયું, અને કામ અધુરું છે; તેથી પાણીની શોધમાં ચાલ્યો. પાણી તો મળ્યું નહિ, પણ અતિ તાપ અને તરસથી પીડાયેલો એ એક જાડની છાયામાં થોડું સૂતો, ને ઊંઘ આવી ગઈ. ઊંઘમાં એને સ્વખ આવ્યું અને સ્વખમાં એક સરોવર દીહું. ભારે તરસના સંસ્કારવાળો એ સ્વખમાં જ સરોવરનું પાણી પીવા ગયો. એ શી રીતે પીએ ? ખોબે ખોબે ? ના, તરસ ભારે છે તો એમ સંતોષ શી રીતે વળે ? એ તો પડ્યો જમીન પર ઊંઘો સાણંગ દંડવત્ત ! અને પાણી પર મોહું માંડી મંડ્યો ઢયક ઢયક પીવા ! સ્વખાની તરસ એમ શે મીટે ? આખું સરોવર પી ગયો, છિતાં તૃષ્ણા હજુ ભારે છે. તેથી ઉઠીને આગળ ગયો બીજા નદી-સરોવર પાસે. એ ય પીને ખાલી કરી નાખ્યા. તો ય તરસ નથી શમતી. તે આગળ જઈ જઈને કેઈ નદી-સરોવર પાસે. એ ય પીને ખાલી કરી નાખ્યા. તો ય તરસ નથી શમતી. તે આગળ જઈ જઈને કેઈ નદી-સરોવરો પી નાખ્યા. પણ હજુ ય તૃષ્ણા ઊભી છે, ને હવે નદી-સરોવરો દેખાતા નથી, એટલે ફાંફાં મારે છે. ‘ક્યાંય પાણી ?’ એટલામાં એક ભીના કાદવનું ખાબોચિયું જર્ઝું. ખોબો ભરાય એવું પાણી નથી એટલે પોતાનું કપું કાદવ ઉપર પાથરી દે છે, અને પછી લિંજાયેલા એ કપડાનું ટીપું ટીપું પોતાના મુખમાં નીચોવે છે; અને મનથી માને છે, ‘હાશ ! ઠીક મળ્યું ! હવે શાંતિ થશે.’

અહીં પ્રભુ પુત્રોને પૂછે છે, ‘બોલો, જે તૃષ્ણા મોટમોટા નદી-સરોવરોથી ન છીપી, એ આ કાદવિયા પાણીના ટીપા-ટીપાથી છીપી જશે ને ?’

અણાણુ પુત્રો કહે છે, ‘ના રે ના, શાની છીપે ? એ તો એની ભ્રમણા છે કે માને છે હાશ હવે શાંતિ વળશે !’

તૃષ્ણાનો અંત ક્યાં ? :-

ભગવાન કહે છે, ‘તો બસ ! સમજુ જાઓ કે તમારી પણ ભ્રમણા છે કે જે તમારી તૃષ્ણા પૂર્વ ભવોમાં મોટમોટા રાજ્યો, લક્ષ્મી અને દેવતાઈ વૈભવથી પણ ન મળી તે અહીંના ટીપાં જેવા તુચ્છ રાજ્ય અને લક્ષ્મીથી શાંત થવાની આશા રાખો છો. ભૂલા પડ્યા છો જે અહીં તૃષ્ણા કેળવી સુખી થવા મથો છો ! એમ એ તૃષ્ણા શાંત થવાની છે ? સંસાર એક મહાસ્વાન્ન છે, એની તૃષ્ણા તો ગજબ ! સ્વખાની તૃષ્ણા તો હજુ સારી સ્વખાનો અંત થયે એ શાંત થાય; પણ આ સંસારની તૃષ્ણા તો ભયંકર ! કેમકે સંસારનો અંત થાય તો એ મીટે ને ? બીલટું,

તૃષ્ણા છે ત્યાં સુધી સંસારનો અંત થવાની વાત શી ? અને,

સંસાર છે તો તૃષ્ણાના તાપની અંદ ધારાનું પૂછવું શું ? સંસાર અને તૃષ્ણાનું વિષયક છે.’

એ સાંભળીને અણાણુ પુત્રોનાં હૈયાં હયમચી ઉઠ્યા ! લાગ્યું કે ક્યાં ભરત સાથેની તુચ્છ ખેંચાયેચ ! અને ક્યાં જીવની તૃષ્ણા પાછળ અનંતસંસારની લીલા !

સૂયગડાંગ સૂત્રના બીજા ‘વેયાલિય’ નામના અથયનમાં શ્રી ઋષભદેવ ભગવાને અણાણુ પુત્રોને આપેલો ઉપદેશ સંગૃહીત કરવામાં આવ્યો છે. તેની પહેલી જ ગાથામાં કહ્યું છે,

‘સંબુજ્ઞહ, કિં ન બુજ્ઞહ ?, સંબોહી ખલુ પેચ્ચ દુલ્લહા ।

નોહૂવણમંતિ રાઙ્ડાઓ, નો સુલહં પુણરાવિ જીવિઅં ॥

‘હે પુત્રો ! સંબોધ પામો, તમે કેમ બુઝતા નથી ?

સંબોધ ખરેખર ભવાંતરે દુર્લભ છે.

આયુષ્માંથી પસાર થઈ ગઈ રાત્રિઓ ફરી પાછી આવતી નથી.

તેમ, ફરીથી સંયમ જીવન પણ સુલભ નથી.’

સંબોધ એટલે ? :-

પ્રભુએ શું કહ્યું ? એજ કે સંબોધ પામો. સંબોધ એટલે આત્મહિતની પ્રાપ્તિ અને આત્મ-અહિતનો ત્યાગ. ધ્યાનમાં રાખવાનું છે, સંબોધ એટલે માત્ર સારી રીતે જાણી મૂકવાનું એમ નહિ, પરંતુ અમલમાં ઉતારી જાણવાનું. એ કર્યું તો સંબોધ

પામ્યા ગણાયા. અહીં આત્મહિત તરીકે સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્યારિત્રય ધર્મ લેવાનો છે. અને આત્મ-અહિત તરીકે વિષયભોગો અને કષાયો સમજવાના છે. પ્રભુ ઉપદેશે છે કે,

‘હે પુત્રો ! તમે કેમ આ ગ્રાણ દર્શન-જ્ઞાન-ચારિત્રમય રતનરૂપી ધર્મને વિષે પ્રવૃત્ત થતા નથી ? ને આ ‘અમારું રાજ્ય, અમારું રાજ્ય’ એ ભાંજગડમાં પડ્યા છો ? ભૂલશો નહિ કે પરલોકમાં બીજું મળવું સહેલું છે, પરંતુ આ સંબોધિ, અર્થાત્ આ રતનત્રયીરૂપ ધર્મને વિષે પ્રવૃત્તિ મળવી મહાદુર્લભ છે. એવી મહાદુર્લભ વસ્તુ અહીં જો અતિ સુલભ છે તો તમે કેમ એ પ્રાપ્ત કરી લેતા નથી ?

ગણા દિવસ ગણા :-

હે વત્સ ! તમને કદાચ લાગતું હશે કે હજી હમણાં એની શી ઉતાવળ છે ? પરંતુ તમને એ તો ખબર છે ને કે આયુષ્ય કાળમાંથી જે દિવસો પસાર થતા જાય છે, એ પાછા ફરતા નથી ? એ તો આયુષ્યમાંથી ઘટાડો કર્યે જાય છે. પૂર્તિ નહિ ! તો આ પસાર થઈ જતા કિમતી દિવસો, અરે ! કિમતી ક્ષણોને મહાદુર્લભ રતનત્રયીની સાધના વિના કેમ જવા દો છો ? નથી તો તૂટા જતા આયુષ્યને સાંધી શકતું, કે નથી તો આ ભવ બાદ સંયમજીવનને જટ પ્રાપ્ત કરી શકતું ! પછી ત્યાં કરી લેવા યોગ્ય હિતકારી પ્રવૃત્તિમાં વિલંબ શા માટે ?

વિનભૂત સ્વજનો ભવવર્ધક :-

હે આયુષ્મન્ ! ભૂલતા નહિ કે જે સ્વજન સંબંધીના મોહમાં ફસીને આ સંબોધિ ચૂકી રહ્યા છો, તે સ્વજનો તમને મોહ કરાવીને ધર્મથી વંચિત રાખી રહ્યા છે, ધર્મસાધનામાં વિનભૂત થઈ રહ્યા છે; ને તેથી તે તમને ભવભ્રમણ કરાવનારા છે, ભવમાંથી ધૂટકારો નહિ. એવા પૂર્વે અનંતા મોહકારી માતાપિતા, અને સ્ત્રી-પુત્રાદિ સ્વજનોએ તમને અનંતકાળ ભવાટીમાં ભમતા રાખ્યા છે. તો હવે એવાના મોહમાં ધર્મ શા સારુ ચૂકવો ? કદાચ તમને થશે કે એ ક્યાં અમને પકડી રાખે છે ? પરંતુ વસ્તુસ્થિતિએ એમને તમારો સાંસારિક સંબંધ જોઈએ છે. માટે જ એ તમારા પર ભારે સેહ કરીને સેહ-રાગની પોલાટી જંજલથી તમને જકડી રાખે છે ! એ જ તમને ધર્મ કરવામાંથી અટકાવ્યા બરાબર છે. પછી,

પાપસ્થાનકની કિયાઓ ક્યાં લઈ જાય ? :-

હે મહાનુભાવો ! એમના મોહમાં ફસ્યા રહી જે આરબ-સમારંભ અને જે પાપસ્થાનકની કિયાઓ કર્યે જવાય છે, તે પરિણામે જીવને મનુષ્ય ભવના શિખરેથી દુર્ગતિની ખીણમાં પટકી દેનારી બને છે. તો શું તમને એનો ભય નથી ? શું તમે આટલા ઊંચા માનવભવના શિખરે ચઢ્યા પછી અંતે ભણ થઈ ફરી દુર્ગતિની

ખીણમાં પટકાવું પસંદ કરશો ? પાપસ્થાનકોના સેવનથી જો સદ્ગતિ મળતી હોય તો તો ધર્મની જરૂર જ શી રહે ? તેમ, દુનિયા આખી સદ્ગતિમાં જ કેમ ન રમતી હોય ? પણ નજરે દેખો છો કે અનંતા જીવો દુર્ગતિઓમાં સબજ્યા કરે છે. એ શાના કારણે ? પાપસ્થાનકોની કિયાના જ કારણે. માટે જો તમને દુર્ગતિનો ભય લાગતો હોય તો એજ સીધો રસ્તો છે કે એવી પાપકિયાઓથી પહેલી તકે વિરામ પામો, નિવૃત્ત થાઓ. દુર્ગતિઓને તાળાં મારવાનો એ સીધો ઉપાય છે કે પાપકિયાઓના હંમેશના ત્યાગની પ્રતિજ્ઞા કરી એનાથી દૂર થઈ જવું.

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદ્દિપિ”

વર્ષ-૭, અંક-૩૨, તા. ૨૫-૪-૧૯૫૮



## ૪૨ ગૃહસ્થધર્મ કેમ દીપે ?

દરેક જીવનાં કર્મ અને સુખદુઃખ જુદાં :-

હે વત્સ ! એવી હિંસાદિ પાપસ્થાનકની પ્રવૃત્તિથી સ્વજનોને તમે સુખી કરવા ચાહતા હશો, પરંતુ એ સમજ રાખો કે એ જીવોનાં દરેકનાં કર્મ જુદાં જુદાં છે, ને એનાં સુખદુઃખ પણ જુદાં જુદાં છે, સ્વતન્ત્ર છે. એનાં કર્મ પ્રતિકૂળ હોય તો તમે એને સુખી કરી શકતા નથી; ને તમે કશું ન કરો તો ય એનાં અનુકૂળ કર્મ એને સુખ આપે જ છે. ખરી રીતે તમે તો એને પાપકિયાઓમાં તાણી દુઃખના વન તરફ ઘસડી રહ્યા છો. શા માટે એવી સામાની ભાવહિંસા કરવાનું કરવું ? તેમ, શા માટે એવા અલગ અલગ કર્મસ્વતંત્રતાવાળા જીવોને આપણે જાતે સુખી કરી દેવાનો ભય સેવવો ? એને સુખ મળશે તો એનાં કર્મના પ્રતાપે મળશે. આપણે એને સુખ આપીએ છીએ એ માનવું ખોટું છે. દરેક જીવનાં કર્મ અને સુખદુઃખનાં સ્વાતન્ત્ર્યની વસ્તુ ઉપર એ પણ વાત છે કે કૃદ્ર જીવો જો પોતાના કર્મનો માર તો ખાઈ રહ્યા છે, તો પછી આપણે એને હિંસાદિ આરંભો દ્વારા કાં વધુ પીડવા ?

દેવો, રાક્ષસો સરખાનેય ભોગો કાયમી નહિ :-

હે ભાગ્યવાનો ! સમજ રાખજો કે મોટા દેવતાઓ, ગંધર્વો, યક્ષો અને રાક્ષસો જેવા પણ ગમે તેટલા ઊંચા ભોગો અને પાપકિયાઓમાં મહાલે, પણ એમને ય ત્યાંથી ચ્યવવું પડે છે ! મૃત્યુવશ થવું પડે છે ! ને એના દારુણ વિપાકથી દીર્ઘકાળ પીડાવું પડે છે ! દેવોની આ સ્થિતિ, તો તમારે ક્યાં આ બધું કાયમી બેસી રહેવાનું

છે ? કે ક્યાં એના ભયંકર પરિણામથી બચી શકાવાનું છે ? તમે ય અનંતીવાર એવા દેવના અવતાર જોઈ નાખ્યા ! આજે ક્યાં એમાંનું કશું ઊભું છે ? ક્યાં એ ભોગોનો કોઈ આનંદ, કોઈ તૃપ્તિ આજે અનુભવી શકો છો ? તો પછી મરણની સામે આંખમિયામણા, અને ભોગોની લંપટા શા સારુ કરી રહ્યા છો ?'

**ભોગો અને સ્વજન પરિચયમાં કલેશ :-**

'હે બાળ ! જરા ય અમણામાં ન રહો કે ઈન્દ્રિયોના મનગમતા વિષયોના ભોગવટા અને પ્રિયજનોના પરિચય સુખકારી છે ! એ ભોગો અને એ પરિચયો તો આ જીવનમાં અને પરલોકમાં બંને ઠેકાણો કેવળ કલેશને આપનારા છે.

એ ભોગો અને પરિચય પાછળ અહીં મનને કેઈ ચિંતા, ભય અને સંતાપ રહ્યા કરે છે એ કલેશ નહિ તો બીજું શું છે ?

ભોગો અને સ્વજન સંબંધો પાછળ કાયાને વિંબવી પડે છે, એ કલેશ નહિ તો શું કહેવાય ?

એના ઉપર જ કેઈ આફતો ઊભી થાય છે, રોગો પીડે છે, દોરધામ કરવી પડે છે, આ બધું કલેશનું જ સ્વરૂપ છે.

એની પાછળ પવિત્ર ભાવનાઓ, ઊચા ગ્રત-નિયમો, નિર્મળ તત્ત્વચિત્તન, દેવગુરુભક્તિ અને ધર્મસાધના વગેરે વિસારી પાપવિચારો, અવિરતિ અશુભ લેશ્યા-ભાવનાઓ, અતત્ત્વચિત્તન, મોહંધોની સેવા-ગુલામી, અને પાપસ્થાનકીની કિયાઓનાં આચરણ કરવાં પડે, એ શું કલેશ નથી ?

'હજુ એટલેથી બસ નથી, એની પાછળ પરલોકમાં એથી ય કેઈ ગુણા કલેશ ઉત્તરી પડે છે ! એ ભોગો અને પરિચયોની આસક્તિમાં એક આંખના પલકારા જેટલા સૂક્ષ્મ કાળમાં ય અસંખ્ય વાર જ્ઞાનાવરણાદિ સાતે ય કર્મના થોકબંધ ભાર આત્મા પર વધે છે ! ... જૂના કેઈ શુભ કર્મ અશુભમાં પલટાઈ જાય છે ! કેઈ નવાં શુભ કર્માઈ થતી નથી, ને નવાં પાપ બંધાય તે પણ અનુભંધવાળાં બંધાય છે ! આ બધાં પાપના ભારનો ભયંકર વિપાક પરલોકમાં આવીને ઊભો રહે ત્યાં દુઃખ, દૌર્ભાગ્ય અને દુર્દીશાનો કોઈ પાર રહેતો નથી ! ભવોના ભવો સુધી ધર્મ પામવાની વાતે ય શી ? પછી ચોરાશી લાખ યોનિમાં ચિરકાળ ભમવાનું જ થાય એમાં શી નવાઈ ?

'આ બધું કલેશ, કલેશ ને કલેશ નહિ તો બીજું શું કહેવાય ? એ વખતે પૂર્વે વહાલા કરેલા વિષયો અને પ્રિય જનો કોઈ જ બચાવવા કે સુખી કરવા આવતા નથી. તો પછી એના ભોગ અને પરિચયમાં શા સારુ લંપટ થઈ બેસી રહેવું ? એમાં શી વડાઈ કે શી સુજ્ઞતા ગણાય ?' માટે,

### સંસારનું મૂળ કષાય :-

'હે ભવ્યાત્મા ! એમાં લેશ પણ મૂંજાઓ ના, મોહ ન કરો. ધ્યાનમાં રાખજો કે એ ભોગો અને સ્વજનપરિચયોની પાછળ જીવને કેઈ કષાયો કરવા પડે છે ! કેઈ રાગદ્વેષ, કેઈ મમતામાયા, ને કેઈ મદ-માન સેવવાનું બને છે ! કેટલાય રોષ, ઈર્ષા અને અસ્યુયા, કેટલીય તૃષ્ણા, લોભ અને આસક્તિમાં સબડ્યા કરવાનું બને છે ! અને ‘કષાયમૂલઃ સંસાર’ સંસારનું મૂળ કષાયો છે; એટલે એ કષાયના મૂળમાંથી સંસારનું મોહું વૃદ્ધ જન્મે છે, એ ખૂબ વિચારાણીય છે, ગયા સંસારની શી અફસોસી કરવી ? પણ નવો દીર્ઘ સંસાર ન ઊભો થાય એ તો જેવું જ ને ? જો એ ન થવા દેવો હોય તો કષાયોને મૂકવા પડશે. કષાય સેવવા એટલે ભવવાસને રીજર્વ કરાવવા જેવું છે, દુર્ગતિને કુંકુમ પત્રિકા લખવા જેવું છે, સંસારકેદની સજી ઊભી કરવા જેવું છે.'

**વિદ્ધાનો, વિરક્તો, અને તપસ્વીઓ પર કષાયોની શિરજોરી ! :-**

હે વિચક્ષણો ! ધ્યાન રાખજો કે એ કષાયોની કુટિલતા કોઈ વિલક્ષણ છે !

મોટ મોટા શાસ્ત્રવેત્તાઓ પણ જો માયા વગેરે કષાયમાં પડ્યા, તો એ કષાયો એની વિદ્ધતાની લેશ પણ શરમ રાખ્યા વિના એક કંગાળ કુદ્ર જન્તુની જેમ એને ધોર દુર્ગતિના ચકાવે ચઢાવી દે છે !

મોટમોટા વૈભવ વિલાસોથી વિરક્ત બનીને બધું ત્યજ વનમાં જઈ બેઠેલાને પણ કષાયો અહંત્વ અને મહામિશ્યાત્વમાં ફસાવી રાખી અંતે ભવસાગરમાં નિરાધાર કરી દે છે !

ભલભલા ઉપવાસ-દૃષ્ટ-અહુંમ અહૃદી...યાવત્ માસખમણ સુધીના તપ કરનારાઓએ પણ જો મદમાયાદિ કષાય સેવ્યા, તો એ કષાયો એમને ય ભવાટવીમાં ભટકતા કરી દીધા છે !

**વિચારજો કષાયોની શિરજોરી ! મહાવિદ્ધતા, વૈરાગ્ય કે તપસ્યાવાળાને પણ જો એ ફેંદી નાખે, તો અજ્ઞાન, વિષયાંધ અને ભોગીની કઈ પારાવાર દૂર્દીશા ન કરે ? એનો અર્થ એ નથી કે તો પછી વિદ્ધતા, વૈરાગ્યાદિ કેળવવાથી ય શું, જો કષાયોની શિરજોરી જ હોય ? કેમકે એ તો કષાયોને કાઢી મૂક્યા પછી ફરી એને પાછો પગઠામ આપીએ, તો એની શિરજોરી છે. બાકી તો,**

**કષાય-નિવારણાના ઉપાય કયા ? :-**

શાસ્ત્રાધ્યયન, તત્ત્વજ્ઞાન, વૈરાગ્ય અને તપસ્યા, એ તો કષાયોને દૂર રાખવાના સચોટ ઉપાય છે. કહો, એ જ ઉપાય છે, પણ અજ્ઞાન, વિષયાસક્તિ અને ભોગો નહિ.

અજ્ઞાનાદિ તો કથાયોને મંદ નહિ પણ પુષ્ટ કરનારા છે. વિષયો, લક્ષ્મી, ભોગો, પરિવાર; એ બધા તો કથાયોને પ્રેરનારા છે, ઉદ્દીરનારા છે. એટલે ત્યાં તો કથાયોને હટાવવાનો કોઈ અવકાશ નથી. જુઓને આ તમે રાજ્યલક્ષ્મી અને વિષયાદિના સંગમાં બેદા છો માટે જ ભરત પર ગુસ્સો, અહંત્વ વગેરે ધખધખે છે ને ? એ કથાયો માસભમણ સુધીના તપ કરનારને પણ અનંતા ગર્ભવાસ ઊભા કરી આપે, તો બીજાનું એ શું ન કરે ? માટે, એ કથાયો અને એના પોપક પાપકર્મો ત્યજ દેવા યોગ્ય છે. તો,

‘ગમે તેટલું આયુષ્ય પણ કેટલું ? :-

પુરિસોરમ પાવકમુણા, પલિયંત મળુયાણ જીવિયં ।

સના ઇહ કામમુચ્છ્યા, મોહં જંતિ નરા અસંવુડા ॥

હે પુરુષાર્થી પુત્રો ! પાપકર્મથી વિરામ પામો, પાપકર્મથી આ મનુષ્ય જીવનને સુખી બનાવવા ધારતા હશો, પણ ભૂલશો નહિ કે મનુષ્યોનું આયુષ્ય વધારેમાં વધારે હોય તો તે ત્રણ પટ્યોપમ સુધીનું જ હોય છે. પછી તો એ આયુષ્ય ખત્મ ! એની સાથે અહીની બધી લહેર ખત્મ ! અને પાપકર્મનાં ફળ દીર્ઘતિર્દીર્ઘ કાળ સુધી ભોગવવા ભવયકમાં ભમવાનું ! માટે પાપકર્મથી આવા ટૂંકા જીવનને દીર્ઘ ભાવીકાળના ભોગે લહેર કરાવીને શું કરવું છે ? કહેશો નહિ કે ‘શું કરીએ, પાપકર્મ અમારાથી છૂટતા નથી !’ એ કાયરતા પશુને છાજે, પુરુષને નહિ !

પુરુષ એટલે તો પુરુષત્વવાળો, પુરુષાર્થ કરી શકનારો. અવળા પુરુષાર્થ કરવાની તાકાત છે, તો શું સીધા હિતકારી પુરુષાર્થ કરવાની તાકાત નથી ? એ તો જે શિથિલ છે, નભળા છે, કાયર છે, તે લોક ઈન્દ્રિયસુખોમાં મૂર્છિત બની વિષયો અને પરિવારના રાગરૂપી કીચડમાં ચોંટી રહે છે. તમારે શા સારું એવા નભળા બની ચોંટ્યા રહેવું ?

‘મોહ છોડ્યા પછી કેમ જાગે ? :-

તમને થશે કે કદાચ ભોગો પરિવાર વગેરે મૂકી તો દઈએ, પરંતુ પછી મોહ જાગે તો ?

પરંતુ હે પુત્રો ! ધ્યાનમાં રાખો કે માણસ જ્યાં સુધી સંવર નથી કરતો, એ બધાના ત્યાગની હાઈક પ્રતિક્ષા નથી કરતો, ત્યાં સુધી એ મોહ પામે છે. સંવર કર્યા પછી તો મન કહે છે, ‘મારે પ્રતિક્ષા છે, હવે છોડ્યું તે છોડ્યું; એને મનમાં ય ઘલાય નહિ.’

સારાંશ, જીવન ટૂંકું છે, વિષયો કલેશરૂપ છે, માટે ગૃહવાસ મૂકી દો; રાગાદિ કથાયોરોનો માર ન ખાઓ. ગૃહવાસમાં તો એ જ મળે છે, કથાયોથી ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ” (ભાગ-૧૮)

પીડાવાનું જ રહે છે.

નહિ કહેતા કે-‘ગૃહવાસ છોડીએ તો ખરા, પરંતુ પછી સાધુજીવનમાં ભૂખ-તરસ વગેરે પરીસહ કષ્ટો અને અધમ જીવોના ઉપસર્ગ-ઉપદ્રવો વેઠવા પડે ને ? એ શી રીતે વેઠાય ?’

કારણ કે, કષ્ટો અને ઉપદ્રવો ગૃહવાસમાં પણ ક્યાં નથી ? બાકી જો એટલું વિચારાય કે,

શું પીડા આપણને જ છે ? :-

‘ણ વિ તા અહમેવ લુપ્પએ, લુપ્યંતી લોઅંસિ પાણિણો’

આ જગતમાં હું એકલો જ પીડાતો નથી, બીજા પ્રાઇસીઓ ય ભારે પીડાઓ વેઠે છે. તો પીડા વેઠવાનું મારે ક્યાં નવું છે ? ઉલદું, ફરક એ પડે છે કે અજ્ઞાન જીવોનું ધારું બધું વેઠેલું અકામ નિર્જરામાં જાય છે, ત્યારે મુનિજીવનમાં વેઠેલું સુંદર સકામનિર્જરાનો લાભ આપે છે. અકામ નિર્જરા એટલે પરાણે કર્મ ખપે તે પણ થોડા, અને નવાં પાપના બંધ બહુ ! સકામનિર્જરામાં પરાણે નહિ પણ કર્મક્ષય કરવાની ઈચ્છાથી સહર્ષ કષ્ટ ઉપદ્રવ વેઠવાનાં હોય છે, તેથી ત્યાં વિપુલ કર્મક્ષય થાય છે, ને નવાં કર્મ ઓછાં લાગે છે !

ત્યારે તમને એમ થશે કે કષ્ટ-ઉપદ્રવ તો વેઠી લેવાય પરંતુ ગૃહવાસ છોડ્યા પછી પૂર્વના ચિરકાળના પરિચિત સ્નેહી-સ્વજનો લોભાવે-આકર્ષ, ત્યાં શી રીતે સ્થિર રહેવાય ?

‘સ્વજનો કેમ ન આકર્ષી શકે ? :-

પણ હે સૌભ્ય ! એમાં જો જો કે ગૃહવાસ છોડ્યો એ અસંયમના જીવનથી છૂટી સંયમ-જીવન આદરવા માટે ને ? તો જેને અસંયમના જીવન ઉપર ભારે કંટાળો છે, તિરસ્કાર છે, એને સંસારી સ્વજનો આકર્ષવા કેમજ સમર્થ થઈ શકે ? કેમકે એમની સાથેના સહવાસમાં તો અસંયમ આદરવા પડે છે ! એટલે જ મન કહી દે કે જ્યાં અસંયમ જીવવું પડે એવા આ સ્વજન-સ્નેહીઓના સહવાસથી સર્યું. કિમત શાની છે ? સ્વજનો અને વિષયોની ? કે દીર્ઘ સુખદાયી સંયમ જીવની ?

એ તો જે સત્ત્વ વિનાના હોય તે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના જીવનને બદલે સ્વજન અને વિષયોરૂપી ચેતન-અચેતન વસ્તુમાં આકર્ષાઈ મોહ પામે ! કેમકે એના મોહ છોડી સમ્યગ્દર્શનાદિમાં સ્થિર રહેવાનું એમનામાં સત્ત્વ નથી. એના માટે સત્ત્વ જોઈએ છે. મોટાં રાજ્યો સર કરવાની તૃષ્ણાથી જંગી યુદ્ધો જેલે કે કામરાગની પાછળ પ્રાણ સુધીની કુરબાની આપે એવા સત્ત્વની કિમત નથી, એમાં સાચું સત્ત્વ

નથી; કારણ કે ત્યાં પોતાના રાગાદિ આંતર દુશ્મનોની ભારે ગુલામી સેવાતી હોઈ નિઃસત્ત્વ દશા છે.

**સત્ત્વ શું ? :-**

પરંતુ હે પુત્રો ! સમજજો કે આત્મા એના શુદ્ધ સ્વરૂપમાં માત્ર નિર્ભળ જ્ઞાન-દર્શનના સ્વરૂપવાળો છે; પણ રાગદ્વેષાદિ મહિનતાવાળો નહિ ! વિશુદ્ધ અસંયોગિક આનંદવાળો છે, પરસંયોગાધીન શાતાઅશાતાવાળો નહિ ! અનું સત્ત્વ એ શુદ્ધ જ્ઞાન અને આનંદ છે; પણ એના પર કર્મના આવરણ ચઢી જવાથી એ ઢંકાઈ ગયા છે. એટલે પછી આત્મા રાગ-દ્વેષાદિની કંગાલિયતતા ભોગવે છે; નિઃસત્ત્વ, નિર્બળ અને અજ્ઞાન બની કખાયની પરિણાતિમાં નિરંતર મળન રહે છે. અને ખબર નથી કે જગતના ભાવોનું માત્ર દર્શન કરવાનું હોય, અમેંા લહેવાઈ-લપટાઈ જવાનું નહિ ! પણ સત્ત્વ નહિ હોવાથી પોતાના જ હદ્ય પર પોતાનો કાબુ નથી રહેતો, હદ્ય લહેવાઈ જાય છે, અને તેથી અમેંા મિથ્યાત્વ, અસંયમ, રાગ-દ્વેષ, મોહ-માયા, અને જડના વિકલ્પો વગેરે કોઈ અવગુણો ખદબદીને આત્માને દીર્ઘ દુર્ગીતિના પંથે ચઢાવી હે છે ! બસ, અહીં સત્ત્વ એ ખીલવવાનું છે કે હેઠું કાબુમાં રહે, જગતના ભાવોમાં લહેવાઈ ન જાય, રાગદ્વેષાદિને પરવશ ન થઈ જાય, અને દદ મને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમય જીવન જીવાય. સત્ત્વ કેળવવું હોય તો આ કેળવો; બાબી યુદ્ધો કરવામાં શા સત્ત્વ હતા ? ત્યાં તો નીતરતી આંતરશત્રુની ગુલામીમાં સત્ત્વહીનતા જ દેખાય છે. જેમ, માણસ ‘જુઓ હું કેવો બધાદુર હું’ એવા ગુમાનથી શાબાશી લેવા જો પોતાના જ પગ પર કુદાડો મારે તો તે મૂર્ખ ગણાય છે, એવી રીતે ‘બીજા કરતાં અમે નબળા નથી બળવાન છીએ,’ -એ શાબાશી લેવા સત્ત્વહીનપણે કખાયો અને કલહને પરવશ થઈ પોતાના આત્મા પર કુઠારાધાતથી ય મહાભયંકર પ્રહાર કરવા, એ સરાસર મૂર્ખતા છે.

**સર્પ કાંચણી ત્યજે તેમ મુનિ માનમદ ત્યજે :-**

હે પુષ્યવંતા પુત્રો ! ધ્યાનમાં લેજો કે મહામુનિઓ અથાગ સત્ત્વને વિસ્તારી, જેવી રીતે સર્પ કાંચણીને ત્યજીને ચાલ્યો જાય પછી એના સામું ય ન જુએ, તેવી રીતે માન, મદ, તૃષ્ણા વગેરેને પડતા મૂકી સંયમજીવનમાં ચાલ્યા જાય છે. અને એવા સત્ત્વશીલ રહે છે કે પછી એનો વિચાર સરખો ય કરતા નથી. માણસને અહંત્વ મારે છે, ‘હું ધણી, હું ધણિયાણી, હું બાપ, હું રાજા...તે હું એકદમ છોડી દઉં તો કેવો લાગું !’ - આ માન નડે છે. એમ જીવને તૃષ્ણા પીડે છે, રાગાદિ પીડે છે. તેથી જ, જેમ પેટના દર્દથી પીડાતો ઉત્તમ જમાણ જમવાનું ગુમાવે, એમ આ કખાયોથી પીડાઈ રહેલો ભવ્ય મોક્ષમાર્ગ સાધી લેવાનું ચૂકે છે. સત્ત્વ

પ્રગટાવનારા મહીર્ષિઓ વિકટ સંયોગોમાં પણ એ માન, મદ વગેરેની લેશમાત્ર પીડાને વહોરતા નથી; અને મુક્તિના રાહે પોતાની સાધનામાં આગેકૂચ કરતા પોતે કોઈ પણ જીવને સહેજ પણ કલેશરૂપ નથી બનતા.

**પરપીડા કેમ ત્યજાય ? :-**

હે ચતુર પુરુષો ! ધ્યાલમાં લેવા જેવું છે કે જીવન જીવતાં એવા કેઈ પ્રસંગો આવે કે જ્યાં પોતાની સ્વાર્થપૂર્તિ કરવા માટે બીજા કુદ્ર જીવને પીડા આપવા, યાવત્ત અનો નાશ કરવા સુધી જીવ લલચાય; પરંતુ તે પોતાના જ રાગ, લોભ વગેરેની પરવશતાને લઈને બને છે; ત્યારે, મહામુનિઓને તેવી કોઈ સ્વાર્થપૂર્તિ કરવી નથી, કે રાગાદિની અંશ માત્ર પરવશતા નથી, તેથી શું કામ કોઈ એક પણ જીવને સહેજ પણ દુભવે ? ત્યારે શું પરને પીડા આચ્યા પછી અનો પડધો નથી પડતો ? યાદ રાખો,

**પરાભવનું ફળ :-**

‘જો પરભવઙ્ગ પરં જણં, સંસારે પરિયતઙ્ગ મહં ।’

-જે બીજા જીવનો પરાભવ કરે છે, એ સંસારમાં બહુ કાળ ભટકે છે. એક ભવમાંથી બીજા ભવમાં, એક દુઃખમાંથી બીજા દુઃખમાં, એક પરાધીનતામાંથી બીજી પરાધીનતામાં, એક પુદ્ગળ પરથી બીજા પુદ્ગળ પર, એક ચિંતામાંથી બીજી ચિંતામાં, એક કર્મના ઉદ્યમાંથી બીજા કર્મના ઉદ્યમાં,...એમ કેટલીય જતના પરિવર્તન વેઠે જાય છે ! માટે જ કહેવાય કે,

**‘પરોપકાર: પુણ્યાય, પાપાય પરપીડનમ् ।’**

પરોપકાર, પરદ્યા, એ પુણ્યદાયી છે, અને પરપીડા એ પાપઅર્જક છે. વાત પણ સાચી છે, બાવળ વાવીને કેરી ક્યાંથી ઉગાડી શકાય ? કોઈને તાંબિયા પેસા ધીર્યા ઉપર એની પાસેથી હીરામાણેક પાછા ક્યાંથી મેળવી શકાય ? બીજાને દુઃખ-અશાતાના દાન દીધા પછી સુખ-શાતા મળવાની શી આશા રાખી શકાય ? ત્યારે ઘરવાસમાં કમ રથાવર જીવને માર માર કર્યા સ્વિવાય કયાં રહેવાય છે ? તો અનું ફળ શું આવવાનું ? એના બદલામાં શું મળવાનું ?

**મોહશાસનથી ધર્મશાસન વડું કેમ ? :-**

હે સોભાગી જીવો ! એટલું તો વિચારો કે આ સર્વોચ્ચ ભવ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય સાંપડ્યા ઉપર શું પરપીડામય દુર્ભાગી જીવન જીવવામાં શોભા છે ? તે પણ શું મદ-માયાની ચક્કીમાં પિસાયા કરવાનું દૌર્ભાગ્ય વેઠીને ? જરા નજર નાખો પૂર્વના ચકવતી સરખા મહાવૈભવી જીવોના ચારિત્રજીવન પર ! એમના

વैભવ-વિલાસમાં શી ખામી હતી ? એમની સત્તા, હકુરાઈ અને દમામમાં શી કહીના હતી ? છતાં સાધુછુણવન લીધા પછી એ શા સારું પોતાના પૂર્વદીક્ષિત એક દાસના દાસ સાધુના ચરણમાં માથું જુકાવી વંદના કરે ? પોતાના ચકવર્તી સમાટપણાની જહાંગીરશાહી વખતે પોતાના એક નોકરનો પણ જે નોકર હતો, એ હવે મુનિ બની ગયેલ છે, અને પોતે એની પછી મુનિદીક્ષા લે છે, તો એના પગમાં પડી નમસ્કાર કરવામાં એને કેમ લજ્જા નથી આવતી ? તેમ એ વંદના લેનાર મુનિને આવા ચકવર્તી મુનિ વંદનાની મળવા બદલ કેમ અભિમાન નથી થતું ? મોહશાસન મૂકીને ધર્મશાસન પામ્યાની આ બલિહારી છે કે એક વખતનો ઊંચો નીચાને નમતાં શરમાવતો નથી, કેમકે એને માન-મદ નથી; ત્યારે એક સમયનો નીચો નમન લેતાં ફુલાતો નથી; કારણ કે એ પણ મદ અભિમાનથી દૂર ને દૂર રહે છે. બાકી મોહના શાસનમાં તો ઓછા પુષ્યવાળાને ય ખુમારી હોય છે, ને વહુ પુષ્ય ધરાવનારા ય અહંકારના ઘોડાપૂરમાં તશાઈ જાય છે ! મોહરાજાની આ કરામત છે કે જીવની કાનપદ્ધી જાલીને એને એવી ભ્રમણા કરાવે કે- ‘હું કમ નથી, કાયો નથી ! હું તો પહોંચ્યો છું, પાવર્યો છું. હું શાનો દબાઉ ? શાનો ગાંઝ્યો જાઉ ?’... આમ ભ્રમણા સેવી સેવીને જાતે જ પાયમાલ થાય છે ! અંતે તો વળવાનું-ટકવાનું કાંઈ જ નહિ, છતાં કર્મ એની સામે કોઈ એક ઓહું ગમે તે નિમિત્ત ધરીને એને ચીડું છે ! મદમાં નચાવે છે ! બાલિશ જીવને ભાન નથી કે- ‘એક રે દિવસ એવો આવશે, જ્યારે હું ય નહિ હોઉં, ને સામેનું નિમિત્તે ય નહિ હોય ! ને મદમાં સડી મર્યાના દારુણ વિપાક મારે ભોગવવા પડશે !’ આ ભાન હોય તો શેખી શાના ઉપર ?

**મુનિઓ દૂરદર્શી, અતીત-અનાગતદર્શી :-**

હે વીરો ! વીરતા તો તે મહામુનિઓની યાદ કરો કે જે એ વસ્તુને બરાબર સમજતા હોય છે, તેથી જ એ

**‘દૂરમણુપસ્સયા મુણીડતીતમળાગયં તહા ।’**

-દૂર અતિદૂરવર્તી મોક્ષ તરફ એ મીટ માંડી રહ્યા હોય છે; ‘ક્યારે હવે જલદી મોક્ષ મળે ? કેમ મોક્ષની નિકટ નિકટ પહોંચી જવાય ?’ એ તમન્નામાં હોય છે; અને મોક્ષ એટલે તો સર્વથા મદરહિત સ્વસ્થ વીતરાગ અવસ્થા; તો ‘કેવી રીતે એ મદના સર્વથા ભુક્કા કરી નાખું ?’ એ માટે એ મુનિઓ જીવોની ભૂતકાળની સંસારમાંની ઊંચી-નીચી સ્થિતિ અને ગતિને જોનારા હોય છે. એ ઊંચી નીચી કેવી ? કર્મને પનારે પડ્યા જીવને એકવાર કુણ, લક્ષ્મી, સત્તા, હોશિયારી વગેરેના

શિખરે ચઢવાનું બને છે, તો બીજી વાર એની ખીડ્ઝોમાં પટકાવાનું બને છે ! ત્યા મદ-માન કર્યાના શા લેખા રહ્યા ? ઊલટું ભાવી સંસારમાંની ઊંચી-નીચી સ્થિતિ-ગતિઓમાં પાછું ચઢવા-પડવાનું ચાલુ જ રહે છે ! જેમાં ઉન્માદ-ઉદ્દેગ સિવાય બીજું કાંઈ જોવા મળતું નથી ! આનું હૂબહૂ નિરીક્ષણ કરનાર મહામુનિ જાતે મદના લેપથી સહેજ પણ લેપાતા નથી; તેમ મદભર્યા ભોગો અને પાપકિયાઓ આદિને લેશ પણ આવકારતા નથી.

**‘ધર્મસ્મ પારએ મુણી આરંભસ્મ અંતએ ઠિએ ।’**

-શુતર્ધમ અને ચારિત્રધર્મને પાર કરી ગયેલા મુનિ સાવદ્ય વ્યાપાર યાને પાપકિયાના છેડે ઊભેલા અર્થાત્ એનાથી સર્વથા રહિત બનેલા હોય છે.

**મહામુનિઓના પરાકર્માઓ :-**

હે બુદ્ધિમાન પુત્રો ! આ મહામુનિઓ દેવો નથી હોતા, તમારા જેવા મનુષ્યો જ હોય છે. છતાં એમનું સત્ત્વ, એમની બુદ્ધિમતા, અને એમનો પુરુષાર્થ જુઓ કે

રાગદ્વેષ અને મદમાયાને લેશ પણ મચક ન આપવા માટે ઠંડી વગેરેથી બચવા મુકામની બારી સરખી પણ બંધ કરતા નથી !

મન મોકણું કરવા કે બીજી ત્રીજી રક્ષા-સગવડ અર્થે કોઈની ય સાથે પ્રશ્ન-ઉત્તર કે વાતચીત સરખી કરતા નથી !

સૂર્યસ્ત થયે એક ડગ આગળ ચાલતા નથી, પછી ભલે ભયભર્યા સ્થાને ચાત્રિભર રહેવું પડે !

હે વીરો ! શું વીરતા તો આ કેળવવા જેવી ? કે એથી ઊલટી નામની વીરતા ને પોતાના રાગદ્વેષાદિથી હારવાની કાયરતા ? બુદ્ધિ, સત્ત્વ અને પુરુષાર્થ ક્યાં ફોરવવાના ? જુઓ કે

એ મહામુનિઓ તો અતિદૃષ્ટિ ઠંડી-ગરમી, ડાંસ-મચ્છર, પ્રહાર-પરાભવ વગેરે ઘોર પરીસહો અને દૈવી-માનવીય પ્રાણાન્ત સુધીના ભયંકર ઉપસર્ગોમાં એવા અડોલ અને ઉપશમ રસતરબોળ રહે છે કે એવા વખતે શરીરે રોમાંચ ખડ થઈ જવા વગેરે કોઈ વિકાર એમનામાં જાગતો નથી. કોઈ અરેરાટી, કોઈ હાય કે વોય, કોઈ સિલ્કારી કે આંતર ઊકારો, કશું જ એ થવા દેતા નથી. કેટલી વીરતાભરી ભવ્ય નિષ્ઠકંપતા-નિર્વિકારતા !

પરાકર્મ જ ખેડાવા હોય તો આ સ્થિતિએ પહોંચવાના ખેડો કે પછી કોઈ કાયાના ચામડાં ઊરડી નાખે કે આખા ને આખા સણગાવી મુકે છતાં લેશમાત્ર

ચૂકારો-ઉંકારો ન થાય કે કોઈ દ્વેષ-દીનતાનો વિકાર થાય નહિ.

અહીં વિચાર થઈ પડશે કે જરા છોલામણ કે તણખામાં ઝણજણાટી થઈ જતી હોય ત્યાં આ તે શી રીતે બને ?

પરંતુ એ નિર્ભળતાનું કારણ તો એ છે કે પોતાના આત્મસ્વરૂપનો વિચાર નથી કરવામાં આવતો.

આત્મસ્વરૂપની ભાવના :-

આત્મસ્વરૂપનું વારંવાર ચિંતન જોઈએ, ખૂબ ખૂબ ભાવના ભાવવી જોઈએ. વારંવારની એક સરખી ભાવના દીર્ઘકાળ સુધી કર્યા કરવાથી આત્મા અને મન એવા ભાવિત થઈ જાય છે કે પછી વસ્તુને તે સ્વરૂપે જાણે સાક્ષાત् અનુભવે છે. ભાવનાના એક પ્રકાર તરીકે આત્મસ્વરૂપની એ રીતે ભાવના કેળવવી જોઈએ કે, ‘મારો આત્મા એટલે કે ચેતન એવો હું સ્ફટિક રતની જેમ નિર્મણ અને અક્ષય છું. મારામાં નથી તો કોઈ રાગદ્વેષાદ્ધિના ડાઢ લાગતા, કે નથી તો કોઈ છેદન-ભેદન વગેરે થઈ શકતું.’ કલ્પના કરાય કે, ‘જાણે મને કોઈ હીરામાણેકની પેટીઓ ભેટ ધરવા આવે છે, અથવા પૃથ્વીનું સામ્રાજ્ય સોંપવા તૈયાર થાય છે, અગર તો જાણે કોઈ મારું સર્વસ્વ લૂંટવા આવે છે, છતાં નિર્મણ દર્પણ જેવો હું આત્મા માત્ર એનું શુદ્ધ દર્શન કરી રહ્યો છું, પણ કોઈ જ રાગ, દ્વેષ કે હર્ષ, ઉદ્દેગ વગેરે વિકાર હું અનુભવતો નથી. એમ જાણે શરીરમાંથી માંસના લોચા કપાવા માર્દે છે, કે શરીર જાણે સણગવા લાગે છે, છતાં હું જરાય કપાતો નથી કે સણગતો નથી; એવો હું વજથી અધિક કઠિન છું, અવિકાર અને અવિનાશી છું.’ આવી આવી વિવિધ ભાવના વારંવાર કરવામાં આવે તો ખરા ગ્રસંગના અવસરે અંશે પણ નિર્વિકારતાનો અનુભવ કરી શકાય.

સમભાવથી ભયનો અભાવ :-

હે સુજ્ઞ પુરુષો ! સત્ત્વશીલ મહામુનિઓ ત્યાં સુધીના સામાયિક-ભાવમાં ચઢેલા હોય છે કે ભયંકર ઉપસર્ગોમાં પણ એ રોમાંચ, કંપ વગેરે કોઈ જ વિકાર જાગવા દેતા નથી; અને,

‘સામાઇયમાહુ તસ્સ જં, જો અપ્પાણ ભાએ ન દંસએ ।’

-સામાયિક પણ તેને કહે છે કે જ્યાં સમભાવને આત્મસાત્ત કરવાના હિસાબે કોઈપણ પ્રકારના ભયને પરવશ થવાનું હોતું નથી. સમભાવ જગાડ્યો છે એટલે જીવન-મરણ, શત્રુ-મિત્ર, સુખ-દુઃખ, ઈત્યાદિ પ્રત્યે સમદિષ્ટ છે, બેમાંથી એકે ય સારું-નરસું કે આદર-અનાદર યોગ્ય લાગતું નથી. પછી શા માટે દુશ્મન, દુઃખ, કે

મરણનો ઉપસર્ગ ઉપસ્થિત થતાં ભય થાય ? જીવન મરણાદિ પર આ સમદિષ્ટ એટલા માટે છે કે એ બધું પર છે; તો પરની પાછળ ઘસડાવા કે ભય પામવાનું શા સારું કરવું ? માટે જ ‘ચાલો, ઉપસર્ગ વેઠવાથી પરજનોની પ્રશંસા મળશે, અગર પરભવે સ્વર્ગાદિનું જીવન મળશે’ એવી લાલસા પણ હોતી નથી. વિચારવા જેવું એ છે કે મનુષ્ય જીવન પામીને કેઈ જીતના સત્ત્વ અને વિવેક જગાવી શકાય, કેવા પરાકરમ આદરી શકાય ? અને કેવા ઊંચા વિકાસ સાધી શકાય ?

દિવ્ય, માનવીય અને પાશવી કર્તવ્યના વિભાગ :- હે નરરત્નો ! આ અણમોલા સમયના કર્તવ્ય પરખો; ક્યાં કર્તવ્ય દિવ્ય ? ક્યાં માનવીય ? ને ક્યાં પાશવી ? ચાલુ જીવન સરખાવતાં ચોકી ઉઠશો ! દિવ્ય કર્તવ્યો બજાવવા માટે તો મહર્ષિનું જીવન અપનાવવું પડશે, અને ત્યાં,

(૧) પૂર્વ ભોગવેલા ઈષ્ટ વિષયોનું સ્મરણ પણ કરવાનું હોતું નથી; કેમકે એ વાસનાને ઉત્સર્જિત કરનારું છે. સાથે,

(૨) સર્વથા કષાય મુક્ત થવાની ચિંતા રાખ્યા કરવાની હોય છે. તેમજ

(૩) ઈષ્ટાનિષ્ટ વિષયોમાં મનને મુદ્દલ લઈ જવાનું હોતું નથી.

આ જે કરી જાણે તે જ ભવ્ય સમાધિનો અનુભવ કરી શકે છે. જેમ વિજયી જુગારી ૧,૨,૩ આંક નહિ પણ ચોકિયાને પકડનારો હોય છે, તેમ બુદ્ધિમાન પુરુષ ગૃહસ્થધર્મ, મિથ્યામતિના ધર્મ અને કુગુરુ પાસસ્થાદ્ધિના ધર્મને ત્યજી યત્યિધમને વળગનારો હોય છે.

દિવ્ય કર્તવ્યના સાદને ધ્યાન પર લો, દિવ્ય કર્તવ્યના સ્વાદને જીવનમાં અનુભવો.

હે દીર્ઘદર્શી પુત્રો ! સૂક્ષ્મતાથી જોશો તો જણાશે કે

ઉત્તરમણુયાણ આહિયા, ગામધમ્મા ઇઝ મે અણુસુયં ।

જંસી વિરયા સમુદ્ધિયા કાસવસ્સ અણુધમ્મચારિણો ॥’

- ઉત્તમ મનુષ્યોને માટે વિષયો એ તો ગામદિયાપણાના પ્રદર્શક છે. માટે એનાથી વિરામ પામી, અર્થાત્ પ્રતિજ્ઞાપૂર્વક એના ત્યાગી બની, એ ભવ્યાત્માઓ તીર્થકર ભગવાનના અનુયાયી બનનારા હોય છે ! આ જગતમાં અર્હત્ પરમાત્માના અનુયાયી બનવાથી અધિક કર્તવ્ય પંડિતો માટે શું હોઈ શકે ? અણાન જીવોને દીર્ઘ કે વિશાળ દિષ્ટ હોતી નથી તેથી,

‘વિંત પસવો ય નાડ્યાઓ, તં બાલે સરણ તિ મનઙ્દ’ ।

-અણાન જીવો ધન, પશુ અને સગાંસંબંધીને શરણ તરીકે સ્વીકારે છે. જાણે

અનાથી જ સુખ અને સંરક્ષણ મળશે એમ માની એની જ ચિંતા અને સેવામાં રચ્યો  
પચ્યો રહે છે. પરંતુ એમાં પોતે જ ઉપાર્જિતા કર્મો વડે એ આ સંસારમાં, અનેકાનેક  
જન્મ-જરા-મૃત્યુના ઉપદ્રવોથી પીડાય છે ! કેવી વિટંબણા ! અશરણને શરણ તરીકે  
સેવવા પાછળ કચી દુર્દ્શા ! વિચારજો કે શું પર, વિનાશી અને વિપત્તિકારી ધન-  
પશુ-સગાં એ શરણ આપે ? કે સ્વકીય, અવિનાશી અને સંરક્ષક યત્નધર્મ જ એ  
શરણ આપી શકે ?

ઇણમેવ ખરણ વિયાળિયા, ણો સુલભં બોહિં ચ આહિએ ।  
તિવિહેણ વિ પાણ મા હણે, આહિયતે અણિયાણ સંબુદે ।  
એવં સિદ્ધા અણંતસો, સંપદ જે અ અણાગણ વરે ॥'

વર્તમાન દુર્લભ ક્ષણને પિછાણો :-

હે મહાભાગ ! આ જન્મની અપૂર્વ ક્ષણનાં યોગ્ય મૂલ્યાંકન કરો. આ તે  
ક્ષણ છે, તે અવસર છે, કે જ્યાં પ્રતિકૂળતા આવકારવા દ્વારા સંસારમાં સામા પૂરે  
જઈ શકાય, અને છતાં આશ્રય છે કે મુક્તિના કિનારે પહોંચી શકાય ! અને  
મુક્તિએ પહોંચ્યા પછી માથે કોઈ સત્તાધીશ નથી, પરાભવ કરનાર નથી, શરુ  
નથી, કે કલેશ દુઃખનું કોઈ જ નિમિત્ત નથી. આ તે અવસર છે કે જ્યાં  
સમ્યગ્દર્શનાંદિ રત્નત્રધીના ઉત્તમ વ્યાપાર કરી શકાય. બીજા ત્રીજા વ્યાપાર ખેડવાના  
ભવ ધણા, રત્નત્રધીના વ્યાપાર ખેડવાનો ભવ માત્ર એક મનુષ્યભવ, અને તે પણ  
માત્ર સામચીસંપન્ન માનવભવ ! તો શા માટે એની એ પ્રમાણે કદર કરતા  
નથી ? ને અન્ય ભવ સુલભ ક્ષણાય પ્રવૃત્તિમાં શા સારું તણાઈ રહ્યા છે ?

બોધિ ફરીથી દુર્લભ છે :-

ધ્યાનમાં રાખજો કે આવી ક્ષણ, આવો મનુષ્ય ભવ તો દુર્લભ છે જ, પણ  
વિશેષ કરીને બોધિ યાને હિત પ્રાપ્તિ અહિત ત્યાગ અત્યંત દુર્લભ છે. અહીં એને  
આદરી શકો એ સુલભ બન્યું છે, છતાં જો નહિ આદરો તો પરભવે તો એ ક્યાંથી  
જ પ્રાપ્ત કરી શકશે ? કેમકે અહીં છતી સગવડે એની ઉપેક્ષા એ એવા મોહનીય  
કર્મને દઢ કરે છે કે જે પરભવે મહાવિઘ્નભૂત બને છે. સંસારમાં જન્મયું સાર્થક  
થવાનો આધાર સારા જીવન પર છે. સારું જીવન એટલે જન્મ-મરણની જંજાળનો  
અંત લાવે તેવું જીવન. એ અંત થવાનો આધાર સંબોધિ પ્રાપ્ત કરવા ઉપર છે.

નિવિધ-ત્રિવિધે હિંસા ત્યજો; નિદાન ત્યજો : સંવર કરો :-

સંબોધિમાં જે અહિતનો ત્યાગ કરવાનો છે, તેમાં પહેલું તો જીવમાત્રની  
હિંસાનો નિવિધ-ત્રિવિધે ત્યાગ કરવાનો છે. ‘કોઈ પણ જીવને મનથી, વચ્ચનથી,

અને કાયાથી મારું નહિ, મરાવું નહિ, ને મારતાને અનુમોદું નહિ;’ એ રીતે  
પ્રતિજ્ઞાપૂર્વક હિંસાત્યાગ કરવાનો છે, જીવમાત્ર પ્રત્યે, ચાચ તે આપણો માથાવાઢ  
દુશ્મન હોય, એની ઉપર પણ આપણા દિલની આ દ્યાભરી કોમળતા વિના સકલ  
કર્મનું નિરાકરણ થઈ શકે એમ નથી. ઉલાંહ હિંસાથી, તો કર્મના ભાર વધે છે.


અહિત ત્યાગમાં બીજું, કોઈપણ પ્રકારનું નિયાણું કરવાનું નથી. અર્થાત્ પર  
પુદ્ગલ માત્રની આશાસા ત્યજ દેવાની છે. ધર્મના ફળરૂપે ય નહિ, ને વર્તમાન  
આકંક્ષારૂપે ય નહિ.

હિતના આદર તરીકે સંવર આદરવાનો છે. સંવર એટલે જગતમાં જેટલાં  
પાપસ્થાનક કહેવાય છે, એ સર્વથી નિવૃત્ત થવું તે. આગળ વધતાં કિયા માત્રથી  
પાછા હટવાનું છે, અને અયોગી કેવળી બનવાનું છે.

હે પુષ્યવાનો ! આમ કરીને આજ પૂર્વ અનંતા ઉત્તમ આત્મા સિદ્ધિપદને  
પામ્યા છે, વર્તમાનમાં ય ઉત્તમ જીવો એ રીતે સિદ્ધિપદ પામે છે, અને ભવિષ્યમાં  
પણ પામશે. તો તમારે ય એમનો રાહ પકડી જીવનને સુંદર સફલતા પમાડવા  
જેવી છે. જે કાંઈ વિચારણા કરવાની છે તે આંખ મિંચાયા પહેલાં કરજો. આંખ  
મિંચાયા પછી, જીવનદોરી કપાયા પછી, એક પણ વિચારણાને અવકાશ  
નહિ મળે.”

આ સાંભળીને અદ્ધાણું ય પુત્રો ભરત પ્રત્યેની દુશ્મનાવટને તો શું, પણ  
આખા ય સંસારમોહને વિસરી ગયા, મોહ મૂકી દીધો અને પ્રભુ પાસે ચારિત્ર લઈ  
સ્વ-પરના તારક બની ગયા.

•\*• •\*• •\*•



## ચંડકોશિયાનું દૃષ્ટાન્ત

દ્વિ-ક્ષેત્ર-કાલ-ભાવથી પહેલા ભવનું પ્રમાણ :-

જ્ઞાનભેદ ગ્રભુએ અણાણું પુત્રોને આપેલી એજ દેશના આપણે પણ વિચારવાની છે. આંખ મીચાયા પછી કાંઈ નહિ વળે. પછી પાછું આનું આ મોહનું નાટક ચાલુ રહેશે, કદાચ ભવાંતરમાં વૃદ્ધિ પામશે.

પ્ર.- વૃદ્ધિ શી રીતે ?

૬.- ચંડકોશિયાનો પ્રસંગ યાદ કરો. દરેક ભવે દ્વિથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી એનો ગુસ્સો વધતો ચાલ્યો, જન્મે જન્મે વધતો ગયો. પ્રથમ સાધુના ભવમાં માત્ર એક કુલ્લક સાધુ પર ગુસ્સો કર્યો હતો એટલે દ્વિથી, એક વ્યક્તિ પર ગુસ્સો હતો, ક્ષેત્રથી, ઉપાશ્રયમાં રહેનાર એ સાધુ પ્રત્યે હતો એટલે એટલા ક્ષેત્ર પૂરતો હતો; કાલથી, તો કેટલો જ કાલ, કેમકે લગભગ જીવનના અંતકાલે આ બનાવ બનેલ છે, ભાવથી, એક માત્ર દંડો અને તે એક વાર ઠોકવાની બૃદ્ધિ હતી, ‘આ બહુ વાચાલ છે, જરા દંડો મારી સીધો કરી દઉં,’ આ રીતે દંડો મારવા પૂરતો ગુસ્સો હતો, મારી નાખવાની બૃદ્ધિ નહોતી. સાધુથી દેડકી મરી હશે, કુલ્લક સાધુ મહારાજને પ્રાયશ્વિતની યાદી કરાવતો હતો, એ માનતો ‘મહારાજ ભૂતી ગયા,’ એટલે ‘મહારાજ પેલી દેડકી,’ એમ બોલી પ્રાયશ્વિત માટે યાદ કરાવતો હતો. સાધુને થયું, આજે આને દેડકી ભૂલાવી દઉં, સાંજે તો ન બોલ્યા; રાત્રે દંડો લઈને આવેશમાં દોડ્યા ઠોકવા કુલ્લકને, અંધારે કાંઈ દેખાયું નહિ, વચ્ચે એક થાંબલે જોરથી પટકાયા, માથું ફૂટી ગયું, કાલ કરી ગયા. ચારિત્ર પાણ્યું હતું, એટલે જ્યોતિષ લોકમાં દેવ થયા.

દ્વિ-ક્ષેત્ર-કાલ-ભાવથી ગુસ્સાનું બીજા ભવનું પ્રમાણ :-

ત્યાર પછી તાપસ થયા. ત્યારનું ગુસ્સાનું પ્રમાણ તપાસો. ત્યાં ગુસ્સાના દ્વિ-ક્ષેત્ર-કાલ-ભાવનું પ્રમાણ વધ્યું. દ્વિથી, જે ફલ લેવા આવે તે તમામ પર ગુસ્સો હતો, ‘બતાવી દઉં જે ફલ લેવા આવે એને !’ ક્ષેત્ર વધ્યું, વાડી સુધી ગયું જો જો પહેલા ભવમાં દ્વિથી એક વ્યક્તિ હતી, ક્ષેત્રમાં માત્ર ઉપાશ્રય હતો.

કાલથી, પ્રથમ ભવમાં જોયું કે જીવનના અંતકાલે બનેલું એટલે ઘણો ઓછો કાલ ! જ્યારે આ ભવમાં એની માલિકી પછી જ્યારે જ્યારે લગભગ વાડી ખીલવા માંડી અને ખીલેલી રહી તેટલા તેટલા કાળ માટે બતાવી દેવાની ભાવનાનો ગુસ્સો રહ્યો. ભાવથી, પ્રથમ ભવમાં તો દંડ પૂરતી વાત હતી, હવે ‘બસ મારું, એવો મારું કે હરામખોર ખોડ ભૂલી જાય, એ શિક્ષા જોઈને બીજો આવે નહિ,’ વધ્યું પ્રમાણ.

દ્વિ-ક્ષેત્ર-કાલ-ભાવથી ગુસ્સાનું બીજા ભવનું પ્રમાણ :-

ત્યાંથી પછી પ્રમાણ તપાસો ચંડકોશિયા સર્પના ભવનું. તાપસ મરીને સર્પ થયો, લોકોએ એનું નામ ચંડકોશિયો પાછ્યું. શાથી ? તાપસનું નામ કૌશિક હતું. અતિ કોધી હોવાથી એને ચંડકોશિક કહેતા. એકવાર રાજકુમાર ફળ લેવા આવેલ; એને મારવા ફરસી લઈને આ તાપસ દોડ્યો ! વચ્ચે ફૂવો આવ્યો, તાપસ પડી ગયો, ફરસી પોતાને જ ભોંકાઈ, મરી ગયો ! એ મરીને સર્પ થયો ! તાપસ મનુષ્યપણામાંથી ભષ થઈ હવે પટકાયો તિર્યચપણામાં ! તે પણ હલકા હિંસક સર્પપણામાં ! કષાયોની જોહુકમી જોજો. જરાક શું સ્વમાન ઘવાતું લાગ્યું એના ઉપર સાધુએ સાધુ પર કષાય કર્યો, તો એ કષાય એવો ફાલ્યો-ફૂલ્યો કે તાપસપણું પામ્યા છતાં એને ફૂર અને વિકરાળ બનાવ્યો. પછી કર્મને ક્યાં શરમ છે ? પટક્યો સર્પયોનીમાં ! પૂર્વ નામના હિસાબે ગ્રભુએ એને ‘બુજુજ બુજુજ ચંડકોશિયા !’ કહ્યું, તેમાંથી એ સર્પનું નામ ચંડકોશિક થયું. બાકી તો સર્પનું નામ પાડવા કોઈ ફોઈ થોડી જ હતી ? હવે કષાયનું પ્રમાણ વધ્યું. દ્વિ-ક્ષેત્ર-કાલ-ભાવ, એ ચારના પ્રમાણે માજા મૂકી ! તાપસના ભવમાં દ્વિ હતું, ફલ લેવા આવે તેટલા પૂરતું; હવે જે કોઈ આવે, પછી ભલેને પરમ તારક મહાવીર મહારાજા હોય, એમને ય ઝેરી દંશ દેતાં વાર નહિ, વિચાર નહિ ! આ શાનો પ્રતાપ ? માનવ ભવમાં આંતર દુશ્મનનો આદર કર્યો, તો નતીજો એ આવ્યો કે એ ફાલ્યો-ફૂલ્યો ! ક્ષેત્રથી પ્રથમના તાપસના ભવમાં તો નજીક આવે તેટલા પૂરતું પ્રમાણ હતું, હવે ‘નજીક આવે તેને ડસી મારી નાખું, એટલું જ નહિ પણ દૂરથી દેખું તો દાખિ ફેંકી પ્રમાણ લઉં !’ આ થયું. એ દાખિ વિષ સર્પ હતો. કાલથી જોતાં તાપસના ભવમાં બાલપણથી તો ન હોય ને ? આ તો જન્મથી, ભવ જ સર્પનો ! અને ભાવથી ! ‘બસ ! મારી જ નાખું !’ કેઈ પશુ-ખંખી અને માનવોના મડદાં પાડ્યાં ! યાવત્તે જંગલની વનરાજ ખાખ કરી નાખી ! પરાકાણાએ પરમાત્મા મહાવીરદેવને મારી નાખવા ઉસ્યો !

## પ્રમાણની વૃદ્ધિની માત્રા પરમાત્મા સુધી પહોંચી :-

ભગવાન તો ત્યાં જાણીને જ પથાર્યી હતા. જાણતા જ હતા, એ કરડશે, ભલે કરે પણ પ્રતિબોધ કરવો છે. સાપને દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવનું એ કોધને અંગે પ્રમાણ એટલું વધી ગયું, ન પૂછો વાત ! ત્રણ લોકના તારણાહાર, જગત માત્રાના જીવો પર અપરંપાર કુરુણા ધરનાર, ભયંકરમાં ભયંકર દુશ્મન માટે પણ એકાંત વાત્સલ્યમય હદ્યવાળા, એવા એમને ય બચકુ ભરતાં, દંશ મારતાં વાર ન કરી ! એ ભગવાનને દાખિથી કાંઈ ન કરી શક્યો, બચકુ ભરીને પણ અંદર ઝેર દાખલ ન કરી શક્યો, માત્ર ચામડી તોડી શક્યો, પછી શું જોયું ? ઉજ્જવલ, ગાયના દૂધ જેવા લોહીની ધારા બહાર નીકળી ! એ થંભ્યો, વિચારમાં પડ્યો. ત્યાં ભગવાને હવે અવસર જોઈ કહ્યું, ‘બુજ્જ બુજ્જ, ચંડકોશિયા !’ આપણે આટલા પ્રસંગ પૂરતું દાખાંત છે.

## કાળ વાનરના જડભામાં નાચવાનું -કૂદવાનું કેવું ? :-

ऋષભદેવ ભગવાન અણ્ણાણું પુત્રોને સમજાવે છે. ‘જે મનુષ્ય માનવજીવનમાં આંતર દુશ્મનનોને વધારી જગતને દ્રબ્દવાળા કોડ સેવે છે, કરપીણ કાળ રાજી એની સામે અણ્ણાસ્ય કરી રહ્યો છે !’

જંગલના વાંદરાના મોંમાં વડનો ટેટો પેઠો. એ ટેટામાં કીડા કૂદ કૂદ કરી રહ્યા છે, પણ તે ક્યાં સુધી ? વાંદરો જડનું ન દાબે ત્યાં સુધી જ ને ? વાંદરો જડનું દાબે એટલે ટેટો ચચાઈ જાય, ને અંદરના રસમાં આસક્ત કીડા ખતમ થઈ જાય ! તો ‘કાળ વાનરના જડભામાં રહી અર્થકામ રૂપ ટેટામાંના જીવે કૂદવાનું હોય ? સંસારના મૂળસમાં આરંભ-સમારંભનું મૂળ અર્થ-કામ છે.’ ભગવાને અણ્ણાણુંને આ વાત સમજાવી દીધી, સાધુ બનાવ્યા, ઉદ્વર્યો.

## ક્યાં પરમાત્માની વડાઈ ? :-

આ ભગવાને શું કર્યું ? જગતની દાખિએ ન્યાયી ગણાતા એવા એક નહિ, બે નહિ પણ સામટા અણ્ણાણુંને રાગ-દ્રેષ્ટમાં ઘદબદદા અને ઘોર કર્મના કંલખાનામાં ધકેલાઈ જતા જોઈ એમનો સંસારનો રંગ ઉત્તરાવી ચારિત્રના રંગવાળા બનાવ્યા ! બીજી તરફ ગીતામાંનો પ્રસંગ વિચારો; તેઓ કૃષ્ણને પરમાત્મા માને છે. અર્જુનને તેમનો ભક્ત માને છે. યુદ્ધ પ્રસંગે કુરુક્ષેત્રમાં અર્જુન નજર નાખીને કહે છે : “આ કોણ ? પિતામહ ભીખ, ગુરુ દ્રોષાચાર્ય, વડીલો, બધુજનો ! શું આમને મારીને રાજસંપત્તિ લઉં ? નથી જોઈતી મારે એ ! દુર્યોધન ગાદી ન આપે તો ન સહી, જંગલમાં રહીશું, ત્યાં અમને બહુ આનંદ હતો, હજ આનંદ રહેશે, ભીખ માર્ગિશ એ હા પણ આ યુદ્ધ નહિ થાય, હરગીજ નહિ થાય.” ના પારી યુદ્ધ કરવાની. શ્રી

કૃષ્ણ કે જેમને પરમાત્મા કહેવામાં આવે છે તે વિરાગી બનેલા, યુદ્ધથી પરાઇનુભું બનેલા ભક્ત અર્જુનને શું કહે છે : “મૂર્ખો છે ! અજ્ઞાન છે ! કોઈ મરતું નથી, કોઈ મારતું નથી, આત્મા અમર છે, મરતો નથી. તારો આ વૈરાગ્ય નથી, કાયરતા છે. ક્લેબ્યં મા સ્મ ગમઃ પાર્થ ! હે અર્જુન નિર્બળતાને ન પામ...”

અહીં પ્રશ્ન થાય છે કે- ‘જો ! આત્મા મરતો નથી તો પછી આ પ્રયત્નની શી જરૂર ?’ પણ એ કોણ વિચારે ? એમના પરમાત્મા શ્રી કૃષ્ણ અર્જુનને હવે કહે છે : ‘તને અહંભાવ થયો છે, તને ખોટું ગુમાન થયું છે કે, બધું હું જ કરું છું. હું તને કહું છું કે જો તને પાપનો ડર લાગતો હોય તો તું મારા ચરણો સર્મર્પણ કર. તું જે કાંઈ કરે તે મારા ચરણો ધરી દે. જે કાંઈ તપ કરે, ખાય પીયે, જે કાંઈ કરે, મને અર્પા દે. નિરહંભાવે અને નિઃસ્વાર્થ ભાવે તું કિયા માત્ર કર્યે જા ! અહીં પણ મને સર્મર્પણ યુદ્ધક્રિયા કર.’ આમ કહીને જે કુરુક્ષેત્રનું યુદ્ધ અટકવાનું હતું તે શરૂ કરાયું, વિરાગી અર્જુનને યુદ્ધમાં ઉતાર્યો. આ પણ પરમાત્મા ! ઋષભદેવ પણ પરમાત્મા ! પણ પરમ આત્માનાં લક્ષણ કોનામાં ? બેમાં અંતર કેટલું ? એક રાગિદેશી થઈને લડવાનું પૂછવા આવેલાને વિરાગી બનાવ્યા ! એકે વિરાગી ભક્તને યુદ્ધથી પાછા હટવા હંચનારને મહારાગદ્રેષ ભર્યા યુદ્ધમાં ઉતાર્યો ! લોહીની નદી વહેતી કરાવી !

એ પરમાત્માએ પોતે જ કહું છે, આપણે નથી કહેતા, ગીતા કહે છે-

**યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત !**

.....સંભવામિ યુગે યુગે ॥

હે અર્જુન ! જ્યારે જ્યારે ધર્મની ગ્લાની થાય છે, ત્યારે ત્યારે અભ્યુદ્ય કરવા હું જન્મ લઉં છું.

**પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ् ।**

સાધુઓના રક્ષણ માટે અને પાપીઓના નાશ માટે જન્મ લઉં છું.

જાતનું ભાન ભૂલે એને કોણ બચાવે ?

પ્ર.- કોઈ ફરજ ભૂલે તો ભાન ન કરાવાય ?

ઉ.- ભાન કરાવાય પણ કષ્ટમાં રહીને, કષ્ટ બહાર જઈને નહિ.

આ પરમાત્મા (ऋષભદેવ)નો કિમિઓ તો જુઓ. લડવા તૈયાર થયેલા અણ્ણાણુને સંસારના ઉદ્વારક સાધુ સંત કર્યા ! ભરત રોતો થયો. અણ્ણાણુ સામે કહેણ મોકલનારો ભરત રોતે છે, ચોધાર આંસુથી રોતે છે, ચરણમાં પડે છે. ‘કહે છે, ‘ભગવાનના સાચા પુત્રો તમે છો, સપુત તમે છો, હું તો કમજાત કે સત્તાના

મદમાં ભાન ભૂલી, પિતાએ તમને આપેલા રાજ્ય તરફ નજર કરી !

પેલા પરમાત્માએ, લડાઈથી પાછા હટવા સુધી પહોંચેલા ભક્તને લડાઈમાં ઉતાર્યો. કુરુક્ષેત્રની લડાઈ બંધ રહેલી ઊભી કરી. કુરુક્ષેત્રનું યુદ્ધ થયું એટલે પતી ગયું ? ત્યાર પછી ભરત ભૂમિ પર યુદ્ધો ન થયાં ?

‘આતતાયીને હણવામાં પાપ નથી,’ બોલ્યા ! મિથ્યાજ્ઞાન છે ! પહેલાં તો દુર્ઘટન આતતાયી છે ? ને આતતાયી કોને કહેવો એ વિચારણીય છે. દુશ્મનને પણ જ્યાં મિત્ર માનવાનો છે, બનાવવાનો છે, ત્યાં ક્યાં ગયા ? હિંસા સુધી ગયા !

પ્ર.- સ્થાન કે વેશ ભાન ન કરાવે ?

૬.- સ્થાન પણ કરાવે, ને વેશ પણ ભાન કરાવે, કુલ પણ ભાન કરાવે. પણ કોને ? જેને જીતનું ભાન હોય એને ને ? વેશથી આત્માનું કલ્યાણ છે, જગતે માન્યું છે. ઉપદેશમાળામાં વેશના ગુણ ગાયા છે. રૂપવતી સ્ત્રી નીકળી, કદાચ ગૃહરથ નજર નાખી દેશે, પણ સાધુને એમ કરતાં વેશ અટકાવશે. મ્રસન્નચંદ્ર રાજર્ષિને દુધબિનિથી પાછા ફરવામાં એક કારણ વેશ હતું. વેશના ગુણા તો ગાયા, પણ સાથે જ કહું, વેશ હોય પણ ગુણા ન હોય તો કામ ન થાય, બચાવ ન થાય. વેશના પરિવર્તન માત્રથી કલ્યાણ નથી. જેરનું નામ અમૃત રાખી કોઈ ખાય તો ન મરે ? નામ પરિવર્તન કરે, રંગ પરિવર્તન કરે, સ્વાદ પરિવર્તન કરે. Sugar Cosated શુગર કોટેડ કરે, એવું જેર ખાય એટલે ન મરે ? અધમને ધર્મ કહેવાથી, હિંસાને અહિંસા કહેવાથી અહિંસા ન થઈ જાય. સ્વધંદે નાચે, જગતના પાઠ ભાષાવે એવાને વેશમાત્રના પરિવર્તનિથી શું વળે ? રાજ્ય છીનવી લેનારની હિંસામાં ધર્મ હોય એવું શ્રી વીતરાગના શાસનમાં ક્યાંય જાહ્યું છે ?

પ્ર.- કાલિક્સૂરિનો પ્રસંગ ?

૭.- કાલિક્સૂરિનો દાખલો લીધો ! એ આખો પ્રસંગ જુદો છે. સાધ્વી સંસ્થા પર આઝી છે, જુલમ થઈ જાય ! આધિદશમાં આ આઝીત ? પોતાની બેન છે માટે ગયા એમ નહિ પણ તેઓ કેમ ગયા ? સામે સાધ્વી છે માટે. પ્રશ્ન સાધ્વી-સંસ્થાનો છે. રાજાએ સાધ્વીને કેદ પૂરી છે, એનું શીલ લૂંટવા માટે. બચાવવાના અનેક પ્રયત્નો પછી આ માર્ગ લીધો છે. સાધ્વીને બચાવવા પૂરતું જ આ કામ. જે ગર્દભીલ રાજ સાધ્વીને પકડી ગયો છે તેની પાસે ગર્દભી નામની વિદ્યા છે. એ વિદ્યા યોગે એ રાજ ગઢેલીનું રૂપ કરી ભૂકે, એનો અવાજ સાંભળનારા ડેઢા પડી જાય, ભોંય ભેગા થઈ જાય. આમણે શબ્દવેધી દસ્તિવેધી સુભટો કબજે કર્યા, લડવામાં કરવાનું એક જ, ભૂકવા માટે ગઢેલી બનેલા (બીજાનું ભૂરું કરવા એકવાર

ભૂવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ” (ભાગ-૧૮)

૨૮૮

ગઢેલી બનાય છે !) ગર્દભીલ રાજાના (ગઢેલીના) મોંને બાણોથી ભરી દેવું- મોંને પહોળું કરે કે ભૂકતાં પહેલાં - અવાજ કરતાં પહેલાં કે જરાક અવાજ થતાં એ મોંને બાણોથી ભરી દેવું કે અવાજ ન કરી શકે. આ રીતે એ રાજાને પકડીને સાધ્વીને છોડાવી છે.

બે તાબોટા જીલવા, આ ? :-

આવો દાખલો ક્યાં લાગુ કરાય છે ? ‘કોઈ અનીતિ કરે, ચોરી કરે, બસ એને મારો ! કાપો !’ આમ મરાશે, કપાશે તો પછી જગતમાં જીવાડનાર કોણ ? જગતના સમ્યગ્ વ્યવહારનો ઠેકો લઈ શકાય ? એમ તો દુનિયામાં ખૂણોખાંચરે કેઈ અનાડીપણું કરનારા હોય છે. ઈશ્વર કેમ એમનો નિગ્રહ કરતા કરાવતા નથી ? કહો ને એ શક્ય જ નથી. અલબત સત્તાધીશો અનાડીઓનો નિગ્રહ કરવા બનતું કરે છે. પરંતુ ઈશ્વરની દરમિયાનગીરીમાં તો ઈશ્વરનું વીતરાગપણું ઉઠી જાય. બાકી સત્તાધીશોથી મ્રસરતી કારમી પશુહિંસા, શિકારી ટોળીઓ, વ્યાપક માંસાહાર વગેરે, એ અનાર્ય સંસ્કૃતિના નાચ છે. એને વિકાસયુગ કહેવામાં આવે છે; અને આર્ય લોકો પણ એના ગુણ ગાય છે. આજે તો વાણીનો જમાનો છે, થૂક ઉડવવાના પેસા પડતા નથી. કલજુગનો મહિમા છે ! કલયુગમાં આવાને વધાવી લેનારા મોજુદ છે. શાસનની જ્યોતનો જગમગાટ અજવાળાનારાનો રાહ ન્યારો છે. એનો બોધ હોય, એવી વાણી હોય, જગત આફરીન થઈ જાય પણ આજે તો ભય છે કે જગતના (જગતને ગમતા) ઉદ્ગાર નહિ કાઢીએ તો કિંમત નહિ રહે, એટલે માન-પાનની લાલસાથી, બે તાબોટા જીલવા યથેચુ બોલાય છે.

છે કોઈ શાસ્ત્રનો પાઠ ? કોઈ પૂછે છે ? :-

સાધુની વાણી કેવી હોય ? દશવૈકાલિકમાં સાતમું અધ્યયન એ વિષે છે. ચોર જતો હોય તો સાધુથી એને ‘ચોર’ એમ ન કહેવાય. કહે તો હિંસા કરી ગણાય. આ તો કહે છે, ન્યાયી હિંસા એ અહિંસા છે. ન્યાયી હિંસા !’ છે કાંઈ ? મારી મહોર છાપ ! જડવાદના ધરના બધા ભેગા થયા છે, કોઈ પૂછતું નથી, ‘ન્યાયી હિંસા એ અહિંસા, આતતાયીને હણવામાં પાપ નહિ,’ વગેરેમાં છે કોઈ શાસ્ત્રનો પાઠ ? ક્યારે બને ? ધરની વાત જાણતા હોય ત્યારે ને ?

ગીતા કહે છે ! :-

સાભામાંથી :- કૃષ્ણો આવું કહું એ બને ? રૂપક ન હોય ? આ તમારો આક્ષેપ નથી !

૮.- આપણે ક્યાં સાચું ખોટું સાબિત કરવા બેઢા છીએ. આપણે કહેતા નથી, ગીતા કહે છે. આપણે આક્ષેપ કરતા નથી. રૂપક એટલે અર્થ જુદા ! તમે

૩૦૦ ભૂવનભાનુ એન્સાઈક્લોપીડિયા-ચંડ્કોશિયાનું દસ્તાન્ત (ભાગ-૧૮)

ગમે તે અર્થ કરો, ત્યાં શું અર્થ થાય છે? કયો અર્થ ઘટે છે? ‘આ ઠીક નથી’ એવા ભયથી કેટલાકોએ રૂપક ફેરવી અધ્યાત્મ ગીતા ઉભી કરી છે. આ તો ઐતિહાસિક બીના છે, રૂપક હોય, માન્યું, તો યુદ્ધ નથી થયું? કુરુક્ષેત્રનું યુદ્ધ થયું એ ઈતિહાસ જેવો તેવો પ્રસિદ્ધ છે? રૂપક હોય તો થઈ શકે તો પછી, ભીજ્ય, પાંડવ, કૌરવ એવાં નામ શા માટે? કોઈ કોષમાં એ શબ્દોના અર્થ યુદ્ધાદિના વાચક છે? હોય તો લાવો, બતાવો! જૈન ગ્રંથોમાંથી નાટકની રચના છે, પાત્રો પણ છે, પણ નામ ક્યાં? રાગ કેશરી, દ્વેષગજેન્દ્ર, કોધમિત્ર...વગેરે. રૂપક હોય ત્યાં આવાં નામ હોય. રૂપકવાળો અર્થ તમે ભલે ઘટાવો, એ ધર્મના ચુસ્ત માનનારને લાવી એ અર્થ કરાવો તો ખરા !

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદ્વિ”

વર્ષ-૭, અંક-૩૪, તા. ૮-૫-૧૯૫૮



## ચંડકોશિયાનું દેષાન્ત

કોડ હોય તો ભલે આવી જાય :-

બાહુબલી દૂતને કહે છે, “એ અણ્ણાણુંએ તો સંયમ લીધો, પણ હું એમ નહિ લઉં. આવા, બીજાનું રાજ્ય પડાવી દેનારા લોભીઆઓ પૃથ્વી પર લહેર કરે, અને પાછા મારા પર શિરજોરી કરે એ હું સહન ન કરું. જરૂર શી? દૂત, તું તો અવધ્ય છે પણ ભરતના નામથી જ્યારે તું મને ડરાવે છે તો હું કહું છું, યાદ આપજે તારા ભરતને, બાલપણામાં ગંગા નદીએ, કિનારે જ્યારે રમતા હતા ત્યારે એક વખત તારા ભરતને મેં ઊંચકીને એક દડાની જેમ આકાશમાં ઉછાળ્યો હતો, (આકાશમાં દડાની જેમ? બેય સરખી ઉમરના છે. કાયા પાંચસો ધનુષની. બાલવય એટલે કંક ઓછી હોય.) દસ્તિપથથી બહાર ગયો ત્યારે દયા આવી, આટલેથી ઊંચેથી પડશે; શું થશે એટલે હાથ પહોળા કરી ફૂલના દડાની જેમ આમ જીલી લીધો હતો, અને કહેજે, મને શું ડરાવે છે? પસ્તાઈશ. સંતોષ રાખીને બેસ તો સુખી થઈશ.” જે ભરતનું ગૌરવ દૂતે આટલું કર્યું હતું એ ભરતને ફૂલના દડાની જેમ પોતે ઉછાળ્યો હોવાનું ભરસભામાં જાહેર કરે છે. દૂતને કેવું થયું હશે! ખૂબી એ કે, બાહુબલીએ ભરસભામાં આટલે સુધી કહું ખરું પણ પછી એનું પિંજણ નહિ! દૂત જોશે તે પછી એની વાત નહિ! હજી દૂતને શું કહે છે : “તારા ભરતને તું બહુ ચડાવે છે એને આ મારા બલની યાદ આપજો.” પરિગ્રહ શું ન કરાવે? ધન જેમ પરિગ્રહ છે, રાજરિદ્ધિ-સમૃદ્ધિ એ જેમ પરિગ્રહ છે, તેમ અખૂટ બલ એ પણ પરિગ્રહ છે.

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદ્વિ” (ભાગ-૧૮)

309

દૂતને કહે છે, ‘એના છ ખંડ એની પાસે ભલે રહ્યા, મારે એનું એક હુંચ રાજ્ય જોઈતું નથી. એને પિતાએ આપેલું અને બીજું જીતેલું છે એમાં એ સંતોષ લે. બાકી એને અહીં નજર હોય એને કોડ હોય તો કહેજે ‘ભલે આવી જાય રણમેદાને.’ યોગ્યની આ ખૂબી, અભિમાનનું વચન કહું પણ મર્યાદમાં રહીને કહું. ‘ભલે આવી જાય,’ એ છે પડકાર પણ મર્યાદા એ કે, ‘એને કોડ હોય તો - બાકી હું નથી કહેતો?’ દૂત તો ગયો પણ ગયા પછી સભાને થયું કે, ‘પોતાના સમાટની આવી નિંદા કરનારો આ દૂત જેનો છે એ ભરત છે કોણ? બાહુબલી ધારત તો બોલી શકત પણ એક શબ્દ નહિ, જાણો છે કે પાછળ વાંકું બોલવું એ નિયમપ્રવૃત્તિ છે, એ છાજે? નિયમપ્રવૃત્તિનો ત્યાગ, માગાનુસારીનો ગુણ છે, એને ન ભૂલાય. એ નિયમપ્રવૃત્તિના ત્યાગો તો યુદ્ધભૂમિમાં કેશનો લોચ કરાવ્યો છે.

વાંકું પડતાં વળગતું ભૂત :-

બાહુબલજી, ભરતનો દૂત ગમે તેમ વાંકું બોલી ગયા પછી સભા આગળ કશું એનું પિંજણ કે પોતાના મનમાં વિકલ્પ કરતા નથી. બાહુબલજીનો આ ગુણ બહુ ધ્યાનમાં લેવા જેવો છે. વિચારજો કે સામા તરફથી કોઈ અન્યાય થવાનું જાણવા મળે તો પછી એની પાછળ આપણે પિંજણ કેટલું કરીએ છીએ. કુટુંબીઓ આગળ, સેહીઓ આગળ, બીજા ગીજા આગળ, સામાની વિરુદ્ધમાં કેટકેટલું બોલવાનું થાય? મોહની કરામત જ એવી છે કે જીવને ક્યાંકથી જરા વાંકું પડયું, કે જટ એનું ભૂત વળગાડી હે. પછી એ જીવને એની જ વિચારસરણીના, એના જ વિકલ્પોના, ને એની વિરુદ્ધમાં બોલવાના તથા યોજનાઓ ઘડવાના નાચ નચાવે છે! બસ, કેમ જાણો હવે તો એનું પાનિયું પકડાઈ ગયું! એ પછી પેલાનું ભૂતકાળનું સારું પણ કાં તો નજીવું ગણાવશે, અગર ખોટામાં ખતવશે! ને પોતાની ન્યામિતા, ઉદારતા, ‘એ તો હું આટલું સહન કર્યે જાઉં છું,’ એવી સહિષ્ણુતા વગેરેની બડાઈ ગવરાવશે! વિચારજો કે નજીવી બાબતમાં કે સામાના નજીવા ગુનામાં પણ આવું આવું આપણા જીવનમાં કેટલું બને છે! વાંકું પડતાં વળગેલા ભૂતથી આ કેવી મહારૂદ્ધશા થાય છે? પછી ત્યાં

તત્વજ્ઞાન અલોપ થઈ જાય છે! ધર્મભાવના વિસારે પડી જાય છે!

ગુરુની શિખામણ, શાસ્ત્રનો ઉપદેશ, દેવાધિદેવના આદેશ વગેરે જાણો કંઈ મળ્યા જ નથી એવું થાય છે!

તેમ, ત્યાં કર્મબંધનો ભાર કેટલો વધશે, કુસંસ્કારોને આવા ઊંચા ભવમાં નખળા પાડી દેવાને બદલે મજબૂત કરવાની ભયંકરતા કેવી સર્જશે,

મન કેટલું આવેશવાળું થઈ બગડશે, ને

सामो कदाच वयगाणे सुधरी जवाथी, ऐनी सामे भविष्यमां कशुं करवानुं  
तो नहि आवे, पण पोताना काढेला भजाणा केटली खराब असर निपज्जवशे,  
इत्यादि वस्तुनो कोई ज विचार रहेतो नथी ! त्यारे प्रश्न थशे,  
पानियुं पकडवानुं भीज :-

प्र.- प्रश्न थशे के आवुं पानियुं पकडवानुं केम थाय छे ?

३.- दिलनी तुच्छता, अने असहिष्णुता, तथा स्वार्थीता अने उच्च कर्तव्य-  
शून्यता ए करावे छे. दिल पहोणुं होय, विशाल होय, तो सामानो नज्जवो तो  
शुं पण मोटो अपराध पण ए विशाल दिलसागरमां क्यांय समाई जाय.  
दिल सहिष्णु होय तो, सामानो कममां कम वाणीनो अपराध दिलमां एकदम  
गरभी न लावी शके. तेम, स्वार्थ होय, पण स्वार्थीता न होय तो पोताना  
स्वार्थ उपर आवतुं सामान्य आकमण एवुं खण्डणावी न मूळे के जेथी झट ऐनी  
ज मानसिक गुमथल अने वाचिक भजाणा बस शरू थई जाय. तेम ए पण एक  
हकीकत छे के

ज्ञवनमां कोई ऊंचा आदर्श अने सात्त्विक कर्तव्योंसे प्रधान स्थान जमाव्युं  
नथी होतुं तेथी ज तुच्छ बाबतो झट दिलनो कबज्जे लई ले छे. कायिक आकमणानी  
आगण वाचिक आकमण तो तुच्छ गणाय.

उन्नतिनी यावी :-

उन्नतिनी आ एक महान यावी छे के जो क्षुद्रता, खण्डणाट, आवेश,  
विकल्पो अने तुच्छ येष्ठाओ वगेरेथी बचवुं होय तो ज्ञवनमां ऊंचा आदर्श अने  
सात्त्विक कर्तव्यने प्रधान स्थान आपो; जेथी मगज एमां रम्या करवाथी अने काया  
एमां ज ओतप्रोत रहेवाथी बीच-त्रीच गुमथलमां नहि पडाय. एम न समजता  
के गृहस्थने एवा शा ऊंचा आदर्श अने सात्त्विक कर्तव्य होई शके ? गृहस्थने पण  
मोक्ष, वीतरागता, उच्च चारित्र उच्च देवगुरु भक्ति अने क्षमादिगुणो वगेरेना  
आदर्श होई शके छे; तेमज ऐनी कक्षा मुजबना सात्त्विक कर्तव्य पण मन-वयन-  
कायाथी करवाना रहे छे. दा.त.

आश्रितो अने बीजाने वात्सल्य दाखववा, प्रसन्न राखवा वगेरेनां योग्य  
कर्तव्य छे, जे बाहुबलज्ज राजसभामां य कही रख्य छे; माटे तो ए भरतना हूते  
अनिष्ट उद्गारो काढीने गया पट्ठी क्षायभर्पु एतुं पिंजण करता नथी, ऐनी  
पाइण विकल्पो करता नथी. एम,

शक्य परोपकारनां निश्चित कर्तव्य छे, दानादि सुझूतो छे,

मार्गानुसारी ज्ञवनां सत्कृत्यो छे, योग्यता विकसावनारा गुणो छे,

वगेरे वगेरे केई जातनां कर्तव्य बज्जवाना उभां छे, एमांथी एकेक या  
अनेक कर्तव्य सिद्ध करवा माटे मनमां निधर थई जवा जोईअ, दिनरात ऐनी  
रटणा रहेवी जोईअ, ऐनी पूऱ्ठे लागवुं जोईअ. पछी पेलुं भूत स्थान नहि पामी  
शके, वस्तु बनवानी बनवा काणे बनी गई, पछी ऐना मानसिक विकल्पो-  
खण्डणाट, वाचिक भजाणा वगेरे माटे समय ज नहि होय; सत्कर्तव्योनी  
विचारणाथी कबज्जे करायेला मनमां ऐनी जगा ज नहि होय.

आजे दुनियामां पण एवा माणसो जडशे के जेमाणे कोईने हुन्यवी कर्तव्य  
पकडी लीधा होय छे. दा.त. प्रयोगशाणामां विज्ञाननी शोधो करनार वैज्ञानिको,  
गणितमां नवी नवी गुमथल करनार गणितशास्त्रीओ, संगीत ऊंचामां ऊंचुं केम  
गावुं ए माटे मथनाराओ, वार्ता लेखको, काव्य रचनार... आवाने पूर्वे कहेला  
भूत नथी वणगता, तेथी कोईना बोली-करी जवा उपर हवे ऐना ज विकल्पो-  
भजाणा वगेरे नाच ए नथी करता. मोटमोटी उद्योग भील चलावनारा, चारे  
बाजु पेढीओनो पथारो पाथरी बेठेलाओ, अरे ! एक ज दुकानने पण बहु  
विस्तारनारा, अथवा ज्ञवनमां कोई ने कोई महाशोभ उभो करनारा... एवा  
एवाने पण हुरसद नथी होती. केमके ज्ञवन-व्यापी कोई ने कोई कर्तव्य पकडाई  
गयुं छे, त्यारे शुं धर्मी ज्ञवोनी पासे एवां कोई शुभ कर्तव्य नथी के ए विकल्पो,  
आवेश अने भजाणामां यढे ?

कदाच शारीरिक नहि तो मानसिक कर्तव्य केटवांय छे ! जेवां के,

परमात्मानी नवा नवा विशेषणोथी, नवी नवी उपमाओथी, नवा नवा  
श्लोको-काव्योथी स्तुति रचवानुं कर्तव्य,

नास्तिकना प्रश्नो सामे हुन्यवी दृष्टान्तो शोधी उतरो उभा करवानुं कर्तव्य,  
शास्त्रोक्त तत्त्वोने ज्ञवन प्रसंगोमां घटाव्ये जवानुं कर्तव्य,

कोई पण पदार्थ, प्रसंग अने प्रवृत्तिने आंतर दृष्टिए, दीर्घ परिणामनी  
दृष्टिए, के आत्मानुं उपकारक कोई ने कोई साँवुं तत्व एमांथी शोधी काढवानी  
दृष्टिए ज्ञेवानुं कर्तव्य,

नवी नवी वैराग्य भावनाओ उभी करवानुं कर्तव्य,

आवां तो केई कर्तव्य उभां करी शकाय. तो धर्मत्वा पासे शुं आवुं कोई  
कर्तव्य नथी के ज्ञवननो अभूत्य समय खोटा विकल्पो, निंदाओ, आवेशो, खण्डणाट  
अने गुमथलोमां लगाडी दे छे ? त्यारे एमां शुं एकलो समय ज बगडे छे ? ना  
महाकोमण अने महाकिंमती मन पण बगडे छे ! प्राप्त करेली धर्मभावनाओ नष्ट  
थती जाय छे ! धर्मी तरीकेनी आबहु बगडे छे ! भावी भवो बगडे छे ! आटली

ઉંચી પ્રાપ્ત કરેલી વર્તમાન ચઢતી બગડે છે !

ઉંચા કર્તવ્ય જીવનમાં વણી લીધા પછી તો કેટલાય અકાર્યો અને દુર્ગુણોમાંથી બચી જવાય છે !

ઉંચા આદર્શ નજર સામે રાખ્યા કરવાથી કેટલાય દોષ-દુષ્કૃત્યો સેવવાનું મન જ થતું નથી.

કરો, આ કરો. જીવનમાં જેનો રસ હોય તેવું કોઈ પણ સત્કર્તવ્ય, એક યા અનેક એવા ઉભાં કરી દો, કે જેની લગની લાગી જાય ચોવીસે ય કલાક એની ધૂન લાગી જાય. બીજા કાર્યો મૂકી દેવાની આ વાત નથી, પણ એમાંથી જરા નવરા પડ્યા કે આ લગનીવાળા કર્તવ્યમાં આત્મા પરોવાઈ જવો જોઈએ. કદાચ કાયાની કિયાથી નહિ, તો વાંચન કે ગુણગાનથી, તે ય નહિ તો માનસિક વિચારણા-ભાવનાથી. કમમાં કમ એ કર્તવ્યની અનુમોદના, એના ઉપદેશનાર દેવ-ગુરુના કૃત્યાનુભૂતિઓના સંસ્મરણ, એને બજાવનાર પૂર્વપુરુષોના જીવન સ્મરણ, એ કર્તવ્યના મહાલાભો..., વગેરેમાં મન પરોવાઈ જાય. આ જો આવડે તો કહો પછી ફંજૂલ વાતોના વિકલ્પો, ખળબળાટ, બખાળા, ગેજેટીંગ, નિંદા, નિંઘપ્રવૃત્તિ વગેરેને ક્યાંથી સ્થાન મળે ? બાહુબલજ જેવા મહાપુરુષોમાં આમ આદર્શ અને કર્તવ્યની સજાગતા હતી, તો ખોટાં પિંજણ, વિકલ્પો વગેરેને સ્થાન નથી મળતું. એથી જ એવી શક્તિ વિકસતી જાય છે કે જે મહાપરાકમે પહોંચાડે છે. આંતરશક્તિના વિકાસ કરવા હોય તો ખોટાં પિંજણ વગેરેને ટાળવા જ પડશે.

નિંઘપ્રવૃત્તિ એ દોષ હોવાનું ભાન :-

બાહુબલ પાસેથી દૂત તો ભરત પાસે જવા નીકળ્યો પણ રામ તો રમી ગયા છે ! નિરાશ છે ! પહોંચ્યો અયોધ્યામાં, આવ્યો ભરત પાસે. એને પૂછ્યું ભરતે, ‘જઈ આવ્યો ? કેમ, ભાઈ છે તો કુશલ ને ?’

જુઓ ખૂબી, પ્રેમ ભર્યો પડ્યો છે. બાહુબલીની જેમ જ પ્રશ્ન પૂછે છે, આ યોગ્યતા સહજ છે ! દૂત હોશિયાર છે ને ? એટલે ચાલાક ઉત્તર કરે છે, ‘મહારાજ ! આપના એ ભાઈનું અકુશલ કરનાર જગતમાં છે કોણ ?’

કેવી ખૂબી કરી, સ્વામીનું ગૌરવ ગાઈને બાહુબલીની ખુમારીનું, બલનું સૂચન કર્યું.

ભરત કહે છે : ‘હું જાણું છું, છે તો એ ગંધહસ્તી જેવો, કોઈની આજ્ઞા સહન ન કરે. પછી ?’

‘પછી શું ? મેં ધીમે ધીમે આપનો સંદેશ કહ્યો, આપની આજ્ઞા સંભળાવી, છેલ્યે સેવામાં આવી જવાને કહ્યું.’

‘પછી ?’

‘પછી ? પછીનું શું પૂછો છો ? પોતાના ખભા તરફ નજર કરી મને કહ્યું, ‘તું દૂત છે, અવધ્ય છે, તને ન મરાય, એમ કહી એમણે તો મદાંધતાથી આપને આવી જા-’ એમ કહેવરાયું છે, એમ કહીને દાની જેમ ઉછાળ્યાની વગેરે તમામ વાત થઈ હતી તે એવી કુશલતા પૂર્વક કરી કે જેથી ભરતને ભારે ગુસ્સો ચઢે, ધમધમાઠ થાય. પણ ભરતની વિશેષતા હવે દેખાય છે. ભાઈના પડકારથી લડાઈ કરવાનું પોતાના શિરે આવે છે ને ?

‘હું શું આવા ભાઈ સાથે લડાઈ કરું ? હરગીજ નહિ. ભાઈથી વિરોધ ? રાજ્યસમૃદ્ધિ તો મળે પણ બંધુ ક્યાં મળે ? બંધુની સામે લડાઈ કરવી એ નિંઘપ્રવૃત્તિ છે.’ બાહુબલીજીને જેમ નિંઘપ્રવૃત્તિના ત્યાગના ગુણનું ભાન છે તેમ ભરતને પણ છે. નિંઘ-પ્રવૃત્તિનો ત્યાગ એ મોટો ગુણ છે. અનિંઘપ્રવૃત્તિ એ ગુણ છે, નિંઘપ્રવૃત્તિ એ દોષ છે.

અહીં પણ પરિગ્રહે લડાઈ ઊભી કરાવી :-

મજીઆરો વહેંચ્યો, ત્યાં બે વાસણ ઓછા આવ્યા કે વધારે, થાય યાદવાસ્થાલી ! ભરતની ભાવના કેવી છે ! ‘બંધુ મળે, સંપત્તિ મળે, રાજ્ય મળે, ભાઈ ક્યાં મળે ?’ રાજ સંપત્તિની એને કિમત નથી, ભાઈ એને મોંઘો લાગ્યો, ‘તે માલ મિલકત નકામી, તે છુંતર નકામું છે જ્યાં બંધુનો ઉપકાર નથી; જે દુઃખી જીવોની રક્ષામાં ખરચાતું નથી,’ આ ભાવનાએ તો લાખો કરોડોના દાન દેવરાયા. ભરતે તો સંભળાવ્યું, ‘મારે લડવું નથી.’

પાસે બેઠેલો મંત્રી આ સાંભળી રહ્યો છે, એ કહે છે, ‘ન ચાલે, ચક્રરત્ન બહાર રહે છે, અંદર પેસાંતું નથી.’

‘ભાલે ન પેસે, શી કમીના છે ?’

પણ વાત ત્યાં અટકે ? મંત્રીએ બાહુબળે કરેલું અપમાન, એનું અભિમાન-ઉદ્ધતાઈ વગેરે ગમે તેમ સમજાવીને યુદ્ધ કર્યું ઊભું ! પરિગ્રહ આ કરાવે. મંત્રી વગેરે પરિગ્રહ જ છે ને, લડાઈ ઊભી કરાવી. લડાઈ થઈ તેમાં દરાવેલા ચારે યુદ્ધમાં ભરત હારી જવાથી હવે ચક મૂકે છે. એક ગોત્રમાં ચક ચાલે નહિ તેથી પાછું આવ્યું. બાહુબલને એથી ભારે ગુસ્સો ચઢ્યો, ભરત પર મૂકી ઉગામી, પણ ‘આ મૂકીથી શું થાય ? ભાઈ જેવો ભાઈ મરી જાય તો ?’ એમ વિચારી એ મૂકીએ કેશનો લોચ કર્યો. ભરતથી ડરીને નહિ પણ ‘જગતને મુક્તિની કૂચ કરાવનારા, જગતના તારક, એવા શ્રી ઋષભદેવ ભગવાનાના પુત્રો જડ જમીન ખાતર લડી એમાંનો એક બીજાનો ધાત કરનારો થયો !’

જગતના ઈતિહાસમાં આ લખાય; માટે આવી નિદ્યપ્રવૃત્તિ ન થાય.

નિદ્યપ્રવૃત્તિનો ત્યાગ કર્યો, પગલું ઉપાડતાં જ કેવલજ્ઞાન ! :-

બાહુબલીએ કેશનો લોચ કર્યો, ભરત ચક્રવર્તી હાથ જોડી ક્ષમા માગે છે, ભારે પશ્ચાત્યાપ કરે છે, ચોધાર આંસુએ રે છે, પણ આ મહાત્મા તો પ્રશ્નમરસમાં કાઉસ્સગધ્યાને. ભરતચી તો બાહુબલીના પુત્રને અનું રાજ્ય આપી ચાલ્યો પણ પોતે બાહુબલી ક્યાં ? ત્યાં જ ! ભર ઉનાણો, નીચે તપે, ઉપર તપે, ભર ચોમાસું, એકધારો વરસાદ, ભર શિયાળો કાતીલ ઠડી પણ લેશ ચસક્યા નહિ બાહુબલી. બાહુબલીએ કેવું કર્યું ? ક્યાંની ચરાઈ ક્યાં કરી ? પગથિયાં બદલ્યાં. ત્યાં થોડુંક બાકી રહ્યું ! કેવળજ્ઞાન હાજર છતાં, ફરતું રહ્યું, આવતું અટક્યું ! અનું ભૂત ભરાયું, ‘મને હજ કેવલજ્ઞાન થયું નથી, નાના ભાઈઓને કેવલજ્ઞાન થયું છે, નાનાને કેમ નમાય ? કેવલજ્ઞાન થયા પછી જઉં તો નમવું ન પડે.’ એમને એ ખ્યાલ ન આવ્યો કે, ‘હું કેમ નમું ?’ એ તો ગર્વ છે, એ ઘાતિકર્મના ઉદ્યે છે, એ ઉદ્ય સુધી કેળવજ્ઞાન-તેરમું ગુણસ્થાનક તો ન આવે, પણ વીતરાગતા પણ ન આવે.’ બાર મહિને ભગવાને મોકલેલી બહેનોએ ભાન કરાયું, આમ કેવલજ્ઞાન ન થાય, ‘ધીરા મોરા, ગજ થકી ઉતરો; ગજ ચડે કેવલ ન હોય.’ એમને ભાન થયું, ‘હું ભૂલ્યો, આ કહેનાર પ્રવ્રાજિત બહેનો છે, એ યોગ્ય જ કહે, એ ભાઈઓ અનંતજ્ઞાની છે, હું છચ્ચસ્થ છું, અનંતજ્ઞાનીના ચરણમાં નમું નહિ તો મેલ જાય શી રીતે, પવિત્ર થાઉં શી રીતે ? મારું આ અભિમાન, એ નિદ છે. બસ, હમણાં જ જઉં, કેવળજ્ઞાની મહર્ષિઓના ચરણો વંદના કરું...’ આ વિચાર કર્યો, નિદ્યપ્રવૃત્તિનો ત્યાગ કર્યો, ભાઈઓને નમવા જવાની ભાવના ચઢતી છે, ને પગલું ઉપાડ્યું કે તરત કેવલજ્ઞાન !



“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદધિ”

વર્ષ-૩, અંક-૭, તા. ૨૩-૧૦-૧૯૫૪

૪૫

## અંગર્ષિ અને રૂદ્રકનું કથાનક

(વ્યવહાર અને નિમિત્તના આધારે જ કેવી કેવી ખાસ ઘટના

બને છે અનું એક સુંદર શાસ્ત્રીય કથાનક છે. - પ્રકાશક)

માનાકંંશા અને સ્વાર્થલંપટતા માનવ-યોગ્ય ગુણોનો પણ કચ્ચરધાણ કાઢે છે.

એક નગરમાં કૌશિકાર્ય નામના એક ઉપાધ્યાયની પાસે બે વિદ્યાર્થી ભણતા હતા. એમનાં નામ અંગર્ષિ અને રૂદ્રક. અંગર્ષિ સ્વભાવે સૌભ્ય તથા ગુણીયલ બહુ; અને રૂદ્રક અધિયલ બહુ, તેથી રૂદ્રક અંગર્ષિ પ્રત્યે મત્ત્સરભાવ રાખતો. દુનિયામાં આવું બહુ બને છે. જાતે ગુણીયલ થવું તો દૂર રહ્યું પણ સામાના ગુણને જોયા પછી પચાવવા મુશ્કેલ છે. ત્યારે પચાવવાનું બીજેય ક્યાં મુશ્કેલ નથી ? પક્ખવાનનું ભોજન જમવું સહેલું પણ પચાવવું કઠીન ! પૈસા-કમાવવા સહેલા પણ પચાવવા ભારી ! કેમકે જટ અભિમાન-ઉન્માદાદિનું અજ્ઞાણ થતાં વાર નહિ. પુણ્યાઈ હોય એટલે માનકીર્તિ કે સેવાચાકરી સહેજે મળી જાય; પરંતુ એને પચાવવી કેટકેટલી મોંધી છે ! કેમકે ત્યાં અક્કડતા, અતડાઈ, રોઝ વગેરે દોષો જાગવાનું સુલભ દેખાય છે. દુનિયામાં માન સેવા મેળવનારા માણસોએ જો એને પચાવી જાણી હોત તો જગતને માટે એ મહાન આશીર્વાદરૂપ અને સુખદાતા બન્યા હોત. એમ બીજાની સુખસંપત્તિ કે ગુણોનું દર્શન પણ હજ્ય મળી જાય; પરંતુ એને પચાવી જાણવું એ યોગ્યતા ઉપર અવલંબે છે. યોગ્યતાના અભાવે ઈર્ધ્ય-દ્રેષ-અધમ વિચારણા વગેરે જન્મે છે. એથી સામાને શું નુકસાન ? નુકસાન પોતાને. પોતે ગુણી કે વધુ ગુણી બનવાને બદલે ગુણો ગુમાવી, દોષોને પોણીને દીર્ઘકાળ દુર્ગતિમાં દુઃખોથી પીડાય છે. આ કેવી કરુણ દશા ! આના પ્રસંગમાં બે વસ્તુ ખાસ લક્ષમાં રાખવી જોઈએ છે.

(૧) એક તો એ કે કદીય સામાના ગુણ જોઈને આપણો ડીયા-નીયા ન થવું, આપણું મન ન બગાડવું. જેમ કદાચ સામાનું નાક સુંદર છે, ને આપણું નાક સારું નથી, તો તેથી કાંઈ આપણા નાકને વધુ બગાડતું નથી; એવી જ રીતે ગુણો વગેરે સારી વસ્તુ માટે સમજવાનું છે.

(૨) બીજું એ કે આપણામાં ગુણો છે, પણ બીજાઓ એની નિંદાઈશ્વાઈ કરે છે, તો તેથી આપણું કંઈ બગડતું નથી; માટે આપણે મન બગાડી સામા ઉપર દેખ કરવાનું ન કરવું. આપણે આપણી પોતાની લઘુતા વિચારવી કે, ‘મારામાં શું માલ છે?’ તેમ સામાની દયા-મૈત્રી ચિંતવવી કે ‘બિચારા કર્મ બાંધે છે. એમનું ભલું થાઓ.’

રૂદ્રકની રૌદ્રતા :- એક વખતે ઉપાધ્યાયે બંનેને સવારના સમયે જંગલમાંથી લાકડાં લઈ આવવા કહ્યું. રૂદ્રક તો ત્યાંથી નીકળી કાર્ય ભૂલી દેવદીઓમાં રમવા કરવા રહી ગયો. તે ઠેઠ મધ્યાહ્ન દૂરથી જ્યારે અંગર્ષિને લાકડાનો ભારો લઈને આવતો જોયો, ત્યારે ચોક્કો ! તેને યાદ આવ્યું; હાય કરતો દોડ્યો ! નદીના કંઠેથી એક તેશીને લાકડાનો ભારો લઈને આવતી જોઈ. રૂદ્રકને ગભરામણ તો હતી જ કે ‘લાકડાં લીધા વિના એમજ પાછો જાઉ તો ગુરુજુને શું જવાબ આપવો? અંગર્ષિની સામે ફજેતી થાય, ગુરુજુ ઠપકો આપે.’ વગેરે. તેથી અંતરમાં રૌદ્ર ભાવના ઉઠી. તેશી પાસેથી પડાવીને નહિ પણ તેશીને મારી નાખીને એનો ભારો લઈ જવાનું મન થયું. કેમ વારું ? એટલા જ માટે કે પડાવવામાં ખેંચાખેંચ થાય અને કોઈ આવી ચઢે તો ? અથવા, જોસ્થી પડાવી તો લીધો, પણ તેશી ગામમાં ફરીયાદ ઉઠાવે તો ? માટે ‘મારી નાખું એને,’ એવું નક્કી કર્યું. અહાણ ! કેવી કુરતા !

માનાકંકણ અને સ્વાર્થલાલસાથી ખાસ બચો :- સ્વમાનની લાલસાવાળો જીવ જ્ઞાણે વિફરેલા વાધ જેવો ! સ્વાર્થ ગમે તે પ્રકારે સાધવાની હઠવાળો, એ તો રાક્ષસી કાળી લેશ્યા કરવામાં અચકાશે નહિ. એવી કાળી લેશ્યાની અસર નીચે ધોર હિસા, બયંકર જૂઠ, કાળી ચોરી, વગેરે પાપ આચરતાં સંકોચાવાનો નહિ. માનવતાનું ત્યાં સરાસર દેવાળું નીકળે, એમાં કોઈ નવાઈ નથી. માનાકંકણ અને સ્વાર્થંપટતા માનવ-યોગ્ય ગુણોનો પણ કચ્ચયરધાણ કાઢે છે, એ ગુણો વિસરાવે છે, તો દેવી ગુણોની શી વાત કરવી ? એવા માનવતાનું દેવાળું કાઢનારની પાપલીલાથી દુનિયા ત્રાસે છે, પણ એ જોવાનું નથી કે એવી કુર પાપલીલાના કારણભૂત માનાકંકણ અને સ્વાર્થિતા જ્યાંસુધી ઘટે નહિ ત્યાં સુધી એના ઉપરના પાશવી કૃત્યો કયાંથી અટકવાના હતા ? પોતાના આત્માનું સંરક્ષણ કરવા માટે હિંસા-જૂઠ-અનીતિ વગેરેને તિલાંજલિ આપે છૂટકો છે; અને એ માટે માનાકંકણને બદલે લઘુભાવ કેળવવાની જરૂર છે. તેમજ પોતાના અનંત ગંજવર દોષોભરી પોતાની સ્થિતિની મુખ્ય સમજ જોઈએ. મહાન પુરુષ બનવાનો આજ રસ્તો છે.

**નિમિત્તની પ્રબળતા :-** રૂદ્રક ભાનભૂલો થયો. શાથી ? આત્મામાં અયોગ્યતા તો હતી જ. પરંતુ આ તેશીના દર્શનનું નિમિત્ત મળી આવતાં કુરતા પ્રગટ થઈ. નિમિત્ત કેવું બળવાન છે ? માટે જ જ્ઞાનીઓ ખરાબ નિમિત્તથી આધા રહેવાનું અને સારા નિમિત્તો સતત સેવવાનું કહે છે. સોનગઢી મતવાળા પણ નિમિત્તોને સેવે છે; ‘ચાલો મહિનો કુરસદ છે તો સોનગઢ જઈએ’ એમ કરે છે પણ ‘ચાલો જુમામસીદમાં’ એમ નથી કરતા; કેમકે એ આલંબન સારું નથી, ઉપયોગી નથી. આટલું છતાં બિચારા સારી એવી સામાયિક-પ્રતિકમણ-પૂજા-પ્રત-નિયમ-ચારિત્ર વગેરે તારક કિયાના સુંદર નિમિત્તને ઉડાવે છે !! એ એમની મોહમૂઢતા અને દયાપાત્રતા સૂચવે છે.

**અંગર્ષિ પર આરોપ :-** રૂદ્રકે એકદમ તેશી સામે જઈ એની તોક મરી મારી નાખી; લાકડાનો ભારો પોતાના માથે લઈ જટપટ બીજા ટૂંકા રસ્તે ગુરુ પાસે પહોંચે જઈ પોકારે છે “ગુરુજી ! ગુરુજી ! આપ જાણો છો હજ અંગર્ષિ કેમ નથી આવ્યો ? આટલો બધો વખત એ દેવદીઓમાં ફર્યો, અને મને આવતો દેખી ગભરાતો ગભરાતો બિચારી એક તેશીને તોક મરી મારી નાખી એનો લાકડાનો ભારો લઈ હવે શાણો થતો આવી રહ્યો છે.” કાચા કાનના ગુરુ આ સાંભળી અંગર્ષિ ઉપર ગુરુસે ભરાણા.

જુઓ આ પણ નિમિત્તની બલિધારી ! શાંત અને પ્રેમી ગુરુ રૂદ્રકના બોલના નિમિત્તથી અંગર્ષિ ઉપર કોથ અને દેખવાણ બન્યા. અહીંઓ જે કહેવું કે “એમાં નિમિત્ત તો માત્ર હાજર હોય જ એટલું જ, બાકી એ કંઈ કરતું નથી માટે કારણ ન કહેવાય;” એ ખરી રીતે વસ્તુસ્થિતિનો અપલાપ કરવા જેવું છે. કેમકે નિમિત્તકારણની ગેરહાજરીમાં ક્યાંક કાર્ય બનેલું દેખાતું નથી. હાજરીમાં બીજી સામગ્રી હોય તો કાર્ય અવશ્ય થતું દેખાય છે. આમ જેની હાજરીથી જ કાર્ય નીપજે છે, જેની ગેરહાજરીમાં કાર્ય નથી જ નીપજતું, જેના હાજર થવાના વિંબે કાર્ય બનવામાં પણ વિલબ દેખાય છે. એનું જ નામ કારણ છે. આ વ્યાખ્યા જેવી ઉપાદાનમાં લાગુ પડે છે, બરાબર એવી જ નિમિત્તમાં લાગુ પડે છે. તો પછી ‘ઉપાદાન એ કારણ ખરું, અને નિમિત્ત એ કારણ નહિ.- એવો બેદ શાથી ? આ તો એવું થયું કે ‘મોટા મગનકાકાની વહુ તે તો કાકી ખરી; પણ નાના છગનકાકાની વહુ એ કાકી નહિ; એ તો માત્ર કાકાની ઘરવાળી !’ અસ્તુ.



## અંગર્ષિ અને રદ્રકનું કથાનક

ગુરુ વિદ્યાર્થીના અંતર : એટલું ખાસ ધ્યાનમાં રહે કે આ દુનિયા ઉપર બનતા હજારો પ્રસંગો પરથી એ સિદ્ધ હકીકત છે કે ‘નિમિત્તો અને આલંબનો જબરદસ્ત અસર કરે છે. ખાસ રીતે નવીન કાર્યો સરજાવે છે.’ ઉપાધ્યાય કૌશિકાર્ય રૂદ્રકના દંભી વચ્ચનના નિમિત્તને પામી અંગર્ષિ પર એવા ગુસ્સે થઈ ગયા કે જ્યારે અંગર્ષિ બિચારો લાકડાના ભારા સાથે થાક્યો-પાક્યો મકાને આવી ચઢ્યો કે તુર્ત જ એને ધૂતકાર્યો ‘નાલાયક ! ચાલ્યો જા અહીંથી, અહીં તારું કામ નથી.’ કોથ અંધ સર્પ છે. એ ગમે ત્યાં ડસે છે. કોથમાં કરેલ કામ અંતે પોતાને નુકશાનકારી અને પસ્તાવો કરાવનારું બને છે. તેથી ડાહ્યો માણસ પોતાના હૈયાને તપાસી લે છે. પોતાના હૈયામાં જો કોઈના પર રોષ જાગ્યો છે, તો એટલીવાર બોલવા-ચાલવામાં અટકી જાય છે. તેથી ઘણા અનર્થથી બચી ઉપરથી સામાનેય અંતે ગુણકારી બને છે. અહીં પણ ગુરુ-વિદ્યાર્થીમાં આ ફરક પડવાનો છે. ગુરુ ગુસ્સામાં છે; ત્યાં નિર્દ્વિષ અંગર્ષિનો બળતા તાપમાં કલાકીની મહેનત કરી લાકડાં લાવવાનો થાક ક્યાં જોવાનો હતો ? અરે ! એ તો શું પણ એની વર્ષોની યોગ્યતા પણ ક્યાં જોવી હતી ? જ્ઞાની ભગવંતો કોથને આંધળો કહે છે તે સાચું જ છે; અને અંધતામાં શા અકાર્ય નહિ થાય ? માટે જ હંમેશા દેખતા રહેવા માટે મનમાં કોધને જરાય પેસવા દેવા જોવો નથી. એટલે જ સદા સમતા અને સૌમ્યતાને સુવાસની જેમ હદ્યકમલનો સ્વભાવ બનાવી દેવો જોઈએ. જેથી આવા કોઈ કસોટીના પ્રસંગે મહાત્માની વતણૂક જાળવી શકીએ. અંગર્ષિએ એજ કર્યું. એમાં પોતાનું બગરાંનું નહિ, મહા સુધર્યું.

અંગર્ષિની ઉત્તમતા અને સત્ત્વ : ગુરુના વચ્ચનને માથે ધરી અંગર્ષિ ચૂંચાપ ત્યાંથી નીકળી ગયો. પહોંચ્યો નગરની બહાર. એક ઝાડ નીચે ઊભો વિચારી રહ્યો છે. જો જો એની વિચારણામાં કેટકેટલું સત્ત્વ ભરેલું છે ! એમ સમજતા મા, કે બીજાના દોષો વિચારી ધમધમવામાં સત્ત્વ છે. અને જાતના દોષ જોઈ સ્વાત્માને નિદ્વામાં કાયરતા છે. આવું નથી; બલ્કે તેથી ઉધું છે. પરદોષરદ્શન અને ધમધમાટમાં જ કાયરતા અને તામસીવૃત્તિ છે. ત્યારે સ્વદોષની જાંય અને સ્વાધમતાના ધ્યાલમાં સાત્ત્વિકતા છે. હવે આ સર્વોચ્ચ માનવભવમાં હલકટ તામસભાવ કે ઉત્તમ સાત્ત્વિક ભાવ, એ બેમાંથી શું ખપે છે, અને તો શું કરવું જોઈએ, એ જાતે વિચારી લેવા જેવું છે. અંગર્ષિ ગુરુનો જરાય દોષ જોતો નથી. રૂદ્રકની ચઢવણીની તો અને ખબરેય નથી; અને હોત તોય એના પર ગુસ્સે થાય એવો એ નથી. અંગર્ષિ સાધુ નથી હોય છે. છિતાં સુભુદ્ર હોવાથી ઉચ્ચ સમતા અને

સ્વાત્મ દર્શનને જ અવલંબે છે. કેમ ? પોતાનામાં પ્રકૃતિ-સૌમ્યતા નામનો એક મહાન ગુણ છે તેથી. શાસ્ત્ર ધર્મ પામવાની યોગ્યતાના ઘરમાં આ ગુણ પણ મૂક્યો છે. આ ગુણના લીધે માણસ જ અનુચ્ચિત વિચારથી બચી જાય છે. પ્રકૃતિસૌમ્યનો સ્વભાવ ચંદ્રની માફક એવો ઠંકભર્યો રહે છે કે કખાયની ઉગ્રતા કે વિષયની વિહુવલતા જાગવાની વાત નહિ.

**જીવનતપાસ :** અંગર્ષિ વિચારે છે, ‘અહો ! મેં ક્યાં ભૂલ કરી ? મારાથી ક્યાં અપરાધ થઈ ગયો ? જરૂર હું અપરાધી છું. તે વિના કાંઈ ચંદ્ર જેવા ગુરુજીમાંથી અંગરાવૃષ્ટિ થાય નહિ.’ અંગર્ષિનું મન ઘણું ફેંદે છે; આજનો દિવસ, ગઈ કાલનો, ગયું સપ્તાહ, ગયો માસ-વર્ષ, યાવતું પસાર થયેલું આખું સ્વજીવન તપાસે છે પણ એક દોષ દેખાતો નથી. કહો જોઉં, જીવન કેવું જીવો હશે ? પ્રકૃતિએ સદા સૌમ્ય માણસ પ્રાય: કોઈ દોષ નહિ સેવે. કેમકે સૌમ્યતામાં હૈયું કોમળ રહે છે, નિષ્ઠર નથી બનતું. ત્યારે નિષ્ઠર હૈયાથી સહેજે પાપ થઈ જાય છે. તેથી કદી હૈયાને નઠીર ન બનવા દો. તો પાપથી બચાયો.

**કેવળજ્ઞાન :** વ્યવહારથી નિશ્ચયમાં : અંગર્ષિને આ જીવનનો અપરાધ ન જગ્યો. પણ રટણા ચાલુ છે. તેથી ત્યાં જાતિસ્મરણ જ્ઞાનથી પોતાનો પૂર્વ ભવ હુંબંધ યાદ આવ્યો. એમાં તત્ત્વની ખબર પડી; મોક્ષમાર્ગની જયોતિ જાગી; એ વૈરાગ્યભાવનામાં ચઢ્યા; “અહો ! એક ધૂપેલા પાપે, જો આવું જીવનભરનું કરેલું સારું બધું જ જાણે ધૂળધારી થઈ જાય એવું ફળ આપ્યું, તો કોણ જાણે મારા આત્મામાં ધૂપાયેલા બીજા તો કેટલાય ભયંકર પાપો હશે ? કેવો હું ?...” એવી કોઈક આત્મનિદામાં અને સંસારથી અલિપત્તાના રંગમાં ચઢ્યા, ક્ષપકશ્રેણી માંડી, કેવળજ્ઞાન ત્યાં જ ઉપાર્જ્યુ !! ગવેષણા, વૈરાગ્યભાવના, આત્મનિદાના સંકલ્પો આ બધા માનસિક વ્યવહારમાર્ગ મહાનિશ્ચયમાર્ગ જગાડ્યો ને સર્વજ્ઞ બનાવ્યા. તો વ્યવહારમાર્ગ કેટલો બધો ઉપયોગી ?

નિમિત પણ કેવું બળવાન ! ગુરુના ગુસ્સાએ અંગર્ષિને તો સ્વાત્મનિરીક્ષણ કરવાની એવી તક આપી કે એ એમાં લોકાલોકનું અને અનંતકાળનું નિરીક્ષણ કરનાર બન્યા. ત્યાં દેવતાએ મહિમા કર્યો; અને નગરમાં જાહેરાત કરી કે ‘આ દુર્કે દોશીને મારી એનાં લાકડાં પડાવી લઈને ખોટો આરોપ અંગર્ષિ મહાત્મા પર મૂક્યો છે.’ ગુરુ આકાશવાણી સાંભળી પસ્તાયા ! આ નિમિત અને દેવતાના ઉત્સવનો વ્યવહાર, વાણીનો વ્યવહાર, એના પર ગુરુનો ક્ષમાયાચનાદિ વ્યવહાર, જુઓ કે, શું કામ કરે છે. કેવળજ્ઞાની મહર્ષિ અંગર્ષિ પાસે ઉપાધ્યાય આવીને ક્ષમા માગે છે; ને દેશના સાંભળી પ્રતિબોધ પામે છે. રૂદ્રક પણ ત્યાં આવી પશ્ચાત્તાપ કરે છે; ને બૂજે છે. સારા અંગર્ષિના નિમિતકારણો બધું સારું બને છે. સારા વ્યવહારથી કાર્ય જલદી સીંજે છે.

•\*• •\*• •\*•